

त्रिभाषा श्लेशडालल-11

त्रिभाषा कलशलडलल-11

गुजराती-डुडल-अंग्रेल त्रिभाषा श्लेश

[डुड - 1]

[अ - ड]

गुजराती-हलंदी-अंग्रेगी त्रिभाषा कलश

(खंड 1)

(अ - ड)



केंद्रीय डुडल नलदेशललय

शलकुषल वलडललल

डलनव ससलधन वलकलस डलतुरललय

(डलरत सरकलर)

केंद्रीय हलंदी नलदेशललय

शलकुषल वलडललल

डलनव ससलधन वलकलस डलतुरललय

(डलरत सरकलर)

पी.ई.डी. 670 (त्रिभाषी)

1000-1989 (उपभडारी-2)

प्रथम सस्करण : 1989

मूल्य : ^{Price cut} ₹ 689.00 पए

प्रकाशक: केंद्रीय हिदी निदेशालय
शिक्षा विभाग
मानव ससाधन विकास मत्रालय
(भारत सरकार)
पश्चिमी खण्ड-7
रामकृष्णपुरम्, नई दिल्ली-110066

सर्वश्री वैप एटरप्राइजिज, एच-24, ग्रीन पार्क एक्सटेंशन, नई दिल्ली द्वारा 1989 में मुद्रित ।

प्राक्कथन

देश की एकता और अखडता को सुदृढ करने के लिए यह आवश्यक है कि विभिन्न भाषा-भाषी प्रदेशों की जनता को भावात्मक दृष्टि से परस्पर निकट लाया जाए। इसके अतिरिक्त यह भी जरूरी है कि देश के विभिन्न प्रदेशों की बौद्धिक और सांस्कृतिक आदान-प्रदान की स्वस्थ परंपरा को उत्तरोत्तर बहुआयामी प्रोत्साहन दिया जाए। भाषा एक ऐसा माध्यम है जो विभिन्न भाषा-भाषियों को निकट लाने में एक सुगम सेतु का काम कर सकता है। इसके लिए भाषिक आधार पर आदान-प्रदान को तथा एक दूसरे की भाषा की सीखने-समझने की प्रवृत्ति को बढ़ावा दिया जाना चाहिए। भारतीय संविधान में हिंदी की राजभाषा के रूप में स्वीकृति के बाद यह और भी आवश्यक हो गया है कि उसे संविधान में स्वीकृत सभी भारतीय भाषाओं के अधिकाधिक निकट लाया जाए और उनमें व्याप्त परस्पर समान तत्वों की बारीकी से खोज की जाए।

भारतीय शिक्षा जगत में जब से त्रिभाषा सूत्र लागू हुआ है तब से इस बात की आवश्यकता का अनुभव किया जा रहा है कि ऐसे अनेक कोश तैयार किए जाएं जिनमें हिंदी, प्रादेशिक भाषा और अंग्रेजी तीनों के समानांतर पर्याय दिए जाएं ताकि संविधान की आठवीं सूची में परिगणित किसी भी भाषा को बोलने वाला छात्र या शोधकर्ता भारतीय भाषाओं और अंग्रेजी के समानार्थक शब्द साथ-साथ देख सके। इसी लक्ष्य को सामने रखकर शिक्षा तथा संस्कृति मंत्रालय की शिक्षा समिति और कार्यकारिणी उपसमिति की सिफारिशों को ध्यान में रख कर केंद्रीय हिंदी निदेशालय ने सन् 1969 में त्रिभाषा कोशों के निर्माण की योजना बनाई। कालांतर में केंद्रीय हिंदी निदेशालय ने द्विभाषा कोशों और भारतीय भाषा कोश के निर्माण का काम भी हाथ में लिया। जब से नई राष्ट्रीय शिक्षा नीति की घोषणा हुई है और उसकी समयबद्ध कार्य योजना बनाई गई है तब से इन कोशों के प्रकाशन में गति आई है।

त्रिभाषा कोशमाला के अंतर्गत हिंदी-मूलक और प्रादेशिक भाषा-मूलक 12-12 कोश तैयार किए जा रहे हैं। इन सभी कोशों में तीसरी भाषा समान रूप से अंग्रेजी है। अब तक हिंदी-गुजराती-अंग्रेजी, हिंदी-तमिल-अंग्रेजी, हिंदी-मलयालम-अंग्रेजी, हिंदी-कन्नड-अंग्रेजी, हिंदी-कश्मीरी-अंग्रेजी, हिंदी-बंगला-अंग्रेजी, हिंदी-पंजाबी-अंग्रेजी, हिंदी-मराठी-अंग्रेजी, हिंदी-सिंधी-अंग्रेजी तथा हिंदी-असमिया-अंग्रेजी कोश प्रकाशित हो चुके हैं। अन्य हिंदी-मूलक कोश निर्माण/प्रकाशन की भिन्न-भिन्न अवस्थाओं में हैं।

प्रादेशिक भाषा-मूलक कोशमाला में गुजराती-हिंदी-अंग्रेजी कोश प्रथम पुष्प के रूप में प्रस्तुत है। इस कोश में लगभग 20,000 प्रविष्टियां हैं। कोश के निर्माण में केंद्रीय हिंदी निदेशालय को यूनिवर्सिटी बुक प्रोडक्शन बोर्ड, अहमदाबाद से पूर्ण सहयोग प्राप्त हुआ है।

इस कोश को तीन खंडों में प्रकाशित किया जा रहा है। प्रत्येक पृष्ठ पर छह कॉलम हैं। पहले कॉलम की गुजराती प्रविष्टि मोटे टाइप में दी गई है, दूसरे कॉलम में गुजराती प्रविष्टि का देवनागरी में लिप्यंतरण दिया गया है, तीसरे कॉलम में मुख्य प्रविष्टि की व्याकरणिक कोटि बताई गई है, चौथे कॉलम में वे गुजराती अर्थच्छायाए दी गई हैं, जिनके तदनुसार हिंदी पर्याय

पाचवें कालम में दिए गए हैं , और अंतिम कालम में मुख्य प्रविष्टि के अंग्रेजी पर्याय दिए गए हैं ।

निदेशालय लंबे समय से पारिभाषिक शब्दावली के क्षेत्र में काम करता रहा है किंतु हिंदी और विभिन्न भारतीय भाषाओं में द्विभाषी, त्रिभाषी एवं बहुभाषी कोशों की रचना के क्षेत्र में निदेशालय का यह आरंभिक प्रयास है । इस दृष्टि से हमें अपनी कमियों और सीमाओं का भली प्रकार से ज्ञान है तथा इस कोश में कुछ त्रुटियाँ रह जाने की संभावना का भी हमें पूरी तरह से अहसास है । इस तथ्य को हम स्वीकार करते हैं और इसीलिए इस कोश को प्रथम प्रारूप के रूप में सुविज्ञ प्रयोक्ताओं के सम्मुख इस आशा से प्रस्तुत कर रहे हैं कि वे इसमें पाई गई कमियों की ओर हमारा ध्यान आकृष्ट करेंगे । ध्यान में लाई गई कमियों को अगले संस्करण में दूर करने का प्रयास किया जाएगा ।

इस कोश के निर्माण कार्य में यूनिवर्सिटी बुक प्रोडक्शन बोर्ड, अहमदाबाद ने तथा उससे संबद्ध विद्वानों ने सहयोग दिया है । निदेशालय के अधिकारियों ने भी परिश्रम और निष्ठापूर्वक कार्य किया है । इन सब सहयोगियों की सूची आगे दी जा रही है । मैं इन सभी के प्रति अपना आभार व्यक्त करता हूँ ।

नई दिल्ली

दिनांक नवंबर 23, 1989

(गंगा प्रसाद विमल)

निदेशक

कोश कार्य से संबद्ध विशेषज्ञ
तथा
निदेशालय के अधिकारी

निर्माण

यूनिवर्सिटी बुक प्रोडक्शन बोर्ड, अहमदाबाद

प्रो अबाशकर नागर

प्रो दिगीशभाई मेहता

प्रो एफ सी दयार्ष

श्री नानूभाई बारोत

प्रो योगेंद्र व्यास

पुनरीक्षण

श्री चद्रकात मेहता

निदेशक

डॉ गगा प्रसाद विमल

सपादन

डॉ नरेंद्र व्यास, प्रधान सपादक

श्री एस एल गूमर, सहायक शिक्षा अधिकारी

श्रीमती सुदर्शन अरोडा, अनुसंधान सहायक

प्रकाशन

डॉ एम पी श्रीवास्तव, उपनिदेशक

श्री अनिल कुमार सुकुल, सहायक निदेशक

श्रीमती कुलदीप कौर, अनुसंधान सहायक

सुश्री डॉ गुडी कौल, अनुसंधान सहायक

संक्षेप सूची

व्या. को.	व्याकरणिक कोटि
पु.	पुलिंग
न.	नपुसकलिंग
स्त्री.	स्त्रीलिंग
वि.	विशेषण
सर्व.	सर्वनाम
क्रि. वि.	क्रियाविशेषण
अ. क्रि.	अकर्मक क्रिया
स. क्रि.	सकर्मक क्रिया
अ.	अव्यय

गुजराती-हिंदी-अंग्रेज़ त्रिभाषा कोश

गुजराती-हिंदी-अंग्रेज़ी त्रिभाषा कोश

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અકડાઈ	અકડાઈ	સ્ત્રી	1 અકકડપાણુ, મગરૂરી 2 કાકડપાણુ	અકડ, ઈંઠ, અભિમાન બાકપન	arrogance foppishness
અકડાટ	અકડાટ	પુ	1 અકડાવુ તે 2 અકડાવાની અસર	અકડના અકડને કા અસર	stiffness, arrogance effect of stiffness
અકડાવુ	અકડાવુ	અ ક્રિ	1 સઘાઈ જવુ, [અગનુ] ઝલાઈ જવુ 2 ભપકામા ફરવુ 3 મગરૂરીમા રહેવુ	(અગ કા) જડ હો જાના ફેશન કરકે ઘૂમના ઘમડ કરના	to become stiff (body) to move in a fashionable manner to be arrogant
અકળાવુ	અકળાવુ	સ્ત્રી	1 અમૂઝાવુ, ગભરાવુ 2 કટાળવુ 3 ચિડાવુ, છછેડાવુ	અકુલના અકતાના ચિઢના	to be perplexed, to be uneasy to be tired to be irritated
અકળામણ	અકળામણ	સ્ત્રી	1 અકળાવાની અસર, અમૂઝણ 2 કટાળો કે ચીડ	વ્યાકુલતા, ઘબરાહટ અબ, ચિઢ	perplexity, embarrassment boredom or irritation
અકંટક	અકટક	વિ	કાટો-આડખીલી કે વચ્ચે વિઢન વિનાનુ, નિષ્કટક	નિષ્કટક, અકટક	without thorns or obstacles, unhampered
અકથ્ય	અકથ્ય	વિ	અવર્ણનીય	અવર્ણનીય	indescribable
અકબંધ	અકબધ	વિ	1 જેમનુ તેમ 2 વગર ખોલેલુ 3 વગર તોડેલુ	જ્યો કા ત્યો ન બરતા હુઆ, બિના ખોલા હુઆ બિના તોડા હુઆ	intact unopened unbroken
અકરામ	અકરામ	ન	1 કૃપા, માન 2 બાક્ષિસ	ઈકરામ, માન, કૃપા બરુશીશ	favour respect gift

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અકરાતિયાવેડા	अकरातियावेडा	પુ	અકરાતિયાની માફક વર્તન	भुक्खडपन	gluttony
અકરાતિયુ	अकरातियु	વિ	1 બહુ ખાનારુ, ખાઉધરુ 2 હા પાર, ખૂબ (ખાવુ)	पेटू, भुक्खड अत्यधिक (खाना)	gluttonous voracious gluttony
અકારણ	अकारण	વિ	કારણ વગરનુ, નિષ્પ્રયોજન	अकारण, निष्प्रयोजन	causeless without any reason
		અ	વગર કારણે, બિનજરૂર	बेमतलब, बिना वजह, अकारण	without any cause. for nothing
અકાલ (-ળ)	अकाल	વિ	કવખતનુ	अकाल	untimely, premature
		પુ	1 અયોગ્ય સમય, કવખત 2 દુકાળ 3 કાલાતીત-પરમાત્મા	कुसमय दुर्भिक्ष, अकाल परमात्मा	improper or awkward time famine God who is timeless
અકીક	अकीक	પુ	એક જાતનો લીસો, ચળકતો પથ્થર	अकीक	agate
અકુઠ (નઠિત)	अकुठ (-ठित)	વિ	1 પાછુ ન પડે તેવુ, કાર્યસાધક, અપ્રતિહત 2 તીક્ષ્ણ, કુઠિત-બૂઠુ નહિ એવુ	कार्यक्षम, अकुठित जो भोधरा न हो, अकुठ, पेना	formidable efficient sharp not blunt
અકૃપણ	अकृपण	વિ	કૃપણ નહિ એવુ, ઉદાર	अकृपण	generous
અકર્મક	अकर्मक	વિ	કર્મ વિનાનુ (કિં)	अकर्मक	intransitive
અકર્મણ્ય	अकर्मण्य	વિ	1 કામ કરવાને નાલાયક, 2 ન કરવા યોગ્ય	अकर्मण्य न करने योग्य	unworthy of job not fit to be done

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		ન	કર્મ ન કરવું તે, અનુદ્યોગ	કર્મ ન કરના	inactivity, inaction
અકર્મકામી	અક(-કક)ર્મી	વિ	1 અભાગિયુ 2 કર્મ નહિ કરનારુ 3 દુરાચારી	અભાગા અકર્મણ્ય દુરાચારી	unfortunate inactive wicked
અકલમંદ	અકલમદ	વિ	બુદ્ધિશાળી	અકલમદ, બુદ્ધિમાન	intelligent
અકલ-ળા	અકલ (-ઝ)	વિ	ન કળી શકાય એવું	અકલ, જો મોંપા યા સમજા ન જાણ	unfathomable, inscrutable
અકસીર	અકસીર	વિ	આબાદ, રામબાણ	અકસીર, રામબાણ	unfailing, sure to produce result
		સ્ત્રી	તેવી દવા, ક્ષીમિયો	અચૂક ઔષધ, કીમિયા	such a medicine, elixir
અકસ્માત	અકસ્માત	પુ	અણધારી ઘટના, હોનારત	આકસ્મિક ઘટના, દુર્ઘટના	accident, mishap
અકર ચકર	અકકર ચકકર	અ	1 અણધારી રીતે 2 આમતેમ થઈને 3 ગમે તેમ કરીને	અકસ્માત જેસે તેસે કરકે યેન કેન પ્રકારેણ	unexpectedly circuitously by whatever means or somehow
			4 આડુ અવળું સમજાવીને	પટ્ટી પઢાકર	talking one around
અક્કલ	અક્કલ	સ્ત્રી	બુદ્ધિ	અક્લ, બુદ્ધિ, સમજ	intelligence, sense
અક્કા	અક્કા	સ્ત્રી	1 અબોલા	કુટ્ટી	not/no longer being on speaking terms

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2. ભાઈબધી તોડવી તે	लडकों के खेल में साथियों से मैत्री-भंग	to break off friendship
અક્ષ	अक्ष	पु	1. રમવાનેા પાસો	खेलने का पासा, अक्ष	dice
			2. માળાનેા મણકેા	माला का मनका	bead
			3. ધરી (ચકનો કે પૃથ્વીની)	पहिये की या धरती की धुरी	axle, axis
			4. આખ	आँख, अक्ष	eye
			5. જ્ઞાનેન્દ્રિય	ज्ञानेन्द्रिय	organ of sense
			6. (ભૂ) વિષુવવૃત્તથી ઉત્તરદક્ષિણ શ્રેણણ જગાનુ ગોલીય અંતર	भूमध्यरेखा के उत्तर या दक्षिण किसी स्थान का गोलीय अंतर	angular distance of a place either N or S from the equator
અક્ષત	अक्षत	वि	ઇજા પામ્યા વિનાનુ, અખડ	अखडित, समूचा	unhurt, whole
		पु	ધાર્મિક ક્રિયામા અથવા મગળ પ્રસંગે કોઈને વધાવી લેવામા વપરાતા વગર ભાગેલા અગિશુદ્ર અનાજના દાણા -ચોખા, ડાગર, ઘઉં, જવ વગેરે	अखडित चावल, अक्षत	whole grains of rice, wheat, barley etc used in religious rites or to welcome a person on an auspicious occasion
અક્ષમ	अक्षम	वि	1. અશક્ત, અસમર્થ	अशक्त, असमर्थ	weak, unable
			2. અસહિષ્ણુ	असहिष्णु	intolerant
અક્ષય	अक्षय	वि	1. કદી ક્ષીણ ન થાય એવુ, અવિનાશી	क्षयरहित	indestructible
			2. અખૂટ	अविनाशी, अक्षय	impershable
અક્ષરગણિત	अक्षरगणित	न	બીજગણિત	अखूट	inexhaustible
				अक्षरगणित	algebra

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યાકો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અક્ષરદેહ	અક્ષરદેહ	પુ	1 નાશ ન પામે એવું શરીર 2 કીર્તિ 3 સાહિત્યકૃતિ	અવિનાશી શરીર કીર્તિ સાહિત્યિક રચના	body that cannot be destroyed fame literary work
અક્ષરધામ	અક્ષરધામ	ન	બ્રહ્મલોક, મોક્ષ	અક્ષરધામ	abode of Brahma, salvation
અક્ષરમાલા (-મા)	અક્ષરમાલા (- મા)	સ્ત્રી	મૂળાક્ષરો, વર્ણમાળા	અક્ષરમાલા, વર્ણમાલા	alphabet
અક્ષરમેળ	અક્ષરમેઠ	ન	અક્ષરના માપવાળો (છંદ)	અક્ષરવૃત્ત	metre or prosody in which quantity of letters or syllables is the main determinant
અક્ષરશઃ	અક્ષરશ	અ	અક્ષરેઅક્ષર	અક્ષરશ	literally, verbatim
અક્ષુણ્ણ	અક્ષુણ્ણ	વિ	1 ક્ષુણ્ણ -વટાયેલું નહિ તેવું 2 પગરવટ વિનાનું 3 અજિત, હુતેહમદ	અક્ષુણ્ણ, અમ્મન અખડિત અપરાજિત	not untrodden untrodden (of path) invincible triumphant
અક્ષુબ્ધ (-ભિત)	અક્ષુબ્ધ(-ભિત)	વિ	1 ક્ષોભ પામ્યા વિનાનું, સ્વસ્થ 2 નહિ ડહોળાયેલું	ક્ષોભરહિત, અક્ષુબ્ધ શાન્ત	unperplexed, calm not turbid, tranquil
અક્ષૌહિણી	અક્ષૌહિણી	સ્ત્રી	૨૧,૮૭૦ રથ, ૨૧,૮૭૦ હાથી, ૬૫,૬૧૦ ઘોડા	અક્ષૌહિણી	army consisting of 21870

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			तथा १,०८,३५० पायदणनी जनेली सेनानो अेक-समूह		chariots, 21870 elephants, 65610 horses and 109350 infantry
अजडअजड (अजडाअजडी)	अखडबखड अखडाबखडी	वि	भाडाभैयावाण, असमान, ठियुनीथु	ऊबड-खाबड	having ups and downs, uneven
अजडावु	अखडावु	अ क्रि	अड्णावु, टियावु, अशडावु	भटकना, ठोकरे खाना, टकराना	to wander, to come into conflict
अडारु	अकारु	वि	अप्रिय, अणभामारु	अप्रिय, अरुचिकर	disagreeable, unpopular, disliked
अडेक (-डु)	अकेक (-कु)	वि	1 अेक पण अेक 2 अेक अेक 3 प्रत्येक, डरेक	एक के बाद एक एक-एक- प्रत्येक, हरेक	one after another one by one, one each each one, everyone
अडेणु	अकोणु	वि	1 अतडु, भणी न जय तेवु 2 डेणु न माने तेवु	जो मिलनसार न हो जो किसी का कहा न माने	reserved, unsociable difficult or intractable
अडड	अक्कड	वि	1 डड, वणे नीड तेवु 2 टार 3 मगरुणीवाणु	सख्त, कडा सीधा, तना हुआ अकडू	stiff, unbending erect uppish, arrogant
अडडलक (-ग) रे।	अक्कलक (-ग) रे	पु	अेक वनस्पति, औषधि	अकरकरा नामक एक औषध,	a medicinal shrub

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અખત્યારનામુ (૦ પત્ર)	અખત્યારનામુ (૦પત્ર)	ન, પુ	મુખત્યારનામુ, સનદ	અધિકાર-પત્ર, મુખતારનામા	power of attorney, charter
અખબાર	અખબાર	પુ, ન	વર્તમાનપત્ર, છાપુ	અખબાર, સમાચારપત્ર	newspaper
અખબારનવીસ	અખબારનવીસ	પુ	૧ ખબરપત્રી ૨ છાપાનો લખનારો	સવાદદાતા પત્રકાર, અખબારનવીસ	reporter correspondent, journalist
અખરોટ	અખરોટ	ન	એક મેવો, અખરોટ	અખરોટ	walnut
અખડ	અખડ	વિ	આખુ	અખડ, સપૂર્ણ	whole, complete
અખડસૌભાગ્ય	અખડસૌભાગ્ય	ન	સૌભાગ્યની અખડિતતા, સ્ત્રીના મરણ સુધી પતિ જીવતો હોય તેવુ તેનુ સૌભાગ્ય	અખડસૌભાગ્ય	unbroken state of good fortune, good fortune of a woman in having her husband living till her death
અખાજ	અખાજ	વિ ન	ન ખવાય એવુ કે ન ખાવા જેવુ નિષિદ્ધ ખોરાક, માસ	અખાજ નિષિદ્ધ ખુરાક, માસ	inedible, not fit to be eaten prohibited food, flesh
અખાત્રીજ	અખાત્રીજ	સ્ત્રી	અક્ષયતૃતીયા, વૈશાખ સુદ ત્રીજ	અક્ષયતૃતીયા	third day of the bright half of Vaishakha
અખિયાતુ	અખિયાતુ	વિ	૧ જરા પણ ક્ષતિ-ઇજા પામ્યા વિનાનુ, સહી સલામત ૨ તદુરસ્ત	સહીસલામત નીરોગ, સ્વસ્થ	unharmmed, safe healthy
અખિલ	અખિલ	વિ	આખુ, બધુ, સમસ્ત	અખિલ, સારા, સમસ્ત	all, whole

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
अખૂટ	अखूट	वि	ખૂટે નહિ એવું	अखूट	inexhaustible
અખેપાત્ર	अखेपात्र	न	અક્ષયપાત્ર	अक्षयपात्र	inexhaustible vessel, cornucopia
અખેવન	अखेवन	वि स्त्री	આખું જેનું એક પુણ સતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી	पूरा, अखंड वह सौभाग्यवती स्त्री जिसकी एक भी सतान मरी न हो	whole woman with all her children and her husband living
અખૂઝાડ	अग (कग)ड	पु	સાઠમારીનું મેદાન	जानवरों को लडाने का मैदान	arena
અમડબંબ	अगडबब	वि पु	ઘણું જાડું, ફાધવાળું, ગોળમટોળું એક જાતનો અવધૂત	खुब मोटा, तौदिल, सड-मसड साधुओं का एक प्रकार	corpulent, pot-bellied, ample member of a sect of wandering friars in India
અગડબગડ	अगडबगड	वि न	ખરું ખોટું ગમે તેવી ખરીખોટી-અસ્યષ્ટ બોલી	खरा-खोटा अट - सट, बेमायने बात	true and false mixed together meaningless talk
અગણ (નશિકા)	अगण (णित)	वि	અસખ્ય	अगणित	innumerable
અગણોનશ્યોખેર	अगणो(ण्यो)तेर	वि	૬૯	उनहत्तर, 69	sixty-nine, 69
અગણ્ય	अगण्य	वि	ગણી ન શકાય તેવું	अगण्य	that which can not be counted
અગણ્યા (૦ એ) શી(-સી)	अगण्या (-ए) शी (-सी)	वि	૭૯	उन्नासी, 79	seventy-nine, 79
અગત્ય	अगत्य	स्त्री	૧ જરૂર ૨ મહત્વ	जरूरत महत्त्व	necessity importance
અગન	अगन	स्त्री	૧ અગ્નિ ૨ બળતરા, ઝાળ, લાઇ	अग्नि, आग जलन, दाह	fire burning sensation

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અગમ	અગમ	વિ	1 અગમ્ય, ગૂઢ 2 ઈન્દ્રિયાતીત 3 જ્યાં ન જઈ શકાય તેવું	અગમ્ય, ગૂઢ મન, બુદ્ધિ સે પરે, ઈન્દ્રિયાતીત	incomprehensible, esoteric beyond the reach of the senses inaccessible
અગમનિગમ	અગમનિગમ	ન	1 ભૂત અને ભવિષ્ય 2 વેદ અને શાસ્ત્ર	ભૂત ઓર ભવિષ્ય વેદ, આગમ	the past and the future the Vedas and the Shastras
અગમવાણી	અગમવાણી	સ્ત્રી	1 ગૂઢ વાણી 2 ભવિષ્યવાણી 3 વેદવાણી	ગૂઢ વાણી ભવિષ્યવાણી વેદવાણી	mysterious speech prophecy words of the Vedas
અગર	અગર	પુ	મીઠું પકવવાની જમીન કે ક્યારી	આગર	salt-pan (where salt is made by evaporation of brine)
અગર	અગર	અ	1 જો 2 અથવા	અગર, યદિ અથવા	if or
અગરબત્તી	અગરબત્તી	સ્ત્રી	ધૂપસળી	ધૂપબત્તી	incense-stick
અગવડ	અગવડ	સ્ત્રી	1 સગવડથી ઊલટું તે 2 મુશ્કેલી 3 અડચણ	અડચન, અસુવિધા બાધા કઠિનાઈ	inconvenience difficulty bar or obstruction
અગાઉ	અગાઉ	અ	પૂર્વે, પહેલા	આગે, પહેલે	formerly, before
અગાડી	અગાડી	અ	આગળ	આગે, અગાડી	in front, before

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અગાડીપછાડી	અગાડીપછાડી	અ	આગળપાછળ	આગે-પીછે	behind and in front
		સ્ત્રી	ઘોડાને ગળે અને પગે બાધવાના દોરડા	ઘોડે કે ગલે ઔર પૌવ મેં બૌધને કી રસ્સિયૌ	ropes tied to the neck and legs of a horse
અગાધ	અગાધ	વિ	ગાધ નહીં તેવું, અતિ ઊંડું	અગાધ, ગહરા	fathomless very deep
અગાશી(-સી)	અગાશી (-સી)	સ્ત્રી	ઘરના ઉપલા ભાગમાં કરેલી ખુલ્લી છોબધ જગા, ગચ્છી	છત	terraced roof of a house terrace
અગિયાર	અગિયાર	વિ	૧૧	ગ્યારહ, 11	eleven, 11
અગિયારી	અગિયારી	સ્ત્રી	પારસી લોકોનું મંદિર, આતસબહેરામ	પારસિયૌં કા મદિર	fire-temple of the Parsees
અગોચર	અગોચર	વિ	ઈન્દ્રિયાતીત, અગમ્ય	અગોચર, ઈન્દ્રિયાતીત	beyond the reach of the senses inaccessible
અગ્રાહ્ય	અગ્રાહ્ય	વિ	ગ્રહણ ન કરવા યોગ્ય	અગ્રાહ્ય	unacceptable
અગ્રિમ	અગ્રિમ	વિ.	1 મુખ્ય 2 મોટો ભાઈ	મુખ્ય બડા ભાઈ	first foremost elder or eldest brother
અગ્રેસર	અગ્રેસર	વિ, પુ	આગેવાન, નાયક, નેતા	અગ્રેસર	leader
અગ્નિ	અગ્નિ	પુ, સ્ત્રી	1 દેવતા 2 પ્રકાશ અને ઉષ્ણતાનો કે અગ્નિકોણનો અધિષ્ઠાતા દેવ 3. જઠરાગ્નિ	અગ્નિ, આગ અગ્નિદેવ જઠરાગ્નિ, ઔગ્નિ	fire the God of light and warmth or of the south-east quarter fire of the stomach hunger

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અગ્નિકુડ	અગ્નિકુડ	પુ	વેદ	વેદી, અગ્નિકુડ	altar, shallow pit in which sacrificial fire burns
અગ્નિપરીક્ષા	અગ્નિપરીક્ષા	સ્ત્રી	અગ્નિ વડે પરીક્ષા કરવી તે, આકરી કસોટી	અગ્નિપરીક્ષા	ordeal by fire acid test
અગ્નિમાઘ	અગ્નિમાઘ	ન	જઠરાગ્નિની મદતા	મદાગ્નિ	weakness of hunger or digestion, dyspepsia
અગ્નિસસ્કાર	અગ્નિસસ્કાર	પુ	મુડદને બાળવાની ક્રિયા	અગ્નિસસ્કાર	cremation of a dead body
અગ્ર	અગ્ર	વિ	આગળ પડતુ, મુખ્ય, પહેલુ, મોખરેનુ	મુખ્ય, પહલા, અગલા, અગ્રગણ્ય	prominent chief first foremost
		ન	આગળનો કે સૌથી ઉપરનો કે ચક્રિયાતો કે શ્રેષ્ઠ ભાગ, આણી, ટોચ	અગલા ભાગ, નોક, અગ્ર	foremost topmost or best part or point
અગ્ર ગણ્ય	અગ્રગણ્ય	વિ	ગણતરીમા પહેલુ, મુખ્ય	મુખ્ય, અગ્રગણ્ય	first in order chief
અગ્રદૂત	અગ્રદૂત	પુ	આગળથી સમાચાર લઈ જનાર	અગ્રદૂત	forerunner herald
અગ્રલેખ	અગ્રલેખ	પુ	વર્તમાન પત્રનો મુખ્ય લેખ	અગ્રલેખ, લીડિંગ આર્ટિકલ	editorial
અગ્રસ્થાન	અગ્રસ્થાન	ન	આગળ પડતુ—મુખ્ય સ્થાન	અગ્રસ્થાન	prominent place priority

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अधटतु	अघटतु	वि	अणघटतु, अणघणजतु	अशोभनीय, नाजायज, बेजा	improper
अधमूतर	अघमूतर	स्त्री	अधपु-मूतरपु ते	हगना-मूतना	defecation
अधया(र)णी	अघय (-र) णी	न, स्त्री	1 पडेलापडेला गळ रडेपो ते 2 तेनी डिया, सीमत	प्रथम गर्भाधान सीमतोन्नयन सस्कार	the first pregnancy the ceremony performed in the seventh month of the first pregnancy
अधरु	अघरु	वि	मुश्केल	मुश्किल, कठिन	difficult
अधपु	अघपु	अ क्रि	मणत्याग करपो, अडे करपु	हगना, टट्टी करना	to defecate. to get rid of excrement
अघाट	अघाट	वि	1 अपार, अनन्त 2 (दस्तावेजमा) कुल लल साधेनु	अपार (दस्तावेज में) कुल हकों के साथ का	endless infinite (with reference to a legal document) – giving unconditional right of ownership
		पु	1 शिलालेख	शिलालेख	stone on which is inscribed a description of land given as a free gift
			2 छिनापी जमीन, धान-देवस्थानमा अपायेली जमीन	माफी की जमीन जिसे उसका स्वामी बेच न सके	land given as free gift
			3 घाट, ओपारे	घाट	stone-steps leading down to the water of a river

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अधामण	अघामण	स्त्री	(वारवार) अधवु डे अधवानु थाय ते, अतिसार	अतिसार, दस्त लगना	frequent defecation, diarrhoea
अघार	अघार	स्त्री	पणी डे ज़पडानो मण	बीट, चिडियों का मल	faeces of birds and insects
अघोर	अघोर	वि	1 अति भयानक 2 घातकी 3 भान-सान वगरनु 4 धार सभत डे मुश्केल 5 गाढु	अत्यत भयानक घातक होश-हवास बिना का अत्यत कठिन प्रगाढ	terrible, extremely dreadful wicked, cruel unconscious very hard, difficult deep, dense
अघोरी	अघोरी	वि	1 अेडी, ॐधाराशी 2 जुगुप्सा उपजावे- चीतरी चडे तेवु गडु	सुस्त, निद्रालु जो जुगुप्सा उपजाए	lazy, sluggish person, person who is slothful disgusting, exciting aversion or loathing
		पु	1 अेवो गडी अेड जातनो (नागडो) जावो 2 भयकर अेडी डे ॐधाराशी माणस	अघोरी भयकर अहदी मनुष्य	a class of mendicants who go about naked and are particularly disgusting person who has given himself up to extremely slothful habits
अघोष	अघोष	वि	घोष वगरनु, शात	अघोष, बिना शब्द का	calm, quiet, voiceless

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		પુ	પાય ઉચ્ચાર-સ્થાનોના પહેલા બે વર્ગોનો ઉચ્ચાર	અઘોષ (વર્ણસમૂહ)	the first two consonants of each of the five classes
અચક્રમચક્ર	અચક્રમચક્ર	અ	અચાનક, એકદમ, ઓચિતુ	અચાનક, યક્રાયક	suddenly, all of a sudden, unexpected
અચક્રવુ	અચક્રવુ	અ ક્રિ	અચક્રવુ, ખમચાવુ	ઠિઠકના, અટકના, સ્કના	to hesitate, stop
અચક્રમચક્ર	અચક્રમચક્ર	પુ	લહેકો, લટકો (સ્ત્રીઓનો)	(સ્ત્રિયો કી) અદા, લહજા, લટકા	gesture, a term used in certain nursery rhymes
અચપચુ	અચપચુ	વિ	1 (અધ+ખોચુ) ક્રાચુખોચુ, અધકચરુ 2. નહિ પ્રવાહી અને નહિ ઘટ્ટ	કચ્ચા-પક્કા, અધકુટા ન પ્રવાહી ન ગાદા	raw, half-baked semi-liquid
અચબૂચ	અચબૂચ	અ	અચાનક	અચાનક	suddenly unexpectedly
અચરકો	અચરકો	પુ	1 ઉમળકો 2 આચકો	ઉલ્લાસ આઘાત, ધક્કા	impulse of love shock
અચરજ(ન-ત)	અચરજ (-ત)	ન	નવાઈ, આશ્ચર્ય	અચરજ	astonishment, wonder
અચરપચર	અચરપચર	વિ અ	ક્રાચુકોરુ રહી રહીને, વારેવારે, જેમ આબ્યુ તેમ	કચ્ચા-પક્કા રહ-રહકર, બારબાર	of the nature of snacks frequently again and again
અચલ(ન-ગ)	અચલ (--ઠ)	વિ	1 દૃઢ, સ્થિર 2 (ગ) અવિકારી	અચલ, સ્થિર, દૃઢ (ગ) અવિકારી	immovable firm constant unchanging

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या- को-	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		पु	પર્વત	पहाड, अचल	mountain
અચિત્તુ(-ત્યુ)	अचित्तु (-त्यु)	वि	ઓચિત્તુ	अचानक, यकायक	unexpected, sudden
અચિત્ય	अचित्य	वि	ચિતવી ન શકાય કે ચિતવવુ અયોગ્ય એવુ	अचितनीय	inconceivable or that which should not be thought of, unthinkable
અચબો	अचबो	पु	નવાઈ, આશ્ચર્ય, અચરજ	अचभा, आश्चर्य, हैरत	astonishment, wonder
અચાનક	अचानक	अ	એકાએક, ઓચિત્તુ	अचानक, यकायक	suddenly, all of a sudden
અચૂક	अचूक	वि	1 ચૂકે નહિ તેવુ	अचूक	that which will not fail
		अ	2 ચૂક્યા વિના	कौशलपूर्वक	without fail, certainly
અચેતન	अचेतन	वि	1 ચેતન વિનાનુ, જડ 2 બેભાન	चेतना-रहित, जड, अचेतन बेसुध, अचेतन	inanimate, without life unconscious
અચેષ્ટ	अचेष्ट	वि	અચેતન	अचेतन	inanimate, without life
અચ્છેર	अच्छेर	पु	અર્ધો શેર	आधा सेर (कच्चा)	half a seer or pound in weight
અચ્છેરો	अच्छेरो	पु	અર્ધોશેરનુ વજન-કાટલુ	अधसेरा (कच्चा)	half a seer, weight of half a seer
અચ્યુત	अच्युत	वि	પતન કે સ્ખલન વિનાનુ, નિશ્ચલ	अच्युत, अस्खलित	not fallen or moved from its place, firm
		पु	(સ) વિષ્ણુ	विष्णु	Vishnu

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अछ्त	अछत	स्त्री	तगी, ताण	कमी, न्यूनता, तगी	scarcity shortage
अछड-रतु	अछड (-र) तु	वि	1 मात्र सपाटीने अडधने पसार थछ जतु 2. धना बराबर, अशग 3 छलछलातु	सतह को छूकर निकलने वाला किनारे तक, लबालब छलछलाता	touching the surface alone filled to the brim overflowing
अछबडा	अछबडा	पु	अेड रोग जेभा शरीर पर आछी आछी शेल्नीओ नीधणे छे	एक रोग, छोटी माता, चेचक का एक प्रकार	chickenpox
अछदस	अछदस	वि	छदरहित	छदरहित, जो छदोवद्व न हो	free of regular metres
अछूत	अछूत	वि	1 अस्पृश्य 2 अस्पृश्य मनाती धेमनु	अछूत, अस्पृश्य अछूत जाति का, अत्यज	untouchable belonging to the so-called untouchable caste
अछोडो	अछोडो	पु	1 शश 2 गणामा पछेरवानो सोनाशपानो धेरो 3 घडियाणनी साडणी	रास, लगाम, पघा गले में पहनने की एक लडी की सोने चादी की माला घडी की जजीर या साकल	rein for a bullock chain of gold or silver meant to be worn around the neck watch-chain
अज	अज	पु	1 नछि जन्मेत्तु, अनादि 2 अडरो 3 अ्रह्मा 4 अमदेव	अज, जिस का जन्म नहीं है बकरा ब्रह्मा कामदेव	the unborn one God goat Brahma the God of Love

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			5 ચંદ્ર 6. શ્રીમચંદ્રના દાદાનું નામ	चन्द्र श्री रामचन्द्र जी के दादा का नाम	the Moon name of Shri Rama's grandfather on the paternal side, i e of Dasharatha's father
અજગર	अजगर	पु	(બકરુ ગળી જાય તેવો) મોટો સાપ	अजगर	python
અજગરવૃત્તિ	अजगरवृत्ति	સ્ત્રી	દૈવ ઉપર આધાર રાખવાની વૃત્તિ	अजगरवृत्ति	tendency to leave every thing to fate
અજન્મા	अजन्मा	વિ સ્ત્રી	જેને જન્મ નથી એવું (ઈશ્વર) 1 (સ) માયા 2 સીતા 3 લક્ષ્મી	अजन्मा (ईश्वर) माया सीता लक्ष्मी	having no birth (God) illusion (maya) Sita Laxmi
અજબ	अजब	વિ	નવાઈ ઉપજે તેવું, આશ્ચર્યકારક, અદ્ભુત	अजीब	wonderful, strange
અજમાયશ	अजमायश	સ્ત્રી	અજમાવી જોવું તે, પરીક્ષા	आजमाइश, परीक्षा	trial, test
અજમાવવું	अजमाववु	સ ક્રિ	વાપરી જોવું, તપાસી જોવું	आजमाना, उपभोग करके देखना, जाच कर के देखना	to try, to test
અજમો	अजमो	પુ	એક વનસ્પતિ-ઔષધિ	अजवायन	parsley, a herb
અજય	अजय	વિ	1 જયરહિત	जयरहित	devoid of victory

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 ન જિતાય એવું, અજેય	અજેય, અજય	invincible
		પુ	હાર	પરાજય, અજય	defeat
અજ્યા	અજયા	સ્ત્રી	1 માયા 2 ભાગ 3 એક વનસ્પતિ	માયા, અજયા ભોંગ एक वनस्पति	illusion (maya) hemp kind of plant
અજર	અજર	વિ	1 ઘરડું ન થાય તેવું 2 પચી ન શકે તેવું	અજર पाचन न हो सके वैसा	one which does not grow old indigestible
અજ્યાશ	અજવાશ	પુ	ઉજાસ	उजाला, प्रकाश	light
અજ્યાણવું	અજવાઠવું	સ ક્રિ	1 ઘસીને ઊજાણું કરવું, માજણવું 2 અજ્યાણું કરવું 3 નામ ઘાટવું, આખરૂ વધારવી	माजना, रगड़कर उज्ज्वल करना उजाला करना नाम रोशन करना, प्रतिष्ठा बढ़ाना	to cleanse to light a lamp to make a good name, earn reputation
અજ્યાણિયું	અજવાઠ્ઠિયું	ન	1 ચંદ્રની વધતો જતી ઠાણવાણું પખવાડિયું, શુકલપક્ષ 2 અજ્યાણા સારું છાપરામા કે ભીંતમા મૂકેલું જાણિયું કે બાકું	शुक्लपक्ष रोशनदान	bright half of a lunar month sky-light
અજ્યાણી	અજવાઠ્ઠી	વિ	અજ્યાણાવાણી, ચાંદણાવાણી (રાત)	उजालेवाली, चादनीवाली (रात)	moon-lit
અજ્યાણું	અજવાઠું	ન	પ્રકાશ, ઉજાસ	उजाला, रोशनी	light, glow
અજ્યા(-પો)	અજપ (-પો)	ન	જપનો અભાવ, અશાંતિ	अशांति, घबराहट, बेकरारी	absence of ease, restlessness
અજા	અજા	સ્ત્રી	1 માયા, કુદરત 2 બકરી	अजा, माया, प्रकृति बकरी	maya nature she-goat

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અજાગલ(ન-ળ) સ્તન	અજાગલ (ळ) સ્તન	પુ,	1 બકરાને ગળે લટકતો આથળ 2 (લા)નિરર્થક વસ્તુ	અજાગલસ્તન (લા) નિરર્થક વસ્તુ	dewlap useless article
અજા(ન્યા)ચક	અજા (-યા) ચક	વિ	યાચના ન કરનાર, ન માગનાર	અયાચક	not living on charity
અજાણ	અજાણ	વિ	1 વાકેફ કે માહિતગાર નહીં તે 2 જાણનો અભાવ	અજાન જાનકારી કા અભાવ	ignorant, not knowing lack of knowledge
અજાતશત્રુ	અજાતશત્રુ	વિ	જેને કોઈ સાથે દુશ્મનાવટ નથી એવું	અજાતશત્રુ, શત્રુવિહીન	one who does not have any enemy
અજાયબ	અજાયબ	વિ	(સ) યુધિષ્ઠિર અજબ જેવું, આશ્ચર્યકારક	યુધિષ્ઠિર અજીબ, આશ્ચર્યકારક	Yudhishtir wonderful astonishing
અજાયબઘર	અજાયબઘર	ન	સંગ્રહસ્થાન, 'મ્યુઝિયમ'	અજાયબખાના, અજાયબઘર	museum
અજાયબી	અજાયબી	સ્ત્રી	આશ્ચર્ય	આશ્ચર્ય, તાજ્જુબ	astonishment surprise
અજીઠું	અજીઠું	વિ	એઠું	જૂઠા, ઉચ્છિષ્ટ	leavings from a meal
અજીરણ	અજીરણ	ન	અજીર્ણ, અપચો	અજીર્ણ, બદહજમી	indigestion
અજુક્તુ(-ગતુ)	અજુક્તુ (-ગતુ)	વિ	અયોગ્ય, અધિકૃત	અનુચિત, અયુક્ત, નામુનાસિદ	unbecoming unsuitable
અજેય	અજેય	વિ	જીતી ન શકાય તેવું	અજેય, જિસે કોઈ જીત ન સકે	invincible
અજોડ	અજોડ	વિ	જેની જોડ ન હોય તેવું, અદ્વિતીય	બેજોડ, અદ્વિતીય	unmatched matchless

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યાકો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અજ્ઞ	અજ્ઞ	વિ	1 અજ્ઞાણ 2 મૂર્ખ	જ્ઞાન-રહિત, અજ્ઞ મૂર્ખ	ignorant foolish
અજ્ઞાત	અજ્ઞાત	વિ	1 જ્ઞાત નહિ તેવું 2 ગુપ્ત	જાત નહીં એસા, અજ્ઞાત ગુપ્ત	unknown hidden, secret
અજ્ઞાતચર્યા	અજ્ઞાતચર્યા	સ્ત્રી	કોઈ જાણે નહિ એવી રીતે ફરવું તે, ગુપ્તચર્યા	અજ્ઞાતચર્યા, ગુપ્તવાસ	going in disguise, moving about incognito
અજ્ઞાતયૌવના	અજ્ઞાતયૌવના	વિ, સ્ત્રી	હલેતી જુવાન સ્ત્રી, મુગ્ધા	અજ્ઞાતયૌવના	young woman, virgin
અજ્ઞાતવાસ	અજ્ઞાતવાસ	પુ	છૂપા રહેવું તે, ગુપ્તવાસ	ગુપ્તવાસ, અજ્ઞાતવાસ	living hidngly or incognito
અજ્ઞાન	અજ્ઞાન	ન, પુ	1 જ્ઞાનનો અભાવ, અબુધપાણ 2 અવિદ્યા, માયા 3 જેને સ્માન-સમજ નથી તેવું 4 અજ્ઞાણ 5 અભણ	અજ્ઞાન અવિદ્યા, માયા બુદ્ધિહીન, નાસમમ્મ અનજાન અનપઢ	ignorance foolishness ignorance represented as the work of Maya, 'Avidya' ignorant ignorant, not knowing uneducated
અજ્ઞાની	અજ્ઞાની	વિ	1 જુઓ 'અજ્ઞાન' 2 અવિદ્યા-માયામા બધાયેલું	દેખિય 'અજ્ઞાન' અવિદ્યા-માયા મેં લિપટા હુઆ	see 'અજ્ઞાન' bound by igno- rance i e Maya
અજ્ઞેય	અજ્ઞેય	વિ	જાણી ન શકાય તેવું	અજ્ઞેય	unknowable
અટક	અટક	સ્ત્રી	1 નડતર, અવરોધ 2 મુશ્કેલી	રુકાવટ, બાધા મુશ્કિલ	stoppage, obstruction difficulty

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 शश, मननो जथशे	शका	doubt mental reservation
			4 शथी डेड	हवालात, हिरासत	custody imprisonment
			5 अटशर, ठेस	टेकन, ठेस	prop, stopper
			6 सडलप, प्रतिज्ञा	सकल्प, प्रतिज्ञा	oath, solemn promise
अटशथाणु	अटकचाळु	वि, न	अडपलु	नटखट, शरारती, शरारत	mischievous, mischief, prank
अटशु	अटकवु	स क्रि	गति डे प्रवृत्ति जध पडवी, शोभवु	अटकना, रुकना, धमना	to halt, to stop
अटशण	अटकळ	स्त्री	डलपना, अनुमान	अनुमान, कल्पना	guess, estimate
अटशायत	अटकायत	स्त्री	1 अटशायतु ते, रुशायत 2 अटशमा शायतु ते 3 नजरकैदमा शायतु	रोक, रुकावट हिरासत में लेना नजरकैद में रखना	obstruction to take into custody to keep under house-arrest keep under surveillance
अटशाय	अटकाव	पु	1 अटशायतु-शेडु ते 2 अतशय, डरुशत 3 अडशाय, रुशेडशन	रुकावट बाधा, प्रतिरोध मासिक धर्म	bar prevention obstruction resistance menses menstruation
अटवावु	अटवावु	अ क्रि	1 रजडवु 2 अटवावु, गुथवावु, पगमा भरवु 3 मूआवु, शयर शवु	भटकना उलझना, पैर में फँस जाना उलझन में पडना, कायर-सा होना	to roam or to wander to be intrigued to be puzzled to be entangled to be perplexed to tire

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 पटावु, पिलावु, घूटाईने ओडरस थपु	पिलना, पिसना, चूर होकर एकरस होना	to be crushed. to be reduced to pulp
अटअ-अ, -धु)	अटक (-की, -कु)	वि	टेअीलु	हठीला	steadfast
अटापटा	अटापटा	पु	1 रगबेरगी लाजा-पछोणा लीटा, अटापटा 2 आडाअवणा पटा (लाडडी के छथियार पीअता थाय ते)	रगबिरगी धारियाँ नील (लकड़ी या हथियार से मारने पर पडनेवाला टाग)	long and broad stripes of varied colours criss-cross of passages out through air as one wields a stick or similar weapon
अटपटु	अटपटु	वि	गूथवणभरेलु	अटपटा, पेचीदा	complicated intricate
अटवामण	अटवामण	स्त्री	1 गूथवावु ते, गूथवण 2 अअडामण, रअडामण 3 मूअवण, गअडामण	उलझन बेकार घूमना, आवारागर्दी घबराहट	puzzle fruitless wandering confusion nervousness
अटवि(-वी)	अटवि (-वी)	स्त्री	जगल, वन	अटवि, जगल, वन	forest
अटण	अटळ	वि	1 टणे नळि तेवु 2 नित्य	अटल नित्य, अटल	unavoidable eternal
अट्टहास्य	अट्टहास्य	न	अडअडाट असपु ते	अट्टहास, जोर से हँसना	excessive or loud laughter
अट्टल	अट्टल	वि	1 प्रवीण, अठग 2 अटण	प्रवीण, चालाक, उस्ताद अटल, स्थिर	expert eternal

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			३ अदल, वाज्जी, ખરુ (तोला)	सही, वाजिब, योग्य, पूरा (तौल)	correct, proper, correct (weight)
अटाभाण	अटामण	न	शेटली वाणवा माटे जोधतो शेरु लोट	पलेधन (रोटी बेलने के लिए लोई पर लगाया जानेवाला सूखा आटा)	flour used in preparing chappatis
अटारी(-ली, -णी)	अटारी (-ली, -ळी)	स्त्री	ઝરુખો, છજી	अट्टालिका, अटारी, कोठा, छज्जा, झरोखा	balcony window
अटेरण	अटेरण	न	सूतर वगेरे उतारवानु साधन, क्षणधो	अटेरन (सूत लपेटने का साधन)	spool for winding cotton yarn
अटूलु	अटूलु	वि	अकेलवायु, साथरहित	अकेला, एकाकी	friendless lonely
अठवाडियु	अठवाडियु	न	सातवारनो समय	सप्ताह, सात दिन का समय	week
अठग	अठग	वि	पाहु, उस्ताद, पछोथेल	उस्ताद, चालाक	expert cunning
अठि(-ठी)गण	अठि(-ठी)गण	न	टेधो, तडियो	सहारा, तकिया	pillow, support
अठई	अठई	स्त्री	आठ दिवस सुधी चालती धार्मिक प्रवृत्ति, आठ उपवास (जैन)	आठ दिन तक चलनेवाली धार्मिक प्रवृत्ति, आठ उपवास (जैन)	a religious observance of fasting for eight days among the Jains
अठईण (१९)	अठईण (-णु)	वि	९८	अठानवे, 98	ninety-eight 98
अठईवन	अठईवन	वि	५८	अठईवन, 58	fifty-eight 58
अठई (-ठ्या) वीश (-स)	अठई (-ठ्या) वीश (-स)	वि	२८	अठईस, 28	twenty-eight 28
अठै	अठै	पु	१ आठनी सख्यानो पासो	आठ की सख्या का पासो	eight on a dice

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 आठ धारानु गण्डानु पत्तु 3 बाणने दरेडे छेडे त्रण जाना छीय छे ते	आठ चिहनों वाला गजीफे का पत्ता बाजी के चारों ओर के त्रिकोन होते हैं	eight in a suit of cards the three squares at each of the four ends of a game or a dice
अष्टौ(-ठयो)मेर	अठो (--ठ्यो) तेर	वि	७८	अठहत्तर, 78	seventy-eight. 78
अष्ट्याशी(-सी)	अठ्ठयाशी (-सी) वि	८८		अठासी, 88	eighty-eight. 88
अऽऽ	अडक	स्त्री	नाम जोडे मूडवाभा आवतु, गोत्र, धंधो डे पतन छत्यादि अतावतु उपनाम	नाम के साथ जोड़ा जानेवाला, गोत्र, वश, व्यवसाय, स्थान आदि सूचक उपनाम, जातिनाम	surname
अऽऽपुं	अडकवु	सक्रि अक्रि	अऽपु, स्पर्श करवो पथ्ये आऽु आवपु	छूना, स्पर्श करना अडना, बीच में अटकना	to touch to come in the way. hinder or to obstruct
अऽऽवपु	अडकाववु	सक्रि	बंध करवु, वासपु	बंद करना	to shut. close (door or window)
अऽऽरे एऽऽरे	अडको दडको	पु	नाना छोडशनी ओड शमत	बच्चों का एक खेल	a game played by children
अऽऽपेपऽऽपे	अडखेपडखे	अ-	आगुआगु	इर्दगिर्द, आसपास	side by side
अऽऽ	अडग	वि	दृढ, ऽगै नहि तेवु	अडिग, दृढ	firm. resolute
अऽऽय	अडचण	स्त्री	1 उरुअत, ऽअत, वाधो 2 मुशुअली, आपध, भाऽ	अडचन, दखल आपत्ति मुश्किल, आपदा	inconvenience. interference. objection difficulty. hardship. obstacle

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૩ અડકાવ કે અટકાવ	સ્ત્રી का रजस्वला होना	menstruation
અડતાળીસ	अडताळीस	વિ	૪૮	अडतालीस, 48	forty eight, 48
અડદ	अडद	પુ	એક અનાજ-કઠોળ	उडद, उरद	a kind of beans
અડદાવો(-ળો)	अडदावो (-ळो)	પુ	૧ છૂંદાયાથી નરમ થઈ જવુ તે, ભેચો, ઘાણ	कुटने से नरम होना	becoming soft by being crushed
			૨ ખૂબ માર પડ્યાથી હાડકા-પાસળા નરમ થઈ જવા તે	कचरकूट	complete prostration after severe beating
			૩ અતિશય કામ કર્તા થી છેક જ થાકી જવુ તે	थककर चूर होना	completely exhausted
અડધિયુ	अडधियु	ન	૧ અડધુ માપ	आधा (तौल)	half of a measure
			૨ અર્ધો નાનો ચૂડો	आधा चूडा	one of the two halves of a whole bangle
			૩ તાબા કે પીતળનો વચલા વળનો નળો, પવાલી	ताबे या पीतल का मध्यम आकार का बरतन	cylindrical vessel of medium size
			૪ થોડા ડબાની અને લાંબે ન જતી લોકલગાડી	छोटी रेलगाडी	shuttle-train
અડધુ	अडधु	વિ	અર્ધ	आधा	half
અડધુપડધુ	अडधुपडधु	વિ	લગભગ અડધુ, થોડાધુ	लगभग आधा, थोडा बहुत	nearly half partly or more or less
અડધોઅડધ	अडधोअडध	વિ	બરાબર અડધુ	आधोआध, ठीक आधा	exactly half

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અડપલુ	અડપલુ	વિ	તોફાની, યાદવુ	શરારતી, નટખટ	mischievous, jocular
		ન	અટક્યાળુ, તોફાન, છેડતી	શરારત, છેડછાડ	mischievous, prank
અડફ(-ફે, -ફો) ટ	અડફ (-ફે, -ફો) ટ	સ્ત્રી	ઝપટ, સપાટો	ચપેટ, ટક્કર	blow, collision, sweep
અડબગ	અડબગ	વિ	1 કહીએ કઈ ને કરે કઈ તેવુ, નાદાન	બેદગા, ટેટે મિજાજવાલા, અડબગા	childish, wayword or capricious
			2 ભય, ફિકર કે વિચાર વિના કામ કરનારુ મૂર્ખ, અવિચારી, બેફિકરુ	ભય, ચિતા અથવા વિચાર કિણ બિના કામ કરને વાલા, મૂર્ખ, અવિચારી, મસ્તમૌલા	reckless, stupid
અડબોત(-થ)	અડબોત (-થ)	વિ	1 અડબગ	અડબગા, ગાવદી	childish or capricious
			2 ઘોલ, આડા હાથની શાપટ	થપ્પડ, ચપટ, ધૌલ	slap, blow
અડવડિયુ	અડવડિયુ	ન	અડબડિયુ, લશકિયુ, ચકરી	ચક્કર, લડખડાહટ	reeling staggering, giddiness
અડવાણ	અડવાણ	સ ક્રિ વિ	અડવુ 1 શણગાર વિનાનુ, શોભારહિત, બેહુકુ 2 ઉઘાડવગુ	છૂના, સ્પર્શ કરના શ્રુગાર રહિત, શોભાહીન નગે પૈર ચલનેવાલા	to touch uncouth unadorn ugly bare-footed
અડવુ	અડવુ	સ ક્રિ	1 અડકવુ, સ્પર્શવુ 2 નડવુ, વચ્ચે આવવુ, રોધવુ	છૂના, સ્પર્શ કરના અડના, અટકના	to touch to interfere to obstruct, to halt, to stop
		અ ક્રિ	3 ખાધ-નુકસાન લાગવુ 1 લગોલગ થવુ, પહોચવુ	ઘાટા યા હાનિ હોના સાથ હોના	to suffer loss to come up with to catch up

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 मऽया रळेवु	लगा रहना, आरंभ होकर गतिशील रहना	to preserve
अऽवो	अडवो	पु	ભવાઈમા આવતો વાણિયાનો વેશ	भवाई में बनिये का स्वाग	conventional name of the Fool, usually a Bania in Bhavai (a farical folk play)
अऽसट्टो	अडसट्टो	पु	અદાજ, શુમાર	अदाजा, अनुमान	rough estimate
अऽसठ	अडसठ	वि	૬૮	अडसठ, 68	sixty-eight 68
अऽगो	अडगो	पु	1 ધામો	अडगा	long and continuous stay, especially unwelcome
			2 કુશ્તીનો એક દાવ	कुश्ती का एक दाव	a trick in wrestling
अऽऽवु	अडाडवु	स क्रि	1 અઽઽવુ 2 પહોંચાડવુ, ભેગુ ઉમેરવુ, ધકેલી દેવુ, ઘુસાડવુ	छुआना, अडाना धकेल देना, घुसेडना	to cause or make one touch to reach, add to, palm off, insert
अऽऽबीड	अडाबीड	वि	1 ભય ઉપજાવે તેવું મોટું 2 ખોડખાપણ વગરનું	भय उत्पन्न करे ऐसा बडा क्षतिरहित	terrific, huge faultless
अऽऽयु	अडायु	न	1 ગાયભેસના છાણનું સૂકું પોચકું, છાણ 2 છોકરાની એક રમત	कडा, गोईठा, उपला बच्चों का एक खेल	dried cake of cowdung a kind of children's game

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अडावपुं	अडावपुं	सक्रि.	1. अप भास्वी 2. ओठपपु, गूठु छेपु 3. धरा भापु 4. घुसाडपु 5. धमअपपु, पडपु	गप्प मारना झूठ बोलना ठोस ठोसकर खाना घुसेडना धमकाना, डौटना	to tell a lie to tell a made-up false story to eat voraciously to interpolate to scold
अडाणी	अडाळी	स्त्री	એક જ ભોતવાળી છૂટી ઓસરી	एक ही दीवार के सहारे बना खुला दालान या बरामदा	shed with wall on one side only
अडियल	अडियल		1. अडी बेसवाना के अडी गचाना स्वभावनु-छठीनु 2. घुसाशियु	अडियल हठीला घुस-पैठ करनेवाला	obstinate, mulish intrusive, officious
अडिओ	अडिगो	पु.	અડી, ધામો	अडडा, डेरा	see 'अडी'
अडूकडूक	अडूकदडूक	अ	ઘડીમા અહીં ને ઘડીમા તહીં	कभी यहाँ कभी वहाँ	now here, now there
अडूकडूकियुं	अडूकदडूकियुं	क्रि.	1. अने पक्षमा छोय तेयुं 2. अस्थिर	दोनो पक्षो में रहनेवाला अस्थिर	as if belonging to two opposite groups unsettled, unsteady
अडोअड	अडोअड	अ	લગભગ, અડાઅડી	सटकर, निकट बिल्कुल	very close, touching one another, side by side
अडी	अडडो	पु.	1. એકઠા મળવાની, બેઠક જેવી, અથવા એકઠા થઈને પડી રહેવાની, અખાડા જેવી જગ્યા	अडडा, नीचे दर्जे के लोगों के मिलने या रहने का स्थान	rendezvous

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 બેઠક 3 અખાડો	बैठक डेरा	meeting-place den of idlers, gamblers and addicts
અઢળક	अढळक	वि	પુષ્કળ	बहुत, ढेर सारा	abundant, inexhaustible
અઢાર	अढार	वि	૧૮	अठारह, 18	eighteen, 18
અઢી	अढी	वि	૨૧	अढाई	two-and-a half, 2 1/2
અઢેલવું	अढेलवु	स क्रि	ટેકો દેવો	सहारा लगाना	to lean against, support oneself against
આગચી	अणची	स्त्री	અથઈ, ખાસ રમત, અગે) વાકુ બોલવું કે નીતિ બહાર વર્તવું તે, જૂઠ	(खेल में) अनुचित व्यवहार, रौंगटी, बेईमानी	foul play, tell a lie in a game
આણછોવાણછો	अणछोवणछो	पु	પાકને નુકસાન કરે તેવો છાયો	ऐसी छाया जो फसल को नुकसान पहुँचाये	shade harmful to crop
આણનમ	अणनम	वि	નમે નહીં તેવું	जो न झुके, अडिग	firm unyielding
આણવટ	अणवट	पु	સ્ત્રીઓના પગના અગૂઠાનું ઘરેણું	स्त्रियों के पैर के अगूठे में पहनने का गहना	an ornament worn by women on toe
આણવર	अणवर	पु	1 પહેલી વાર સાસરે જતા વર અથવા કન્યા સાથે મોકલાતો સોબતી	पहली बार ससुराल जाते समय वर अथवा कन्या के साथ भेजा जाने वाला साथी, विनायक, शहबाला	best-man a friend or relation accompanying bride or bridegroom on her or his first trip to the in-laws'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 वरनी साथेनो अेठ अेठअेठ परे ते	वर का वह साथी जिसका यकायक विवाह हो	a comrade of the bridegroom who offers to marry at the same time unexpectedly
अणसार	अणसार	पुं.	1 मणतामणानो अंश 2 सूक्ष्म असर	समानता या सादृश्य का अण सूक्ष्म असर	a little similarity subtle influence
अण्ठि-अण्ठि	अण्ठि (-ण्ठि)	स्त्री.	1 वस्तुनो अण्ठो अेठ तेचो छेडो 2 टोच, शिखर 3. अण्ठि अे अत	अण्ठो, नोक चोटी, शिखर सिरा, अत	sharp end or a tip of a thing top. peak end or extreme limit
अण्ठ	अण्ठ	वि.	4. अण्ठेअण्ठेनो समय अण्ठ अण्ठे, अण्ठि सूक्ष्म	सकट की स्थिति अण्ठ	critical moment very little. small
		पुं.	1. (समय अे अण्ठे) नानामा नानो अण्ठ	समय या सख्या का छोटें से छोटा हिस्सा	smallest part of time or a quantity
			2. अण्ठेनो विशेष अण्ठ न अण्ठ अण्ठे ते- परमाण्ठ	जिस का और कोई विभाजन नहीं हो सकता, परमाण्ठ	atom
			3 अण्ठ अण्ठेनू धान, अण्ठ	एक प्रकार का अनाज	a kind of grain. 'Kang'
अण्ठे-अण्ठे	अण्ठे (-ण्ठे) जो	पुं.	अण्ठेअण्ठेनो अण्ठेनो दिवस	अण्ठेअण्ठे की अण्ठे का दिन, अण्ठे, अण्ठे	day on which artisans don't work
अण्ठे	अण्ठे	अ	अण्ठे	इसलिए	that is why, hence. therefore

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
અતડુ	अतडु	वि	1 ભળી જાય નહીં એવું (માણસ) 2 તોછડુ, વરવુ	अकड़, अमिलनसार उद्धत, विरूप	reserved, unsociable rude, impolite
અતરાપી(-પુ)	अतरापी (-पु)	वि	ગાહિત, અજાણ્યુ, પરાયુ, બહારનુ	अनजान, पराया, अपरिचित	unknown, stranger, foreigner
અતલ(-ળ)	अतल (-ळ)	वि	1 તળિયા વિનાનુ ઊડુ 2 સાત પાતાળમાનુ એક	अतल सात पातालों में से एक	bottomless, unfathomable, very deep one of the seven nether worlds
અતલસ	अतलस	स्त्री	એક જાતનુ રેશમી કાપડ	एक प्रकार का रेशमी कपडा	a kind of silk cloth
અતર	अतर	वि	1 તાર વિનાનુ (વાદ્ય) 2 નિરકુશ 3 તર વિનાનુ, અવ્યવસ્થિત	बिना तार का (वाद्य यंत्र) निरकुश तर-हीन, अव्यवस्थित	stringless (musical instrument) uncontrolled chaotic, without any system or plan, irregular
અતિઘ્રય	अतिकाय	वि	મહાકાય	महाकाय	huge, colossal
અતિક્રમ	अतिक्रम	पु	1 હા બહાર જવુ તે 2 (કાળનુ) પસાર થઈ જવુ 3 ધસારો	अतिक्रम हल्ला	transgression passage of time rush, attack
અતિજ્ઞાન	अतिज्ञान	न	વધારે પડતુ-નિષ્ફળ જ્ઞાન	जस्त से ज्यादा-निष्फल ज्ञान	excessive but futile knowledge
અતિથિ	अतिथि	पु	1 મહેમાન	अतिथि	guest

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 अभ्यागत, भिक्षु	यात्री, भिक्षुक	pilgrim, beggar
अतिभौतिक	अतिभौतिक	वि	भौतिकशी पर 'मेटाफिजिकल'	भौतिक से परे, मेटाफिजिकल	metaphysical
अतिमनुष्य	अतिमनुष्य	पु	अलौकिक पुरुष, 'सुपरमैन'	अलौकिक पुरुष, 'सुपरमैन'	superman
अतिरथा(-शी)	अतिरथ (-थी)	पु	ज्वर-श्रेष्ठ योद्धा	महारथी, श्रेष्ठ योद्धा	great warrior (fighting from a chariot)
अति(-ती)रेक	अति (-ती) रेक	पु	1 अतिशयता 2 अडियातापरा	अतिशयता श्रेष्ठता	excess, super- abundance superiority, excellence
अतिवृष्टि	अतिवृष्टि	स्त्री	जोएते ते इरता वधारे वरसाए शपो ते	अतिवृष्टि	excessive rain- fall
अतिव्याप्ति	अतिव्याप्ति	स्त्री	लक्ष्य न होय तेवी वस्तुनो समावेश शपो ते	अतिव्याप्ति	wide and irrelevant interpretation of a definition
अतिशय	अतिशय	वि पु	घागुज पुष्कणता	अतिशय बहुलता	excessive super- abundance
अतिशयोक्ति	अतिशयोक्ति	स्त्री	1 अत्युक्ति, वधारेने जोएते ते 2 (डा शा) अे नामनो अलकार	अतिशयोक्ति	exaggeration
अति(-ती)सार	अति (-ती) सार	पु	सघरणी	अतिसार	a literary figure involving exaggeration
अतीत	अतीत	वि	1 पर थयेले, -ने वटावी गयेले	अतीत	dysentery gone beyond, crossed

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
અતીંદ્રિય	अतींद्रिय	वि	2 ગત, વીતેલું અગોચર, ઈન્દ્રિયાતીત	गत, बीता हुआ अतींद्रिय, अगोचर	past, gone by super-sensible, beyond the reach of the senses
અતુલ (-લિત, -લ્ય)	अतुल (-लित, -ल्य)	वि	1 તુલના વગરનું, અનુપમ 2 તોલ વગરનું, ઘણુંજ	तुलनारहित, अनुपम जिसे तौला या मापा न जा सके, अत्यधिक	incomparable, unparalleled immeasurable, abundant
અતૂટ	अतूट	वि	1 અખડ, સળગ 2 તોડ્યું તૂટે નહીં તેવું	अटूट, अखड जो तोडने पर न टूटे	unbroken, whole unbreakable
અતૃપ્ત	अतृप्त	वि	અસતુષ્ટ	अतृप्त	unsatisfied
અત્તર	अत्तर	न	પુષ્પાદિક સુગંધીદાર પદાર્થનો અર્ક	इत्र, सुगंधित पदार्थ का अर्क	fragrant essence of flowers, <i>attar</i>
અત્યલ્પ	अत्यल्प	वि	અતિ અલ્પ, ઘણું નાનું	बहुत थोडा, स्वल्प	excessively small, very little
અત્યત	अत्यत	वि	છેડો-હાડ વટાવી ગયેલું, ઘણુંજ	अत्यत	very much, limitless
અત્યાગ્રહ	अत्याग्रह	पु	અતિ આગ્રહ, હઠ	अत्याग्रह, हठ	excessive insistence obstinacy
અત્યાચાર	अत्याचार	पु	1 અધર્માચરણ 2 બળાત્કાર	अत्याचार बलात्कार	outrage rape
અથડામણ(-ણી)	अथडामण (णी)	स्त्री	1 રખડપટ્ટી, ટિયામણ 2 તકરાર, લડાઈ	आवारागदी मुठभेड, लडाई	wandering clash quarrel

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अथडावु	अथडावु	अ क्रि	1 टिथावु, अडुणावु 2 रजडवु, लटडवु 3 तडरर शवी	टकराना, भिड जाना भटकना, घूमना भगडा करना	to dash against to wander, to roam to quarrel
अथाड (-ग)	अथाक (-ग)	वि	1 अथाड, अगाध, अताग 2 पार विनानु	अथाह, अगाध अपार	tireless boundless, fathomless
अथाणु	अथाणु	न	मीठा डे मसालामा आशी राजेला डुण, मूण छत्यादि	अचार	pickle
अथावु	अथावु	अ क्रि	मीठु डे मसालो परपर थडपो	नमक या मसाले का ठीक तरह से उठना (अचार आदि में)	to ferment
अदत्तादान	अदत्तादान	न	चोरी	चोरी	theft
अदब	अदब	स्त्री	1 विवेक, मर्यादा 2 बन्ने छथने छोरीशी वाणी सामसामी छोरी आगण डाडा टेडवी डरती मुद्रा	अदब दोनों हाथ कुहनी से मोडकर आमने-सामने कुहनी के पास रखने की एक विनयसूचक मुद्रा	civility, decorum, politeness arms crossed on the chest as a mark of respect
अदम्य	अदम्य	वि	दबाय नडि डे दाबी न शत्रय तेवु	अदम्य	irrepressible
अदल	अदल	वि	परपर, यथार्थ, परु	सही, ठीक वैसा ही, यथार्थ	exact, true, correct
अदलबदल	अदलबदल	न	डेरबदल, डेरडेर	रददोबदल, अदल-बदल	exchange transfer

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અદૂરદર્શી	અદૂરદર્શી	વિ	ટૂંકી દૈષ્ટિનુ, લાખો વિચાર નહિ કરનારુ	અદૂરદર્શી	short-sighted
અદૃશ્ય	અદૃશ્ય	વિ, ન	1 દેખાય નહીં એવુ, ગુપ્ત 2 અલોપ	અદૃશ્ય ગાયબ	invisible, secret act of disappearance
અદોદઘ્નુ	અદોદઘ્નુ	વિ	ચરબીથી જાડુ થઈ ગયેલુ, સ્થૂલ	ચરબી સે મોટા હુઆ, સ્થૂલ	corpulent, fat
અદલ	અદલ	અ	બરોબર, સચોટ	સહી, ઠીક	exact, correct
અદ્ભુત	અદ્ભુત	વિ	આશ્ચર્યકારક, અલૌકિક	અદ્ભુત	wonderful extra-ordinary
		ન	ચમત્કાર, આશ્ચર્ય	ચમત્કાર, આશ્ચર્ય	miracle wonder
અદિ	અદિ	પુ	પર્વત	અદિ, પહાડ	mountain
અદ્વિતીય	અદ્વિતીય	વિ	અજોડ, અનન્ય	અદ્વિતીય	matchless unique
અદ્વૈત	અદ્વૈત	ન	1 એકતા 2 જીવાત્મા અને પરમાત્માની એકતા	અદ્વૈત જીવાત્મા ઓર પરમાત્મા કી એકતા	non-duality unity identity identity of the soul with the Brahma
અધખોલુ	અધખોલુ	વિ	અડધુ ઊઘડેલુ	આધાખુલા	ajar
અધણિયાતુ	અધણિયાતુ	વિ	માલિક વિનાનુ	સ્વામીહીન	not belonging to anyone ownerless neglected
અધધ	અધધ	અ	આશ્ચર્ય અને બહુમાણ દર્શાવનાર ઉદ્ગાર	આશ્ચર્ય ઓર અહોભાવ પ્રદર્શિત કરનેવાલા ઉદ્ગાર	an expression of wonder at plentiffulness

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अधपडियाणी	अधपडियाळी	वि	अडधी मींचेली, मस्ती भरेली (आंख)	अधखुले मादक (नेत्र)	half closed, full of mischief (eye)
अधम	अधम	वि	1 नीच, नठारु, उलट 2 धिक्कारवा योग्य	नीच, निकृष्ट, निर्लज्ज निदनीय	mean wicked, low contemptible, hateful
अधर	अधर	वि	नीचेनु	अधर	belonging to the lower part. lower
		पु	नीचलो छोठ, छोठ		lower lip. lip
अध-धर	अध (-धर)	अ	1 उवामा लटके तेम, टेश पिना 2 अनिश्चित	हवा में लटकता, आधार रहित अनिश्चित	suspended in mid-air uncertain
अधरात मधरात	अधरात मधरात	अ	रात्रे जूज मोडे-जमे ते वधते	आधी रात को, बहुत रात बीते-जब चाहे तब जरूरत के वक्त	at any time in the night, at any odd time
अध्यक्ष	अध्यक्ष	पु	1 उपरी, मुख्य अधिशरी 2 (सभानो) प्रमुख	मुख्य अधिकारी, नियामक सभापति	chairman, chief officer president's seat office or chair
अध्यात्म	अध्यात्म	वि	आत्मा-परमात्मा संबंधी	आत्मा-परमात्मा से संबंध रखनेवाला, अध्यात्म	spiritual
		न	ब्रह्मज्ञान आत्मज्ञान	ब्रह्मज्ञान, आत्मज्ञान	knowledge of God or soul
अध्यापन	अध्यापन	न	भाषावपु ते	अध्यापन	teaching
अध्याय	अध्याय	पु	प्रकरण	परिच्छेद, प्रकरण, अध्याय	chapter

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अनघड	अनघड	वि	आगधड, असस्कारी	उजड्ड, असस्कृत, अनगढ	boorish uncultured
अधवच	अधवच	स्त्री अ	मध्य, वच 1 मध्यमा, वचमा 2 पूरु शता पडेला	मध्य, बीच मध्य में, बीच में समाप्ति से पहले	middle in the middle, midway before a thing ends
अधा(-ध)र ताल	अध (-ध) र ताल	वि	लटझु, अनिश्चित	लटकता, अनिश्चित	hanging, indefinite uncertain
अधर्म	अधर्म	पु	1 धर्म नहि ते, पाप, अनीति 2 अन्याय 3 अर्द्धव्य 4 श्रुतिस्मृति विरुद्ध धर्म के वर्तन	अधर्म अन्याय अकर्त्तव्य श्रुति स्मृति विरुद्ध कार्य या व्यवहार	apostacy, unrighteousness injustice that which ought not to be done sacrilege
अधिड	अधिक	वि	वधारानु, वधारे	अधिक	more additional
अधिडमास	अधिकमास	पु	वधारानो मडिनो, पुरुषोत्तम मास	परुषोत्तम-मास	extra month added in the lunar calendar
अधिडार	अधिकार	पु	1 सत्ता, उडूमत 2 पदवी 3 लायकत, पात्रता 4 उड 5 प्रडरुग	सत्ता, हुकूमत पदवी लियाकत, पात्रता हक प्रकरण	authority jurisdiction title rank qualification competence right chapter section

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અધિકુ	અધિકુ	વિ	અધિક, વધારે	અધિક, જ્યાદા	more, additional
અધિકૃત	અધિકૃત	વિ	1 નીમેલુ 2 સત્તાવાળુ ૩ સત્તાવાર	નિયુક્ત સત્તા યા અધિકાર સપન્ન સત્તાયુક્ત	appointed having authority, authorized official, authoritative
અધિવેશન	અધિવેશન	ન	(સભા ઇત્યાદિની) બેઠક	અધિવેશન, વૈઠક	session convention conference
અધિષ્ઠાતા	અધિષ્ઠાતા	પુ	1 મુખ્ય કર્મને સ્થાપ્યા હોય તે દેવ, રાજા, કારભારી વગેરે) 2 નિયામક	અધિષ્ઠાતા નિયામક	presiding deity (God, king etc) director
અધીન	અધીન	વિ	વશ, તાબેદાર	અધીન	dependent, state of being under someone
અધીર	અધીર	વિ	ઉતાવળુ, ચચળ	અધીર	impatient, restless
અધીરુ	અધીરુ	સ્ત્રી	અધીરાઈ	અધીરતા, ઉતાવલ	impatience
અધીરુ	અધીરુ	વિ	ધીરજ ખોઈ બેઠેલુ, અધીર, ઉતાવળુ	અધીર, ધૈર્યરહિત, ઉતાવલા	impatient hasty, anxious
અધૂકડુ	અધૂકડુ	વિ	ઉભે પગે બેઠેલુ કે બરાબર બેઠેલુ નહીં તેવુ	જો ઝકડૂં વૈઠા હો	sitting on one's feet not sitting properly
અધૂરુ	અધૂરુ	વિ	અપૂર્ણ, ખાંડી, ઊણ	અધૂરા, વાકી	incomplete, pending, not full to the brim
અધોગતિ	અધોગતિ	સ્ત્રી	1 અવનતિ, પડતી	અધોગતિ	downfall, decline, degeneration

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 નરકમા પડવુ તે, અવગતિ	નરક મેં જાના, અવગતિ	going to hell
અધોતુ	અધોતુ	ન	વપરાયેલુ કે છર્ણવસ્ત્ર	બરતા હુઆ યા જીર્ણ વસ્ત્ર	rag, old worn out dress
અધોમુખ	અધોમુખ	વિ	નીચા મોવાળુ	અધોમુખ	with face turned down
		ન	નીચુ મો	નીચા મૌહ	crest-fallen
અધોળ	અધોઢ	ન	અઢી રૂપિયાભાર વજન	આધી છટાક (કચ્છી)	weight equivalent to two rupees and- a-half
અધ્યાપક	અધ્યાપક	પુ	શિક્ષક, પ્રોફેસર	અધ્યાપક	teacher, professor
અનર્ગલ(-ળ)	અનર્ગલ (-ઢ)	વિ	1 રુકાવટ કે અકુશ વિનાનુ	અનર્ગલ	unrestrained
			2 અપાર, પુષ્કળ	અપાર, બહુત	boundless
અનર્થ	અનર્થ	વિ	1 ખોટો અર્થ	ગલત અર્થ	wrong meaning
			2 ખોટુ કામ	ખરાબ કામ	misdeed bad deed
			3 જુલમ	જુલમ	oppression, calamity
અનલસ	અનલસ	વિ	આળસ-મદતા વિનાનુ, સ્ફૂર્તિવાળુ	આલસ્ય-રહિત, ફુર્તીલા	industrious smart
અનલહક(-હ)	અનલહક (વક)	શ પ્ર	(હુ હક-ખુદા છુ) 'અહ બ્રહ્મસ્મિ' જેવુ સૂક્ષ્મ મહાવાક્ય	અનલહક	Sufi sentence meaning I am God
અનવઘ	અનવઘ	વિ	અનિદિત, સુદર, ખોડખામી વિનાનુ	અનિઘ, સુદર, નિર્દોષ	irreproachable beautiful without any defect

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અના(ને)નાસ	અન (ને) નાસ	ન	એક ફળ	एक फल, अनन्नास	pine-apple
અનન્ય	અનન્ય	વિ	1 અન્ય-જુદું નહિ તેવું 2 અજોડ 3 એકત્રિણ	अभिन्न, अनन्य वेजोड, अद्वितीय एकनिष्ठ, अनन्य	not different or separate matchless devoted to one only
અનવચ	અનવચ	પુ	1 અવચ-સબધનો અભાવ 2 [ક્રિ.શા.] જેમાં ઉપમેયની અસામાન્યતા દર્શાવવા એની જ ઉપમા અપાયેલી હોય તે અલકાર	अवच-सबध का अभाव, अनवच अनवच (अर्थोत्कार)	irrelevance a figure in which the object of comparison is compared with itself
અનપેક્ષ	અનપેક્ષ	વિ	1 અપેક્ષારહિત લાલસા વિનાનું 2 ક્રિ.શા. યાગ સબધોથી પર 'એક્સોલ્યુટ'	चाह न रखनेवाला, अनपेक्ष असबद्ध, 'एक्सोत्युट'	having no desire absolute
અનભિજ્ઞ	અનભિજ્ઞ	વિ	1 અજ્ઞાણ 2 મૂઠ	अनजान, अनभिज्ञ मूर्ख	not knowing foolish
અનરાધાર	અનરાધાર	વિ	મૂશળધાર	मूसलाधार	torrential
અનહદ	અનહદ	વિ	હદ વિનાનું, અપાર	नि सीम, बेहद	boundless unlimited
અનંત	અનંત	વિ પુ	અપાર 1 વિષ્ણુ, રુદ્ર, બ્રહ્મા 2 શેષનાગ 3 બલરામ	अनत विष्णु, रुद्र, ब्रह्मा शेषनाग बलराम	endless, infinite Vishnu Rudra. Brahma the great serpent Shesh Balram Krishna's brother

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 आकाश 5 जैनोना थौदमा तीर्थकर	आकाश जैनियों के चौदहवें तीर्थकर	the sky fourteenth Tirthankar of the Jainas
अनाचार	अनाचार	पु	दुराचार, अधर्म	अनाचार	bad or improper behaviour, sinful behaviour
अनाज	अनाज	न	धान्य, दारुण	अनाज, अन्न, दाने	grains, corn
अनाडी	अनाडी	वि	1 मूर्ख, गमार 2 उठी, जकडी	मूर्ख, गँवार हठी, जिद्दी	foolish, mannerless obstinate
अनाथ	अनाथ	वि	निराधार	अनाथ	orphan, helpless
अनामत	अनामत	वि	साथवी राखवा सोपेनु	सभाल कर रखने के लिए सौंपी गई (चीज)	kept in deposit, reserved
		स्त्री	अनामत वस्तु, थापण	अमानत, धाती	deposit, thing reserved
अनायास	अनायास	पु	1 आयास डे श्रमनो अभाव 2 आणस 3 सडेलाडशी, सुगमताशी 4 डरार, आराम	आयास या श्रम का अभाव आलस्य, आलसीपन आसानी से, सरलता से चैन, आराम	absence of effort or trouble idleness ease, facility
		वि	मडेनत विनानु, सडेनु	बिना प्रयास, बिना परिश्रम के	peace, quiet easy, not trouble-some
अनार्य	अनार्य	वि	1 आर्य नडी तेपु डे तेने लगतु 2 असभ्य	अनार्य असभ्य	non-Aryan uncivil

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			१ आर्यने अनुचित	जो आर्य के लिए उचित न हो	not becoming of an Aryan
		पु	आर्य नहीं ते—मलेच्छ यवन वगैरे जातिनो माशस	जो आर्य नहीं - मलेच्छ, यवन आदि जाति का मानव	one who is not an Aryan—a man who belongs to classes other than Aryan
अनावृष्टि	अनावृष्टि	स्त्री	१ वरसाए नहीं पडयो ते २ दुक्षण	अनावृष्टि दुष्काल, अकाल	scarcity of rains drought
अनास्था	अनास्था	स्त्री	आस्थानो अभाव, अभ्रक्षा	अश्रद्धा, अनारथा	want of faith
अनाहत	अनाहत	वि	१ नहीं मारेलु २ न पड़ेरेलु, नपु ३ आघात विना अेनी मेणे थतो—अनछे (ध्वनि)	आघातरहित, अनाहत, न मारा हुआ कोरा, नया जो आघात से उत्पन्न न हुआ हो, अनाहत	not beaten, unhurt not used (as cloth) not produced by beating or striking (of sound)
अनावला	अनावला	वि	अनाविल जातिनु	अनाविल जाति का	of the Anavil community
		पु	अनाविल जातिना माशसो	अनाविल जाति के मनुष्य	members of the Anavil community
अनावृत	अनावृत	वि	१ ढाक्या विनानु, उघाडु २ अरक्षित	खुला, अनावृत अरक्षित	uncovered, open unprotected
अनिच्छा	अनिच्छा	स्त्री	१ छ्छानो अभाव २ नापुशी	अनिच्छा नाराजगी	lack of will unwillingness
अनित्य	अनित्य	वि	१ अधुप, नश्चर	अनित्य	inconstant, unsteady transitory

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			2 [गणितभा]विधारी, 'वेरियेबल'	(गणित में) चिकारी	variable (in Mathematics)
अनिद	अनिद्र	वि	निदा विनानु, जागृत	निद्रारहित, जागृत	awake, sleepless vigilant, watchful
अनिभि(भे)ष	अनिमि (-मे) ष	वि पु	पलझार विनानु, रिश्तर जेनी आप उधडे डे भाथाय नही तेपु छदादि देव, माछलु पगेरे)	अनिमिष जिसकी आखें न तो खुलती हैं और न बंद होती हैं (इन्द्रादिदेव, मछली वगैरह)	without winking steady one whose eyes do not wink (God fish etc)
अनियत्रित	अनियत्रित	वि	1 नियत्रित नहीं तेपु 2 निरकुश	अनियत्रित निरकुश	unrestrained uncontrolled absolute
अनिष्ट	अनिष्ट	वि न	1 नहीं छच्छेलु, 2 नहीं छच्छवा जोग, पूरु भूड	अनिष्ट अवाछित, बुरा अहित, अनिष्ट, अमगल	undesired undesirable bad evil inauspiciousness
अनिदित	अनिदित	वि	1 नहीं निदायेलु 2 सुदर, श्रेष्ठ	निद्रारहित, अनिदित सुदर, श्रेष्ठ	not censured beautiful excellent
अनिघ	अनिघ	वि	1 नहीं निदवा योग्य, निदोष 2 सुदर	निदोष, अनिदनीय सुदर, अनिघ	irreproachable faultless beautiful
अनीति	अनीति	स्त्री	1 नीति नहीं ते दुराचरण, पाप	अनीति दुराचरण, पाप	want of morals immoral behaviour, sin

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अनीप्सित	अनीप्सित	वि	अनिच्छित	अनिच्छित, अनीप्सित	undesired
अनुकरण	अनुकरण	न	नकल	अनुकरण	imitation
अनुकपवु	अनुकपवु	अक्रि	अनुकपाशी द्रवपु, ध्या आववी	अनुकपा से द्रवना, दया आना	to feel pity
अनुकपा	अनुकपा	स्त्री	ध्या, सलानुभूति	अनुकपा	compassion, sympathy, pity
अनुकूल(-ण)	अनुकूल (-ळ)	वि	1 पोतानी तरङ्गु, बधभेसतु, क्षवतु 2 छितकर, माङ्क, रुथतु, पथ्य, सगवडवाणु	अनुकूल हितकर, अभिमुख, पथ्य, सुविधाजनक	favourable, convenient advantageous, agreeable
अनुक्त	अनुक्त	वि	1 नळी छडेवायेलु 2 असाधारण, अपूर्व	अकथित, न कहा हुआ असाधारण, अपूर्व	unspoken extra-ordinary, unprecedented
अनुक्रम	अनुक्रम	पु	1 अेक पछी अेक आवपु ते, क्रम 2 पद्धति, रचना 3 अेक अर्थालकार 4 व्यवस्था, नियम 5 आयदे, धारो 6 आचार, रिवाज	एक-एक करके, सिलसिला, उचित क्रम पद्धति, रचना एक अर्थालकार व्यवस्था, नियम कानून रीति-रिवाज	serial order method a figure of speech arrangement rule, regulation custom. convention
अनुक्रमणिका	अनुक्रमणि (-णीका)	स्त्री	साक्षणियु	अनुक्रमणिका	list of contents, index
अनुग	अनुग	वि	पाछण चालनारु	अनुगामी, पीछे चलने वाला	that which follows, following

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		पु	1 अनुचर 2 [व्याकरणमा] 'पूर्वग' शी ॐ-टो-शब्दने पाछण लागतो प्रत्यय	अनुचर (व्याकरण में) शब्द के अंत में लगनेवाला प्रत्यय	follower servant suffix
अनुगत	अनुगत	वि	पाछण गयेलु	अनुगामी, अनुगत	that which has followed
अनुगमन	अनुगमन	न	1 पाछण जवु ते अनुसरण 2 पतिनी पाछण सती शवु ते	अनुगमन सती होना	following, going after self-immolation of a widow on her husband's funeral pyre
अनुगामी	अनुगामी	वि, पु	अनुगमन करनारु, अनुयायी	अनुगामी	following follower successor
अनुगृहीत	अनुग्रहीत	वि	अनुग्रह पाभेलु	अनुगृहीत	obliged, grateful
अनुग्रह	अनुग्रह	पु	1 कृपा 2 उपकार	अनुग्रह, कृपा उपकार	grace obligation favour
अनुचर	अनुचर	पु	पाछण थावनारो, थाकर	अनुचर	one who follows servant
अनुचित	अनुचित	वि	अयोग्य	अनुचित	improper
अनुज	अनुज	वि	पछी जन्मेलु	पीछे जन्मा हुआ, अनुज	born after
		पु	नानो भाई	छोटा भाई	younger brother
अनुनय	अनुनय	पु	1 विनवणी, डावावाला	अनुनय, चिनती	supplication entreaty

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 કલાવી પટાવી મનાવવુ તે	समझा बुझाकर मनाना	coaxing, cajoling
अनुनासिक	अनुनासिक	वि पु न	नाडमाथी उच्चारतु (व्या.) अनुनासिक वर्ण गूगणो उच्चार	नाक से उच्चारित (व्या.) अनुनासिक वर्ण, अनुनासिक गुणगुना उच्चार	nasal nasal letter pronounced through nasal cavity
अनुज्ञा	अनुज्ञा	स्त्री	परवानगी	अनुज्ञा	permission
अनुत्पादक	अनुत्पादक	वि	ઉત્પાદક નહીં તેવુ	अनुत्पादक	unproductive
अनुदात्त	अनुदात्त	वि पु	1 ઉદાત્ત નહીં એવુ 2. नीचा स्वरवाणु स्वरना त्रण भेदोभानो એક ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત)	जो उदात्त न हो, अनुदात्त नीचे स्वरवाला नीचा स्वर, अनुदात्त स्वर	not lofty or high low (of accent) one of the three kinds of vowels or accent
अनुद्यमी	अनुद्यमी	वि	ઉદ્યમી નહીં એવુ	उद्यम न करने वाला	not industrious
अनुद्योग	अनुद्योग	पु	ઉદ્યોગનો અભાવ	उद्योग का अभाव, अनुद्योग	absence of industry
अनुताप	अनुताप	पु	પશ્ચાતાપ, પસ્તાવો	अनुताप	regret
अनुत्तर	अनुत्तर	वि	1 નિરુત્તર, ઉત્તર વિનાનુ, ચૂપ 2. જેનો ઉત્તર નથી કે ન આપીશકાય તેવુ 3 જેનાથી ઉત્તર-ચકિયાતુ નથી એવુ, શ્રેષ્ઠ, ઉત્તમ	निरुत्तर, जिस का उत्तर न हो, चुप जिसका उत्तर न दिया जा सके जिससे कोई श्रेष्ठ न हो ऐसा, सर्वोत्तम, श्रेष्ठ	having no answer, silent unanswerable
अनुद्वेग	अनुद्वेग	पु	ઉદ્વેગનો અભાવ	अनुद्वेग	freedom from anxiety, peace, fearlessness

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યાકો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અનુપમ	અનુપમ	વિ	જેને ઉપમા નથી તેવું, સર્વોત્તમ	અનુપમ	incomparable, excellent
અનુપાન	અનુપાન	ન	ઔષધિની સાથે લેવાતી તેને મદદરૂપ વસ્તુ	અનુપાન	base for medicine
અનુપૂર્તિ(-ત્તિ)	અનુપૂર્તિ (-ત્તિ)	સ્ત્રી	1 ઉમેરે, પૂર્તિ કરવી તે 2 (લા) ઉશ્કેરણી	ઔર બદાના, પૂર્તિ કરના (લા) ઉકસાહટ	to supplement incitement
અનુપ્રાસ	અનુપ્રાસ	પુ	એકનો એક અક્ષર જેમા વારવાર આવે એવો શબ્દાલંકાર	અનુપ્રાસ	alliteration
અનુબધ	અનુબધ	પુ	1 બધન, સબધ 2 ચાલુ અનુક્રમ, સાકળ 3 આગળ પાછળનો સબધ 4 (વેદાતમા) વિષય પ્રયોજન, અધિકારી ને સબધ એ ચારનો સમૂહ	બધન, સબધ સિલસિલા પૂર્વાપર સબધ (વેદાત મેં) વિષય, પ્રયોજન, અધિકારી ઔર સબધ - इन चारों का समूह	relation continuation, sequence context relevance the aggregate of the subject purpose qualification (or authority) and relation (in Vedanta)
અનુભવ	અનુભવ	પુ	1 પ્રત્યક્ષ જ્ઞાન, જાતે પોતે જાણવું તે 2 વીતક, ઉપભોગ	પ્રત્યક્ષ જ્ઞાન, અનુભવ સુખ-દુખ રૂપ મેં ઉપલબ્ધિ	direct knowledge direct experience going through having a taste of
અનુભવી	અનુભવી	વિ	અનુભવવાળું	અનુભવી, તજરબાકાર	experienced

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अनुभूति	अनुभूति	स्त्री	अनुभव	अनुभूति	experience
अनुमान	अनुमान	न	1 अटकण 2 न्यायशास्त्रमाना चार प्रमाणोमानु अेक-अनुभूतिनु साधन	अनुमान न्यायशास्त्र के चार प्रमाणों में से एक-- अनुभूति का साधन	guess one of the four means of acquiring knowledge according to Nyaya philosophy (of poetics) a figure of speech
अनुमित	अनुमित	वि	3. (काव्यशास्त्रमा) अे णतनी अलकार अनुमान उपर रथायेले, अनुमान करेले	(काव्यशास्त्र में) एक अलकार अनुमित, अनुमान किया हुआ	based on inference, inferred
अनुमेय	अनुमेय	वि	अनुमान करवा योग्य के करी शक्य अेपु	अनुमान करने योग्य, अनुमेय	worth inferring or that can be inferred
अनुभोद	अनुभोद	पु	सहानुभूतिशी ओपणतो आनद	सहानुभूतिजन्य आनद	joy born of sympathy
अनुयायी	अनुयायी	वि	1 अनुसरनारु 2 पथनु, मतनु	अनुसरण करने वाला, अनुगामी पथ या मत का	disciple belonging to a sect or a school of thought
अनुचर	अनुचर	पु	अनुसार व्यक्ति, भास	अनुचर, पथ का अनुगामी	member of a sect
अनुरक्त	अनुरक्त	वि	1 रगायेले 2 आसक्त	रगा हुआ प्रेमी, आसक्त	steeped in, coloured attached to
अनुरणन	अनुरणन	न	रसकार	अनुरणन	resonance, ring, echo

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अनुराग	अनुराग	पु	1 प्रेम, आसक्ति 2 रट	प्रेम, आसक्ति, अनुराग	love, attachment passion
अनुवाद	अनुवाद	पु	1 छेलेली वस्तु इरी छेवी ते 2 तरजुमा, भाषातर 3 मान्य सिद्धातने उदाहरण तथा पुष्टि जातर इरी रज्जु इरवो ते	कही गई वस्तु को फिर से कहना तरजुमा, भाषातर मान्य सिद्धात को उदाहरण अथवा पुष्टि के लिए फिर से प्रस्तुत करना	re-telling translation repetition by way of explanation
अनुसरण	अनुसरण	न	अनुसरवु ते	अनुसरण, पीछे चलना	following
अनुसरवु	अनुसरवु	स क्रि	पाछण पाछण जवु, उपदेश प्रमाणे वर्तवु	पीछे-पीछे चलना, उपदे के अनुसार कार्य करना	to go after, follow, act according to teaching
अनुसधान	अनुसधान	न	1 आगणनी वस्तु साथेनु जोडाए डे तेम आपती वस्तु 2 योग्य सबध 3 थोडसाए, पारीड तपास	पहले आई हुई बात या वस्तु के साथ सबद्ध बात या वस्तु योग्य सबध सावधानी, जाच-पडताल	continuation, or connection with what has gone before suitable connection scrutiny, close inspection
अनुस्नातक	अनुस्नातक	वि	स्नातक थया पछीनु, 'पोस्ट-ग्रेज्युअेट'	स्नातकोत्तर	post-graduate
अनुस्यूत	अनुस्यूत	वि	1 नी साथे जोडायेलु 2 गूथायेलु 3 अग तरीडे अदर आपी जतु	अनुस्यूत बुना हुआ समाविष्ट	attached woven, sewn included in
अनूठ	अनूठ	वि	अनोणु, अपूर्व	अनूठा, अपूर्व	unique

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અને(ને)	અને (ને)	અ	બે વાક્યો કે શબ્દોને જોડનારું ઉભયાન્વયી અથવા) ને, તથા	(દો વાક્યો અથવા શબ્દો કો જોડને વાલા ઉભયાન્વયી અવ્યય) ઔર, તથા	(conjunction joining two sentences or words) and
અનેરુ	અનેરુ	વિ	1 બીજુ, જુદુ 2 અનન્ય, અસાધારણ વિચિત્ર	દૂસરા, ભિન્ન અપૂર્વ, અનોખા, અસાધારણ, વિચિત્ર	another, different unique, extra- ordinary, strange
અનોખુ	અનોખુ	વિ	1 નિરાખુ જ, અનેરુ, અસાધારણ, અપૂર્વ 2 નોખુ નહીં તેવુ, ભેગુ, સાંહિયારુ, મઝિયારુ	અનોખા, અસાધારણ જુદા ન હો પેસા, સયુક્ત	unique. uncommon, extra-ordinary common not separate
અન્ન	અન્ન	ન	(શધે(નુ) અનાજ, ખોરાક	પકા અન્ન, ખુરાક, અન્ન	cooked (foodgrain) food
અન્નકૂટ	અન્નકૂટ	પુ.	અણકૂટ, ઠાણેરુ આગળ નૈવધ તરીકે ગોઠવવામા આવતો અનેક વાનગીઓનો ઢગલો	અન્નકૂટ	heap of various kinds of dishes offered to the deity
અન્નક્ષેત્ર	અન્નક્ષેત્ર	ન	સત, સાધુ, વટેમાર્ગુ, ગરીબો વગેરેને જ્યા અન્નદાન આપાતુ હોય તે સ્થળ	અન્નસત્ર	a place where the poor, travellers and sadhus are offered food
અન્ય	અન્ય	વિ	1 બીજુ, 2 ભિન્ન	દૂસરા, અન્ય ભિન્ન	another different
અન્યમનસ્ક [મનુ]	અન્યમનસ્ક (મનુ)	વિ	મન બીજે ઠેકાણે ગયેલુ હોય એવુ, ધ્યાનરહિત	અન્યમનસ્ક, અનમના	pre-occupied inattentive

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અન્યાય	અન્યાય	પુ	ન્યાય વિરુદ્ધ કર્મ, ગેરઈ-સાફ	અન્યાય	injustice, unjust act
અન્વય	અન્વય	પુ	1 સબધ 2 (વ્યાકરણમાં) પદોનો પરસ્પર યોગ્ય સબધ 3 કારણ હોય ત્યાં કાર્યનું હોવું તે નિયમ 4 વંશ 5 ભાવાર્થ	અન્વય (વ્યાકરણ મેં) પદો કા પારસ્પરિક સબધ કાર્યકારણ નિયમ વંશ ભાવાર્થ	relation syntax law of causation race, lineage meaning
અન્વર્થક	અન્વર્થક	વિ	અર્થને અનુસરતું, ચથાર્થ	અન્વર્થ	according to the meaning, true to sense, appropriate
અન્વીક્ષણ	અન્વીક્ષણ	સ્ત્રી	બારીકશી જોવું-તપાસવું તે	સૂક્ષ્મતા સે દેખના, જાચ કરના	observing minutely investigation
અન્વેષક	અન્વેષક	વિ	તપાસનાર	ખોજી, અન્વેષક, શોધકર્તા	investigator
		પુ	હિસાબ તપાસનાર, 'ઓડિટર'	લેખાપરીક્ષક, 'ઓડિટર'	auditor
અન્વેષણ	અન્વેષણ	ન	તપાસ, શોધ, સશોધન	ખોજ, જાંચ- પડતાલ, અન્વેષણ	investigation research
અપકર્ષ	અપકર્ષ	પુ	પડતી	અપકર્ષ	decline downfall, degeneration
અપકાર	અપકાર	પુ	1 હાનિ, અનુપકાર 2 કૃતઘનતા, દોહ	અપકાર કૃતઘનતા, દ્રોહ	harm injury ingratitude faithlessness
અપકવ	અપકવ	વિ	પકવ નહીં તેવું, કાચું	અપકવ	unripe raw

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अपचय	अपचय	पु	क्षय, छानि, घटाओ	अपचय	decay, harm, decrease
अपचो	अपचो	पु	બદહજમી, અણરણ	बदहजमी, अजीर्ण	indigestion, dyspepsia
अपजशा(-स)	अपजश (-स)	पु	अपयश, अपशीर्ति	अपयश	infamy, disgrace
अपटु	अपटु	वि	1 पटु-કુશળ નહિ તેવુ 2 માદુ	अपटु, अकुशल अस्वस्थ, अपटु	unskilful sick
अपमान	अपमान	न	मानशी ઊલટુ તે, અનાદર, તિરસ્કાર	अपमान	insult, contempt
अपरपार	अपरपार	वि	अपार, પુષ્કળ	अपरपार	limitless abundant
अपराध	अपराध	पु	1 દોષ, ગુનો 2 પાપ	अपराध	offence, crime sin
अपरिग्रह	अपरिग्रह	पु	પરિગ્રહ ન રાખવો તે	अपरिग्रह	non-possession of things
अपलख(-अख)ण	अपलख (-ख) ण	न	1 નઠારુ લક્ષણ 2 દુરાચરણ	खराब लक्षण, कुलक्षण दुराचरण	a distinctive bad quality bad conduct
अपवाद	अपवाद	पु	1 સામાન્ય નિયમમા બાધ 2 નિદા, આળ 3 ખડન, ઈનકાર	अपवाद निदा, झूठा आक्षेप खडन, इकार	exception scandal, false charge refutation. denial
अपशब्द	अपशब्द	पु	1 ગાળ, ખરાબ શબ્દ 2 (વ્યાકરણમા) નિયમ વિરુદ્ધનો શબ્દ, ખોટો પ્રયોગ	अपशब्द व्याकरण में) नियमविरुद्ध का शब्द, अपप्रयोग	abuse, vulgar word incorrect word (in grammar)

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
અપશુકન	अपशुकन	પુ	1 માઠો શુક્ર 2 અશુભ ચિહ્ન	अपशकुन अशुभ चिह्न	ill omen inauspicious sign
અપહરણ	अपहरण	ન	ઊપાડી જવું તે, કાઢી જવું તે	अपहरण	abduction, kidnapping
અપગ	अपग	વિ	1 પાગળ 2 કોઈ અગની ખોડવાળું	अपग जिसके किसी अग में कोई दोष हो	lame crippled
અપૂર્ણ	अपूर्ण	વિ	પૂર્ણ નહીં તેવું	अपूर्ण	imperfect, incomplete
અપૂર્વ	अपूर्व	વિ	1 અવનવું, પૂર્વે ન બનેલું તેવું 2 અસામાન્ય	अपूर्व असामान्य	unprecedented uncommon
અપ્તરગી	अप्तरगी	વિ	તરગી, ચથળ	मनमौजी, चचल	capricious, fickle
અપાસરો	अपासरो	પુ	જૈન સાધુઓને રહેવાનું સ્થાન	जैन साधुओं के रहने का स्थान	Jain monastery
અપીલ	अपील	સ્ત્રી	આગ્રહભરી વિનતી, અનુરોધ	साग्रह प्रार्थना, अपील, अनुरोध	appeal
અપૂજ	अपूज	વિ	પૂજા વગરનું, ન પૂજતું	अपूजित	not worshipped
અપૂરતું	अपूरतु	વિ	પૂરતું નહીં એવું, ખૂટતું	जो काफी न हो, न्यून, कम	insufficient inadequate
અપ્રકાશિત	अप्रक (-ग) ट	વિ	1 બહાર નહીં પડેલું, અપ્રસિદ્ધ 2 છાનું, ગુપ્ત	अप्रकाशित जो प्रकट न हो	unpublished secret, undisclosed
અપ્રસ્તુત	अप्रस्तुत	વિ	પ્રસ્તુત નહીં તેવું	अप्रस्तुत	irrelevant
અપ્રાપ્ત	अप्राप्त	વિ	નહીં મળેલું, ન આવેલું	न मिला हुआ, अप्राप्त न आया हुआ	not secured or found not come

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યાકો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અપ્રામાણિક	અપ્રામાણિક	વિ	પ્રામાણિક નહીં તેવું	જો પ્રામાણિક ન હો, અવિશ્વસનીય	unauthentic, dishonest
અક્ષર	અક્ષર	વિ	નિશ્ચિત, ફરે નહીં તેવું	નિશ્ચિત, અટલ	definite, firm
અક્ષરવુ	અક્ષરવુ	અક્રિ	વધુ ખાવાથી અકળાવુ, આક્ષરો ચડવો	અક્ષરના, પેટ ફૂલના	to suffer from restlessness due to over-eating
અક્ષરમાણ	અક્ષરમાણ	સ્ત્રી	વધુ ખાવાથી થતી અકળામાણ	અક્ષર	restlessness (on account of over-eating)
અક્ષરટુ	અક્ષરટુ	વિ	ઉપરટુ	બાજૂ મેં, પહલૂં સે, - કે બલ	on the sides, upright upside down
અક્ષલાતૂન	અક્ષલાતૂન	પુ	(સ) ગ્રીસનો મહાન તત્વજ્ઞાની પ્લેટો	અક્ષલાતૂન	Plato
અક્ષવા	અક્ષવા	સ્ત્રી	ઊડતી ખબર ગામગપાટો	અક્ષવાહ, ગપ્પ	rumour gossip
અક્ષસોસ	અક્ષસોસ	પુ	શોચ, પસ્તાવો, દિલગીરી	અક્ષસોસ, પછતાવા, ખેદ	repentance regret
		અ	અરેરે!	અરર !	alas!
અક્ષળ	અક્ષળ	વિ	1 નિષ્ફળ, નકામું 2 વાઝિયુ	નિષ્ફલ, વ્યર્થ, બેકાર બોઝ	fruitless useless barren
અક્ષળાટ	અક્ષળાટ	પુ	અક્ષળાવુ તે, તેનો અવાજ	ટકરાના, ઇસકી આવાજ	act of striking its sound
અક્ષાટ	અક્ષાટ	વિ, અ	ખૂબ વિશાળ, અસ્ખલિત, અપાર, અનંત વિસ્તારવાળું	બહુત વિશાલ, અસીમ, અસ્ખલિત, અત્યધિક વિસ્તારવાળું	vast, incessant, endless boundless

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અક્ષાળકૂટ	અફાલકૂટ	સ્ત્રી	1 ધમપછાડા 2 માથાકૂટ	उछलकूद माथापच्ची	going from pillar to post great trouble, botheration
અક્ષાળવુ	અફાલવુ	સ ક્રિ	ટીચવુ, પછાડવુ	टकराना, पटकना (चीज)	to strike, dash against
અક્ષીણ	અફીણ	ન	એક ઝેરી-માદક પદાર્થ	अफीम	opium
અખઘડી	અબઘડી	અ	હમણા જ, આ ક્ષણેજ	अभी, इसी क्षण	now, at this very moment
અખા(-ભાખખા)	અબ (-મ) ળખા	સ્ત્રી	1 ઇચ્છા, ઓરિયો 2 દોહદ	अभिलाषा, चाव गर्भिणी की इच्छा, दोहद	longing, desire longing of a pregnant woman
અખાધ	અબાધ	વિ	ખાધિત નહિ એવુ	अबाध, बाधारहित	unobstructed
અખીર(-ત)	અબીર (-ત)	ન	એક સુગંધીદાર ધોળી ભૂકી	अबीर	perfumed white powder
અખૂઝ	અબૂઝ	વિ	1 આણસમજુ 2 મૂર્ખ	नासमभ मूर्ख	ignorant of worldly ways foolish
અખોટ	અબોટ	પુ	1 રસોઈ અને જમવાની જગાને છાણમાટીથી લોપવી તે 2 નાહ્યા પિના જ્યા જવાય કે અડધાય નહિ એવુ સ્થળ	चौका लगाना चौका-खानापकानेया खाने की जगह	daubing of kitchen floor and dining room with cowdung and earth place where one cannot go or which one cannot touch without having taken bath

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अभोल्ला	अबोला	पु	रिसाएने अमुडनी साथे न बोलेवु ते	अबोला	vow not to speak with a person through anger or disagreement
अभडावु	अभडावु	अ क्रि	1 अभडायेला थु, अस्पर्शना स्पर्शशी दूषित थु 2 (स्त्रीं) दूर बेसवु	अस्पृश्य के स्पर्श से दूषित होना स्त्री का रजस्वला होना	be-defiled by the touch of an untouchable be in monthly course (of women)
अभाए	अभण	वि	नहीं भाएले, निरक्षर	अनपढ़, निरक्षर	uneducated, illiterate
अभद्र	अभद्र	वि	1 अशुभ 2 ખરાબ, દુષ્ટ	अभद्र, अशुभ खराब, दुष्ट	inauspicious evil wicked
अभय	अभय	वि पु, न	नीडर 1 भयनो अभाव 2 સરક્ષણ, આશ્રય	निडर, निर्भय निर्भयता, भय का अभाव सरक्षण, आश्रय	fearless absence of fear protection shelter
अभराई	अभराई	स्त्री	છાજલી	सामान रखने के लिए दीवार पर लगायी गयी लकड़ी की लम्बी तख्ती, परछती	shelf
अभागाए(नी)	अभागण (-णी)	स्त्री	હીણભાગી, ડમનસીબ	अभागिन, कमनसीब	unfortunate unlucky
अभाव	अभाव	पु	1 अस्तित्व न होवु ते 2 અણગમો	अभाव भाव (रुचि) न होना	non-existence dislike, distaste

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अભાવા	अभावा	पु	सगर्भाने थता अभलजा, ईलुड	गर्भिणी की अभिलाषाएँ	longings of a pregnant woman
अભિજાત	अभिजात	वि	1 ખાનદાન 2 સુદર, શ્રેષ્ઠ 3 શિષ્ટ	अभिजात, कुलीन सुदर, श्रेष्ठ शिष्ट	born in a noble family beautiful, excellent well-mannered
અભિજ્ઞ	अभिज्ञ	वि	1 અનુભવી 2 માહિતગાર	अनुभवी जाननेवाला, अभिज्ञ	experienced informed knowing
અભિજ્ઞાન	अभिज्ञान	न	1 સ્મૃતિ, ઓળખ 2 ઓળખાણની નિશાની	स्मृति, पहचान पहचान की निशानी	recognition remembrance token of recollection
અભિતાપ	अभिताप	पु	સતાપ	सताप	distress
અભિધા	अभिधा	स्त्री	1 શબ્દનો મૂળ અર્થ 2 એ અર્થની બોધક શબ્દશક્તિ	अभिधा इस अर्थवाली बोधक शब्दशक्ति	original or root- meaning of a word power of a word to carry this meaning
અભિનય	अभिनय	पु	1 મનોભાવદર્શક હલનચલન કે મુદા 2 વેશ ભજવવો તે	अभिनय नट का कार्य	movement or gesture expressive of a mental state acting
અભિનદન	अभिनदन	न	1 ધન્યવાદ 2 અનુમતિ 3 સ્તુતિ	धन्यवाद, बधाई अनुमति स्तुति	congratulation felicitation compliment approval praise

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अभिनिदित	अभिनिदित	वि	अभिनिदन पाभेलु	अभिनिदित	congratulated, approved
अभिनिवेश	अभिनिवेश	पु	1 तन्मयता 2 आसक्ति 3 दृढ विश्वास 4 आग्रह, ठठ	अभिनिवेश आसक्ति दृढ विश्वास आग्रह, हठ	absorption attachment firm resolve obstinacy, insistence
अभिनीत	अभिनीत	वि	1 पासे अशाथेलु 2 भण्वाथेलु	निकट लाया हुआ अभिनय किया हुआ	brought near acted, presented
अभिनेय	अभिनेय	वि	भण्वा योज्य	अभिनेय	stageable
अभिप्राय	अभिप्राय	पु	1 मत 2. हेतु, मतलब 3 अर्थ	अभिप्राय	opinion purpose, intention meaning
अभिप्रेत	अभिप्रेत	वि	1 मनमा धारेलु, छष्ट 2 स्वीकारेलु	अभिप्रेत स्वीकृत	meant, intended, implied accepted
अभिमान	अभिमान	न, पु	अहकार, गर्व	अभिमान	pride, arrogance
अभिमानी	अभिमानी	वि	अभिमानवाणु	अभिमानी	proud
अभिमुख	अभिमुख	वि	1 —ना तरङ्ग मुखवाणु, समुख 2. (ग) सामेनी (जुएणी)	की ओर मुख किये हुए, सम्मुख, अभिमुख (ग) सामने का (कोण)	facing (towards somebody) opposite angle
अभिलाषा	अभिलाषा	स्त्री	छष्टा	अभिलाषा	desire, aspiration
अभिवादन	अभिवादन	न	नमस्कार	प्रणाम, अभिवादन	bowing greeting

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अभिवृद्धि	अभिवृद्धि	स्त्री	1 वधारो 2 उन्नति	अभिवृद्धि अभ्युदय	increase, growth rise, promotion
अभूत	अभूत	वि	नाहिले शक्ये	जो न हुआ हो, अभूत	non-existent
अभेद	अभेद	वि	भेदरहित, अेकરૂપ, अभिन्न	भेदरहित, एकरूप, अभिन्न, अभेद	having no distinction, identical
		पु	अेकરૂપता, अद्वैत	एकरूपता, अभेद	identity, oneness
अभिरुचि	अभिरुचि	स्त्री	रुचि, शोभ, प्रीति	अभिरुचि	liking, fondness, inclination for taste
अभ्यस्त	अभ्यस्त	वि	1 वारेवार करी जेथे 2 मळापरावाणु, टेवाये 3 अभ्यासशी ज्ञाणे के अभ्यास कराये	अभ्यस्त जिस को आदत हो गई हो गहरे अध्ययन से जिस का ज्ञान प्राप्त हो	frequently tried out accustomed habituated learnt through close study
अभ्यतर	अभ्यतर	वि न	अदरनु 1 अदरनो भाग 2 अतर, मन	अभ्यतर अदर का भाग अतर, मन	internal, inner inner part inner being mind
		अ	अदर, मनमा	भीतर, मन में	inwardly
अभ्यागत	अभ्यागत	वि	पासे आवे	अभ्यागत	something (or someone) which has drawn nearer
		पु	1 अतिथि, परोक्षो 2 भिक्षु	अतिथि, मेहमान भिक्षुक	guest mendicant

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યાકો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અભ્યાસ	અભ્યાસ	પુ	1 પુનરાવૃત્તિ 2 ભાણવુ તે 3 મહાવરો, ટેવ, બધાણ	અભ્યાસ પઢના આદત	repetition study practice, exercise
અભ્યુદય	અભ્યુદય	પુ	1 ઉન્નતિ, આબાદી 2 કલ્યાણ, શ્રેય	અભ્યુદય કલ્યાણ, શ્રેય	rise, prosperity good fortune, well-being
અમથુ	અમથુ	વિ	1 વ્યર્થ, નકામુ 2 અહેતુક, વિના કારણ 3 મફતનુ, વિના મહેનત કે મૂલ્યનુ	વ્યર્થ અહેતુક, અકારણ મુફત કા, વિના મેહનત યા વિના મૂલ્ય પ્રાપ્ત હુઆ	useless, wasteful purposeless gratuitous, obtained (or obtainable) without any effort
અમનચમન	અમનચમન	ન	મોજમજા	અમન-ચૈન	merry-making
અમર	અમર	વિ પુ	મરે નહિ એવુ દેવ	અમર દેવતા	immortal god
અમરફળ	અમરફલ	ન	અમરપાણુ આપનારુ ફળ	અમરત્વ દેનેવાલા ફલ	fruit giving immortality
અમરવેલ	અમરવેલ	સ્ત્રી	(વાડ, ઝાડ ઇત્યાદિ પર) જ્યા નાખો ત્યા વગર પાણીએ થતી એકવેલી	અમરબેલ, અકાસબેલ	dodder (cuscuta hyalina)
અમરાઈ	અમરાઈ	સ્ત્રી	આબાવાડિયુ, આબાની ઊર	અમરાઈ	mango-grove
અમલ	અમલ	પુ	1 સત્તા, અધિકાર, હકૂમત 2 કારકિર્દી, વહીવટ 3 કેફ કે કેફી વસ્તુ, અફીણ	સત્તા, અધિકાર, હકૂમત શાસન, વ્યવસ્થા અફીમ	power, authority, rule regime, tenure duration of the effect of an intoxicant

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 समयनो शुमार	समय का अंदाज	approximate time
अमळाट	अमळाट	पु	1 आमणो, वण 2 पेटमा गूथणा वणवा ते, आडडी 3 डरभोडापु ते 4 वाडा वाडा थालवु ते, भिण्ण 5 पडता, वेर	ऐंठन, बट पेट में ऐंठन, मरोड लचक, बल बल खाते हुए चलना, मिजाज वक्रता, टेढ़ापन, बैर	twist gripping pain in the stomach, colic sprain arrogant walk, arrogance crookedness, enmity
अमगल(-ण)	अमगल (-ळ)	वि न	अशुभ दुर्भाग्य	अशुभ, अमगल दुर्भाग्य	inauspicious misfortune
अमात्य	अमात्य	पु	प्रधान, मंत्री	मंत्री, अमात्य	minister, counsellor (to a king)
अमान्य	अमान्य	वि	मान्य नहिं थेवु, नामजूर	नामजूर अस्वीकृत	not accepted, disapproved
अमाप	अमाप	वि	जेड, पार पिनानु	अमाप	boundless
अमी	अमी	न	1 अमृत 2 मीठाश 3 इया 4 थूक 5 रसकस, पाणी	अमृत मीठापन कृपा थूक (जमीन का) रस और कस	nectar sweetness grace, mercy saliva, spit essence, sap
अमीर	अमीर	पु	1 सरदार, उभराव 2 राजर्ता (अफघानिस्ताननो)	सरदार, रईस, अमीर राजा (अफघानिस्तान का)	knight, nobleman King (of Afghanistan)

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૩ ખાનદાન કુટુંબનો કે પૈસાદાર માણસ	ધનવાન યા કુલીન વ્યક્તિ	aristocratic or rich person
અમુકતમુક	અમુક તમુક	વિ	ફલાણ-ફીકણ	અમુક-અમુક, ફલો-ફલો	so and so, such and such
અમુ(મૂ)ઝાવુ	અમુ (-મૂ) ઝાવુ અ ક્રિ		મૂઝાવુ, અઝળાવુ	ઘબડાના, અકુલાના	to be baffled, to be embarrassed
અમૂર્ત(-ર્ત)	અમૂર્ત (-ર્ત)	વિ	૧ આકારરહિત ૨ અસ્પષ્ટ	આકાર-રહિત, અમૂર્ત અસ્પષ્ટ	having no shape indistinct, vague
અર્થધન	અર્થધન	વિ	ખૂબ અર્થવાળુ, અર્થથી ભરપૂર	અર્થપૂર્ણ	weighty with meaning, full of meaning
અર્થ	અર્થ	પુ	૧ હેતુ ૨ માયનો, સમજૂતી ૩ ધન, સપત્તિ ૪ ગરજ, પ્રયોજન ૫ ધર્માદિ ચાર પ્રયોજનમાનુ ખીજુ	અર્થ માયના ધન, સપત્તિ ગરજ, પ્રયોજન ધર્માદિ ચાર પ્રયોજનો મેં સે દૂસરા	purpose import, meaning wealth, money need, use, end to serve aquisition of wealth as one of the four principal ends of life
અર્પણ	અર્પણ	ન	આપવુ તે, ભેટ કરવુ તે, માનપૂર્વક ધરવુ તે	અર્પણ	giving, dedication, presentation, offering
અમૂ(મો)લખ	અમૂ (-મો)લખ	વિ	જેની કિંમત આકી ન શકાય તેવુ, ઘણુજ કીમતી	અમૂલ્ય, અનમોલ	priceless
અમે(મો)	અમે (-મો)	અ	'હુ' નુ બહુવચન	હમ	we, plural of 'I'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યાકો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અમોઘ	અમોઘ	વિ	અચૂક, સમબાણ, અફળ ન જાય તેવું	અમોઘ	unfailing
અરજ	અરજ	સ્ત્રી	1 અર્જ, કોઈ પણ કામ સારું નમ્રતાથી ઉઠાડત કહી કરેલી વિનતિ 2 ફરિયાદ	અર્જ, નિવેદન, પ્રાર્થના ફરિયાદ	petition, application complaint
અરમાન	અરમાન	પુ	1 અભિલાષા, ઉમેદ 2 તીવ્ર ઈચ્છા, આતુરતા	અભિલાષા, ઉમ્મીદ લાલસા, અરમાન, આતુરતા	desire, ambition longing
અરમાર	અરમાર	સ્ત્રી	દરિયાઈ ક્ષત્રો	જહાજી બેડા	naval armada, fleet
અરર	અરર	અ	ચિતા, દુઃખ, દિલગીરી ખતાવનાર ઉદ્ગાર	ચિતા, દુખ આદિ સૂચક ઉદ્ગાર	alas
અરસપરસ	અરસપરસ	અ	પરસ્પર	પરસ્પર, આપસ મેં	mutually, mutual
અરાજકતા	અરાજકતા	સ્ત્રી	અધાધૂધી	અરાજકતા	anarchy, lawlessness
અરીસો	અરીસો	પુ	આરસો, આયનો, દર્પણ	આઈના, દર્પણ	mirror
અરુપરુ	અરુપરુ	અ	અરુપરુ, આમતેમ, આગળપાછળ	ઇઘર-ઉઘર, આગે-પીછે	here and there
અલપઝલપ	અલપઝલપ	વિ	અસ્પષ્ટ, ઝાંખું	અસ્પષ્ટ, ધુધલા	in passing, dim, faint
અલફાઉ	અલફાઉ	વિ	નકામું, ફાલતું	નિકમ્મા, ફાલતૂ	useless, surplus
અલખત	અલખત	અ	ખચીત, બેશક, જરૂર	અલખત્તા, બેશક	of course
અલબેલુ	અલબેલુ	વિ	1 ફાકડું, ફૂટડું 2 ઈશ્કી	અલબેલા, બોંકા, સુદર છૈલા, ઇશ્કબાજ	debonair charming amorous
અલભ(-મ્ય)	અલભ (-મ્ય)	વિ	અપ્રાપ્ય, ન મળે એવું	અલમ્ય	unobtainable

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યાકો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અલમસ્ત	અલમસ્ત	વિ	1 મસ્તાન 2 મલ જૈવુ પુષ્ટ અને જોશવર	મસ્ત, અલમસ્ત જોરાવર, હટ્ટા-કટ્ટા	engrossed in one's self strong and healthy (like a wrestler)
અલકમલક	અલકમલક	પુ	દેશવિદેશ, ગમે તેવો દૂરનો કે વિહટ દેશપ્રદેશ	દેશ-વિદેશ	home and abroad remote or wonderful land
અલગારી	અલગારી	વિ	1 શોખીન 2 મસ્ત 3 મનસ્વી	શોકીન મસ્ત મનમોજી	man of pleasure happy in himself self-willed
અલા-ગમો	અલ (-ઝ) તો પુ		1 ઉકાળેલી લાખમાથી બનાવેલો લાલ રંગ 2 મેદીનો છૂંદો	લાલ કો પિઘલાકર બનાયા ગયા લાલ રંગ અલકતક, મહાવર	red colour prepared from lac (sealing wax) crushed mehandi
અલમારી	અલમારી	સ્ત્રી	1 કબાટ 2 અનેક ખાનાવાળું ભીંતનું તાકું, સચ 3 છાજલી કે અનેક ખાનાવાળી ઘોડી	અલમારી કઈ દરાજોં વાલા તાક યા આલા અનેક દરાજવાલી લકડી યા લોહે કી રચના	cupboard recess in wall with many drawers stand with many compartments shelf
અલેતુ	અલેતુ	વિ	હલેતુ, આસમજુ, છોકરવાદ	અલ્હડ, નાસમઝ	childish, puerile
અલેલટપ્પુ	અલેલટપ્પુ	વિ	અટકળે ઠોકનાર, ગપાટિયુ	અલલટપ્પુ, અટકલપચ્ચૂ, ગપ્પ યા ગપ્પી	man given to wild gossips or guess

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અલૈ(-લૈ)યા બલૈ(-લૈ)યા	અલૈ (-લૈ) યા ન બલૈ (-લૈ) યા		ઓવરશા	બલાઈ લેના, કિસી કા દુખ-દર્દ અપને ડુપર લેના	benedictory ceremony for removing evil
અલ્પ	અલ્પ	વિ	1 થોડુ 2 ક્ષુલ્લક, નજીવુ	અલ્પ ક્ષુલ્લક, મામૂલી	little, small insignificant, unimportant, trifling
અલ્પજીવી	અલ્પજીવી	વિ	1 થોડો વખત જીવનારુ 2 થોડા વડે જીવનારુ	અલ્પજીવી થોડે મેં નિર્વાહ કરનેવાલા	short-lived living on frugal means
અલ્પવિરામ	અલ્પવિરામ	ન	અર્થગ્રહણની સગવડ ખાતર વાક્યમા થોડુ થોભવુ તે કે તેનુ સ્થાન બતાવનારુ (,) આવુ ચિહ્ન	અલ્પવિરામ	comma, a punctuation mark
અલ્યા (-યો)	અલ્યા (-યો)	અ	એક તુકારાભર્યુ પુરુષવાચક સબોધન	અબે, તુચ્છતા સૂચક સબોધન	vocative- particle used in addressing a male, usually expressive of disregard
અલ્લડ	અલ્લડ	વિ	1 અલેતુ, નાદાન 2 ઉચ્છૃખલ	અલ્હડ, નાસમમ્મ ઉચ્છૃખલ	childish, foolish unrestrained
અલકાર	અલકાર	પુ	1 ઘરેણુ 2 શણગાર 3 શબ્દ કે અર્થની ચમત્કૃતિવાળી રચના	અલકાર, આમૂષણ સજાવટ શબ્દ યા અર્થ કા ચમત્કાર, અલકાર	ornament embellishment figure of speech
અલાયદુ	અલાયદુ	વિ	ઈલાયદુ, ભિન્ન, ગુદુ	અલગ, જુદા, ભિન્ન	separate, segregated, isolated

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અલી	अली	સ્ત્રી અ	સખી એક સ્ત્રીવાચક સબોધન	अली अली (सबोधन में प्रयुक्त)	female friend vocative particle used in addressing a female
અલૂણ	अलूण	વિ ન	1 લૂણ-મીઠા વિનાનુ 2 લૂણ-અન્ન વિનાનુ, ભૂખ્યુ અલૂણ ખાવાનુ વ્રત	अलोना बिना अन्न पाया हुआ, भूखा अलोना रहना (व्रत)	without salt hungry vow to eat food without salt
અલોપ	अलोप	વિ	અદૃશ્ય, હુપ્ત	अलोप, अदृश्य	invisible, vanished
અલૌકિક	अलौकिक	વિ	1 અસામાન્ય, અદ્ભૂત 2 દિવ્ય	असाधारण, अद्भुत, अलौकिक दिव्य	extra-ordinary divine, unearthly
અવગણના	अवगणना	સ્ત્રી	ઉપેક્ષા, અવજ્ઞા	अवगणना	neglect, disobedience
અવગણવું	अवगणवु	સ ક્રિ	લેખામા ન લેવું	अवगणना करना	to disregard
અવગાહન	अवगाहन	ન	1 ડૂબકી મારવા કે લીન થવું તે 2 સ્નાન	डुबकी लगाना, अवगाहन स्नान	dive or be engrossed bathing
અવગુણ	अवगुण	પુ	1 દોષ, દુર્ગુણ 2 ગેરકાર્યદો, નુકસાન 3 અપકાર	दोष, ऐब, अवगुण हानि, नुकसान अपकार	fault, vice disadvantage, loss, harm ungratefulness
અવગુઠન	अवगुठन	ન	1 આચ્છાદન, ઢાકણ 2 બુરખો	आच्छादन, ढक्कन बुर्का	covering, lid veil
અવતાર	अवतार	પુ	1 નીચે ઉતરવું તે	नीचे उतरना	descending, descent

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 उत्पत्ति, जन्म, देहधारण 3 जन्मारे	उत्पत्ति, जन्म, देहधारण जिन्दगी	incarnation, birth whole of one's earthly life
			4 पृथ्वी पर जन्मेला देव के ईश्वर	पृथ्वी पर देवता या ईश्वर का अवतार	descent of God or deity on earth
अवतीर्ण	अवतीर्ण	वि	1 नीचे उतरेलु 2 अवतार पाभेलु 3 उताशरुपे लीधेलु	नीचे उतरा हुआ अवतार के रूप में उत्पन्न अवतरण के रूप में लिया हुआ	lowered incarnate quoted
अवधि	अवधि	स्त्री	1 छे 2 अत, समाप्ति 3 निश्चित समय	अवधि अत, समाप्ति निश्चित समय	limit, boundary end definite period of time
अवनत	अवनत	वि	1 नीथु नभेलु, पडेलु 2 अस्त पाभेलु	भुका हुआ, गिरा हुआ, अवनत अस्त हुआ	bent low, prostrate fallen
अवनवु	अवनवु	वि	1 नवतर 2 नवी नवी जगतनु 3 विचित्र, अद्भुत	नवीनतर अभिनव, नए प्रकार का विचित्र, अद्भुत	new, novel diverse, novelties wonderful, strange
अवमानना	अवमानना	स्त्री	अपमान, अवगणना	अपमान, अवज्ञा, अवगणना	insult, disregard, indifference
अव-व्यक्त	अव (-व्व) ल	वि	1 पडेलु, मुख्य 2 उत्तम	अव्वल उत्तम	first, chief excellent
अवलबन	अवलबन	न	1 अवलब 2 साध, मद्द	अवलब, अवलबन सहारा, मदद	prop, support help

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अवलोकन	अवलोकन	न	निरीक्षण, तपास, परीक्षा	अवलोकन, निरीक्षण, परीक्षा	observation, investigation, examination
अवलोकवु	अवलोकवु	स क्रि	अवलोकन करवु	अवलोकना	to observe, to examine, to review
अवस्था	अवस्था	स्त्री	1 स्थिति, दशा 2 आयुष्यना अमुठ अमुठ मुदतना भाग डे पेटा भाग ते 3 धडपरा	अवस्था आयु की कालकृत अवस्था बुढापा	condition, state one of the stages of life old age
अवहेलना	अवहेलना	स्त्री	अवहेलवु ते, अनादर, अवगणना	अनादर, अवज्ञा, अवहेला, अवहेलना	disregard, disrespect
अवणु	अवळु	वि	1 उधु, उलटु 2 वाडु, आडु, प्रतिधूल 3 ખોટુ	उल्टा, औंधा आडा, टेढा, विपरीत गलत	inverse, reverse non-co-operative, cross wrong
अवाचक	अवाचक	वि	1 मूगु 2 બેભાન	मौन, अवाक, चुप बेसुध, बेहोश	speechless, quiet unconscious
अर्वाचीन	अर्वाचीन	वि	आधुनिक	आधुनिक	modern
अविडण	अविकळ	वि	1 અખડ 2 અવસ્થિત 3 અચુળ કે ગભરાયેલુ નહીં તેવુ	अखड व्यवस्थित जो बेचैन न हो, शान्त, अविकल	whole, entire in order undisturbed, unagitated
अविडार	अविकार	वि पु	विडाररहित, जेभा इरडार न थाय तेवु विडार-इरडारनो अभाव	विकारहित, अविकार विकार का अभाव, अविकार	unchangeable immutability

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अविधारी	अविकारी	वि	1 अविधार 2 (व्या.) जाति के पथनने लीधे रुपभा हेरुधर न शाय अेषु (५६)	विकारहित, अविकार, अविकारी (व्या.) अविकारी (पद)	unchangeable involving word that does not change its form on account of gender or number
अविधृति	अविकृति	स्त्री	1 विधृतिनो अभाव 2 प्रकृति (सांख्यदर्शनभा)	(ग) 'कोन्स्टट', 'इनवेरियेबल' विकार का अभाव, अविकृति प्रकृति (सांख्य दर्शन)	constant, invariable absence of distortion nature (in Sankhya Phil)
अविचल(-ण)	अविचल (-ळ)	वि	1 अणे नलि तेपु, स्थिर 2 नित्य	अविचल नित्य	immoveable, steady eternal
अविचार	अविचार	पु	1 विचार-विवेकनो अभाव 2 अत्रावण	विचार-विवेक का अभाव, अविचार जल्दी	want of discrimination haste
अविच्छन्न	अविच्छिन्न	वि	1 अण्ड 2 सतत	अखड जो लगातार हो, अविच्छिन्न	whole incessant
अविच्छेद	अविच्छेद	वि पु	विच्छेद विनानु विच्छेदनो अभाव	विच्छेदरहित, अविच्छेद विच्छेद का अभाव, अविच्छेद	not separated want of separation
अविद्ध	अविद्ध	वि	वीधाथेपु नलि अेषु	अनविधा, अविद्ध	not pierced or penetrated
अविनाश(-शी)	अविनाश (-शी)	वि	अमर, अक्षर नित्य	नित्य, अविनाशी	immortal bodiless eternal

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अविभक्त	अविभक्त	विं	1. એકરૂપ 2. મળિયારુ, સચુક્ત	एकरूप, अविभक्त अविभाजित, सयुक्त	whole, undivided joint
अविशत	अविरत	वि	નિરતર, સતત	लगातार, निरतर	incessant, continuous
अविशम	अविराम	पु अ	વિશમનો અભાવ વિશમ લીધા વિના સતત	विराम का अभाव अविराम, लगातार, निरतर	uninterrupted succession without interruption, continuous
अविरोध	अविरोध	पु	1. વિરોધનો અભાવ 2. મેળ, બનાવ 3. પૂર્વાપર સગતિ	વિરોધ का अभाव, अविरोध મેલ સામજસ્ય	absence of opposition agreement coherence
अविलम्ब	अविलम्ब	क्रि वि पु	મોડુ કર્યા વિનાનુ વિલમ નહિ તે	भटपट, तुरत विलम्ब का न होना	at once, immediately absence of delay
अवच्छेद	अवच्छेद	पु	1. ભાગ 2. મર્યાદા 3. છેદન, જુદુ પાડવુ તે 4. વિશેષતા 5. અવધારણ	अवच्छेद सीमा छेदन, काट कर अलग करना विशेषता अवधारणा	part, section limit separation special feature determination, decision
अपज्ञा	अवज्ञा	स्त्री	અવગણના	अनादर, उपेक्षा	disregard
अपटञ्ज	अवटक	स्त्री	અટક કે અડક 'સરનેમ'	नाम के साथ लगने वाला जाति या पेशा सूचक उपनाम	surname
अपठव	अवढव	न	ઢથુપથુપણ	ढुलमुल, अस्थिर	indecision, hesitation

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		સ્ત્રી	ઓરતો	હસરત, અરમાન, અતૃપ્ત કામના	longing, desire
અવતરણ	અવતરણ	ન	1 નીચે ઉતરવું તે 2 અવતાર, જન્મ 3 ઉતાર, ઉતરતો ઢાળ 4 ઉતારો, ટાચણ	અવતરણ અવતાર, જન્મ ઢલાન, ઉતાર લિખ લેના	descent incarnation, birth slope jottings, notes
અવધાન	અવધાન	ન	1 લક્ષ, ધ્યાન, એકાગ્રતા 2 કાળજી 3 સમાધિ	અવધાન હિફાજત, દેખભાલ, ચિતા સમાધિ	attention, concentration care deep meditation, trance
અવયવ	અવયવ	પુ	1 શરીરનો ભાગ 2 આખી વસ્તુનો વિભાગ, અંશ 3 સાધન, ઉપકરણ 4 (ગણિતમાં) 'ફેક્ટર'	અવયવ પૂરી चीज का एक भाग, અંશ સાધન, ઉપકરણ (ગણિત મેં) 'ફેક્ટર'	part of the body part of a whole tools, instruments (Maths) factor
અવ્યય	અવ્યય	વિ ન	ન બદલાય તેવું, શાશ્વત (વ્યાકરણમાં) જેને જ્ઞાતિ, વચન કે વિભક્તિના પ્રત્યય ન લાગે તેવો શબ્દ	અવ્યય, નિત્ય (વ્યા) અવ્યય શબ્દ	not liable to change (Gr) an indeclinable word
		પુ	શિવ, વિષ્ણુ	શિવ, વિષ્ણુ	Shiva, Vishnu
અશક્તિ	અશક્તિ	સ્ત્રી	1 શક્તિનો અભાવ, નબળાઈ 2 ગળુ-તાકાત ન હોવી તે	નિર્બલતા, અશક્તિ તાકત, ક્ષમતા ન હોના	want of strength, weakness inability
અશક્ય	અશક્ય	વિ	અસંભવિત	અસંભવ, અશક્ય	impossible

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અવર	અવર	વિ	1 બીજું, અન્ય 2 કનિષ્ઠ, ઉતરતુ	અવર કનિષ્ઠ, નિમ્ન કોટિ કા ઇતર, અન્ય	another, the other inferior other
અવરજવર	અવરજવર	પુ	આવજા	આનાજાના	traffic, coming and going
અવરોધ	અવરોધ	પુ	1 અટકાયત, પ્રતિબધ 2 અતપુર, જનાનો	અવરોધ અત પુર, જનાનખાના	detention, prohibition harem
અવરોહ	અવરોહ	પુ	1 ઉતરવુ તે 2 (સંગીતમા) ઊંચા સૂર ઉપરથી નીચા સૂર ઉપર આવવુ તે 3 (ગણિતમા) 'ડિસેન્ડિંગ ઓર્ડર'	અવરોહ (સંગીત મે) અવરોહ (ગણિત મે) 'ડિસેન્ડિંગ ઓર્ડર'	descending, descent (in music) coming down from higher note to a lower one (Maths.) 'descending order'
અવર્ણનીય, અવર્ણ્ય	અવર્ણનીય, અવર્ણ્ય	વિ	વર્ણવી ન શકાય તેવુ	અવર્ણનીય	indescribable
અવશિષ્ટ	અવશિષ્ટ	વિ	વધેલુ, બાકી રહેલુ	અવશિષ્ટ	left over, remaining
અવશ્ય	અવશ્ય	વિ	જરૂરી, આવશ્યક	આવશ્યક	necessary, of course
		અ	જરૂર, ખચીત	અવશ્ય, જરૂર	surely, definitely, certainly
અવસર	અવસર	પુ	1 તક, લાગ	અવસર	opportunity, opportune time or occasion

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 समय, वખત 3 ટાણ, પ્રસંગ	समय, वक्त प्रसंग	time auspicious occasion
અવસાદ	अवसाद	पु	1 नाश, अत 2 ખેદ	अवसाद खेद	ruin, destruction sadness
અવસાન	अवसान	न	1 અટકવું-બંધ થવું તે, અત 2 આખર ઘડી, મોત 3 હદ, સીમા 4 યાતિ, વિરામ	विराम, अत आखिरी वक्त, मौत हद, सीमा यति, विराम	stopping, end death boundary, limit pause, casura
અવળચડું	अवळचडुं	वि	1 કહે તેથી ઉલટું કરનારું 2 અટક્યાળું અડપલાખોર	जो कहे उससे उलटा करनेवाला शरारती	perverse prankish
અવળવાણી	अवळवाणी	स्त्री	1 વાચ્યાર્થથી ઉલટો અર્થ સૂચવતી વાણી, ગૂઢવાણી 2 અવળું બોલવું તે 3 અશુભ વાણી	वाच्यार्थ से उलटा अर्थ सूचित करने वाली वाणी, उलटबोसी, गूढ वाणी उलटा बोलना अशुभ वाणी	speech with meaning contrary to the literal meaning perverted talk inauspicious speech
અવળસવળ	अवळसवळ	अ	ઉલટ સૂલટ	उलटा-सीधा	topsy turvy, disorderly
અવાજ	अवाज	पु	1 ધ્વનિ, શબ્દ 2 ઘાટો, નાદ	आवाज, ध्वनि, शब्द कठ, नाद	sound, voice, noise call
અવાવરું	अवावरुं	वि	બહુ વખતથી વપરાયા વિનાનું, હવડ	अव्यवहृत, जो बहुत समय से काम में न लाया गया हो	unused or uninhabited for a long time

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अवाणु	अवाळु	पु, न	1. दातना पारा-पीठिया 2. लाण उत्पन्न करनार भासपिंड	मसूडा, मसूढा लार उत्पन्न करने वाला मास-पिंड	gums glands producing saliva
अवातर	अवातर	वि	1. अदरनु 2. पयमा आपेळु 3. नी अदर आपी जतु, समायेळु 4. बाह्य, आगतुक	अवातर बीच में आया हुआ -के अदर आया हुआ, समाविष्ट बाह्य, आगतुक	inside intervening included extraneous, incidental
अविवेक	अविचेक	पु	1. अविचार 2. विचारशून्यता 3. अविनय	अशोच्य विचारशून्य अविनय	thoughtless void of thought immodesty
अव्यक्त	अव्यक्त	वि	1. अस्पष्ट 2. अदृष्ट 3. (गणितमा) अज्ञात, विशिष्ट सख्या पतापनार (राशि)	अव्यक्त अदृश्य अज्ञात	not clear invisible (Maths) unknown, not indicating a specific number
		न	1. ब्रह्म, परमात्म तत्त्व 2. मूल प्रकृति	ब्रह्म, परमात्म तत्त्व मूल प्रकृति	Brahma, the universal spirit Prakriti, nature
अशब्द	अशब्द	वि	1. निशब्द, नीरव 2. शब्दमा व्यक्त नहीं थयेळु	निशब्द, नीरव जो शब्द में व्यक्त न हुआ हो	silent, not making a sound not expressed in words
		न	ब्रह्म	ब्रह्म	Brahma
अशरफी	अशरफी	स्त्री	1. सोनामखोर 2. अे नामनु अेक ढडीळु थाडु	अशरफी इस नाम का चर्मरोग	gold coin kind of obstinate ulcer
अशुभ	अशुभ	वि	1. अमगल 2. मरणने लगतु	अशुभ मृत्यु के बारे में, मृत्यु विषयक	inauspicious concerning death

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		न	1 अक्षय्याण, भूडु 2 दुराचरण	अकल्याण, बुरा दुराचरण	evil, misfortune sin
अशेष	अशेष	वि	पूरेपूरु, तमाम	सपूर्ण, समूचा	complete, whole
अश्लील	अश्लील	वि	1 लीमित्स, नठारु 2 असभ्य, ग्राम्य	अश्लील अभद्र, ग्राम्य	obscene indecent, vulgar
असभ्य	असभ्य	वि	अविनयी, जगली	असभ्य	boorish, indecent, impolite
असर	असर	स्त्री	1 वस्तुनो (सारो के माठो) प्रभाव के छाप पडे या गुण-अवगुण दाखवे ते 2 परिणाम 3 लागणी	असर परिणाम सहानुभूति का भाव	effect, impression, influence result sympathy
असल	असल	वि	1 मूण 2 प्राचीन 3 उत्तम 4 जरु, साथु	मूल, असली प्राचीन उत्तम सही	original ancient best genuine
असहकार	असहकार	पु	1 सहकार-संबंध न राखवा ते, 2 सरकार साथे गाधीज्ज्जे शरु करेली जे नामनी लडत	असहयोग ब्रिटिश शासन को सहयोग न देने के लिए गाधीजी द्वारा चलाए गए आंदोलन का नाम	non-co- operation non-co- operation movement launched by Gandhiji
असंगत	असंगत	वि	1 भेण न जाय जेवु परस्पर विरोधी 2 अनुचित	बेमेल, असंगत, परस्पर विरोधी अनुचित	incongruous, inconsistent improper
असतोष	असतोष	पु	सतोषनो अभाव	असतोष	dissatisfaction
असंबद्ध	असंबद्ध	वि	1 संबद्ध नही तेवु	असंबद्ध	irrelevant

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 अर्थशून्य 3 अनुचित	अर्थशून्य अनुचित	meaningless improper
असभव	असभव	पु	सभवनो अभाव, अशक्यता	असभव	impossibility, unlikelihood
असूया	असूया	स्त्री	1 अदेभाए 2 पारधाना गुणोभा दोष शोधवा ते 3 क्रोध	असूया अन्य के गुणों में दोष ढूढना क्रोध	jealousy, envy calumny anger
असूर(-रु)	असूर (-रु)	अ	मोडु	देर से, विलंब से	late
अस्तर	अस्तर	न	अएरनु पड	अस्तर, सिले कपडे के भीतर की तह	lining
अस्तरौ	अस्तरौ	पु	वाण छढवानु ओणर, अस्त्रौ	उस्तरा	razor
अस्वस्थ	अस्वस्थ	वि	1 स्वस्थ नहिले तेपु, अशात 2 बेचैन, सडेण बीमार	अस्वस्थ बेचैन, थोडा सा बीमार	not composed, disturbed restless, indisposed
अस्वाभाविक	अस्वाभाविक	वि	स्वाभाविक नहिले तेपु, कृत्रिम	अस्वाभाविक	unnatural, artificial
अस्वीकार	अस्वीकार	पु	स्वीकारनो अभाव	अस्वीकार	non-acceptance, rejection
अहर्निश	अहर्निश	अ	दिनरात	अहर्निश	day and night, incessant
अहालेक	अहालेक	पु	भाभी बावाओनो [[मिक्षा मागती वजतनो] अेक पोडर	'अलख' की पुकार	cry made by a particular class of sadhus, while begging
अहिंसा	अहिंसा	स्त्री	टडेल	टेर, गाने की पक्ति	call for alms
		स्त्री	मन, वारणी अथवा अर्भशी हिंसा न करवी ते	अहिंसा	non-violence

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
અહુણા (-નાં)	अहुणा (-णा)	अ	અધુના, હમણા	अभी, हाल ही में	now
અહેવાલ	अहेवाल	पु	વૃત્તાત, હેવાલ	अहवाल, वृत्तात	report, account
અહેશા-સાન	अहेशा (-सा) नन		ઉપકાર, આભાર	उपकार	obligation, gratitude
અળખામણ	अळखामणु	वि	આશમાનીતુ, અપ્રિય	अप्रिय	disliked, unfavoured
અળગુ	अळगु	वि	1 દૂર, છેટેનુ, વેગળુ 2 જુદુ, નિરાળુ, અનેરુ	अलग, दूर न्यारा, निराला	distant, disconnected different, unique
અળદાવુ	अळदावु	अ क्रि	શાક્રીને લોથ થઈ જવુ, પિલાવુ	थक कर चूर हो जाना	to be thoroughly tired, sweat
અળવી	अळवी	स्त्री	એક કદમૂળ, જેના પાદડાના પતરવેલિયા શાય છે	अरबी, एक कद, घुइयों	name of a plant whose leaves are cooked for food
અળવીતરુ	अळवीतरु	वि	અટકથાળુ	तूफानी, ऊधमी, शरारती	prankish
અળશી(-સી)	अळशी (-सी)	स्त्री	એક તેલી બી	अलसी, एक तिलहन	linseed
અળસાવુ	अळसावु	अ क्रि	આળસ અથવા કટાળાથી છોડી દેવુ	आलस्य अथवा थक कर छोड देना	to give up out of laziness or boredom
અળસિયુ	अळसियु	न	ચોમાસામા દેખાતો જમીનનો એક કીડો	केंचुआ	earth-worm
અળબો	अळबो	पु	બિલાડીનો ટોપ	कुकुरमुत्ता	mushroom
અળાઈ	अळाई	स्त्री	ઉનાળામા શરીરે થતી ઝીણી ફોલ્લી	अलाई, अम्हौरी, गरमी के मौसम में शरीर पर निकलनेवाले दाने, फुसी	prickly heat

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अक्ष	अक	पु	1 आक्षो, चिह्न 2 आक्षो, सभ्यानु चिह्न 3 दाधो, छलछ (जेम डे थड्मा) 4 जोणो 5 नाटकनो विभाग 6 टेड	अक आकडा, सख्या का चिह्न दाग, कलक (जैसे चन्द्र में) गोद नाटक का एक भाग ध्रुवपद	mark, sign number, digit, figure spot, blemish lap act of a drama burden of a song
अक्षित	अकित	वि	1 निशानी अथवा छापवाणु 2 अक्षयेत्तु, प्रसिद्ध 3 अधीन	अकित प्रसिद्ध अधीन	having a sign or impress well-known dependent
अक्षुर	अकुर	पु	क्षुरगो	अकुर	sprout, shoot
अक्षुश	अकुश	पु	1 दाब, डाबू 2 छाथीने छाडवानु लोढानु साधन	अकुश	check, control goad or hook for controlling an elephant
अक्षोडी	अकोडो	पु	1 बेउ छेडे वाणेलो धातु नो कडी जेवो सणियो, साडणनो आक्षो-कडी 2 आक्षो-‘छूँ’ 3 साणसो, थीपियो	जजीर का आँकडा, कडी हुक सँडसा, पकड	link hook a pair of large tongs
अगरखु (-जो)	अगरखु, -(-खो)न		जूनो ढबनो कस बाधवानो ङगलो	अँगरखा, पुराने ढग का कसों से बाँधने का कोट या कुरता	old fashioned jacket with strings
अगारवायु	अगारवायु	पु	‘कार्बोनिड अेसिड गेस’	कार्बोनिड एसिड गैस	carbonic acid gas

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अंगी(-)ठी	अगी (-गे) ठी	स्त्री	1 शगडी (भास करीने सोनीनी) 2 पोड पाडवा भाटे तैयार करेदी जगा 3 आण, अगन	अंगीठी (खास कर सुनार की) नवान्न को पकाने के लिए तैयार की गई जगह अग्नि, ज्वाला	brazier or portable fire-pan (esp of a goldsmith) clearing for parching ears of a corn hot blast of a flame, burning sensation
अगूछे	अगूछो	पु	अग लूछेवानो कटको, टुवाल	अग पोंछने का कपडा, अंगोछा, तोलिया	towel
अंगूठी	अगूठी	स्त्री	1 पगने अगूठे पडेरवानु स्त्रीनु धरेण 2 आगणीना रक्षण भाटेनी जोणी	एक गहना जिसे स्त्रियाँ पग के अंगूठे में पहनती हैं अंगुली के रक्षण के लिए पहनी जानेवाली खोली, अगुशताना	ornament worn by women on the big toe finger-cap
अगूठो	अगूठो	पु	छथ अथवा पगनु जडामा जडु पडेलु आगणु	अंगूठा	thumb, big toe
अगूर	अगूर	स्त्री	लीली दूक्ष	अगूर	grape
अघोण	अघोळ	न	स्नान, नडावु ते	स्नान, नहाना	bath, act of bathing
अंजणपारणी	अजळपाणी	न	दारोपारणीनु निर्माण	अन्न-जल, खाना-पीना, गुजारे का साधन	termination of a relation as ordained
अजाम	अजाम	पु	1 अत 2 परिणाम	अजाम परिणाम	end result

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अणवु	अजावु	अक्रि	1 तेजने लीधे आभ भीथाए जवा 2 बीज आगण आभा पडी जवु 3 'आणवु' नु कर्मणि	चौंधियाना किसी के प्रभाव में आना 'आणवु' क्रिया का कर्मणि रूप	to be dazzled to be put out by someone passive of 'आणवु' 'apply collyrium'
अणर	अजीर	न	अेक भेवो	अजीर (फल और पेड)	fig
अटस	अटस	पु	वेर, पाडाभार	ऑट, कट्टर वैर	enmity, grudge
अडणगडण	अडळ गडळ	वि	भरुभोटु, अेलइल	भूठ-सच, अड-बड	of doubtful quality
अतर	अतर	वि न	1 अडरनु 2 नण्डनु 1 अडरनो भाग 2 अत.करण, मन 3 अवकाश, छेटु 4 पथलो डाण 5 तक्षवत 6 भेद, जुदाए	अतर समीप, नजदीक अदर का एक भाग अतकरण, मन अवकाश, दूरी मध्यावकाश तफावत भेद, अलग होने की स्थिति	inner, internal close, near inner part, interior heart, mind space, distance interval difference separateness
अतर्निहित	अतर्निहित	वि	अडर भुडेनु	अतर्निहित	deposited inside
अतर्मुख	अतर्मुख	वि	अडर वणेनु, आत्मर्धितन परायण	अतर्मुख	turned inward, introspective
अतेवासी	अतेवासी	वि पु	पासे रहेनारु [गुरुनी समीप रहेनार] शिष्य	अतेवासी गुरु के समीप रहनेवाला शिष्य	living near disciple (staying with the Guru)
अडर	अदर	अ	भा, भर्छा	अदर	in, within

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યાકો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અદેશ(-શો)	અદેશ (-શો)	પુ	સંદેહ, વહેમ	અદેશ, શકા, વહમ	suspicion, doubt
અંધારુ	અધારુ	ન	1 પ્રકાશનો અભાવ, ન દેખાય તેવી પ્રકારની સ્થિતિ 2 અવ્યવસ્થા, અધેર 3 ગુપ્તતા, અપ્રસિધ્ધ 4 અજ્ઞાન	અધેરા અધેર, અવ્યવસ્થા ગુપ્તતા, અપ્રસિદ્ધિ અજ્ઞાન	absence of light disorder, anarchy secrecy, obscurity ignorance
અધેર	અધેર	ન	અવ્યવસ્થા, અસંજ્ઞતા	અવ્યવસ્થા, અરાજકતા	disorder, anarchy
અંબાડી	અબાડી	સ્ત્રી	હાથી ઉપરની બેઠક	હૌદા, અબારી	howda
અંબાર	અબાર	પું	ઢગલો, ભંડાર	ઢેર	heap, store
અબાવુ	અબાવુ	અ ક્રિ	ખટાઈ જવું	(દાત) ખટાના	(of teeth) be affected with sour things, be set on edge
અબોડો	અબોડો	પુ	માથાના કેશની પાછળ વાળવામા આવતી ગાઠ	કેશ-પાશ, જૂડા	(of woman) hair tied in a knot on the back of the head
આઈ	आई	સ્ત્રી	1 મા 2 દાદી 3 દેવી 4 સાસુ	મૌ દાદી દેવી સાસ	mother grandmother goddess mother-in-law
આકરુ	આકરુ	વિ	1 તીવ્ર, સખત, અસહ્ય 2 કઠણ, મુશ્કેલ 3 આકળુ, ગરમ સ્વભાવનુ	તીવ્ર, સખત, અસહ્ય કઠિન, મુશ્કિલ તેજ, તીખા (સ્વભાવ કા)	intense, hard, unbearable tough, difficult hot tempered, high-strung

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 भावमा आडरु, मोधु	महंगा	costly, dear
आडस्मिड	आकस्मिक	वि	ओधितु, आण्धार्यु, अडस्मात जनतु	आकस्मिक, अचित्त्य	sudden, unexpected, accidental
आडण विडण	आकळ विकळ	वि	गभशयेलु	आकुल, बेचैन, घबराया हुआ	perplexed, bewildered
आडणु	आकळू	वि	1 अधीरु, उतावणु 2 उट गुस्से थळ गाय तेवा स्वभावनु	अधीर, उतावला गुस्सावर	impatient, hasty irascible
आडार	आकार	पु	1 आकृति, घाट 2 विघोटी 3 शुमार	आकृति लगान शुमार	form, shape land-tax rough estimate, approximate
आडए	आक्रद	न	रुदन, विलाप	आक्रद	crying aloud, wailing
आक्षेप	आक्षेप	पु	1 आरोप 2 डेडपु ते 3 लगानु, थोपडपु, धसपु 4 वाधो 5 झूटवी लेपु ते, 6 निदा 7 (डाव्यशास्त्रमा)अडेक अलकार	आक्षेप फेंकना लगाना, घिसना, मलना विरोध हडप लेना निन्दा काव्यशास्त्र में एक अलकार	accusation throwing applying, rubbing objection to grab censure (rhetorically) paralipsis
आणडपु	आखडवु	अ क्रि	1 रणडपु 2 ठोकर जावी, टीथापु 3 लडी पडपु	भटकना ठोकरें खाना भिड जाना, झगडना	to wander aimlessly to trip, to stumble to quarrel
आणडी	आखडी	स्त्री	बाधा, मानता	मनोती	religious vow taken, or

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
					promise made, before or to a diety, of making an offering to him (or her) on the fulfilment of one's particular desire
आખર	आखर	स्त्री अ	अत अस्ते	आखिर, अत आखिर में	end in the end
આખલો	आखलो	पु	साढ	सॉड	bull
આખુ	आखु	वि	1 ભાગ્યા વિનાનુ અખડ 2 પૂરુ, બધુ, સળગ	अखड पूरा, सब का सब, साबित	unbroken, whole complete, unabridged, continuous
આગ	आग	स्त्री	1 અગન, લાય, બળતરા 2 અકસ્માત ઢાઈ બળી ઉઠે ને ભડકે લાગે તે 3 ક્રોધ, ઝનૂન, દાઝ કે એવા આવેશના જુસ્સાની લાગણી	आग, जलन आकस्मिक कुछ जलने लगना क्रोध, जुनुन या आवेश का भाव	fire, burning sensation burst into flames enraged feeling
આગતા સ્વાગતા	आगता स्वागता	स्त्री	આવેલાનો આદરસત્કાર, પરોણાચાકરી	आवभगत	hospitality
આગમચ(જ)	आगमच (-ज)	अ	પહેલેથી, આગળથી, અગાઉ	पहले से, आगे से	from the beginning, beforehand, before
આગલુ	आगलु	वि	1 પહેલાનુ, અગાઉ બનેલુ 2 મુખ્ય, આગળ પડતુ	प्राथमिक, अगला मुख्य	previous chief

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आगवु	आगवु	वि	ઇલાયદુ, પોતીકુ	अपना, अलायदा	peculiar to an individual, exclusively one's own
आगण	आगळ	अ	1 अगाઉ, पूर्वे 2 पासे, डने 3 सन्मुख, सामे 4 બહાર, જાહેરમા	अगाडी, आगे पास में, निकट सन्मुख, सामने आइन्दा, आगे, प्रकट में	formerly near, by the side of before, in presence of henceforward, in public, outside
आगणो(-णयो)	आगळो (-ळियो) पु		બારણ ઉઘાડવાની કે વાસવાની ડળ, ઉલાળો	अर्गला, अगडी, चिटकनी	wooden bar or bolt for fastening the door
आगाडी	आगाही	स्त्री	ભવિષ્યનુ સૂચન	भविष्यवाणी	forecast
आगियो	आगियो	पु	1 ખઘોત 2 જુવાર ઇત્યાદિનો એક રોગ 3 એક જાતની ધોળી જુવાર 4 જેને અડકવાથી લાય બળે એવો છોડ 5 વૈતાલ	जुगनु, खद्योत ज्वार-बाजरे का एक रोग, आगडा सफेद ज्वार जिसे छूने से जलन हो ऐसा पौधा वेताल.	glow-worm pest destroying jowar a kind of white jowar plant causing burning sensation when touched King of evil spirits, Vaital
आघात	आघात	पु	1 પ્રહાર, ફટકો 2 અવાજ થાય તેવી રીતે અથડાવુ તે 3 દુ.ખની તીવ્ર લાગણી	आघात जोर की आवाज के साथ टकराना दुख की तीव्रानुभूति	blow, stroke collision with a bang shock

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आघुपाछुं	आघुपाछु	वि	1 (समय के अंतरमा) आगण-माछणआवतु, अर्छी-तर्छी ~आसपास छ्याछ छेय तेवु के स्थानदेर थयेलु 2 (जगादेर थयेथी) नजरे न पडे तेवु 3 ખરખોટુ, યોગ્યાયોગ્ય	(समय या अंतर में) आगे-पीछे का स्थानफेर के कारण जो नजर न आए झूठ-सच, योग्यायोग्य	coming before or after lying somewhere about the place, or displaced (in time or place) out of place and hence out of sight straight or crooked
आथडवु	आचकवु	स क्रि	ખેથવુ, આથક સાથે લઈ લેવુ	खेंचना, झटके के साथ ले लेना	to snatch, to snatch away
आथरकूथर	आचरकूचर	वि	1 પરચુરણ 2 પરચુરણ ખાવાનુ, કાચુકોરુ 3 પરચુરણ સરસામાન	फुटकर खाने की फुटकर चीजें फुटकर सामान	of various kinds various items of food, especially uncooked sundry articles of furniture
आथरण	आचरण	न	1 ચાલચલન, વર્તણૂક 2 ચરિત્ર, લક્ષણ 3 વ્યવહાર, લક્ષણ	आचरण चारित्र्य, लक्षण व्यवहार, लक्षण	conduct, behaviour character, trait practice
आथार	आचार	पु	1 આચાર, વર્તન 2 સદાચરણ 3 વિધિ, સસ્કાર 4 ધર્મશાસ્ત્રમા કહેલા આચરણના નિયમો 5 શિષ્ટ સપ્રદાય, રુઠિ, રિવાજ	आचार, व्यवहार सदाचरण विधि, सस्कार धर्मशास्त्र में बताये हुए व्यवहार के नियम शिष्ट सप्रदाय, रीति रिवाज	behaviour good conduct sacred ritual or ceremony rules of conduct as prescribed by the scriptures a body of people subscribing to

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
આછકલુ	आछकलु	વિ	1 છીછરા મનનુ, નાદાન 2 મોટાઈ ન છરવી શકનારુ કૂલરાઈ	छिछोरा, नादान फूलकर कुप्पा हो जाने वाला	set principles of conduct, practice or custom shallow, childish puffed up, vain
આછુ	आछु	વિ	1 છૂટુ છૂટુ, પાખુ 2 થોડુ, ઓછુ 3 પાતળુ, છેક ઓછુ 4 ઝાખુ	छिदरा, झीना स्वल्प, धोडा पतला धुधला	thinly spread, flimsy little, less thin, very fine dun
આજ	आज	અ સ્ત્રી	આજે, ચાલુ દિવસે આજનો દિવસ	आज आज का दिन	this day to-day
આજીજી	आजीजी	સ્ત્રી	કાલાવાલા, આગ્રહભરી વિનતિ	आजिजी, गिडगिडाहट, दीनता, आग्रहपूर्ण विनती	entreaty. supplication
આજીવિકા	आजीविका	સ્ત્રી	1 ગુજરાન 2 ગુજરાનનુ સાધન	आजीविका आजीविका का साधन	livelihood means of livelihood
આજુ(-જૂ)બાજુ (-જૂ)	आजु(-जू) बाजु(-जू)	અ	આસપાસ, ચારેબાજુ	आसपास, इर्दगिर्द, चारों तरफ	on all sides, all around
આજ્ઞા	आज्ञा	સ્ત્રી	1 હુકમ 2 રજા, પરવાનગી	आज्ञा इजाजत	command, order permission
આઝાદ	आझाद	વિ	સ્વતંત્ર	आजाद, स्वतंत्र	free
આટઆટલુ	आटआटलु	વિ	આટલુ આટલુ, આટલુ બધુ	इतना-इतना, इतना सब	so much, such a lot
આટલુ	आटलु	વિ	અમુક દેખાડેલા નક્કી કદ, જથ્થા, પ્રમાણ જેટલુ	इतना	this much, so much

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आटापाटा	आटापाटा	पु	आरोपाट-अेड रमत	एक खेल	a kind of game
आटोपवु	आटोपवु	स क्रि	1. अेडठु डरवु, सडलवु 2. पूरु डरवु, पताववु 3. बध डरवु	समेटना निबटाना समाप्त या बद करना	to collect, to gather, wind up to finish, round off to close, stop
आठ	आठ	वि	८	8, आठ	eight, 8
आड	आड	स्त्री	1. बेनी आडे-वख्ये डोवु ते डे जे डोय ते वस्तु 2. प्रतिबध, डरडत 3. 'गौण' अर्थ डशावतो पूर्वग डत आडडथा	आड, ओट, परदा रोक, रूकावट, प्रतिबध, बाधा 'उप' जैसा पूर्वग जो गौण अर्थ बताता है जैसे 'आडकथा'	act of intervention or that which intervenes ban or obstruction a prefix signifying 'minor', 'secondary', a prefix like उप which indicates a secondary meaning
आडडतरु	आडकतरु	वि	1. वाडुथुडु 2. परोक्ष, अप्रत्यक्ष	बौका-चौका, टेढा-मेढा परोक्ष, अप्रत्यक्ष	winding, zigzag indirect
आडडीली(-लो)	आडखीली (-लो)	स्त्री	विधन	विधन, अर्गला	obstruction
आडणी	आडणी	स्त्री	रोटली डत्याडि वणवानी त्रिपाड, आभणियो	(रोटी बेलने का) चकला	small tripod or stool for rolling <i>chappatis</i>

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आडत	आडत	स्त्री	1. માલિકના વતી કામ કરવું તે 2. હકસાઈ, દલાલી	आदत दलाली	something on behalf of the employer brokerage
આડત્રીસ	आडत्रीस	वि	3૮	38, अडतीस	thirty-eight, 38
આડબર	आडबर	पु	1. લાખુ પહોળુ છવાઈ રહેવું તે, ખટાટોપ 2. ઠાઠ, દબદબો 3. ખોટો ડોળ 4. અહકાર	आडबर ठाठ, दबदबा भूठा दिखावा अहकार	spreading far and wide, an outward false show pomp, show empty showing off vanity
આડાઈ	आडाई	स्त्री	1. હઠ, દુરાગ્રહ 2. વાકાપારુ, વિરુદ્ધતા	हठ वक्रता, विरुद्धता	obstinacy, stubbornness crookedness, an unwillingness to co-operate
આડીવાડી	आडीवाडी	स्त्री	કુટુંબકબીલો	कुटुब-कबीला, पूरा परिवार	whole family
આડુ	आडु	वि	1. સીધું નહિ તેવું 2. ઊભું નહિ તેવું 3. વચ્ચે પડ્યું હોય કે આવે તેવું 4. હઠીલું 5. વાધાખોરિયું 6. પરોક્ષ, આડકતરું 7. ખોટું, વાકું 8. વિરુદ્ધ, વચ્ચે આવતું	जो सीधा न हो खडे का उल्टा बीच में पडा हुआ, या बीच में आये ऐसा हठी अडगेबाज परोक्ष टेढा, बाँका विरुद्ध, बीच में आता हुआ	not straight not vertical, horizontal lying across or in the way obstinate fault finding indirect crooked, bad opposing, coming in the way

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		अ	આડી બાજુએ	तिरछी दिशा में	from the wrong side
		न	1 ગાડાનુ ખલવુ	बैलगाडी का खडा डडा	stump of wood fixed on the side of a cart
			2 મેલુ, ભૂત ઇત્યાદિ	भूत-प्रेत इत्यादि	evil spirit
આડુતો(-ટે)કુ	आडुते (-टे) कु	वि, अ	આડુ અવળુ, વાકુચૂકુ, ઊલટુસૂલટુ	उलटा-सीधा	not in the right order, zigzag or winding, jumbled up
આડેઘડ(-ડે)	आडेघड (-डे)	अ	ઘડો રાખ્યા વિના, જેમ આવે તેમ	अधाधुध, बेहिसाब, मनचाहा	without any restraint, without any rhyme or reason
આડો આક	आडो आक	पु.	સીમા, અવધિ	सीमा, हद, मर्यादा	farthest limit
આડોશપાડોશ	आडोशपाडोश	पु	1 આસપાસનો રહેઠાણનો ભાગ-તત્તો 2 આસપાસ રહેનારાઓનો સમૂહ, આસપાસનો વસવાટ	अडोस-पडोस, पास-पडोस आसपास रहनेवालों का समूह	neighbourhood or locality neighbouring people
આડોશીપાડોશી	आडोशीपाडोशी	पु	આડોશપાડોશમા રહેનારુ તે	अडोसी-पडोसी	neighbours
આણ	आण	स्त्री	1 આજ્ઞા, દુવાઈ 2 મનાઈ, શપથ	आज्ञा मनाई, शपथ	order prohibitory order, prohibition, pledge
			3 ઢ્ઢેશે	घोषणा, दिदौरा	proclamation

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आणवु	आणवु	स क्रि	दूरशी लाववु, ज्जणे लाववु	दूर से लाना, ले आना	to fetch, to bring
आण	आण	न	1 पिथरशी वडुने विधिसर सासरे वजावी आणवी ते, तेडु 2 इन्याने सासरे वजावता इरती रीत, इरियावर	गौना गौने के समय का नेग, दहेज	ceremonial, the bringing of bride to her father-in-law's house presents sent along with the bride at her first visit to her father-in-law's house
आतश(-स)	आतश (-स)		1 अग्नि 2 जलतर	अग्नि जलन	fire burning sensation
			3 क्रोध	क्रोध	anger
आती(-थी)पोती(-थी)	आती (-थी) पोती (-थी)	स्त्री	आश, पुण्ड	पूजी	wealth
आतुर	आतुर	वि	1 उत्सुध 2 अधीर, आडणु	आतुर अधीर, आकुल	eager impatient, anxious
आथमार	आथमणु	वि	3 -थी पीडातु, दुःखी पश्चिम तरइनु	से पीडित, दुखी पश्चिमी	suffering from westerly
आथमवु	आथमवु	अ क्रि	1 अस्त पामवु, न देजावु 2 पडती दशाभा आववु	अस्त होना पतन होना	to set to decline
आथर	आथर	पु	1 घास-नो थर 2 पछेडी, पाथररु	घास की तह चदर, बिछावन	layer of grass sheet of cloth, carpet

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 ગઘેડા ઉપર નાખવાની ડળી	(घोड़े या गधे की पीठ पर जीन के नीचे बिछाने की) दरी या गुदडी	coarse thick cloth put under the saddle of an ass
આશવુ	आथवु	स क्रि	1 મીઠું-મસાલો ચડે તેમ કરવુ 2 ખમીર ચડાવવુ	नमक-मसाला चढे ऐसा करना खमीर उठाना	10 season to leaven
આદત	आदत	स्त्री	ટેવ, મહાવશે	आदत	habit, practice
આદર્શ	आदर्श	पु वि	1 દર્પણ, આરસો 2 નમૂનો 3 ધ્યેય, લક્ષ્ય નમુનેદાર, ધ્યેયરૂપ	आईना नमूना ध्येय, लक्ष्य	mirror model aim, objective ideal
આદા-દાવેર	आदा (-दा) वेर	न	1 મૂળનુ-જૂનુ વેર 2 હાડવેર, પાકી દુશ્મનાવટ	पुराना वैर, कदीमी अदावत कट्टर वैर, जानी दुश्मनी	old enmity rooted enmity
આદાનપ્રદાન	आदान प्रदान	न	લેણદેણ, આપલે	आदान-प्रदान	exchange
આદા(-દા)શીશી	आदा (-दा) शीशी	स्त्री	અડધુ-એક બાજુનુ માથુ દુખે તેવો રોગ	आधाशीशी, एक तरफ से सिर के दुखने की तकलीफ	megrim
આદિમ	आदिम	वि	પ્રારંભનુ, મૂળ, અસલ	प्रारभिक, मूल, असल	first, primitive, original
આદુ	आदु	न	એક કદ, જેની સૂઠ બને છે તે	अदरक, एक कद जिसकी सोंठ बनती है	ginger
આધ (-ર) ણ	आध (-र) ण	न	અનાજને બાફવા માટે એકલુ પાણી પહેલેથી મુકામ છે તે	अदहन, अनाज को उबालने के लिए रखा गया पानी	water on the boil in which grain is added to be cooked

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
આધાર	આધાર	પુ	1 ટેકો, અવલબન 2 આશ્રય, મદદ 3 પુરાવો, સાબિતી	અવલબન આશ્રય, મદદ સબૂત, પ્રમાણ	support, prop protection, aid ground or basis
આધેડ	આધેડ	વિ	અડધી ઉમરે પહોંચેલુ, પ્રોટ વયનુ	અધેડ, પ્રોટ	middle - aged
આનાકાની	આનાકાની	સ્ત્રી	હા ના કરવી તે, ઢચુપચુ હોવાની દશા	આનાકાની, આગાપીછા	hesitation, sitting on the fence
આપણ(ને)	આપણ (-णे)	અ	હુ કે અમે અને તુ કે તમે, બોલનાર અને સાભળનાર બધા	મેં या हम और तुम या आप, अपन	we
આપદ(-દા)	આપદ (-दा)	સ્ત્રી	આપતિ	આપत्ति	adversity
આપન્યા	આપન્યા	સ્ત્રી	1 પોતાની સ્થિતિનુ ભાન 2 આત્મસતોષ	અપની સ્થિતિ का खयाल આત્મસતોષ	knowledge of one's own predicament sense of self- satisfaction
આપવુ	આપવુ	સ ક્રિ	1 અર્પવુ, દેવુ 2 સોપવુ, હવાલે કરવુ	અર્પિત કરના દેના, સિપુર્દ કરના	to give, to hand over to deliver, to consign
આફળીએ	આફળીए	અ	1 પોતાની મેળે 2 એકએક	અપને આપ यकायक	willingly accidentally
આફરીન	આફરીन	અ	1 કુરબાન, ફિદા, ખુશખુશ, વાશી ગયુ હોય તેમ 2 ધન્ય, શાબાશ	કુરબાન, ફિદા, न्योछावर हो गया हो ऐसा धन्य, शाबाश (उद्गार) शाबाशी	pleased to the point of sacri- ficing everything bravo, well- done congratulation

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आङ्शे	आफरो	पु	1. पेट थडपु ते 2. धाणु भावाशी शती अडणामण	अफारा, अफरा ज्यादा खाने से पेट का फूलना	windiness in the stomach restlessness after over-eating
आङ्स	आफूस	स्त्री	डेरी नी अेड णत	आम की एक किस्म	a kind of mango, alphonso
आबकारी	आबकारी	स्त्री	1. धाणु वगेरे डेडी थीणो पर लेवातो डर 2. धाणु गाणवानु काम	मादक वस्तुओं पर लिया जानेवाला कर शराब खींचने का काम	excise business of a distiller
आबरु	आबरु	स्त्री	कीर्ति, शाण, नामना	आबरु, इज्जत, कीर्ति, साख	respectability, credit, fame
आबाद	आबाद	वि	1. भरपूर, समृद्ध 2. वस्तीवाणु 3. धेडायेले, इणद्रुप 4. सलामत, सुधी 5. भारे, सरस, उत्तम 6. अचूक	आबाद, भरपूर, समृद्ध आबादीवाला उपजाऊ, जरखेज सलामत, सुधी सुन्दर, उत्तम अचूक	prosperous populous fertile safe, secure rich, excellent faultless, exact, unfailing
आबालवृद्ध	आबालवृद्ध	अ	बाणडशी माडीने वृद्धपर्यंत	आबाल वृद्ध, बच्चे से लेकर वृद्ध तक सभी	all, young and old
आबेडूब	आबेहूब	वि	डूबडू, ताडेश	हूबहू, वैसा ही	true to the original vivid
आबोडवा	आबोहवा	स्त्री	डवापारुी	आबो-हवा, हवा-पानी	climate
आभ	आभ	न	आडाश, वाडणु	आकाश, बादल	sky, cloud

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
આભડછેટ	આમ્હછેટ	સ્ત્રી	1 અભડાવુ તે 2 અમુકના સ્પર્શથી દૂષિત થવાય તેવી માન્યતા 3 અટકાવ, રજસાવ 4 પ્રસવ સમયે ઓર, લોહી ઇત્યાદિ નીકળે છે તે	અસ્પૃશ્ય કો છૂના છૂઆછૂત કા હ્યાલ, છૂઆછૂત	be defiled belief that a person is liable to be defiled by touching another person menstruation bleeding at child-birth
આભડવુ	આમ્હવુ	અ ક્રિ	1 અભડાવુ 2 અડવુ	અસ્પૃશ્ય કો છૂને સે અપવિત્ર હોના સ્પર્શ કરના, છૂના	to be defiled by touching another person to touch
આભાર	આભાર	પુ	ઉપકાર, અહેશાન	આભાર	obligation, gratitude, thanks
આભાસ	આભાસ	પુ	1 સાદૃશ્ય, બે વસ્તુ વચ્ચે સરખામણીનો દેખાવ 2 ભ્રમ, ખોટો દેખાવ 3 ઝાખો પ્રકાશ 4 ભ્રામક હેતુ, હેત્વાભાસ	આભાસ ભ્રમ, મૂઠા દિખાવા કમ પ્રકાશ ભ્રામક હેતુ, હેત્વાભાસ	likeness illusion, hallu- cination dim light fallacy
આભિજાત્ય	આભિજાત્ય	ન	1 કુલીનતા, ખાનદાની 2 શ્રેષ્ઠતા, સૌન્દર્ય	અભિજાત્ય શ્રેષ્ઠતા, સૌન્દર્ય	quality of being well-born nobility, grace
આભુ	આમ્હુ	વિ	ચકિત, દિગ્	ચકિત, હૈરાન, દગ	astonished
આભૂષણ	આમ્હૂષણ	ન	ઘરેણુ	આમ્હૂષણ	ornament
આભ્યંતર(-રિક)	આમ્હ્યંતર (-રિક)	વિ	અંદરનુ, માહેલુ	આમ્હ્યંતર, આમ્હ્યંતરિક	interior, internal

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आम	आम	अ	1 आ प्रमाणे 2 आ तरङ्, अली	इस तरह इस ओर, यहाँ	in this manner, thus this way, to this place
आमाणे	आमाणे	अ	आ व्यक्तिअे	इस व्यक्ति ने, इन्होंने	this person, these persons
आमन्या	आमन्या	स्त्री	1 आज्ञापालन 2 मर्यादा, सभ्यता	आज्ञापालन मर्यादा, सभ्यता	obedience respect, good manners
आमसुअ-सुअत)	आमरण (-णात)	अ	1 णिअगी पर्यंत	आमरण	whole life
		वि	2 मरण पर्यंत रहेनारु		lasting till death
आमली	आमली	स्त्री	1 अे नामनु आड, आमली 2 तेनु इण	इमली का पेड इमली का फल	tamarind, a kind of a tree its fruit
आमणु	आमळवु	स क्रि	वण देवो, मथडवु	बटना, ऐंठना, मरोडना	to twist, wring
आमणु	आमळु	न	अेड इण	ऑवला, आमला (फल)	a kind of fruit
आमणो	आमळो	पु	1 वण 2 टेड, अभिमान 3 द्वेष, पार	बट, ऐंठन टेक, अभिमान द्वेष, डाह	twist pride, vow jealousy, grudge
आमत्रण	आमत्रण	न	बोलाववु ते, नोतरु	आमत्रण	invitation
आमत्रित	आमत्रित	वि	आमत्रेलु	आमत्रित	invited
आमात्य	आमात्य	पु	अमात्य	अमात्य	minister, counsellor
आमुअ	आमुख	न	प्रस्तावना, उपोद्घात	प्रस्तावना, उपोद्घात	preface, foreword

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आमेज	आमेज	वि	सामेल, भेजवेलु	शामिल, सम्मिलित	included
आय	आय	स्त्री	1 लाभ, आवक, इयदे 2 पैदाश 3 जनानजानानो रक्षक डे नाजर	लाभ, आय उपज नाजिर, जनानखाने का रक्षक	gain, income produce, out-put keeper of the harem
आयनो	आयनो	पु	अरीसो	आईना, दर्पण	mirror
आयपत	आयपत	स्त्री	आय, आवक, उपज कमाणी	आय, आवक, उपज, कमाई, आमदनी	income, gain
		न	वारसो	पैतृक सपत्ति, विरासत	inheritance
आयदे	आयदे	अ	1 हवे पछी, भविष्यमा 2 सरवाणे	आइदा, भविष्य में अत में, फलत	henceforth, hereafter, in future ultimately, in the end, in all
आया	आया	स्त्री	छोकरने सभाणवा राभेली बाछ	आया, धाय	governess, ayah
आयात	आयात	पु	1 बहारगामशी डे परदेशशी आवेलु 2 बहारगामना मालनो आवरो	आयात, विदेश से आया हुआ माल बाहर से आने वाले माल की आमदानी	imported things import
आयास	आयास	पु	1 कष्ट, महेनत 2 प्रयत्न 3 थक, पीडा	आयास, कष्ट, मेहनत प्रयत्न थकान, पीडा	exertion, labour effort fatigue, mental pain
आयुध	आयुध	न	छिथार	आयुध	weapon
आयुष(-भ्य)	आयुष (-भ्य)	न	आवरद	आयु, जीवनकाल	longevity, duration of life

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आयोजन	आयोजन	न	1 व्यवस्था करणी ते, 2 तेने माटेनी साधन-सामग्री	आयोजन, व्यवस्था प्रबन्ध उसकी साधन-सामग्री	planning resources for planning
आर	आर	स्त्री	1 (लोढानी) अशी, (परोशानी अशी) 2 परोशी 3 मोथीनु टोचागु	लोहे की नोक या कील बैलों को हॉकने की कील जिसमें लगी हुई है वैसी लकड़ी मोची का सूआ	spike goad shoe-maker's awl
आरजू	आरजू	स्त्री	1 इच्छा 2 उमेद, आशा 3 आतुरता तीव्र इच्छा	आरजू, इच्छा आशा, उम्मीद आतुरता, तीव्र इच्छा	desire hope, longing impatience, deep longing
आरणे	आरजो	पु	1 रोग, बीमारी, पीडा 2 सोणे	रोग, बीमारी, पीडा सूजन	disease, sickness, pain swelling
आरडवु	आरडवु	अ क्रि	1 गणामाशी जेथीने अवाज डाढवो 2 मोटो अने जेसूरो अवाज डाढवो	गला फाडकर बोलना, अरडाना, डकारना (ढोर आदि का) ऊँची और बेसुरी आवाज निकालना	to grunt, to cry out loudly to bawl
आरखधरख	आरण काण	न वि	पछानु अनिश्चित	बहाना अनिश्चित	excuse, pretext uncertain
आस्त	आरत	वि	1 आर्त, पीडित 2 लीडभा आवी पडेनु 3 अगत्यनु 4 आतुर	आर्त, पीडित सकट-ग्रस्त जसुरी आतुर	distressed hard pressed necessary eager

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		स्त्री	1 पीडा, भीड 2 गरज 3 आरिथो, डोड, उत्कट छच्छ	पीडा, कष्ट गरज, प्रयोजन चाव, उत्साह, अरमान, उत्कट इच्छा	pain need longing, wish
आस्ती	आरती	स्त्री	1 देवनी मूर्ति समक्ष दीपो उतारवो ते 2 ते वजतनु गवातु पद 3 એક છદ 4 દુઃખ, પીડા	आरती उस समय गाये जाने वाला गीत-पद एक छद दुख, पीडा	ceremony of waving a lamp before an idol, <i>arati</i> verse chanted at the time of <i>arati</i> a meter pain, anguish
आरपार	आरपार	अ	आ बाणुथी पेत्ती बाणु, सोंसरु	आर-पार	across, through
आरमार	आरमार	स्त्री	मनवार, अरमार	युद्ध करनेवाला व्यक्ति	man-of-war
आरसपहाण	आरसपहाण	पु	એક જાતનો લીસો થળકતો પથ્થર, સગમરમર	आदर्श पाषाण, एक प्रकार का पत्थर, सगमरमर	marble
आरभ	आरभ	पु	શરૂઆત, તૈયારી	आरभ, शुरुआत, तैयारी	beginning, preparation
आराधक	आराधक	वि	આરાધના કરનારુ	आराधक	devotee, worshipper
आराम	आराम	पु	1. विश्रान्ति, शाड जावो ते 2. शान्ति सुखरूपता 3. (दुःख वगेरेमाथी) भुक्ति, निवृत्ति	आराम, विश्राम शांति दुख वगैरह से छुटकारा	rest ease, well-being relief from pain

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 કવાયતમા આરામથી ઉભા રહેવાનો હુકમ	कवायद में आराम से खड़े रहने का हुक्म	order to stand at ease
આરાસુર	आरासुर	पु	અરવલ્લી પર્વતનુ, આબુનુ એક શિખર	अरावली पर्वत का, आबू का एक शिखर	one of the peaks of the Aravallis
આરી	आरी	સ્ત્રી	1 નાની કચ્છી 2. મોચીનુ એક ઓજાર	आरी, कचच्ची मोची का एक औजार, सूआ	small saw a tool of a shoe maker
આરૂઢ	आरूढ	વિ	—ની ઉપર ચડેલુ, બેઠેલુ	आरूढ	mounted, seated on
આરેડુ	आरेडु	વિ	1 હારેડુ, તોફાની 2. જાકી, હઠીલુ	शरारती जिद्दी, हठी	mischievous obstinate, stubborn
		ન	સાત માણુ એક માપ કે વજન	पक्के साढे तीन मन का वजन या माप	measure of seven maunds
આરો	आरो	પુ	1 કિનારો 2 પાર, છેડો 3 માર્ગ, છૂટવાનો ઉપાય	किनारा अत छूटने का उपाय	bank, embankment end way, solution
આરોગ્ય	आरोग्य	ન	તદુરસ્તી	स्वास्थ्य	health
આરોપ	आरोप	પુ	1 આક્ષેપ, તહોમત 2. આરોપવુ તે	आरोप, इलजाम, आक्षेप इलजाम या आक्षेप लगाना	accusation, charge act of attributing
આરોહ	आरोह	પુ	1 ચડાણ, ચડાવ 2 રાગ ખેચવો તે 3 સ્ત્રીની કેડ, નિતબ	आरोह राग को ऊँचा ले जाना स्त्री की कमर	ascent, rise ascending notes (in music) woman's waist

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आलपाल	आलपाल	स्त्री	1 सेवाचाक्षरी 2 भावजत, सत्भाण 3 सरभरा	सेवाचाकरी देख-भाल (बालकों की) स्वागत-सत्कार	tending, looking after care, nursing hospitality
आलाप	आलाप	पु	1 वातचीत 2 गायननी पूर्वे तेनी तैयारीरुपे अने पथमा रागनी धूनमा 'अ आ' अेम गावा आवे छे ते 3 गुञ्जन	आलाप, बातचीत गाने से पूर्व उस का रियाज करते हुए आ आ गाया जाता है यह गूजन	conversation, talk tuning to voice previously to and during singing humming
आला-लुखनीलु	आला (-लु) लीलु	वि	लीलुसूक्षु	भीना	semi-dry
आलिगन	आलिगन	न	छाती सरसु थापयु ते	आलिगन	embrace
आलू	आलू	न	1 अेक मेवो, जरदाणु 2 पटाटा	एक मेवा, जरदालू आलू, एक सब्जी	plum, a kind of dry fruit potato
आलेख	आलेख	पु	1 लभाण 2 पत, दस्तावेज 3 सनद 4 मछोर, सील 5 ग्राफ 6 चित्र	आलेख, लिखावट रवत, पट्टा, दस्तावेज सनद मुहर, सील ग्राफ, मानचित्र चित्र	writing document charter, permis- sion seal graph picture
आलेशान	आलेशान	वि	1 प्रतिष्ठित, उत्तम 2 ખૂબ મોટુ 3 ભભકાદાર, ભવ્ય	आलीशान, शानदार, उत्तम बहुत बड़ा भव्य	honoured, ex- cellent huge grand, gorgeous

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
આલોકવું	आलोकवु	स क्रि	1 જોવું 2 અવલોકન કરવું	देखना अवलोकन करना	to see to observe
આવક	आवक	સ્ત્રી	1 આવવું તે 2 ઉત્પન્ન, પેદાશ, કમાણી	आना, आगमन आय, आमदनी, उपज, कमाई	coming in wages, income, produce
આવકવેરો	आवकवेरो	પુ	1 કમાણી ઉપરનો કર 2 આયાત થતા માલ ઉપરની જકાત	आयकर आयात कर, चूगी	income-tax import-duty
આવકાર	आवकार	પુ.	આવો-પધારો એમ કહેવું તે, સ્વાગત, આદરમાન	आवभगत, सत्कार, स्वागत	reception, wel- come
આવજાવ	आवजाव	સ્ત્રી	આવવું અને જવું તે	आना-जाना	comings and goings
આવજો	आवजो	ક્રિ વિ	કુરી પધારજો એવા અર્થનો, જનારને વિદાય આપવાનો બોલ	मेहमान को विदा करते समय पुन आने के लिए आग्रह-सूचक विशेष शब्द	a word of parting salutation (signifying an invitation to come or meet again)
આવડત	आवडत	સ્ત્રી	કુશળતા	अभिज्ञता, जानकारी, कार्य-कुशलता	skill, knowl- edge
આવડવું	आवडवु	અ ક્રિ	—ની જાણ હોવી —નું વાકેફ હોવું —ની કુશળતા હોવી	अभिज्ञ होना, जानकारी होना की जानकारी होना से वाकिफ होना	to know to be familiar with, to be skilled in
આવડું	आवडु	વિ	આ કદનું, અમુકના જેવડું, આટલું	इतना	of this size, as big as, so much, this much

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आवरण	आवरण	न	1 आच्छादन, पडदे 2 अतराय, विघ्न	आच्छादन परदा अतराय, विघ्न	covering, layer obstruction, hindrance
आवरण	आवरण	पु	1 आयुध 2 जिदगानी	आयुष्य जिदगानी	longevity span of life
आवरण	आवरण	स क्रि	1 ढाडपु, आच्छाडपु 2 व्यापपु 3 रुधपु, धेरपु	ढँकना, छा देना छा जाना, व्याप्त होना घेरना	to cover to spread to block, encircle
आवरो जावरो	आवरो जावरो	पु	1 आवपु अने जपु ते, अवरजवर 2 आवडणवड, उपजअर्थ	आना-जाना आय-व्यय	coming and going income and expenditure
आवर्तक	आवर्तक	वि	1 इरी इरी आवतु- आटा जातु 2 इरी इरी शतो	बारबार आनेवाला, घूमनेवाला या चक्कर काटने वाला पुन पुन होने वाला	coming again and again recurring
		पु	1 गोल इरपु ते, आटो, अडरापो 2 अडरी, भमरी	चक्कर लगाने की प्रक्रिया भँवरी, चक्कर	process of going in circles vertigo
आवलि (-ली, -ळि, -ळी)	आवलि (-ली, -ळि, -ळी)	स्त्री	1 हार, पक्ति 2 परपरा	हार, पक्ति परपरा	row series
आवपु	आवपु	अ क्रि	1 दूर डोय त्याशी पास जपुत्तेवी गति करवी, पडोथपु 2 डोपुनी स्थिति डोवी	दूर से पास पहुँचना स्थित होना, उदा अहमदाबाद गुजरात में कहाँ आया?	to come, to approach to be located

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			3 ન હોય ને આવી લાગવુ કે જણાવુ કે જન્મવુ કે દેખા દેવી કે ફળવુ-ફૂલવુ	પેદા હોના, નિકલના (ફલ-ફૂલ, દાંત આદિ)	to occur, to find, to be born, to appear, to blossom, to give fruit
			4 બરોબર બધ બેસવુ	ઠીક બેઠના (ટોપી, પેટ આદિ કા)	to fit in
			5 કોઈ વસ્તુ બરોબર ઉતરવી, નીપજવી, બનવી	સહી આના (હિસાબ આદિ કા)	to come off
			6 કોઈ ભાવ ઉત્પન્ન થવો, ઇ ત કોઈ આવવો	કિસી ભાવ (ક્રોધ આદિ) કા ઉત્પન્ન હોના	to experience a feeling
			7 થવુ, હિસાબે ઉતરવુ, સમાવુ, ગોઠવવુ, માવુ, વળતરરૂપે મળવુ એવા ભાવ બતાવે, ઇ ત ખર્ચ કેટલુ આવ્યુ? કેટલુ શાક આપ્યુ?	હોના, સમાના	to amount to cover, be accommodated, get (something) in exchange of (another thing, usually money)
			8 શરીરનુ અગ ફૂટવુ કે કામ કરતુ થવુ કે તે સ્થાને દર્દ થવુ ઇ ત જીભ આવી	દર્દ હોના	to sprout or grow (a limb or wings), have sore eyes (mouth etc)
આવશ્યક	आवश्यक	वि	જરૂરી	આવશ્યક, જસ્તી	necessary
આવાગમન	आवागमन	न	1 આવવુ ને જવુ તે 2 અવતરવુ અને મરવુ તે	આવાગમન જન્મ મૃત્યુ કે ફેરે	coming and going birth and death
આવાસ	आवास	पु	1 ઘર, નિવાસસ્થાન, હવેલી 2 ખડ, ઓરડો	આવાસ	dwelling, house, mansion room, hall

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आवाहन	आवाहन	न	1 आभरण 2 दैवी तत्पने मूर्तिमा आरावा-देवनी प्रतिष्ठा करवी	आवाहन दैवी तत्त्वों को मूर्ति में लाना-देव की प्रतिष्ठा करनी	invitation invoking a God to enter an idol
आविर्भाव	आविर्भाव	पु	1 जलार नीडणपु डे प्रगटपु ते 2 अपतार, जन्म	आविर्भाव अवतार, जन्म	manifestation appearance avatai, incarnation
आविष्कार	आविष्कार	पु	जलार श्रुपु, प्रगट- जुल्लु थपु ते	प्रकटन	manifestation, making visible
आपु	आवु	वि.	आना जेपु, आ जतनु	ऐसा	such, of this sort
आवृत	आवृत	वि	1 आवरेलु, ढोडेलु 2 व्याप्त 3 घेरथेलु, इधायेलु	आवृत व्याप्त, फैला हुआ अवरुद्ध, घिरा हुआ	covered overcast, spread blocked, encircled
आवृत्ति	आवृत्ति	स्त्री	1 यधधरे इरपु ते 2 पाछु आपपु ते 3 बारबार थपु-इरपु ते 4 पुस्तकनु प्रशान, अेडिशन	आवृत्ति, चक्रगति से घूमना वापिस लौटना बारबार होना पुस्तक का सस्करण	moving in a circle return repetition edition
आवेग	आवेग	पु	1 जुस्सो, जेरे 2 क्षोभ, व्यग्रता, आवेश	आवेग, प्रबल मनोवेग, जोश क्षोभ, व्यग्रता, आवेश	force, vigour vague appre- hension, uneasi- ness, excitement
आवेदन	आवेदन	न	3 उतावण, दोडादोडी 1 निवेदन	उतावली, दौडादौडी आवेदन	hurry, haste statement, memorandum

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 क्षरिया	शिकायत	complaint
आवेश	आवेश	पु	1 णुस्सो, ओभरो 2 गुस्सो	जोश आवेश, गुस्सा	zeal, ardour anger, passion
आवेष्टन	आवेष्टन	न	1 वीटी वणनारी वस्तु, वेष्टन, गलेक्ष, रूपर, परबीडियु, आच्छादन छ जे छोय ते।	आवेष्टन	thing that envelops (envelope, wrapper, pillow-cover etc)
			2 वाड, छोट	बाड, गढ	fence, wall
आशक	आशक	पु वि	प्रेमी प्रेमवश, क्षीण, मोहित	आशिक, प्रेमी प्रेमवश, फिदा, मोहित	lover enamoured, love-lorn, enchanted
आशा-साध	आश (-स) का स्त्री		देवनी आरती, भस्म छत्यादि लेवा ते	देवता की आरती, भस्म आदि लेना	take off an idol's ashes, a dii-lamp, etc to bless one's self with
आशय	आशय	पु	मननी धारणा, छराधे, हेतु	मनसूबा, इरादा, हेतु	intention, purpose, supposition
		न	1 स्थान 2 पात्र 3 छरेला छर्भोना सस्कार छे तेमनो समूह	स्थान पात्र किये हुए कर्मों के सस्कार या उनका समूह	place receptacle impression (or body of impressions) of one's deeds of the past
आशरो	आशरो	पु	1 आश्रय, छत्रछाया	आसरा, आश्रय, छत्रछाया, सहारा	refuge, protec- tion

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 टेओ, आधार, आलनन	आधार, अवलंब	support help, anchor
			3 अडसट्टी, अडल, सुमार	तखमीना, अदाज	guess, rough estimate
आशअ	आशका	स्त्री	शअ, पलेम	आशका, वहम	suspicion, doubt
आशा	आशा	स्त्री	1 उमेड, छथल, धारणा 2 विश्वास, आस्था	आशा, धारणा विश्वास, श्रद्धा	desire, hope, expectation trust, confi- dence
आशा(न्या)ठ	आशा (-षा) ढ	पु	विद्यम सपतनो नवमो मडिनो	आषाढ, विक्रम सवत् का नवो महीना	ninth month of the lunar calendar
आशिश	आशिश	स्त्री	दुवा, आशीर्वाद	दुआ, आशीर्वाद	blessings, benediction
आशुतोष	आशुतोष	वि पु.	जलदी सतुष्ट थल गय अेपु अेवा देव-शकर	आशुतोष, जल्दी सतुष्ट होनेवाला शकर देव	one who is easily pleased epithet of Shankar, a Hindu God
आश्चर्य	आश्चर्य	न	1 नवाँ, अथबो 2 यमत्कार, आश्चर्यकारक बनाव	आश्चर्य, ताज्जुब, अचबा चमत्कार	surprise, wonder miracle, marvel
आश्रम	आश्रम	पु	1 विसामानु स्थान रहेठाण 2 विश्रान्ति 3 साधुनो निवास, तपोवन, पार्शुकुटी	आश्रम, विश्रामस्थान, रहने का स्थान विश्रान्ति साधु सतों का निवासस्थान	place of refuge, shelter, abode period of rest hermitage, abode of the

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 જીવનનો એક વિભાગ	जीवन का एक विभाग	Rishis, forest-hut one of the four stages of life
આશ્વાસન	आश्वासन	न	1 દિલાસો, સાત્વન, હિંમત 2 અભયદાન આપવું તે	आश्वासन	consolation, giving courage promise of safety or protection
આસક્તિ	आसक्ति	स्त्री	અતિશય સ્નેહ, મોહ	आसक्ति	attachment, infatuation
આસન	आसन	न.	1 બેસવાની જગ્યા 2 બેસવા, ઊભા રહેવા કે સૂવાની ઢાળ 3 આસનિયું, બેસવાની વસ્તુ 4 ચોપડી ટેકવાની વસ્તુ 5 ચોપડી અથવા પત્રકમાં પાડેલો કોઠો, ખાનુ	आसन, बैठने की जगह बैठने, सोने या खड़े रहने का ढग आसन, वह चीज जिस पर बैठा जाय पुस्तक रखने या टेकने की वस्तु लकीरों से बनाया हुआ कोष्ठक	seat posture small carpet prop or stand for a book column in a book or register
આસનાવાસના	आसनावासना	स्त्री	1 આશ્વાસન, દિલાસો 2 સરભરા, મહેમાની	आश्वासन खातिरदारी, स्वागत-सत्कार	consolation treating a guest, hospitality
આસપાસમા	आसपासमा	अ.	1 આજુબાજુ 2 નજીકમાં	आसपास, अगलबगल पास में, करीब	all around nearby
આસમાન	आसमान	न	આકાશ, ગગન	आसमान	the sky

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
આસપાસ	આસપાસ	અ	1 જાણી જોઈને, ખામુખા, ખાસ યાહીને 2 પાસે	જાનબૂઝકર, યાસ કરકે, ઝવા-મ-ઝવાહ પાસ મેં	deliberately, intentionally near
આસવ	આસવ	પુ	1 સત્વ, અર્ક 2 ગાળેલો દારૂ	આસવ તૈયાર કી હુઈ શરાબ	extract, essence distilled liquor
આસાથેશ	આસાથેશ	સ્ત્રી	આરામ, વિશ્રાંતિ	આરામ, વિશ્રાંતિ	rest, repose
આસાન	આસાન	વિ	સહેલુ, નરમ	સુગમ, સીધા	easy, mild
આસામી	આસામી	પુ	1 માણસ, વ્યક્તિ 2 દેણદાર 3 પૈસાદાર-પ્રતિષ્ઠિત વ્યક્તિ 4 ધરાક, અસીલ	આસામી, મનુષ્ય, વ્યક્તિ કર્જદાર માલદાર ગ્રાહક, મુવક્કલ	person, individual debtor man of status customer, client
આસુર (-રી)	આસુર (-રી)	વિ	અસુર સબધી, રાક્ષસી, જગલી	અસુર સબધી, રાક્ષસી, દાનવી	pertaining to a demon, devil- ish, barbarous
આસો	આસો	પુ	વિક્રમ વર્ષનો છેલ્લો મહિનો	આશ્વિન, કુઆર, આસોજ, વિક્રમવર્ષ કા અતિમ મહીના	last month of the lunar year
આસોપાલવ	આસોપાલવ	પુ	એક ઝાડ	અશોક વૃક્ષ	Ashok tree, a kind of tree
આસ્તિક	આસ્તિક	વિ	1 ઇશ્વર અને પરલોકના આસ્તિત્વમા માનનારુ 2. શ્રદ્ધાળુ	આસ્તિક શ્રદ્ધાળુ	one who be- lieves in God and in the other world religious
આસ્તે	આસ્તે	અ	1 ધીમે	આહિસ્તા, ધીરે	gently, slowly

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 'ઉભુ રાખો' 'धीमे डरो' એમ સૂચવતો ઉદ્ગાર	'ठहरो', 'धीमे करो' यह सूचित करने का उद्गार	word denoting 'stop'
આસ્થા	आस्था	स्त्री	1 આદર, માન 2 શ્રદ્ધા, આશ્રીન 3 મૂડી, પૂજા	आस्था, आदर-भाव श्रद्धा, यकीन पूजा	respect, reverence faith, trust wealth, asset
આસ્વાદ	आस्वाद	पु	1 ચાખવું-સ્વાદ લેવો તે 2 માણવું તે	आस्वाद आनंद मनाना	taste relish
આહત	आहत	वि	1 ઇજા પામેલું, જખમી 2 હાણાયેલું 3 વગાડેલું, વગાડવાથી નીપજતું	आहत मारा हुआ बजाया हुआ, बजाने से उत्पन्न	wounded, injured killed, slain struck, beaten
આહાર	आहार	पु	ખોરાક, ખાવું તે, ખાનપાન	आहार	food, eating, eating and drinking
આહુતિ	आहुति	स्त्री	1 હોમવું તે 2 હોમવાનું દ્રવ્ય-વસ્તુ, બલિદાન	आहुति हूतद्रव्य	sacrificial offering things offered as sacrifice
આહોડી	आहेडी	पु	શિકારી, ભીલ	अहेरी, शिकारी, भील	hunter, a tribesman (Bhil)
આહ્લાદ	आह्लाद	पु	આનંદ, હર્ષ	आह्लाद	joy, delight
આહ્વાન	आह्वान	न	1 આમત્રણ 2 પડકાર 3 હાજર થવાનો હુકમ, સમન્સ	आह्वान चुनौती प्रस्तुत होने का हुकम	invitation challenge summons

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
આળ	આळ	ન	ખોટો આરોપ, તહોમત, કલક, આક્ષેપ	આરોપ, કલક, આક્ષેપ	false charge, accusation, stigma, allegation
આળવીતરુ	आळवीतरु	વિ	મસ્તીખોર, તોફાની	शरारती	mischievous, prankish
આળસ	आळस	પુ	એદીપણ, સુસ્તી	आलस्य, सुस्ती	indolence, laziness
આળુ	आळु	વિ	1 લીલુ, ભીનુ 2 કાચુ (ખામડા- તાળુ ઉતરડેલુ 3 જરા અડકવાથી દુખાવાય એવુ 4 નરમ, પોચુ	गीला, आर्द्र ताजा, उधेडा हुआ (चमडा) स्पर्श मात्र से दुखनेवाला नरम, गुद्गुदा	wet, fresh skin (of an animal) lately stripped tender soft
આળોટવુ	आळोटवु	અ ક્રિ	સૂઈને એક ઠેકાણેથી બીજે ઠેકાણે એમ ગબડવુ, લોટવુ	लोटना	to wallow, to roll
આક	आक	પુ	1 સખ્યાની નિશાની 2 ભાવ, મૂલ્ય 3 જાડાઈ કે પાતળાઈનો હિસાબ (સૂતરનો) 4 નિશાની 5 અડસટ્ટો 6 સીમા, હદ પડિયા, પાડા	अक दर, मूल्य मोटाई या पतलेपन का हिसाब (सूत का) निशानी, चिन्ह अदाजा सीमा, हद पहाडे	number, numerical figure price, value index of fine- ness or thickness (of cotton thread) mark, sign estimate limit, boundary table of multi- plication

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आकडी	आकडी	स्त्री	1. अेक अथवा बने छेडेशी वाणेलेो सणियो, कडी 'छूक' 2. आतरडामा थती पीडा, थूक 3. ताण 4. माछली पकडवानो गण	अकूडी, एक अथवा दोनों किनारों से मुड़ा हुआ लोहे का तार, हुक आतों में होनेवाली पीडा, मरोड अकडबाई (रोग) मछली पकडने का काटा, बसी	hook colic spasm fishing-hook
आकडो	आकडो	पु	1. सध्या, सध्यानी निशानी 2. लेणदेणनो ङिसाब 3. 'बिल' 4. वरने आपवानो चाटलेो, परठण	आकडा, अक, सख्या, सख्या का चिह्न लेनदेन का हिसाब बिल दहेज	number, symbol of a number accounts of money borrowed or lent bill dowry
आખ	आख	स्त्री	1. अक्षु, नेत्र 2. जेवानी शक्ति, नजर 3. ध्यान, देअरेअ 4. छोट थानु आખ जेवु नानु डारु, छिद 5. बीजनी गाठ	आँख देखने की शक्ति ध्यान, देखभाल (किसी भी चीज का आँख जैसा) छोटा सा छेद बीज की गाठ	eye sense of sight supervision, keeping an eye on small eye-like whole (of a thing) part of a seed which puts forth sprout
आगडियो	आगडियो	पु	1. आगड-दागीना, शेकड वगेरेनु जेअम लण जनाशे माणस	गहने, माल-सामान या रुपया-पैसा आदि एक स्थान से	person employed to carry valuables from

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
				दूसरे स्थान तक पहुँचानेवाला व्यक्ति	place to place
			2 विश्वास नोकर	विश्वासपात्र सेवक	trustworthy servant
આગળનાં જગ્યા	आगण (-णु)	न	घरना मुख्य द्वार सामेनी जग्या	आगण, सहन	open space in front of a house, courtyard
આગળનાં પ્રાત	आगळियात	वि	आगला धरणीनु બાળક	पहले पति की सतान	a child accompanying its mother at the time of her remarriage
આંગળી	आगळी	स्त्री	હાથપગના પગ આગળના પાચ અવયવોમાનો દરેક અવયવ	अँगुली, उगली	finger or toe
આવ	आव	स्त्री	1 ઝાળ, ભભૂંધે સખત, તાપ 2 દીપ્તિ, શોહ, રૂઆબ 3 ધમધે, ત્રાસ 4 રૂઆબ 5 ચોટ	ऑच, ज्वाला तेज, दीप्ति	blaze, bright flame, heat glamour, awe, imposing presence threat, oppression trying to impress injury
આવડું	आवडु	अ क्रि	જોરથી એકદમ ખેંચવું	जोर से एकदम खींचना	to snatch, to grab
	आवडी	स्त्री	1 તાણ, આડડી 2 હેડધે	नसों का तनाव हिचकी	spasm, convulsion hiccup

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आथण	आचळ	पु	पशुमादना आउनो अग्रभाग	(मादा पशु का) लम्बा धन	udder, teat
आण्ण	आजण	न	1 अण्ण, अण्ण 2. छेतरीपिडी, छण	अजन, ऑजन, काजल भरमाना, छल	collyrium, pigment for the eye deception, cheating
आण्णु	आजवु	अ क्रि	1 आभमा लगाडु 2. अतिप्रकाशशी आभनु तेज डरी लेवु 3 शेडमा नाभवु, आभा पाडी देवु, छड डरी देवु	ऑजना चकाचौध हो जाना चकित कर देना, प्रभावित कर देना	to apply to one's eyes to dazzle to browbeat, to make (someone else) appear pale in comparison, dazzle
आट	आट	स्त्री	1 आटी, गूथ 2 डीनो, वेर 3 शाभ, आभरु 4 डथोटी 5 डशडभमा डे पोलवा-लभवामा डोशियारी, अडम 6 अगूठा ने तर्जनी वर्येनो भाग डे ज्यथा डलम टेडवीने लभीअे छीअे 7 ताडोडियापाडु, थोट	ऑटी, गॉठ, गुत्थी कीना, बैर, प्रपच साख, आबरु हथौटी कामकाज में फुर्ती, होशियारी अंगूठे और तर्जनी के बीच का भाग जहाँ कलम टेककर लिखा जाता है, ऑटन निशानेबाजी, चोट	twist, knot grudge, vengeance prestige, credit skill fluency or ease (in manual work, or inspeaking or writing) joints of the first finger and of the thumb between which the pen is held while writing marksmanship

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
				दूसरे स्थान तक पहुँचानेवाला व्यक्ति	place to place
			2 विश्वासु नोकर	विश्वामपात्र सेवक	trustworthy servant
आगण(नशु)	आगण (-णु)	न	घरना मुख्य द्वार सामे-नी जग	आगन, सहन	open space in front of a house, courtyard
आगणियात	आगळियात	वि	आगला धाणीनु बाण्ड	पहले पति की सतान	a child accompanying its mother at the time of her remarriage
आगणी	आगळी	स्त्री	हाथपगना पण आगणना पाथ अवयवोमानो धरेड अवयव	अँगुली, उगली	finger or toe
आथ	आच	स्त्री	1 आण, लवूडो सभत, ताप 2 दीप्त, शेड, उआल 3 धमडी, तास 4 उआल 5 चोट	आँच, ज्वाला तेज, दीप्ति धमकी रोब चोट	blaze, bright flame, heat glamour, awe, imposing presence threat, oppression trying to impress injury
आथडु	आचकवु	अ क्रि	जोरशी अेकडम भेचवु	जोर से एकदम खींचना	to snatch, to grab
आथडी	आचकी	स्त्री	1 ताण, आडडी 2 डेडडी	नसों का तनाव हिचकी	spasm, convulsion hiccup

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आथण	आचळ	पु	पशुमादना आठिनो अग्रभाग	(मादा पशु का) लम्बा धन	udder, teat
आण्ण	आजण	न	1 अञ्ज, झञ्ज 2 ऐतरपिडी, एण	अजन, अँजन, काजल भरमाना, छल	collyrium, pigment for the eye deception, cheating
आण्णु	आजवु	अ क्रि	1 आपमा लग्गडवु 2 अतिप्रकाशशी आपनु तेज डरी लेवु 3 शेडमा नापवु, आपा पाडी देवु, एड डरी देवु	अँजना चकाचौध हो जाना चकित कर देना, प्रभावित कर देना	to apply to one's eyes to dazzle to browbeat, to make (someone else) appear pale in comparison, dazzle
आट	आट	स्त्री	1 आटी, गूथ 2 झिनो, वेर 3 शाप, आभरु 4 डथोटी 5 डथडममा डे जोलवा-लपवामा डोशियारी, डडप 6 अगूठा ने तर्जनी पथेनो भाग डे जया डलम डेडवीने लपुथे एथे 7 ताडोडियापण, थोट	अँटी, गॉठ, गुत्थी कीना, बैर, प्रपच साख, आबरू हथौटी कामकाज में फुर्ती, होशियारी अँगूठे और तर्जनी के बीच का भाग जहाँ कलम टेककर लिखा जाता है, अँटन निशानेबाजी, चोट	twist, knot grudge, vengeance prestige, credit skill fluency or ease (in manual work, or inspeaking or writing) joints of the first finger and of the thumb between which the pen is held while writing marksmanship

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आटण	आटण	न	(थामडी पर) धसाराणु थिडन	(चमडी पर का) चट्ठा, ऑटन	contraction of skin through constant pressure
आटी	आटी	स्त्री	1 गड, गाठ, गूथ 2 झतेल धोरनी झरती गडी	ऑटी, गॉठ, उलझन काते हुए सूत की लच्छी, ऑटी	bulge, twist, knot skein of thread
आटो	आटो	पु	1 वण, थडरावो, डेर 2 डेरु, धक्को 3 अटस	बट, लपेट, पेंच धक्का, चक्कर कहर, बैर	twist, turn short walk or trip rancour, grudge
आतरप्रतीति	आतरप्रतीति	स्त्री	अडर-मनमा थती प्रतीति	अदर-मन में होनेवाली प्रतीति	realization on the inner plane
आतरप्रातीय	आतरप्रातीय	वि	बधा प्रातो डे तेमना परस्पर सबाधने लगतु	अतर्प्रातीय, दो या अधिक प्रातों के बीच का (सबध आदि)	inter-state
आतरराष्ट्रीय	आतरराष्ट्रीय	वि	सर्वे राष्ट्रोंने डे तेमना परस्परना सबाधोने लगतु	अतर्राष्ट्रीय, दो या अधिक राष्ट्रों के बीच का, उनसे सबद्ध या उनमें प्रचलित विधान आदि	international
आतरविग्रह	आतरविग्रह	पु	अेड समूहना लोडोमा अडरअडर युद्ध, 'सिविल वार'	एक ही समूह के लोगों का आतरिक युद्ध	civil war
आंतरडु	आतरडु	न	पेटमाना अन्नरसने पथावी भणने बडार झडनार नणना आडरनो अवथव, पेटनो नण	आंत, अंतडी	intestine

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आतरवु	आतरवु	स क्रि	1. (वाड धरी डे पडडे भरीने) ग्नुडु पाडवु, पडडे भरवो 2. घेरवु 3. अटडाववु, रस्तो रोडवो	(बाड या परदे की ओट बना कर) अलग करना घेरना रास्ता रोकना	to partition, to put a screen to encircle to stop, to hold up on the way, intercept
आतरिड	आतरिक	वि	1. अडरनु 2. अतरनु, डूडयनु	आतरिक, अदर का अतर से सबधित, हृदय का	internal intimate, close to one's heart
आतरी	आतरी	स्त्री	1. धोतियु, जेंस वगेरे डापडना वगर वगेला छेडा ते 2. डोर, छेडो, पालव 3. डापड, थोपडीओभा पडती अेड ण्वात 4. वडाणनी डिनार 5. जावाना पाननी नस	कपडे या धोती की किनारी पल्ला पुस्तक, कपडे आदि में लगनेवाला कीटाणु नाव की किनारी खाने के पान की नस	unwoven thread at the ends of a dhoti or a scarf border, end, hem kind of moth found inside cloth or books ship's edge vein of a betel- leaf
आतरो	आतरो	पु	1. अतर, गाणो 2. अतरपट, पडदे 3. ग्नुडाड, डेड 4. धुपडनो बीणो भाग	अतर, फासला अतरपट, परदा भेद, जुदाई अतरा, धुपद का दूसरा हिस्सा	distance, interval screen, partition division, separation second part of <i>Dhi upad</i> (in music)
आदोलन	आदोलन	न	1. आदोलन, डोलन 2. डालवु ते, डूलवु	आदोलन, हिलना-डुलना डूलना, हिलना	undulation swinging, rocking

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 छिल्याल, जणभजाट	हलचल	agitation, commotion
			4 गतिमान (प्रेरक) तत्त्व	व्यापक सामूहिक प्रयत्न	moving force
आधणु	आधळु	वि	1 अध, न देणतु 2 विचारहीन, ज्ञानहीन 3 अधारु	अधा, जिसे दिखता न हो विचार या ज्ञानहीन अंधेरा	blind thoughtless, ignorant dark
आधी	आधी	स्त्री	1 दिशाओ धूलशी पुराए जाय अेवु सजत वावओडु 2 अधापी	धूलभरी जोर की हवा, प्रभजन अधापन	whirlwind, storm blindness
आभवु	आभवु	स क्रि	पछोथवु, पकडी पाडवु	आगे बढ़े हुए की बराबरी में आ जाना, पकड लेना	to reach, to catch up with
आबेल	आबेल	अ क्रि	अभावु, जटाए जवु	खट्टे हो जाना	to turn sour
		न	अेक टक अल्लुण जमवानु व्रत (जैन)	एक जून अल्लुण खाने का व्रत (जैन)	religious vow observed by Jains to take only that food which has no salt etc
आभो	आबो	पु	आभ्रवृक्ष, डेरानु आड	आम, आम का पेड	mango-tree
आभोए	आबोई	स्त्री	दुटीनी नीचेनी रगोनी गाड	नाभि के नीचे रगों की गॉठ जैसा अदर का भाग	navel-string
आसु	आसु	न	अश्रु आभोमाशी दुभ के उर्ध्व वजते टपकता टीपा	आँसू, अश्रु	tear
ए-अेओतेर	इ (-ए) कोतेर	वि	७१	इकहत्तर , 71	seventy-one, 71
एच्छवु	इच्छवु	स क्रि	1 एच्छा करवी 2 आशा राखवी	इच्छा करना आशा करना	to wish to hope

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઇચ્છા	इच्छा	સ્ત્રી	3 માગવું 1 મરણ, રુચિ, ખુશી	મોંગના इच्छा, रुचि	to ask for wish, inclination, willingness
ઇજન	इजन	ન	નોતરું, આમત્રણ	ન્યોતા, આમત્રણ	invitation, call
ઇજનેર	इजनेर	પુ	1 બાધકામ ઇત્યાદિની યોજના કરનાર આદમી 2 યત્રવિદ્યા જ્ઞાણનાર આદમી	इजीनियर યત્રવિદ્યા-વિશેષજ્ઞ	civil engineer technologist
ઇજાજત	इजाजत	સ્ત્રી	પરવાનગી, રજા	અનુમતિ	permit, permission
ઇજારો	इजारो	પુ	1 ઠરાવેલી શરત પ્રમાણે કોઈ હક્કનો એકલથુ ભોગવટો, ઠેકો, પટો, કરાર 2 સનદી હક	इजारा, ठेका સનદ સે મિલા હક	monopoly right by charter
ઇજ્જત	इज्जत	સ્ત્રી	1 આબરૂ 2 સ્ત્રીનું શિયળ	इज्जत, आबरू સતીત્વ સ્ત્રી કા શીલ	prestige virtue
ઇઠ્ઠોતેર	इठ्ठोतेर	વિ	૭૮	अठहत्तर, 78	seventy eight, 78
ઇઠ્યાશી(-સી)	इठ्याशी (-सी)	વિ	૮૮	अठासी, अट्ठासी, 88	eighty-eight, 88
ઇતર	इतर	વિ, અ	1 અન્ય, બીજું 2 ફાલતું, ભિન્ન 3 ક્ષુલ્લક	अन्य, दूसरा फालतू, भिन्न तुच्छ	another, else extra, apart worthless

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या को.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઇદતૃતીયમ	इदतृतीयम्	वि	ધાર્યા કરતા નવુજ-જુદુજ	कल्पना किए हुए से भिन्न	something which is quite different from, contrary to expectation something out of the ordinary
ઇધર અ-તિધર	इधर उ (-ति) धर	अ	ત્રીજુજ-અવનવુજ કઇક અહીં તહીં	तीसरा ही, अजीब-सा इधर-उधर	around here, hereabout
ઇનામ	इनाम	न	બક્ષિસ, યોગ્યતાની કદરમા મળતી ભેટ	पारितोषिक, इनाम, बखशीश	prize, reward
ઇન્સાફ	इन्साफ	पु	1 ન્યાય 2 ચુકાદો	इन्साफ, न्याय फैसला	justice judgement
ઇચળ	इचल	स्त्री	એક કીડો	एक कीड़ा, घुन	caterpillar
ઇરાદો	इरादो	पु	ઉદ્દેશ, આશય	इरादा, उद्देश्य, आशय	intention, objective
ઇલકાબ	इलकाब	पु	ખિતાબ	खिताब, पदवी	title
ઇલમ	इलम	पु	1 વિદ્યા, શાસ્ત્ર, કળા 2 જાદુ 3 ઉપાય, તજવીજ 4 મેલી વિદ્યા	इल्म, विद्या, कला जादू उपाय वशीकरण, जतरमतर	learning, science, art magic remedy, device sorcery
ઇલાજ	इलाज	पु	1 ઉપાય 2 ઉપચાર, દવા	उपाय उपचार, दवा	remedy cure, medicine
ઇલાયચી	इलायची	स्त्री	એક તેજનો	इलायची	cardamom
ઇશારો	इशारो	पु	1 ઇશારો 2 સૂચન	इशारा, संकेत इंगित	signal hint
ઇસપા-બાગોળ	इसप (ब) गोळ	न	ઊટિયુ ઊરુ	इसबगोल	spogel seed

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઇસ્કોતરો	इस्कोतरो	પુ	નાની પેટી	छोटा सद्दूक	small box or chest
ઇસ્તાપડી	इस्तापडी	સ્ત્રી	બારીબારણા ઇત્યાદિ બંધ કરવા માટે તેના ઉપર જડવામા આવતી ચાપ કે ઠેસી, 'સ્ટોપર'	सिटकिनी, स्टॉपर	stopper
ઇસ્તરી	इस्तरी	સ્ત્રી	ઇસ્ત્રી, સફાઈ અથવા કડકપણુ લાવવા માટે ઘોયેલા કપડા પર ફેરવવાનુ અગ્નિભરેલુ પાત્ર	इस्तरी, इस्तिरी	iron (for pressing clothes etc).
ઇસ્પિતાલ (-ગ)	इस्पिताल (-ग)	સ્ત્રી	(રોગીઓને રાખીને ઉપચાર કરવાનુ) દવાખાનુ	अस्पताल, दवाखाना	hospital
ઇગિત	इगित	ન	1 ઇશારો, સંકેત 2 મનોવિકારનુ બાહ્યચિહ્ન-ચેષ્ટા 3 મનની વાત	इगित, इशारा, सकेत मनोविकार की बाह्य अभिव्यक्ति मन की बात	hint, signal external indication of one's mental workings intimate secret
ઇજન	इजन	ન	એજિન	ऐंजिन, इजन	engine
ઇતેજામ	इतेजाम	પુ	બંદોબસ્ત, વ્યવસ્થા	इन्तजाम, बन्दोबस्त, व्यवस्था	arrangement
ઇમાન	ईमान	પુ, ન	1 આસ્થા, શ્રદ્ધા 2 ધર્મ, દીન 3 અત કરણ 4 પ્રમાણિકતા	ईमान धर्म अत करण प्रामाणिकता	trust, faith religion conscience honesty
ઇર્ષા(-ર્ષ્યા)	ईर्षा (-र्ष्या)	સ્ત્રી	અદેખાઈ	डाह, जलन, इर्ष्या	jealousy, envy

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઈશાન	ईशान	स्त्री	उत्तर અને पूर्व વચ્ચેની દિશા કે ખૂણો	ईशान (दिशा अथवा कोण)	north-east
ઈશ્વર	ईश्वर	पु. पु.	મહાદેવ 1 પ્રભુ, પરમેશ્વર 2 સ્વામી, માલિક 3 રાજા	महादेव प्रभु, परमेश्वर स्वामी, मालिक राजा	Lord Shiva God master, lord king
ઈસ	ईस	स्त्री	ખાટલાના પાયાને ગોડતા બે લાખા લાકડામાનુ દરેક	लकड़ी की बनी पाटी (चारपाई की)	lengthwise side-pieces of a wooden cot
ઈજવુ	ईजवु	स क्रि	1 અર્પણ કરવુ, આપી દેવુ 2. તેલ ઊજવુ 3 અગિયારીમા અગ્નિની સ્થાપના કરવી 4 અભિષેક કરવો 5 પ્રસન્ન કરવુ	अर्पण करना तेल लगाना अगियारी में अग्नि-स्थापना करना अभिषेक करना प्रसन्न करना	to offer, to surrender to oil to install sacred fire in Agiyari of the Parsis to pour oblation to propitiate
ઈટ	ईट	स्त्री	ઘર ઇત્યાદિ ચણવામા વપરાતુ માટીનુ થોસલુ	ईट	brick
ઈડુ	ईडु	न	1 બેદુ 2 શિખર પરનો કળશ	अडा मदिर का कलश	egg simacle
ઈધણ(નગ)	ईधण (- णु)	न.	ઈદન, બળતણ	ईधन, जलाने की लकड़ी	faggot, fuel
ઉકરડી	उकरडी	स्त्री	1 નાનો ઉકરડો 2. વિવાહના સમયમા કચરો-પૂગો નાખવાની જગા	कूड़े का छोटा ढेर ब्याह के अवसर पर कूड़ा-करकट डालने की जगह	small rubbish heap dumping ground for garbage etc at the time of marriage

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			3 अेड भलिन देवता	एक मलिन देवता	a God of evil cast
उकळाट(-टो)	उकळाट (-टो)	पु	1 धाम, कठारे 2 गुस्सो 3 सताप	उमस, पसीना हो वैसा मौसम गुस्सा सताप	sultry weather anger anguish
उकळो	उकाळो	पु	1 उकळायु ते 2 वनस्पति, ओसडिया के तेजानानो कापो 3 धाम, पाक्ष 4 कडापो, सताप	उबालना काढा, धनिया, लौंग आदि पानी में औटा कर बनाया हुआ पेय उमस कुढन, सताप	boiling brew of herbs and indigenous medicines etc , broth sultry weather anguish
उकेल	उकेल	पु, स्त्री	1 सूळ, समज 2 निडाल, रस्तो	सूझ, समझ हल, रास्ता	insight, grasp solution, way out
उखा(-जे)डवु	उखा (-खे) डवु	स क्रि	1 'उखडवु' नु प्रेरक- उखडे अेम करवु, चॉटेनु गुडु करवु 2 मूल जेची नाखवु 3 पदच्युत करवु, उठाडी मूडवु 4 नाश करवो	'उखडवु' का प्रेरक रूप, चिपकी हुई वस्तु को अलग करना मूलोच्छेदन पदच्युत करना नाश करना	to detach (causal form of 'उखडवु') to uproot to depose, to overthrow to destroy
उखाणु	उखाणु	न	1 समस्या, कोयडो 2 कळेवत, दृष्टात	समस्या, पहेली कहावत, दृष्टात	riddle, puzzle proverb, saying, illustrative anecdote
उगम	उगम	पु	1 मूल 2 जन्म, आरम्भ 3 उगवु ते, उदय	मूल जन्म, आरम्भ उदय, उदित होना	source birth, origin dawning, rise
उगामवु	उगामवु	स क्रि	भारवा उपाडवु	मारने के लिए उठाना	to flourish (weapon)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
उगारो	उगारो	पु	थोभासामा शता नाना छोटोनी समूह, उगारो	वर्षा में उगनेवाले नन्हे पौधों का समूह	clump of shrubs growing in monsoon
उग्र	उग्र	वि	1 आडरु, જલદ 2 क्रोधी 3 पिडाभाइ 4 જખરુ	तीव्र क्रोधी डरावना प्रबल	intense. vehement irascible, hot-tempered frightening strong-headed
उधराणी	उधराणी	स्त्री.	1 लेणानी वसूलनात 2. लेणानी मागणी, तडादी	उगाही, कर्ज वसूल करने की क्रिया तकाजा	collection of outstanding debts demand for dues
उधस	उघाड	पु	आडाश वाधणा विनानु शठ तडो नीउणे ते	आकाश खुलना, धूप निकलना	fair sunny weather following rains
उधाडु	उघाडु	वि	1 नलि ढाडेलु, नलि वासेलु, नलि पिडायेलु 2 नलि ओढेलु, पडेरेलु-नागु 3 नलि शागारेलु 4 थोभु, स्पष्ट, सरण, सौने समणाय तेपु 5 प्रकट, छडे थोड, गछेर, सौनी नजर सामे पडेलु जानगी, नलि तेपु 6 निर्लज्ज 7. अरक्षित	जो ढका हुआ, बद या भिडा हुआ न हो न पहना-ओढा हुआ, नगा श्रृंगार न किया हुआ साफ, स्पष्ट प्रकट, जाहिर	open, uncovered naked, bare unadorned, plain clear, simple public, fully in view
उधाडु पुगाडु	उघाडु पुगाडु	वि	साव उधाडु, नागुपूगु	नगधडग, नगा	quite naked, unclothed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉચાટ	उचाट	पु	1. धिता, ફિક્કર 2. અધીરાઈ	चिता, फिक्र अधीरता	worry, anxiety impatience
ઉચાપત	उचापत	स्त्री	ખોટી રીતે ઉપાડી કે ઠાણી જ્યુ તે, ઓળવવુ તે	अनुचित रीति से किसी वस्तु को उठा लेना, उडाना या हजम कर जाना	misappropriation, embezzlement
ઉચાળો	उचाळो	पु	ઘરવાખરો	घर का माल-असबाब	household furniture
ઉચિત	उचित	वि	યોગ્ય, ઘટિત	योग्य, घटित	proper, suitable
ઉચો-ઘોડવુ	उचे (-घे) डवु	स क्रि.	1. ઊંડવુ, ઊખેડવુ 2. (છાલ) ઉતારવી	उधेडना (छाल) उतारना	see 'ઉખેડવુ' to remove the skin, to peel
ઉચ્ચરવુ	उच्चरवु	स क्रि	1. ઓચરવુ, ખોલવુ 2. ઉચ્ચારવુ કે ઉચ્ચારણ કરવુ	बोलना उच्चारण करना	to speak, to utter to pronounce, to articulate
ઉચ્ચાટન	उच्चाटन	न	એક અભિચાર, (મત્રતત્રશી) ઉચાટ કરાવવો તે	तत्र के षट् अभिचारों में से एक, मत्र-तत्रादि से चित्त को उचटाना	causing anxiety to a person (by casting a spell)
ઉચ્ચાર	उच्चार	पु	મોમાશી ખોલ કાઢવો તે કે તેમ કરવાની ઢબ	उच्चारण	articulation or pronunciation
ઉચ્ચાલન	उच्चालन	न	1. ઊચુ કરવુ તે 2. વજન ઊચુ કરવાની એક યોજના, 'લીવર' 3. કપ, ધૂળારો	ऊँचा करना बोझ को उठाने की प्रक्रिया, 'लीवर' कप	raising, lifting lever quake, tremor
ઉચ્ચાવચ	उच्चावच	वि	1. ઊચુનીચુ, અણસરખુ 2. નાનુમોટુ 3. જુદા જુદા જાતનુ	ऊँचा नीचा, जो समतल न हो, ऊबड़-खाबड़ छोटा-बड़ा भौति-भौति का	uneven, unequal big and small heterogeneous, various

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉચ્છ્ર-છાગ	उच्छ (-छ)ग	पु	ઉત્સગ, ખોળો	उत्सग, गोद	lap
ઉચ્છેદ	उच्छेद	पु	જડમૂળથી ઉખાડી નાખવું તે, સમૂળો નાશ	जड से उखाडना, उन्मूलन, समूचा नाश	extermination, total destruction
ઉચ્છ્વાસ	उच्छ्वास	पु	1 શ્વાસ લેવો-મુકવો તે 2 આશા 3 પ્રકરણ, કાડ 4 જાળિયું	श्वास खीचना या छोडना, आह भरना आशा प्रकरण, काड जाली	breathing hope chapter, canto small window, ventilation
ઉછરગ	उछरग	पु	આનદ, આનદનો ઉછાળો	आनद, आनद की तरग-लहर	joy, jubilation
ઉછર્યુપાછર્યુ, (ઉછરેલ પાછરેલ)	उछर्यु पाछर्यु, (उछरेल पाछरेल)	વિ	ઊછરીને મોટું થયેલું	पालित-पोषित	grown up, come of age
ઉછળામણી	उछळामणी	સ્ત્રી	1 હરીફાઈ 2 લિલામ, હરાજી	स्पर्धा नीलाम	competition auction
ઉછાળ	उछाळ	સ્ત્રી	ઉછાળો	उछाल	leap, jump, rise
ઉછાંછળું	उछाछळु	વિ	1 અવિચારી, ઉદ્દત, તોફાની 2. લાજ વિનાનું	अविचारी, उद्धत, उहड निर्लज्ज	rash thoughtless, mischievous shameless
ઉછીતું(-નું)	उछीतु (-नु)	વિ	થોડા દિવસ પછી પાછું આપવાની શરતે આપેલું- લીધેલું (વ્યાજ ઇત્યાદિ આપ્યા વિના)	थोडे दिनों के लिए मागकर लिया या दिया हुआ	borrowed or lent
ઉછેદિયું	उछेदियु	વિ	1 વશ કે વારસ વિનાનું 2 ઉચ્છેદક	निर्वश, लावारिस उच्छेदक	heir-less one who destroys one's own progeny

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		न	निर्वशनी भिलक्षत	लावारिस (की) सपत्ति	property of one who has no heir
ઉછેર	उछेर	पु	1 ઉછેરવુ તે 2 તાલીમ, કેળવણી	पालन-पोषण तालीम, शिक्षा-दीक्षा	upbringing training, education
ઉછેરવુ	उछेरवु	स क्रि	1 પાળીપોષી મોટુ કરવુ (ઝાડ, પશુ, બાળક વગેરે) 2 સસ્કારવાળુ કરવુ, કેળવવુ તાલીમ આપવી	पालपोस कर बडा करना शिक्षा-दीक्षा देना, सस्कारी बनाना	to bring up, to rear to train, to educate
ઉજમાળુ	उजमाळु	वि	1 ઉજમવાળુ, ઉમગી 2 ઊજળુ, પ્રકાશમાન	उत्साही उज्ज्वल, प्रकाशमान	enthusiastic bright
ઉજવણી	उजवणी	स्त्री	1 ઉજવવુ તે 2 ઊજણી, જાફત	उत्सव मनाना वन-भोज	celebration feast, banquet
ઉજળિયાત	उजळियात	वि	ઉચ્ચ વર્ણનુ	उच्च वर्ण का	of upper class
ઉજાગરો	उजागरो	पु	1 જાગરણ નહિ ઊઘવુ તે 2 ચિંતા, ફિકર	जागरण चिंता, फिकर	keeping awake, going without sleep worry, anxiety
ઉજાણી	उजाणी	स्त्री	1 વન, મદિર ઇત્યાદિ સ્થળે ઊજવાતુ જમણ, વનભોજન 2 જાફત, મિજબાની	वन, मंदिर आदि में आयोजित भोज वनभोज	picnic feast, banquet
ઉજાશ(-સ)	उजाश (-स)	पु	1 અજવાળુ, પ્રકાશ 2 ઉજવળતા, તેજ	उजास, रोशनी, प्रकाश उज्ज्वलता, तेज	light, glow brightness, illumination
ઉજાળવુ	उजाळवु	स क्रि	1 ઊજળુ કરવુ	उज्ज्वल करना, चमकाना	to polish to brighten, to burnish

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2. सारु करवु, शोभाववु	सुशोभित करना, रोशन करना	to hold (a post etc) with distinction
ઉજ્જડ	उज्जड	वि	वेरान, ઊજડ	वीरान, उजाड	desolate, barren
ઉજ્જવલ (-ળ)	उज्जवल (-ळ)	वि	ઊજળુ, દેદીપ્યમાન	उजला, देदीप्यमान	bright, resplendent
ઉઝરડવુ	उझरडवु	स क्रि	નખથી કે ધારવાળા હથિયાર કે કશાકથી ઘસરડાને ઊખાડવુ	नोचना, खरोचना, रगडकर उज्ज्वल करना	to scratch, to tear off (with nails etc)
ઉઝરડો	उझरडो	पु	1. ઊઝરડાવાથી થતો કોઈ લિસોટો 2. શરીર ઉપર નખ, કાટા વગેરેનો લિસોટો	रगडने से होने वाला निशान, रगड खरोच	scratch laceration
ઉટ(-ટા)ગ	उट (-टा) ग	वि न	1. ઉટપટાગ, આધાર વગરનુ, તરગી 2. આધાર વગરની વાત, ગપ્પુ તરગ, બુદ્ધો	ऊटपटाग, असगत निराधार बात, गप्प तरग, मन की मौज	fantastic, baseless tall talk, hoax whim, brain- wave
ઉઠમ (-વા) ણ	उठम (-व) णु	न.	(ઊઠવુ) (મરણનુ) બેસણ	मृतक के शोक की बैठक, उठावनी, मातमपुरसी	a ritual to be performed during the period of mourning
ઉઠાવગીર	उठावगीर	वि	નજર ચુકાવી પારકી વસ્તુ ઊઠાવનારુ, ચોરનારુ	उचक्का, पराई वस्तु को उठाने या चुरा लेने वाला	given to pilfering, stealing, rogue
ઉઠાવ	उठाव	पु	1. ઊઠવુ-ઊપસવુ તે 2. દેખાવ, ભભક	उठाव, उभार दिखावा, तडकभडक	lifting, swelling bright appearance, glamour

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 ઉપાડ, ખપત 4 ઊંચાઈ 5 કલ્પના, બુદ્ધી	खपत, बिक्री ऊँचाई कल्पना	demand height fancy, whim
ઉઠાંતરી	उठातरी	સ્ત્રી.	ચાલ્યા જવું તે	चलते बनना, चम्पत होना	abrupt departure, going away
ઉડાઉ	उडाउ	વિ	1 ઉડાવનારુ, ઉડાવે એવું 2 અતિ ખર્ચાળ, અવિચારી ખર્ચ કરનારુ	उडाऊ फिजूलखर्च	extravagant, spendthrift one who spends indiscriminate- ly
ઉડાવવું	उडाववु	સ.ક્રિ	1 ઊડે એમ કરવું, થગાવવું 2 વાપરી નાખવું, વેડકી નાખવું, બરબાદ કરવું 3 (વાત, ગપ ઇ) ફેલાવવું 4 જવાબમાં ચાલાકી કરવી, આડવાતમાં થડાવવું 5 મજાક કરવી 6 રદ-નપાસ કરવું	उडाना (पतंग) उडा देना, खर्च कर डालना, बरबाद करना (अफवाह) उडाना या फैलाना जवाब में चालाकी करना, चकमा देना मजाक करना फेल करना (परीक्षा में)	to fly (a kite) to squander, to throw away to spread (rumour etc) to evade, to side-track to fool, to poke at to cancel, to reject
ઉડું	उडु	પુ	1 તારો 2 ગ્રહ 3 નક્ષત્ર	तारा ग्रह नक्षत्र	star planet constellation
ઉઠા-ઢેરું	उठा (-ढे) णु	ન.	માથા પર વજન ઊંચકતી વખતે વચ્ચે મૂકવામાં આવતો	ईडुरो, बिडई	round of cloth which serves as a cushion in

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			ભૂગડા ઇત્યાદિનો વીંટો		carrying a weight on the head
ઉતરડ	उतरड	स्त्री	વાસણ ઉપર વાસણ—ખાસ કરીને એક એકથી નાના—એવી ગોઠવણી	एक पर एक रखे हुए छोटे-बड़े घड़े	pots arranged one above the other in a pyramidal fashion
ઉતરડવુ	उतरडवु	स क्रि	1 ઉતરવુ, સીવણ ઉકેલવુ, ટાકા તોડી જુદુ કરવુ 2 (છાલ-ચામડી ઇ) ઉતારવી	उधेडना छाल, चमडी खीचना	to remove stitches to peel off, skin
ઉતરાણ	उतराण	स्त्री	1 મકરસંક્રાતિ 2 એ દિવસે પળાતો તહેવાર	उत्तरायण, मकर संक्राति उस दिन का त्यौहार	Sun's northward passage towards the tropic of Capricorn Hindu holiday falling on that date (generally on the 14th of January)
		न	ઉતાર, ઉતરણ	उतार, वह जगह जहाँ से चलकर नदी पार की जा सके	descent
ઉતારુ	उतारु	पु	1 પ્રવાસી, મુસાફર 2 ઉતારો કરનાર (વીશી-ધર્મશાળાના ઉતારુઓ)	प्रवासी, मुसाफिर, यात्री (सराय आदि में) उतरने या ठहरने वाला	passenger, traveller traveller putting up at an inn etc

	का.	अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
	पु, न	1 जवाब, पूछ्या डे कथ्य सामे कडेपु ते, रदियो 2 अथापनु कथन	सफाई के लिए दिया गया जवाब, बचाव सफाई का ब्यान	rejoinder
उत्तरीय	न	3 दिशा	उत्तर दिशा	defence (in argument) the North
उत्तरोत्तर	अ	उपवस्त्र वधारे ने वधारे, दिवसे दिवसे, क्रमशः	उपवस्त्र उत्तरोत्तर, अधिकाधिक, क्रमश	scarf, upper garment progressively, successively
उत्तान	वि	1 चतु 2 पछेणु पथराथेनु 3 छीछरु	चित, कमर के बल सीधा कमर पर सोना विस्तार या फैलाया हुआ छिछला	lying flat on the back, supine far-flung shallow
उत्तीर्ण	वि	1 तरी पार ओतरेनु 2 (परीक्षामा) पास थथेनु	तैर कर पार उतरा हुआ (परीक्षा) में सफल हुआ	that which has crossed over successful (in examination etc)
उत्तेजक	वि	1 उत्तेजन आपे अेपु 2 उत्साह-छोश प्रेरे अेपु 3 जलद, उदीपक	उत्तेजक, उत्तेजना देनेवाला उत्साहवर्धक	inciting stimulating, encouraging intoxicating
उत्तेजित	वि	1 उत्तेजन डे उदीपन पामेनु 2 उश्केशथेनु	उद्दीपक उत्तेजना या उद्दीपन प्राप्त क्रोधित	stimulated, excited agitated

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
उत्थान	उत्थान	न	1 ठीठपु-ठीठा थपु ते 2 ठीगपु ते 3 उदय, जागृति 4 उत्साह, निराशा छोडी करी करी प्रयत्न करयो ते 5 टेको, मदद	उठना उगना उदय, जागृति उत्साह सहारा, मदद	getting up, rising to one's feet rising awakening zest, renewing one's efforts support, aid
उत्पत्ति	उत्पत्ति	स्त्री	1 पैदाश 2 जन्म 3 मूल	उत्पत्ति, पैदाइश जन्म मूल	produce birth source
उत्पन्न	उत्पन्न	वि	1 जन्मेले 2 नीपण्हेले, अनेले	जन्मा हुआ पैदा या तैयार किया हुआ	born produced
उत्पल	उत्पल	न	कमल	कमल	lotus
उत्पात	उत्पात	पुं	1 छूएपु ते 2 तोक्षण, धाधल 3 आपत्तिनु थिखन 4 विनाशकारक आपत्ति	छलाग धौधल, उत्पात विपत्तिसूचक घटना विनाशकारक विपत्ति	jumping up mischief, rampage sign of upheaval catastrophe
उत्पादक	उत्पादक	वि	उत्पन्न-पैदा करनारु	पैदा करनेवाला	that which produces
उत्पादन	उत्पादन	न	1 उत्पन्न करपु त 2 पैदाश, उत्पत्ति 3 इण	उत्पन्न करना उपज फल, लाभ	production income output reward
उत्प्रेक्षा	उत्प्रेक्षा	स्त्री	1 धारणा, कल्पना 2 अेक अलंकार	अनुमान, धारणा अर्थालंकार का एक भेद	guess, fancy a figure of speech

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉત્સર્ગ	उत्सर्ग	पु	1 તજી દેવુ તે, ત્યાગ 2 સમર્પણ 3 શરીરમાંથી મળમૂત્રાદિ કાઢવા તે 4 સામાન્ય લાગુ પડતો કાયદો કે નિયમ (અપવાદથી ઊલટું)	त्यागना, छोडना समर्पण मल-मूत्रविसर्जन सामान्य नियम (अपवाद का उलटा)	giving up renunciation evacuation of bowels rule (as against exception)
ઉત્સવ	उत्सव	पु	1 આનંદનો દિવસ, તહેવાર 2 આનંદનો મેળાવડો, ઓચ્છવ	आनद का दिन, त्यौहार आनद का मिलन या कार्य	holiday, day of festivity festive gathering
ઉત્સાહ	उत्साह	पु	1 હોશ, ઉમગ 2 આનંદ, હર્ષ 3 ખત 4 વીર રસનો એક સ્થાયી ભાવ કે દૃઢતા	उमग, हौसला आनद, हर्ष लगन, तदेही, धैर्य वीर रस का स्थायी भाव	enthusiasm, energy joy, jubilation perseverance a shade of heroic sentiment (in poetics)
ઉથાપ	उथाप	पु	1 ઉથાપવું-ઉલટાવવું તે 2 સામી થાપ 3 આજ્ઞાનું ઉલ્લઘન	बदलना या हटा देना उलटना-पलटना आज्ञा का उल्लघन करना	removal reaction, counter stroke defying an order
ઉદય	उदय	पु	1 ઊગવું તે 2 ઉન્નતિ 3 પ્રાગટ્ય, ઉદ્ભવ 4 (જૈન) કર્મોનું ફળ દેવા તત્પર થવું તે	उगना उन्नति प्राकट्य, उद्भव (जैन) कर्मों का फल देने में तत्पर होना	dawning, rising rise, promotion birth, manifestation term denoting the fruits of past <i>karmas</i> (in Jain philosophy)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉદર	उदर	न	1 पेट 2 गर्भाशय 3 બખોલ 4 પોલાણ 5 અદરનો ભાગ 6 આજીવિકા	उदर, पेट गर्भाशय कोटर खोखला भाग अदर का भाग आजीविका	belly, stomach womb hollow cavity interior livelihood
ઉદાસ	उध (-ध) रावो	पु	चिंता, ઉચાટ	चिंता, परेशानी	worry, anxiety
ઉદાત્ત	उदात्त	वि	1 ઉચ્ચ, ઉન્નત 2 ઉદાર, સખી દિલનુ, દાતાર 3 ઊંચા સ્વરવાળુ સ્વરના ત્રણ ભેદોમાંનો પ્રથમ ભેદ	ऊँचा, उच्च, उन्नत उदार, दातार ऊँचा (स्वर) स्वर के तीन भेदों में से एक	exalted, sublime generous, large hearted loud a musical term denoting the first of the three divisions of sound
ઉદાર	उदार	वि	1 સખી દિલનુ, દાનશીલ, ત્યાગશીલ 2 ખુલ્લા મનનુ, નિખાલસ, સરળ	दानशील, दिलवाला खुले दिल का, सरल	generous, bountiful liberal, candid, open-minded
ઉદાસ	उदास	वि	1 નિરપેક્ષ, તટસ્થ, બેફિકર 2 વૈરાગી, વિષય તરફ અપ્રીતિવાળુ 3 ગમગીન, ખિન્ન	तटस्थ, निरपेक्ष, निश्चिन्त विरक्त, वैरागी उदास, गमगीन	objective, detached indifferent, one without attachment sad, depressed
ઉદાહરણ	उदाहरण	न	દાખલો, દૃષ્ટાંત	उदाहरण, 'मिसाल, दृष्टान्त	example, illustration
ઉદાહૃત	उदाहृत	वि	1 શહેવાયેલુ	वर्णित, कथित	reported, narrated

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
उदित	उदित	वि	2 नाम दएने बोलायेलु 3 दृष्टातरुपे अपायेलु	जिसे नाम लेकर पुकारा गया हो जिस का दृष्टात दिया गया हो	called by name quoted as an example
उदघाटन	उदघाटन	न	1 उगेलु 2 ખીलेलु 3 જાગृत 4 ચળકતુ, પ્રકાશવતુ 5 બોलेलु 6 જન્મેलु	उगा हुआ खिला हुआ जागृत चमकता हुआ, चमकीला कथित जन्मा हुआ उदघाटन, चाबी आदि से खोलना	arisen in bloom awakened shining spoken born inauguration
उद्दाम	उद्दाम	वि	1 ખોલવુ તે, કૂચીથી ઉઘાડવુ તે, પહેલપ્રથમ ખોલવુ તે 2 સ્પષ્ટ કરવુ -સમજાવવુ તે 3 ઉઘાડવાનુ સાધન (કૂચી વ.)	स्पष्ट करना, समझना खोलने का साधन (कुजी वगैरह) बिना अकुश या बधन, निरकुश स्वच्छद, उच्छृखल उग्र	explication, understanding means to open (key etc) unrestrained self-willed
उद्दिष्ट	उद्दिष्ट	वि	1 અકુશ કે બધન વિનાનુ 2 સ્વચ્છદ, ઉચ્છૃખલ 3 ઉગ્ર, જહાલ	बताया हुआ अभिप्रेत, सम्बोधित सोचा या चाहा हुआ उद्दीपक, उत्तेजित करनेवाला जलाना	radical directed addressed intended
उद्दीपक	उद्दीपक	वि	1 ખતાવેલુ 2 ઉદ્દેશાયેલુ, સબોધાયેલુ 3 ધારેલુ, ઇચ્છેલુ	उद्दीपन करना, उत्तेजित करना	stimulating, exciting
उद्दीपन	उद्दीपन	न	1 સળગાવવુ-પ્રજ્વલિત કરવુ તે	जलाना	kindling

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ઉશ્કેરણી	उत्तेजित करना, भडकाना	incitement, provocation
			3 ઉત્તેજના	उत्तेजना	excitement
			4 ઉદ્દીપન વિભાવ	उद्दीपन विभाव	one of the <i>vibhavas</i> (in poetics)
ઉદ્દીપિત	उद्दीपित	वि	ઉદ્દીપિત કરે લુ	उद्दीपित किया हुआ	stimulated
ઉદ્દેશ	उद्देश	पु	1 હેતુ, ધારણા, ઇરાદો	उद्देश्य, हेतु, इरादा	intention, object, motive
			2 ઉલ્લેખ, નામ દઈ બતાવવુ તે કહેવુ તે	सकेत या लक्ष्य करना	stating a thing by its name
			3 ઉદાહરણ	उदाहरण	illustration
			4 પ્રશ્ન-વિચાર, તપાસ, શોધન	छान-बीन	scrutiny, examination
ઉદ્દાર	उद्धार	पु	1 મુક્તિ, મોક્ષ	मुक्ति, मोक्ष	liberation, salvation
			2 છૂટકારો	छुटकारा	release
			3 સારી સ્થિતિ થવી તે	अच्छी स्थिति होना	recovery, uplift
ઉદ્દૂત	उद्धृत	वि	1 અવતરણ તરીકે લીધેલુ	अवतरण के रूप में चुना हुआ	quoted
			2 ઉદ્દારણ કરેલુ	बचाया हुआ	absolved, saved
ઉદ્ભવ	उद्भव	पु	1 જન્મ, ઉત્પત્તિ, પેદાશ	जन्म, उत्पत्ति, पैदाइश	birth, rise
			2 મૂળ	मूल	origin, source
ઉદ્યત	उद्यत	वि	1 ખતીલુ, ઉદ્યમી	लगनवाला, उद्यमी	hard-working, industrious
			2 નિશ્ચયવાળુ, તત્પર	कृतनिश्चयी, तत्पर	determined, bent on
ઉદ્યમ	उद्यम	पु	1 યત્ન, મહેનત	उद्यम, श्रम, यत्न, मेहनत	effort, labour

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉદ્યાન	उद्यान	पु, न	2 ઉદ્યોગ, ધંધો બગીચો, વાડી	उद्योग	occupation, industry
ઉદ્યોગ	उद्योग	પુ	1 ધંધો, શેઠગાર 2 કામ 3 મહેનત	बगीचा, उपवन, बाग	garden, park
ઉદ્દેક	उद्देक	પુ	1 વધારો, પુષ્ટતા, અતિશયતા 2 થકિયાતાપણ	धधा काम महेनत	occupation work industry, labour
ઉદ્વિગ્ન	उद्विग्न	વિ	2 થકિયાતાપણ વ્યાકુળ, ખિન્ન, દુખી	बढ़ती, इफरात, अतिशयता, उद्देक	excess, increase, abundance preponderance
ઉદ્વેગ	उद्वेग	પુ	1 વ્યાકુળતા, ગભરાટ 2 ચિંતા	વ્યાકુલ, खिन्न, दुखी	anxious, perturbed, miserable
ઉધકિયુ	उधकियु	વિ	1 ઉધકુ શખેલુ-આપેલુ કામ 2 ઉધકુ કામ કરનારુ	વ્યાકુલતા, घबराहट चिन्ता	anxiety, stress
ઉધમાત	उधमात	પુ	3 બેપરવાઈથી કરેલુ	थोक में लिया हुआ काम	worry work undertaken wholesale one who undertakes work on this basis
ઉધરસ	उधरस	પુ સ્ત્રી	તોફાન, મસ્તી, ઉત્પાત ઉદરસ, ઠાસો, કફ, ખાસી	थोक में काम करने वाला, निश्चित दाम पर पूरा काम करने वाला लापरवाही से किया हुआ ऊधम, उत्पात खॉसी	done carelessly mischief cough

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉધામો	उधामो	पु	1 પ્રયત્ન 2 વલખુ, ધમપછાડો	प्रयत्न मिथ्या दौड़-धूप, महाप्रयत्न	attempt frantic effort, fruitless effort
ઉધાર (-રુ)	उधार (-रु)	वि	1 પૈસા આપ્યા વિના નામે લખાવીને, દેવા કરી લીધેલું કે આપેલું 2 ભરપાઈ નહિ થયેલું એવું 3 નિકૃષ્ટ	उधार, ऋण पूरे दाम न दिया हो वैसा निकृष्ट	borrowed due base
ઉધેઈ	उधेई	स्त्री	ઉધઈ, જમીનમા અધારામા રહેતું એક જીવડું	दीमक	white-ant
ઉનાળો	उनाळो	पु	ફાગુણથી જોઈ માસ સુધીનો ગરમીનો સમય	फागुन से जेठ महीने तक का समय	summer
ઉન્નત	उन्नत	वि	1 ઊંચું 2 ટટાર 3 ઉન્નતિવાળું	उन्नत, ऊँचा सीधा, तना हुआ उन्नतिशील	raised, high erect, taut one which has risen
ઉન્મત્ત	उन्मत्त	वि	1 ગાડું, ભાન વગરનું 2 કેફી, છાકટું 3 ક્રોધી 4 અહકારી, ગર્વિષ્ટ 5 ઉદ્વૃત	उन्मत्त, पागल नशेबाज क्रोधी अहकारी उद्वत	mad, insane drunk, intoxicated hot-tempered haughty insolent
ઉન્માદ	उन्माद	पु	1 ઘેલછા, ગાડપણ 2 તોર, મદ 3 એક રોગ, સનેપાતનો એક પ્રકાર	उन्माद, पागलपन मद, अभिमान एक रोग, सन्निपात का एक प्रकार	madness, insanity pride, insolence delirium, a type of disease

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
उन्मार्ग	उन्मार्ग	पु	4 तोड़ना 1 जोटो के उधो रस्तो	शैतानी गलत या उल्टा मार्ग	mischief wrong path or contrary way
उन्मुख	उन्मुख	वि	2 कुमार्ग, अनैतिनी मार्ग 1 ठिया मुजवाणु, ठिये जेतु 2 आडु जेतु, नाराज 3 तत्पर, तैयार 4 आतुर, राडु जेतु	कुमार्ग, अनैति का मार्ग ऊँचे मुखवाला नाराज तत्पर, तैयार	evil course having the face lifted up, looking up looking in the other direction, displeased intent on, prepared for expectant, looking forward to
उन्मूलन	उन्मूलन	न	जडमूलशी अढी नाणपु ते, निकदन	जडमूल से निकालना, निकदन	uprooting, wiping out, extermination
उन्मेष	उन्मेष	पु	1 पलडासे, आजनी उधासवास 2 प्रकटीकरण, स्फुरण	उन्मेष, खुलना बंद होना (आँख का) प्रकटीकरण, स्फुरण	wink of an eye
उपकार	उपकार	पु	3 विकास 1 भलु करपु ते, डल्याण 2 मडे, सहाय	विकास भलाई मदद, सहायता	manifestation, revelation, visionary flash goodness assistance
उपकृत	उपकृत	वि	3 पास आभार	आभार	support favour, obligation
				जिसके साथ उपकार किया गया हो, कृतज्ञ, आभारी	obliged, indebted

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઉપક્રમ	ઉપક્રમ	પુ	1 આરભ, શરૂઆત 2 પાસે-આગળ આવવું તે 3 યોજના 4 ખત, ઉદ્યોગ	પ્રારમ, શરૂઆત નિકટ યા આગે આના યોજના, અનુષ્ઠાન ઉદ્યોગ, તૈયારી	beginning, commencement advance, approach plan perseverance, industry
ઉપગ્રહ	ઉપગ્રહ	પુ	1 મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો ચંદ્ર જેવો નાનો ગ્રહ 2 આકાશમા આવેલા નાના ગ્રહોમાનો દરેક	છોટા ગ્રહ, બડે ગ્રહ કે ચારોં ઓર ફિરનેવાલા છોટા ગ્રહ અપ્રધાન ગ્રહ	satellite asteroid
ઉપચાર	ઉપચાર	પુ	1 સારુ કરવા જે ઉપાય- સારવાર, ઓસડ-વેસડ ઈત્યાદિ કરવા તે 2 શરીરે ચદન ઈત્યાદિ ચોપડવું તે 3 પૂજાવિધિ, ક્રિયાકર્મ, સસ્કાર 4 સાધન, સામગ્રી 5 માનપાન, સેવાચાકરી 6 બીજાને ખુશ કરવા કરેલું મિશ્યા કથન 7 લક્ષણા દ્વારા અર્થબોધ થવો તે	ઇલાજ, તીમારદારી, સુશ્રૂષા શરીર પર ચદન ઈત્યાદિ મલના સસ્કાર, પૂજા વિધિ સાધન, સામગ્રી સન્માનિત કરના, સેવા-ચાકારી ખુશામદ લાક્ષણિક અર્થ	medical treatment applying sandal wood paste etc to the body any of the details of idol- worship, ritual means. properties liberal or warm reception, service flattery comprehension through lakshana (in poetics)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
उपजाऊ	उपजाऊ	वि	1. उपज कराना, उत्पादक 2. क्षुद्रप, रसाण	उपजाऊ, उत्पादक	productive
उपजिह्वा	उपजिह्वा	स्त्री	जुभना मूण पासेनी नानी जुभ	उर्वर, जिसमें अच्छी उपज हो	fertile, rich
उपडामणी	उपडामणी	स्त्री	उपाडवानु मडेनताण	जीभ के मूल के निकट छोटी जीभ	uvrula or soft palate
उपणियु	उपणियु	न	उपणवानु साधन-टोपलो, सूपकु जे छेय ते	उठाने का मेहनताना	wages for lifting or carrying weight
उपदेश	उपदेश	पु	1 शिक्षण 2 बोध, शिजाभाण, सलाह 3 पाडोशीदेश	ओसाने का साधन-टोकरा, छाज आदि	tool for winnowing a basket, a plate etc
उपद्रव	उपद्रव	पु	1 पणवणी 2 छण, पीडा 3 त्रास, उपाधि 4 सकट, आपध	शिक्षा, सीख, नसीहत सलाह, बोध	teaching, instruction precept, advice
उपभोग	उपभोग	पु	1 भोगवटो 2 अनुभव 3 लखवो 4 भाणवु-मण लेवी ते	पडोसी देश त्रास चोट, पीडा गडबड	neighbouring country pest injury pain nuisance, harassment calamity, misery
उपयुक्त	उपयुक्त	वि	1 भोगवटो 2 अनुभव 3 लखवो 4 भाणवु-मण लेवी ते	सकट, विपत्ति उपभोग अनुभव विशिष्ट प्रकार का सुख मजा लेना	possession experience special pleasure enjoyment
			1 अरोपर, छाणतु, थोअ्य, अधवेसतु	उपयुक्त, योग्य, उचित, वाजिब	proper, suited, appropriate

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉપયોગ	उपयोग	पु	2 ઉપયોગી 1 કામ, વાપર, વપરાશ 2 ખપ, જરૂરિયાત 3 (જૈન) ધ્યાન, સાવધેતી	उपयोगी काम, व्यवहार, प्रयोग आवश्यकता, जरूरत (जैन) ध्यान, सावधानी	useful use, usage, application need, requirement care, attention (in Jain terminology)
ઉપરચોટિયુ, ઉપરછલુ(-લ્લુ)	उपरचोटियु, उपरछलु (-ल्लु)	वि	છીછરુ, ઉપલકિયુ	ऊपर-ऊपर का, छिछला	superficial, shallow
ઉપરટપકે	उपरटपके	अ	1 ઉપર, ઉપરથી 2 ચોપડામા રીતસર લખ્યા વિના	ऊपर-ऊपर हिसाब-बही में चढ़ाये बिना	outwardly without entering into the account books
ઉપરણ	उपरणु	न	ઉપર ઓઢવાનુ વસ્ત્ર, ઓઢણી, ખેસ, પિછોડી, અગવસ્ત્ર	उपवस्त्र, दुपट्टा	scarf, upper garment
ઉપરવટ	उपरवट	स्त्री	1 અનધિકાર ઉપરીપણ દાખવવુ તે 2 ઉલ્લઘન, અવગણના	अनधिकार, बडे अधिकारी का भाव दिखाना उल्लघन, अवहेलना	imposing oneself over others without any authority transgression, defiance
ઉપરવાડ	उपरवाड	स्त्री	1 ઘર, ફળિયુ કે ગામની નજીકનો ભાગ, પરવાડ 2 ઘરની વાડ-સીમાત, દીવાલની બે બાજુનો ભાગ	घर, मुहल्ले या गाँव के नजदीक का भाग चहारदीवारी के दोनों ओर का भाग	region adjoining to a house, a locality or a village boundary-wall

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉપરવાસ	उपरवास	न	पवन के पारशीना वलननी વિરુદ્ધ દિશાએ, ઉપલે ભાગે	पानी या पवन के बहाव के सामने या विरुद्ध रहना	upper region, catchment area
ઉપરાઉ (-છા) પરી	उपराउ (-छा) परी	अ	એક પછી એક, લાગલાગટ	एक के बाद एक, लगातार	one after the other, continuous
ઉપરાણ(-ળુ)	उपराणु (-ळु)	न	પક્ષ લેવો તે, તરફદારી	पक्ष लेना, तरफदारी	taking side with, vindication
ઉપરામ	उपराम	पु	1 ઉપરમ, નિવૃત્તિ 2 વિરામ, અટકવું તે 3 સન્યાસ 4 મૃત્યુ	निवृत्ति विराम सन्यास मृत्यु	retirement ceasing, stopping renunciation death
ઉપરામણી	उपरामणी	स्त्री	તકાવત, ઠરાવેલી કિંમતથી ઉપરનું જે હોય તે	दो वस्तुओं की अदला बदली में ऊपर से अदा की गई रकम, फर्क	excess, difference to be paid while making a bargain of two articles or things
ઉપા-કુશટુ	उप (-फ) राटु वि	वि	1 પાસાભેર એવું 2 બાજુ ઉપરનું, સામેનું 3 ઉભું 4 અવળું, ઊંધું	दूसरी दिशा में है वैसा समुख, विरोधी खडा उल्टा	sideways alongside, opposite vertical reverse, inverted
ઉપરાત	उपरात	अ	1 વધારે, વિશેષમા 2. સિવાય, વળી બીજું 3 પછી, ઉપરથી	ज्यादा, अधिक अतिरिक्त, सिवा पश्चात्, पीछे	in addition besides over and above
ઉપરી	उपरी	पु	ઉપરનો અધિકારી	ऊपर का अधिकारी	superior, senior officer

गिजगती शब्द	देवनागरी	लिप्यंतरण	व्या. को.	गिजगती	हिंदी पक्ष	अंग्रेजी पक्ष
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण-अपूर्ण	उपपूर्ण, अपूर्ण	as mentioned above, aforesaid
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	superficial
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	supernumerary, extra
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	not entered in the account-
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	books
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	gained, obtained
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	gathered, known
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	obtainable
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	commendable, respectable
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	upper, higher
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	upper part or side
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	garden, orchard
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	scarf, upper garment
अपुर्ण	उपपूर्ण	उपपूर्ण	लि	उपपूर्ण, अपूर्ण	उपपूर्ण, अपूर्ण	denying food and other pleasures of the senses to oneself in accordance with a religious vow

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
उपवीत	उपवीत	न	2 न जावु ते—अनशन જનોઈ	निराहार, अनशन उपवीत, यज्ञोपवीत, जनेऊ	fasting sacred thread
उपशम	उपशम	पु	1 शात पडवु-विराम लेवो ते, शमवु ते 2 शाति, निवृत्ति	शमन, शात होना शाति, निवृत्ति	subsiding, abetting peace, tranquillity
उपसर्ग	उपसर्ग	पु	3 सात्वना 1 रोग, भादगी 2 आइत, ઈજા 3 अपशुकुन, મરણચિહ્ન	सात्वना रोग, बीमारी आफत अपशकुन	relief, solace disease, illness mishap, injury bad omen, symptom suggestive of death
			4 દેવ અને મનુષ્ય વગેરે તરફથી કનડગત	देव, मनुष्य आदि द्वारा प्रदत्त कष्ट	harassment from man or God
			5 ધાતુઓ કે ધાતુ ઉપરથી બનેલો નામની આગળ જોડાતો અને તેમના મૂળ અર્થમાં વિશેષતા આણતો શબ્દ કે અવ્યય	उपसर्ग, धातु सज्ञा आदि के पूर्व जुंडकर विशेषता उत्पन्न करनेवाला शब्द या अव्यय	prefix
उपसहार	उपसहार	पु	1 એકત્ર કરવુ તે 2 સારાશ	एकत्र करना साराश	gathering up synopsis, resume
			3 ટૂંકામાં આટોપી લેવુ તે	थोड़े में दिया गया साराश	summing up, conclusion
उपस्थित	उपस्थित	वि	1 નજીક ઊભેલુ, હાજર, રજૂ	निकट बैठा हुआ, हाजिर, मौजूद, प्रस्तुत	present

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 आવી पडेले	आगत, आया हुआ	having come fortuitously
			3 બનેલુ	घटित	having taken place
			4 જ્ઞાત, પ્રાપ્ત	ज्ञात, प्राप्त	known, obtained
ઉપહાર	उपहार	पु	1 ભેટ, બક્ષિસ	नजर, सौगात, उपहार, इनाम, बखशीश	present, gift
			2 પૂજનો સામાન	पूजा का सामान	items used for <i>puja</i> ceremony
			3 લવાજમ	चदा, सदस्यता शुल्क	subscription
ઉપહાસ	उपहास	पु	મજકરી, ઠેકડી	हँसी, ठट्ठा	ridicule, derision, mockery
ઉપાડ (-ડો)	उपाड (-डो)	पु	1 ઉપસાટ, સોજો	फैलाव, सूजन	rising, swelling
			2 ભરાઉપાણ	मोटापा	fullness
			3 જીરુસો, આવેશ	जोश, आवेश	vehemence, impulse -
			4 આરભ	आरभ	beginning
			5 કોશિશ, પ્રયત્ન	कोशिश, यत्न	effort, attempt
			6 મૂકેલા નાણામાથી પાછુ લેવુ તે, પાછી લીધેલી રકમ	जमा रकम में से वापस लेना, वापस ली हुई रकम	withdrawing money, amount withdrawn
			7 ખપત, ઉઠાવ, માગ	मॉग, विक्रय, उपभोग	demand, sale, consumption
ઉપાધિ	उपाधि	સ્ત્રી	1 પીડા, આપદા	पीडा, आपदा	source of trouble, affliction
			2 જજળળ, પચાત, ચિતા	झझट, चिता	liability, botheration, worry

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 चिह्न, सज्ञा 4 भास लक्षणा, गुणधर्म	चिह्न, सज्ञा विशेष लक्षण, गुणधर्म	sign, mark essential quality
			5 पदवी, 'डिग्री'	उपाधि, 'डिग्री'	degree, award
			6 ખિતાબ, ઇતિહાસ	खिताब	title
			7 અટક, ઉપનામ	जातिनाम, उपनाम	surname, epithet
ઉપાધ્યાય	उपाध्याय	पु	1 શિક્ષક, અધ્યાપક 2 પુરોહિત, ગોર 3 બ્રાહ્મણોની એક અટક	शिक्षक, अध्यापक पुरोहित ब्राह्मणों की एक उपजाति की उपाधि	teacher, preceptor family priest surname among Brahmins
ઉપાય	उपाय	पु	1 ઇલાજ, યુક્તિ 2 સાધન, રસ્તો 3 ચિકિત્સા, ઉપચાર, પ્રયોગ 4 આરંભ, શરૂઆત	उपाय, इलाज, युक्ति साधन चिकित्सा, उपचार आरंभ, शुरूआत	remedy, trick means, way out diagnosis, cure, treatment beginning, start
ઉપાર્જન	उपार्जन	न	1 મેળવવુ તે, પ્રાપ્તિ 2 કમાઈ	उपार्जन कमाई	gaining, acquisition earning
ઉપાલભ	उपालभ	पु	ઠપકો	उपालभ, उलाहना	admonition
ઉપાશ્રય	उपाश्रय	पु	1 અપાસરો 2 આશ્રયસ્થાન	जैन साधुओं के रहने का स्थान आश्रय-स्थान	resort of the Jain <i>munis</i> (1 e monks) resting place
ઉપાસના	उपासना	स्त्री	1 આરાધના, સેવા ભક્તિ 2 ધ્યાન ઇત્યાદિ દ્વારા ઇષ્ટદેવનું ચિંતન વગેરે	सेवा, आराधना, भक्ति ध्यान आदि के द्वारा इष्टदेव का चिंतन	worship, act of propitiation, devotion religious meditation

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૩ તીર ફેડવાનો અભ્યાસ કરવો તે	ઉપાસન, શરાભ્યાસ	study of archery
ઉપાસવું	ઉપાસવું	સ ક્રિ	આરાધવું, સેવાપૂજા કરવી	ઉપાસના કરના, સેવાપૂજા કરના	to worship, to propitiate
ઉપાહાર	ઉપાહાર	પુ	નાસ્તો	જલપાન, નાશતા	light refreshment
ઉપેક્ષા	ઉપેક્ષા	સ્ત્રી	૧ અનાદર, તિરસ્કાર ૨ ત્યાગ ૩ અનપેક્ષા, ઉદાસીનતા ૪ બેદરકારી	ઉપેક્ષા ત્યાગ ઉપેક્ષા, ઉદાસીનતા લાપરવાહી	disrespect, contempt rejection disregard, indifference negligence
ઉપોદ્ઘાત	ઉપોદ્ઘાત	પુ	૧ આરંભ ૨ પ્રસ્તાવના	ઉપોદ્ઘાત, આરંભ ભૂમિકા	beginning preface, foreword
ઉબાડિયું	ઉબાડિયું	ન	[એક છેકેશી બળતું ને હાથમા લીધેલું] બળતું પાતળું લાકડું કે સાઠી, સળેકડું, ખોરિયું	લુઆઠી, લૂકા, જલતી લકડી આદિ	firebrand
ઉબાવું	ઉબાવું	અ ક્રિ	ફૂગવાળું બનવું, ફોવાવું	ફફૂંદી જમના, સડના	to go mouldy, to be decomposed
ઉભાર	ઉભાર	પુ	૧ ઉપરનું મોટાપણ કે દેખીતું વજન કે ભાર ૨ ખાલી દમામ	ઉભાર ખોખલા દિખાવા	apparent load empty show
ઉમદા (-દું)	ઉમદા (-દું)	વિ	૧ સારું, શ્રેષ્ઠ ૨ ખાનદાન ૩ શ્રીમતી, મૂલ્યવાન	ઉમદા કુલીન દામી, મૂલ્યવાન	best, excellent well-born valuable
ઉમ(-મ્મ)ર	ઉમ(-મ્મ)ર	સ્ત્રી	ઉંમર, વય	ઉમ્મ	age

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉમરાવ	उमराव	पु	1 अमीर 2 श्रीमत	धनी, 'अमीर' का बहुवचन धनवान	nobleman rich man
ઉમળાંકો	उमळको	पु	વહાલ-હેતનો ઊભરો	हुलास, प्रेम की उमग	impulse of love
ઉમગ	उमग	पु	1 ઉત્સાહ, હોંશ 2 આનંદ, હર્ષ 3 ખુશી, ઇચ્છા	उमग आनद, हर्ष खुशी, इच्छा	eagerness, keenness joy, jubilation willingness, readiness
ઉમેદ	उमेद	स्त्री	1 આશા 2 ઇચ્છા, અભિલાષા	उम्मीद, आशा इच्छा, अभिलाषा	hope wish, longing
ઉમેરવું	उमेरवु	स क्रि	1 હોય તેમા બીજું નાખવું, મૂકવું, રેડવું, વધારવું 2 મેળવવું, ભેગું કરવું 3 ઉશ્કેરવું	और रखना, डालना, उडेलना या बढ़ाना मिलाना, जोड़ना उकसाना, भड़काना	to add, to put, to pour to mix, to collect to excite
ઉમેરો	उमेरो	पु	1 વધારો 2 મેળવણી, ભેગવવું તે	वृद्धि, बढ़त मिलावट	addition mixing
ઊર	उर	न	1 હૃદય 2 છાતી	उर छाती	heart bosom
ઊરાગઊટાગ	उरागउटाग	पु न	ઊભો ચાલી શકે તેવો એક જાતનો વાદરો વગ કે વેતા વિનાનું	ओराग-उटाग, एक प्रकार का वानर ऊटपटाग	Orang-outang, a kind of ape nonentity
ઉલ (-લ્લ) ઘવું	उल(-ल्ल)घवुं	स क्रि	1 ઓળંગવું, ઉપર થઈને જવું, પાર કરવું 2 અનાદર કરવો	उल्लघन करना, लाघना अनादर करना	to cross, to transgress to disrespect
ઉલાળ	उलाळ	वि	ઊલળતું	उलार	tossing, jerking

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		पु	गाडा ઈત્યાદિના પાછળના ભાગમાં વધારે વજન હોવું તે	गाड़ी आदि का अधिक भार से पीछे की ओर झुकना	having extra load towards the rear of a cart etc
ઉલેચવું	उलेचवु	स क्रि	થોડે થોડે બહાર કાઢવું (પ્રવાહી માટે)	उलीचना	to remove liquid contents by small quantities
ઉલ્લેખ	उल्लेख	પુ	1 નિર્દેશ, કથન 2 વર્ણન 3 એક અલંકાર (કાવ્યશાસ્ત્રમાં)	उल्लेख वर्णन एक अलंकार	reference, mention description a figure of speech (in poetics)
ઉલ્કાપાત	उल्कापात	પુ	1 ઉલકાનું પડવું તે 2 મહા અનર્થ-ઉત્પાત	उल्कापात महान अनिष्ट, उत्पात	fall of a meteor great calamity, cataclysm
ઉવેખવું	उवेखवु	स क्रि	1 ઉપેક્ષા કરવી 2 અનાદર કરવો, અવગણવું, તુચ્છકારવું	उपेक्षा करना अनादर, अवहेलना या तिरस्कार करना	to disregard to insult, to disobey, to pour scorn on
ઉશીકું(-સુ)	उशीकु (-सु)	न	ઓશીકું	तकिया	pillow
ઉશો(-સોટવું)	उशे (-से) टवु	स क्रि	તિરસ્કારથી કે કાળજી વિના ગમે તેમ ફેંકવું	लापरवाही से या तिरस्कार से फेंकना	to throw away
ઉશ્કેરવું	उश्केरवु	स क्रि	1 આવેશમાં આવે તેમ કરવું, ઉત્તેજિત કરવું 2 ભભેરવું	उत्तेजित करना उकसाना	to excite, to stimulate to instigate
ઉશ્કેરાટ	उश्केराट	પુ	આવેશ, ઉશ્કેરણી	आवेश, उकसाहट	excitement, instigation
ઉષ્ણ	उष्ण	वि	ગરમ	उष्ण	warm, hot

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઉષ્મા	उष्मा	स्त्री	1 હુક 2 ગરમી 3 વરાળ	उष्मा गरमी भाप	warmth heat steam
ઉસરડવું	उसरडवु	स क्रि	1 એકઠું કરવું 2 કચરો દૂર કરવા કે ફેંકી દેવા માટે, જેમ કે, ગદથી, એઠવાડ છ) વાળીઝૂડીને એકઠું કરવું	बटोरना, समेटना झाड़-बुहार कर फेंकने के लिए (कचरा) इकट्ठा करना	to collect to make a pile of garbage for removal
ઉસ્તાદ	उस्ताद	वि पु	કાબેલ, પહોચેલુ 1 ગુરુ 2 વિદ્યાગુરુ, આચાર્ય, તજજ્ઞ	उस्ताद, काबिल गुरु विद्यागुरु, आचार्य, निष्णात	sharp, shrewd guru, master teacher, preceptor, expert
ઉબર-શે)	उबर (-रो)	पुं	1 એક ઝાડ, ઉમરડો 2 ધરનો ઊમરો	उदुबर, गूलर देहली	kind of tree threshold, doorstep
ઊકઠવું	ऊकठवु	स क्रि	1 ગરમ થવું 2 ગુસ્સે થવું	उबलना, खौलना गुस्से होना	to boil to be angry
ઊખડેલ	ऊखडेल	वि	વઠેલ	गुमराह, बहका हुआ	wayward
ઊખળ(-ળી-ળુ)	ऊखळ (-ळी-ळु)	न	1 ખાડણિયો 2 ચાર બળદવાળા ગાડાના બે આગળના બળદનું ધૂસરું	ऊखल (बैलगाडी का) जुआ	mortar yoke of the front pair of a cart drawn by a pair of bullocks
ઊગમ	ऊगम	पु	1 ઊગવું તે 2 મૂળ, ઉદ્ભવસ્થાન 3 શરૂઆત	उगना उद्गम, मूल आरम्भ, शुरुआत	rising source, origin beginning, commencement

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઊગવું	ऊगवु	अ क्रि	1 आगण अक्षुर शवा वधवु, इटवु 2 उदय शवो (सूरज, चंद्र वगैरे-नो) 3 (मनमा) स्फुरवु— उत्पन्न शवु	उगना, अकुरित होना उदित होना उपजना (मन में आना), उत्पन्न होना	to sprout to rise (of the Sun, the Moon etc) to occur (in the mind), strike
ઊઘલવું	ऊघलवु	अ क्रि	1 परगवा (वरधोडामा) नीडणवु 2 छलडणवु 3 इज्जेत शवु	घोडी चढना (विवाह में) छलकना बदनाम होना	to go forth mounted on horse-back in a marriage procession to overflow to be exposed
ઊંચકવું	ऊचकवु	स क्रि	1 ઊંચુ ડરવુ, માથે લેવુ 2 ઠપકો આપવો, ધમકાવવુ	उठाना, सिर पर रखना धमकाना, डौटना	to lift, carry load on the head to scold, to rebuke
ઊંચડવું	ऊचडवु	स क्रि	ઊખાડવું	उखाडना	to detach
ઊંચરવું	ऊचरवु	स क्रि	ઊચ્ચારવું, બોલવું	उच्चारण करना, बोलना	to articulate, to speak
ઊછરવું	ऊछरवु	स क्रि	પાલનપોષણ અને સભાળશી મોટા થવું	पलना	to be carefully brought up
ઊજળું	ऊजळु	वि	1 ધોળું 2 ચક્રચક્ર, તેજસ્વી 3 ચોખ્ખું, નિષ્કલક, નિર્મળ 4 ઊચ વર્ણનું, ઊર્જળિયાત	उजला, सफेद उजागर, चमकदार निर्मल, स्वच्छ उच्च वर्ण का	white bright clean, spotless of upper class

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			૧ રીતભાતે સુધડ	अच्छे रहन सहन वाला	of decent manners
			૬ પૈસટકે સુખી, સારુ, રૂડુ	धन से सुखी	well-off, acceptable, good
ઊટ (-ડ) ડવુ	उट (-ड) कवु	સક્રિ	માજવુ, અજવાળવુ	माजना	to burnish, to clean up
ઊટોફૂટો	उटोकूटो	પુ	અનાજને ખાડયા ઝાટકયા પછી રહેલા શેતરા	अनाज को कूटकर, फटकने के बाद रहने- वाले छिलके, भूसी	chaff
ઊઠવેઠ	उठवेठ	સ્ત્રી	૧ સેવાયાકરીમા આલખાલનો હાજર ને હાજર રહેવામા પડતો શ્રમ ૨ વેઠરૂપ શ્રમ	सेवा-टहल में हरदम हाजिर रहने से होनेवाला श्रम वह श्रम जो बेगार-सा लगे	strain in attending on a sick person useless labour
ઊઠબેસ	उठबेस	સ્ત્રી	૧ ઊઠવુ અને બેસવુ તે ૨ એવી કસરત અથવા શિક્ષા	उठ-बैठ उठने बैठने का व्यायाम अथवा सजा	getting up and sitting down exercise or punishment of that kind
ઊડણ	ऊडण	વિ	૧ ઊડે તેવુ ૨ ચેપી	उडाकू, उडनेवाला छुतहा, सक्रामक	flying infectious, contagious
ઊડમૂડ	ऊडमूड	વિ	ઊધુ ઘાલીને, આડુ અવળુ, વિવેક વિચાર વિના	अधाधुध, विचारहीन	reckless
ઊડમૂડ	ऊडमूड	અ	એકાએક, ઇનુમાનુ	यकायक, चुपके से, गुप-चुप	suddenly, stealthily
ઊણ (-ણ)	ऊण (-णु)	વિ	૧ શોડુ ઓછુ	ऊन, न्यून, कम	less than full

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ઊણપ, અપૂર્ણતા	कमी, न्यूनता, अपूर्णता	falling, short-coming
ઊતડવુ	ऊतडवु	स क्रि	ઊતરડવુ	उधेडना, (छाल, चमडी आदि) खीचना या उधेडना	to peel off, to scratch the skin
ઊન	ऊन	स्त्री	દેટાના વાળ	ऊन	fleece, wool
ઊથલો	ऊथलो	पु	1 ઊઘાથતા થઈને બીજા બાજુ પર પડવુ તે 2 ગયેલો મદવાડ પાછો આવે તે 3 વલણ (શિલ્પમા) 4 સામો જવાબ	पलटा खाना, उलट पलट होना दौरा (रोग आदि का) (कविता में) छदातर सूचित करनेवाला पद्य प्रत्युत्तर	tumbling head over heels relapse of an illness attitude (in poetry) retort
ઊધાર-ચાવુ	ऊधर (-रा) वु	स क्रि	1 ઊધાર ખાતે લખાવુ 2 દૂર થવુ, ટળવુ 3 ઊઠ્ઠરવુ	उधार-खाते लिखा जाना दूर होना, टलना पलना	to be debited to be pushed, to be rid of to be brought up
ऋક	ऋ क	स्त्री	1 ऋग्वेद 2 वेदनो मंत्र	ऋग्वेद वेदमंत्र	the Rigveda verse of the Rigveda
ऋक्ष	ऋक्षा	पु, न	1 રીંછ 2 નક્ષત્ર, તારો	भालू नक्षत्र, तारा	bear constellation
ऋक्षपति	ऋक्षपति	पु	1 રીંછોનો રાજા 2 ચંદ્ર	भालुओं का राजा चंद्रमा	king of bears the moon
ऋक्षराज	ऋक्षराज	पु	જુઓ 'ઋક્ષપતિ'	ऋक्षपति	see 'ऋक्षपति'
ऋक्षा	ऋक्षा	पु, स्त्री	सप्तर्षि ઉત્તર દિશા	सप्तर्षि उत्तर दिशा	the great bear the north

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ऋषि	ऋषि	पु	ऋषि, गुरु	ऋषि, गुरु	'rishi', master
ऋग्वेद	ऋग्वेद	पु.	यतुर्वेदेदमानो पठेत्तो वेद	ऋग्वेद, चारो वेदो में पहला	the first of the four Vedas
ऋग्वेदसंहिता	ऋग्वेदसंहिता	स्त्री	ऋग्वेदनी ऋचाओनो व्यवस्थित संग्रह	ऋग्वेद की ऋचाओ का व्यवस्थित संग्रह	the systematic collection of the verses of the Rigveda
ऋग्वेदी	ऋग्वेदी	वि	1 ऋग्वेदने ज्ञाननारु 2 ऋग्वेद भाषनार ब्राह्मणोना दुणमा जन्मेत्तु	ऋग्वेद को जाननेवाला ऋग्वेद का पढनेवाला, ब्राह्मणो के कुल में जन्मा हुआ	one who knows the Rigveda born in the family of the Brahmins knowing the Rigveda
ऋथ	ऋच	पु	ऋग्वेदी ब्राह्मण	ऋग्वेदी ब्राह्मण	such Brahmin
ऋथ	ऋच	स्त्री	1 ऋग्वेद 2. वेदनो मत्र	ऋग्वेद वेदमत्र	the Rigveda verse of the Rigveda
ऋथा	ऋचा	स्त्री	1 ऋग्वेद 2 वेदनो मत्र	ऋग्वेद वेदमत्र	the Rigveda verse of the Rigveda
ऋणु	ऋजु	वि	1 सरल, सीधु 2. अनुकूल, नरम, भलु	सरल, सीधा अनुकूल, सरल चित्त का, भला, नरम	simple, straight favourable, humble, kind-hearted
ऋणुयोधी	ऋजुयोधी	वि	सरण रीते—कूड वगर लडनारु	सरल रीति से- बिना कपट के लडनेवाला	honest fighter
ऋण	ऋण	न.	1 देवु 2 आभारनो भार	कर्ज, ऋण उपकार का बोझ	debt obligation

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ऋणमुक्त	ऋणमुक्त	वि	ऋण-देवामाशी छूट थये	ऋणमुक्त	free from debt
ऋणमुक्ति	ऋणमुक्ति	स्त्री	ऋणमुक्त थपु ते	ऋणमुक्त होना	redemption from debt
ऋणसबध	ऋणसबध	पु	पूर्व जन्मनो ऋणानुबध	पूर्वजन्म का लेनदेन	bond of indebtedness contracted in previous birth
ऋणानुबध	ऋणानुबध	पु	लेणदेण	पूर्वजन्म का सबध	bond of indebtedness contracted in previous birth
ऋणियु	ऋणियु	वि	ऋणवाणु	कर्जदार, ऋणी	indebted, having debt
ऋणी	ऋणी	वि	जुओ 'ऋणियु'	देखिए 'ऋणियु'	see 'ऋणियु'
ऋत	ऋत	न	1 सत्य 2 नक्की अथण नियम, देवी नियम 3 पाणी	सत्य निश्चित, अचल नियम, दैवी नियम पानी	truth fixed or divine rule water
ऋतभर	ऋतभर	पु	सत्यने टडावी राणभर ते-ईश्वर	ईश्वर	one who sustains truth-God
ऋतभर	ऋतभर	वि	विपर्यास विनानी, सत्य (प्रज्ञा)	बिना विपर्यास की, सत्य (प्रज्ञे)	(of intellect) constant and true
ऋतु	ऋतु	पु	ऋतुअल	गर्भाधान का समय	time for impregnation
		स्त्री	1 अडडाव, रजस्राव 2 जे मडिनानो नियत अण	रजोदर्शन दो महीनो का नियत काल	menstruation fixed period of two months

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3. (ला) मोसम 4. ढवापाणी	मौसम आबोहवा, जलवायु	season climate
ऋतुदर्शन	ऋतुदर्शन	न	अऽधवनु देभायु ते	रजोदर्शन	appearance of the monthly course
ऋतुधर्म	ऋतुधर्म	पु	ऋतुदर्शन	रजोदर्शन	menstruation
ऋतुप्राप्ति	ऋतुप्राप्ति	स्त्री.	ऋतुदर्शन	रजोदर्शन, रजस्वला होना	appearance of the monthly course
ऋतुमती	ऋतुमती	वि, स्त्री	रजस्वला	रजस्वला, ऋतुमती	woman in the monthly course
ऋतुराज	ऋतुराज	पु	ऋतुओमा श्रेष्ठ अेषी ऋतु-वसंत	वसंत ऋतु, ऋतुराज	spring
ऋतुस्नान	ऋतुस्नान	न	अऽधव पध्णी (थोशे दिवसे) नाडवु ते	ऋतुस्नान	bath taken on the fourth day after menstruation
ऋते	ऋते	अ	सिवाय, सिवाय डे	सिवा, सिवाय	except
ऋत्विज	ऋत्विज	पु	यज्ञ करानार ब्राह्मण, पुरोहित	यज्ञ कराने वाला ब्राह्मण, पुरोहित	priest performing a sacrifice
ऋद्धि	ऋद्धि	स्त्री	1 वृद्धि, समृद्धि 2 आजादी, उत्कर्ष 3 सिद्धि 4 लक्ष्मी, पार्वती	वृद्धि, समृद्धि उत्कर्ष सिद्धि लक्ष्मी, पार्वती	growth, prosperity rise, elevation achievement Laxmi, Parvati
ऋषि	ऋषि	पु	1 भत्रद्रष्टा, नवु दर्शन पामनार पुरुष	भत्रद्रष्टा, नये दर्शन का साक्षात्कार करनेवाला	seer, person to whom new knowledge is revealed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 मुनि, तपस्वी, साधु	मुनि, तपस्वी, साधु	sage, saint
ऋषिकुमार	ऋषिकुमार	पु	ऋषिनो पुत्र	ऋषि का पुत्र, ऋषिकुमार	son of 'rishi'
ऋषिकुल	ऋषिकुल	न	1 ऋषिओनो समूह 2 ऋषिनो आश्रम (जेभा प्राचीनकालमा विद्या अपाती छती)	ऋषियो का समूह ऋषि का आश्रम (प्राचीनकाल में जिसमें विद्या दी जाती थी)	group of rishis ashram of a rishi (where knowledge was imparted in ancient times)
			3 ऋषिनो वंश	ऋषि का वंश	family or race of rishi
ऋषिकुल	ऋषिकुल	न	जुओ 'ऋषिकुल'	देखिए 'ऋषिकुल'	see 'ऋषिकुल'
ऋषिपत्नी	ऋषिपत्नी	स्त्री	ऋषिनी पत्नी	ऋषि की पत्नी	wife of a rishi
ऋषिपचमी	ऋषिपचमी	स्त्री	भादरवा सुद पाचम, साभापाचम	भादो सुदी पचमी	the fifth day of the bright half of 'Bhadrapada
ऋषु	ऋषु	अ क्रि	ऋषु	ऋषु, कोप करना	to be displeased
ऋषु	ऋषु	वि	सारु, उत्तम, सुदर (लालित्य वाचक)	अच्छा, उत्तम, सुदर (लालित्य वाचक)	good, excellent, beautiful (signifying artistic elegance)
ऋषु	ऋषु	वि	घाणा कालशी प्रचार के पपराशमा डोवाशी दृढ थयेलु	प्रचलित, दृढ	established by custom or usage, rooted
ऋषियो	ऋषियो	पु	सोण आनानी किमतनो रुपानो सिक्को	रुपया	rupee, a silver coin
ऋषे	ऋषे	अ	1 (दर्शक) ते, पेले	(निश्चयवाचक) वह	(demon) it, that

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 वर अश्रवा वहुनी सज्ञा (हिंदुओमा)	पति या पत्नी की सज्ञा (हिंदुओ में)	(amongst the Hindus) name for wife or husband
		वि	पेलु (प)	वह (पद्य में)	that
		अ	1 'अरे', 'ओ', 'हे' आदि सूयक उद्गार 2 त्रीण ने सातमी विभक्तिनो प्रत्यय	'अरे' 'ओ' 'हे' आदि सूचित करने वाला उद्गार करणकारक और अधिकरण कारक का प्रत्यय	oh! termination of instrumental and vocative cases
એક	एक	वि	1 '१', सभ्यामा पडेलु 2 अण्जेड, अद्वितीय 3 कोण अमुक, तदन थोक्कस नहि अेषु 4 अेकसरधु, समान, भेदवगरनु 5 अेक मतनु, अेकतावाणु, सपीलु, अेकठु 6 अमुक निश्चित, पीणु नहि	एक, '1', सख्या में पहला बेजोड, अद्वितीय कोई, अनिश्चित एकसा, समान एकमत का, एकता वाला, इकट्ठा अमुक निश्चित, अन्य नहीं	one, 1 matchless, unique a, someone (indefinite) uniform, equal of the same opinion, united someone or something definite
એક એક	एक एक	वि	1 अेक्रीसाथे अेक 2 अेक पछी अेक, ક્રમિક	एक साथ एक एक के बाद दूसरा, क्रमिक	one at a time one after another, in order
એક કાને	एक काने	अ	अेकग्र, अेकध्यान	एकाग्र, जिसका ध्यान एक ओर लगा हो	attentively

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એકઝાલિંક	एककालिक	वि	1 એક જ સમયનુ, સમઝાલીન 2 એકીસાથે બનતુ 3 માત્ર એક વાર બનતુ	समकालीन एक साथ बनने वाला सिर्फ एक बार बनने वाला	contemporary simultaneous occurring only once
એકકેદ્ર	एककेंद्र	वि	એક કેન્દ્રવાળુ	एककेन्द्रीय	concentric
એકઝર્ભકોશી	एकगर्भकोशी	वि	એક જ ગર્ભકોશવાળુ	एक ही गर्भकोश वाला	having one embryo cell
એકઝર્ભકોષી	एकगर्भकोषी	वि	જુઓ 'એકઝર્ભકોશી'	देखिए 'એકઝર્ભકોશી'	see 'એકઝર્ભકોશી'
એકઝાઠ	एकगाठ	स्त्री	સપ, મેળ, મૈત્રી	ऐक्य, मेल, मित्रता	unity, agreement, friendship
એકઝાતપદી	एकघातपदी	स्त्री	(ગ) 'ધી ફર્સ્ટ ડિગ્રી એક્સપ્રેશન'	'द फर्स्ट डिग्री एक्सप्रेसशन'	the first degree expression
એકઝાત-સમીકરણ	एकघात - समीकरण	न	સુરેખ સમીકરણ, 'લીનિયર ઇક્વેશન'	(ग) सुरेख समीकरण, 'लीनियर इक्ववेशन'	linear equation
એક ચક્રવે	एक चक्रवे	अ	એક જ જાણના હાથમા બધી સત્તા રાખીને	एकचक्र	with all power concentrated in one person
એકચક્ર	एकचक्र	वि	ચક્રવર્તી	एकचक्र	paramount, supreme
એકચક્રી	एकचक्री	वि.	1 એક પૈડાવાળુ 2 ચક્રવર્તી	एक पहियेवाला, एकचक्र चक्रवर्ती, एकचक्र	having one wheel absolute, supreme
		स्त्री	એક પૈડાની સાઇકલ	एक पहियेवाली साइकल, एक चक्री	one-wheeled cycle

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अेकथडे	एकचक्रे	अ	अेक जे राजाना हाथमा बधी सता राणीने	एकच्छत्र	with all power concentrated in person
अेकधित	एकचित्त	वि	अेकग्र, तल्लीन, ध्यानमग्न	एकचित, तल्लीन, दत्तचित, ध्यानमग्न	engrossed, attentive
		न	ध्यान, अेकग्रता	ध्यान, एकाग्रता	attention concentration
अेकछत्र	एकछत्र	वि	अेक राजावाणु	एकच्छत्र, एक नरेशवाला	having one king
		पु	कुल अधिधर अेक जे हाथमा होय अेवी शासन पध्दति	एकतन शासन-प्रणाली	system of government in which all power rests in one person
अेकछत्रे	एकछत्रे	अ	अेक जे राजाना अमल तणे	एक ही राजा की हुकूमत में, एक ही राजा के शासन में	under one king
अेकजथे	एकजथे	अ	अेकसाथे, अेक ठेगाने	एकसाथ, एक ही जगह पर	in one mass, at one place
अेकजथे	एकजथे	अ	जुओ 'अेकजथे'	देखिए 'अेकजथे'	see 'अेकजथे'
अेकजिव	एकजीव	वि	मनमा परस्पर भेदभाव वगैरनु, अेकजिव	अभिन्न, एकजीव	in complete agreement completely merged
अेकटाणु	एकटाणु	न	अेक टक जमवु ते	एक बार भोजन करना	the vow of having only one meal in a day
अेकठु	एकठु	वि	1 अेकसाथेनु, अेकत्रित, भेगु	इकट्ठा, एकत्रित, एकसाथ	collected, gathered, together

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		अ	2 એક જગાએ—સાથે	एकत्र, एक जगह	at the same place or time
એકડ	एकड	वि	કોઈની સાથે ભળે નહિ એવું, એકલ	अकेला, एकाकी, एकल	reserved
એકડો	एकडो	पु	1 એકની સજ્ઞાસૂચક આકડું-૧ 2 સહી 3 કબૂલાત 4 જ્ઞાતિનો ગોળ	एक की सख्या बताने वाला अक हस्ताक्षर स्वीकार बिरादरी का गोल	number or figure one (1) signature agreement certain group within a caste
એકઢાળિયું	एकढाळियु	वि	એક જ બાજુ ઢળતા છાપરાવાળું	एकपलिया (छाजन)	having a roof sloping one way only
		न	એવું મકાન કે ઓસરું	एकपलिया मकान या ओसारा	such a house or shed
એકતરફી	एकतरफी	वि	એકપક્ષી, એક બાજુનું	एकतरफा	partial, biased, one-sided
એકતત	एकतत	वि पु	આગ્રહી આગ્રહ	आग्रही आग्रह	insistent insistence
એકતતે	एकतते	अ	1 સાથે મળીને, એકરાગથી 2 લાગુ રહીને, ખત ને આગ્રહથી	साथ मिलकर, एकजीव होकर लगा रहकर, तदेही और आग्रहपूर्वक	together, in complete agreement insistently, perseveringly
એકતત્ર	एकतत्र	वि	1 બધાની સમતિવાળું 2 તૂટ પડ્યા વિનાનું 3 એક વ્યવસ્થા નીચેનું	सबकी सम्मति वाला बिना भग का एकच्छत्र	unanimous having no dissent under one management
		न	1 એક સરખી વ્યવસ્થા તે	एकसा प्रबंध	identical or similar

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 सर्वानुमति	सर्वानुमत	management unanimity
अेअतरे	एकतत्रे	अ	अेअ साथे सपीने, अेअ णूथभा	एकजीव होकर, सब मिलकर	unitedly, together
अेअता	एकता	स्त्री	सप, अेअथ	ऐक्य, मेल, एकता	unity
अेअतान	एकतान	वि	अेअग्र, तल्लीन, ध्यानस्थ	एकाग्र, एकतान, ध्यानस्थ	engrossed, attentive
		न	ध्यान, अेअग्रता	ध्यान, एकाग्रता	attention, concentration
अेअतार	एकतार	वि	1 अेअ तारवाणु	एक तार वाला	having one string
			2 अेअसरणु	एकसा	identical, uniform
			3 अेअरस	गला हुआ	merged, mixed
			4 अेअथित	तन्मय	absorbed in
अेअतारु	एकतारु	वि	1 अेअ तारवाणु	एक तार वाला	having one string
			2 अेअ सरणु	एकसा	uniform, equal
अेअतारो	एकतारो	पु	अेअ तारवाणो तबूरो	एकतारा, इकतारा	kind of musical instrument with one string
अेअताल	एकताल	पु	1 णेमा अेअ ण ताल आपे अेवो राज	एक ताल वाला राग	(music) 'raga' with a measure of time
			2. संगीतनो अेअ ताल	संगीत का एक ताल	(music) a measure of time
			3 अेअथ	ऐक्य	unity
		वि	अेअ तालवाणु	एक तालवाला	having a measure of time
अेअतालीस	एकतालीस	वि	४१	एकतालीस, 41	forty-one, 41

one tusk	एक दाँत	एक दाँत वाला	एक दाँत	एक दाँत	एक दाँत	एक दाँत	एक दाँत
elephant with tusk	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी
having only one tusk	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी	एक दाँत वाला हाथी
recluse	एक भूत	एक भूत	एक भूत	एक भूत	एक भूत	एक भूत	एक भूत
a kind of Hindu	एक हिन्दू	एक हिन्दू	एक हिन्दू	एक हिन्दू	एक हिन्दू	एक हिन्दू	एक हिन्दू
see, अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर
see, अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर	एक अक्षर
copyledon	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही
having single monocolyledon	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही
quite, utterly, absolutely, immediately	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही
at once, unity	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही
thirty-one, 31	31	31	31	31	31	31	31
gathered, collected, aggregate	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही
one place together, in, gathered,	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही
thirty-one, 31	31	31	31	31	31	31	31
a measure of 41	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही	एक ही

एक ही पक्षी एक ही पक्षी एक ही पक्षी एक ही पक्षी एक ही पक्षी

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
એકફસલી	एकफसली	વિ	વરસમા એક વાર આપે એવું	સાલ મેં એક ફસલ દેને ચાલા, एकफसला	giving crop once a year
એકભાવુ	एकभावु	વિ	એક જ ભાવનું, સરખી કિંમતનું	एक ही दाम का, समान मूल्य का	of uniform price, having same price
એકમ	एकम	પુ	1 ગાતરો વગેરે હેતુઓ એક અને આખી પાર્શ્વ માનેલી વસ્તુ અથવા સમૂહ, 'યુનિટ'	इकाई, एकाई युनिट	unit
			2 એકડો	एक का अक, एक	one 1
			3 સખ્યા લેખનમા જમણા હાથથી પહેલા સ્થાનનો આકડો	एकाई	unit
		સ્ત્રી	પડવો	प्रतिपदा	first day of a lunar fortnight
એકમગ	एकमग	અ	એક બાજુ	एक ओर	on one side
એકમગા	एकमगा	અ	જુઓ 'એકમગ'	देखिए 'एकमग'	see 'એકમગ'
એકમજલી	एकमजली	વિ	એક મજલાવાળું	इकमजिला	one-storeyed
એકમત	एकमत	વિ	1 એક અભિપ્રાયવાળું, સર્વાનુમત	एकमत	unanimous
			2 સમત	सहमत	agreed
એકમતિયુ	एकमतियु	વિ	એક જ મત કે તતને વળગી રહેનારું, જિદ્દી	जिद्दी	stubborn
એકમતી	एकमती	સ્ત્રી	બધાનો સરખો મત હોવો તે	एकवाक्यता, एकमत्य	unanimity
એકમય	एकमय	વિ	એકમા લીન, એકરૂપ	एक में लीन	engrossed in one, merged

only one, sole	एक ही, सिर्फ एक ही	एक ही, केवल	वि	एकमात्र	एकमात्र
adhering to one way	एक ही माँग की पकड़ रखनेवाला	एक ही माँग की पकड़ रखनेवाला	वि	एकमात्र	एकमात्र
straightforward and simple	सरल, सीधा	सरल, सीधा	वि	एकमात्र	एकमात्र
mutually, among themselves, yourselves etc	एक-दूसरे में	एक-दूसरे में	अ	एक-दूसरे	एक-दूसरे
one side	एक ओर	एक ओर	अ	एकमात्र	एकमात्र
united	मिलजोलीबजली	एकजुट	वि	एकजुट	एकजुट
harmonious	सहज, सहमति	सहज, सहमति	वि	एकजुट	एकजुट
unity, harmony	एकता, ऐक्य	एकता, ऐक्य	वि	एकता	एकता
acre (4046 sq metres of land)	एकड़	एकड़	वि	एकड़	एकड़
completely mixed or fully dissolved	एकजुट	एकजुट	वि	एकजुट	एकजुट
of the same colour	एक ही रंग का	एक ही रंग का	वि	एकजुट	एकजुट
having identical thoughts	एक-एक-साँचे	एक-एक-साँचे	वि	एकजुट	एकजुट
see, see	देखिए, देखिए	देखिए, देखिए	वि	एकजुट	एकजुट
see, see	देखिए, देखिए	देखिए, देखिए	वि	एकजुट	एकजुट

अंग्रेजी पद

हिंदी पद

गणना

विभक्ति

गणना

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એકદા	एकदा	अ	1 એક વખતે 2 અગાઉના વખતમાં	एक बार, एकदा प्राचीन काल में	once once upon a time
એકદિલ	एकदिल	वि.	જેના દિલમાં જુદાઈ નથી એવું, એકજીવ	एकदिल	one mind, identical
એકદિલી	एकदिली	स्त्री	1 એકદિલ હોવું તે 2. મનનો મેળ, સમ	एकदिली एका, मेल	unity, identity union of heart, unity
એકદૂધ	एकदूध	वि	એક જ દૂધ ધાવેલું, એક વશનું	एक ही दूध पर पला हुआ, एक कुल का	nurtured on the same milk, of the same family
એકદેશ	एकदेश	पु.	1 એક સ્થળ અથવા જગા 2. એક ભાગ અથવા વિભાગ, એક બાજુ 3 એક આશય કે મહત્વાકાંક્ષા	एक स्थल या जगह एक भाग या विभाग, एक दिशा एक आशय या महत्वाकांक्षा	one place one part or division, one side one desire or ambition
એકદેશી	एकदेशी	वि	1 એક જ દેશનું વતનનું 2. એક દેશ-ભાગને લાગુ પડતું, એકતરફી, એકેન્દ્રિય 3 અધૂરું, સકુચિત, મર્યાદિત	एक ही देश का- वतन का एकतरफा, एकाकी, एकदेशीय अधूरा, सकुचित, मर्यादित	of one country pertaining to one part, one-sided incomplete, narrow, limited
એકદેશીય	एकदेशीय	वि	જુઓ 'એકદેશી'	देखिए 'एकदेशी'	see 'એકદેશી'
એકઠા	एकधा	अ	1 એક રીતે 2. એક હાથે	एक प्रकार से, एकधा एक हाथ से	in one way or manner single-handedly

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या- को-	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 એકદમ, એક જ વખતે 4 એક વખતે	एकदम, एक ही वकत एक समय	at once, simultaneously once, at one time
એકધારુ	एकधारु	वि	એકસરખુ, ફેરફાર વિનાનુ	एकसा, फेरफाररहित	uniform, constant
એકધ્યાન	एकध्यान	वि	એકચિત્ત, ધ્યાનમાં એકાગ્ર	एकचित्त, ध्यान में तल्लीन	attentive, engrossed, absorbed
		न	એકાગ્રતા	एकाग्रता	concentration
એકનિષ્ઠ	एकनिष्ठ	वि	એકનિષ્ઠાવાળુ	एकनिष्ठ	devoted
એકનિષ્ઠા	एकनिष्ठा	स्त्री	1 એકની જ ઉપર નિષ્ઠા-આસ્થા હોવી તે 2 વફાદારી 3 પ્રમાણિકતા	एकनिष्ठा वफादारी प्रामाणिकता	devotedness loyalty honesty
એકપક્ષી	एकपक्षी	वि	એકતરફી	एकपक्षीय	one-sided, partial
એકપગુ	एकपगु	वि	એક પગવાળુ	एक पैर वाला	having one leg
એકપગે	एकपगे	अ	અધીરુ, તલપાપડ થતુ હોય એમ	अधीर	impatient, very eager
એકપત્નીકત્વ	एकपत्नीकत्व	न	એક જ પત્ની હોવી તે	एकपत्नीकत्व	monogamy
એકપત્નીત્વ	एकपत्नीत्व	न	જુઓ 'એકપત્નીકત્વ'	देखिए 'एकपत्नीकत्व'	see 'એકપત્નીકત્વ'
એકપત્નીવ્રત	एकपत्नीव्रत	न	એક જ પત્ની કરવાનુ વ્રત	एकपत्नीव्रत	vow to have only one wife
એકપદી	एकपदी	वि	એક પદવાળુ, 'મોનોમિયલ' (ગ.)	एक पदवाला, 'मोनोमियल' (ग.)	(math) monomial
		स्त्री	કેડી, પગથી	पगडडी	foot-path

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એકફસલી	एकफसली	वि	વરસમા એક પાક આપે એવું	साल में एक फसल देने वाला, एकफसला	giving crop once a year
એકભાવુ	एकभावु	वि	એક જ ભાવનું, સરખી કિંમતનું	एक ही दाम का, समान मूल्य का	of uniform price, having same price
એકમ	एकम	पु	1 ગણતરી વગેરે હેતુઓ એક અને આખી પૂર્ણ માનેલી વસ્તુ અથવા સમૂહ, 'યુનિટ'	इकाई, एकाई 'यूनिट'	unit
			2 એકડો	एक का अक, एक	one, 1
			3 સપ્ત્યા લેખનમા જમણા હાથથી પહેલા સ્થાનનો આકડો	एकाई	unit
		સ્ત્રી	પડવો	प्रतिपदा	first day of a lunar fortnight
એકમગ	एकमग	अ	એક બાજુ	एक ओर	on one side
એકમગા	एकमगा	अ	જુઓ 'એકમગ'	देखिए 'एकमग'	see 'એકમગ'
એકમજલી	एकमजली	वि	એક મજલાવાળું	इकमजिला	one-storeyed
એકમત	एकमत	वि	1 એક અભિપ્રાયવાળું, સર્વાનુમત 2 સમત	एकमत सहमत	unanimous agreed
એકમતિયુ	एकमतियु	वि	એક જ મત કે તતને વળગી રહેનારું, જિદ્દી	जिद्दी	stubborn
એકમતી	एकमती	સ્ત્રી	બધાનો સરખો મત હોવો તે	एकवाक्यता, एकमत्य	unanimity
એકમય	एकमय	वि	એકમા લીન, એકરૂપ	एक में लीन	engrossed in one, merged

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એકમાત્ર	एकमात्र	वि	એકનું એક, ફક્ત એક જ	सिर्फ एक ही, एक ही	only one, sole
એકમાર્ગી	एकमार्गी	वि	1 એક જ માર્ગને વળગી રહેનારું 2 સરળ, સીધું માર્ગે જનારું	एक ही मार्ग को पकड़े रहनेवाला सरल, सीधी राह चलनेवाला	adhering to one way simple and straightforward
એકબેક	एकमेक	अ	પરસ્પર, માહોમાહે	परस्पर, आपस में	mutually, among themselves, yourselves etc
એકબેર	एकमेर	अ	એક બાજુ	एक ओर	one side
એકબેળ	एकमेळ	वि	1 સપીલું 2 પરસ્પર મેળ ખાય એવું, સવાદી	मेलजोलवाला सवादी, सहमत	united harmonious
		पु	સપ, સવાદ, મેળ	मेल, ऐक्य	unity, harmony
એકર	एकर	पु	૪૮૪૦ ચોરસવાર જમીનનું માપ	एकड	acre (4046 sq metres of land)
એકરસ	एकरस	वि	1 બરાબર મળી-ખીગળી ગયેલું 2 ગુલતાન	एकरस मशगूल	completely mixed or fully dissolved absorbed
એકરંગ	एकरंग	वि	1 એક જ સરખા રંગનું 2 મળતા સ્વભાવ કે વિચારવાળું	एक से रंग का समान स्वभाव या विचारवाला	of the same colour having identical thoughts or nature
એકરંગી	एकरंगी	वि	જુઓ 'એકરંગ'	देखिए 'एकरंग'	see 'એકરંગ'
એકરંગ	एकरंग	वि	જુઓ 'એકરંગી'	देखिए 'एकरंगी'	see 'એકરંગી'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		પુ	એકમતી, સપ, સવાદ	एकमत्य, ऐक्य	unanimity, unity, concord
એકરાર	एकरार	પુ	1 ઇકરાર, હા માડવી તે, કબૂલાત 2 કેફીયત, પ્રતિજ્ઞાપૂર્વક કહેલો અથવા લખાયેલો મજકૂર, ઇકરાર	इकरार, स्वीकृति, कबूल शपथ पत्र	assent affidavit
એકરારનામુ	एकरारनामु	ન	પ્રતિજ્ઞાપૂર્વક કબૂલાતનો લેખ, 'અફિડેવિટ', ઇકરારનામુ	शपथपत्र, प्रतिज्ञापत्र, 'एफिडेविट'	affidavit
એકરાશ	एकराश	વિ	1 એક જાતનુ, એકસરખુ, સમાન ગુણવાળુ 2 જેમની મળતી રાશિ હોય એવુ	एकसा, समान गुणोवाला एक राशिवाला	similar, having the same qualities born in the same sign of zodiac
		સ્ત્રી	1 સરખાપણુ, મળતાપણુ 2 સપ	समानता ऐक्य	similarity unity
એકરૂપ	एकरूप	વિ	1 એક જ રૂમનુ, અભેદ 2 સરખા દેખાવનુ, બહુરૂપીથી ઊભડુ	एकरूप एक ही राहग का, बहुरूप से उलटा	of the same size or quality, identical similar
એકરૂપી	एकरूपी	વિ	જુઓ 'એકરૂપ'	देखिए 'एकरूप'	see 'एकरूप'
એકલ	एकल	વિ	એકાકી, એકલુ	अकेला, एकाकी	lonely, by one self
એકલડુ	एकलडु	વિ	(પ) એકલુ	अकेला	lonely, sole
એકલડોકલ	एकलडोकल	વિ	એકલુ, સોખત-સગાથ વિનાનુ (અથવા એકાદ સગાથવાળુ)	अकेला-दुकेला, इक्का-दुक्का	lonely or nearly so

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એકલતા	एकलता	स्त्री	એકલાપણ	अकेलापन, तनहाई	loneliness
એકલપેટુ	एकलपेटु	वि	આપસ્વાર્થી	अकलखुरा, खुदगरज	selfish
એકલદોકલ	एकलदोकल	वि	એકલુ, સાથી વગરનુ	अकेला, अकेला-दुकेला	lonely, lone
એકલમલ્લ	एकलमल्ल	पु	1 અદ્વિતીય મલ્લ— કુસ્તીબાજ	अद्वितीय मल्ल, कुश्तीबाज	matchless wrestler
			2. ઘણો જબરો માણસ	बहुत बलवान व्यक्ति	very strong man
			3 એક્કો	एक बूटीवाला ताश का पत्ता, इक्का	ace
		वि	1 અજોડ	बेजोड	matchless, unique
			2 એકમાર્ગી	एकमार्गी	one-track- minded
એકલમૂડિયુ	एकलमूडियु	वि	સ્ત્રી, પુત્ર આદિ પરિવાર વિનાનુ, એકલેએકલુ	निरा अकेला	alone, single
એકલમૂડુ	एकलमूडु	वि	જુઓ 'એકલમૂડિયુ'	देखिए 'એકલમૂડિયુ'	see 'એકલમૂડિયુ'
એકલવાયુ	एकलवायु	वि	1 એકલુ, એકલદોકલ	अकेला, इक्का-दुक्का	lonesome
			2. સ્ત્રી, પુત્રાદિ પરિવાર વિનાનુ	निरा अकेला	single
			3 આશ્રય વગરનુ	बिना सहारे का	having no shelter
એકલસૂરુ	एकलसूरु	वि	1 એકલુ, સોબત વિનાનુ	अकेला, सगी- साथीहीन	lonely
			2 એકલપેટુ, સ્વાર્થી	अकलखुरा, स्वार्थी	selfish

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એકલુ	एकलु	वि	કોઈ સાથે વિનાનું, એકાકી, સાવ છૂટું કે અલગ	अकेला, एकाकी, तनहा	lonely
એકલોહિયું	एकलोहियुं	वि	એક લોહીવાળું— એક કુળમાં જન્મેલું	एक ही खून का, एक कुल में जन्मा हुआ	born in the same family
એકવગુ	एकवगु	वि अ.	એકસાથે—એક બાજુ એ હોય એવું 1 સામટું, એકજથો 2 ઓર્થિતું	एक ओर हो ऐसा एकसाथ, एकत्र अचानक, यकायक	together (on one side) together, in a body suddenly
એકવચન	एकवचन	न	1 ફરે નહિ એવું વચન 2 [વ્યા.] એક જ વસ્તુનો બોધ કરે તે	मुकर न जाए ऐसा वचन एकवचन (व्या)	not to turn to one's word (gram) singular
એકવચની	एकवचनी	वि	બોલ્યું પાળે એવું	वात का धनी, एकवचनी, कहा हुआ निवाहने वाला	true to one's word
એકવડ	एकवड	वि	એકવડું, એક પડવાળું	एकहरा	not folded or doubled, having one layer only
એકવડિયું	एकवडियुं	वि	નાજુકું—નબળા બાધાનું, સૂકલા—પાતળા ઝોઠાનું	एकहरे बदन का, नाजुक गठन का	delicate, weak slim, thin
એકવડું	एकवडुं	वि	1 જુઓ 'એકવડિયું' 2 એક પડવાળું	देखिए 'एकवडियुं' एकहरा	see 'એકવડિયું' not folded or doubled
એકવર્ણ	एकवर्ण	वि	1 એક વર્ણનું—ચાતનું 2 -ચાતબાતના ભેદ વિનાનું	एक जाति का, एक वर्ण का जिसमें जाति पाति का भेद न हो	of the same caste casteless

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 अेकइगी	एकरग	of the same type or colour
			4 अेकसरणु	एकसा	similar
अेकवारण-समीकरण	एकवर्ण समीकरण	न	'सिम्पल इक्वेशन' (ग.)	'सिम्पल इक्वेशन' (ग.)	simple equation
अेकवाक्य	एकवाक्य	न	अेकसमान के सर्वमान्य मत के अभिप्राय	एकसमान राय या अभिप्राय	similar or general opinion
		वि	अेकसमान मतवाणु, अेकमत	एकमत, एकराय	having identical views
अेकवाक्यता	एकवाक्यता	स्त्री	अेकसरणुपाणु, समानार्थता, अेकवाक्य छेवु के थवु ते	एकवाक्यता	similarity, consistency of meaning
अेकवार	एकवार	अ	1 अेक, अमुक वधते	एक बार	once, once upon a time
			2 अेक इरे	एक दफा	once
अेकवारे	एकवारे	अ	गुओ 'अेकवार'	देखिए 'अेकवार'	see 'अेकवार'
अेकवारियु	एकवारियु	वि	1 अेक वार बने अेवु अेक वधतनु	एक बार निष्पन्न होनेवाला, एक समय का	occurring once only
			2 अेक वारना मापनु	एक गज की नाप का	measuring one yard
			3 अेक वार जाडेली डागर, इरे	एक बार का कूटा हुआ धान	rice hulled only once
अेकविध	एकविध	वि	अेक प्रकारनु	एकविध	of one type
अेकवीस	एकवीस	वि	'२१'	इक्कीस, 21	twenty-one, 21
अेकसठ	एकसठ	वि	'६१'	इकसठ, 61	sixty-one, 61
अेकसत्ताक	एकसत्ताक	वि	अेकइथु सत्तावाणु	एकतत्र, एकसत्तात्मक	totalitarian

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યાકો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
એકસરખુ	एकसरखु	વિ	સમાન, બધી રીતે સરખુ	समान, एक सरीखा	similar, identical
એકસપ	एकसप	વિ	એકસપીવાળુ	मेलवाला	united
એકસપી	एकसपी	પુ	એકથ, સપ	ऐक्य, मेल	unity
એકસપીલુ	एकसपीलु	સ્ત્રી	એકથ, સપ	ऐक्य, मेल	unity
એકસાથે	एकसाथे	વિ	એકસપ	मेलजोल वाला	united
એકસેરુ	एकसेरु	અ	સૌ સાથે મળીને, જોડે, એકીવખતે	एक साथ, मिलेजुले	together, simultaneously
એકસે	एकसे	વિ	એક સેરવાળુ	एक लडी वाला	consisting of only one string
એકસો	एकसो	વિ	'૧૦૦'	सौ, 100	one hundred, 100
એકહથુ	एकहथु	વિ	જુઓ 'એકસે'	देखिए 'એકસે'	see 'એકસે'
એકદર	एकदर	વિ	એક જ હાથમા હોય એવુ એકહથુ	एक हत्था	(of power) vested in one person
એકાએક	एकाएक	વિ	૧ બધુ મળીને થતુ, કુલ	सारा, कुल	total
એકાકાર	एकाकार	અ	૨ સામટી રીતે, બધી બાબતનો વિચાર કરતા એકદરે	समग्रतया	on the whole, all things considered
એકાકી	एकाकी	વિ	ઓચિતુ, એકદમ	एकाएक, अचानक	suddenly, at once
		વિ	૧ એક આકારવાળુ, એકરૂપ	एकाकार, एकरूप	of the same form, merged
		વિ	૨ સેળભેળ	मिलाजुला, एकाकार	mixed
		વિ	૧ એકલુ	अकेला, एकाकी	alone, lone-some

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 નિરાધાર	નિરાધાર	helpless
એકાક્ષ	एकाक्ष	વિ	1 એક આખવાળુ	एकाक्ष, एक आँखवाला	having one eye
		પુ	2 કાણુ કાગડો	काना, एकाक्ष कौआ	one-eyed crow
એકાક્ષર	एकाक्षर	વિ પુ	એક અક્ષરવાળુ 1 એક અક્ષર	एकाक्षर एक अक्षर	monosyllabic one letter of the alphabet
			2 એવો ગૂઢ મત્ર-ૐ	एकाक्षर मंत्र-ॐ	esoteric, sacred word
એકાક્ષરી	एकाक्षरी	વિ	એકાક્ષરવાળુ	एकाक्षरी	having one letter
એકાક્ષી	एकाक्षी	વિ	જુઓ 'એકાક્ષ'	देखिए 'एकक्ष'	see 'એકાક્ષ'
એકાગ્ર	एकाग्र	વિ	1 એકલક્ષી	जिसका ध्यान एक ही ओर लगा हो, एकाग्र	single-minded
			2 તલ્લીન	तन्मय	engrossed, absorbed
એકાગ્રચિત્ત	एकाग्रचित्त	વિ	એકાગ્ર ચિત્તવાળુ	एकाग्रचित्त, स्थिरचित्त	absorbed
એકાગ્નિ	एकाग्नि	વિ	'૯૧'	एक्यानवे, 91	ninety-one, 91
એકાગ્નિ	एकाग्नि	વિ	જુઓ 'એકાગ્નિ'	देखिए 'एकआग्नि'	see 'એકાગ્નિ'
એકાત્મ	एकात्म	વિ	1 પોતાના ઉપર જ આધાર રાખનારુ એકલુ	अपने ऊपर आधार रखनेवाला, अकेला	independent, depending solely on oneself, alone
			2 એક-સમાન આત્માવાળુ	एकप्राण, एकात्म	having one common soul
એકાત્મતા	एकात्मता	સ્ત્રી	આત્મૈક્ય	एकात्मता	identity or unity (of souls)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એકાત્મભાવ	एकात्मभाव	पु	જુઓ 'એકાત્મતા'	देखिए 'એકાત્મતા'	see 'એકાત્મતા'
એકાદ	एकाद	वि	1 કોઇ એક 2 એક અથવા બે 3 ભાગ્યે એક, વિરલ	कोई एक, एकाध एक या दो शायद एक	certain one or two hardly any
એકાદશ	एकादश	वि	'૧૧'	एकादश, ग्यारह, 11	eleven, 11
એકાદશી	एकादशी	स्त्री	અગિયારસ	एकादशी, ग्यारस	the eleventh day of every lunar fortnight
એકાદુ	एकादु	वि	જુઓ 'એકાદ'	देखिए 'એકાદ'	see 'એકાદ'
એકાવન	एकावन	वि	'૫૧'	इक्यावन, 51	fifty-one, 51
એકાશણ	एकाशण	न	એક ટક ખાવુ તે, એકાશણ	एकाशना, एक ही बार भोजन करने का व्रत	vow of having meal once a day only
એકાશણુ	एकाशणु	न	એકાશણ	एकाशना	see 'એકાશણ'
એકાશી	एकाशी	वि	'૮૧'	इक्यासी, 81	eighty-one, 81
એકાસણ	एकासण	पु	એકાશણ, એકાશણુ	एकाशना, एक ही बार भोजन करने का व्रत रखनेवाला	see 'એકાશણ'
એકાસણુ	एकासणु	न	એકાશણ, એકાશણુ, એકાસણ	एक जून भोजन करना, एकाशना	vow of having meal once a day only
એકાસી	एकासी	वि	જુઓ 'એકાસી'	देखिए 'એકાસી'	see 'એકાસી'
એકાસૂઘ	एकासूघ	अ	દરેક દરેક, તમામ	प्रत्येक, तमाम	each and every one, one and all
એકાગ	एकाग	वि	1 એક અગવાળુ	एक अगवाला, एकाग	having one limb

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या- को-	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		पु	2 અપગ, ખોડવાળુ 1 અગરક્ષક 2 (સ) બુધ નામનો ગ્રહ	विकलाग अगरक्षक बुध ग्रह, एकाग	crippled body-guard planet (Mercury)
		न	એક અગ અથવા ભાગ	एक अग या भाग	one limb or part
એકાત	एकात	वि	1 કોઈના અવરજવર વિનાનુ 2 એકલુ, એકાકી 3 ખાનગી	एक ही ओर लगा हुआ, एकात अकेला निजी	lonely alone personal, private
		न, स्त्री	4 એક જ બાજુ અથવા વસ્તુને લગતુ જ્યા કોઈ ન હોય એવી-કોઈના અવરજવર વગરની-એકાત જગા	एक ही वस्तु को लक्ष्य करनेवाला सूना स्थान, एकात	concerning only one thing or side solitary place
એકાતરા	एकातरा	अ	એકને આતરે, વચમા એક મૂકી દઈને	बीच में एक को छोडकर, एकातर	on alternate days
એકાતરિયો	एकातरियो	पु	એક એક દહાડાને આતરે આવતો તાવ	अंतरा ज्वर, एकातर	fever recurring on alternate days
એકાતરુ	एकातरु	वि	1 વચમા એક આતરો પડે એવુ 2 દર ત્રીજે દિવસે આવતુ	एकातर हर तीसरे दिन पडनेवाला	alternate occurring on every third day
એકાતરે	एकातरे	अ	જુઓ 'એકાતરા'	देखिए 'अकतरा'	see 'अकतरा'
એકાતવાદ	एकातवाद	पु	એક અમુક જ સાચુ ને બીજુ નહિ એવો આગ્રહ	एकातवाद	insistence that what he believes is truth and nothing else

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अेअंतवास	एकातवास	पु	1 अेअतमा रडेवुं ते 2 धूपी रते रडेवु ते	गोशानशीनी, एकातवास गुप्त रूप में रहना	living in solitude living in secrecy
अेअ	एकी	वि	वे वडे निशेष न भागी शक्य अेवी (सख्या)	जो दो से निशेष विभाजित न हो सके (सख्या)	(of number) odd
अेअकरण	एकीकरण	स्त्री	1 अेअता 2 पेशाबनी छाजत	एकता पेशाब की हाजत होना	unity urination
अेअकलमे	एकीकलमे	न	अनेकने अेअ करवा ते	अनेक को एक करना	unification
अेअटशे	एकीटशे	अ	अेअसाथे	एकसाथ	at the same time
अेअटसे	एकीटसे	अ	टगरटगर	टकटकी लगाये हुए, निर्निमेष	staringly
अेअबेअ	एकीबेकी	अ	जुओ 'अेअटशे'	देखिए 'अेअटशे'	see 'अेअटशे'
अेअवारे	एकीवारे	स्त्री	अेअ बाणरमत	बच्चों का एक खेल	kind of children's game
अेअसाथे	एकीसाथे	अ	अेअ अ्पाटे	एक ही बार में, एकबारगी	with one stroke
अेअभूत	एकीभूत	अ	अेअ साथे, सौ साथे थछने	एक साथ, सब साथ में मिलकर	all together, jointly
अेअे	एके	वि	अेअरुप बनेलु, अेअत्रित	एकीभूत	unified, united
अेअेअ	एकेक	वि	अेअ पण	एक भी	even one
		वि	1 अेअ अेअ 2 छूट, नोपु	एक-एक अलग, जुदा	one by one separate
		अ	अेअवपते अेअ अेम	एक बार में एक, एक-एक	one at a time

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
એકેકુ	एकेकु	વિ	એક પછી એક, એકું એકેક	एक के बाद एक, एक-एक	one after another, one by one
એકે ચકવે	एके चकवे	अ	જુઓ 'એક ચકવે'	देखिए 'एक चकवे'	see 'એક ચકવે'
એકોતેર	एकोतेर	વિ	'૭૧' ઇકોતેર	एकहत्तर, 71	seventy-one, 71
એકકડ	एककड	વિ.	એકલા રહેવાના સ્વભાવનુ, એકાતપ્રિય, ઓછુ મિલનસાર	एकातप्रिय, कम मिलनसार	fond of solitude, unsociable
એકકે	एकके	વિ	જુઓ 'એકે'	देखिए 'एके'	see 'એકે'
એકકો	एकको	પુ	1 રમવાના પાનામાનુ એક સજાવાળુ પતુ 2 એક બળદ કે ઘોડાથી ખેચાતુ વાહન 3 એકતા, સપ 4 (લા) સૌથી બાહોશ અથવા કુશળ આદમી, શ્રેષ્ઠ પુરુષ	एक बूटी वाला ताश का पत्ता, एकका इक्का एका, मेल बेजोड या श्रेष्ठ व्यक्ति	(of cards) ace cart or carriage drawn by one bullock or horse unity most capable or best person
એક્યાશી	एक्याशी	વિ	'૮૧'	इक्यासी, 81	eighty-one, 81
એક્યાસી	एक्यासी	વિ	જુઓ 'એક્યાશી'	देखिए 'एक्याशी'	see 'એક્યાશી'
એખરો	एखरो	પુ	1 એક ઔષધિ 2 એનુ ઝાડ 3 (લા) કચરાપૂજા જેવો માલ	एक औषध उसका पेड रद्दी-सा माल	kind of medicine plant yielding it commodity of inferior quality
એખલાસ	एखलास	પુ	દોસ્તી, ઇખલાસ	मित्रता, इखलास	friendship, conciliation
એજન	एजन	अ	એ જ, ઉપર પ્રમાણે	ऊपर बताये मुताबिक	ibidem, as above

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अेजन्ट	एजन्ट	पु	1 आडतीयो, मुनीम 2 प्रतिनिधि, मुजत्थार	आढतिया, गुमाश्ता प्रतिनिधि, एजेंट	agent representative
अेटअेटलु	एटएटलु	वि	अेटलु अेटलु, अेटलु बधु	उतना उतना, पुष्कल	so much
अेटला माटे	एटला माटे	अ	अे डारुसर, तेथी डरीने	इसलिए, अत	therefore, for that reason
अटलामा	एटलामा	अ	अेटला वजतमा	इतने में	in the meanwhile, about that time
अेटलु	एटलु	वि	जगावेला माप डे सभ्यानु	उतना	so much or so little (quantity and number)
अेटलु बधु	एटलु बधु	वि	धार, पुष्कल	इतना अधिक, पुष्कल	so much
अेटले	एटले	अ	1 अर्थात् 2 तेथी, अे उपरथी 3 अे जगाअे, त्या सुधी 4 [प]अे वजते, अेटलामा	अर्थात्, यानी इससे, इस पर से वहाँ तक, वहाँ	that is to say therefore in that place, so far
अेटलेथी	एटलेथी	अ	त्याथी, ते स्थानेथी	उस समय, इतने में	then, in the meanwhile
अेठ	एठ	विं	अेठु	वहाँ से, उस स्थान से	thence, from that place
अेठवास	एठवास	स्त्री पु	अेठवास 1 जावापीवाथी थतो गडवास	जूठन खाने पीने से होने वाली गदगी	(of food) tasted from and therefore polluted leavings of food garbage resulting from dinner

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 કચરોપૂજો, મલિનતા	કૂડા-કરકટ, મલિનતા	garbage, dirty things
એઠવાડો	एठवाडो	પુ	જુઓ 'એઠવાડ'	देखिए 'એઠવાડ'	see 'એઠવાડ'
એઠું	एठुं	વિ	1 જમતા વધેલું, ઉચ્છિષ્ટ 2 ખાઈ પી કે અડીને બોટેલું કે બોટાય એવું	जूठा, उच्छिष्ट खा-पीकर या छूकर जुठारा हुआ या जुठारने योग्य, जूठा	(of food) left after-eating polluted by being eaten or touched
			3 એઠવાડથી ગદું	जूठन लगा हुआ	made dirty by leavings of food
		ન	એઠું કે તેવું શાય એવું અન્ન	जूठा या जुठारा जाय ऐसा अन्न	polluted food
એઠુંજૂઠું	एठुजूठुं	વિ ન	એઠું છાટણ, એઠવાડ	जूठा जूठन, उच्छिष्ट	polluted (food) leavings of food
એડ	एड	સ્ત્રી	1 પાનીનો છેડો 2 બૂટની એડી 3 ત્યાં લગાડાતી ઘોડાને મારવાની આર-ચકરડી 4 બીબુ, સોનીનું એક ઓજાર	एडी, एड बूट की एड बूट में लगाई जाने वाली घोड़े को मारने की एड़ सुनार का एक औजार	heel heel of a shoe spur a goldsmith's tool
એડી	एडी	સ્ત્રી	જુઓ 'એડ'	देखिए 'એડ'	see 'એડ'
એડો	एडो	વિ, પુ	આડો, ઊધો, ખરાબ	अडगेबाज, खराब	cross, wicked
એડો	एडो	પુ	નેડો, સ્નેહ	स्नेह, नेह	affection, love
એણી	एणी	અ	એ, પેલી	वह	(demo pro) she
એણી કોર	एणी कोर	અ	એ બાજુએ	उस ओर	on that side
એણી ગમ	एणी गम	અ	જુઓ 'એણી કોર'	देखिए 'એણી કોર'	see 'એણી કોર'
એણી પા	एणी पा	અ	જુઓ 'એણી કોર'	देखिए 'એણી કોર'	see 'એણી કોર'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अंरमडी	एरमडी	स्त्री	अेड आड	एक पेड	kind of tree
अेरंडियु	एरडियु	न	दिवेल	एरेंडी का तेल	castor oil
अेरडी	एरडो	पु	दिवेलो	एरड, रेड, अरड	castor-oil plant
अेरिग	एरिग	न	अननी भूटनु अेड धरेणु	कान की बाली, कर्णफूल	ear-ring
अेरु	एरु	पु, न	साप	साँप	snake, serpent
अेरुअरुअर	एरुभाभर	न	साप वगेरे अेशे ज्ञानवर	साँप आदि जहरीले जतु	poisonous creatures like snake etc
अेसे	एरो	पु.	1 अवरज्वर 2 उवाडो	आना-जाना उबारा	traffic big trough
अेलथे (अेलथी)	एलकी (एलची)	स्त्री	इलायची	इलायची	cardamom
अेलथी	एलची	पु	राजदूत	एलची, राजदूत	ambassador
अेलथेल	एलफेल	वि.	1 आडुअवणु, गमे तेवु 2 अविचारी, गाडुधेलु 3 असभ्य	अनाप-शनाप, असबद्ध अविचारी, अड-बड असभ्य	of an indifferent sort thoughtless indecent
		न.	1 नपरु, तोशन 2 असभद्ध-मिथ्या प्रलाप	नखरा, शरारत बकवास, अड-बड	pranks, mischief wild incoherent talk
अेलरवु	एलरवु	अ क्रि	मिश्र प्रवाही थड जवु	मिश्र प्रवाही हो जाना	to turn into mixed liquid
अेलणवु	एलळवु	अ क्रि	अेसरवु, पाणी छूटवु	पसीना छूटना	to perspire
अेला	एला	स्त्री.	1 इलायचीनो छोड 2. इलायची	इलायची का पौधा इलायची	cardamom plant cardamom
अेवडु	एवडु	वि	1 अेटला उधनु 2. अेटलु पधु	उतना उतना अधिक	of this or that size so much

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એવણ	एवण	वि	(पारसी) એ	वह	he, they
એવમ્	एवम्	अ	આમ, આ રીતે	एव, इस तरह	in this way
એવુ	एवु	वि	1 એ રીતનુ—પ્રકારનુ 2 એના જેવુ—સરખુ	वैसा उसके जैसा	of that sort or type like that, such
એશ	एश	स्त्री	મોજમજા, સુખચેન રગબાજી	ऐश, भोग-विलास, सुख	enjoyment, luxury
એશઆરામ	एशआराम	पु	ભોગવિલાસ, સુખચેન	भोग-विलास, ऐश व आराम	sensual enjoyment, pleasure and luxury
એસણ	एसणु	न	સોનીની નાની સગડી	सुनार की छोटी अगीठी	small hearth or stove used by goldsmith
એહ	एह	वि	પેલુ	वह	that
એહમક	एहमक	वि	મૂર્ખ	अहमक, मूर्ख	foolish
એળ	एळ	स्त्री	જુઓ 'ઇયળ'	देखिए 'इयल'	see 'इयल'
એળચી	एळची	न, स्त्री	ઇલાયચી	इलायची	cardamom
એળિયો	एळियो	पु	કુવારના પાઠાનો સુકવેલો ગર્ભ, એક ઔષધિ	एलुवा, मुसब्बर	dry aloe
એળે	एळे	अ	1 ફોકટ, વૃથા 2 વગર મહેનતે, સહેજમા	फोकट, वृथा बिना परिश्रम, सहज में	in vain, to no purpose without exertion, easily
એટ	एट	स्त्री	1 મમત, જીદ 2 આટ, સાખ 3 ટેક	ऐठ, जिद, हठ ऐतबार (लेन-देन), साख, प्रतिष्ठा टेक, प्रतिज्ञा	obstinacy credit, honour resolve

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એણી પેર	एणी पेर	अ	એ રીતે, એ પ્રમાણે	उस प्रकार	in that way
એણી પેરે	एणी पेरे	अ	જુઓ 'એણી પેર'	देखिए 'એણી પેર'	see 'એણી પેર'
એણી મગ	एणी मग	अ	એ બાજુએ	उस तरफ	that side
એણે	एणे	अ	'એ'નું ત્રીજું વિભક્તિનું રૂપ	उसने	instrumental of 'એ'
એથી	एथी	अ	એ કારણે, એને લીધે	इस कारण, इसलिए	therefore, because of it
એથી કરીને	एथी करीने	अ	જુઓ 'એથી'	देखिए 'એથી'	see 'એથી'
એદી	एदी	वि	પ્રમાદી, આળસુ, સુસ્ત	अहदी, आलसी, प्रमादी	lazy, indolent
એદીખાનુ	एदीखानु	न	આળસનું ઘર, એદીનો અખાડો	अहदीखाना	den of idlers
એધાણ	एधाण	न	એધાણ, સજા, નિશાની, ચિહ્ન	निशानी, पहचान, चिह्न	sign, symbol, omen
એધાણી	एधाणी	स्त्री	જુઓ 'એધાણ'	देखिए 'એધાણ'	see 'એધાણ'
એન	एन	वि	1 ખરું, અસલ 2 ખાસ, મુખ્ય 3 સરસ, સુંદર 4 ઠીકઠીક, સામાન્ય રીતે સારું	सच्चा, असल खास, मुख्य सुंदर मामूली, सामान्य	true, real special, chief nice, beautiful fair, ordinarily good
		स्त्री, न	1 શોભા, આબરૂ, શાખ 2 અણીનો વખત	आबरू, शान ऐन वक्त, जरूरत का वक्त	reputation critical time
એનધેન	एनधेन	स्त्री	છોકરાની એક રમત	लडकों का एक खेल	a children's game
એનવેળા	एनवेळा	स्त्री	ખરી-અણીની વેળા	ऐन वक्त, अडी	critical moment
એનાથી	एनाथी	अ	'એ'નું ત્રીજું વિભક્તિનું રૂપ	उससे	instrumental of 'એ'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
એનામા	एनामा	अ	'એ'નું સાતમી વિભક્તિનું રૂપ	उसमें	locative of 'એ'
એનાયત	एनायत	स्त्री	આપવું, બક્ષવું તે, બક્ષિસ, ઇનાયત	इनायत, प्रदान	bestowing gift, title etc
એને	एने	अ	'એ'નું ચોથી વિભક્તિનું રૂપ	उसे, उसको	dative of 'એ'
એનું	एनु	अ	'એ'નું છઠી વિભક્તિનું રૂપ	उसका	possessive of 'એ'
એપ્રિલ	एप्रिल	पु	અગ્રેજી વર્ષનો ચોથો મહિનો	अप्रैल	April
એબ	एब	स्त्री	1 ખોડખાપણ, ખામી 2 દૂષણ, કલક	ऐब, दोष दूषण, कलक, बुराई	defect blemish, stigma
એમ	एम	अ	એ રીતે, એ પ્રમાણે	इस तरह	thus, in this way
એમણે	एमणे	अ	'એણે' નું બ વ	उन्होंने	plural of 'એણે'
એમનું	एमनु	अ	'એ' નું છઠી વિભક્તિનું બ વ નું રૂપ	उनका	plural of 'એ' in possessive case
		वि	એ બાજુનું, એ રીતનું એવું	उस तरफ का, उस प्रकार का, ऐसा	of that side, in that way
એમા	एमा	अ	'એ' નું સાતમી વિભક્તિનું રૂપ	उसमें	locative of 'એ'
એરણ	एरण	स्त्री	અમુક આકારનું લોખંડનું ગચ્ચિયું જેના ઉપર સોની, લુહાર વગેરે ઘડવાનું ઘડે છે	निहाई	anvil
એરણકાકડી	एरणकाकडी	स्त्री	1 પપૈયાનું ઝાડ 2 તેનું ફળ	एरड, रेंड एरडखरबूजा	papaya tree its fruit

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
એટદાર	एटदार	વિ	એટવાળુ	ऐठवाला	resolute
એટવુ	एटवु	અ ક્રિ	1 ગર્વ કરવો 2. જાક કરવી	ऐठना, अकडना जिद करना, अडना	to be proud to be obstinate
એંટી	ऐंटी	વિ	જાકી, આડુ	भक्की, अडगेबाज	obstinate
એધરા	ऐंधरा	ન	ઇધારા, બળતારા, લાકડા	ईधन	fuel
એધારા	ऐंधाण	ન	જુઓ 'એધારા'	देखिए 'अंधार'	see 'अंधार'
એધારી	ऐंधाणी	સ્ત્રી	જુઓ 'એધારા'	देखिए 'अंधार'	see 'अंधार'
એશી	ऐंशी	વિ	'૮૦'	अस्सी, 80	eighty, 80
એસી	ऐंसी	વિ	'૮૦'	अस्सी, 80	eighty, 80
એક્ય	ऐक्य	ન	એકતા	एकता, ऐक्य	unity
એડ	ऐड	વિ	આડુ, જિંદી	टेढा, जिद्दी, अडगेबाज, ऐंडा	obstinate, headstrong, crooked
એડજતર	ऐडजतर	વિ	સાવ એડ	नितान्त टेढा, आडा	very obstinate
એતિહાસિક	ऐतिहासिक	વિ	ઇતિહાસને લગતુ	ऐतिहासिक	historical
એચાર	ऐचार	વિ	ચાલાક, લુચ્યુ, ઠગ	चालाक, धूर्त, ठग	shrewd, cunning, rogue
એચારી	ऐचारी	સ્ત્રી	ચાલાકી, ઠગાઇ	चालाकी, ठगपना	cunningness, rogury
એશ્વર્ય	ऐश्वर्य	ન	1 ઇશ્વરપારુ 2 સર્વોપરીપારુ 3 મોટાઇ, સાહેબી 4 વિભૂતિ, સપત્તિ	ईश्वरत्व, ऐश्वर्य सर्वशक्तिमत्ता प्रभुत्व, ठाठबाट धनवैभव, ऐश्वर्य	divinity supremacy greatness opulence
એહિક	ऐहिक	વિ	સાસરિક, આ લોક સબધી	ऐहिक	worldly, pertaining to this world

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
औद्रिक	ऐद्रिक	वि	1. छद्रियोने लगतु 2. छद्रियगम्य	ऐद्रिय, ऐद्रियक इद्रियग्राह्य, ऐद्रिय	sensuous, pertaining to the senses perceptible by the senses
औद्रिय	ऐद्रिय	वि	जुओ 'औद्रिक'	देखिए 'औद्रिक'	see 'औद्रिक'
ओकणी	ओकळी	स्त्री	1. लहर 2. लीपणनी अेक लहरी देभाती भात	लहर लिपाई की लहर जैसी बेल-बूटेदार छाप	ripple, small wave mode of daubing the floor so as to make a ripple-like appearance
ओक्षरी	ओकारी	स्त्री	वक्षरी, उलटी, ओक	उबकाई, कै, उलटी	vomit
ओक्षवु	ओकावु	स क्रि	'ओक्षवु' नु प्रेरक	उगलवाना, उगलाना	caus of 'ओक्षवु'
ओछ्या	ओइया	पु	[रव] ओक्षर आवता शतो-क्षतो सतोषजनक उद्गार	डकार लेते समय होनेवाला सतोषप्रद उद्गार	noise made while belching
		न	1. ओक्षर के तेनी अवाज 2. गराप करी जवु, पयावी पडवु-पाडवु ते	डकार या उसकी आवाज डकार जाना, हडप लेना, हजम कर लेना	belching or noise caused by belching usurption, taking away
ओकवु	ओकवु	स क्रि	1. उलटी करवी 2. लीधेलु पाछु आपवु 3. कळी नाभवु	कै करना, ओकना हजम किया हुआ माल लौटा देना बात गुप्त न रखना	to vomit to return what is taken to speak out

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ऑक्टोबर	ऑक्टोबर	पु	૫ સ નો દશમો મહિનો	अक्टूबर	October
ओખડ	ओखड	न	૧ ઓસડ, દવા ૨ ઇલાજ	औषध, दवाई इलाज	medicine, drug remedy
ओખદ	ओखद	न	જુઓ 'ઓખડ'	देखिए 'ओखड'	see 'ओखड'
ओખદિયુ	ओखदियु	न	દવાના ગુણવાળી વનસ્પતિ, ઓસડિયુ	जडी-बूटी, औषध	herb having medicinal quality, medicine
ओખર	ओखर	न	નરક, ગદવાડ	मैला, गद्गी	excreta, filth
ओખાત	ओखात	स्त्री	૧ ગજુ, તાકાત, ગુજાશ ૨ મામલત, વિસાત	ताकत, बूता, शक्ति, क्षमता औकात, हैसियत, बिसात	power, capacity value, significance
ओખાદ	ओखाद	स्त्री	જુઓ 'ઓખાત'	देखिए 'ओખાત'	see 'ओખાત'
ओगट	ओगट	पु, न	ઢોરનુ છાડ્યુ ધાસ, ઓગાસ	पशुओं के खाने के बाद बचा हुआ चारा, आखोर	fodder left out by cattle
ओगठ	ओगठ	पु, न	જુઓ 'ઓગટ'	देखिए 'ओगट'	see 'ओगट'
ओगणचाळीस	ओगणचाळीस	वि	'૩૯'	उनचालीस, उनतालीस, 39	thirty-nine, 39
ओगणतीस	ओगणतीस	वि	'૨૯'	उनतीस, 29	twenty-nine, 29
ओगणत्रीस	ओगणत्रीस	वि	'૨૯'	उनतीस, 29	twenty-nine, 29
ओगणपचास	ओगणपचास	वि	'૪૯'	उनचास, उचास, 49	forty-nine, 49
ओगणसाठ	ओगणसाठ	वि	'૫૯'	उनसठ, 59	fifty-nine, 59
ओगणीस	ओगणीस	वि	'૧૯'	उन्नीस, 19	nineteen, 19
ओगणोतेर	ओगणोतेर	वि	'૬૯'	उनहत्तर, 69	sixty-nine, 69

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओगाण्याअेशी	ओगण्याएशी	वि	'७९' 'अगाण्याअेशी'	उन्नासी, 79	seventy-nine, 79
ओगाण्याअेशी	ओगण्याएसी	वि	જુઓ 'ओगाण्याअेशी'	देखिए 'ओगाण्याअेशी'	see 'ओगाण्याअेशी'
ऑगस्ट	ऑगस्ट	पु	ઇ સ નો ટમો મહિનો	अगस्त	August
ओगणवु	ओगळवु	अ क्रि	1 धननु प्रवाळी थवु, पीगणवु, 2 (शरीर) गणी जवु, सुडावु 3 प्रवाळीमा प्रवाळी थएने मणवु, अेकरस थवु 4 (ला) नरम थवु, दया लाववी, असर थवी	गलना, पिघलना (शरीर) घुलना, दुबला होना एकरस होना दयार्द्र होना, पसीजना, प्रभावित होना	to melt to be emaciated (of body) to mix in liquid form to take pity (on), to be affected (by)
ओगाट	ओगाट	पु न	ओगाट, ટોરનુ છાડ્યુ ઘાસ, ઓગાસ, ઓઘાસ	पशुओं के खाने के बाद बचा हुआ चारा, आखोर	fodder left out by cattle
ओगाठ	ओगाठ	पु न	જુઓ 'ओगाट'	देखिए 'ओगाट'	see 'ओगाट'
ओगान	ओगान	पु	પાણીનુ મોજુ	पानी की लहर	wave
ओगाणवु	ओगाळवु	स क्रि	1 'ओगणवु' नु प्रेरक, 2. धीमे धीमे—वागोणता जाणे—जाए जवु	पिघलाना धीरे-धीरे खाना	caus of 'ओगणवु' to eat slowly as if chewing the cud
ओघ	ओघ	पु	1 पूरनु पाणी, प्रवाळ 2 ढगलो, जथो	ओघ, बाढ का पानी ढेर, राशि, ओघ	flood water, current heap
ओघड	ओघड	वि	1 અણધડ, ભોટ, બોથડ	अनगढ़, कम अक्ल, औघर, बुद्ध	stupid, dull

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 લાગણી વગરનું, ભયના ભાન વગરનું	भावहीन, जिसे भय का ख्याल न हो	insensitive, having no consciousness of fear
ઓઘરાણું	ओघराळु	वि	ઓઘરાવાળું, ઓઘરાણાવાળું ધૂળ, મેલ, કચરાવાળું	दागदार, मैला	soiled by dried lines of liquid emitted or poured out
ઓઘરાણો	ओघराळो	पु	1 પ્રવાહી ખોરાક પીરસવાનો પહોળા ઊંડા મોના અને ટૂંકા ઘાંડાનો એક ચમચો, કૂદો 2 ઓગાળના ડાઘ, રેલા જેવો ઘાઘ	डोई रेला जैसा दाग	broad-mouthed deep cup with handle streak or line of liquid
ઓઘલો	ओघलो	पु	જુઓ 'ઓઘો'	देखिए 'ओघो'	see 'ओघो'
ઓઘાસ	ओघास	पु, न	જુઓ 'ઓગાટ'	देखिए 'ओगाट'	see 'ओगाट'
ઓઘો	ओघो	पु	1 ઓઘ, ગજી 2 ગોટો, ફગફગતા વાળનો જથ્થો 3 જમણ જમનારનો મોટો સમૂહ	गजी, ढेर, ओघ बिखरे हुए बालों का समूह भोजन करने वालों का बड़ा समूह	hay-stack mass of flying hair large dinner party
ઓચર	ओचर	न	જુઓ 'ઓચરિયું'	देखिए 'ओचरियु'	see 'ओचरियु'
ઓચરિયું	ओचरियु	न	ખિલ, આધારરૂપ (હિસાબી) કાગળ, દસ્તાવેજ, 'વાઉચર' ઓચર	वाउचर	voucher, bill
ઓચિતું	ओचितु	वि	અણચિતવ્યું	अचित्य	unthought of, unexpected
		अ	અણધારી રીતે, એકદમ	यकायक, अचानक	suddenly, unexpectedly

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओछ	ओछ	स्त्री	ओछापाण, जोट	न्यूनता, कमी	want, scarcity
ओछप	ओछप	स्त्री	જુઓ 'ओछ'	देखिए 'ओछ'	see 'ओछ'
ओछग	ओछग	पु	ઉછગ, जोणो	गोद, उछग	lap
ओछाड	ओछाड	पु	1 ઢાકવા-પાથરવાનુ વસ્ત્ર, ચાદર 2 ઓઢે	बिछाने का कपडा, चादर आच्छादन, ढक्कन	counterpane, covering cover
ओछापेटनु	ओछापेटनु	वि	વાત પેટમા ન રાખી શકે એવુ, ઊણા પેટનુ, ઓછુપાત્ર	पेट का हलका, ओछा	unable to keep a secret
ओछाबोलु	ओछाबोलु	वि	શોડુ બોલનારુ	मितभाषी, कम बोलने वाला	reserved, taciturn
ओछायो	ओछायो	पु	1 છાયો, પડછાયો 2 સકોચ, લાજ	छाँह, परछाई सकोच, लज्जा	shade, shadow shyness, timidity
ओछु	ओछु	वि	1 જોઈએ તેથી શોડુ, કમી 2 અધૂરુ, ઊણ 3 ઊતરતુ, ઊલટુ	थोडा, कम अधूरा, अपूर्ण घटिया, हलका, ओछा	less incomplete inferior, low
ओछुपात्र	ओछुपात्र	वि	1 ઊલકી લાયકાતનુ કે ઊલકા કુળનુ 2 પેટમા વાત ન રહે એવુ, ઊણા પેટનુ, ઓછા પેટનુ 3 અભિમાની, બડાઈખોર	कम पात्रतावाला या हलके कुल का ओछा, पेट का हलका अभिमानी, शेखीखोर	of mean status or low family unable to keep a secret proud, boastful
ओछुवतु	ओछुवतु	वि	ઓછુ કે વધારે, શોડુધણ	कम-बेश, थोडा-बहुत	more or less
ओज	ओज	न	જુઓ 'ઓજસ'	देखिए 'ओजस'	see 'ओजस'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओजस	ओजस	न	1 शुक्र धातुमाथी तत्पदपे पनी कर्ति ने प्रभापदपे विराजती शरीरनी धातु 2 प्रकाश, तेज 3 अण, प्रतिभा, पराक्रम 4 चैतन्य	ओजस तेज, प्रकाश बल, प्रतिभा, ओज चैतन्य	virility light, lustre power, genius, valour vitality
ओजस्विता	ओजस्विता	स्त्री	ओजस्वीपारु	ओजस्विता, प्रभाव	vitality
ओजस्वी	ओजस्वी	वि	ओजसवाणु	ओजभरा, ओजस्वी	full of vitality
ओजार	ओजार	न	राय, छशियार, काँठ करवा माटेनु यत्र-साधन	ओजार, आला, कुछ करने के लिए यत्र-साधन	tool, implement
ओञ्जरी	ओञ्जरी	स्त्री	छोञ्जरी, पेट	जठर, पेट, ओञ्जरी	stomach
ओञ्जरे	ओञ्जर	न	जुओ 'ओञ्जरी'	देखिए 'ओञ्जरी'	see 'ओञ्जरी'
ओञ्जल	ओञ्जल	पु, स्त्री, न	1 पडदे, बुरजो 2 जनानो	ओञ्जल, परदा जनाना	curtain, veil harem
ओञ्जे	ओञ्जो	पु	कुमार	कुम्हार	potter
ओञ्ज	ओञ्जी	स्त्री	कुमारण	कुम्हारिन	potter's wife
ओट	ओट	न	ओ नामनु (ज्य जेवु) ओड विलायती धान्य	ओट, जई	oat
		पु, स्त्री	1 भरतीनु ओतरी ज्यु 2 ओशु, पडदे 3 पडती अ- परत, वणतु	ज्वार का उलटा, भाटा आड, परदा पतन, गिरावट वापिस	ebb partition, curtain fall, decline back
ओटण	ओटण	न	1 ओटपु ते 2 अजियो	तुरपन बखिया	act of hemmung close stichung
ओटणी	ओटणी	स्त्री	1 ओटण 2 ओटाँ	तुरपन तुरपने की उज्रत	see 'ओटण' hemmung

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઓટલી	ઓટલી	સ્ત્રી	નાનો ઓટલો	છોટા ચબૂતરા	small, narrow verandah
ઓટલો	ઓટલો	પુ	જુઓ 'ઓટો'	દેખિય 'ઓટો'	see 'ઓટો'
ઓટવુ	ઓટવુ	સક્રિ	1 બખિયો દેવો, કપડાની કિનારી અદર વાળીને સીવવુ 2 ઉકાળી, ઘસી કે હલાવીને એકરસ કરવુ	બખિયા કરના, બખિયાના, તુરપના ઉબાલકર, ઘિસકર યા હિલાકર એકરસ કરના	to hem a garment to mix together by boiling, rubbing or shaking
ઓટાઈ	ઓટાઈ	સ્ત્રી	1 ઓટણ 2 ઓટવાનુ મહેનતાણુ	તુરપન તુરપને કી મજદૂરી	see 'ઓટણ' money paid for the work of hemming
ઓટામણ	ઓટામણ	ન	1 ઓટણ 2 ઓટવાનુ મહેનતાણુ	તુરપન તુરપને કી મજદૂરી	hemming money paid for the work of hemming
ઓટામણી	ઓટામણી	સ્ત્રી	જુઓ 'ઓટાઈ'	દેખિય 'ઓટાઈ'	see 'ઓટાઈ'
ઓટી	ઓટી	સ્ત્રી	કમર ઉપરના વસ્ત્રનુ વાળીને બધ જોવુ કરાતુ પડ	અટી, ટેંટ, ઑટી	knot of the lower garment made under the navel
ઓટો	ઓટો	પુ	ઓટલો, બેઠક તરીકે વપરાય એવી ઘરને અડાને કરાતી ઊંચી જગા	બડા ચબૂતરા	verandah
ઓઠ	ઓઠ	પુ	હોઠ	હોઠ, ઓઠ	lip
ઓઠુ	ઓઠુ	વિ	ભોઠુ, આખુ	મ્હેપૂ, ખિસિયાના	ashamed, abashed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		न	1 ओथु, पडदे, आतरो 2 आतरने लीधे अधारु अने अेकत छोय तेवी जगा 3 धुमावानी के आशरो लेवानी जगा 4 छाया, पडछायो, ओणो 5 डाधो, डभओ 6 बछानु 7 नमूनो, बीबु 8 भूतणु, ओडु 9 भछेणु	ओट, परदा, आड ओट के कारण बनी एकान्त और अंधेरी जगह छिपने की या आश्रय लेने की जगह छाया, परछाई दाग, धब्बा बहाना नमूना, नकल पुतला जैसा आदमी ताना, चुटीली बात	curtain, partition dark and secluded place (because of partition) place of hiding or shelter shade, shadow blot false excuse model, die puppet taunt
ओड	ओड	पु	(भोडवानु काम करनारी अे नामनी जातनु (भाणस)	ओड (खुदाई का काम करने वाली जाति)	member of a caste which does the work of digging
ओड (आ)	ओड (ओ)	पु	पवन रोडवानो पडदे, ओथु	आड, परदा	wind-screen
ओड (ओड)	ओड (ओड)	स्त्री	बोथी, गरदन	गरदन	neck
ओडअर	ओडकार	पु	पेटनो वायु भोभाथी नीडणता थतो डअर	डकार	belching
ओडनु थोड	ओडनु चोड	वि.	डवानु डेवु विचित्र, ओधु अवणु ज	कुछ का कुछ, विचित्र, उलटा	strange, queer, quite the reverse
ओडवु	ओडवु	न	1 अेड इण 2 छोडकु	एक फल छोटी नाव, डोंगी	kind of fruit small boat

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		સ ક્રિ·	1 સામે ધરવુ, રજૂ કરવુ 2 ખાળવુ, રોકવુ 3 ખેંચવુ	પેશ કરના, પ્રસ્તુત કરના રોકના, ઓડના ખીંચના	to hold forth, to present to stop, prevent to pull, draw
		અ ક્રિ	મુશ્કેલીથી બોલવુ— પોતાનો અર્થ સમજાવવો	મુશ્કિલ સે બોલના યા અપના પ્રયોજન સમજાના	to speak or explain one's meaning with difficulty
ઓડુ	ઓડુ	ન	1 ખેતરનો ચાકિયો 2 રમકડુ, પૂતળુ, કામચલાઉ ખોટી રીતે ઊભુ કરેલુ નકામુ માણસ	ખેત કા ધડકા પુતલા જૈસા વ્યક્તિ	scarecrow toy, puppet, useless substitute for man
ઓઢણ	ઓઢણ	ન	[સ્ત્રીઓ અને છોકરીઓનું] ઓઢવાનુ —પહેરવાનુ એક વસ્ત્ર	ઓઢના, ઓઢની	upper garment worn by women and girls
ઓઢણી	ઓઢણી	સ્ત્રી	જુઓ 'ઓઢણ'	દેખિયે 'ઓઢણ'	see 'ઓઢણ'
ઓઢણ	ઓઢણ	ન	જુઓ 'ઓઢણ'	દેખિયે 'ઓઢણ'	see 'ઓઢણ'
ઓઢવુ	ઓઢવુ	સ ક્રિ	1 શરીર કે માથુ ઢાકવુ, શરીર કે માથા પર ધારણ કરવુ 2 વહોરવુ, માથે લેવુ	ઓઢના અપને ડપર, જિમ્મે લેના, ઓઢના	to cover the head, to wear on head or body to take upon oneself
			3 દેવાળુ ડાઢવુ	દિવાલા નિકાલના	to go bankrupt
ઓઢાડ	ઓઢાડ	પુ	આચ્છાદન, ઢાકણ	આચ્છાદન, ઢક્કન	cover
ઓઢાડવુ	ઓઢાડવુ	સ ક્રિ	'ઓઢવુ' નુ પ્રેરક	ઓઢાના, ડઢાના	caus of 'ઓઢવુ'
ઓઢે	ઓઢો	પુ	જુઓ 'ઓઢાડ'	દેખિયે 'ઓઢાડ'	see 'ઓઢાડ'
ઓણ	ઓણ	અ	1 આ સાલમા 2 ચાલુ સમયમા	ઇસ વર્ષ ચાલુ સમય મેં	this year at the present time

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओणूकु	ओणूकु	वि	आ सालनु	इस वर्ष का	of this year
ओतप्रोत	ओतप्रोत	वि	1 એકબીજામાં પરોવાયેલું, એકબીજા સાથે વણાઈ ગયેલું—મળી ભળી ગયેલું 2 તલ્લીન, તન્મય	ओतप्रोत, ताने-बाने की तरह गूँथा हुआ	interwoven, wholly merged with each other
ओतरग	ओतरग	पु, न	બારસાખનો ઉપલો ભાગ	उतरग	intel
ओतरातु	ओतरातु	वि	ઉત્તર દિશાનું, ઉત્તર તરફનું	उत्तर दिशा का, उत्तर की ओर का, उदीच्य	northern
ओतरादु	ओतरादु	वि	જુઓ 'ઓતરાતુ'	देखिए 'ओतरातु'	see 'ओतरातु'
ओताडु	ओताडु	वि	આડફેટું, અપરિચિત	(मार्ग से) अपरिचित, उलटा	taking a diverse path, opposite
ओतारी	ओतारी	अ	(૨૫) અહો! વાહ રે!	ओहो ! वाह !	expression of surprise (oh !, bravo!)
ओथो(आ)	ओथो(ओ)	पु	1 ओथ 2 વચ્ચે આવવું તે 3 છાયો	आसरा, सहारा ओट, बीच में आना छाया, छाँह	shelter, prop barring shade
ओधरवु	ओधरवु	अ क्रि	1 ઊઠવું અથવા ઉપર જવું 2 મુક્ત થવું, ઉદ્ધાર થવો 3 સફળ થવું	उठना या ऊपर जाना मुक्त होना, उद्धार होना सफल होना	to rise or go up to be free, be redeemed to succeed
ओधान	ओधान	न	ગર્ભ રહેવો તે, આધાન	गर्भ रहना, गर्भाधान	conception
ओधो	ओधो	पु	પદવી, અધિકાર, હોદ્દો	ओहदा, पद, अधिकार	position, authority

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઓપ	ઓપ	પુ	1 ચળકાટ, ઢોળ 2 સફાઈ, શોભા	ચમક, ઓપ, પાલિશ, મુલમ્મા સફાઈ, શોભા	burnishing, gild cleaning, beauty
ઓપટી	ઓપટી	સ્ત્રી	1 અડચણ, મુશ્કેલી 2 અટકાય, ઋતુ 3 સુવાવડ	અડચન, મુસીબત રજોદર્શન પ્રસૂતિ	difficulty menstruation delivery
ઓપવુ	ઓપવુ	અ ક્રિ સ ક્રિ	શોભવુ 1 માજી ઘસીને ચળકતુ કરવુ 2 (સોનારૂપાનો) ઢોળ ચઢાવવો	ફબના, સોહના, શોભાયમાન લગના ઓપના, પાલિશ કરના (ચોંદી યા સોને કા) પાની ચઢાના	to appear beautiful to burnish, polish to gild, plate
ઓફિસ	ઓફિસ	પુ	કાર્યાલય	આફિસ, દફતર, કાર્યાલય	office
ઓબાળ	ઓબાઢ	પુ	1 ઊબાળો, બળતણ 2 નદીનો કાપ	ઈધન નદી કા માઠ	fuel alluvium
ઓબાળો	ઓબાઢો	પુ	જુઓ 'ઓબાળ'	દેખિણ 'ઓબાળ'	see 'ઓબાળ'
ઓભા	ઓમા	સ્ત્રી	મુશ્કેલી, ઊપાધિ, પીડા	મુસીબત, પીડા, બલા	difficulty, trouble
ઓભામણ	ઓમામણ	સ્ત્રી	ઓભાવુ તે	મુસીબત, ડલમ્ફન	being in difficulty, having trouble
ઓભામણી	ઓમામણી	સ્ત્રી	જુઓ 'ઓભામણ'	દેખિણ 'ઓભામણ'	see 'ઓભામણ'
ઓર	ઓર	વિ	1 અવર, અન્ય, બીજુ 2 નિરાળુ, અસાધારણ, વિચિત્ર	ઑર, અન્ય, ઢૂસરા નિરાલા, અસાધારણ	another unique, strange
		સ્ત્રી	1 ગર્ભના રક્ષણ માટે તેના ઊપર રહેતુ પાતળી ચામડીનુ પડ	ઑવલ (ગર્ભ કા)	thin protecting skin on an embryo, placenta

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रजी पर्याय
ओरडी	ओरडी	स्त्री	2 डेरीने पाडवा नाभव ते नानो ओरडो	आम को पाल में डालना छोटा कमरा	ripening mangoes small room, closet
ओरडो	ओरडो	पु	1 मोटो-मुज्य षड डे श्रेष्ठाण षड 2 घर 3 अत पुर	बडा कमरा घर अत पुर, जनाना	room, big room, hall house harem, ladies' room
ओरणी	ओरणी	स्त्री	4 ભડાર, ખજાનો 1 ओरवु ते 2 ओरणीनो समय 3 ओरवानु अेड साधन, थावडु 4 દળવાની ઘટીનુ મો, જેમા દળણુ ઓરાય છે 5 મોમા ઓરવુ-ખા ખા કરવુ તે (તુચ્છકારમા)	भडार, खजाना बोआई बोआई का समय बोसा (बीज बोने का) चक्की का मुँह गले में ठूसना- बहुत अधिक खाना	treasure sowing of seeds sowing time sowing implement, drill-plough mouth of a hand-mill (contempt) putting something in the mouth continuously
ओरणु	ओरणु	न	1 જુઓ 'ઓરણી' ૧,૩,૪ અર્થો 2 ઓરવાની વસ્તુ (અનાજ, બી ઇત્યાદિ) 3 મોમા ઓરવાનુ, ખાવાનુ (તુચ્છકારમા)	देखिए 'ओरणी' 1,3,4 अर्थ बोने की चीज (बीज, अनाज, इत्यादि) मुँह में डालना, खाना	see 'ओरणी' 1, 3, 4 thing sown (corn, seeds etc) (contempt) eating

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओरत	ओरत	स्त्री	भैरी, नारी	औरत, स्त्री, महिला, नारी	woman, wife
ओस्तो	ओरतो	पु	ओरियो, लडावानी उमेद	अरमान	ardent desire
ओरमाँ	ओरमाई	वि	सावधु	सौतेला	relationship between members of the family other than by blood, indicated by the prefix step (as in step- mother, etc)
ओरमान	ओरमान	वि	जुओ 'ओरमाँ'	देखिए 'ओरमाँ'	see 'ओरमाँ'
ओरमायु	ओरमायु	वि	जुओ 'ओरमाँ'	देखिए 'ओरमाँ'	see 'ओरमाँ'
ओरमु	ओरमु	न	अेउ मिष्ठान्न	एक मिष्ठान्न	kind of sweetmeat
ओरवणी	ओरवणी	स्त्री	ओरववा माटे-नी- वस्त्र सूखववानी धोरी डे वास, वणगणी	अलगनी	clothesline or pole for drying clothes
ओरवु	ओरवु	स क्रि	1 -मा नाभवु, धरेडो उरवो [जेम डे घटीमा धणवानु अनाज] 2 [बी] पेरवा, ओरणीथी [जेतर] वाववु 3 [राधवा माटे] धाण आधणमा नाभव 4 मोमा ओरवु-नाभवु, भावु [तुस्धउरमा]	-में डालना जैसे चक्की में अनाज (बीज) बोना दाने अदहन - खोलते हुए पानी में डालना मुँह में डालना, खाना	to pour in (e g in the mouth of a hand-mill) to sow seeds by drill to put corn in (usually) boiling water (contempt) to put in the mouth

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઓરશિયો	ઓરશિયો	પુ	સુખડ ઇત્યાદિ ઘસવાનો પથ્થર	હોરસા, પથર કા ચકલા	slab or stone for rubbing sandal etc
ઓરસિયો	ઓરસિયો	પુ	જુઓ 'ઓરશિયો'	દેખિય 'ઓરશિયો'	see 'ઓરશિયો'
ઓરસડી	ઓરસડી	સ્ત્રી	નાનો ઓરસિયો	છોટા હોરસા	small 'ઓરસિયો'
ઓરિયો	ઓરિયો	પુ	1 જુઓ 'ઓરતો' 2 કાઠા ઉપરનો કૂવો	દેખિય 'ઓરતો' કિનારે કા કુઆ	see 'ઓરતો' well on the bank of a river
ઓરી	ઓરી	સ્ત્રી	એક ચેપી રોગ	એક સક્રામક રોગ, ખસરા	measles
ઓરુ	ઓરુ	વિ	નજીક, પાસે	પાસ, નજદીક	near
ઓલવવુ	ઓલવવુ	સ ક્રિ	બૂઝવવુ, ઢોલવવુ	બુઝાના	to extinguish, put out
ઓલા	ઓલા	પુ	કાચુ ચામડુ, ખાલ	કચ્ચા ચમડા, ખાલ	skin, raw hide
ઓલાણ	ઓલાણ	ન	1 ઓલવવુ તે, ઢોલાણ 2 કોસ ખેતતા બળદોને ઉતરવાનો ઢાળવાળો ખાડો	બુઝાના નૈચી, પૌદર	act of extinguishing sloping surface for bullocks drawing water from well
ઓલાણુ	ઓલાણુ	ન	જુઓ 'ઓલાણ'	દેખિય 'ઓલાણ'	see 'ઓલાણ'
ઓલાદ	ઓલાદ	સ્ત્રી	1 સતાન, સતતિ 2 કુળ, વંશ	ઓલાદ, સતાન, સતતિ કુલ, વંશ	children, progeny family, lineage
ઓલિયુ	ઓલિયુ	વિ	1 ભોળિયુ, નિખાલસ, ઉદાર 2 ભક્ત	ભોલા, સરલ, ઉદાર ભક્ત	innocent, frank, generous devotee, worshipper
ઓલિયો	ઓલિયો	પુ	1 ઓલિયો આદમી	ઓલિયા	God's man

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ખુદાનો બદો, ભક્ત	खुदा का बदा, भक्त	devotee of God
ઓલુ	ओलु	वि	(કા) પેલુ	वह	that
ઓલો	ओलो	पु	ચૂલ્હાની સાથે જોડેલો નાનો ચૂલો	चूल्हे के साथ लगाया हुआ छोटा चूल्हा	small hearth or stove by the side of a big one
ઓલ્યુ	ओल्यु	वि	જુઓ 'ઓલુ'	देखिए 'ओलु'	see 'ओलु'
ઓવારણ	ओवारणु	न	અશુભ અથવા દુઃખનુ વારણ કરવા માટે આશીર્વાદ આપવાની એક રીત	वारना, बलाए लेना	mode of blessing with a purpose of removing unhappiness or evil influence
ઓવારણુ	ओवारवु	स क्रि	1 ઓવારણા લેવા 2 વારી નાખવુ, કુરબાન કરવુ	वारना, बलाए लेना निछावर करना	to bless to sacrifice
ઓવારો	ओवारो	पु	નહાવાઘોવાનો ઘાટ	नहाने धोने का घाट	bank, bathing-ghat on the bank of a river or pond
ઓવાળવુ	ओवाळवु	स क्रि	1 દુઃખ-સકટનુ વારણ કરવા શાળીમા સળગતી દિવેટો તથા પૈસો મૂંઝી માણસના માથા ઉપર ઉતારવુ 2 આરતી ઉતારવી	वारना, बलाएँ लेना	to wave (a platter with lighted wicks, a coin etc) around the head of a person for the removal of troubles to wave around in offering and consecration

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			३ अर्पण કરવું	निछावर करना	to offer
ઓશરી	ओशरी	स्त्री	१ અડાળી, માડવી २ ઘરનો શરૂનો— પરસાળમા જતા પહેલાનો ખુલ્લો [આગણ પૂરું થતા શરૂ થતો] ભાગ	सायबान, बारामदा ओसारा, दालान	verandah front part of a house
ઓશલો	ओशलो	पु	१ ओश, छाती २ शेठलो (तुच्छकारमा)	छाती रोटी (तिरस्कार युक्त)	chest (contempt) bread
ઓશિયાળ	ओशियाळ	वि स्त्री, न	જુઓ 'ઓશિયાળું' આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીનતા કે દીનતા કે મનપરનો બોજો	देखिए 'ओशियाणु' आश्रय, उपकार या गरज के कारण पराधीनता या दीनता या मन पर बोझ	see 'ओशियाणु' feeling of dependence or wretchedness on account of obligation or shelter
ઓશિયાણુ	ओशियाळु	वि न	१ આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન-દબાયેલું २ શરમિદું	आश्रय, उपकार या गरज के कारण पराधीन या दमित शर्मिदा	dependent on account of shelter or obligation ashamed, abashed
ઓશિકળ	ओशिकळ	वि न	ઓશિયાળપણ	उक्त प्रकार की पराधीनता का भाव	feeling of being obliged
ઓશીકું	ओशीकु	न	આભારી	आभारी	obliged, thankful
ઓશીકું	ओशीकु	न	સૂતી વખતે માથાની નીચે મુકાતું ટેકણ	तकिया, सिरहाना	pillow
ઓસ	ओस	पु, स्त्री	१ ઝાકળ २ મૃગજળ	ओस, शबनम मृगजल	dew mirage

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઓસડ	ઓસડ	ન	1 દવા 2 (લા) ઉપાય, ઇલાજ	દવાઈ, ઔષધ ઇલાજ, ઉપાય	medicine remedy, cure
ઓસડિયુ	ઓસડિયુ	ન	દવાના ગુણવાળી વનસ્પતિ-ઔષધિ	ઔષધ, જડી-બૂટી	herb having medicinal qualities
ઓસરવુ	ઓસરવુ	અ ક્રિ	1 પાછા હટવુ, સકોચાવુ 2. ઓછુ થવુ, ઘટવુ 3 સુકાવુ 4 શરમાવુ	પીછે હટના, સિકુંડના ઘટના, કમ હોના સૂકના લજ્જિત હોના	to recede, shrink to decrease, abate to dry to feel shy
ઓસરી	ઓસરી	સ્ત્રી	જુઓ 'ઓશરી'	દેખિય 'ઓશરી'	see 'ઓશરી'
ઓસલો	ઓસલો	પુ	જુઓ 'ઓશલો'	દેખિય 'ઓશલો'	see 'ઓશલો'
ઓસવવુ	ઓસવવુ	સ ક્રિ	દાણો ચડી જાય એટલે વધારાનુ પાણી નિતારી નાખવુ	પસાના	to take out surplus water from cooked rice or pulse
ઓસવાવુ	ઓસવાવુ	અ ક્રિ.	1 (દાણા) ચડવુ, બફાવુ 2 ઘટવુ, શોષાઇ જઇ ઓછુ થવુ 3 (લા) મનમા દુ.ખ પામવુ, ઓછુ લાગવુ 4 શરમાવુ, સકોચાવુ	પકના, સીઝના, ગલના (દાના) ઘટના, જજ્બ હોકર કમ હોના મન મસોસના	(of rice etc) to be cooked or boiled to decrease by drying to be grieved
ઓસવુ	ઓસવુ	અ ક્રિ	પીગળવુ, ટપકવુ	પિઘલના, ચૂના	to melt, drip
ઓસગ	ઓસગ	પુ	ઉચ્છગ, ખોળો	ગોદ, ઉછગ	lap
ઓસગાવુ	ઓસગાવુ	અ ક્રિ	ઓશકાવુ, શરમાવુ	શર્મિદા હોના	to feel shy

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઓસગો	ઓસગો	પુ	શરમ, સકોચ, ઓસગાવુ તે	શર્મ, સકોચ, લજ્જા	shyness
ઓસામણ	ઓસામણ	ન	1 ઓસાવાથી નીકળેલુ પાણી 2 ઘણના પાણીની એક વાની	મોંઢ, પસાવન દાલ કે પાની સે બનાઈ જાને વાલી एक प्रवाही खाद्य वस्तु	water taken out of cooked rice or pulse a preparation of pulse water
ઓસાર	ઓસાર	પુ	1 ભીંતની જાડાઈ 2 ઓસરવુ—ઓછુ થવુ તે, સકોચાવુ તે 3 પાછા હટવુ તે 4 ખસેડવુ, દૂર કરવુ તે 5 બીક, નબળાઈ, પોચાપણ	દીવાર કી મોટાई કમ હોના, સિકુડના पीछे हटना दूर करना डर, निर्बलता	thickness of wall decrease, shrink receding removing timidity, weakness
		સ્ત્રી	ઓશ, આશરો, રક્ષણ	આસરા, રક્ષણ	protection, shelter
ઓસારો	ઓસારો	પુ	1 (થ) ઓસરી જેવી મોટી ખુલ્લીઅડાળી 2 સકોચ, શરમથી પાછા પડવુ તે	ઓસરા, દાલાન સકોચ યા શર્મ સે पीछे हटना	large veranda with three sides open shyness, backwardness caused by shyness
ઓસાવવુ	ઓસાવવુ	સ ક્રિ	જુઓ 'ઓસવવુ'	દેખિય 'ઓસવવુ'	see 'ઓસવવુ'
ઓસીકુ	ઓસીકુ	ન	જુઓ 'ઓશીકુ'	દેખિય 'ઓશીકુ'	see 'ઓશીકુ'
ઓસીસુ	ઓસીસુ	ન	જુઓ 'ઓશીકુ'	દેખિય 'ઓશીકુ'	see 'ઓશીકુ'
ઓહિયા	ઓહિયા	અ	જુઓ 'ઓહયા'	દેખિય 'ઓહયા'	see 'ઓહયા'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઓહો	ઓહો	અ	આશ્ચર્ય કે ક્ષુદ્રતા દર્શાવનારો એક ઉદ્ગાર	ઓહો	interjection expressing surprise or deprecation
ઓળ	ઓઠ	સ્ત્રી	1 હાર, પંક્તિ 2 શ્રેણી, વર્ગ 3 ગલી, શેરી	કતાર, પૉત શ્રેણી, વર્ગ ગલી, કૂચા	row, line class, standard street, alley
ઓળખ	ઓઠ્ઠ	સ્ત્રી	1 ઓળખાણ 2 અડક 3 ઓળખવાનું ચિહ્ન-સાધન	પહચાન અલ્લ, ઉપનામ, જાતિનામ પરિચાયક ચિહ્ન	acquaintance surname mark of recognition
ઓળખપાળખ	ઓઠ્ઠપાઠ્ઠ	સ્ત્રી	ઓળખ અને પરીક્ષા, ઓળખાણ	પહચાન	acquaintance and critical estimate, reference etc about a person
ઓળખવું	ઓઠ્ઠવું	સ ક્રિ	જાણવું, પિછાનવું	પહચાનના, જાનના	to be acquainted with, know, recognise
ઓળખાણ	ઓઠ્ઠખાણ	સ્ત્રી, ન	1 પિછાન, પરિચય 2 ઓળખવાનું ચિહ્ન-સાધન 3 ઓળખીતા માણસની ખાતરી	પહચાન, પરિચય પરિચાયક ચિહ્ન પહચાન વાલે મનુષ્ય કા સબૂત	acquaintance, familiarity mark of recognition guarantee by a known person
ઓળખાણપાળખાણ	ઓઠ્ઠખાણ પાઠ્ઠખાણ	સ્ત્રી, ન	જુઓ 'ઓળખાણ'	દેખિણ 'ઓળખાણ'	see 'ઓળખાણ'
ઓળખાવવું	ઓઠ્ઠખાવવું	સ ક્રિ	'ઓળખવું' નું પ્રેરક	પહચાન કરાના	caus of 'ઓળખવું'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઓળખાવું	ઓઢખાવું	અ ક્રિ	'ઓળખવું' નું કર્મણિ	પહચાના જાના	passive of 'ઓળખવું'
ઓળખીતું	ઓઢખીતું	વિ	ઓળખાણવાળું, પરિચિત, જાણીતું	જાન-પહચાન વાલા, પરિચિત	having acquaintance, known
ઓળખીતું પાળખીતું	ઓઢખીતું પાઢખીતું	વિ	જુઓ 'ઓળખીતું'	દેખિણ 'ઓળખીતું'	see 'ઓળખીતું'
ઓળગાણી	ઓઢગાણી	સ્ત્રી	ભગિચણ	ભગિન, મેહતરાની, જમાદારિન	feminine of sweeper
ઓળગાણો	ઓઢગાણો	પુ	ભગી	ભગી	sweeper
ઓળઘોળ	ઓઢઘોઢ	અ	માથે ફેરવીને—ઉતારીને	સિર પર ઘુમાકર યા ઉતારકર	having waved round the head in a circular manner
ઓળવવું	ઓઢવવું	સ ક્રિ	1 ખોટી રીતે લઈ લેવું, પચાવી પાડવું 2 છુપાવવું, સતાડવું	હડપના, પચાના છિપાના, ગુપ્ત રખના	to usurp, misappropriate to hide, conceal
ઓળવું	ઓઢવું	સ ક્રિ	કિશને) કાસકીશી સાફ અને વ્યવસ્થિત કરવા, ડોળવું	કઘી કરના	to comb the hair
ઓળસવું	ઓઢસવું	સ ક્રિ	1 ઓળાસવું, માલિસ કરવું, ઓળવું 2 (લા) ખુશામત કરવી	માલિશ કરના ખુશામદ કરના	to massage, rub to flatter
ઓળગવું	ઓઢગવું	સ ક્રિ	1 પાર જવું, ઉપર થઈને જવું, વટાવી જવું 2 કૂદી જવું 3 ઉલ્લઘવું, અવગણના કરવી, લોપવું	લોઘના, ફોંદના, પાર કરના કૂદ જાના ઉલ્લઘન કરના, અવજ્ઞા કરના	to cross, pass over to jump over to transgress, disobey

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઓળડવું	ઓલ્ડવું	સ ક્રિ	(ચ) ઉપર શરૂને—ઓળગીને જવું	લોંઘના	to pass over, cross
ઓળબો	ઓલ્લબો	પુ	ક્રિયાનુ એક ઓળખર	સાહુલ, ગુનિયા	plumb-line
ઓળખો	ઓલ્લખો	પુ	1 ઠપકો 2 ફરિયાદ, રાવ 3 મશ્કરી ઠક્ક	ઉલાહના શિકાયત મજાક, ઠટ્ઠા	rebuke, chide complaint mockery, ridicule
ઓળા	ઓલ્લા	પુ	1 લીલા ચણાના પોપટા, પોપટા સતી એના છોડવાની ઝૂડીઓ 2 ચણાના શેકેલા પોપટા	હોરહા-(હરા), ફલદાર ચના હોરહા (મૂના હુઆ)	green gram- pods, bunch of green gram plants with pods roasted gram- pods
ઓળામણ	ઓલ્લામણ	ન	1 ઓવારણ 2 વળામણ	વારના, બલાણ લેના બિદા	mode of blessing to ward off evil parting, send off
ઓળાયો	ઓલ્લાયો	પુ	આવું— 'j' રકમની પૂર્ણતાસૂચક અર્ધચદ્રાકાર ચિહ્ન	પૂર્ણતાસૂચક ચિહ્ન, બિકારી	crescent-like sign like this)' marking a complete integer
ઓળો	ઓલ્લો	પુ	1 જુઓ 'ઓળા' 2 પડછાયો	દેખિણ 'ઓળા' પરછાઈ	see 'ઓળા' shadow
ઓચિત્ય	ઓચિત્ય	ન	ઉચિતપણ, યોગ્યતા	ઓચિત્ય	fitness, propriety
ઓદરિક	ઓદરિક	વિ	1 ઉદર-પેટ સબધી 2 અકરાતિયુ	પેટ વિષયક, ઓદરિક પેટ, ઓદરિક	of or pertaining to stomach gluttonous

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
औदासीन्य	औदासीन्य	न	ઉદાસીનતા	औदासीन्य, उदासी, औदास्य	dejection, apathy or indifference (to worldly things)
औदास्य	औदास्य	न	જુઓ 'औदासीन्य'	देखिए 'औदासीन्य'	see 'औदासीन्य'
औद्धत्य	औद्धत्य	न	ઉદ્દતપણ	उजड़डपन, उद्धतता	rudeness, impudence
औपचारिक	औपचारिक	वि	1 ઉપચારને લગતુ 2 ઉપચાર પૂરતુ જ (સાચુ નહિ)	उपचार विषयक, औपचारिक रस्मी, दिखाऊ, औपचारिक	pertaining to cure formal (not real)
३	क	अ	1 (प्रश्नार्थक पद साथे बलुधा लागता) तेना अर्थमा अनिश्चितता सूचयतो प्रत्यय ઉદા કોક, કયાક, ક્યારેક, કશુક 2 નઠારુ, અયોગ્ય ઇત્યાદિ અર્થસૂચક પૂર્વગ ઉદા કપૂત, કળોડુ	अर्थ में अनिश्चितता सूचित करनेवाला प्रत्यय (गुज- कोक, क्याक आदि) खराबी या लघुतासूचक पूर्व प्रत्यय (कपूत)	affix implying uncertainty, e g કોક, કયાક, (most often with an interrogative) prefix implying prejection, e g કપૂત, કળોડ
कअवसर	कअवसर	पु	કવખત, કફોડો-કઢગો-પ્રતિકૂળ સમય	बुरा अवसर, कुबेला, प्रतिकूल समय	bad or inopportune time
कई	कई	अ वि, स्त्री	પ્રશ્નવાચક સર્વનામ 'કયુ' નુ સ્ત્રીલિંગ	कौन (प्रश्नवाचक सर्वनाम) 'कयु' का स्त्रीलिंग	interrogative pronoun (gram) feminine form of 'कयु'
कऋतु	कऋतु	स्त्री	1 ખરાબ-અયોગ્ય ઋતુ	खराब, अयोग्य ऋतु	bad or improper season

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 असाधारण डे भोसभ पगरनो समय	असाधारण या बेमौसम का समय	unusual season
કકડતુ	ककडतु	वि	1 ઘણ જ તપી ગયેલુ, ઊકળતુ 2 થોકખુ અને ઇસ્ત્રીવાળુ (કપડુ)	कडकडाता हुआ, खौलता हुआ कलफदार और साफ (कपडा)	very hot, boiling (of clothes) clean and well ironed
			3 આકરી- ધુળાવે એવી (ટાઢ)	कडाके की (सर्दी)	bitterly cold
કકડધજ	ककडधज	वि	1 મજબૂત 2 અક્કડ, ટટાર 3 મહાન, ભવ્ય	मजबूत तना हुआ, सीधा महान, भव्य	strong erect, stiff great, imposing
કકડભૂસ	ककडभूस	अ	કડડડ એવા અવાજ સાથે(તૂટવુ, પડવુ ઇ)	'कडडड' आवाज के साथ (टूटना)	sound of a big crash
કકડવુ	ककडवु	अ क्रि	1 (૨૧) કડકડ એવો અવાજ કરવો 2 દાત કડકે એટલુ ધૂજવુ 3 કડકડ શાય એટલુ ઊકળવુ	कडकडाना (आवाज) बत्तीसी बजना	to make that kind of sound (of teeth) to tremble and make a sound on account of cold
			3 કડકડ શાય એટલુ ઊકળવુ	'कड-कड' आवाज हो उतना खौलना	to be boiling
કકડાટ	ककडाट	पु अ	(૨૧) કડકડવુ તે, કડકડ એવો અવાજ 1 ઝપાટાબધ, વેગભેર 2 એકસરખી રીતે, અટક્યા વગર	कडकडाहट फर्राटे से, तेजी से बिना रुके, एक-समान रूप से	that kind of sound quickly, speedily without interruption, with a uniform speed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કકડી	ककडी	स्त्री	छेक नानो કકડો	छोटा टुकड़ा, टुकड़ी	bit, very small part
કકડીને	ककडीने	अ	1 સખત રીતે 2 કકડક ધઈને	जोर से कड़क से	strongly, acutely with a rattling sound
કકડે બચકે	ककडे बचके	अ.	થોડે થોડે કરીને	थोड़ा-थोड़ा करके, टूक-टूक	bit by bit
કકડો	ककडो	पु	એક ભાગ, ટૂકડો	टुकड़ा	piece, bit
કકરુ	ककरु	वि	1 લીસુ નહિ-કરકર લાગે એવું 2 લા આકર સ્વભાવનું	करकरा तेज मिजाज का	rough to touch, not smooth of an irritable nature
કકળવું	ककळवु	अ क्रि	1 કલ્પાત કરવું, છવ બાળવો 2 બબડવું, ગણગણવું 3 ઊકળવું	कल्पना, विसूरना बडबडाना उबलना	to mourn, to be agonized, to feel bad about to grumble, to complaint to boil
કકળાટ	ककळाट	पु	1 ક્રબ્ધ્યો, કલેશ, રડારોળ 2 બૂમરાણ	क्लेश, किकियाना चीख-पुकार	wrangle, bitterness, plaintive cry clamour, outcry
કકુભ	ककुभ	स्त्री	1 દિશા 2 શોભા 3 એક રાગિણી	दिशा शोभा एक रागिणी, ककुभा	direction decoration musical term (a raga)
		पु	1 તબૂરાનું તૂબડું	तबूरे का तुबा	hollow rounded end of a musical instrument (namely tambur)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 वीणाने छेडे छोटो लाडकानो वाडो भाग	वीणा के अंत का लकड़ी का मुड़ा हुआ भाग, ककुभ	bent wooden piece at the end of a musical instrument (namely <i>veena</i>)
કકો	ककको	पु	1 ક અક્ષર 2 મૂળાક્ષરોની આખી યોજના 3 કકાનો દરેક અક્ષર લઈ બનાવેલી કાવ્યની એક રચના	क अक्षर ककहरा, कक्का ककहरे के प्रत्येक वर्ण को लेकर की गई काव्य की एक रचना (अखरावट, बावनी आदि)	letter ક Gujarati alphabets poetical composition with the initial letters of its verses following the order of the alphabets
			4 (લા) પ્રાથમિક જ્ઞાન	(લા) प्राथमिक ज्ञान	elementary knowledge, (as a special meaning)
કકાવારી	कककावारी	स्त्री	કકાનો અનુક્રમ	ककहरे का अनुक्रम	alphabetical order
કક્ષ	कक्ष	पु	1 બગલ, કાંખ 2 પાસુ, પડખુ 3 (લા) કંદેરો	कक्ष कॉख, बाजू करधनी	arm-pit side, flank girdle (as a special meaning)
કક્ષા	कक्षा	स्त्री	1 ગ્રહનો આકાશમા ફરવાનો માર્ગ 2 સ્થિતિ, શ્રેણી 3 કેડ, પડખુ	कक्षा, ग्रहों का भ्रमण-पथ स्थिति, दरजा, कक्षा कमर, करवट, बाजू, कक्ष	orbit position, cadre waist, side or flank

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 કાછડી	कछोटा	end of a <i>dhota</i> tucked at the back
			5 ઓરડો, ખાનગી ખડ	कमरा, निजी कक्ष	room, private apartment
			6 અત.પુર	अत पुर, कक्ष	harem
કક્ષાશ	कक्षाश	पु	ગ્રહના આકાશમાર્ગનો અશ-ભાગ	कक्षश, ग्रह का आकाश-मार्ग का अश	part of the orbit of a planet
કખા	कखा	સ્ત્રી	નિંદા, બુરાઈ	निंदा, बुराई	scandal, wickedness
કખાય	कखाय	पु	1 ઉઝાળો, કાઢો 2 ભગવો રંગ	क्वाथ, कषाय गेरूआ रंग, कषाय	decoction ochre colour
			3 અસ્વચ્છતા 4 મનોવિકાર	गदगी मनोविकार	uncleanliness passion
		વિ	1 તૂરુ, કસાણ 2 કષાય, ભગવુ	कसैला गेरू के रंग का, कषाय	tasteless ochre coloured
કગરવુ	कगरवु	अ क्रि	અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી, કાલાવાલા કરવા	गिडगिडाना	to implore, beseech, grovel
કચ	कच	સ્ત્રી	જુઓ 'કચકચ'	देखिए 'कचकच'	see 'कचकच'
કચકચ	कचकच	સ્ત્રી	1 ટકટક, નકામી માથાફોડ 2 કઞ્જિયો, તકરાર	हुज्जत, किचकिच, किटकिट कजिया, तकरार, भगडा	bother, fuss squabble, quarrel
કચકચાટ	कचकचाट	पु	1 કચકચ કરવી તે 2 'કચકચ' એવો અવાજ થવો તે	किचकिच करना 'कचकच' ऐसी आवाज होना	wrangle production of sound kach-kach

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કચકચાવવું	कचकचाववु	સ ક્રિ	1 'કચકચવું' નું પ્રેરક 2 જોરથી ખેંચીને બાંધવું 3 હેરાન કરવું	कच-कच कराना कसकर बाँधना परेशान करना	caus of 'કચકચવું' to bind tightly to bother
કચકચિયું	कचकचियु	વિ	1 તકશરી, કળિયાખોર 2 માથાઘોડિયું, જિંદી 3 કાંઈ કરે એવું, અટક્યા વગર અને થોડેથોડે પડતું પાણી	हुज्जती, भगडने वाला जिद्दी कीचड करे ऐसा, बिन रुके बरसता पानी	quarrelsome, contentious fussy, obstinate water with a slow and steady drip which makes the ground slushy
કચકચિયો	कचकचियो	પુ	એક પક્ષી	एक पक्षी	kind of bird
કચકડું	कचकडु	ન	જુઓ 'કચકડો'	देखिए 'कचकडो'	see 'કચકડો'
કચકડો	कचकडो	પુ	કાચબાની પીઠનું છાંડું, કચબડું	कचकडा	tortoise-shell
કચકડવું	कचकडवु	સ ક્રિ	જુઓ 'કચકડવું'	देखिए 'कचकडवु'	see 'કચકડવું'
કચકડાકચકડ	कचकडाकचकड	સ્ત્રી	જુઓ 'કચકડાકચકડી'	देखिए 'कचकडाकचकडी'	see 'કચકડાકચકડી'
કચકડાકચકડી	कचकडाकचकडी	સ્ત્રી	કચકડા જવાય એવી સખત ભીડ	भारी भीड	heavy crowding
કચકડાટ	कचकडाट	પુ	કચકડાકચકડ, સખત ભીડ	सख्त भीड, किचपिच	heavy crowd
કચકપચ	कचकपच	સ્ત્રી	1 કલબલ 2 કચકચ	शोर, कोलाहल किचकिच	din, noise fuss
કચકપચિયું	कचकपचियु	વિ	કચકપચ કર્યા કરનારું	किचपिच करने वाला	wrangling
કચકરકૂટ	कचकरकूट	સ્ત્રી	1 કચકરવું અને કૂટવું તે 2 મહેનત	कुचलना और कूटना मेहनत, रगड	crushing and pounding exertion

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			૩ લડાલડી, મારામારી	मारामारी	fighting with one another
કચરપચર	कचरपचर	वि	1 કચુ કોરુ 2 અપરિપકવ (મળ)	कच्चा-पक्का अपरिपक्व, कच्चा (मल)	(of food) miscellaneous, not regularly cooked (of stool) consisting of undigested food
કચરવુ	कचरवु	स क्रि	1 ચગદવુ 2 છૂદવુ 3 કૂટો કરવો	कुचलना बारीक कुचलना चूर्ण करना	to trample under foot to crush, to press tightly to pound, to bruise as with pestle
કચરાકચર	कचराकचर	સ્ત્રી	કચડાકચડી, સખત ભીડ	भीडभाड, किचपिच	heavy crowd
કચરાકચરી	कचराकचरी	સ્ત્રી	જુઓ 'કચરાકચર'	देखिए 'कचराकचर'	see 'કચરાકચર'
કચરાપટી	कचरापटी	સ્ત્રી	1 કચરો, પૂજો 2 કચરાપૂજનો ઢગલો	कूडा कूडे का ढेर	rubbish, dirt heap of rubbish
કચરાપટ્ટી	कचरापट्टी	સ્ત્રી	જુઓ 'કચરાપટી'	देखिए 'कचरापटी'	see 'કચરાપટી'
કચરાપેટી	कचरापेटी	સ્ત્રી	કચરો નાખવાની-ભેગો કરવાની પેટી	कचरापेटी	dust-bin
કચરાવાળો	कचरावाळो	પુ	ઝાડુવાળો, ભગી	झाड़ुबरदार, भगी, मेहतर, जमादार	sweeper
કચરુ	कचरु	ન	નકામો કચરો	कचरा, कूडाकरकट	waste material
કચરો	कचरो	પુ	નકામુ ફેકી દેવા જેવુ તે	कचरा	rubbish

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કચવવુ	कचववु	स क्रि	દિલ દુખવવુ (असतोषशी), કચવાય તેમ કરવુ	दिल जलाना (असतोष से), दुखाना, कचोटना	to hurt the feeling
કચવાટ	कचवाट	पु	1 મનનુ કચવાવુ તે, અસતોષ 2. આણબનાવ	असतोष, असतुष्ट होना अनबन	perturbation, dissatisfaction ill-feeling, disagreement
કચવાટિયુ	कचवाटियु	वि	3 કચકચાટ, માશાકૂટ	माथापच्ची	nagging, bother
કચવાવુ	कचवावु	अ क्रि	કચવાટ કરનારુ	माथापच्ची करनेवाला	quarrelsome
કચાટ	कचाट	वि	દિલગીર થવુ, મનમા મૂઝાવુ(અસતોષશી)	(असतोष से) दिलगीर होना, कचोटना	to be unhappy, to be grieved on account of dissatisfaction
કચાટ	कचाट	वि	જિદી	जिद्दी	stubborn, obstinate
		पु, स्त्री	1 કચકચ 2 છદ 3 મૂઝવાણ	किचकिच, जिद	wrangle obstinacy
કચાટિયુ	कचाटियु	वि	કચાટ કરવાની આદતવાળુ	हठी, जिद्दी	obstinate
કચાલ	कचाल	पु स्त्री	ખોટો રિવાજ 1 ખરાબ વર્તણૂક	कुप्रथा कुचाल	bad custom (for woman) bad conduct
			2 કુટેવ	कुटेव	bad habit
કચાલો	कचालो	पु	કુરિવાજ	कुरीति	bad custom
કચાશ	कचाश	स्त्री	1 કચાપણ, અપકવતા 2 ન્યૂનતા, કસર	कचाई, कच्चापन न्यूनता, कसर	unripeness, immaturity deficiency, want, weakness

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या- को-	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કચિયાણ	कचियाण	न	ભીડ, ગરદી	किचपिच, भीड	heavy crowd
કચિયારો	कचियारो	पु	1 કચકચાટ 2 કચી ઇટોનો જથ્થો	किचकिच कच्ची ईटों का ढेर	wrangle heap of unbaked bricks
કચિયુ	कचियु	वि	જુઓ 'કચકચિયુ'	देखिए 'कचकचियु'	see 'कचकचियु'
કચુબર	कचुबर	स्त्री, न	ઝીણી કકડીઓ, કાતળીઓ, છૂંદો, કચૂમર	कचूमर	small bits, shavings, crushed fruit, salad
કચૂકો	कचूको	पु	આખલીનો ઠળિયો	चिआँ	tamarind seed
કચૂડકચૂડ	कचूडकचूड	अ	(રવ.) એવો અવાજ થાય તેમ	'कचूडकचूड' आवाज ही ऐसे	कचूडकचूड sound
કચૂડો	कचूडो	पु	(રવ.) ઊંચકો, ઝૂલો	झूला	swing
કચૂમર	कचूमर	स्त्री	કચૂબર	कचूमर	salad
કચૂરો	कचूरो	पु	ઝેરકચોલુ	कुचला	kind of medicinal drug
કચેરી	कचेरी	स्त्री	1 કોર્ટ 2 ઓફિસ 3 દીવાનખાનુ	कचहरी, अदालत कार्यालय, ऑफिस दीवानखाना, बैठक का कमरा	court office drawing-room
કચોરી	कचोरी	स्त्री	ખાવાની એક બનાવટ	कचौरी	preparation made of flour and pulse
કચોરો	कचोरो	पु	ઝેરકચોલુ	कुचला	kind of medicinal drug
કચોલુ	कचोलु	न	1 ચલાણ, નાનુ પ્યાલુ 2 કકાવટી	कचुल्ला, कटोरा कुकुम रखने का पात्र	small bowl cup for holding red-turmeric powder

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કચ્ચર	कच्चर	વિ	1 કચરાઈ-છૂદાઈ ગયું હોય એવું 2 લોહી ન નીકળ્યું હોય પણ અદરશી સખત ઇન્ન થઈ હોય એવું	कुचला हुआ गुप्त मार, मूंदमार	crushed having severe internal injuries, though free from bleeding a kind of vegetable
		પુ, સ્ત્રી	એક વનસ્પતિ	एक वनस्पति	
કચ્ચરકૂટ	कच्चरकूट	સ્ત્રી	જુઓ 'કચ્ચરકૂટ'	देखिए 'कच्चरकूट'	see 'कच्चरकूट'
કચ્ચરધાણ	कच्चरघाण	પુ	પૂરેપૂરું કચરાવું-છૂદાવું તે, પૂર્ણ પાયમાલી	कचरघान, पूरी पामाली	being completely crushed or pounded
કચ્ચાઈ	कच्चाई	સ્ત્રી	કચાપણ	कच्चापन	rawness
કચ્ચાબચ્ચા	कच्चाबच्चा	ન	છોકરાછૈયા	कच्चे-बच्चे	children, kids
કચ્ચુ	कच्चु	વિ	કચ્ચુ, અનુભવ વિનાનું	कच्चा, अनुभवहीन	raw, inexperienced
		ન	કચ્ચુ	एक वनस्पति का फल	kind of fruit
કચ્છ	कच्छ	પુ	1 કછોટો, લગોટ	कच्छ, लगोट	lower end of a dhoti tucked into the waist-band, piece of cloth worn as an under-garment
			2 કચ્ચો	कुछआ	tortoise
			3 કિનારો, કિનારા પરનો પ્રદેશ	कछार, किनारे की जमीन	coast, coastal region
			4 હમેશા જ્યાં પાણી રહે એ દેશ	जहाँ हमेशा पानी रहे (देश)	marshy land

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			કાઠિયાવાડની ઉત્તરનો એ નામનો દેશ	काठियावाड़ के उत्तर में स्थित प्रदेश का नाम	<i>Kutch</i> , a region to the north of Saurashtra in Gujarat
કછોટી	कछोटी	સ્ત્રી-	1 લગોટી 2 એમા બધાતો અવયવ	लॅगोटी उसमें आवृत अवयव	loin-cloth part covered by it
કછોટો	कछोटो	પુ	1 કચ્છો, કાછડો 2 કચ્છમા બધાતો અવયવ	कछोटा कछोटे में आवृत अवयव	loin-cloth part covered by it
કછોરુ	कछोरु	ન	નઠારુ છોડરુ	कपूत	truant, child gone astray
કચ્છેરુ	कछोरु	ન-	જુઓ 'કચ્છેરુ'	देखिए 'कछोरु'	see 'કચ્છેરુ'
કચ્છલી	कजली	સ્ત્રી-	જુઓ 'કચ્છલી'	देखिए 'कजली'	see 'કચ્છલી'
કચ્છળવુ	कजळवु	અ ક્રિ-	કદરવુ, રાખથી ઢાકવુ, ઠરી જવુ, ઓલવાવુ (અગારાનુ)	कजलाना, बुझना, झँवाना	to be covered with ashes, about to be extinguished
કચ્છળાવુ	कजळावु	અ ક્રિ	જુઓ 'કચ્છળવુ'	देखिए 'कजळवु'	see 'કચ્છળવુ'
કજા	कजा	સ્ત્રી	1 કિસ્મત 2 આફત, હાણિ 3 મોત 4. (લા) અશુભની આશંકા 5 યુક્તિ, તદબીર	कजा, भाग्य आफत, हानि मृत्यु, कजा (ला) अशुभ की आशका युक्ति	fate disaster or calamity death ill omen (special use) trick, strategem
કજાક	कजाक	પુ-	લુંટારો	कज्जाक, डाकू	robber
કજાત	कजात	વિ-	હલકા કુટુંબનુ, નીચ	कुजात, कमजात, नीच	born of a low family, base, mean

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કજારજા	कजारजा	स्त्री	1 દૈવનો કોપ, આકૃત 2 મોત	दैव का कोप, आफत मृत्यु, कजा	wrath of fate, calamity death
કજાવો	कजावो	पु	એક પ્રકારનું ઊંટનું પલાણ, જેની બંને તરફ બેસાય છે	कजावा	kind of saddle for the camel
કજિયાખોર	कजियाखोर	वि	કજિયો કરવાની ટેવવાળું	कजिया करने की आदत वाला	quarrelsome
કજિયાદલાલ	कजियादलाल	पु	1 કોર્ટમાં કજિયા લડવાની ગોઠવણ કરી આપનાર દલાલ 2 (તિરસ્કારમા) વકીલ 3 કજિયા કરાવીને અથવા કરનારાઓનો મધ્યસ્થ બનીને કમાઈ કમાઈ ખાનાર આદમી	कजियादलाल (कचहरी में) (तुच्छकार में) वकील कजियादलाल	lawyer's tout (derog) lawyer person carrying on the profession of agent in law- suits
કજિયાળું	कजियाळु	वि	કજિયો કર્યા કરનારું	झगडालू	quarrelsome
કજિયો	कजियो	पु	કકાસ, તકારર, ટટો	कजिया, तकरार, झगडा	bitter brawl, quarrel, disagreement
કજોડ	कजोड	वि स्त्री	જોડી ન જામે એવું, આણસરખું અયોગ્ય જોડી	जिसकी जोड़ी न बने ऐसा, असमान बेमेल जोड़ी	ill-matched ill-matched pair
કજોડું	कजोडु	न	સ્વભાવ, રૂપ કે ઉમ્મર ઇત્યાદિમાં અસમાન—અયોગ્ય જોડું(વરવહુનું)	स्वभाव, रूप, वय आदि में असमान जोडा (वर-कन्या का), बेमेल जोडा	ill-matched couple
કજ્જલ	कज्जल	न	1 મેશ 2 કાજળ	कालिख काजल, कज्जल	lamp-black, soot collyrium

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કજ્જલી	कज्जली	स्त्री	ગદક અને પારાનુ એક મિશ્રણ	कज्जली	mixture of mercury and sulphur
કટ	कट	स्त्री	1 કટિ, કેડ 2 ઘાસની સાદડી 3 મહેનત, મજૂરી 4 જુઓ 'કટ્ટા' 5 કક્કણ, પર્વતની ધાર-બાજુ	कटि, कमर घास की चटाई, कट मेहनत, मजदूरी देखिए 'कट्टा' कगन, पहाड आदि का किनारा	waist mat exertion, labour see 'कट्टा' slope or side of a mountain
		अ	1 (રવ.) તરત 2 કાપ, પેતરવાની રીત(પોશાક)	तुरन्त कट, काट, तराश	at once, immediately cut (of a garment), way of cutting
કટક	कटक	न	1 સૈન્ય 2 છાવણી 3 હુમલો 4 કટ, કડુ, કક્કણ 5 કોટલુ 6 ઘર 7 કટ, પર્વતની ધાર	सेना, कटक छावनी, शिविर हमला कडा, कगन कवच, छिलका घर पहाड की बाजू	army camp attack bracelet, bangle shell house mountain-ridge
કટકટ	कटकट	स्त्री	1 (રવ.)એક કટાળાભર્યો અવાજ 2 ટકટક, ચીડ ચડે એવી ટોક, કળિયો	कटकट (आवाज) किटकिट, किचकिच	kind of boring sound wrangling, offending remark, quarrel
		अ	1 કટકટ અવાજ થાય એમ 2 વ્યવસ્થિતપણે પણ વેગથી	'कटकट' की आवाज व्यवस्थित रूप से मगर तेजी से, फरीटे से	in a way making 'कटकट' sound in an orderly way but quickly

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કટકટાટ	कटकटाट	पु	કટકટ-ટકટક કરવી તે	किटकिट, टोक-टाक	wrangle, grumble
કટકટારો	कटकटारो	पु	જુઓ 'કટકટાર'	देखिए 'કટકટાર'	see 'કટકટાર'
કટકટાવવુ	कटकटाववु	स क्रि	(દાત.)કટકટ કરવા	किटकिटाना	to grind the teeth
કટકટિયુ	कटकटियु	वि	1 ટકટકિયુ 2 ડ્રજ્યાખોર	किटकिट करनेवाला, बकवादी झगडालू	wrangling quarrelsome
કટકણુ	कटकणु	वि	ખરડ	कनकना (टूटना), खस्ता	brittle
કટકિયુ	कटकियु	वि	1 કટકણુ, ખરડ 2 સૈન્યને લગતુ	कनकना, खस्ता सेना संबंधी	brittle pertaining to an army
		न	1 છાપરુ 2 માળ, મેડો	छप्पर, कटक मकान का दरजा, मजिल	roof upper storey
કટકિયો	कटकियो	पु	સૈનિક, લડવૈયો	सैनिक	soldier, warrior
કટકી	कटकी	स्त्री	નાનો ટુકડો	छोटा टुकडा, टुकडी	small bit, small piece
કટકુ	कटकु	न	1 નાનુ ખેતર 2 કટક, લશ્કર, છાવણી	छोटा खेत, गाटा सेना, छावनी, कटक	small field army, camp
ક ડ્રે	कटको	पु	ટુકડો	टुकडा	piece, bit, portion
કટકો કોર	कटको कोर	न	જુઓ 'કટકોખટકો'	देखिए 'કટકોખટકો'	see 'કટકોખટકો'
કટકોખટકો	कटकोबटको	पु	ટુકડો, ખટકુ ભરતા મોંઠા આપે એટલો ભાગ	टुकडा, दाँतों की काट से मुँह में आये उतना अंश, कौर	piece, morsel, mouthful

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કટખોર	कटखोर	न	એક પક્ષી	एक पक्षी	a bird
કટલું	कटलु	न	1 નાનુ ઝૂપડુ 2 ઝૂપડાનુ બારણ 3 કપાસની સાઠીઓનો ગૂથેલો આડપડો, કડતલુ	छोटी झोंपडी झोंपडी का दरवाजा टटर	small hut door of a hut partition made of reeds or sticks
કટાકટ	कटाकट	સ્ત્રી	1 મારામારી, ઝપાઝપી 2 જીવલેણ દુશ્મનાવટ 3 તીવ્ર હરીફાઈ 4 જુઓ 'કટોકટી'	कटाकटी, मारकाट जानलेवा दुश्मनी तीव्र प्रतिद्वंद्विता देखिए 'कटोकटी'	scuffle, fray mortal enmity keen competition see 'કટોકટી'
કટાકટી	कटाकटी	સ્ત્રી	જુઓ 'કટાકટ'	देखिए 'कटाकट'	see 'કટાકટ'
કટાક્ષ	कटाक्ष	પુ, ન	1 પ્રેમ, સંકેત કે ક્રોધભરી વકટ્ટૃષ્ટિ, 2 (લા) યકોક્તિ, કટાક્ષ કથન	कटाक्ष वक्रोक्ति	side-glance of love, assignation or anger irony (special use)
કટાણ	कटाणु	વિ	1 કટાયેલુ 2 કટના જેવુ બેસ્વાદ 3 બગડેલુ (ખો), આણગમતુ	कसैला बेस्वाद मुँह (बनाया हुआ)	rusty insipid in taste displeased, to make a wry (face)
કટામણ	कटामणु	ન	કવેળા	असमय	inopportune time
કટાર	कटार	વિ	1 કાટ ચડાવે એવુ 2 કટાઈ જાય એવુ 3 બગડેલુ, કટાણ	जो जग लगावे जग लगे ऐसा बिगडा हुआ, कसैला	causing rust liable to be rusty gone bad
કટાર	कटार	સ્ત્રી	1 વર્तमानपत्रनु कॉलम 2. જુઓ 'કટારી'	(अखबार का) कॉलम देखिए 'कटारी'	newspaper column see 'કટારી'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કટારી	कटारी	स्त्री	1 એક બેધારુ શસ્ત્ર 2 (લા) કટાક્ષુભરી દૃષ્ટિ કે વચન	कटार, एक दुधारा हथियार (ला) कटाक्षयुक्त दृष्टि या वचन	dagger, double edged weapon ironic look or word (special use)
કટાવ	कटाव	पु	1 એક છદ 2 પત્તાની રમતમાં અમુક પત્તા નહોવા તે 3 કોતરણી, કામ કરવી તે 4 પતગોના પેચ શવા- કરવા તે	एक छद ताश के खेल में अमुक पत्तों का न होना काट या खोदकर बेलबूटे बनाना (पतग का) पेंच	a metre (literary term) missing certain cards in a game of cards carving, grafting playing at kite-flying
કટાવવુ	कटाववु	स क्रि	1 કપાવવુ 2 કાટ ચડે એમ કરવુ	कटाना, कटवाना धातु का कसाव लगे ऐसा करना	caus of 'કપાવવુ' to make rusty
કટાવુ	कटावु	अ क्रि	કાટ ચડવો	कसाना, जग लगना	to rust
કટિ	कटि	स्त्री	કેડ, શરીરનો ભાગ	कटि	waist
કટિબદ્ધ	कटिबद्ध	वि	કેડ બાધીને ઊભેલુ, તૈયાર	कटिबद्ध, तैयार	ready, having girded up loins
કટિબધ	कटिबध	पु	1 કમરપટ્ટો 2 (ગરમી તથા ઠડીનો ખ્યાલ આવવા) પૃથ્વીના ગોળાના બતાવતા પાંચ ભાગમાંનો કોઈ પણ ભૂ 3 એક છદ, કટાવ	कटिबध, कमरबध कटिबध (पृथ्वी का) (भू) एक छद	waistband any of the five zones of the earth name of a metre (poet)
કટી	कटी	स्त्री	જુઓ 'કટિ'	देखिए 'कटि'	see 'કટિ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કુટેવ	कटेव	स्त्री	જુઓ 'કુટેવ'	देखिए 'कुटेव'	see 'कुटेव'
કુટેશરી	कटेशरी	न	ગળાનુ એક ઘરોણુ	गले का आभूषण	an ornament worn round the neck
કુટેસરી	कटेशरी	न	જુઓ 'કુટેશરી'	देखिए 'कुटेशरी'	see 'कुटेशरी'
કટોકટી	कटोकटी	स्त्री	આણીનો-બારીક સમય, કટાકટી	नाज़क स्थिति या वक़्त, आपात	crisis
કટોરી	कटोरी	स्त्री	1 વાડકી 2 કપડાનો સ્તનભાગ ઉપર રહેતો કપલો	कटोरी, छोटा कटोरा अगिया की कटोरी	small bowl upper part of bodice covering the breasts
કટ્ટર	कट्टर	वि	1 ઘણુ સખત 2 ચુસ્ત, આગ્રહી 3 જીવલોણ	कट्टर, सख्त चुस्त, आग्रही जानलेवा	bitter strict, unrelenting fatal
કટ્ટા	कट्टा	पु	દોસ્તીનો ભંગ	कुट्टी, मैत्रीभंग	breach of friendship
કટ્ટી	कट्टी	स्त्री	જુઓ 'કટ્ટી'	देखिए 'कुट्टी'	see 'कुट्टी'
કટ્ટુ	कट्टु	वि	જુઓ 'કટ્ટર'	देखिए 'कुट्टर'	see 'कुट्टर'
કઠ	कठ	स्त्री	1 કઠારો, બકારો 2 આતરિક પીડા, અમૂઝણ 3 કઠણાઈ	उमस आतरिक पीडा कठिनाई	sultriness, discomfort because of excessive heat inner pain, anxiety hardship, difficulty
કઠણ	कठण	वि	1 ઝટ ભાગે કે પોચુ નીંહ એવુ, સખત	कठिन, कडा, सख्त	hard

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 अधरु, मुश्केल 3 मजबूत 4 दुःखकारक 5 निर्दय	मुश्किल, दुस्साध्य मजबूत दुःखकारक निर्दय	difficult strong painful cruel
કઠણાઈ	कठणाई	स्त्री.	કઠણ હોવું તે	कठिनता	hardness, difficulty
કઠણાશ	कठणाश	स्त्री	જુઓ 'કઠણાઈ'	देखिए 'कठणाई'	see 'કઠણાઈ'
કઠવું	कठवुं	अ क्रि	1 દુઃખ થવું, મૂઝાવું 2 બહારો મારવો-લાગવો	खटकना, घबराना उमस लगना	to be unhappy, to be uncomfortable to be sultry, to feel sultry
કઠવો	कठवो	पु	ઘી, તેલ ભરવાનો ગાડવો	घी-तेल का कुप्पा, कूप	earthen jar for keeping oil or ghee
કઠામ	कठाम	न	જુઓ 'કઠે આણ'	देखिए 'कठे आण'	see 'કઠે આણ'
કઠિન	कठिन	वि	કઠણ	कठिन	hard
કઠિનતા	कठिनता	स्त्री	કઠણપણ	कठिनता	hardness
કઠિયારુ	कठियारु	न	કઠિયારાનો ધધો	लकडहारे का पेशा	woodcutting profession
કઠિયારો	कठियारो	पु	લાકડા કાપી વેચવાનો ધધો કરનારો	लकडहारा	wood-cutter
કઠિયો	कठियो	पु	પૈસો, દોઢિયુ	पैसा	a paisa
કઠે આણ	कठेकाणु	न	1 કુમળી જગા, દેખાડતા શરમ આવે એવી જગા (શરીરની) 2 ખરાબ-કથોલી જગા, કઠામ	(शरीर का) कोमल अग जिसे दिखाने में शर्म आती है कुठौव, कुठौर	(of body) delicate part to expose which one feels ashamed bad place

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કઠેડો	कठेडो	पु	1 બારી, અગાસી, દાદરો ઇત્યાદિ સ્થાનોએ પડી ન જવાય તે માટે કરેલી આડ 2 ગોખ, ઝરુખો 3 ખટારો, મોટું ગાડું	कटहरा झरोखा, गवाक्ष बड़ी बैलगाड़ी	banister balcony large-sized cart
કઠેરો	कठेरो	पु	જુઓ 'કઠેડો'	देखिए 'कठेडो'	see 'कठेडो'
કઠોડું	कठोडु	न	મસાલો રાખવાની ખાનાવાળી લાકડાની પેટી, લક્કડિયુ	चौघड़ा (लकड़ी का)	wooden box with compartments for spices
કઠોર	कठोर	वि	1 કર્કશ 2 કઠણ 3 નિર્દય	कठोर, कर्कश कड़ा, सख्त निष्ठुर, बेरहम	harsh stiff, tough cruel, hard- hearted
કઠોળ	कठोळ	न	દાળ પકે એવું-દ્વિદલ અનાજ	दहलन, द्विदल	pulse (peas, beans etc)
કડ	कड	स्त्री	1 કિ) કમર 2 એક વાર ખાડેલી ડાગર, કરડ 3 ગણીને અપાતી વસ્તુ ઉપર સેકડે અપાતો વધારો, કરડ	कमर, कटि एक बार कूटा हुआ धान गिनती पर दी जाती चीजों पर प्रति सैंकडे का कमिशन	waist rice once pounded commission allowed on the purchase of a hundred articles
કડક	कडक	वि	1 રવ ખડકો બોલે એવું 2 કઠણ, આકરુ 3 કાચુ, અપરિપકવ 4 કડાકાવાળું, ભૂખ્યું, ઉપવાસી	कुरकुरा कठोर कच्चा अपरिपक्व	crisp hard, stiff unripe, raw fasting, hungry
કડકડ	कडकड	अ	રવ.એવો અવાજ કરીને	'कडकड' आवाज करके	making a loud crashing sound

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કડકડતુ	कडकडतु	वि	જુઓ 'કડકડતુ'	देखिए 'कडकडतु'	see 'कडकडतु'
કડકડવુ	कडकडवु	अ क्रि	જુઓ 'કડકડવુ'	देखिए 'कडकडवु'	see 'कडकडवु'
કડકડાટ	कडकडाट	पु	(રવા)કડકડવુ તે, કડકડ એવો અવાજ	कडकडाहट	rolling sound
		अ	1 ઝપાટાબધ, વેગભેર 2 એકસરખી રીતે, અટક્યા વગર	तेजी से बिना रुके	fast, speedily without a break, at the same pitch
કડકડીને	कडकडीने	अ	1 જુઓ 'કડકડીને' 2 ધસારાબધ, ઘણા જ જોશમા	देखिए 'कडकडीने' अत्यधिक वेग से	see 'कडकडीने' with great force
કડકા-બાલૂસ	कडका-बालूस	वि	સાવ ખાલી, કડક બગાળી	मुफलिस, निर्धन	penniless
કડકિયુ	कडकियु	पु.	પુરુષના કાનનું ઘરેણું	पुरुष के कान का आभूषण	an ear- ornament worn by man
કડકી	कडकी	સ્ત્રી	કડકી, કટકી	छोटा टुकडा, टुकडी	small piece
કડકો	कडको	પુ	કડકો, કટકો	टुकडा	piece, bit
કડકોચલી	कडकोचली	સ્ત્રી	કરચલી, કરચોલી	झुर्री (देह पर)	wrinkle, fold
કડખેદ	कडखेद	પુ	કડખો બોલનાર ભાટ	कडखा बोलनेवाला भाट	bard who recites a particular form of verse, viz કડખો (see કડખો)
કડખો	कडखो	પુ	દુહા જેવી એક વીર રસની રચના	दोहे जैसी एक वीर रस की रचना	a form of heroic verse
કડછી	कडछी	સ્ત્રી	રસોઈ હલાવવા કે પીરસવાનું છેડે વાડકી જેવું લાખી ઘડીનું એક સાધન	करछी	ladle

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કડછો	कडछो	पु	भोटी કડછી	बडी कलछी, कलछा	big spoon
કડડ કડડ	कडड कडड	अ	(૨૫) ટૂટવા કે કરડવાનો અવાજ	कडककर (टूटना)	sound of breaking or biting
કડડડભૂસ	कडडडभूस	अ	(૨૫) જુઓ 'કડડભૂસ'	देखिए 'કડડભૂસ'	see 'કડડભૂસ'
કડડતલ	कडडतल	સ્ત્રી	૧ જુઓ 'કરતાલ' ૨ કાનકામી કૂચલી	देखिए 'કરતાલ' खोटी निदा	see 'કરતાલ' scandal, gossip
કડદો	कडदो	પુ	૧ ઓછુ આપવુ તે ૨ ભેગ ૩ કાટલુ	कम देना मिलावट बाट	discount adulteration weight (or measure)
કડપ	कडप	પુ	દાબ, ધાક, અકુશ, વજન	आतक, अकुश	authority, awe, control, respect
કડબ	कडब	સ્ત્રી	જાડખાજરીના સૂકા સાઠા	कडबी, कडवी, ज्वार के डठल जो चारे के काम में लाये जाए	dried stalks or straw of juvar, millet used as a forage for cattle
કડલી	कडली	સ્ત્રી	હાથનુ એક ઘરેણુ, કલ્લી	कडुला	an ornament for the wrist
કડલુ	कडलु	ન	પગનુ એક ઘરેણુ, કલ્લુ	पॉव का एक गहना, कडा	an ornament for the ankle
કડવાટ	कडवाट	સ્ત્રી	૧ કડવો સ્વાદ ૨ લાગણીઓની- સબધોની કટુતા	कडुआहट मन में, सबध में कटुता	bitter taste bitterness (of feeling)
કડવાશ	कडवाश	સ્ત્રી	કડવાપણ	कडुआपन	bitterness of taste
કડવી	कडवी	સ્ત્રી	એક વેલ, ગળો	गुडुच	kind of medicinal creeper

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय	
કડવો	कडवो	पु	1 કડવડો, નાળચાવાળો લોટો 2 પાટીદારની એક જાતનો મારણ	टोंटीदार लोटा, करवा पटेलों की एक जाति का व्यक्ति	container or pot with a spout member of a Patidar caste of that name	
કડા	कडा	पु	1 એક જાતની ડાગર-ચોખા 2 કડો	एक प्रकार का धान-चावल कुडा, कुटज	a kind of rice a medicinal plant	
		સ્ત્રી	1 તળવાનુ વાસણ પેણી 2 ચરુ	कडाही (तलने की), तई देग	frying pan large copper vessel	
કડવું	कडवु	स क्रि	1 દુઃખ થવું, મૂઝાવું 2 બહારો મારવો-લાગવો 3 કઠણ લાગવું, ખૂચવું	दुःख होना, उलझन में पडना उमस होना चुभना, कठिन लगन	to be pained, to be worried to be put out by excessive heat to be hurt, to smart	
			वि	1 કટું 2 અપ્રિય	कटु अप्रिय	bitter unpleasant
			न	એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓનો સમુદાય	एक ही राग के काव्य की कुछ कडियों का समूह	stanza (in poetry)
		वि	કેર જેવું-ખૂબ કડવું	विष-सा कडवा, अति कटु	very bitter, bitter like poison	
કડવું વાખ	कडवु वाख	वि	જુઓ 'કડવું કેર'	देखिए 'कडवु केर'	see 'કડવું કેર'	
કડાઈ	कडाई	સ્ત્રી	પેણી, તળવાનુ વાસણ	कडाही	frying pan	
કડાક	कडाक	अ	(રવ) કડાક એવો અવાજ કરીને	कडाके के साथ	with crackling sound	
કડાકડ	कडाकड	अ	(રવ) કડાકડ એવા અવાજ સાથે	'कडाकड' आवाज के साथ	with crackling sounds rapidly	

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
--------------	--------------------	-----------	--------------	--------------	-----------------

કડાકડી	कडाकडी	स्त्री	1 હરીફાઈ, ચડસાચડસી 2 સખત બોલાબોલી, તડાતડી 3 ઘડાઘડી, મારામારી 4 શત્રુવટ 5 ઉપવાસ	प्रतिद्विदिता, होड, स्पर्धा सख्त बोलचाल	following one another competition wrangling
કડાકૂટ	कडाकूट	स्त्री	માથાકૂટ	मार-पीट शत्रुता कडाका, फाका, उपवास	fighting enmity fast
કડાકૂટિયુ	कडाकूटियु	वि	માથાફોડિયુ, કટાળાભરેલુ	किचकिच, मगजपच्ची	bother
કડાકૂટો	कडाकूटो	पु	માથાકૂટ	मगजचट, उकता देनेवाला	bothersome, tiresome
કડાકો	कडाको	पु	1 (રવ) કડાક એવો મોટો અવાજ 2 નકોરડો ઉપવાસ, લાઘણ	मगजपच्ची कडाका अनशन	botheration loud crash rigid fast
કડાઝૂડ	कडाझूड	अ	અડાબીડ, ધમધોડાર, સજ્જડ	धडाके से, सख्त	vigorously, firm
કડાનુ	कडानु	वि	(કોઈ માટે) અકિત કરાયેલુ, -ને યોગ્ય, -ને માટેનુ	(किसी के लिए) अकित किया हुआ, - के योग्य, - के लिए	(for some one) set apart, suitable for, of use to, for
કડાબીડ	कडाबीड	अ	જુઓ 'કડાઝૂડ'	देखिए 'कडाझूड'	see 'कडाझूड'
કડાબીન	कडाबीन	स्त्री	એક નાની ટૂંકી બદ્દક	छोटी बद्दक	shot gun
કડાચુ	कडाचु	न	મોટી કડાઈ, પેણો	कडाहा	big frying pan
કડિયાકામ	कडियाकाम	न	છોવા ચણવાનુ કામ	राजगीरी	mason's work, masonry

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કડયાળી	कडियाळी	वि	કડીવાળી (ડાગ)	जिसमें लोहे की कड़ियाँ लगी हों (लोहॉगी)	staff or stick with metal ring
કડયુ	कडियु	न	કેડ સુધી આવે એવું બદન, બડી, કેડિયુ(કા)	कमर तक का अगरखा, मिरजई	waist-coat, jacket
કડયો	कडियो	पु	છોવા ચણવાનું કામ કરનાર કારીગર	राज, मकान बनाने वाला कारीगर	mason
કડી	कडी	स्त्री	1 આકડી, 'હૂક' 2 ગોળ વાળેલો તાર કે સળિયો 3 કાનનું એક ઘરેણું 4 બેડી 5 કવિતાનું પદ, ચરણ 6 ઓળ, હાર 7 બારણાની આકડી, સાકળ	कडी कान का एक गहना, बाली बेडी कविता का चरण कतार, लाईन, पक्ति जजीर या कुडी	hook ring-shaped wire or rod ear-ring fettors stanza row hook or chain for door or gate fastening
કડુ	कडु	न	એક વનસ્પતિ	एक वनस्पति, कुटकी	kind of medicinal plant
કડુ	कडु	न	1 ગોળ વાળેલો ધાતુનો સળિયો, મોટી કડી 2 હાથનું એક ઘરેણું	कडा, छल्ला, चलय हाथ का गहना	metal ring bracelet
કડૂખલો	कडूखलो	पु	ખૂણો, કોલો	कोना	corner
કડૂચુ	कडूचु	वि	કડવાશ પડતુ, જરા કડવાજેવા સ્વાદનું	कुछ कड़वे स्वाद का	little bitter
કડે	कडे	अ	1 પાસે, કને 2 તરફ	पास, नजदीक ओर, तरफ	near, in vicinity to, towards
કડેડાટ	कडेडाट	अ	(રવ) સપાટાબધ	तेजी से, झपाटे के साथ	quickly, swiftly

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કડેઘડે	कडेघडे	अ	(रघ.) धमधोशर, બહુ સારી રીતે	अच्छी तरह, पूरे वेग से, धडाके से	in full swing, (going) very well
કડો	कडो	पु	એક વનસ્પતિ, ઇન્દ્રજીવનુ ઝાડ	एक वनस्पति, कुटज, कुरैया इन्द्रजौ का पेड	kind of medicinal plant
કટંગ	कटंग	पु	કુચાલ, ગેરવર્તણૂક	कुचाल, दुराचार	bad conduct, bad manners
કટા	कटा	स्त्री	1 તળવાનુ વાસણ, પેણી 2 ચરુ	कडाही देग	frying vessel big copper vessel
કટાઈ	कटाई	स्त्री	જુઓ 'કડાઈ'	देखिए 'कडाई'	see 'कडाई'
કટાણુ	कटाणु	वि	1 કટાયલ 2 કટણિયુ	कढा हुआ, खूब खौला हुआ चिडचिडा, तुनकमिजाज	boiled irritable
કટાપો	कटापो	पु	1 કઠારો, ધામ 2. કલેશ, પરિતાપ 3 કટી(તિરસ્કારમા)	उमस क्लेश, कुटना कटी (तिरस्कार में)	sultriness, excessive heat grief, sorrow (derogatory for) 'કટી'
કટાયુ	कटायु	न	મોટી કડાઈ	कडाहा	big frying pan
કટાયેલુ	कटायेलु	वि	જુઓ 'કટાણુ'	देखिए 'कटाणु'	see 'कटाणु'
કટારું	कटारुं	न	ઢોર બાધવાની પડાળી— ધર, કોઠિયુ	मवेशी बाँधने का घर, मवेशी खाना	pen for cattle, cow-shed
કટાવવુ	कटाववु	स.क्रि	'કટવુ', 'કટવુ'નુ પ્રેરક	उबलवाना	causal form of 'કટવુ', 'કટવુ'
કટાવુ	कटावु	अ.क्रि	'કટવુ', 'કટવુ'નુ કર્મણ	'કટવુ', 'કટવુ' का कर्मणि रूप, निकाला जाना	passive of 'કટવુ' and 'કટવુ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अढियल	कढियल	वि	उढेलु, ખૂબ ઉકાળેલુ	उबाला हुआ	boiled
अढी	कढी	स्त्री	ખાવાની એક વાની	कढी	curry, kind of soup made from buttermilk
अर	कण	पु	1 દાણો 2 ઘણો નાનો ભાગ, પરમાણુ 3 (લા) ખાધાણ કે અભ્યાગતને આપેલુ ભિક્ષાન્ન 4 ડાગરી	कण बहुत छोटा भाग, परमाणु ब्राह्मण या अभ्यागत को दिया हुआ भिक्षान्न काटे जैसी कगनी वाला	gram of corn small portion or particle gift of corn to a Brahmin (special use) edge with dents
अरड	कणक	स्त्री	ખાધેલો લોટ	गूधा हुआ आटा, भिक्षान्न	dough
अरअ	कणकी	स्त्री	1 ચોખાનો ભગાર 2 ઝીણો અર	चावल के टूटे कण छोटा कण	broken grains of rice small grains
अरअण्यु	कणजियु	न	કણજીના ખીનુ તેલ	करज के बीज का तेल	oil extracted from the seeds of pomgamia tree
अरअण	कणजी	स्त्री	એક ઝાડ	एक पेड़, करज	the pomgamia tree
अरअणु	कणजु	न	કણજીનુ ખી	करज का बीज	seed of pomgamia tree
अरअणो	कणजो	पु	જુઓ 'અણેજરો'	देखिए 'अणेजरो'	see 'अणेजरो'
अरअर	कणदार	वि	1 દાણાદાર 2 ડાગરીવાળુ	दानेदार कगनीदार	granular, grainy having dented border
अरअपीठ	कणपीठ	स्त्री	દાણાપીઠ	अनाज की मडी	grain-market

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કણબી	कणबी	वि	એ નામની એક જ્ઞાતિનું	एक विशेष जाति, कुनबी	of a particular caste of that name
		पु	1 એ જ્ઞાતિનો માણસ 2 (ના કાબેદાર આદમી, ગુલામ	उस जाति का मनुष्य गुलाम	person of that caste subordinate, slave (special use)
કણવીર	कणवीर	न	એક ફૂલગ્રાહક, ડરેણ	कनेर, करवीर	a flowering plant
કણસલુ	कणसलु	न	ડૂડુ, ડરણસુ	बाल (जौ, गेहूँ आदि की)	ear of corn
કણસવુ	कणसवु	अ क्रि	દુઃખના જોરને લીધે ઊઠકાર કરવો-શવો	(दर्द के कारण) कराहना	to groan
કણસાઈ	कणसाई	સ્ત્રી	એક મીઠાઈ, મોતીચૂર	मोतीचूर	kind of sweet
કણસાટ	कणसाट	पु	કણસવુ તે	कराह	groaning
કણ	कण	સ્ત્રી	1 લીંડીપીપર 2 જીરુ 3 બારીક ભાગ 4 એક જાતની માખી	पीपर, पीपल जीरा, कण बहुत छोटा भाग, रवा, कण एक तरह की मक्खी, कण	kind of pepper cumin seed small particle kind of fly
કણિકા	कणिका	સ્ત્રી	1 છેક ઝીણો ડર, ઝીણી કરચ 2 આટણ, કપાશી	कणिका खरौच, घट्ठा	small particle spot left by a shoe-pinch
કણિયો	कणियो	पु	અનાજ વેચનારો ફૂડિયો	अनाज बेचने वाला, मोदी	grain-dealer
કણી	कणी	સ્ત્રી	1 જુઓ 'કણિકા' 2 તેલઘીમા કોઈ વસ્તુ તબ્બા પછી જે ઝીણી ભૂંડી રહે છે તે	देखिए 'कणिका' तलने के बाद पडी रहने वाली बुनकी	see 'કણિકા' residue left in after frying something in it

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अक्ष	कणु	न	1 नानो अक्ष 2 जुओ 'अक्ष', 'अक्ष'	छोटा कण देखिए 'अक्ष', 'अक्ष'	small particle see 'अक्ष', 'अक्ष'
अक्षेणु	कणेजरो	पु	अेक वनस्पति, औषधि	एक वनस्पति, औषध	kind of medicinal plant
अक्षेर	कणेर	स्त्री	अक्षेणु	कनेर	flowering plant
अक्षो	कणो	पु	1 थोडा दिवसनु जन्मेनु सापनु अर्थ्यु 2 डेटो 3 रेटियानी धरी 4 अरजानी आधवाणी लाट	सँपोला पगडी, साफा चरखे या ओटनी की धुरी ओटनी की पेचदार लाट	tiny off-spring of a snake head-band or a turban axis of a spinning wheel dented axle of a spinning wheel
अक्ष	कत	स्त्री	अक्षमनो अक्ष	कलम की काट, कत	point, cut of a pen
अक्षुं	कतकु	न	1 भाग भाडवानो लाडवानो दस्तो 2 अक्षुं	भौंग कूटने का लकडी का दस्ता कुतका, सौटा	wooden pestle for pounding 'bhang' cudgel
अक्षणी	कतरणी	स्त्री	धातुना पतर अक्षवानी अक्षर	कतरनी (धातु के पत्तर काटने की)	pair of scissors used to cut sheets of metal
अक्षतु	कतरातु	वि	त्रासु, आडु अक्षु	कतराता हुआ, तिरछा जाता हुआ	cross, side-long, divergent
अक्षयु	कतरायु	वि	जुओ 'अक्षतु'	देखिए 'अक्षतु'	see 'अक्षतु'
अक्षवु	कतरावु	अ क्रि	1 आडु-त्रासु अक्षु 2 विरुद्ध अक्षु 3 अक्षवु	कतराना विरुद्ध जाना कटना	to cut aslant to go against to be cut

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કતલ	कतल	સ્ત્રી	કાપાકાપી, ખૂનરેણુ	કતલ, કત્લ, હત્યા	massacre, butchery
કતલખાનુ	कतलखानु	ન	કતલ થતી હોય તે જગા-મકાન	કત્લગાહ, હત્યા કા સ્થાન	slaughter-house
કતાર	कतार	સ્ત્રી	1 હાર, અલગાર 2 લડાઈ, કાપાકાપી	કતાર, પક્તિ લડાઈ, મારકાટ	queue, row war, massacre
કતાલ	कताल	વિ.	ખૂની, કતલ કરનાર	ખૂની, કતલવાજ, હત્યારા	murderer
		પુ, સ્ત્રી	1 આણખનાવ, ડ્રજ્યો 2 રડારોળ, કલેશ	અનવન, કજિયા રો-પીટ, કલેશ	quarrel loud lamentations
કત્તા	कत्ता	સ્ત્રી	ઠીકરાનો ગોળ કકડો, કૂકો	કત્તા, પાસા (મિટ્ટી કા),	round broken piece of earthen pot
કત્લેઆમ	कत्लेआम	સ્ત્રી	કશા અકુશ કે વિવેક વિનાની કતલ, ખૂનરેણુ	કત્લેઆમ	massacre, indiscriminate slaughter
કથક	कथक	વિ	કહેનારુ, બોલનારુ, વર્ણવનારુ	કથક	narrator
		પુ.	1 વકતા 2 પુરાણી	વક્તા પુરાણ બ્રાંચને વાલા, કથક	speaker one who gives a recital of <i>purana</i>
			3 નટ અને ગાયક	નટ ઓર ગાયક, કથક	actor-singer
		ન	કહેવત	કહાવત	proverb
કથન	कथन	ન	1 કહેવુ તે, બોલ 2 વર્ણન	કથન વર્ણન	statement narration, description
			3 વિવેચન 4 કહેવત	વિવેચના કહાવત	criticism saying or proverb

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કથની	कथनी	स्त्री	1 કથા, વાત 2 કહેવાની રીત, કહેણી 3 કૂથલી	कथा, बात कहने की रीत निदा	story, tale manner of telling scandal
કથરોટ	कथरोट	स्त्री	મોટો શાળ	कठौता, बड़ी थाली	large metal plate, trencher
કથવું	कथवु	स क्रि	1 કહેવુ, બોલવુ 2 કથા-વાત કરવી 3 ટીકા કે વિવેચન કરવુ	कहना, बोलना कथा-बात करना टीका या विवेचना करना	to say, to speak to talk to criticise
કથળવુ	कथळवु	अ क्रि	1 સ્થાન ભ્રષ્ટ થવુ, ઊતરી જવુ (હાડકુ ઇત્યાદિ) 2 બગડવુ, વણસવુ	उखडना (हड्डी आदि का उतरना) टूट-फूट जाना, विनष्ट होना, बिगडना	to be displaced, to be dislocated (bone etc) to deteriorate, to degenerate
કથા	कथा	स्त्री	1 વાર્તા, કહાણી 2 ઇશ્વર કે ધર્મ સબધી ભાષણ, કીર્તન કે વાર્તા કરવી તે 3 વૃત્તાત, ચરિત્ર	कथा, वार्ता, कहानी ईश्वर या धर्म सबधी भाषण, कीर्तन या कथा कहना वृत्तात, चरित्र, कथा	story, narrative sermon life-story, biography
કથાકાર	कथाकार	पु	1 કથા કહેનાર 2 વાર્તા બનાવનાર	कथाकार कहानीकार	story-teller story-writer
કથાનાક	कथानक	न	1 કથાનો ભાગ-કિસ્સો 2 આડકથા, ઉપકથા 3 કહેણ	कथा का भाग-किस्सा, कथानक उपकथा कूठव	plot of a story side story, part of a story improper place

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કથાનાયક	કથાનાયક	પુ	કથાનુ મુખ્ય પાત્ર	કથાનાયક	hero
કથાપ્રસંગ	કથાપ્રસંગ	પુ	કથાને માટે અનુકૂળ પ્રસંગ	કથાપ્રસંગ	incident proper for a story
કથાભટ	કથાભટ	પુ	પુરાણી, વ્યાસ	કથાકાર, વ્યાસ, કથાવાચક	one who gives a religious discourse
કથાભટ્ટ	કથાભટ્ટ	પુ	જુઓ 'કથાભટ'	દેખિયે 'કથાભટ'	see 'કથાભટ'
કથીર	કથીર	ન	1 કલાઈ અને સીસાની મેળવણીથી બનેલી ઘાતુ જસત 2 લા.કલકી-તુચ્છ વસ્તુ	કથીર	pewter
કથીરી	કથીરી	સ્ત્રી	એક જીવડુ	હલ્કી, નિકૃષ્ટ વસ્તુ	worthless thing (special use)
કથીરો	કથીરો	પુ	મોટી કથીરી	કિલની, ચિચડી	tick
કથોલ	કથોલ	સ્ત્રી	1 સારા લાગનો અભાવ 2 કથળવુ તે જુઓ 'કથોલુ'	બડી કિલની અચ્છે લાગ કા અભાવ બિગડના દેખિયે 'કથોલુ'	big tick lack of opportunity being spoiled see 'કથોલુ'
કથોલુ	કથોલુ	વિ	1 કંઠેકાણાનુ 2 લાગ વિનાનુ, અગવડ ભરેલુ	કુઠોર કા અસુવિધાજનક, બિના લાગ કા	of improper place uncomfortable, having no opportunity
કથ્યાઈ	કથ્યાઈ	વિ	કથાના જેવા રંગનુ	કથ્યાઈ (રંગ)	of chocolate colour
કદ	કદ	ન	1 શરીરની ઊંચાઈ 2 પ્રમાણ, વિસ્તાર, આકાર 3 વજન, ભાર, બોજ	કદ, શરીર કી ઊંચાઈ પરિમાણ, વિસ્તાર, આકાર વજન, ભાર, બોજ	physical height size, bulk, form weight, load

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 पदवी, दरजा 5 ओंठ जातनु रेशमी वस्त्र 6 'कु' - ખરાબ, નિંદા એ અર્થ પતાવતો (नाम पूर्व आगतो) पूर्वग, ॐ. ३६३५)	पद, दरजा एक प्रकार का रेशमी वस्त्र 'कु'-खराब, निंद आदि अर्थों में	degree, position kind of silk prefix before noun adding the sense of bad or contemptible (e g ३६३५)
કદમ	कदम	न	1 પગ 2 પગલુ, ડગલુ 3 કદબનુ ઝાડ	कदम, पाँव डग कदब का पेड, कदम	the foot step kind of tree
કદમબોસ	कदमबोस	वि	1 ચરણ ચૂમનારુ 2 નમ્ર, આજ્ઞાકિત	चरण चूमने वाला नम्र, आज्ञाकित	one licking the feet humble, obedient
કદમબોસી	कदमबोसी	स्त्री	1 ચરણ ચૂમવા તે 2. દડવત પ્રણામ, નમસ્કાર	कदमबोसी नमस्कार, दडवत्	kissing the feet of someone obeisance
કદમી	कदमी	वि	કદમ, પ્રાચીન	कदीम, प्राचीन	ancient
કદર	कदर	स्त्री	ઘટતી કિંમત કરવી તે, બૂજ	कदर, कद्र	appreciation
કદરજ	कदरज	वि	1 કજૂસ 2 પાણી, ક્ષુદ્ર	कजूस क्षुद्र, पाजी	miser mean, low
કદરદાન	कदरदान	वि	કદર જાણે એવું, ગુણજ્ઞ	कदरदान	appreciative
કદરદાની	कदरदानी	स्त्री	કદરદાન છોવું તે, કદર જાણવી તે	कद्रदानी	appreciation
કદરવું	कदरवुं	अ क्रि	ઓલવાવું, બુઝવું (દીવાનું કે દેવતાનું)	बुझना (दीपक, अग्नि)	to extinguish (of fire, lamp)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કદરાવુ	कदरावु	अ क्रि	જુઓ 'કદરવુ'	देखिए 'कदरवु'	see 'कदरवु'
કદરુપુ	कदरुपु	वि	કૂબડુ, બેડોળ	कुरूप, बेडौल	ugly, ungainly
કદવા	कदवा	स्त्री	કદૂવા, શાપ	बद्दुआ, शाप	curse
કદવાન	कदवान	वि	કદવાળુ, કદાવર	डील-डौल का, कद्दावर	of big size, strong and stout
કદવુ	कदवु	स क्रि	મારવુ, ઇજા કરવી	मारना, कष्ट पहुँचाना	to beat, to hurt
કદલી	कदली	स्त्री	કેળ	कदली, केला	plantain tree
કદલીફલ	कदलीफल	न	કેળુ	कदली का फल, केला	banana, plantain
કદલીવન	कदलीवन	न	કેળાનુ વન, કેળા જ્યા ઘણા હોય એવી જગા	कदली का वन	grove of plantain trees
કદહાડો	कदहाडो	पु	1 કમોસમ 2 દુઃખનો દહાડો	खराब ऋतु दुर्दिन, कुदिन	bad season day of sorrow
કદળી	कदळी	स्त्री	જુઓ 'કદલી'	देखिए 'कदली'	see 'कदली'
કદળીપુષ્પ	कदळीपुष्प	न	કેળનુ ફૂલ, કદલીપુષ્પ	कदली का पुष्प	flower of plantain tree
કદલીફલ	कदलीफल	न	જુઓ 'કદલીફલ'	देखिए 'कदलीफल'	see 'कदलीफल'
કદલીવન	कदलीवन	न	જુઓ 'કદલીવન'	देखिए 'कदलीवन'	see 'कदलीवन'
કદલીસ્તભ	कदलीस्तभ	पु.	કેળનો સ્તભ, કદલીસ્તભ	केले का स्तभ	stem of plantain tree
કદાચ	कदाच	अ	1 દૈવયોગે, રખેને 2 કોઈ વાર (સભવ બતાવવા)	कदाचित्	as luck would have it, lest sometimes
કદાચિત્	कदाचित्	अ	કોઈ વખતે, ક્યારેક, કદી	कभी कभी	at times, sometimes

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કદાગરો	कदागरो	પુ	1 કઞ્જિયો 2 અદાવત, અટસ	झगडा अदावत	quarrel ill-will enmity
કદાવર	कदावर	વિ	1 મોટા કદ અશ્વવા આકૃતિવાળુ 2 મજબૂત	कददावर मजबूत	large-sized or tall in stature stout, strong
કદી	कदी	અ	1 કદાપિ, ક્યારે પણ 2 કોઈક વેળા	कदापि, कभी, हर्गिज कभी, किसी समय	at times sometimes
કદીક	कदीक	અ	જવલ્લે, કોઈક જ વાર	कभी-कभी	rarely
કદી કદી	कदी कदी	અ	કોઈ કોઈ વાર	कभी-कभी	sometimes, at times
કદીમ	कदीम	વિ	અસલી, પ્રાચીન, જૂના જમાનાનુ	कदीम, प्राचीन, पुराना	ancient, olden
કદીમદી	कदीमदी	અ	કદી નહિ ને કોઈવાર	शायद ही कभी, कभी न कभी	once in a while
કદીમી	कदीमी	વિ	જુઓ 'કદીમ'	देखिए 'कदीम', कदीमी	see 'કદીમ'
કદુવા	कदुवा	સ્ત્રી	કદવા, શાપ	बददुआ, शाप	curse
કદૂપ	कदूप	વિ	કૂબડુ, કદરૂપુ	कुरूप, भद्दा	ugly
કદૂપુ	कदूपु	વિ	જુઓ 'કદૂપ'	देखिए 'कदूप'	see 'કદૂપ'
કધાન	कधान	ન	1 હલકી ગાતનુ અનાજ (કોદરા, બટી ઇ) 2 બગડેલુ અનાજ	कदन्न (साँवा, कोदो आदि) खराब हुआ अन्न	corn of lower quality spoiled corn or food-grain
કનક	कनक	ન	1 સોનુ 2 ધન, દોલત 3 ધતૂરો	कनक, सोना धन-दौलत धतूरा, कनक	gold wealth, riches a kind of poisonous plant

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કનકવી	कनकवी	સ્ત્રી	નાની પતગ	छोटा कनकौवा, गुड्डी, पतग	small paper-kite
કનકવો	कनकवो	પુ	પતગ	कनकौवा, पतग	paper-kite
કનકગત	कनकगत	સ્ત્રી	કનકવુ તે, હેરાનગત	कष्ट, परेशानी	harassment
કનકવું	कनकवु	સક્રિ	દુઃખ દેવુ, પજવવુ	सताना, परेशान करना	to harass
કનાત	कनात	સ્ત્રી	1 તબૂની કપડાની ભીત 2 જાડા કપડાનો પડદો	कनात मोटे कपडे का परदा	cloth walling of a tent curtain of thick cloth
કનિષ્ઠ	कनिष्ठ	વિ	1 ઉમ્મરમા સૌથી નાનુ 2 સૌથી નાનુ 3 છેક ઊતરતુ, હલકામા હલકુ	कनिष्ठ सबसे छोटा निकृष्ट, बहुत हलकी कोटि का	youngest smallest meanest, of lowest quality
કને	कने	અ	પાસે	पास	near
કનેરી	कनेरी	સ્ત્રી	1 ચોખાની કાચ 2 કિનારી, કોર 3 કાગરી 4 ખારી પૂરી 5 એક પક્ષી	चावल की कौजी किनारी, छोर कॅगनी, कार्निस खारी पूरी एक पक्षी, कनेरी	rice porridge border cornice salt bun kind of bird, canary
કનૈયો	कनैयो	પુ	કૃષ્ણ, કનાઇ	कृष्ण, कन्हैया	Krishna
કન્ના	कन्ना	સ્ત્રી	કન્યા, પતગના ઢક અને કમાન સાથે બધાતી દોરીની યોજના	कन्ना (पतग का)	string tied to the frame of a paper-kite
કન્ની	कन्नी	સ્ત્રી	1 કન્નાતી ઓછી કરવા માટે પતગને છેડે ચોડાતી પૂછડી 2 નાની પતગ	कन्नी (छज्जी) छोटी पतग, गुड्डी	paper or rag tail attached to a paper-kite to reduce its swaying small paper-kite

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કન્યા	कन्या	સ્ત્રી	1 કુવારી છોકરી 2 પુત્રી, દીકરી 3 એક રાશિ 4 મોટી ઇલાયચી 5 દુર્ગા, પાર્વતી	कन्या पुत्री, बेटी एक राशि, कन्या बडी इलायची दुर्गा, पार्वती	maiden daughter sign Virgo a kind of big cardamom Durga, a goddess
કપચી	कपची	સ્ત્રી	1 સડક પૂરવાનો પથ્થર 2 પથ્થરનો ભૂકો	गिट्टी पत्थर का चूरा	metal for roads small bits of stone
કપટ	कपट	ન	છળ, પ્રપચ	कपट, छल	deceit, duplicity
કપટી	कपटी	વિ	1 કપટવાળુ, કપટભર્યું 2 કપટ કરનારુ	कपटयुक्त कपटी, फरेबी	deceitful fraudulent
કપઠાણ	कपठाण	સ્ત્રી	જુઓ 'કપઠાણ'	देखिए 'कपठाण'	see 'कपठाण'
કપડછાણ	कपडछाण	વિ	1 કપડાથી ચાળેલુ 2 કપડામા સીવી લઈ છાણ માટીથી લીપેલુ	कपडे से छाना हुआ कपडमिट्टी हुआ	strained through cloth sewn in cloth and seated in dung and earth
		ન	કપડાથી ચાળવુ તે	कपडछान	straining through cloth
કપડમટ્ટી	कपडमट्टी	સ્ત્રી	હવા ન પેસે તે માટે અને માટી વડે ડાટો મારવો કે કપડુ લપેટી માટીનો લેપ કરવો તે	कपडमिट्टी	making container air- tight by corking it with mud and cloth or by wrapping it with cloth and plastering with mud

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કપડુ	कपडु	न	1 કાપડ, લૂગડુ 2 પહેરવાનુ લૂગડુ—વસ્ત્ર	कोरा कपडा, कपडा वस्त्र	cloth garment, dress
કપડાલત્તા	कपडालत्ता	न	પહેરવાના લૂગડાલત્તા	कपडालत्ता	clothes, garments
કપરુ	कपरु	वि	1 મુશ્કેલ, અઘરુ 2 વસમા-કડક સ્વભાવવાળુ 3 ખાપરુ, ભારે પહોચેલુ	कठिन तेज स्वभाव चाला, सखत बहुत चालाक, घाघ	difficult short-tempered sharp, clever
કપાતર	कपातर	वि	1 કુપાત્ર, નાલાયક, અનધિકારી 2 બેઅદબ, છકી ગયેલુ	कुपात्र, नालायक, अनधिकारी बेअदब, बहका हुआ	undeserving immodest
કપાલ	कपाल	न	1 ભમરની ઉપરનો અને માથાના વાળની નીચેનો મોઢાનો ભાગ, લલાટ 2 ખોપરી 3 લા ઋઘ્ય	ललाट, माथा खोपडी, कपाल (ला) भाग्य	forehead skull fate, luck (special use)
કપાશિયો	कपाशियो	न	1 કપાસનુ બી 2 પાકેલા ગૂમડા, ખીલ છ માથી નીકળતો ગઠાયેલો ઘણો	बिनोला कडी पीब, कील	cotton seed granlike bit of hardened flesh coming out of a boil or pimple
કપાશી	कपाशी	स्त्री	(પગની) કણી, આટણ	तलवे में पडा हुआ घट्ठा, गोखरू	corns
કપાસ	कपास	पु	1 કપાસનો છોડ 2 બી સાથેનુ રૂ	कपास बीज के साथ की रूई	cotton-plant cotton which is unprocessed
કપાસિયો	कपासियो	पु	જુઓ 'કપાશિયો'	देखिए 'कपाशियो'	see 'कपाशियो'
કપાસી	कपासी	स्त्री	જુઓ 'કપાશી'	देखिए 'कपाशी'	see 'कपाशी'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કપાળ	कपाळ	न	જુઓ 'કપાલ'	देखिए 'कपाल'	see 'कपाल'
કપાળકૂટ	कपाळकूट	स्त्री	માથાફોડ, મગજમારી	मगजपच्ची	botheration
કપાળકૂટિયુ	कपाळकूटियु	वि	1. માથાફોડિયુ, કટકટ કરતુ 2. ઘણી મગજમારી કરાવે એવુ	मगजपच्ची करनेवाला, मगजचट पेचीदा	bothersome very complicated
કપાળકૂટુ	कपाळकूटु	वि	જુઓ 'કપાળકૂટિયુ'	देखिए 'कपालकूटियु'	see 'कपालकूटियु'
કપૂત	कपूत	पु	ખરાબ-નામ બોળે એવો પુત્ર	कपूत, कुपुत्र	unworthy son bringing disgrace to family
કપૂર	कपूर	न	એક સુગંધી પદાર્થ	कपूर	camphor
કપૂરકાચરી	कपूरकाचरी	સ્ત્રી	એક સુગંધીદાર મૂળિયુ	कपूरी (एक सुगंधित जडी)	camphorous long zedoary
કપૂરકાચલી	कपूरकाचली	સ્ત્રી	જુઓ 'કપૂરકાચરી'	देखिए 'कपूरकाचरी'	see 'कपूरकाचरी'
કપૂરી	कपूरी	वि	1. કપૂરના જેવુ, સફેદ 2. એ નામની જાતનુ (નાગરવેલનુ પાન)	कपूर के रंग का, कपूरी कपूरी (पान)	white (like camphor) betal leaf of 'Kapuri' variety
કપેચા	कपेचा	न	એક વસાણુ	औषधयुक्त एक पाक	a medicinal tonic
કપેચુ	कपेचु	वि	અટપટુ, અઘરુ	अटपटा, पेचीदा	difficult, complex
કપોટી	कपोटी	સ્ત્રી	1. પોપડી (રોટલી, રોટલા ઇત્યાદિની) 2. પાતળી છાલ, ઝીણુ	पपडी (रोटी की) पतली छाल, ऊपरी पतली परत	crust (over bread, chapati etc) thin upper film

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
उपोट्ट	कपोट्ट	न	जुओ 'उपोटी'	दर्शिए 'उपोटी'	see 'उपोटी'
उपोल	कपोल	पु	1 गाल 2 पाणिथानी ओड गाल	रुपान, गाल बनिगा सै एक जान	cheek one of the sub- castes among bhattas
उपोलअल्पित	कपोलकल्पित	वि	बनावटी, ओठवी अटेलु	रुपोनकल्पित	fictionous fabricated
उपोण	कपोळ	पु	जुओ 'उपोल'	दर्शिए 'उपोल'	see 'उपोल'
उपान	कप्तान	पु	1 आजेवान, पडो-परी अमलदार 2 टकेल, पडाला डे आनपोटनो उपर 3 पलताननो डे ट्रेड टडोनो उपर	रुपान, बग अकसर जहाज स रुपान सना या क्रिमो दरुजी स अगुआ, (क्रिकेट आदि स) रुपान	leader, chief officer captain of a ship captain of an army or of a team (e.g. a cricket team)
उपड	कप्पड	न	अपड	कपडा	cloth
उपपी	कप्पी	स्त्री	जुओ 'उपपी'	दर्शिए 'उपपी'	see 'उपपी'
उफ	कफ	पु	1 आयुर्वेद प्रमाने शरीरनी नरु धातुमानी ओड, श्लेष्म 2 भासी, अघरस 3 गणरो, बणजो	कफ	phlegm
उफन	कफन	न	शबने ओटाडवानु लुगडु	खोसी बलगम, कफ, खखार कफन	cough phlegm shroud or winding sheet, a cloth covering a dead body
उफनी	कफनी	स्त्री	1 इअरनु कुत्तु, इअरनो वेश 2 टूअरी पायनु लापु पछेरु	कफनी छोटी बाँह का लबा कुरता	cloak worn by a Muslim saint long shirt with short sleeves

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ક્રૂ	कफा	वि	ખફા, ક્રોધાયમાન, નાખુશ	खफा, नाखुश, क्रुद्ध	angry, displeased
ક્રૂમરજી	कफामरजी	स्त्री	નાખુશી, ઈતરાજી	खफगी, नाराजगी	anger, displeasure
ક્રૂડુ	कफोडु	वि	1 વિષમ, વિપરીત 2 ક્રુટુ, ક્રુતુ 3 મુશ્કેલ	विषम, प्रतिकूल कुटगा, बेमेल मुश्किल	adverse awkward difficult
કબજ	कबज	वि	1 કબજામાં કે તાબામાં હોય એવું 2 બંધકોશવાળું	कब्जे में कोष्ठबद्ध वाला	in the possession of constipated
કબજાગીરો	कबजागीरो	पु	મિલકતનો કબજો આપીને તે ઉપર બ્યાજે નાણા લેવા તે	भागेबधक, पटबधक	mortgage with possession
કબજિયત	कबजियत	स्त्री	1 રોકાણ, અટકાવ 2 બંધકોશ, મળાવરોધ એક રોગ	रोक, अवरोध कोष्ठबद्धता, कब्जियत	stopping constipation
કબજિયાત	कबजियात	स्त्री	જુઓ 'કબજિયાત'	देखिए 'कब्जियात'	see 'कब्जियात'
કબજેદાર	कबजेदार	वि पु	કબજો ધરાવનારું તેવો માણસ	कब्जादार ऐसा व्यक्ति	possessing a person possessing
કબજો	कबजो	पु	1 તાબો, હવાલો, ભોગવટો 2 દબાણ, પકડ 3 બાય વગરનું અથવા ટુકી બાયનું બંધન 4 ચોળી	कब्जा पकड़ बिना बॉह का या छोटी बॉह का कुर्ता चौली, अंगिया	possession, custody grip, pressure waist-coat with or without sleeves blouse
કબજોભોગવટો	कबजोभोगवटो	पु	કબજો તેમ જ ભોગવટો	कब्जा और उपभोग, अधिकार और भुक्ति	possession and use

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કબર	कबर	સ્ત્રી	1 કબ્ર, ધોર 2 તેમા મસ્જુ દાટી ઉપર કરેલુ ચણતર	कबर, कब्र, गोर कब्र पर का चबूतरा या पत्थर, कब्र	grave grave-stone, tomb
કબરસ્તાન	कबरस्तान	ન	મુસલમાનો યા ખ્રિસ્તીઓનુ સ્મશાન	कब्रिस्तान	grave-yard, burial ground
કબાટ	कबाट	પુ, ન	વસ્તુઓ મૂકવાની ખાનાવાળી એક બનાવટ	अलमारी	cupboard
કબાડ	कबाड	વિ પુ	કદરૂપુ, ખરાબ, દુષ્ટ ઘાસનો ભોર, ગણ	कुरूप, खराब, दुष्ट घास का गज, गजी	ugly, wicked heap of grass well arranged, hay-stack
		ન	ઇમારતી લાકડુ	मकान बनाने की लकड़ी	timber
કબાડિયુ	कबाडियु	વિ	1 જાડુ અને જોરવાળુ 2 કબાડી	मोटा और शक्तिशाली बुरा काम करनेवाला	stout and strong wicked
કબાડી	कबाडी	વિ પુ	કબાડા કરનારુ 1 ઇમારતી લાકડાનો વેપારી 2 કાઠચારો	बुरा काम करनेवाला मकान की लकड़ी का व्यापारी लकड़हारा	wicked dealer in timber wood-cutter
કબાડુ	कबाडु	વિ ન	1 બેડોળ, કઢગુ, કદરૂપુ 2 નઠારુ, દુષ્ટ, વ્યભિચારી	बेडौल, कुढ़गा, कुरूप नीच, दुष्ट, व्यभिचारी	ugly, of a bad shape, uneven mean, wicked
કબાબ	कबाब	પુ	તેવુ કામ	वैसा काम	wicked deed
કબાબ	कबाब	પુ	માસનુ મૂઠિયુ-ભાજિયુ	कबाब	fried meat
કબાબચીની	कबाबचीनी	સ્ત્રી	એક ઔષધિ	कबाबचीनी	a medicine, cubeb

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કબાલો	कबालो	पु	1 साटु 2 साटानो કરાર 3 વાયદે નાણા આપવાના કરારથી કરેલી ખરીદી	अदला-बदली विनिमय का करार वादे के मुताबिक पैसे देने की शर्त पर की गई खरीद	exchange deed of exchange deed of purchase when the payment is to be made by instalments
કબી	कबी	अ	કબૂ , કદી	कभी, कदापि	any time, sometimes
કબીર	कबीर	वि पु	મહાન, મોટુ 1 ભાટ, કવિ 2 પ્રસિદ્ધ ભક્તકવિ અને જ્ઞાની	कबीर, महान भाट, कवि सत कबीरदास	great minstrel, poet St Kabir
કબીલો	कबीलो	पु	1 બૈરા છોકરા 2 કુટુંબ, પરિવાર	पत्नी और बच्चे कुल, वंश, परिवार, कबीला	wife and children family, household
કબૂલાવવુ	कबुलाववु	स क्रि	'કબૂલવુ' નુ પ્રેરક	कबूलवाना	caus of 'કબૂલવુ'
કબૂલાવુ	कबुलावु	अ क्रि	'કબૂલવુ' નુ કર્મીણ	कबूला जाना	passive of 'કબૂલવુ'
કબૂતર	कबूतर	न	એક પખી	कबूतर	pigeon, dove
કબૂતરખાનુ	कबूतरखानु	न	1 કબૂતરો રાખવાનું પાંજરું 2 (લા) નાના નાના ઘણા ખાનાવાળું એક કબાટ 3 ગદી જગા	कबूतरखाना (ला) छोटे-छोटे बहुत दरारों वाली अलमारी गदी जगह	cage or place for keeping pigeons cup-board with a number of small partitions dirty place
કબૂતરી	कबूतरी	स्त्री	કબૂતરની માદા	कबूतर की मादा, कबूतरी	female pigeon

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કબૂદ	कबूद	न	એક પક્ષી	एक पक्षी, कबूद	a kind of bird
કબૂધ	कबूध	स्त्री	કુબુદિદ	कुबुद्धि, दुर्बुद्धि	wicked mind or thought
કબૂધિયુ	कबूधियु	वि	કુબુદિદવાળુ	कुबुद्धि	having wicked mind or thought
કબૂલ	कबूल	वि	મજૂર, માન્ય	कबूल	accepted, agreed
કબૂલત	कबूलत	स्त्री	કબૂલવુ તે	कबूलियत, स्वीकृति	agreement, acceptance
કબૂલમજૂર	कबूलमजूर	वि	કબૂલેલુ , મજૂર કરેલુ	स्वीकृत, मजूर	accepted, agreed
કબૂલાત	कबूलात	स्त्री	કબૂલવુ તે	कबूलियत, स्वीकृति	agreement, acceptance
કબૂલી	कबूली	स्त्री	ચણાની ઘાળની ખીચડી	कबूली	preparation of gram pulse
કબેલુ	कबेलु	न	1 કાળુ મોટુ નળિયુ, મોભારિયુ 2 ઘાટ વગરનુ ઠીકરુ 3 મોટી બેડોળ ઠીબ	काली बडी खपरेल, मोघिया बेडौल ठीकरा बडा बेडौल कटाह (मिट्टी की गगर का)	big, black tile shapeless piece of earthen pot big, ugly broken earthen pot
કભારજા	कभारजा	स्त्री	કુભારજા, કર્કશા સ્ત્રી	कुभार्या, कर्कशा	bad woman, shrew
કભાવ	कभाव	पु	અપ્રીતિ, કટાળો, તિરસ્કાર	अप्रीति, ऊब, दुर्भाव, कुभाव	dislike, odium
કભાવો	कभावो	पु	જુઓ 'કભાવ'	देखिए 'कभाव'	see 'કભાવ'
કમ	कम	वि	1 ઓછુ 2 ખરાબ	कम खराब	less, wanting bad, mean
કમઅક્કલ	कमअक्कल	वि	ઓછી બુદ્ધિવાળુ, મૂર્ખ	कमअक्ल	imbecile, foolish

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		स्त्री	ओछी अक्कल	कम अक्ल	imbecility
કમઆવડ	कमआवड	स्त्री	ओछी आवडत	कम कुशलता, कम आना	want of skill or efficiency
કમઆવડત	कमआवडत	स्त्री	જુઓ 'કમઆવડ'	देखिए 'કમઆવડ'	see 'કમઆવડ'
કમકમવુ	कमकमवु	अ क्रि	ધૂજવુ, કપારી ખાવી	कॅपकॅपाना	to tremble, to shiver
કમકમાટ	कमकमाट	पु	1 કમકમવુ તે, કમકમી 2 ત્રાસ, 3 જુગુપ્સા	कॅपकॅपी त्रास जुगुप्सा	trembling horror, torture odium
કમકમાટી	कमकमाटी	સ્ત્રી	જુઓ 'કમકમાટ'	देखिए 'કમકમાટ'	see 'કમકમાટ'
કમકમા	कमकमा	न	ધૂજારી, કપારી	कॅपकॅपी, कॅपन	tremor, shiver
કમખો	कमखो	पु	કાપડુ, કાચળી	कचुकी	bodice, brassiere
કમચી	कमची	સ્ત્રી	1 ચાબુક, કોરડો 2 ચાબુકની ઢોરી	चाबुक, कोडा चाबुक की डोरी	whip, scourge whip-cord
કમજરે	कमजरे	अ	એળે, બરબાદ	वृथा, बेकार, बरबाद	futile, in vain
કમજાત	कमजात	वि	કમઅસલ	रखेली के पेट का	of low birth
કમજોર	कमजोर	वि	અશક્ત, દુર્બળ	कमजोर	weak, infirm
કમજોરી	कमजोरी	સ્ત્રી	અશક્તિ	कमजोरी, दुर्बलता	weakness, infirmity
કમઠાડુ	कमठाडु	न	ખખાટિયુ (ખાસ કરીને વાસનુ)	कमठी (बास की)	chip of bamboo
કમઠાણ	कमठाण	न	1 મોટો ખટલો, રસાલો 2 વાખરો, સરસમાન 3 ઢગઢગ વગરની કે ખાલી મોટી રચના	परिवार, रिसाला असबाब, सामान बेढगी रचना	big parafernalta household furniture big shapeless structure
કમઠાયો	कमठायो	पु	શિલ્પી	शिल्पी	sculptor

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કમઠાળ	कमठाळ	स्त्री	ચિતાળ, કાઠેલુ લાકડુ	फट्टा, चैला	chip or splinter of wood
કમત	कमत	स्त्री.	કુબુદ્ધિ	कुमति	wicked intention
કમતર	कमतर	वि	જુઓ 'કમતરીન'	देखिए 'कमतरीन'	see 'कमतरीन'
કમતરીન	कमतरीन	वि	વધારે ઓછુ-ઊતરતુ	कमतरीन, लघुतम	inferior
કમતાકાત	कमताकात	वि	કમજોર	कमजोर	weak
કમતિયુ	कमतियु	वि	કમતવાળુ	कुबुद्धि, नासमझ	having wicked intention, without understanding
કમનસીબ	कमनसीब	वि न	દુર્ભાગી દુર્ભાગ્ય	कमनसीब, अभागा कमनसीबी, दुर्भाग्य	unfortunate misfortune
કમબેશ	कमबेश	वि	ઓછુવતુ	कम-ज्यादा, कमोबेश	more or less
કમનીય	कमनीय	वि	1 ચાહવા-ઠચ્છવા યોગ્ય 2 સુદર, મજેનુ	कमनीय सुदर, कमनीय	attractive charming
કમર	कमर	स्त्री.	કમ્મર, કેડ	कमर	waist
કમરક	कमरक	न.	એક ખાટુ ફળ	कमरख (फल)	a fruit
કમરકસ	कमरकस	वि	કમર કસનારુ, જોરનુ કામ કરનારુ	कमर कसना, जोरों से काम करना	girding up one's loins
		पु न	લડવૈયો, વીરપુરુષ કેડને મજબૂતી આપનાર ઔષધિ	योद्धा, वीरपुरुष कमर को जोर देने वाली औषध	warrior, hero medicine for making loins strong
કમરતૂટ	कमरतूट	वि	કમર તોડી નાખે તેવુ અઘરુ (કામ)	कठिन (काम)	strenuous
કમરતોડ	कमरतोड	वि	જુઓ 'કમરતૂટ'	देखिए 'कमरतूट'	see 'कमरतूट'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કમરપટો	कमरपटो	पु	કેડે બાધવાનો પટો	कमरपट्टा	belt, waist-band
કમરપટ્ટો	कमरपट्टो	पु	જુઓ 'કમરપટો'	देखिए 'કમરપટો'	see 'કમરપટો'
કમલ	कमल	ન	1 એક ફૂલ, કમળ 2 ગર્ભસ્થાન	कमल गर्भाशय का मुँह	lotus, a kind of flower womb, uterus
કમળ	कमळ	ન	જુઓ 'કમલ'	देखिए 'કમલ'	see 'કમલ'
કમળકાકડી	कमळकाकडी	સ્ત્રી	કમળનુ બીજ	कँवलगट्टा	seed of the lotus plant
કમળનાળ	कमळनाळ	સ્ત્રી	કમળની ઠાંડી	कमलनाल	stock of the lotus plant
કમળપૂજા	कमळपूजा	સ્ત્રી	1 કમળ ચડાવીને પૂજા કરવી તે 2 જેમા દેવને મસ્તક ચડાવાય છે એવી પૂજા	कमल चढा कर की गई पूजा मस्तक चढाकर की जाने वाली पूजा	worship with lotus flowers worship with a human head as offering
કમળી	कमळी	સ્ત્રી	1 એક ફૂલ 2 એક રોગ	एक फूल एक रोग	kind of flower a disease, a type of jaundice
કમળો	कमळो	પુ	1 એક રોગ 2 (લા) વિકૃત દૃષ્ટિ	पीलिया, पाड़ुरोग (ला) विकृत दृष्टि	jaundice perverted vision
કમંડલુ	कमडलु	ન	1 સયાસીનુ જલપાત્ર 2 એક ધાતુપાત્ર (પીરસવાના કામનુ)	सन्यासी का जलपात्र, कमडल परोसने के काम आने वाला एक धातुपात्र	water-pot of an ascetic a metal vessel (for serving)
કમડળ	कमडळ	ન	1 સયાસીનુ જલપાત્ર 2 એક ધાતુપાત્ર	कमडल, सन्यासी का जलपात्र एक धातु पात्र	water-pot used by a <i>sanyasi</i> metal pot
કમડળુ	कमडळु	ન	જુઓ 'કમડલુ'	देखिए 'કમડલુ'	see 'કમડલુ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કમાઈ	कमाई	स्त्री	કમાણી	कमाई	earning
કમાડ	कमाड	न	બારણ	किवाड	door
કમાણી	कमाणी	स्त्री	રળતર, કમાઈ	कमाई	earning
કમાન	कमान	स्त्री	1 કામઠું, ધનુષ 2 કામઠાનો આકાર, એ આકારની કોઈપણ રચના, મહેરાબ 3 સ્થિતિસ્થાપક, ગુણવાળુ ગૂંછળુ	कमान, धनुष कमान के प्रकार की कोई रचना, मेहराब कमानी, स्प्रिंग, स्थिति स्थापक	bow arch spring
કમાનગર	कमानगर	पु	1 કમાન ચણનારો કારીગર 2 ચિતારો 3 હાડવૈદ	कमान बनानेवाला, कमानगर चित्रकार, कमगर हड्डी बैठाने वाला, कमगर	workman who constructs an arch painter bone-setter
કમાનદાર	कमानदार	वि	1 કમાનવાળુ 2 અર્ધગોળાકાર	कमानदार, मेहराबदार अर्ध गोलाकार	arched describing a semi-circle
કમાલ	कमाल	वि स्त्री	1 સપૂર્ણ 2 ઉત્કૃષ્ટ, ઘણું સારું 3 સુદર હૃદ, પરાકાષ્ટા	कमाल, पूर्ण सर्वोत्तम, बहुत कमाल सुदर पराकाष्ठा, कमाल	perfect excellent beautiful height of extreme, climax
કમાલિયો	कमालियो	पु	1 હીજડો, ક્ષતકો 2 નપુસક, વ્યડળ	हिजडा नपुसक	eunuch impotent
કમારગ	कमारग	पु	1 નઠારો-આડો રસ્તો, કુમાર્ગ 2 અધર્મ	कुमार्ग अधर्म	evil course violation of religious dictates

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 કુછુદ	लपटता	vice
કમાવવુ	कमाववु	स क्रि	1 (આમડુ) કેળવવુ, સાફ અને સુવાળુ કરવુ 2 'કમાવુ' નુ પ્રેરક, કમાણી કરાવવી	(चमडा) कमाना, काम लाने लायक बनाना 'કમાવુ' ક્રિયા का प्रेरणार्थक रूप, कमवाना	to tan to assist in earning
કમાવુ	कमावु	स क्रि	પેદા કરવુ, રળવુ	कमाना, पैदा करना	to earn, to gain
કમાળિયો	कमाळियो	પુ	જુથો 'કમાલિયો'	देखिए 'कमाळियो'	see 'કમાલિયો'
કમિશન	कमिशन	ન	1 દલાલી, ઉકસાઈ 2 નિયુક્ત જન, પચ, તપાસપચ 3 અખત્યારનામુ, સનદ 4 અખત્યાર, અધિકાર	कमीशन, दलाली, दस्तूरी नियुक्त जाँच समिति सनद, अधिकार-पत्र अधिकार	commission appointed inquiry committee letter of authority authority
કમી	कमी	વિ સ્ત્રી	1 કમ, ઓછુ 2 ઊણ, અધૂરુ ઓછપ, ઊણપ	कम, अल्प न्यून, अधूरा, ऊन कमी, खामी, कसर	see 'કમ' less, incomplete want, deficiency
કમીજાસ્તી	कमीजास्ती	વિ	ઓછુવતુ	कम-ज्यादा, कम-बेश	more or less
કમીન	कमीन	વિ	1 નીચ, ઉલ્લક મનનુ 2 મેલા મનનુ, કપટી	नीच, कमीना कपटी, मैले मन का	mean (minded), low crooked, deceitful
કમીનુ	कमीनु	વિ	કગાળ, પામર, ઉલ્લકુ	कगाल, पामर	mean, abject, petty

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अमुरत	कमुरत	न	अशुभ मुहूर्त, अयोग्य समय	अशुभ मुहूर्त, अयोग्य समय, कुसाइत	inauspicious moment, inopportune time
अमुरता	कमुरता	न	अमुरतवाणा दिवसो	अशुभ मुहूर्त के दिन	days declared as inauspicious by astrologers
अमोत	कमोत	न	अस्वभाविक मोत	कुमोत	unnatural death
अमोतियु	कमोतियु	वि	1 अमोते भरेतु 2 अमोते भरे तेवु 3 (ला) साहसिक	कुमोत मरा हुआ कुमोत मर जाय वैसा (ला) साहसिक	who died an unnatural death likely to die an unnatural death (fig) rash
अमोद	कमोद	स्त्री	अेक जातनी दागर	धान की एक जाति	a variety of rice
अमोसम	कमोसम	स्त्री	अमो, अवजत	बेमौसम का समय, कुसमय	bad season, improper time
अमर	कम्मर	स्त्री	जुओ 'अमर'	देखिए 'अमर'	see 'अमर'
अयामत	कयामत	स्त्री	जुओ 'अयामत'	देखिए 'अयामत'	see 'अयामत'
अयास	कयास	पु	जुओ 'अयास'	देखिए 'अयास'	see 'अयास'
अयु	कयु	अ, वि स्त्री	कोए, शु अ (प्रश्नवाचक)	कौन, क्या	which ? what ?
अर	कर	पु	1 हाथ 2 वेरो, भलेसूल, जगत 3 लागो 4 किरण 5 सूड 6 बेनी सजा	कर, हाथ कर, महसूल, जकात नेग, लाग किरण, कर सूड, कर दो की सजा	the hand tax, duty fixed levy ray trunk sign for number two
अरअटयो	करकटियो	वि	अभतरधारी	बक्तरपोश, कवचधर	armour clad

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કરકટી	करकटी	स्त्री	ઠાઠડી	अर्धी	wooden bier
કરકર	करकर	स्त्री	1 કઝીણી કઠકરી 2 દ્વેષ, ખાર	किरकिरी द्वेष	coarse sand or small bits of stone grudge, spite
કરકરિયાવર	करकरियावर	पु	કન્યાના લગ્ન પ્રસંગે કરેલો આપલેનો ઠરાવ, પહેરામણી, રીત	दहेज	agreement at the time of marriage pertaining to the sum of money, etc to be given by the bride's party, marriage gifts or dowry customary exchange of gifts, etc at the time of marriage
કરકરુ	करकरु	वि	જુઓ 'કકરુ'	देखिए 'ककरु'	see 'ककरु'
કરકશા	करकशा	वि, स्त्री	કઠાસિયાણ, વઢકારી	लडाकी, कर्कशा	shrew, bad-tempered woman
કરકસર	करकसर	स्त्री	જરૂરી ખર્ચ જ કરવું-થવા દેવું તે, ત્રેવડ	मितव्ययता, किफायत	thrift
કરકોચલી	करकोचली	स्त्री	કરચોલી, કરચલી	झुर्री (शरीर की)	wrinkle, fold
કરકોલવુ	करकोलवु	स क्रि	ધીમે ધીમે કોતરી ખાવું	टूंगना	to gnaw
કરગરવુ	करगरवु	अ क्रि	જુઓ 'કગરવુ'	देखिए 'कगरवु'	see 'कगरवु'
કરચ	करच	स्त्री	છેક નાની પાતળી કકડી	किरच, कनी	small bit

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
करचली	करचली	स्त्री	1 ओंठ सुवाणी साक्ष पस्तु सओचावाथी अेमा पस्ती रेणा, उरथोली 2 उरथलीनी माध	झुरी (देह पर), चुनट (कागज आदि पर)	wrinkle
करचलु	करचलु	न	अेक ञणचर प्राण	केकडे की मादा	female crab
करचलो	करचलो	पु	जुओ 'उरथलु'	केकडा	crab
करचणियाणु	करचळियाळु	वि	उरथलीवाणु	देखिए 'उरथलु'	see 'उरथलु'
करचणी	करचळी	स्त्री	उरथली, उरथोली	झुरीवाला	wrinkled
करज	करज	न	हेपु, ऋण	झुरी (देह पर)	wrinkle
करजदार	करजदार	वि	हेवादार	कर्ज, ऋण	debt
करजाउ	करजाउ	वि	उरजे लीधेलु, व्याणुकु	कर्जदार	debtor
करजी	करजी	वि	हेवादार	सूद पर लिया हुआ, सूदी, कर्ज लिया हुआ	taken on loan, loan on which interest is charged
करड	करड	स्त्री	1 डभ, उरडेलु ते 2 उरडपु ते, चूट, भूणली 3 डगरनु अेकवारियु- भरडीने अडेलो दाणो	कर्जदार	debtor
करडकणु	करडकणु	वि	उरडवानी टेववाणु	काट, डक खुजली, कोई काटता हो वैसे दर्द होना एक बार कूटकर निकाला हुआ दाना	bite, sting biting, pinching, itch coarse, unpolished rice
करडवु	करडवु	स क्रि	1 डभपु, अथकु भरपु, दातथी डापपु 2 जापु (तुच्छअरमा)	कटहा, काटनेवाला काटना, डसना, दात से काटना खाना (तिरस्कार में)	having the tendency to bite to sting, to bite, to gnaw to bite (pejorative, in the sense of eating)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 (લા ત્રીવ્રમણે ખૂચવું	तेजी से चुभना	to hurt sharply (special meaning)
કરડવો	करडवो	पु	જુઓ 'કરવડો'	देखिए 'करवडो'	see 'करवडो'
કરડાકી	करडाकी	સ્ત્રી	1 (વાણીની)વકતા, કટાક્ષ, માર્મિકતા 2 છેલાઈ, અકડાઈ 3 કડકાઈ, સખ્તાઈ	(वाणी की) वक्रता, कटाक्ष बॉकपन, अकड कडाई, सख्ती	irony or subtlety (in speech) vanity, pompousness strictness, stiffness
કરડાગી	करडागी	સ્ત્રી	જુઓ 'કરડાકી'	देखिए 'करडाकी'	see 'करडाकी'
કરડુ	करडु	વિ	1 આકરુ, સખત 2 કઠોર, નિર્દય 3 સહેજ કડવુ, બેસ્વાદ	कठिन, सख्त कठोर, निर्दय कडवा	stiff, strict severe, heartless bitter, insipid
કરણ	करण	ન	1 કારણ, હેતુ 2 ઓષધી ક્રિયાનુ સાધન 3 ઇન્દ્રિય 4 ત્રીજી વિભક્તિથી સૂચવાતો અર્થ (વ્યા.) 5 (જ્યોતિષ) ત્રીસ ઘડીનો ગ્રહ 6 કરવુ તે, કર્મ	कारण, हेतु क्रियाविशेष का साधन, करण इन्द्रिय, करण तीसरा कारक (व्या.) तीस घडी का काल (ज्योतिष) करना, कर्म, करण	cause, motive instrument of an action any one of the senses instrumental case time-span of thirty units (in astrology) to act, action
કરણી	करणी	સ્ત્રી	1 ક્રિયામાણ, કરતૂક 2 આચરણ 3 ક્રિયાનુ એક ઓગર	करनी, करतूत आचरण, कर्म राज का एक औजार, कन्नी, करनी	action, act conduct tool of a mason
કર્તવ્ય	करतव	ન	1 કાર્ય, કર્તવ્ય 2 જાદુ	करतव, काम, कर्तव्य जादू, बाजीगरी	work, duty magic

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
करतार	करतार	पु	कर्ता	करतार	the creator (in the sense of doer of things)
करताल	करताल	स्त्री	1 हाथपडे ताणी आपणी ते 2 असीजोडा, आळ	हाथ से ताली देना, करताल करताल (बाजा)	clap the palm of one's hand on that of another a pair of brass discs used as a musical instrument
करताण	करताळ	स्त्री	जुओ 'करताळ'	देखिए 'करताळ'	see 'करताळ'
करता	करता	अ	थी, थडीतुलना सूचवपाना अर्थभा)	-से,-की अपेक्षा (तुलना सूचित करने के अर्थ में)	than (indicative of comparison)
करतुकारवतु	करतुकारवतु	वि	कर्ताहर्ता, मुख्य, आगेवान, चलारावाणु, आरभारी	करता-धरता	mainly incharge, chief, leader, one having his say, secretary, one who can do and undo
करतूक	करतूक	न	1 कृत्य, करणी 2 वर्तगूक, आचरण (भराण)	करतूत आचरण, व्यवहार (खराब)	action behaviour, conduct (in the pejorative sense)
करतूत	करतूत	न	जुओ 'करतूक'	देखिए 'करतूक'	see 'करतूक'
करप	करप	पु	कडप, धाण, धाक, अकुश, पणन	आतक, दाब, धाक, अकुश	control, awe, dread, (fig) weight
करपवु	करपवु	स क्रि	थोडु थोडु करपवु, आपवु के ओरवु	टूंगना, कुतरना	to eat into, to gnaw

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કરપી	करपी	स्त्री वि	शपडी કૃપણ, કજૂસ	खुरपी कृपण, कजूस	tool for weeding miser
કરપીણ	करपीण	वि	કમકમાટીભર્યું, નિર્દય	रोयें खडे करनेवाला, निर्दय	horrible, cruel
કરબ	करब	पु	જુઓ 'કરપ'	देखिए 'કરપ'	see 'કરપ'
કરબડી	करबडी	સ્ત્રી	શપડી	गहनी (घास के लिए)	farmer's weeding tool, small hoe
કરબવુ	करबवु	સક્રિ	કરબડી-શપડી દેવી	खेत में गहनी देना	to weed a field with a hoe
કરમ	करम	पु	1 હાથીનું બચ્ચું, નાનો-જવાન હાથી, મદનિયુ 2 કોહનીથી કાડા સુધીનો હાથનો ભાગ 3 હથેળીનો પાછલો ભાગ 4 ઊંટ, ઊંટનું બચ્ચું 5 હાથીની સૂંઢ	करम, हाथी का बच्चा कोहनी से कलाई तक का हाथ करतल पृष्ठ ऊँट, ऊँट का बच्चा, करम हाथी की सूँड	young one of an elephant, young elephant part of the hand from elbow to the wrist back of the palm camel, young one of a camel trunk of an elephant
કરભાર	करभार	पु	કરવેરાનો ભાર-બોજો	कर का बोझ, करभार	burden of tax
કરમ	करम	न स्त्री	1 કર્મ, કૃત્ય 2 કુકર્મ, કૂર કર્મ 3 નસીબ, વિધાતા 1 ઉદારતા 2 મહેરબાની	करम, कर्म, काम कुकर्म, क्रूरकर्म भाग्य, करम उदारता कृपा, मेहरबानी	action, deed wicked deed fate, destiny generosity, large-heartedness grace, favour

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
करशणी	करशणी	पु	2 वावेतर, भोल 3 ખેતી	फसल, कर्षण	crop
करसाठी	करसाठी	स्त्री	ખેડૂત	खेती, कृषि	agriculture
करजो	करजो	पु	કરઠી (સુ)	किसान, कृषिकार	farmer
करदु	करदु	वि	કૂવારો	सूखा डठल, रहठा	dry stalk
			કરે એવુ, ઉદ્યોગી	फव्वारा	fountain
करा	करा	पु	આકાશમાથી પડતા કુદરતીબરફના કકડા	करे ऐसा, उद्योगी	person good at doing a thing, hard-working
कराड	कराड	स्त्री	1 ખડક 2 ઊંડા ખાડાની ઊભી કોર, ભેખડ 3 પર્વતની ખો	ओला	hail-stones
				चट्टान कगार	rock high and steep bank, ridge
कराडी	कराडी	पु	ઊંચો છોડ	पहाड की खोह, कदरा	precipice
		स्त्री	1 પર્વતની સાકડી ને ઊંચી ફાટ, ખો 2 ધરો	बडा पौधा	kind of plant reaching high
				खोह, दर्रा	narrow and deep chasm in a mountain range
				गहरा गड्ढा, दरह	deep pool of water in the bed of a river
कराबीन	कराबीन	स्त्री	3 નદીનો ભેખડવાળો કાઠો	नदी का कगार, कगार	craggy bank of a river
करामत	करामत	स्त्री	4 સોનીનુ એક ઓળાર	सुनारों का एक औजार	a tool used by gold-smiths
		स्त्री	જુઓ 'કડાબીન', બદૂક	देखिए 'कडाबीन'	see 'कडाबीन'
		સ્ત્રી	1 કારીગરી 2 કળા, કસબ	कारिगरी, कसब कला	craft skill, art, proficiency

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			3 હિકમત, યુક્તિ 4 ચાતુરી, ખૂબી	હિકમત ચાતુર્ય, खूबी	contrivance knack, speciality
			5 બનાવટ 6 ચમત્કાર, જાદુ	બનાવટ ચમત્કાર, કરામત, જાદૂ	fraud magic
કરામતી	કરામતી	વિ	કરામતવાળુ	કરામાતી	ingenious, skilful
કરાર	કરાર	પુ	1 કબૂલાત, ઠરાવ 2 દુખની શાંતિ, નિરાત, આરામ	કરાર ચૈન, કરાર	agreement relief from pain
કરારદાદ	કરારદાદ	પુ	1 કબૂલાતનો કાગળ 2 સુલેહશાંતિની અરજ	કબૂલિયત, પ્રતિજ્ઞાપત્ર સુલહનામા, સધિપત્ર	deed of agreement appeal for amity or peace
કરારનામુ	કરારનામુ	ન	1 ઠરાવપત્ર, લખત, દસ્તાવેજ 2 સધિપત્ર	કરારનામા, પ્રતિજ્ઞાપત્ર, દસ્તાવેજ સધિપત્ર	written contract, deed of agreement treaty
કરારપત્ર	કરારપત્ર	ન	જુઓ 'કરારનામુ'	દેખિયે 'કરારનામુ'	see 'કરારનામુ'
કરાલ	કરાલ	વિ	1 ભયકર, બિહામાર 2 ઉગ્ર, તીવ્ર 3 ઊંચુ	કરાલ, ભયકર ઉગ્ર, તીવ્ર ऊँचा	awesome, frightful intense, sharp high
કરાલ	કરાલ	વિ	જુઓ 'કરાલ'	દેખિયે 'કરાલ'	see 'કરાલ'
કરાજવુ	કરાજવુ	અ ક્રિ	1 ઝાડે ફરતા ગુદાને જોરે આપવુ 2 ઘણા જોરથી બોલવુ	કોંચના ચિલ્લાના, કડકના	to strain the bowels to rant, to shout in a strained voice
કરાટુ	કરાટુ	ન	જુઓ 'કરેટુ'	દેખિયે 'કરેટુ'	see 'કરેટુ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		पु	कृमि, पेटमा थतो अेक लुप	कृमि, पेट का कीडा	worm (esp intestinal)
કરમકથા	करमकथा	स्त्री	वीतक कथा	आपबीती	tale of woe
કરમકલ્લો	करमकल्लो	पु	अेक शाक, डोपी	करमकल्ला, बदगोभी	kind of vegetable
કરમકહાણી	करमकहाणी	स्त्री	जुओ 'करमकथा'	देखिए 'करमकथा'	see 'करमकथा'
કરમજ	करमज	पु	जुओ 'डिरमज '	देखिए 'डिरमज '	see 'डिरमज '
કરમજી	करमजी	वि	जुओ 'डिरमज'	देखिए 'डिरमज'	see 'डिरमज'
કરમદી	करमदी	स्त्री	अेक इणअाड	करौंदा (झाड)	kind of vegetable plant
કરમદુ	करमदु	न	करमदीनु इण	करौंदा (फल)	fruit of a kind of vegetable plant
કરમાવુ	करमावु	अ क्रि	थीभणावु, विलावु	मुरझाना, कुम्हलाना	to fade, to wither
કરમોડ	करमोड	स्त्री	1 करमोडावु ते, लथक 2 जुओ 'करमोडियो'	मोच (आना) देखिए 'करमोडियो'	sprain, wrench see 'करमोडियो'
કરમોડવુ	करमोडवु	स क्रि	1 मरडवु, लथकवु 2 करमोववु, सडेज पलाणवु	मरोडना सानना, मॉडना	to twist, dislocate to mix (flour etc) with oil or ghee
કરમોડાવુ	करमोडावु	अ क्रि	लथकवु, मरडावु	मोच आना	to be sprained or wrenched
કરમોડિયો	करमोडियो	पु	डोरनो अेक रोग	चौपार्यो का एक रोग	a cattle-disease
કરમોડી	करमोडी	स्त्री	डोरना शींगडानो रोग	चौपार्यो के सींग का रोग	cattle-disease affecting the horns
કરમોવવુ	करमोववु	स क्रि	सडेज प्रवाडी साथे भेणववु—मसणवु, करमोडवु	सानना, मॉडना	to mix with a little liquid

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કરમોવુ	करमोवु	स क्रि	જુઓ 'કરમોવવુ'	देखिए 'करमोववु'	see 'करमोववु'
કરવડી	करवडी	સ્ત્રી	નાળચાવાળી લોટી, ઝારી	छोटा करवा (लोटा)	small pot with a spout
કરવડુ	करवडु	ન	નાળચુ	कीप	spout
કરવડો	करवडो	પુ	નાળચાવાળો લોટો	करवा (लोटा)	pot with a spout
કરવત	करवत	સ્ત્રી, ન	લાકડા વહેરવાનુ એક ઓળાર	करवत, आरा	saw
કરવતિયો	करवतियो	પુ	કરવતથી કામ કરનારો, વહેરણિયો	आराकश	sawyer
કરવતી	करवती	સ્ત્રી	1 નાનુ કરવત 2 સોનીનુ એક ઓળાર 3 એક જાતની ઘોડાગાડી	छोटा करवत, आरी सुनार का एक औजार एक तरह की घोडागाडी	small saw a tool used by a goldsmith a type of horse-drawn cab
કરવરુ	करवरु	વિ ન	ઓછા પાકવાળુ (વર્ષ) ખરડિયુ, નાનો દુકાળ	कम फसलवाला (वर्ष) छोटा अकाल	lean year near-famine condition
કરવાલ	करवाल	સ્ત્રી	તલવાર, ખડ્ગ	करवाल, खड्ग	sword
કરવાલુ	करवालु	ન	જુઓ 'કરવાલ'	देखिए 'करवाल'	see 'करवाल'
કરવુ	करवु	સ ક્રિ	આચરવુ, બનાવવુ, યોજવુ, ઘડવુ, ઉપજાવવુ વગેરે	करना, बनाना, योजना तैयार करना, चिनना इत्यादि	to do, to make, to plan, to shape, to create etc
કરવૈયો	करवैयो	પુ	કરી જાણનારો, કરનારો	करवैया, करनेवाला	adept at doing things
કરવો	करवो	પુ	જુઓ 'કરવડો'	देखिए 'करवडो'	see 'करवडो'
કરશણ	करशण	ન	1 ડૂ	अनाज की बाल, बाली	ear of corn

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કરાઠી	कराठी	स्त्री.	साठी, उपासन्तुपेरनी सूत्री साठी	कपास-अच्छर का सूखा डठल, रहठा	dry stalks of cotton or <i>tuwar</i> (pulse)
કરાઠુ	कराठु	न	साठी-કરાઠીનો ભાગ, साठी	रहठा	a part of dry stalk
કરિયાણુ	करियाणु	न	1 गाधीनी दुकाने मणतु ओसड, मसालो वनेरे 2 गाधियाटु	किराना पसारी का पेना	grocery a grocer's trade
કરિયાતુ	करियातु	न	એક औषधि	विरायता	kind of medicinal plant
કરિયાવર	करियावर	पु	કરકરિયાવર, પહેરામા ઠી, रीत	दहेज	see 'કરકરિયાવર'
કરી	करी	स्त्री	1 पश्य, परहेज 2 आशुष्मो 3 એક વનસ્પતિ	परहेज, पध्य अज्ञा, छुट्टी एक वनस्पति	prescribed diet or regimen (involving restrictions) workmen's esp artisan's holiday a kind of plant or herb
		अ.	—ने लाधे, —अशे	— के कारण, — की वजह से	because of
કરીને	करिने	.अ	1 —ने लाधे, —अशे 2 नामे	— के कारण, — की नाम का	because of by the name of
કરીમ	करीम	वि	દયાળુ, ઉદાર	करीम, उदार, दयालु	kind hearted, generous
કરુણ	करुण	वि	દયાળનક, શોકકારક	करुण, दयनीय शोककारक	piteous, sad

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		पु	अष्टरसमानो अेक (अ १॥)	एक काव्य-रस, करुण	one of the eight <i>rasas</i> (in Sanskrit aesthetics) that of sadness
अरुणप्रशस्ति	करुणप्रशस्ति	स्त्री	अरुण रसथी भरेली प्रशस्ति, काव्यनो अेक प्रकार, 'अेलीण'	शोकगीत, 'एलीजी'	elegy
अरुणालु	करुणालु	वि	ध्याणु	करुणालु, दयालु, करुणामय	kind, compassionate
अरुणावत	करुणावत	वि	जुओ 'अरुणालु'	देखिए 'अरुणालु'	see 'अरुणालु'
अरुणाळ	करुणाळ	वि	जुओ 'अरुणालु'	देखिए 'अरुणालु'	see 'अरुणालु'
अरुणाणु	करुणालु	वि	जुओ 'अरुणालु'	देखिए 'अरुणालु'	see 'अरुणालु'
अरुणात	करुणात	वि	अरुण अतवाणु	करुण अतवाला	having a sad end
		न	ट्रेजेडी	दु खान्त (नाटक), 'ट्रेजेडी'	(a play) with a sad end, tragedy
अरुप	करुप	वि	अरुपु	करुप	deformed, ugly
अरुपु	करुपु	वि	जुओ 'अरुप'	देखिए 'अरुप'	see 'अरुप'
अरेटु	करेटु	न	1 तस्त वियायेली गाय-भेसनु दूध	पेडस, खीस	milk of cow or buffalow who has freshly delivered a calf
			2 धीभानी एस	घी में रही हुई छाछ	portion of butter milk remaining in ghee
			3 देवीने अपाती वार्षिक भेट	देवी को दी जाने वाली वार्षिक भेट	yearly offering to a goddess
अरेठु	करेठु	न	जुओ 'अरेटु'	देखिए 'अरेटु'	see 'अरेटु'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કરેણ	करेण	स्त्री	એક ફૂલગ્રાહ	कनेर	kind of flowering plant
કરેળી	करेळी	स्त्री	1 મોટી બૂમ, ચીસ 2 ક્રોધ, ક્રોધની આળ	कुहराम, शोर, चीख क्रोध, क्रोध की ज्वाला	loud scream or cry of pain anger, burst of anger
કરો	करो	पु	ઘરની બાજુની દીવાલ	घर के बगल की दीवार	side-wall of a house
કરોચળી	करोचळी	स्त्री	જુઓ 'કરચલી'	देखिए 'करचली'	see 'करचली'
કરોટુ	करोटु	न	1 પરમ્પરા, ચાલ, રિવાજ 2 રાટુ, આડુ	परपरा, चाल, रिवाज आडा, तिरछा	tradition, custom, convention aslant, sideways
કરોડ	करोड	पु	કોટિ, સો લાખ	करोड	crore, ten millions
		स्त्री	1 બરડાની ઊભી હાડમાળા, પૃષ્ઠવણ 2 બરડો	मेरुदड, रीढ पीठ	spine, back-bone back
કરોળિયો	करोळियो	पु	1 એક જીવડુ 2 ચામડીનો એક રોગ 3 એક વનસ્પતિ 4 માટીના વાસણ વેચનારો	मकडी सेहुआ, चमडी पर सफेद दाग एक वनस्पति मिट्टी के बरतन बेचनेवाला	spider a skin-disease kind of herb dealer in earthen-ware
કરકેખા	कर्करेखा	स्त्री	વિષવૃત્તની ઉત્તરે 33° 27' અક્ષાંશની ગોળ રેખા	कर्क रेखा	tropic of Cancer
કરકવૃત્ત	कर्कवृत्त	न	કરકેખાનું વર્તુળ	कर्क वृत्त	tropic of Cancer
કરકશ	कर्कश	वि	1 કઠોર, આકરુ 2 કડવાબોલુ 3 ઘાતકી, નિર્દય	कर्कश, कठोर कटुभाषी निर्दय, कर्कश	harsh, rough sharp-tongued cruel, merciless

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अर्श	कर्ण	पु	1 अंन 2 (ग) अटभूण त्रिओणमा अटभूणानी सामेनी बाणु 3 सुअंन 4 कुतीनो सूर्यशी शथेलो पुत्र	कर्ण, कान (ग) त्रिभुज के समकोण के सामने की भुजा नाव की पतवार कुतीपुत्र, कर्ण	ear hypotenuse helm of a ship Karna
अर्शोअर्श	कर्णाकर्णि	अ	णुओ 'अर्शोपअर्श'	देखिए 'अर्शोपअर्श'	see 'अर्शोपअर्श'
अर्शोपअर्श	कर्णोपकर्ण	अ	ओअ अनेशी बाण अने अेम इरतु	कानोंकान	passing from one ear (that is, person) to another, i e spreading
अर्शोपअर्श	कर्णोपकर्णि	अ	णुओ 'अर्शोपअर्श'	देखिए 'अर्शोपअर्श'	see 'अर्शोपअर्श'
अर्तन	कर्तन	न	1 अापु के अतरपु ते 2 अतरपु ते	कर्तन, काटना, कतरना कातना	cutting spinning
अर्तव्य	कर्तव्य	वि	अरवा योग्य, अरवानु	कर्तव्य, करणीय, करने योग्य	worth doing
		न	1 अम, अर्भ 2 इरुण 3 वर्तन	काम, कार्य फर्ज, कर्तव्य आचरण, व्यवहार	work, deed, action duty, obligation behaviour
अर्तव्यपरायण	कर्तव्यपरायण	वि	पोताना अर्तव्यमा परायण-मऽथु रुडेनार	कर्तव्यपरायण	devoted to duty
अर्तव्यपालन	कर्तव्यपालन	न	अर्तव्यनु पालन	कर्तव्य का पालन	doing one's duty
अर्तव्यभान	कर्तव्यभान	न	अर्तव्यनु भान	कर्तव्य की समझदारी	sense of duty

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઋત્વભૂમિતિ	કર્તવ્યભૂમિતિ	સ્ત્રી	'પ્રેક્ટિકલ જ્યોમેટ્રી'		
ઋત્વ	કર્તા	વિ	કરનારુ, બનાવનારુ	'પ્રેક્ટિકલ જ્યામેટ્રી'	practical geometry
ઋત્વ્ય	કર્તૃત્વ	પુ	કરનાર-બનાવનાર માણસ, રચયિતા	કર્તા, કરને વાલા, બનાને વાલા	doer, maker
ઋત્વ્ય	કર્તવ્ય	ન	1 કરવાની-રચવાની શક્તિ	કર્તા, રચયિતા	author, creator
ઋત્વ	કર્તા	ન	2 ઋત્વપણુ	કરને-બનાને કી શક્તિ	power of doing, capacity
ઋત્વ	કર્તા	વિ, પુ	જુઓ 'ઋત્વ્ય'	કર્તૃત્વ	authorship
ઋત્વ	કર્દમ	પુ	જુઓ 'ઋત્વ'	દેખિણ 'ઋત્વ્ય'	see 'ઋત્વ્ય'
ઋત્વભૂમિ	કર્દમભૂમિ	સ્ત્રી	કાદવ, કીચડ	દેખિણ 'ઋત્વ'	see 'ઋત્વ'
ઋત્વ	કર્મ	સ્ત્રી	કાદવવાળી જમીન	કર્દમ, કીચડ	mud
ઋત્વ	કર્મ	ન	1 ક્રિયા, કાર્ય, કામ	કીચડવાલી જમીન	muddy place or area
ઋત્વ	કર્મકથા	સ્ત્રી	2 પ્રવૃત્તિ, ધંધો	કાર્ય, કર્મ, કામ	action
ઋત્વ	કર્મકાડી	વિ	૩ આચરણ, ધર્મકર્મ	ધંધા	business or occupation
ઋત્વ	કર્મકાડી	વિ	4 (લા) કર્મ, નસીબ	આચરણ	conduct, religious practices
ઋત્વ	કર્મકાડી	વિ	5 ઋત્વ્ય	(લા) ભાગ્ય, કર્મ	(special meaning) fate, destiny
ઋત્વ	કર્મકાડી	વિ	6 કુકર્મ, પાપ	કર્તવ્ય	duty
ઋત્વ	કર્મકાડી	વિ	૭ વીતક કથા	કુકર્મ, પાપ	bad deed, sin
ઋત્વ	કર્મકાડી	વિ	ઋત્વકાડીને અનુસરનારુ	આપબીતી	tale of one's woe
ઋત્વ	કર્મકાડી	વિ	કર્મકાડી, કર્મકાડ કા અનુસરણ કરને વાલા	કર્મકાડી, કર્મકાડ કા અનુસરણ કરને વાલા	one who practises rituals (as laid down in the Vedas)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કર્મગતિ	कर्मगति	स्त्री	કર્મની ગતિ	कर्म की गति	consequences of karma
કર્મચોર	कर्मचोर	वि	કામમા ચોરદાનતનુ	कामचोर	one of a shirking nature
કર્મઠ	कर्मठ	वि	1 આહિનિક કર્મમા ચુસ્ત કર્મનિષ્ઠ 2 કર્મકુશળ 3 બાહ્યાચારમા આગ્રહી	कर्मनिष्ठ, कर्मठ काम में कुशल, कर्मठ बाह्याचार का आग्रही	strict in adherence to duty or religious observances proficient one who is keen on propriety in behaviour
કર્મણિ	कर्मणि	वि.	(વ્યા) કર્મ પ્રમાણે જાતિવચન લેનારુ	कर्मणि, कर्मनुसार जिसका जाति, वचन इ हो	in agreement with the object (Grammar)
કર્મણિ પ્રયોગ	कर्मणि प्रयोग	पु	જેમા કર્મ પ્રમાણે ક્રિયાપદ જાતિ અને વચન લેતુ હોય એવો પ્રયોગ	वह 'प्रयोग' जिसमें क्रिया का लिंग, वचन आदि 'कर्म' के अनुसार हो, (व्या) कर्मणि प्रयोग	passive voice (Grammar)
કર્મવાચ્ય	कर्मवाच्य	वि	કર્મ પ્રમાણે જાતિ અને વચન લેનારુ	कर्म के अनुसार लिंग और वचन लेने वाला, कर्मवाच्य	taking gender and number in agreement with the object
કર્મશીલ	कर्मशील	वि	પ્રવૃત્તિશીલ, ઉદ્યમી	उद्योगी, कर्मशील	industrious , active
કર્મસન્નૃગ	कर्मसन्नो	पु	ભાવિનો યોગ, નસીબનો તાકડો	भावी का योग, भाग्य का सयोग	fortuitous happening, piece of luck

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કર્ષણ	कर्षण	न	1 ખેડ, ખેતી 2 ખેતવાણ 3 આકર્ષણ	खेती खीचातानी आकर्षण	tilling, farming wrangling attraction
કલ	कल	पु	1 એક અવાજ, ગુજન 2 કળા, માત્રા(પિગળ)	कल	a kind of sound, voice of a bird
કલકલાટ	कलकलाट	पु	ધોધાટ	कला, मात्रा (पिगल)	unit in metres
કલકલાણ	कलकलाण	न	1 કળકળવુ તે કલમાત 2 બૂમરાણ	शोरगुल कल्पना, कुटना	noise moaning, cry of anguish
કલખખણ	कलखखण	न	1 અપલક્ષણ, ખોડ 2 કુટેવ	शोरगुल	wild uproar
કલગી	कलगी	स्त्री	1 મુગટ અથવા મસ્તક પર મૂકવાનો એક શાણગાર, મજરી 2 ફૂલોનો ગોટો 3 એક શાક્ત લાવણી	ऐब, कुलक्षण, लाछन कुटेव कलगी	bad trait, defect bad habit crest
કલગીદાર	कलगीदार	वि.	કલગીવાળુ	फूलों की कलगी, गुच्छा	bouquet
કલજુગ	कलजुग	पु.	કલિયુગ, ચાર યુગમાનો છેલ્લો યુગ, અધર્મનો સમય	लावनी की एक तर्ज कलगीयुक्त कलियुग	a verse-form having a crest Kali-yuga, that phase of the cycle of time during which evil flourishes
કલણ	कलण	न	કળી-ઉતરી જવાય એવી પાણીપોચી કાંધવની જગા	दलदल	quicksands, swamp
કલદાર	कलदार	वि	1 હુનર-કળાવાળુ	हुनर से भरा, कलायुक्त	knowing art or craft

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			2 અગ્રેણ ચલણનું (નાણું)	कलदार (सिक्का)	of the British Indian currency
કલન	कलन	न	1 કળી જવું-સમજવું તે 2 પકડવું-ઝાલવું તે 3 ગર્ભાધાન થયા પછીની ગર્ભની શરૂઆતની સ્થિતિ	समझ जाना पकड़ पाना (भावार्थ आदि) गर्भ की प्रारम्भिक अवस्था	understanding, following holding, grasping embryo in the first stage after conception
કલપ	कलप	पु	વાળ રંગવાની એક બનાવટ	कलप	hair-dye
કલપવું	कलपवु	अ क्रि	1 ઝૂરવું 2 રડવું, કલ્પાત કરવું	कल्पना, -के लिए तरसना बिलखना, कल्पना, रोना	to pine to weep, to wail
		स क्रि	[શ્રાદ્ધ] સારવું, મરનાર પાછળ પુણ્ય કરવું	श्राद्धकर्म करना, पिंड देना	to perform a ceremony in memory of the dead
કલપાત	कलपात	पु,न	જુઓ 'કલ્પાત'	देखिए 'कल्पात'	see 'कल्पात'
કલફ	कलफ	पु	વાળ રંગવાની એક બનાવટ	कलप, खिजाब	hair-dye
કલબલ	कलबल	स्त्री	1 વાતચીતથી થતો આછો ઘોંઘાટ, શોરબકોર 2 ન સમજાય તેવું બોલવું તે	कलकल अस्पष्ट आवाज	chattering sound, cackle mumbling
કલબલાટ	कलबलाट	पु	ઘોંઘાટ, શોરબકોર	कलकल, शोरगुल	din
કલમ	कलम	स्त्री	1 લેખણ 2 દસ્કત	कलम, लेखनी लिखावट, दस्तखत, अक्षर	pen hand-writing

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 चित्रकारनी पीट्टी	तूलिका	painter's brush
			4 (ला) लेखनशक्ति, चित्ररवानी छटा	लिखावट या चित्र-कौशल	(special meaning) flair for writing or painting
			5 उलमनी पेठे त्रासी आपीने रोपवाने करती आडनी डाणी	कलम (पेड-पौधे की)	graft on a tree or plant
			6 अडिअ, लभाणमा पडेलो अमिअ भाग जेमडे, आयधानी उलम	दफा, धारा (कानून की)	section
			7 करारनी शरत	करार की शर्त	clause in an agreement
			8 (ला) भाषा डे लिपि	भाषा अथवा लिपि	(special meaning) language or script
उलमअश	कलमकश	वि	लेभाण वापरी जाणनारु	लिखने का पेशा करने वाला	one who knows how to wield the pen
		पु	1 लिखियो 2 लेखक, मुसद्दी	लिपिक लेखक, राजनीतिज्ञ	scribe writer, astute man, politician
उलमदान	कलमदान	न.	उलम राखवानी (भूगणी-पेटी)	कलमदान	ink-and-pen stand
उलमदानियु	कलमदानियु	न.	जुओ 'उलमदान'	देखिए 'उलमदान'	see 'उलमदान'
उलमअदी	कलमबदी	स्त्री	1 उलमवार-पेश पाडीने अरेलु थोक्कस लभाण	दफावार या पैरे बाँधकर की हुई चौकस लिखाई	clear piece of writing with section-wise paragraphs
			2 टाय, जप्ती	कुर्कनामा	sequestration
			3 जप्त अरेली	जब्त की हुई चीजों की तफसील	inventory of things attached
			पस्तुओनी यादी		

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કલમબાજ	कलमबाज	वि	કલમ વાપરવામા કુશળ	कलम चलाने में कुशल	one who excels in penmanship
કલમી	कलमी	पु वि	એક જાતના ચોખા કલમ કરી ઉગાડેલુ (ઝાડ)	एक तरह के चावल कलम काटकर लगाया हुआ (पेड़)	kind of rice grafted (tree)
કલમો	कलमो	पु	કુરાનનુ મૂળ સૂત્ર-ફરમાન, ઇસ્લામનુ દીક્ષાવાક્ય	कलमा	precept of a chapter of the Koran Mahomedan confession of faith
કલરવ	कलरव	पु	મધુર ધ્વનિ	कलरव	sweet sound, warbling
કલવો	कलवो	पु	1 કવલ, ડ્રોળિયો 2 પરણવા આવેલા વરને ઊઘલતા પહેલા કન્યાપક્ષ તરફથી મોકલાતો ક્રયો કસાર-ખાવાનુ	ग्रास, कौर, निवाला कलेवा, दूल्हे को कन्या पक्ष की ओर से भेजा जाने वाला कलेवा	mouthful sweet dish sent by the bride's party to bridegroom before the marriage-procession starts
કલશ	कलश	वि	1 એક વાસણ, લોટો 2 દહેશે ઉપર મુકાતુ ઘડાના આકારનુ ધાતુ કે છોનુ શિખર-ટોચ	कलश, लोटा मंदिर का शिखर, कलश	water-pot, jar temple-pinnacle of this shape (see 1) made of metal or stone
કલશોર	कलशोर	पु	કલરવ, મધુર શોર	कल-शोर, कलरव	sweet sound, warbling
કલહ	कलह	पु	કળિયો, કડાસ, લડાઈ	कलह, झगडा, लडाई	quarrel, bitter wrangling, brawl

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કલહપ્રિય	કલહપ્રિય	વિ	કલહ જેને વહાલો છે એવું, કળિયાખોર	કલહપ્રિય, झगडालू	quarrelsome
કલહસ	કલહસ	પુ	1 હસ 2 એક છદ	કલહસ, હસ एक छद	swan a verse-form (prosody)
કલહાતરિતા	કલહાતરિતા	સ્ત્રી	1 ધણી સાથે કલહ કરી રુસાણ લઈ બેઠેલી(સ્ત્રી) 2 પતિનો અનાદર કરી રિસાયા પછી શોક કરતી (નાયિકા) (કાવ્યશાસ્ત્ર)	કલહાતરિતા (रूठनेवाली नायिका) કલહાતરિતા (रूठकर पछताने वाली नायिका)	woman who on account of a tiff with her husband has fallen out with him type of heroine who is filled with regrets after she has picked up a quarrel with her husband (poetics)
કલક	કલક	ન	1 ડાઘ, લાછન, બટ્ટો 2 આળ	કલક, ડાઘ, लाछन, बट्टा तोहमत, लाछन	blot, spot
કલકી	કલકી	પુ	વિષ્ણુનો દશમો અને છેલ્લો અવતાર	કલ્ક	stigma, accusation
કલગી	કલગી	પુ	જુઓ 'કલકી'	देखिए 'कलकी'	the tenth and last incarnation of Vishnu
કલદર	કલદર	પુ	1 એક જાતનો ફકીર 2 નિસ્પૃહ મારાસ	कलदर	see 'कलकी' a type of <i>fakir</i> (muslim mendicant)
				निस्पृह व्यक्ति, फक्कड, कलदर	man who is free from attachments

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 मधारी	बदर-भालू नचानेवाला, कलदर	juggler
			4 વર્ણસકર આદમી	दोगला आदमी	man of mixed origin
કલા	कला	स्त्री	1 કોઈપણ વસ્તુનો એક ભાગ 2 ચંદ્રનો સોળમો ભાગ 3 ડિગ્રીનો સાઠમો ભાગ (ગણિત) 4 કાલમાન 5 યુક્તિ, હિકમત 6 હુનર, કસબ 7 સૌંદર્યયુક્ત રચના કે તેવી હિકમત	कला, अश, भाग चंद्रमा का सोलहवाँ भाग डिग्री का साठवाँ भाग, कला कालमान हिकमत, युक्ति हुनर, कला सुंदर रचना या उसकी रीति, कला	part or portion of a thing sixteenth phase of the moon sixtieth part of a circle division of time trick, ingenuity craft, proficiency artifact
કલાઈ	कलाइ	स्त्री	મગદળ-જોડાની એક કસરત	कसाई	an exercise with a type of club
કલાઈ	कलाई	स्त्री	1 એક ધાતુ 2 વાસણ પર ચડાવાતું કલાઈનું પાતળું પડ	कलाई, रॉंग रॉंगे का मुलम्मा, कलाई	a type of metal coating or lining with tin
કલાઈવાળો	कलाईवाळो	पु	વાસણની કલાઈ કરનારો	कलाईगर	a tinner
કલાક	कलाक	पु	૬૦ મિનિટ જેટલો સમય	घटा, एक घटे का समय	an hour
કલાકાર	कलाकार	पु	કલાયુક્ત રચના કરનારો પુરુષ (કવિ, ચિત્રકાર, શિલ્પી ઇ)	कलाकार	artist (poet, painter, sculptor)
કલાડું	कलाडु	न	રોટલા શેકવાનું શાણકું-ઠીકરું	रोटी सेकने का मिट्टी का तवा	earthen pan

ગુજરાતી સ્વદ્	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
૩૮૫૫	કલાપ	પુ	1 સમૂહ 2 મોરના પીંછાનો સમૂહ 3 ભાથો (તીરનો) 4 ઘરેણુ 5 મ્યાન 6 ચદ્ર	કલાપ, સમૂહ મોર કે પખ કા સમૂહ તરકશ (તીર કા) એક ગહના, કલાપ મ્યાન ચદ્ર	bundle feathers of a peacock quiver ornament sheath the moon
૩૮૫૫૦	કલાપી	પુ	એક પક્ષી-મોર	કલાપી, મોર	peacock
૩૮૫૫૦૮	કલાપીટ	સ્ત્રી	1 શોરબજોર 2 રડારોળ	શોર-શરાબા આક્રદ, રોના-ધોના	loud noise, din wailing sounds
૩૮૫૫૦૯	કલાભવન	ન	હુનર-કળાની શાળા	કલાશાલા, કલાભવન	technical school or college
૩૮૫૫૧	કલાલ	પુ	દારૂનો દુકાનદાર	કલાર, કલાલ	wine-dealer, distiller
૩૮૫૫૧૫	કલાવવુ	સક્રિ	પટાવવુ, કળશી સમજાવવુ	પટાના, યુક્તિ સે સમજાના	to coax, to persuade
૩૮૫૫૧૮	કલાવત	વિ	કલા જાણનારુ	કલાવત, કલાવિદ	one proficient in art
૩૮૫૫૧૯	કલાવાન	વિ.	કળા જાણનારુ- કળાવાળુ	કલાકાર, કલાવિદ્	one proficient in art
૩૮૫૫૨૦	કલાઠ	વિ.	લાઠ તોફાની અને લુચ્ચુ	કલ્લાચ, લઠ, શરારતી, બદમાશ	mischievous, roguish
૩૮૫૫૨૧	કલાઠી	સ્ત્રી	1 પાસળી 2 પાસુ, કસોડ	પસલી કરવટ, બાજૂ, પીઠ	rib flank
૩૮૫૫૨૨	કલિકા	સ્ત્રી	આણખીલેલુ ફૂલ, કળી	કલિકા	bud or an unblown flower
૩૮૫૫૨૩	કલિયુગ	પુ	ચાર યુગોમાનો છેલ્લો યુગ, અધર્મનો સમય	કલિયુગ, કલિકાલ	age of vice and irreligion, iron age

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કલિ	કલિ	પુ	1 ટટો, કલ્પિયો 2 લડાઈ, યુદ્ધ 3 કલ્પિયુગ 4 કલ્પિયુગનો, અધિષ્ઠાતા પુરુષ —અસુર 5 (લા) પાપની બુદ્ધિ	કલહ, કલિ, જગડા લડાઈ, યુદ્ધ, કલિ કલ્પિયુગ, કલિ કલ્પિયુગ કા અધિષ્ઠાતા અસુર, કલિ પાપ-બુદ્ધિ, કલિ	quarrel, dissension war <i>Kali-yuga</i> Demon presiding over <i>Kaliyuga</i> (special meaning) accumulation of sins
કલિગડ	કલિગડ	ન	તડબૂથ, કલિગડુ	કલિગ, તરબૂજ	watermelon
કલિગડુ	કલિગડુ	ન	જુઓ 'કલિગડ'	દેખિયે 'કલિગડ'	see 'કલિગડ'
કલુષ	કલુષ	વિ	1 કલેવવાળુ, મેલુ, ગદુ 2 દુષ્ટ, ઘાતકી 3 પાપી	કલુષ, મૈલો, ગદા દુષ્ટ, ઘાતકી પાપી, કલુષ	muddy, soiled, dirty wicked, merciless sinful
કલેકટર	કલેકટર	પુ	જિલ્લાનો વડો મહેસૂલી અમલદાર	કલેકટર	collector
કલેજુ	કલેજુ	ન	1 પિત્ત ઉત્પન્ન કરનારો અને શિરાઓમાનુ લોહી સાફ કરનારો એક મોટો માસલ અવયવ, કલ્પજુ 2 (લા) હૃદય 3 મન, અત કરણ	કલેજા હૃદય (લા) મન, અત કરણ	the liver (special meaning) heart mind, conscience
કલેડુ	કલેડુ	ન	રોટલા શેકવાનુ શાણકુ	રોટી સેકને કા મિટ્ટી કા તવા	concave earthen baking-pan
કલેવર	કલેવર	ન	શરીર, ખોળિયુ	કલેવર	body
કલેસર	કલેસર	ન	એક પક્ષી	એક પક્ષી	name of a bird

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કલોલ	કલોલ	પુ	1 મોજુ, ઘોડો 2 આનંદથી ઊભરાવુ તે	તરંગ, કલ્લોલ મૌજ, આનંદ સે વિમ્બોર હોના, કલ્લોલ	billow, surge merriment
કલિક	કલ્કિ	પુ	વિષ્ણુનો દશમો અને છેલ્લો અવતાર	કલ્કિ	the tenth and last avtar of Lord Vishnu
કલકી	કલ્કી	પુ	જુઓ 'કલિક'	દેખિય 'કલિક'	see 'કલિક'
કલ્પ	કલ્પ	પુ	1 બ્રહ્માનો એક દહાડો, અર્થાત '૪,૩૨૦,૦૦૦,૦૦૦ વર્ષોનો સમય 2 ધર્મકર્મનો વિધિ 3 આચાર 4 એક વેદાગ, જેમા ચણાકિયા વગેરેનો ઉપદેશ છે 5 સકલ્પ 6 અભિપ્રાય 7 શબ્દને અંતે 'જેવુ', 'સદૃશ' ના અર્થમા (દાત દ્વિપકલ્પ)	કલ્પ, બ્રહ્મા કા એક દિન ધર્મ કર્મ કી વિધિ આચાર એક વેદાગ, કલ્પ સકલ્પ રાય, અભિપ્રાય સમાસાત મેં લગભગ બરાબર, સદૃશ કે અર્થ મેં (ઉદા દ્વિપકલ્પ)	one day of Brahma amounting to a span of 4,320,000,000 years religious rite conduct a text on Hindu rituals resolve opinion a suffix implying 'like' 'similar to' (eg દ્વિપકલ્પ)
કલ્પન	કલ્પન	ન	1 કલ્પવુ તે 2 અંગ્રેજી 'ઇમેજ' ના અર્થમા (સાહિત્યશાસ્ત્ર)	નઈં બાત સોચને કી પ્રક્રિયા અંગ્રેજી 'ઈમેજ' (સાહિત્યશાસ્ત્ર)	imagining image (poetics)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કલ્પના	कल्पना	स्त्री	1 નવું ધિતવી કે ઉપજાવી કાઢવાની શક્તિ 2 હરેક વાતની મનમાં જે પ્રથમ રચના થાય તે 3 ધારણા, ખ્યાલ 4 તરંગ, બુદ્ધી	कल्पना रचना का विचार रूप, कल्पना दयाल मन की तरंग, कल्पना	imagination idea assumption, hypothesis whim, caprice
કલ્પનાચિત્ર	कल्पनाचित्र	न	કલ્પના વડે ખડુ કરેલુ ચિત્ર	कल्पनाचित्र	picture which is a creation of the imagination
કલ્પનાશક્તિ	कल्पनाशक्ति	સ્ત્રી	નવું ધિતવી કે ઉપજાવી કાઢવાની શક્તિ	कल्पनाशक्ति, उद्भावना शक्ति	faculty of imagination
કલ્પનાસૃષ્ટિ	कल्पनासृष्टि	સ્ત્રી	કલ્પનાની સૃષ્ટિ, મનોરાજ્ય	मनोराज्य, कल्पना-सृष्टि	world of imagination
કલ્પવુ	कल्पवु	સ ક્રિ	કલ્પના કરવી	कल्पना करना	to imagine
કલ્પાત	कल्पात	પુ	કલ્પનો અત, જગતનો પ્રલયકાળ	कल्प का अत, प्रलय	end of one age of the world, the time of the destruction of the world
		ન	રડારોળ, અતિશય રડવુ-શોક કરવો તે	कल्पना, खूब रोना, रोना-पीटना	weeping and wailing, lamentation
કલ્પિત	कल्पित	વિ	1 કલ્પેલુ 2 જોડી કાઢેલુ, ખોટુ	सोचा हुआ, कल्पित मन से गढ़ा हुआ, खोटा, कल्पित	imagined fictitious
		ન	કલ્પિત વસ્તુ, કલ્પના, યુક્તિ	कल्पित वस्तु, कल्पना, युक्ति	imaginary thing

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
३८५१	कल्याण	न	1 सुख, आनंद 2 श्रेय, दुःख	कल्याण, सुख, अभ्युदय मंगल, कल्याण	happiness, prosperity well-being, welfare
३८८१	कल्ली	पु स्त्री	अेक राग 1 नानो ३८८ो 2 छथनी आगणीओ वडे धोतिया डे साडी जेवा डपडाने पाणीने मूडवा माटे) डरती गडी 3 छथना डडानु धरेणु	कल्याण राग छोटा मुट्ठा चुनट (दुपट्टे आदि की)	a raga (Music) gold or silver armlet fold (of a sari or a dhoti) made by holding its hem between fingers armlet (an ornament)
३८मष	कल्मष	पु, न	1 मैल, डणश 2 पाप	कडुला कल्मष, मैल, कालापन	stain, dirt sin
३८८ु	कल्लु	न	स्त्रीना पगनु अेक धरेणु	पाप, कल्मष	anklet
३८८ोल	कल्लोल	पु	1 भोजु, धोडो 2 आनड, आनडशी ओभरापु ते	कडा, स्त्री के पाँव का गहना कल्लोल, लहर, तरंग	billow, wave
३८८त	कवखत	पु, स्त्री	जराब-अयोग्य- अशुभ समय	आनद, आनद - विभोर होना	jubilation
३८८थ	कवच	न	1 जभतर 2 तावीज, भूत-पिशाच डे मूठ-चोटशी शरीरनु रक्षाण डरती मनातो मत्र	असमय, कुसमय कवच, बखतर तावीज, एक रक्षा-मत्र, कवच	inopportune or inauspicious time armour talisman

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		स्त्री.	એક વનસ્પતિ, ડ્રીવચ	एक वनस्पति, केवॉच, कौच	a kind of herb.
કવચન	कवचन	न	કુવચન	कुवचन	bad word
કવચબીજ	कवचबीज	न	કૌવચનુ બીજ	केवॉच का बीज	seed of cowhage
કવચુ	कवचु	न	જુઓ 'કવચબીજ	देखिए 'કવચબીજ'	see 'કવચબીજ'
કવણ	कवण	अ	કોણ, કચુ (પ)	कौन, कौन-सा, (प)	who ? which ?
કવન	कवन	न	1 કવિતા કરવી તે 2 કવિતા	कविताई कविता	composition poetry
કવચિત્રી	कवचित्री	स्त्री	સ્ત્રી કવિ	कवचित्री	poetess
કવર	कवर	न	પરબાંકિયુ	कवर, लिफाफा	envelope
કવલ	कवल	पु	કોળિયો, ગ્રસ	कवल	morsel
કવલે	कवले	स्त्री	ખરાબ વલે-દશા	अवदशा, दुर्दशा	bad plight
કવવુ	कववु	स क्रि	1 કવિતા કરવી 2 સ્તુતિ ગાવી, વખાણવુ 3 વર્ણવવુ अ क्रि કળતર થવુ	कविता करना स्तुति करना; प्रशसा करना वर्णन करना शरीर में कष्ट होना	to compose verses to propitiate to praise describe to experience pain
કવશ	कवश	वि स्त्री	તાબેદાર, પરાધીન ઓપટી, અડચણ	पराधीन, ताबेदार औपटी, अडचन	dependent monthly course of a woman
કવળ	कवल	पु	કોળિયો, ગ્રસ, કવલ	कौर, निवाला	mouthful of food, morsel
કવા	कवा	पु	1 પ્રતિકૂળ પવન	प्रतिकूल पवन	ill wind

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
उवायत	कवायत	स्त्री	2 प्रतिकूल समय, सज्जेग डे वातावरण	प्रतिकूल समय, कुजोग	adverse circumstances
उवायती	कवायती	वि	1 ड्रिल, लश्करी तालीम, परेड 2 तरतील, तालीम	कवायद, ड्रिल तालीम	drill training
उवायु	कवायु	वि	उवायत पाभेले, तालीमवाणु	कवायद पाया हुआ, तालीमी	trained
उवार	कवार	पु	प्रतिकूल, उवावाणु	प्रतिकूल	adverse
उवारी	कवारी	स्त्री	अशुभ दिवस-समय	कुदिन, असमय	day or time of ill omen
उवारे	कवारे	अ	अपकीर्ति	अपकीर्ति	ill fame
उवाल	कवाल	पु	अशुभ दिवसे डे समये	अशुभ दिन या समय पर	at a bad time or on a bad day
उवाली	कवाली	स्त्री	1 गवैयो 2 ओड राग	कच्वाल, कौवाल, गवैया एक राग	singer a raga (Music)
उवावु	कवावु	अ क्रि	1 गञ्जल (जास करीने सूझीवाहनी) 2 ज्यालटप्यानु गारु 3 शरीरमा उवा पेसवो, शरीर बगडवु 4 उथणवु, वारसवु 5 वसूडी ञवु	कच्वाली (सूफियाना) ख्याल की गान पद्धति या गीत शरीर में विकार पैदा होना बिगडना दूध तोडना	a verse-form, namely, <i>gazel</i> (prosody) a strain of vocal music (Music) to lose health to deteriorate to stop giving milk (with reference to a cow)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			4 पगोवापु, निधपु	बदनाम होना, निन्दापात्र होना	to be criticized
કવિ	कवि	पु	1 કાવ્ય-કવિતા કરનાર 2 ભાટ	कवि भाट	poet bard
કવિજન	कविजन	पु	કવિલોક, કવિઓ	कविगण	group of poets
કવિત	कवित	न	એક જાતની કવિતા, મનહર છંદ	कवित्त, एक प्रकार की कविता, मनहर छंद	a verse-form, <i>manhar</i> (Prosody)
કવિતા	कविता	स्त्री	1 કાવ્ય 2 પદબંધ 3 કાવ્યનો ગુણ	काव्य, कविता पदों में काव्य की रचना काव्य का गुण	poem, poetry verse written in padas merit peculiar to poetry
કવિદ્યા	कविद्या	स्त्री	1 ખોટી વિદ્યા, ઠગાઈ 2 મેલની-મત્રતત્રની વિદ્યા	खोटी विद्या, ठगाई मत्र तत्र की विद्या	bad learning, roguery craft of black magic or sorcery
કવેણ	कवेण	न	ખોટું-અધટિત વેણ, અપશબ્દ	कुवचन, दुर्वचन, गाली	bad word, insulting speech
કવેળા	कवेळा	स्त्री	કવખત	कुबेला	improper time
કવ્વાલ	कव्वाल	पु	કવાલ, કવાલી ગાનારો	कव्वाल, कव्वाली गाने वाला	one who sings <i>kawalia</i> (a particular air in music)
કવ્વાલી	कव्वाली	स्त्री	1 ગઝલ (ખાસ કરીને સૂફીવાદની)	गजल (सूफियाना), कव्वाली	<i>gazel</i> (especially based on themes from sufism)

कश	कश	स्त्री	2 ખ્યાલવટખાનુ ગાણુ अगरभु, पडी वगेरे भीडवानी नानी दोरी डोय छे ते (पटनने पदले)	ख्याल की गान - पद्धति या गीत	a musical air
कशाणु	कशाणु	न	अणसलु, डूडु, अणसु	कस बद (अगरखी आदि की डोरी)	lace
कशीदो	कशीदो	पु	जरीनु भरतअम	अनाज की बाल, बाली	ear of corn
कशु	कशु	वि	डोछ, अछ (अनिश्चितार्थक)	कशीदा, जरी का काम	embroidery
कशुक	कशुक	वि	डोछक, अछक	कोई, कुछ (अनिश्चितार्थक)	someone, something (indeterminative)
कशेरु	कशेरु	पु, न	अरोड (बरडानी)	कोई भी, कुछ ही	someone, something
कषणी	कषणी	स्त्री	1 कसोटी 2 कसोटीनी वेणा, आपत्ति, दु.भ 3 वासणी, पैसा भरवानी लाणी, डेडे पधाय अेवी, डोशणी	रीढ, मेरुदड कसौटी कसौटी की पीडा, दुख कमर में कसकर बाधने की पैसे की लम्बी थैली	spine test ordeal, hour of trial a money-bag
कषाय	कषाय	वि	रगेलु, रगवाणु थयेलु	कषाय, काषाय, रगा हुआ कवाथ	coloured, stained decoction
		पु	1 अयो, उअणो 2 अटारो, अडूयो स्वाद 3 भगवो-गेरुवो रग 4 अट, मेल, अलय 5 पाप	कसैला स्वाद गैरुआ रग मोरचा, मैल, गलापन पाप	astrigent taste saffron colour rust, dirt, dross sin

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			6. (जैन) क्रोध, मान, माया अने लोभ अ चारमानु ओठ पण	क्रोध, मान, माया और लोभ में से कोई (जैन)	one of the four sins—anger, conceit, attachment, cupidity, according to Jainism
કષ્ટ	कष्ट	न.	1 મહેનત, શ્રમ 2 દુખ, સતાપ	कष्ट, श्रम पीडा, व्यथा, कष्ट	labour, effort, strain hardship
કષ્ટવું	कष्टवु	सक्रि	કષ્ટ આપવુ, પીડવુ	कष्ट देना	to cause pain, to torment
કષ્ટાવુ	कष्टावु	अक्रि	1 દુખ પામવુ, પીડાવુ 2 પ્રસવની પીડ-વેણ આવવી	पीडा होना, दुख पाना प्रसव वेदना होना	to suffer pain pains at the time of delivery
કષ્ટો	कष्टो	સ્ત્રી	લેણા પેટે આપવાનો હતો	किस्त (ऋण की)	instalment of payment of debt
કસ	कस	पु	1 કસોટી ઉપરથી નક્કી કરેલો સોનારૂપાનો ભાવનો આક 2 કસોટી 3 સાર, માત્ર, સત્વ	कसौटी पर तय किया हुआ सोना, रूपा के भाव का ऑक कसौटी, कस सार, सत्व	price of gold or silver determined after testing it on a touch-stone test pith, marrow, essence
કસડો	कसडो	સ્ત્રી	4 બળ, જોર જુઓ 'કશ'	जोर, बल, कस देखिए 'कश'	strength, power see 'कश'
કસડો	कसडो	पु	કમરબધ, કદોરો	कमरबद, कदोरा	waistband, girdle
કસણ	कसण	न સ્ત્રી	કસ જુઓ 'કષણ'	कस देखिए 'कषण'	testing see 'कषण'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કસણવુ	कसणवु	स क्रि	ચોળી મસળીને એક કરવુ, ગૂદવુ, કેળવવુ	रौंदना, गूंधना	to mix by rubbing, kneading
કસણી	कसणी	स्त्री	1 કસોટી 2 કસોટીની વેળા, આપત્તિ, દુ:ખ 3 વાસળી, પૈસા ભરવાની લાભી કેડે બધાય એવી કોથળી 4 નાના છોકરાને થતો કફ કે શ્વાસનો એક રોગ	कसौटी कसौटी का, जॉच का समय, आपत्ति, दुख रुपये रखने की लबी थेली जो कमर पर बँधी जाए, बसनी कास, खाँसी, हब्बा डब्बा (बच्चों का)	test trying time, distress money-bag disease of the lungs in children, bronchitis
કસતુ	कसतु	वि	1 પરાણે બેસતુ થતુ, તણાતુ 2 ઓછુ રહેતુ	चुस्त, तग, कसा हुआ तौल में कम	tight-fitting less
કસદાર	कसदार	वि	1 કસ-સત્વવાળુ 2 રસાળ 3 ધનવાન 4 કસોટીમાથી પાર ઊતરે એવુ, ઓજસ્વી	कस-सत्त्ववाला रसीला, उपजाऊ धनिक कसौटी पर खरा उतरने वाला	sappy, nutritive juicy wealthy that which can withstand the test
કસબ	कसब	पु	1 ધધો, રોજગાર, કામ 2 હુનર, કળા, કારીગરી 3 કળા, કુશળતા, નિપુણતા 4 અનીતિનુ કામ 5 ભસ્તકામ, વણાટમા વપરાતો સોનારૂપાનો બારીક તાર	कसब, धधा हुनर, कारीगरी कलाकौशल, निपुणता अनीतिपूर्ण काम कलाबत्तू	profession, business, trade craft, skill expertness, proficiency act of immorality gold or silver thread used in embroidery

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કસબી	कसबी	वि पु	કસબવાળુ, નિપુણ, કળાકુશળ હુ-નરકળા જાણનાર, કારીગર	कलाकुशल, निपुण कारीगर	skilful, 'expert artist, artisan
કસબો	कसबो	पु	1 મુસલમાનોની વિશેષ વસ્તીવાળુ ગામ 2 મોટુ ગામ	मुसलमानों की ज्यादा आबादी वाला गाँव बड़ा गाँव	town with a large Muslim population large town
કસમ	कसम	સ્ત્રી	સોગન	कसम, सौगंध	oath
કસમજ	कसमज	સ્ત્રી	ખોટી-અયોગ્ય સમજ	भ्रान्ति, गलतफहमी	misunderstanding, wrong understanding
કસમય	कसमय	પુ	કસમો, કવખત, કવેળા	कुसमय, कुबेला	improper time
કસમોડા	कसमोडा	પુ	1 અગ મરોડના ઉકાટા આવવા તે 2 પ્રસવ વખતનુ શરીરનુ દુખવુ ને આકડી-વેણો આવવી તે	अगड़ाई लेने की उत्कठा होना प्रसव वेदना	restive feeling with symptoms like yawning etc labour-pains
કસર	कसर	સ્ત્રી	1 ઘટ, ખોટ 2 ક્યાશ, અપૂર્ણતા 3 ખામી, કસૂર 4 કરકસર 5 નુકસાન	कसर, कमी कमी, अपूर्णता खामी, भूल, कसूर कमखर्ची नुकसान, हानि	deficit, loss deficiency, imperfection defect, mistake thrif, economy damage
કસરત	कसरत	સ્ત્રી	1 વ્યાયામ 2 અભ્યાસ, મહાવરો, તાલીમ	व्यायाम, कसरत तालीम आदि होना, अभ्यास	exercise study, practice, training
કસલુ	कसलु	ન	કસલુ, કસુ	अनाज की बाल, बाली	ear of corn

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કસવાણ	कसवाण	स्त्री	माएगी, बेथेनी	बीमारी, बेकरारी, अस्वस्थता	illness, indisposition
કસવું	कसवु	स क्रि	1 ખૂબ ખેચવું, બાધવું 2 કસોટી કરવી, અજમાવવું 3 મહેનત આપવી, રગડવું 4 પીડવું, સતાવવું 5 ઓછું આપવાનો પ્રયત્ન કરવો	સખત કસના, તનાવ કો કડા કરના, खींचकर बाँधना आजमाना, कसौटी पर कसना रगड़ना	to fasten, to tighten to test, to try out to exact work, to enforce rigorous work to torture, to harass to be stingy at the selling counter butcher
કસાઈ	कसाई	पु	1 પશુઓને મારીને તેમનું માંસ વેચવાનો ધંધો કરનાર ખાટકી 2 ગળકટ્ટો, ખૂની	કસાઈ खूनी, हत्यारा	slaughterer, murderer
કસાણ	कसाणु	वि	કાટના સ્વાદવાળું, કટાણ, બેસ્વાદ	કસૈલા	rusty, tasteless
કસાયેલું	कसायेलु	वि	પલોટાયેલું, અનુભવી	સઘા હુઆ, મઘા હુઆ, અનુભવી	trained, experienced
કસાદો	कसीदो	पु	1 જુઓ 'કશીદો' 2 કાવ્યનો એક પ્રકાર, સ્તુતિ-પ્રશંસા કરવાને માટે લખાયેલું કાવ્ય	દેખિય 'કશીદો' કાવ્ય કા એક પ્રકાર, कसीदा	see 'કશીદો' kind of poem, panegyric
કસુતર	कसुतर	वि	1 સુતર નહિ એવું, મુશ્કેલ 2 કસોજ, બગડી ગયેલું	દુષ્કર, મુશ્કિલ जो दुरुस्त न हो सके, बिगड़ा हुआ	difficult spoiled

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 आडु, वाडु	टेढा, चक्र	not straight, cross
डसुतरु	कसुतरु	वि	જુઓ 'डसुतर'	देखिए 'डसुतर'	see 'डसुतर'
डसुवाण	कसुवाण	स्त्री	જુઓ 'डसवाण'	देखिए 'डसवाण'	see 'डसवाण'
डसुवावड	कसुवावड	स्त्री	गर्भनु तेना नियत समय पळेला गणी ज्यु ते	असमय गर्भपात	miscarriage
डसुपी	कसुपी	वि	डसुपल	कुसुभी, कुसुभ के रग का	of the colour of safflower
		स्त्री	1 डसुपाना डूलनो रग	कुसुभा रग	colour of safflower
			2 डसुपानु पीज	कुसुभ का बीज	safflower seed
डसुपो	कसुपो	पु	1 अेड वनस्पति	कुसुभ	a plant
			2 अेना डूलमाशी नीडणतो रग	इसके फूलों में से प्राप्त रग	dye made of the flower of that plant
			3 अे रगनु डपडु	कुसुभी (कपडा)	cloth dyed in that colour
			4 पाणीमा धोणेनु अक्षीण डे ते भिषे शतो मेणवडो	नशीला पेय या कुसुभा पीने का जलसा	opium in a liquid form, or a session at which this is taken
डसूअ	कसूअ	स्त्री	જુઓ 'डसमण'	देखिए 'डसमण'	see 'डसमण'
डसूर	कसूर	पु	ખામી, ભૂલચૂક, વાકગુનો	कसूर, कुसूर	short-coming, mistake, error, fault or blame
डसूबल	कसूबल	वि	डसुपाना डूलना रगनु, लाल	कुसुभ के फूल के रग का, कुसुभी	of safflower colour, red
डसूबलु	कसूबलु	वि	જુઓ 'डसुबल'	देखिए 'डसुबल'	see 'डसुबल'
डसूपी	कसूपी	वि	જુઓ 'डसुपी'	देखिए 'डसुपी'	see 'डसुपी'
डसूपो	कसूपो	पु	જુઓ 'डसुपो'	देखिए 'डसुपो'	see 'डसुपो'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કસેરુ	कसेरु	पु, न	જુઓ 'કસેરુ'	देखिए 'कसेरु'	see 'कसेरु'
કસોજ	कसोज	वि	બગડી ગયેલુ, કસૂતર	बिगडा हुआ, जो दुरुस्त न हो सके	spoiled
કસોજણ	कसोजण	न	ઝટકામાણ, કચરો	कूडा-कचरा, फटकन	chaff, rubbish
કસોજુ	कसोजु	वि	જુઓ 'કસોજ'	देखिए 'कसोज'	see 'कसोज'
કસોટી	कसोटी	स्त्री	1 સોનાનો કસ જોવાની પથરી 2 કસ કાઢવાની રીત, પરખ 3 કડક તપાસ-પરીક્ષા	कसौटी कस निकालने की रीति, परख कडी जाँच, परीक्षा	touch-stone means of testing, expertness at testing severe test
કસ્તર	कस्तर	न	1 તણખલુ, રજ, કચરો 2 કસારા લોકો સાધવાના વાસણને જે લેપ કરે છે તે	तिनका, रज, कचरा वह लेप जो कसेरा रसोई के बरतनों पर करता है	mote, dust, dirt grease applied to metal vessels at the time of solding
કસ્તી	कस्ती	स्त्री	પારસીની જનોઈ કે તે દેવાનો સસ્કાર	पारसियों का जनेऊ या इस का सस्कार	sacred thread as used among Parsis or the ceremony at which this is given
કસ્તૂરિકા	कस्तुरिका	स्त्री	જુઓ 'કસ્તૂરી'	देखिए 'कस्तूरी'	see 'कस्तूरी'
કસ્તૂરિકા	कस्तूरिका	स्त्री	જુઓ 'કસ્તૂરી'	देखिए 'कस्तूरी'	see 'कस्तूरी'
કસ્તૂરિયો બાટ	कस्तूरियो बाट	पु	એક વનસ્પતિ	एक वनस्पति	kind of plant
કસ્તૂરી	कस्तूरी	स्त्री	અમુક જાતના ઉરણની કૂટીમાથી મળતો એક સુગંધી પદાર્થ, મૃગમદ	कस्तूरी	musk

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કસ્તૂરો	कस्तूरो	पु	એક પક્ષી	एक पक्षी	name of a bird
કહાણી	कहाणी	स्त्री	1 વાર્તા, દતકથા 2 કહેવત	कहानी, वार्ता कहावत	story saying, proverb
કહાન	कहान	पु	કૃષ્ણ	श्रीकृष्ण	Lord Krishna
કહાનો	कहानो	पु	કૃષ્ણ	श्रीकृष्ण	Krishna
કહાવવુ	कहाववु	स क्रि	કહેવુ નુ પ્રેરક, સંદેશો મોકલવો	कहलाना	causal of 'કહેવુ', to send a message
કહી	कही	अ	કયા, કયે ઠેકાણે (પ્રશ્નાર્થક)	कहाँ, किस जगह	where ? at which place ?
કહીકહી	.હી कही	अ	કેટલેક સ્થાને, કયાક કયાક	कही-कही	at some places, at places
કહેણ	कहेण	न	1 કહેવરાવવુ તે, સંદેશો 2 હુકમ 3 વેણ, વચન 4 તેડુ, નોતરુ	सदेशा हुकम वचन, वादा बुलावा, निमत्रण	message order word, promise invitation
કહેણી	कहेणी	स्त्री	1 કહેવત 2 કહેવુ તે, કહેવાની રીત 3 કહાણી 4 લોકોપવાદ, દોષ	कहावत कथन कहानी लोकनिदा, दोष	proverb, saying mode of telling or narrating story or narration scandal, stigma
કહેણ	कहेणु	न	જુઓ 'કહેણ'	देखिए 'कहेण'	see 'કહેણ'
કહેતી	कहेती	स्त्री	જુઓ 'કહેણી'	देखिए 'कहेणी'	see 'કહેણી'
કહેવડાવવુ	कहेवडाववु	स क्रि	1 કહાવવુ 2 'કહેવુ' નુ પ્રેરક	कहलाना 'कहेवु' का प्रेरणार्थक रूप	to send a message active form of the verb 'કહેવુ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કહેવત	कहेवत	स्त्री	1 लोकोक्ति 2 दृष्टान्त, उदाहरण 3 उभाशो 4 उखेवराभास— बदनामी	कहावत दृष्टान्त, उदाहरण पहेली लोकनिदा, बदनामी	proverb, maxim illustration, instance riddle bad name
કહેવાપણ	कहेवापण	न	उखेवु पडे अेवु छेय ते, जामी	खामी, दोष	weak point, defect
કહેવુ	कहेवु	स क्रि	1 बोलेवु, ज्ञापवु 2 समझवु 3 शिजामाण आपवी 4 आज्ञा करवी 5 ठपओ आपवो 6 नाम आपवु	कहना, जानकारी देना समझाना नसीहत देना फरमाना उत्ताहना देना नाम देना, कहना	to say, to tell to explain to advise, to urge to instruct to reprimand to name, to call
કહ્યાગરુ	कह्यागरु	वि	अधु करे अेवु, आज्ञाअित	आज्ञाकारी	obedient
કહ્યુ	कह्यु	न	उखेवु ते, वचन, शिजामाण, आज्ञा	कहा, वचन, नसीहत, आज्ञा	what is told, word, advice, instruction
કદોઈ	कदोई	पु	भीठाઈ जनावनार तथा वेचनार आधमी, सुजडियो	हलवाई	cook who specializes in sweetmeats, one who sells sweetmeats
કદોરી	कदोरी	स्त्री	नानो कदोरो	छोटा कदोरा	small girdle
કદોરો	कदोरो	पु	1 अमरे पखेरवानो कोइ पण दोरो के सेर 2 भीतमा चणोली छटनी डिनारी 3 आओ, लीटो	कदोरा, करधनी, तागडी कगनी (दीवार की) निशान की लकीर, लीक, पक्ति	girdle lining on a wall line or mark

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કધ	कध	स्त्री	1 ખભો 2 ભાર વહેનાર પશુ ઓની ખાધ-બોચી	कधा कधा (बोझ ढोने वाले पशुओं का)	shoulder neck (of a beast of burden)
કળ	कळ	स्त्री	1 પેટી વગેરેને જડેલુ યત્ર, જેમા કૂચી ફેરવવાથી તે વસાય ઉઘડાય છે 2 યત્રની ચાવી, ચાપ 3 (લા)લાગ, યુક્તિ, કરામત, કીમિયો 4 એકદમ (વાગવા વગેરેથી) થતુ તીક્ષ્ણ કે સતત દુઃખ કે તેથી આવતી મૂર્છા 5 અટકળ, સમજ કાદવા(ઝીણો ચીકણો કાપ જેવો), કળી જવાય એવી જમીન, કળણ	कल, पेच, खटका यत्र की चाभी युक्ति, कल मार से या आघात से सिर चकराना अनुमान, समझदारी कर्म, कीचड	spring switch (special use)tact, knack, trick shock guess, grasp mud
કળકળ	कळकळ	स्त्री	1 કકળાટ, કળકળાટ 2 ટિટિયારો, માથાઝીક 3 પખીનો કલરવ-કલકલ 4 તાલાવેલી	चीख-पुकार, हल्ला-गुल्ला मगजपच्ची पक्षियों की चहचहा, कलरव जल्दबाजी, भटपटी	moaning, lamentation quarrel, nagging chirrup of birds eagerness
કળકળવુ	कळकळवु	अ क्रि	જુઓ 'કકળવુ'	देखिए 'ककलवु'	see 'ककलवु'
કળકળાટ	कळकळाट	पु	જુઓ 'કકળાટ'	देखिए 'ककलाट'	see 'ककलाट'
કળકળણ	कळकळाण	न	1 કળકળવુ તે, કલ્પાત 2 બુમરાણ	कल्पना, बिलखना चीख-पुकार	moaning, weeeping and wailing uproar

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કળજગ	कळजग	पु	चार युगमानो छेछो युग, अधर्मनो समय कलियुग	कलियुग	the last age in the cycle of the four ages of the world, an age of vice and irreligion, <i>kaliyuga</i>
કળજુગ	कळजुग	पु	જુઓ 'કલિયુગ'	देखिए 'कलियुग'	see 'कलियुग'
કળાણ	कळण	न	1 જેમા પગ મૂકતા કળી જવાય એવી જમીન-જગા 2 જાણવું તે, સૂઝ, સમજ, જ્ઞાન	दलदल सूझ, ज्ञान	quick-sand knowledge, understanding, insight
કળશી	कळथी	स्त्री	1 એક વનસ્પતિ 2 એક જાતનું હલકું કઠોળ	एक वनस्पति कुलथी (हलका द्विदल)	name of a plant kind of pulse of poor quality
કળપવું	कळपवु	स क्रि	1 મૂએલાને નામે સકલ્પ કરી દાન કરવું	मृतक के नाम सकल्प करके दान करना	to perform a ceremony which involves giving alms for the benefit of the dead
		अ क्रि	2 રાપડી ફેરવવી 1 ખપવું, ઉપયોગમાં આવવું	गहनी जोतना व्यवहार में चले ऐसा होना, उपयोग में आना	to harrow a field to be useful or serviceable
			2 ઝૂરવું, રડવું	रोना, कलपना, तडपना	to weep, to yearn
કળપી	कळपी	स्त्री	કરપી, રાપડી	गहनी	farmer's weeding tool, small hoe

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કળબ	कळब	स्त्री	भोटी रापडी	बडी गहनी	harrow
કળબવુ	कळबवु	स क्रि	रापडी દેવી-કેરવવી	गहनी जोतना	to harrow a field
કળવિકળ	कळविकळ	स्त्री	1 યુક્ત, તદબીર 2 યુક્તાયુક્ત વિચાર 3 યેન, શાત 4 સૂઝ, સમજ	युक्ति युक्तायुक्त विचार चैन, कुशलक्षेम सूझ, समझ	tactics, skill discrimination ease, comfort insight, understanding
કળવુ	कळवु	स क्रि	1 સમજવુ 2 કલ્મવુ, ધારવુ, અટકળ કરવી, હિસાબ કે અદાજ ડાઢવો	समझना, ताडना कल्पना करना, अटकल या अदाजा लगाना	to understand to imagine, to guess, to assess
		अ क्रि	1 દુખવુ, કળતર થવુ 2 કાદવમા ઊતરી જવુ, ખૂતી જવુ	दुखना, पीडा होना दलदल में गडना, धँसना	(v !) to ache to sink in mud, to be bogged down
કળશ	कळश	પુ	1 એક વાસણ, લોટો 2 મદિરના શિખર તરીકે મુકાતો ઘાટ, ઘૂમટની ટોચ, કલશ	कलश, लोटा मदिर का शिखर	water-pot pinnacle of a temple
કળશિયો	कळशियो	પુ	1 લોટો 2 અડો(રોગ)	लोटा दस्त (रोग)	water-pot diarrhoea
કળશી	कळशी	સ્ત્રી	સોળા(કાચા) માણુ માપ	सोलह (कच्चे) मन् की माप	measure of 16 maunds
કળશો	कळशो	પુ	કા X-લોટો	लोटा	water-pot
કળા	कळा	સ્ત્રી	1 જુઓ 'કલા' 2 (મોરની)કલા-કલાપ ફેલાવવો તે	देखिए 'कला' (मोर का) कलाप फैलाना	see 'कला' expanded tail of a peacock
કળાઈ	कळाई	સ્ત્રી	કોણીથી કાડા સુધીનો હાથનો ભાગ	कलाई, गट्ठा	fore-arm
કળાકાર	कळाकार	પુ	જુઓ 'કલાકાર'	देखिए 'कलाकार'	see 'कलाकार'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કળાણ	कळाण	न	1 જુઓ 'કળાણ', કાદવ-ગાણવાળી જગા 2 સૂઝ, સમજણ	देखिए 'कलाण' समझ, सूझ	see 'कलाण', morass, bog insight, understanding
કળાયલ	कळायल	वि	કળા ફેલાયેલો એવો (મોર)	जिसने (पखों को फैलाने की) कला की हो (मयूर), कलापी	having the tail spread out (peacock)
કળાયુ	कळायु	अ क्रि	પ્રતીત થયું, દેખાયું	प्रतीत होना, दिखाई देना	to be realized, be seen
કળિ	कळि	पु	જુઓ 'કળિ'	देखिए 'कळि'	see 'कळि'
કળિયો	कळियो	पु	1 ઠળિયો 2 કોકો 3 દાડમનો દાણો 4 ધુળવાન પુરુષ	गुठली भुट्टा अनारदाना कुलीन व्यक्ति	stone or seed of a fruit ear of corn pomegranate- pip well-born person
કળિગડ	कळिगड	न	જુઓ 'કળિગડ'	देखिए 'कळिगड'	see 'कळिगड'
કળિગડુ	कळिगडु	न	જુઓ 'કળિગડ'	देखिए 'कळिगड'	see 'कळिगड'
કળી	कळी	स्त्री	1 અણખીલ્યુ ફૂલ 2 છૂટો મોતીચૂર	कली मोतीचूर की बुँदिया	bud, blossom a sweetmeat
કળીચૂનો	कळीचूनो	पु	વિશુદ્ધ કરેલો ચૂનો	कली-चूना	quicklime
કળેકળે	कळेकळे	अ	યુક્તિપ્રયુક્તિથી, સમજાવટથી	युक्ति-प्रयुक्ति से, समझा बुझाकर	tactfully, through persuasion
કળેળવું	कळेळवुं	अ क्रि	કળકળવું	कुहराम मचाना, हल्ला-गुल्ला करना	to moan, to grumble

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કળેળી	कळेळी	स्त्री	કળેળી, કળેળવુ તે	कुहराम, चीख-पुकार	lamentation
કળો	कळो	पु	1 કટાપો 2 આવેશ	कुदून, क्लेश आवेश	quarrel, strife passion, fury
કકર	ककर	पु	1 કકરો, નાનો પથ્થર 2 કકરી, મરડિયો	ककड, छोटा पत्थर ककडी, ककड (कच्चा चूना)	pebble gravel
કઈ	कई	अ	1 જુઓ 'કહી' 2 (ચ)કયા	देखिए 'कहाँ' क्या, कहीं (प्रश्न अथवा निषेधसूचक वाक्यों में प्रयुक्त)	see 'कहाँ' where
		वि,अ	1 (અનિશ્ચિતાર્થ, પ્રશ્નાર્થ તથા નકારાર્થમા મુખ્યત્વે વપરાય છે) કઈ, અમુક, કશુ 2 અનેક	कुछ, अमुक (अनिश्चितार्थ, निषेधार्थ, प्रश्नार्थ में प्रयुक्त)	(used mainly in the indeterminate, interrogative or negative sense) anything, certain, a little countless
કઈક	कईक	वि,अ	કેટલુક, થોડુક	कुछ, थोडा सा	a little, somewhat
કકણ	ककण	न	1 કાગરાવાળી ચૂડી-બગડી 2 કાચની કે સોનાની બગડી 3 કકણદોરો	ककण, कगन, ददानेदार चूडी काँच या सोने की चूडी कगना, मैनफल और लाल डोरा	bracelet with studs glass or gold bangle string fastened round the wrist
કકણદોરો	ककणदोरो	पु	લગ્નવિધિ શરૂ કરતા વરકન્યાને કાંડે બધાતુ મીઠળ અને લાલ દોરો, કકણદોરો	मैनफल और लाल डोरा, कगना	auspicious thread put round the wrist of the bride and bride-groom at the marriage ceremony

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કકણાકાર	ककणाकार	वि	કકણના આકારનું (ખગ્ગસ ગ્રહન માટે), 'અન્યુલર'	ककण के आकार का (खग्रास ग्रहण के लिए) 'एन्युलर'	annular (eclipse of the sun)
કકણાકૃતિ	ककणाकृति	वि	જુઓ 'કકણાકાર'	देखिए 'ककणाकार'	see 'કકણાકાર'
કકાલ	ककाल	न स्त्री	હાડપાંજર ડાટાળી એક વનસ્પતિ, કકોલ, કકાળ	ककाल एक वनस्पति, कक्कोल	skeleton name of a plant
કકાલી	ककाली	पु	1 કપાલી 2 શિવભક્ત 3 કકોલ	कपालि, शिव शिवभक्त एक वनस्पति, कक्कोली,	Shiva (God in the Hindu pantheon) devotee of Shiva name of a plant
કકાવટી	ककावटी	स्त्री	કકુ રાખવાની પ્યાલી	कुकुम-पात्र	receptacle for red turmeric powder used for a mark on the forehead
કકાસ	ककास	पु	કળ્થો, કલેશ	क्लेश, कजिया	quarrel, bitter wrangle
કકુ	ककु	न	ખાલ્લો ઇ મા વપરાતુ લાલ દ્રવ્ય, કુકુમ	कुकुम, रोली	red turmeric powder used to mark the forehead
કકોડી	ककोडी	स्त्री	કકોડાની વેલ	ककोडे की बेल, खेखसा	name of a creeper
કકોડુ	ककोडु	न	કકોડાનુ શાક-ફળ	ककोडा, खेखसा	name of a vegetable, fruit of the creeper કકોડી

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કકોતરી	કકોતરી	સ્ત્રી	લગ્નાદિ શુભ પ્રસંગની આમત્રણપત્રિકા	કુકુમપત્રિકા, લગ્ન-પત્રિકા	wedding invitation
કકોત્રી	કકોત્રી	સ્ત્રી	જુઓ 'કકોતરી'	દેખિયે 'કકોતરી'	see 'કકોતરી'
કકોલ	કકોલ	પુ	એક ઔષધિ, ચિનિકબાલા	એક ઔષધ	name of a medicinal herb
કકોલુ	કકોલુ	વિ	કોરવરણ	કુનકુના	luke-warm
કકણ	કકણ	ન	કકણ	કગન, કકણ	wristlet
કકન	કકન	ન	કકણ	કગન	wristlet
કકની	કકની	સ્ત્રી	1 કાસકી 2 કકણ	કઘી કગન	small comb wristlet
કકવો	કકવો	પુ	કાસકો	કઘા	comb
કકાલ	કકાલ	વિ	1 છેક ગરીબ, દીન 2 દરિદ્રી, નિર્માલ્ય, તુષ્ઠ 3 રસકસરહિત	કકાલ, નિર્ધન દરિદ્ર, તુષ્ઠ રસકસ રહિત	poor, abject, insipid, con- temptible dried up, with- ered, sapless
કકાલિયત	કકાલિયત	સ્ત્રી	1 અત્યંત ગરીબી, દીનતા 2 કકાલ દશા	કકાલી, ગરીબી તુષ્ઠ દશા	extreme poverty, indigence abject state
કકાળ	કકાળ	વિ	જુઓ 'કકાલ'	દેખિયે 'કકાલ'	see 'કકાલ'
કકાળિયત	કકાળિયત	સ્ત્રી	જુઓ 'કકાલિયત'	દેખિયે 'કકાલિયત'	see 'કકાલિયત'
કકુરો	કકુરો	પુ	1 કાગરો, ઘાતો, અણી 2 કકુરો	ઢોંતા, ઢઢાના કકડ	tooth, edge stone
કકન	કકન	ન	1 ચોખ્ખુ સોનુ 2 ઢન, દોલત (જુઓ 'કકન')	કકન, શુદ્ધ સોના ઢન-ઢોલત (દેખિયે 'કકન')	pure gold wealth, riches (see 'કકન')
કકવો	કકવો	પુ	કકળી	કકુકી	bodice
કકુક	કકુક	પુ	1 કકળી, કકળો	કોલી, કકુક	bodice

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 सापनी शयणी	केंचुली	slough of a serpent
કચુકી	कचुकी	स्त्री	3 अष्टर	बक्तर, कचुक	armour
		पु	शयणी	चोली, कचुकी	bodice
કચોલુ	कचोलु	न	जनानजानानो थोबदार	अत पुर का रक्षक	chief attendant of the harem
કચોળુ	कचोळु	न	એક सुगंधीदार વનસ્પતિ	एक खुशबदार वनस्पति	kind of fragrant plant
કજ	कज	पु	જુઓ 'કચોલુ'	देखिए 'कचोलु'	see 'કચોલુ'
કજન	कजन	न	બ્રહ્મા	ब्रह्मा	Brahma
		पु	કમળ	कमल	lotus
		न	કામદેવ	कामदेव, कजन	Kamadeva (Cupid)
કજર	कजर	स्त्री	મેના	मेना	female parrot
		पु	1 બ્રહ્મા	ब्रह्मा	Brahma
		न	2 હાથી	हाथी	elephant
કજૂસ	कजूस	वि.	પેટ	उदर, पेट	belly, stomach
		पु	અતિશય કડકસર કરે એવું, કૃપણ, પાણી	कजूस, कृपण	miserly, mean
કટક	कटक	पु	1 ઢાટો, શસ	कटक, काँटा	thorn, splinter
			2 આકડો, ગલ (માછલા પકડવાનો)	कँटिया, गलग्रह (मछली का)	hook (to catch fish)
			3 રોમાચ	रोमाच	thrill
			4 (લા) નડતર, દખલ	(લા) बाधा, दखल,	(special use)
				कटक	obstruction,
કટારિયુ	कटारियु	न	5 દુશ્મન	शत्रु	snag
		સ્ત્રી	શબ ઉપરનું કપડું	कफन	enemy
કટાલુ	कटालु	સ્ત્રી	1 શીગણી	बैंगन	shroud, winding sheet
					kind of vegetable

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 બાવળ	बबूल	kind of tree, <i>bawal</i>
કંટાળવું	कटाळवु	अ क्रि	કંટાળો થડવો-આવવો	ऊबना, उकता जाना	to be tired, to get bored
કંટાળી	कटाळी	वि स्त्री	કાંટાવાળી હાથિયો શોર, શોરી	कॉटों वाली, कटकी धूर	thorny kind of cactus plant
કંટાળો	कटाळो	पु	અવિવિધતા કે શાકશી ઊપજતો અણગમો	एक-सा काम करने अथवा थकान से अरुचि, ऊब, बोरियत	boredom
કંટિયુ	कटियु	न	કૂડુ	अनाज की बाल, बाली	ear of corn
કટી	कटी	स्त्री	1 ડૂડામાના બારીક કણ 2 કૂડુ 3 તાજા ડાગર	बाल के बारीक दाने अनाज की बाल, खोशा ताजा धान	small grain in an ear ear of corn fresh unhusked rice
કટીવાળો	कटीवाळो	પુ	થૂલે ચડાવવાના વાસણને બહારની બાજુએ કરાતો માટીનો લેપ	मिट्टी या राख का लेप जो चूल्हे पर रखनेवाले बर्तन को चढाया जाता है	layer of mud or ash applied to a cooking pot
કટેવાળો	कटेवाळो	પુ	જુઓ 'કટીવાળો'	देखिए 'कटीवाળો'	see 'કટીવાળો'
કટોલી	कटोली	સ્ત્રી	એક વેલો, કકોડા	ककोडे की बेल, खेखसा	a kind of creeper
કટોલુ	कटोलु	न	કકોડુ	ककोडा (एक तरकारी)	kind of vegetable
કટોળી	कटोळी	સ્ત્રી	જુઓ 'કટોલી'	देखिए 'कटोली'	see 'કટોલી'
કટોળુ	कटोळु	न	જુઓ 'કટોલુ'	देखिए 'कटोलु'	see 'કટોલુ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કઠ	कठ	पु	1 ગળુ, ડોક 2 હૈડિયો 3 કઠમાથી નીકળતો અવાજ, સૂર, નાદ 4 કાઠો, કાઠલો	कठ, गला, हलक टेटुवा, घटी स्वर, आवाज, कठ	throat, neck gland in the throat voice, note (in music)
કઠાર	कठार	स्त्री	5 કાઠો, કિનારો	घडे आदि का गला, तोते आदि के गले पर की रगीन लकीर	neck (of a pot etc)
કઠાલ	कठाल	स्त्री	દરિયાનો કાઠો, કિનારો	किनारा, तट	shore, bank
કઠી	कठी	स्त्री	જુઓ 'કઠાર'	समुद्रतट	sea-shore, bank
		स्त्री	1 ડોકનુ એક ઘરેણુ	देखिए 'કઠાર'	see 'કઠાર'
			2 કઠમા પહેરવાની ગુરુએ બધાવેલી માળા	कठी, गले का एक गहना गले में पहनने की गुरु से प्राप्त माला	necklace string (of beads etc) to be worn as a necklace, usually bestowed by a Guru on his disciple
કઠારવુ	कठारवु	स क्रि	કોતરવુ, નકસી કરવી	कोरना, नक्काशी करना	to carve, to engrave
કડિકા	कडिका	स्त्री	1 નાનુ પ્રકરણ 2 વેદની ઋચાઓનો સમૂહ 3 કુકરો	कडिका, छोटा प्रकरण वैदिक ऋचाओं का समूह, कडिका परिच्छेद	small chapter or section section of Vedic stanzas paragraph
કડિયો	कडियो	पु	જુઓ 'કરડિયો'	करड, टोकरा, पिटारा, देखिए 'કરડિયો'	basket, see 'કરડિયો'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ક્રતાન	कतान	न	1 શણનુ કપડુ, શણિયુ 2 ગૂણપાટ, ટાટિયુ	टाट, पटसन का कपडा बोरी	jute fabric sack, canvas
ક્રતામણ	कतामण	न	ક્રતાઈ, ક્રાતવાનુ મહેનતાણ	कताई, कातने की मजदूरी	wages for spinning
ક્રતાવુ	कतावु	अ क्रि	1 'ક્રાતવુ' નુ કર્મણિ 2 પાતળુ થવુ, સુકાવુ 3 ઓછુ થવુ	काता जाना कृश होना, दुबला होना कम होना	passive of 'ક્રાતવુ' to be reduced, to be dried up to be lessened
કથ	कथ	पु	1 ક્રાન્ત, પિયુ 2 પતિ	कत, प्रिय, कात पति, कात	lover husband
કથા	कथा	સ્ત્રી	1 ચાંશરાનુ બનાવેલુ વસ્ત્ર 2 ગોદડી	चिथडा (कपडा) गुदडी, कथा	raggs coarse mattress
કથાર	कथार	न	એક વનસ્પતિ	एक वनस्पति, कथारी	kind of plant
કથારુ	कथारु	न	કથારનુ ફળ	कथारी का फल	fruit of a kind of plant
કદ	कद	पु, न	1 જેમા ખાવાનો ગર હોય તેવુ મૂળ, સૂરણ, બટાટા ઇ 2 મૂળ, કારણ (સમાસને અંતે), ઉદા આનદકદ	कद मूल, कारण (समासांतमें) उदा आनदकद	root (e g potato etc) root, source (when used at the end of a compound), e g આનદકદ
કદમૂલ	कदमूल	न	જુઓ 'કદમૂળ'	देखिए 'कदमूल'	see કદમૂળ'
કદમૂળ	कदमूळ	न	કદ તથા મૂળ (ખવાય તેવા)	कद-मूल (खाने के योग्य)	roots (among vegetables)
કદરા	कदरा	સ્ત્રી	ગુફા, ખો, બખોલ	कदरा, गुफा	cave, cavity

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કર્ષ	कदर्ष	पु	કામદેવ	कामदेव, कदर्ष	Cupid (Hindu mythology)
કધોલુ	कधोलु	न	1 ખભો 2 ખાધ, ગરદન	कधा गरदन	shoulder neck
કપ	कप	पु	કપારો, ધુજારો	कप	tremor
કપવુ	कपवु	अ क्रि	1 ધુજવુ, શરથરવુ 2 બીવુ, ડરવુ	कपना, कौपना, थरथराना डरना, सहमना	to shiver, to tremble to fear, to be afraid
કપાણ	कपाण	સ્ત્રી	એક જાતનો કાટો, ઘાતુની તુલા	राटुल, बडा तराजू	metal scales, larger scale
કપારી	कपारी	સ્ત્રી	જુઓ 'કપારો'	देखिए 'कपारो'	see 'કપારો'
કપારો	कपारो	પુ	1 ધુજારી, કમકમી 2 કમકમાટી	कपन कॅपकॅपी	tremor horror
કપાસ	कपास	પુ	1 હોકાચત્ર 2 વર્તુળ દોરવાનુ ચત્ર	कपास, कुतुबनुमा परकार, कपास	compass (for navigation) compass (a geometrical instrument)
કપુ	कपु	સ્ત્રી, ન	1 ટોળી, જૂથ 2 ફોજની ટુકડી 3 જુઓ 'કપો'	टोली, झुड, यूथ सेना की टुकडी देखिए 'कपो'	group, gang company of soldiers see 'કપો'
કપો	कपो	પુ	પડાવ, કપુ, છાવણી	पडाव, छावनो, डेरा, कप	encampment
કબલ	कबल	પુ	1 કામળી 2 ગાયબળદની ગોદડી- ગરદન નીચે લટકતી જાડી ચામડી	कमली, कम्बल सास्ना (गाय-बैल के गले का)	shawl dewlop (fold of skin hanging down the neck of a cow or of a bullock)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કસાર	कसार	पु	ખાવાની એક વાની	कसार, एक मिष्ठान्न	a sweet preparation
કસારી	कसारी	સ્ત્રી	એક જીવડું	एक लघु कीट जो प्राय ऊनी कपड़ों में लगता है	kind of moth
કસારો	कसारो	पु	ધાતુનું વાસણ ઘડવા-વેચવાનો ધંધો કરનાર પુરુષ	कसेरा, धातु के बर्तन घडने-बेचने वाला	coppersmith
કાંદે-આઝમ	काइदे-आझम	पु	મોટો-મહાન નેતા કે આગેવાન	महान नेता	great leader
કાંઈ	काई	સ્ત્રી	1 શરીર 2 પાતળું પડ આચ્છાદન	शरीर, काया पतली तह-आच्छादन	body slim, thin covering
કાક	काक	पु	કાગડો	काक, कौआ	crow
કાકડી	काकड़ी	સ્ત્રી	1 ચીભડું, આરિયું 2 ચીશરાને વળ દઈ બનાવેલી દિવેટ	ककड़ी रूई या कपडे को बल देकर बनाई गई बत्ती, बाती	cucumber wick
કાકડો	काकड़ो	पु	1 ચીશરાની મોટી દિવેટ 2 ગળાની બારીની આસપાસનો એક અવયવ, ચોળિયો	बड़ी बत्ती गले के भीतर दोनों ओर की गोंठें, 'टॉन्सल'	thick roll of a rag used as a wick tonsil
કાકતાલીય	काकतालीय	વિ	કાગનું તાડ પર બેસવું અને અકસ્માત તાડ ફળનું પડવું થાય એવું, અણધાર્યું, ઓચિંતું	काकतालीय (न्याय), किसी घटना का संयोगवश होना (उदा कौए के बैठते ही ताड के पके फल का चू पडना)	a case of coincidence as when a crow settles on a tree and immediately the tree falls, sudden unexpected

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अ३५	काकब	पु	गोण डे मडुडानी रसी (तमाकु आधवामा वपराय छे ते)	गुड या महुए के फल का शीरा (तबाकू बनाने में प्रयुक्त होता है)	fermented cane- sugar mixed with tobacco
अ३२	काकर	पु	1 दात, दातूशण (सूवरुदि प्राणीना) 2 इरपतनो दातो 3 यामडीमा पडेलो इश थिरो	दाँत (सूअर आदि प्राणियों का) दाँता (करवत का) चमडी में पडी हुई गहरी खरौंच	tusk tooth of a saw rash on the skin
अ३२ी	काकरी	स्त्री	1 नाना दातवाणी धार 2 नानो अ३२े 3 इरइर, रेती	छोटे दाँदानों वाली धार छोटा ककड, ककडी किरकिरी, रेत	tooth or teeth of a saw pebble sand
अ३२े	काकरो	पु	1 अ३२े 2 इथकु (जेम डे डुगणीनु)	ककड डला (नमक या मिसरी का)	stone, pebble piece
अ३२ूदी	काकलूदी	स्त्री	ध्या उपणवे अेवी आण्ण, अलावाला	आजिजी, गिडगिडाहट	supplication
अ३२अ	काकवडा	स्त्री	1 अेक ज वार इणनार वनस्पति 2 अेवी स्त्री	काकवध्या, एक ही बार फलने वाली वनस्पति ऐसी स्त्री	plant which bears fruit only once in life woman of the same type
अ३२ध्या	काकवध्या	स्त्री	जुओ 'अ३२अ'	देखिए 'अ३२अ'	see 'अ३२अ'
अ३	काका	पु	'अ३'नु मानवाचक रुप, आपनो भाए	काका, चाचा (गुज 'काको' का मानवाचक रूप)	form of 'अ३' showing respect, paternal uncle
अ३अैवो	काकाकौवो	पु	पोपट जेवु अेक पक्षी	काकाकौआ, काकातुआ	cockatoo
अ३अ	काकाजी	पु	अ३असर, असराना भाए	काकाजी, चाचा-ससुर, श्वसुर का भाई	brother of one's father-in-law

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કાકાબળિયા	काकाबळिया	पु	બળિયાકાકા, શીતળા	चेचक, बडी माता	small pox, chicken pox
કાકી	काकी	स्त्री	કાકાની સ્ત્રી	काकी, चाची	aunt
કાકીડો	काकीडो	पु	કાકીડો	गिरगिट	chameleon
કાકુ	काकु	पु	1 દુઃખ, ભય, ક્રોધથી સ્વરમા પડતો ફેર 2 કરડાકીમા કે વ્યગમા બોલવુ તે	काकु, ध्वनिभेद व्यग्य, काकु	intonation speaking in an ironical way
કાખ	काख	સ્ત્રી	બગલ	कॉख, बगल	the arm-pit
કાખબલાઈ	काखबलाई	સ્ત્રી	બગલમા થતુ એક ગૂમડુ, બામલી	बगल का फोडा, कँखौरी	painful turnover, abscess in the armpit
કાખબલાડી	काखबिलाडी	સ્ત્રી	જુઓ 'કાખબલાઈ'	देखिए 'काखबलाઈ'	see 'કાખબલાઈ'
કાખલી	काखली	સ્ત્રી	બગલ	बगल, कॉख	arm-pit
કાગ	काग	पु	કાક, કાગડો	कौआ, काग	crow
કાગજ	कागज	पु	1 વાસ, ઘાસ, ઘાગા ઇ માથી કરતી લખવા વગેરેના કામની એક બનાવટ 2 પત્ર, પત્રિકા	कागज, कागद रक्का, चिट्ठी, पुरजा, पत्र	paper letter
કાગઝ	कागझ	पु	જુઓ 'કાગજ'	देखिए 'कागज'	see 'કાગજ'
કાગડો	कागडो	पु	1 કાક, એક કાળુ પક્ષી 2 (લા)ચાલાક, લુચ્ચુ પ્રાણી	कौआ चालाक, लुच्चा	crow (special sense) clever, cunning animal
કાગદી	कागदी	वि	1 પાતળી છાલવાળુ (જેમ કે, લીબુ)	पतली छालवाला (कागजी) नीबू आदि	having a thin skin (e g a lemon)

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		પુ	2 તકલાદી 1 કાગળ બનાવનારો કારીગર	નાજુક કાગજ બનાવે યા બેચને વાલા, કાગજી	flimsy paper-manufac- turer
કાગવાશ	કાગવાશ	સ્ત્રી	2 કાગળ વેચનારો અથવા ચોપડા ઇ બાધનારો વેપારી	કિતાબે બાધને વાલા વ્યાપારી	paper merchant or book-binder
			શ્રાદ્ધને દિવસે પિતૃનિમિત્તે કાગડાને બલિ નાખતી વખતનો ઉદ્ગાર	શ્રાદ્ધોદ્ગાર યા બલિ	utterance made at the time of offering obla- tion to crows in the name of one's ancestors on the occasion of a death- anniversary
કાગળ	કાગળ	પુ	1 વાસ, ઘાસ, ઘાગા ઇ માથી કરાતી લખવા વગેરેના કામની એક બનાવટ 2 પત્ર, પત્રિકા	કાગજ, કાગદ	paper
કાગાનીદર	કાગાનીદર	સ્ત્રી	કાગડાના જેવી ઝટ ઊડા જાય એવી ઊઘ	પત્ર, ચિટ્ઠી, પુરજા	letter
કાગારોલ	કાગારોલ	પુ, સ્ત્રી	1 રોકકળ	કાકનિદ્રા	quick nap
			2 ગરબડાટ, બુમરાણ	રોના-પીટના	weeping and wailing
કાચ	કાચ	પુ	1 રેતી અને ખારવાળી માટી ઓગાળીને બનાવાનો એક પદાર્થ	કાગારોલ, કૌઆરોર, જોર સે ચિલ્લાના કાચ, કૌચ	wailing loudly, din, noise, to cry loudly glass

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2. दर्पण 3. पासादार, यणक्षती मिश्र धातु 4. निर्मल के क्षणभंगुर अेवी उपमा आपता वपराय छे, जेम के - अथ जेवु पाणी	आईना, दर्पण चमकीली पासेदार धातु निर्मल या क्षणभंगुर के अर्थ में प्रयुक्त होता है - उदा काच जैसा पानी	mirror crystal or quartz a metaphor for something undefiled and brittle e.g. for water
अछडो	काछडो	पु	धोतियु के सादलो उथो लछ भे पगनी वच्येशी पाछण जोसवो ते, ते रीते जोसेलो वस्त्रनो (भाग, स्त्री अछडी)	काछ, काछ, कछौटा	lower front end of a <i>dhota</i> or sari passed between the legs and tucked up at the back in the waistband
अछलु	काछलु	न	1. नाणियेरनु भागेलु ओटलु 2. ओछपाण भागेलु अर्धगोल जेवु उछण ओटलु	नरेली, नारियल की टूटी खोपडी कोई भी टूटा हुआ अर्धगोल भाग, कटाह - ठीब आदि	coconut - shell any broken piece having a thick layer of a semi- circle shape
अछियो	काछियो	पु	1. शाड वेचवानो धधो उरनार आधमी 2. अे ज्ञातिनो भाणस	काछी, तरकारी बेचने वाला, कुँजडा इस जाति का आदमी	vegetable- vendor person of that caste
अछ्र	काछी	पु	जुओ 'अछियो'	देखिए 'अछियो'	see 'अछियो'
अछेटी	काछोटी	स्त्री	जुओ 'अछोटी'	देखिए 'अछोटी'	see 'अछोटी'
अछोटो	काछोटो	पु	जुओ 'अछोटो'	देखिए 'अछोटो'	see 'अछोटो'
अण	काज	न.	1. काम 2. अरण, प्रथाजन	काज, काम प्रयोजन, अर्थ, काज	work cause, motive

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કાજગરુ	काजगरु	वि	1 શક્તિવાળુ, કાબેલ 2 જુવાનજોદ, તરુણ 3 ઘણુ પ્યારુ, માનીતુ, લાડકુ 4 નાજુક, તકલાદી	शक्तिशाली, होशियार युवा, तरुण बहुत प्यारा, लाडला, प्रेमपात्र नाजुक	capable, efficient youthful very dear, beloved delicate, easily breakable
કાજળ	काजळ	न	1 મેશ 2 આખમા આજવાની મેશ	काजल, मसी काजल	collyrium collyrium
કાજળી	काजळी	स्त्री	1 મેશ 2 રાખનુ પડ 3 કાળી ફૂગ 4 મેશ પાડવાનુ કોડિયુ 5 શ્રાવણ માસમાગાય પૂજવાનુ સ્ત્રીઓનુ એક વ્રત	मसी, काजल राख की तह काली फफूंदी कजरौटा गाय को पूजने का स्त्रियों का एक व्रत (श्रावण मास में)	collyrium layer of ash fungus (generally black) small earthen pot on which lampblack is allowed to collect vow of cow-worship taken by women (falling in the month of <i>Shravana</i>)
કાજળીત્રીજ	काजळीत्रीज	स्त्री	શ્રાવણ વદ ત્રીજ, કાજળરાણી	कजली तीज	third day of the dark half of the month of <i>Shravana</i>
કાજી	काजी	पु	1 ઇસ્લામી ન્યાયાધીશ 2 ઇસ્લામી વિદ્વાન-પડિત	काजी मौलवी	Muslim judge Muslim pundit

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કાજુ	काजू	पु	એક સૂકો મેવો	काजू	cashew-nut
કાજુકઢિયા	काजूकढिया	पु	1 કાજુ 2 સાકરિયા કાજુ	काजू चीनी चढाये हुए काजू	cashew-nut sugar-coated cashew-nut
કાજે	काजे	अ	માટે, વાસ્તે	- के लिए, वास्ते	for, for the sake of
કાજો	काजो	पु	કચરો, પૂજો	कचरा - करकट	rubbish, junk
કાટ	काट	पु	1 ધાતુને લાગતો મેલ કે તેનો વિકાર, 2 (લા) મકામો, ભારરૂપ, ઉતાર કે મેલ 3 ઇમારતી લાકડુ 4 (દાવો કાપવા) સામે મડાતો દાવો, પ્રતિકાર 5 કાટો, નડતર, આડ, વિઘન	जग (ला) रद्दी, बोझीला, मैल या उतार इमारती लकडी प्रतिदावा, प्रतिकार	rust scrap timber counter-claim
		स्त्री	ગજીશામા અમુક ભાત ન હોવી-કાપતુ હોવુ તે	काँटा, अवरोध, विघ्न (ताश के पत्तों की) काट	obstacle absence of cards of a certain suit with a player
કાટકૂટ	काटकूट	स्त्री	1 કાપવુ અને કૂટવુ- ખાડવુ, ટીચવુ તે 2 તૂટેલો કૂટેલો સરસામાન 3 મકાનના બાધકામનો માલ	काटना और कूटना अगड-खगड, कबाड मकान बनाने का सामान	cutting and crushing or pounding junk miscellaneous building material
કાટકો	काटको	पु	મોટી ગર્જના	बडी गर्जना, कडाका	thunder-clap
કાટખૂણ	काटखूण	पु	1 નેવુ અશનો ખૂણો	90° का कोण	angle of ninety degrees

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 એ માપનુ ક્રિયા સુતારનુ ઓજાર	कोणमापक यंत्र, गोनिया, गुनिया	a device useful in carpentry and masonry
કાટણટ	काटछाट	સ્ત્રી.	કાપકૂપ, સુધારોવધારો	काट-छाट	pruning, additions and improvements
કાટપીટિયો	काटपीटियो	પુ	ઇમારતી લાકડાનો વેપારી	इमारती लकडी का व्यापारी	timber-merchant
કાટમાળ	काटमाळ	પુ	જૂનુનવુ પરચૂરણ ઇમારતી લાકડુ (વળી, વાસ ઇ)	इमारती नयी पुरानी लकडी (बल्ली, बास आदि)	miscellaneous items of timber, old and new, as building material
કાટલુ	काटलु	ન	1 વજન, અમુક નક્કી વજનનુ તોલવાનુ સાધન 2 સુવાવડમા સ્ત્રીઓને અપાતુ ગુદર વગેરેનુ વસાણુ 3 ઓછુ કરવુ તે, કાપી લેવુ તે 4 કાટ, કાટો-નડતર, બલા	वजन, बाट प्रसूतिवाली स्त्रियों को खिलाया जाने वाला पाक काट बाध्ना, बला	piece of metal of a specific weight used in the scales for weighing rich mixture given to women in pregnancy cut back rust, snag, obstruction, burden
કાટવુ	काटवु	स क्रि वि	1 કાપવુ, છેદવુ 2 કરડવુ 3 છેતરવુ કાટના રંગનુ	काटना, छेद करना डसना, काटना ठगना, छलना गेरू के रंग का, कषाय	to cut to bite to deceive of the colour of rust

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अटवो	काटवो	पु	शोकनो अटवो सादलो	शोक की कषाय धोती	mourning sari of the colour of rust
अटाअट	काटाकाट	स्त्री	1 अमाअपी 2 अतल 3 अटस, अधावत	मार-काट, कटाकटी कतल अदावत, कट्टर 'बैर	bloodshed slaughter enmity
अटोडो	काटोडो	पु	1 अडमड 2 ठरेलो अथरो, प्रवाडी वस्तुनो मेल 3 अटाए-अगडीन जराए शए गयेलो माल, नअमो रदी सामान ए	चकमक तलछट, किट्ट जग खाई हुई रद्दी, बेकार चीजें	flint dregs junk
अठ	काठ	वि पु	धूर्त, पडोयेल 1 अष्ट 2 एभारती अट 3 अठडो 4 डेडवेडीनु थोडठु	घाघ, धूर्त, चालाक, अनुभवी काठ, लकडी इमारती सामान काठी काठ की बेडी, काठ	cunning, shrewd wood timber wooden saddle (on camel etc) fettters
अठडी	काठडी	स्त्री	नानो अठडो	छोटी काठी	small wooden saddle for a camel
अठडु	काठडु	न	जुओ 'अठडो'	देखिए 'अठडो'	see 'अठडो'
अठडो	काठडो	पु	ठट वगेरेनी पीठ पर मुअतु लाडडानु आसन	काठी	wooden saddle on a camel
अठा	काठा	वि.	(ए व.)लालाश पस्ता अेअ गतना धउ	एक प्रकार के लाल रग के गेहूँ	kind of reddish wheat
अठाणु	काठाळु	वि	अडावर, अठा-आधावाणु	कद्दावर, गठीला और मजबूत	of large, strong build

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अठियाणी	काठियाणी	स्त्री	अठीनी स्त्री	काठी जाति की स्त्री	<i>kathu woman</i>
अठियावाड	काठियावाड	पु, न	गुजरातનો એક પ્રદેશ	काठियावाड	<i>Kathiawad, a region in Gujarat</i>
अठियावाडी	काठियावाडी	वि पु	अठियावाડનો, -सपधी अठियावाડનો રહીશ	काठियावाड का, काठियावाडी काठियावाड का निवासी	of Kathiawad resident of Kathiawad
अठी	काठी	वि, पु स्त्री	अठियावाડની એક અસલી જાતનું (માણસ) 1 બાળવાનું લાકડું 2 જમીનનું એક માપ (૪૦૦ અઠી, વીઘ)	काठियावाड की एक असली जाति का जलाऊ लकड़ी, ईंधन जमीन की एक नाप (400 काठी - एक बीघा)	(member) of the <i>Kathu tribe</i> fuel a measure of land (1/400 of a <i>bigha</i>)
अठु	काठु	वि न	1. કઠણ, આકરુ 2. કઠોર 3. કજૂસ 4. ખરાબ, માઠું 1. કલેવર, શરીરનો બાધો 2. કઠડો	कठिन, मुश्किल कठोर कजूस खराब, अशुभ, बुरा काठी (देह की) काठी	stiff, hard hard-hearted miserly bad, inauspicious frame or build of the body wooden saddle (on camel etc)
अढ्याल	काढघाल	स्त्री	अढ्यु ने घाल्यु ते	निकालना और घुसेडना	taking out and putting in repeatedly

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઢઢવુ	काढवु	स. क्रि	1 (હોય ત્યાથી કે અદરથી) બહાર ખેંચવુ-લાવવુ-લેવુ મોડલવુ (જેવા ભાવો બતાવે છે)	निकालना	to bring out, to draw out (and similar shades of meaning)
			2 અલગ કરવુ, દૂર કરવુ, છૂટુ પાડવુ	पृथक् करना	to separate, to detach
			3 રદ કરવુ	रद्द करना, हटाना	to cancel
			4 આલેખવુ, દોરવુ	कसीदा, चित्र आदि बनाना	to draw (e g a picture)
			5 કહેવુ, બોલવુ, ઉચ્ચારવુ	आवाज, राग आदि निकालना	to utter (e g a word)
			6 સ્થાપવુ, નવુ ખોલવુ, શરૂ કરવુ	दुकान आदि शुरू करना	to start (e g a dispensary)
			7 ગણી ઢઢવુ, ગણતરી કરવી	गिन डालना	to take (e g a count)
			8 જાહેરમા બહાર આણવુ	नाम आदि रोशन करना	to bring into the open
			9 અદરનો સાર કે અમુ ક ભાગ અલગ કરવો	सार आदि निकालना	to sort out a portion of a thing
			10 કમાવુ, મેળવવુ, જોગ કરવો	जुटाना	to earn, obtain, to provide for
			11 બીજા ક્રિ. સાથે, તે ક્રિયા પૂરી કરી દેવી, પતવવી એવો ભાવ પ્રેરે છે		indicates the completion of an activity when used in combination with another verb
ઢઢો	काढो	पु	ઉઢાળો, ઢાવો	काढा, क्वाथ	decoction (esp of drugs)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आश	काण	स्त्री	मरण पाछण रोवु, डूटवु अथवा लौडिके जवु ते	मृतक के पीछे रोना - धोना, सियापा	weeping, beating the breasts or paying a visit of condolence to a bereaved person
आशभोआश	काणमोकाण	स्त्री	जुओ 'आश'	देखिए 'आश'	see 'आश'
आशियु	काणियु	वि	1 आश डरनारु	सोगी, मातमदार	in mourning (of person)
आश	काणु	वि	2 आश	काना, एकाक्ष	one-eyed
		वि	1 वेळ-छिद्रवाणु	छिद्रवाला	having a hole
		न	2 ओक आपवाणु	काना	one-eyed
			वेळ, छिद्र, पाकु	छिद्र	hole, slit, aperture
अतर	कातर	वि	1 बीअश, अयर	कातर, भीरु, कायर	timid
			2 दु.भी, भयभीत	दुखी, आर्त	frightened
			3 अतरतु, पाकु	कतराता हुआ, तिरछा	oblique
		स्त्री	1 अतरवानु ओजार	कतरनी, कैंची	a pair of scissors
			2 वाण भरी पडवानो गानवरोनो ओक रोग	बाल झडने का चौपायों का एक रोग	a disease among cattle of hair- dropping
			3 अतरना जेवी धारवाणी पातणी ठीकरी, पतरु ए	कैंची के जैसी धारदार पतली ठीकरी	piece of earthen vessel or metal sheet with a sharp edge
अतरवु	कातरवु	स क्रि	1 अतरशी अपवु	कतरना	to cut with a pair of scissors
			2 अपवु, डरवु	काटना	to cut, bite
			3 ओधु डरवु	कम करना	to lessen, reduce

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 ખોતરવુ, ખણવુ 5 ઘસાતુ ખોલવુ	कुरेदना आलोचना करना	to gnaw, scratch to speak in derision
ઢાતરિયુ	कातरियु	न	1 છેક છાપરાની નીચેનો નીચો મેડો 2 લાકડાનુ એક બેધારુ અસ્ત્ર 3 દીવાલ કોથવાનુ ચોરનુ એક ઓળખર 4 ભેજુ	छप्पर के पास की बिलकुल नीची मजिल लकड़ी का एक दुधारा अस्त्र सैंध लगाने का औजार भेजा	garret double-edged wooden missile tool for house-breaking brain
ઢાતરી	कातरी	स्त्री	પાતળી, ચપટી કડકી	कतला, बचका	thin flat piece or slice
ઢાતરો	कातरो	पु	1 ચપટુ, લાબુ, વાકુ ફળ 2 ઊગતા છોકને ઢાતરી ખાનાર જીવડો 3 દાઢીની બને ખાજુ રખાતા વાળના લાખા કાકડાખાનો પ્રત્યેક	चपटा, लबा और टेढा फल अनाज के उगते पौधों को खा जाने वाला एक कीड़ा गलमुच्छा	flat, long and curved fruit (e g tamarind pod) kind of insect which eats up shoots of plants whisker
ઢાતળી	कातळी	स्त्री	પાતળી, ચપટી કડકી	पतला, चपटा टुकड़ा, कतली	thin, flat piece or slice
ઢાતલ	कातिल	वि	1 ઢાતલ કરનારુ-કરે એવુ 2 ઘાતક 3 મર્મવેદી	कातिल घातक मर्मभेदी	killer deadly cutting to the quick
ઢાતી	काती	स्त्री	1 છરી 2 કરવતી	काती, छुरी करवती, आरी	knife small saw

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अतु	कातु	न	भूठी छरी-पाणी	कुद छुरी, काता	blunt knife
अशाडबाला	काथाकबाला	पु	1 कूशली, साथाजूठा 2 नडामी भाजगड, नणवी तकसर	कुत्सा, निदा हुज्जत, व्यर्थ झगडा, मामूली तकरार	gossip squabble
अश्रियु	काथियु	वि न	अशाना रगनु 1 अशीनु दोरडु 2 अशीनी साएडी 3 अशीनु अनावेलु पगलुछरियु	कथई नारियल के छिलकों के रेशों को बटकर बनाई हुई रस्सी इसकी चटाई इसका पायदान	grey coir-rope coir-mat coir-doormat
अशी	काथी	स्त्री	नाणियेरना छोडाना रेसा डे तेनी दोरी(अशी जेवा रगनी)	नारियल के छिलकों के रेशे या इनकी डोरी	coir
अथो	काथो	पु	जेरनी छालनु सत्व	कथा, खैरसार	catechu
अएव	कादव	पु	धूण-मटोडीमा पारणी भणीने अनतो गारो, डीचड	कीचड, कीच	mud
अन	कान	पु	1 सांभणवानी छद्रिय 2 लक्ष, ध्यान 3 नाकु, छिद्र	कान लक्ष्य, ध्यान छेद, बेध	ear notice, attention eyelet, aperture
अनभजूरो	कानखजूरो	पु	घण्ण पगवाणो अेड छवडो	कनखजूरा	centiped
अनभोतरणी	कानखोतरणी	स्त्री	मेल अडवानी अन- ओरणी	कनखोदनी	an instrument to draw out slough from inside the ear
अनटोपी	कानटोपी	स्त्री	अन ढकय अेवी टोपी	कनटोप	close-fitting cap covering the crown and ears

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अनढाअशी	कानढाकणी	स्त्री	જુઓ 'अनटोपी'	देखिए 'अनटोपी'	see 'अनटोपी'
अनपटी	कानपटी	स्त्री	अननी ओर डे प्लूट	कान की लौ, लोलकी	lobe of ear
अनपटो	कानपटो	पु	अन ढाअवानो पटो	कान ढकने की पट्टी	a strip of cloth tied round the ears
अनपट्टी	कानपट्टी	स्त्री	જુઓ 'अनपटी'	देखिए 'अनपटी'	see 'अनपटी'
अनपट्टो	कानपट्टो	पु	જુઓ 'अनपटो'	देखिए 'अनपटो'	see 'अनपटो'
अनअटो	कानफटो	पु	अनमा मोटु कुडण-कुडु पछेरनार साधु, गोरखपथी वेरगी	कनफटा (साधु)	sadhu belonging to the Gorakh Nath sect wearing big rings in his ears
अनअूसिया	कानफूसिया	न	अनअभेरशी	कानाफूसी, कनफुसकी	back-biting
अनअूसियु	कानफूसियु	वि	1 युगलओर 2 अन अभेरनारु	कनफुसका, चुगलखोर बहकानेवाला	backbiter one who is poisoning the ears
		न	अेपु माएस डे अेपी वात अरपी ते	कान भरने वाला	person given to back-biting
अनअभेरशी	कानभभेरणी	स्त्री	अन अभेरवा ते, अेधनु अेध अली अेधी अेरवशी अरपी ते	कान भरना	misleading a person by telling him lies
अनभूणथु	कानमूळियु	न	अनना भूणमा थतो अेअ रोग	कर्णमूल (रोग)	disease affecting the root of the ear
अनशियाण	कानशियाळ	न	अेअ एवडु	एक जतु	a type of insect
अनस	कानस	स्त्री	अेअ ओणर, अतरडी	रेती (औजार)	kind of tool, a file

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अनूडो	कानूडो	पु-	अडानो, कृष्ण	श्रीकृष्ण, कन्हैया	Krishna
अनूगो	कानूगो	पु	अथडे जाणानार पुरुष	कानूनदो	person knowing the law
अनून	कानून	पु	1 अथडे, नियम 2 धारो, रिवाज	कानून, नियम रिवाज, प्रथा	law, rule custom, convention
अनूनभग	कानूनभग	पु-	अनूनने-अथडेनो भग	कानून का भग	breach of law
अनूनी	कानूनी	वि	अनूनने लगतु	कानून से सबद्ध, कानूनी	legal
अनेअन	कानेकान	अ-	1 जुधे जुधे अने थडेने 2 जुधे पोताना अनथी	कानोकान खुद अपने कान से	from ear to ear personally
अनी	कानो	पु-	1 लिपिमा 'आ'नु 'ी' आपु चिह्न 2 वासएनी डोर	खडी पाई, काना 'i' आकार का चिह्न वरतन का किनारा, आँवठ	stroke 'i' attached to a letter denoting the long vowel edge of a vessel
अनोअन	कानोकान	अ	1 (वासएना)अना सुधी 2. जुओ 'अनेअन'	लवरेज देखिए 'अनेअन'	up to the brim (or the edge of a vessel) see 'अनेअन'
अनोमातर	कानोमातर	पु	'ी' आपु चिह्न	'ी' चिह्न	the vowel marks 'ी' indicating pronunciation "o"
अप	काप	पु-	1 अपपु ते 2 अपवाशी पडतो आओ, पाठ, अपो	काटना, काट काटने से पडने वाली खरोच, चीरा या घाव	cutting cut, wound

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 स्त्रीओना अननु अेक धरेणु	स्त्रियों के कान का एक गहना, कौप	stud-like ear-ornament worn by women
			4 आपवानी-वेतरवानी शीत, ખૂબી	काटने-ब्योतने का ढग	method of cutting (esp cloth)
કાપડ	कापड	न	કોરુ કાપડુ	(कोरा, न बरता हुआ) कपडा	cloth
કાપડિયો	कापडियो	पु	કાપડ વેચનાર	बजाज	cloth-merchant
કાપડી	कापडी	वि	કાપડનુ, કાપડને લગતુ	कपडे का	of cloth, pertaining to cloth
		स्त्री	નાનુ કાપડુ	छोटी चोली	small piece of cloth
કાપડુ	कापडु	न	સ્ત્રીઓનુ છાતીએ પહેરવાનુ અેક પ્રકારનુ વસ્ત્ર, કાચળી	चोली, अँगिया	bodice
કાપણી	कापणी	स्त्री	1 કાપવાની શીત 2 પાકેલા અનાજને કાપવુ તે, લાણણી 3 પતરા કાપવાનુ ઓજાર, કાતર	काटने का ढग कटाई (फसल की) कटनी (पत्तर काटने की)	method of cutting reaping tool for cutting metal sheets
કાપલી	कापली	स्त्री	કાગળ કે કાપડાનો નાનો કકડો	पुरजा, रेजा (कागज या कपडे का)	small piece of paper or cloth
કાપલો	कापलो	पु	કાગળ કે કાપડાનો કકડો	पुरजा या रेजा	piece of cloth or paper
કાપવુ	कापवु	स क्रि	1 વાટવુ, વાટી જીદ પાડવુ 2 ઘટાડવુ	काटना, काटकर अलग करना (कुछ अंश) कम करना	to cut to reduce

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			३ દૂર કરવું, ફેંકવું	दूर करना, हटाना	to remove, to pay off
			४ ચીપ્યા પછી પાના વહેંચતા પહેલા અદ્દર અમુક ભાગ ઉઠાવવો	ताश के पना को फेंटने के बाद उनमें से कुछ पत्तों को उठाना	to cut after shuffling (for playing cards)
કાપાકાપ	कापाकाप	स्त्री	એકબીજાને સામસામે ડાપી નાખવું તે, ડાલ, ખૂનરેણ	कटाकटी, कतल, हत्या	bloodshed, massacre
કાચકી	काचकी	स्त्री.	१ કાચી, કાચ્ય, એક વનસ્પતિ २ ગળાની બારી આગળ થતો એક રોગ ३ સડકામાર, મુકુંડલી	एक वनस्पति गले के टेंटुए के पास होनेवाला एक रोग सक्रीर्णता, सकट	kind of plant kind of throat disease difficulty, hardship
કાચકુ	काचकु	न	કાચકીનું ફળ, કાચકુ	काचकी का फल	fruit of 'काचकी'
કાચકો	काचको	पु	કાચકુ, કાચકુ	देखिए 'काचकु'	see 'काचकु'
કાચબી	काचबी	स्त्री	१ કાચબાની માદા २ એક રોગ, કાચકી	मादा कछुआ, कछुई टेंटुए के पास होने वाला एक रोग	female tortoise kind of disease
કાચબો	काचबो	पु.	એક જળચર પ્રાણી	कछुआ	tortoise, tortoise
કાચર	काचर	स्त्री	કકડી	छोटा टुकड़ा, किरिच	small piece
કાચરકૂચર	काचरकूचर	न	१ પરચૂરણ ખાદ્ય વસ્તુઓ २ પરચૂરણ ભાગીતૂટી વસ્તુઓનો સમૂહ	चना-चबेना, फुटकर खाद्य चीजें अगड-खगड	miscellaneous articles of food miscellaneous broken articles

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કાચલી	કાચલી	સ્ત્રી	નાળિયેરનુ ભાગેલુ કોટલુ	નરેલી	coconut-shell
કાચા(-ચિ-ચી)કો	કાચ (-ચિ-ચી) કો	પુ	(જુઓ 'કાકીકો') એક પ્રાર્ણી	ગિરગિટ	chameleon
કાચુ	કાચુ	વિ	1 પાકેલુ નહિ એવુ 2 બરાબર નહિ સીઝેલુ, પકવેલુ કે રધાયેલુ 3 શેકેલુ, રધેલુ નહિ એવુ 4 કશા સસ્કાર ન કરાયેલુ-કુદરતી સ્થિતિમા હોય એવુ 5 તકલાદી, મજબૂત કે ટકાઉ નહિ એવુ 6 નાદાન, બિનઅનુભવી, અધૂરુ, અધકચરુ 7 અધૂરુ, અપૂર્ણ 8 કામચલાઉ 9 પોચુ, નરમ (કાચા કાળજાનુ) 10 બારદાન ઇ સાથેનુ કામચલાઉ કે અદાણ વજન કચાશ, કસર, અધૂરાપણ	કચ્ચા, અપક્વ (ફલ) અનસિદ્ધા, કચ્ચા સેંકા હુઆ, જો પકાયા હુઆ ન હો અધકચરા, કચ્ચા અધિક દિન ન ટિકને વાલા, કમજોર અનાડી, અનુભવહીન, અધકચરા અધૂરા, અપૂર્ણ કામચલાજ પોચા, નમ્ર કચ્ચા વજન કમી, કસર, અધૂરાપન	unripe not properly baked or cooked uncooked not dressed or treated, plain, unripe fragile callow incomplete temporary weak, timid weight at a rough estimate weakness, defect, drawback
કાચુકોરુ	કાચુકોરુ	વિ	નહિ રધેલુ અને લૂખુ	રુખા-સૂખા	uncooked and dry foods

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કાબરચીતરુ	કાબરચીતરુ	વિ	ચિત્રવિચિત્ર, તરેહવાર રંગનુ	ચિતકબરા, રગ-બિરગા	of various colours
કાબરિયું	કાબરિયુ	વિ	રંગબરંગી, કાબરચીતરુ	રગ-બિરગા, ચિતકબરા	of various colours
કાબરી	કાબરી	સ્ત્રી	1 કસૂબીનુ બી 2 કાબરચીતરુ ધોળા અને કાળારંગની તલ્લી	કુસુમ કા બીજ, કુસુમ, કરડી ચિતકબરા, સફેદ ઔર કાલે રગ કા તિલહન	seed of saf- flower plant sesame grains of black and white colour
કાબરુ	કાબરુ	વિ	જુઓ 'કાબરિયુ'	દેખિયે 'કાબરિયુ'	see 'કાબરિયુ'
કાબસ	કાબસ	પુ	તેલનો (તળે ઠરતો) કચરો	તેલ કા તલછટ, કિટ્ટ	drege of oil
કાબૂ	કાબૂ	પુ	1 સત્તા, અખત્યાર 2 અકુશ 3 કબજો 4 વજન, વગ	કાબૂ, અધિકાર અકુશ કબજા વજન, પ્રભાવ	power, authority control possession, mastery weight, influ- ence
કાબેલ	કાબેલ	વિ	1 પહોચેલુ, હોશિયાર 2 પ્રવીણ, બાહોશ	કાબિલ, અનુભવી પ્રવીણ, કુશલ	resourceful, clever expert, efficient
કાબો	કાબો	પુ	કચ્છ તરફ વસતી એક લૂટારુ અને ચાચિયા જાતનો આદમી, લૂટારો	લુટેરા	pirate in the gulf of Kutch
કામ	કામ	ન	કાબેલ, પકકો 1 કર્મ, કૃત્ય 2 નોકર-ચાકરનુ કામ જેમ કે, કામ કરનારી 3 કર્તવ્ય	કાબિલ, અનુભવી કામ, કાર્ય નોકર કા કામ કર્તવ્ય, ફર્જ	capable, clever work, act duties, chores (e.g a servant) duty

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા- કો.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 વ્યવસાય, ધંધો	व्यवसाय	profession, business
			5 જરૂર, ખપ, ઉપયોગ	जरूरत, आवश्यकता, उपयोग	need, use
		અ	6 કેસ, મુકદ્દમો કાજે, માટે	केस, मुकद्दमा के लिए, वास्ते	case, suit, trial (in) for
કામઠી	कामठी	સ્ત્રી	1 નાનુ કામઠુ, સાદુ ધનુષ્ય 2 કામઠીવાળો માણસ, ભીલ	छोटा कमठा, धनुकी भील	small or ordinary bow a Bhil (member of a tribe known by that name)
કામઠુ	कामठु	ન	ધનુષ	कमठा, धनुष	bow
કામડી	कामडी	વિ	1 નખળા બાધાનુ, સુકલકડી 2 કામકરદુ વાસની ચીપ	दुबला-पतला कर्मठ, मेहनती बॉस का फट्टा	lean, thin hard-working chip of bamboo
કામડુ	कामडु	વિ ન	જુઓ 'કામડી' વાસની ચીપ	देखिए 'कामडी' बॉस का फट्टा	see 'कामडी' chip of bamboo
કામદુ	कामदु	વિ	1 કામકરદુ, કામ કરે એવું, કર્તવ્યનિષ્ઠ 2 મહેનતુ	कर्तव्यनिष्ठ, कर्मठ मेहनती	willing to work, dutiful hard-working
કામણ	कामण	ન	1 વશીકરણ, મોહની લગાડવી તે 2 ઘતરમતર, ટુચકો	वशीकरण, मोहनी जतर-मतर, जादू-टोना	conjuraton sorcery
કામણટૂમણ	कामणटूमण	ન	કામણ અને બીજા ટુચકા, ઘતરમતર	जतर-मतर और वशीकरण	sorcery, magic etc
કામદાર	कामदार	પુ	1 અમલદાર, અધિકારી 2 કારબારી, દીવાન	अमलदार, अधिकारी कारबारी, दीवान	officer, official administrator, diwan

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અચુનચ	કાચુનચ	વિ	સાવ અચુ	બિલકુલ-નિરા કચ્ચા	utterly raw
અચુપાકુ	કાચુપાકુ	વિ	કંઈક અચુ અને કંઈક પાકુ એવું, અર્ધકચ્ચ	કચ્ચા-પક્કા, અર્ધકચ્ચ	partly cooked, partly raw, half- baked
અચુપોચુ	કાચુપોચુ	વિ	અનુભવ અને હિમત વગરનું, ભોળું, અકુશળ	અનુભવહીન, બેહિમ્મત, મોલા, અપટુ, કચ્ચા	inexperienced, callow
કાછ	કાછ	પુ	જુઓ 'કાછડો'	દેખિયે 'કાછડો'	see 'કાછડો'
કાછડી	કાછડી	સ્ત્રી	કાછડાની રીતે પાછળ ખોસેલો ધોતિયાનો એક ભાગ	કાછની, લોંગ	tuck of dhoti
કાપાકાપી	કાપાકાપી	સ્ત્રી	કતલ, ખૂનરેણું	કતલ, હત્યા	bloodshed, massacre
કાપાકૂપ	કાપાકૂપ	સ્ત્રી	1 શોડુધારણ કાપવું ઘટાડવું તે 2 સુધારોવધારો 3 કંઈકસર	કતર-બ્યોત કોટછોટ	pruning additions and improvements thrift
કાપાકૂપી	કાપાકૂપી	સ્ત્રી	જુઓ 'કાપાકૂપ'	કિફાયત, મિતવ્યયિતા	see 'કાપાકૂપ'
કાપાલ	કાપાલ	પુ	1 ખોપરીના હાર પહેરનાર-મહાદેવ, શિવ 2 એક જાતનો અધોરી બાવો-શિવભક્ત	દેખિયે 'કાપાકૂપ' કાપાલી, શિવ કાપાલિક	Shiva (Hindu God)
કાપુરુષ	કાપુરુષ	પુ	1 બાયલો મારાસ 2 અધમ-તુચ્છ મારાસ	કાપુરુષ, કાયર પુરુષ નીચ, તુચ્છ પુરુષ	ascetic of Aghori sect, devotee of Shiva coward worthless man

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अपो	कापो	पु	1 आओ, लीटो, छेओ 2 थीरो, डप	लकीर (पडना), छेंक चीरा, शिगाफ	cut, cross slit
अक्षर	काफर	वि	1 मुसलमानी धर्मने नहि माननार, नास्तिक, अधर्मी 2 लुथ्यु, डरामओर 3 जगली	काफिर, नास्तिक, अधर्मी बदमाश, दुष्ट, काफिर जगली	person not believing in Islam infidel, atheist cunning wild
अक्षो	काफलो	पु	आइशानी मूण वतनी जातनो भाणस	अफ्रीका की एक हब्शी जाति का व्यक्ति	member of an aboriginal tribe of Africa
अक्षो	काफलो	पु	1 समुदाय, सघ 2 लडायक वडाणनो समूह	समुदाय, सघ, काफिला जगी बेडा	caravan, company of pilgrims, merchants etc armada
अक्ष्यो	काफियो	पु	अनुप्रास	काफिया, तुक, अत्यानुप्रास	rhyme
अक्षी	काफी	स्त्री	1 ओक रागिणी	एक रागिणी, काफी	one of the ragas of music
			2 बुदधाराभाशी बनावातु ओक पीण	कहवा, काफी	coffee
		वि	पूरतु, जूर जेटलु	पर्याप्त, पूरा, काफी	enough, sufficient
अक्षर	काबर	स्त्री	1 ओक पक्षी	एक पक्षी, मैना	a species of bird
			2 (ला) अथकथियाण स्त्री	(ला) कर्कशा स्त्री	shrewish woman

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
डाबरथीतरु	काबरचीतरु	वि	चित्रपिचित्र, तरेडवार रगनु	चितकबरा, रग-बिरगा	of various colours
डाबरियु	काबरियु	वि	रगबरगी, डाबरथीतरु	रग-बिरगा, चितकबरा	of various colours
डाबरी	काबरी	स्त्री	1 कसूजीनु जी 2 डाबरथीतरु धोणा अने डाणारगनी तली	कुसुम का बीज, कुसुम, करडी चितकबरा, सफेद और काले रग का तिलहन	seed of safflower plant sesame grains of black and white colour
डाबरु	काबरु	वि	जुओ 'डाबरियु'	देखिए 'डाबरियु'	see 'डाबरियु'
डाबरस	काबरस	पु	तेलनो (तणे ठस्तो) क्यरो	तेल का तलछट, किट्ट	drege of oil
डाबू	काबू	पु	1 सत्ता, अजत्यार 2 अकुश 3 कब्जा 4 वजन, वग	काबू, अधिकार अकुश कब्जा वजन, प्रभाव	power, authority control possession, mastery weight, influence
डाबेल	काबेल	वि	1 पडोयेलु, डोशियार 2 प्रवीण, जाडोश	काबिल, अनुभवी प्रवीण, कुशल	resourceful, clever expert, efficient
डाबो	काबो	पु	कच्छ तरङ्क वसती अेक लूटारु अने चाचिया गतनो आधमी, लूटारो	लुटेरा	pirate in the gulf of Kutch
डाभ	काम	वि	डाबेल, पडो	काबिल, अनुभवी	capable, clever
		न	1 कर्म, कृत्य 2 नोकर-चाकरनु डाभ जेम डे, डाभ करनारी 3 कर्तव्य	काम, कार्य नौकर का काम कर्तव्य, फर्ज	work, act duties, chores (e g a servant) duty

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 व्यवसाय, धंधो	व्यवसाय	profession, business
			5 જરૂર, ખપ, ઉપયોગ	जरूरत, आवश्यकता, उपयोग	need, use
		अ.	6 કેસ, મુકદ્દમો કાળે, માટે	केस, मुकद्दमा के लिए, वास्ते	case, suit, trial (in) for
કામઠી	कामठी	स्त्री	1 નાનુ કામઠું, સાદું ધનુષ્ય 2 કામઠીવાળો મારાસ, ભીલ	छोटा कमठा, धुनकी भील	small or ordinary bow a Bhil (member of a tribe known by that name)
કામઠું	कामठु	न	ધનુષ	कमठा, धनुष	bow
કામડી	कामडी	वि	1 નબળા બાધાનુ, સુકલકડી 2 કામકરદું	दुब्ला-पतला	lean, thin
		स्त्री	વાસની ચીપ	कर्मठ, मेहनती बॉस का फट्टा	hard-working chip of bamboo
કામડું	कामडु	वि न	જુઓ 'કામડી' વાસની ચીપ	देखिए 'कामडी' बॉस का फट्टा	see 'कामडी' chip of bamboo
કામદું	कामदु	वि	1 કામકરદું, કામ કરે એવું, કર્તવ્યનિષ્ઠ 2 મહેનતું	कर्तव्यनिष्ठ, कर्मठ मेहनती	willing to work, dutiful hard-working
કામણ	कामण	न	1 વશીકરણ, મોહિની લગાડવી તે 2 ઘતરમતર, ટુચકો	वशीकरण, मोहनी	conjuration
				जतर-मतर, जादू-टोना	sorcery
કામણટૂંમણ	कामणटूमण	न	કામણ અને બીજા ટુચકા, ઘતરમતર	जतर-मतर और वशीकरण	sorcery, magic etc
કામદાર	कामदार	पु	1 અમલદાર, અધિકારી 2 કારભારી, દીવાન	अमलदार, अधिकारी कारबारी, दीवान	officer, official administrator, diwan

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3. काम करनार-नोकरियात माणस अथवा मजूर	नौकरीपेशा या मजदूर	worker, servant
अमाटी	कामाटी	वि	अे नामनी छिंदु शातिनु	इस नाम की हिंदु जाति का	belonging to a Hindu caste of that name
		पु.	1 अे शातिनो माणस	इस जाति का पुरुष	member of that caste
			2 आडळूड करनार नोकर, पटावाणो	चपरासी, झाड-पोंछ करनेवाला नौकर	menial, peon
अमाठी	कामाठी	वि	जुओ 'अमाठी'	देखिए 'अमाठी'	see 'अमाठी'
अमु	कामु	पु	1 काम, कार्य 2 व्यापार, क्रिया	काम, कार्य व्यापार, काम, क्रिया	act, action working, process
अमो	कामो	न	बहादुरीनु काम, पराक्रम	वीरता का काम, पराक्रम	deed of bravery or valour
अयदे-आळम	कायदे-आझम	पु	जुओ 'अयदे-आळम'	देखिए 'अयदे-आळम'	see 'अयदे-आळम'
अयदी	कायदो	पु	1 नियम, धारो 2 सरकारी अनून	कायदा, कानून, नियम राजनियम, कानून	rule, act law
अयनात	कायनात	स्त्री	पूण, विसात	पैजी, बिसात	wealth, value
अयशुण	कायफळ	न	अेक औषधि-शुण	कायफल	kind of fruit
अयम	कायम	वि.	1 स्थिर, टके अेवु 2. लमेश माटेनु, स्थायी, अमयलाउथी ओलटु	कायम, स्थिर स्थायी, कायम	steady, enduring permanent (as opposite of 'temporary')
अयर	कायर	वि.	नाळिमत, सरकरा, पायलु	कायर, डरपोक	coward, weak- ling, chicken- hearted
अर	कार	न	1 काम, कार्य 2 अमअण, धधो	कार, काम, कार्य कामकाज, धधा	act, work trade, profession

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કારકુન	कारकुन	पु	गुमास्तो, भडेतो	कारकुन, कारिदा, क्लर्क	clerk
કારકુની	कारकुनी	स्त्री	કારકુનનુ કામ	कारकुन का काम, किरानीगिरी, क्लर्की	clerical work
કારખાનદાર	कारखानदार	पु	કારખાનાનો માલિક	कारखानेदार	owner of a factory
કારખાનું	कारखानु	न	1 જ્યા હુનરઉદ્યોગનુ કામ થતુ હોય તે મકાન 2 કોઇપણ મોટા કામકાજનુ ખાતુ	कारखाना बड़े काम काज का कार्यालय	factory place of extensive business or work
કારગત	कारगत	स्त्री	1 શક્તિ, ઔષત 2 વગ, ચલાણ 3 કામ, અર્થ 4 કામમા આવવાપાણ	ताकत, शक्ति प्रभाव, चलती काम, प्रयोजन काम आने का भाव	power, strength influence work, use usefulness, serviceability
કારજ	कारज	न	1 કામ, કાર્ય 2 વિવાહ કે મૃત્યુ સબધી (ખર્ચનો) પ્રસંગ-વરો	कारज, कार्य विवाह या मृत्यु सबधी प्रसंग-भोज	work, act dinner on an occasion of marriage or of mourning
કારણ	कारण	न	1 કાર્યની ઉત્પત્તિ કે પ્રવૃત્તિનુ મૂળ-બીજ, સબબ 2 હેતુ, ઉદ્દેશ 3 ગરજ, જરૂર 4 ભૂત, પ્રેત, મૂઠ ઇત્યાદિથી જે વ્યથા થાય તે	कारण, सबब, निमित्त हेतु, उद्देश्य जरूरत, मतलब भूतप्रेतादि से होनेवाली व्यथा	cause object, purpose need, necessity witchcraft, sorcery
		अ	કારણ કે	क्योंकि, कारण यह कि	because, for

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अरुणभूत	कारणभूत	वि	अरुण-साधनरूप अनेलु	निमित्तरूप बना हुआ, साधनरूप बना हुआ	instrumental
अरुणरूप	कारणरूप	वि न	अरुणभूत अधा रूपोना मूलबीजरूप श्रेष्ठ रूप	निमित्तरूप बना हुआ सब रूपों के मूलबीज रूप-श्रेष्ठ रूप	instrumental the best or ideal form as the origin or basis of all forms
अरुणसर	कारणसर	अ	-ना अरुणशी, ने लीधे	- के कारण	for the reason of, on account of
अरुतड	कारतक	पु	विश्व सप्ततनो पडेलो भडिनो	कार्तिक मास, कार्तिक	first month of the year accord- ing to the Vikram era
अरुतडी	कारतकी	वि	अरुतडनु, अरुतडने लगतु	कार्तिक का, कार्तिक सबधी	of or about the month अरुतड (Kartak)
अरुतूस	कारतूस	स्त्री	अड्डु इत्यादिमा लरी डोडवानी टोटी जेवी अनावट	कारतूस	cartridge
अरुभार	कारभार	पु	1 अरुभार, व्यवस्थानु अम 2 अरुभार मोटा अमनो व्यवसाय	कार-बार, कारोबार बडे काम का व्यवसाय	management, administration business on a large scale
अरुभारण	कारभारण	स्त्री	1 अरुभार करनारी स्त्री 2 अरुभारणीनी स्त्री	कार-बार चलाने वाली स्त्री कारबारी की पत्नी	woman- manager wife of a manager
अरुभारी	कारभारी	पु	अरुभार करनारो, व्यवस्थापक, प्रधान	कारबार चलाने वाला दीवान, व्यवस्थापक, कारबारी	manager, administrator, minister

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કારભારુ	કારભારુ	ન	કારભારીનુ કામ, પ્રધાનવટુ	કારભારી કા કામ, વજારત	management
કારમું	કારમું	વિ	1 ભયકર 2 કૂટ સ્વરૂપવાળુ, અદ્ભુ ત 3 દૈવી, સુદર	ભયાનક કૂટ પ્રકૃતિવાલા, અદ્ભુત દૈવી, સુદર	dreadful wonderful, mysterious divine, beautiful
કારવહેવાર	કારવહેવાર	પુ	કામકાજ અને રીતભાત, સામાજિક વહીવટ અને વ્યવહાર	કામકાજ ઓર વ્યવહાર, સામાજિક કારભાર ઓર વ્યવહાર	social intercourse
કારવા	કારવા	પુ	1 આબરુ, પ્રતિષ્ઠા 2 જુઓ 'કવા'	આબરુ, પ્રતિષ્ઠા દેખિયે 'કવા'	reputation, prestige see 'કવા'
કારવો	કારવો	પુ	1 એક તરેહનો નાચ-કેરવો 2 કેરબા વખતે ગાવાનો રાગ 3 અવસર, તક	એક નાચ, કહરવા કહરવા પર ગાયા જાનેવાલા દાદરા, કહરવા મૌકા, અવસર	type of dance musical mode or raga sung at the time opportunity, chance
કારસ્તાન	કારસ્તાન	ન	1 પ્રપચ, જુઓઈનુ કામ 2 તોફાન, મસ્તી	કારસ્તાની, ચાલબાજી, સાજિશ તૂફાન, શરારત	conspiracy, trickery prank, mischief
કારસ્તાની	કારસ્તાની	વિ	કારસ્તાન કરનારુ- કરાવનારુ	કારસ્તાની કરનેવાલા	conspiring
કારાવાસ	કારાવાસ	પુ	કારાગારમા રહેવુ તે	કારાવાસ, કૈદ	prison, jail
કારી	કારી	વિ	1 કારમું, દારુણ 2. ઘાતક, મારક	ભયાનક, દારુણ ઘાતક, મારક, કારી (ચોટ)	dreadful mortal
		સ્ત્રી	યુક્તિ, તદબીર	યુક્તિ, તદબીર	trick, device

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કારીગર	कारीगर	पु	1 હાથની કારીગરીમા પ્રવીણ માણસ 2 યંત્રાદિ ચલાવી જાણનાર 3 કોઈપણ કળામા કુશળ, હોશિયાર માણસ, ઉસ્તાદ	कारीगर, दस्तकार यंत्रचालक कला-कुशल, उस्ताद व्यक्ति	craftsman machine operator one who is an expert in some field
કારીગરી	कारीगरी	स्त्री	1 કારીગરનુ કલાત્મક કામ, રચના 2 કળાકૌશલ્ય, ચતુરાઈ, ઉસ્તાદી	दस्तकारी, कारीगरी कला-कौशल, चतुराई, कारीगरी	craftsmanship skilfulness
કારેલી	कारेली	स्त्री	કારેલાનો વેલો	करेले की बेल, करेली	kind of plant
કારેલુ	कारेलु	न	શાક તરીકે વપરાતુ એક કડવુ ફળ	करेला	kind of vegetable
કારોબાર	कारोबार	पु	કારોબાર	कारोबार, कार-बार	management
કારોબારી	कारोबारी	वि	કારોબારનુ —ને લગતુ	कारोबार का, कारोबार से सबद्ध	pertaining to management
		स्त्री	કારોબારી સમિતિ	कार्यवाहक समिति	executive committee
કારોબારીમંડળી	कारोबारीमंडळी	स्त्री	કાર્યવાહક સભા	कार्यकारिणी सभा	executive council
કાર્ય	कार्य	न	1 કરવાનુ હોય તે, કામકાજ 2 હેતુ, પ્રયોજન 3 કુડળીમાનુ દશમુ સ્થાન 4 કારજ	कार्य, काम हेतु, प्रयोजन, कार्य फलित ज्योतिष में लग्न से दसवाँ स्थान धार्मिक कृत्य	work object, purpose tenth house in a horoscope religious rite or ceremony
કાર્યકર	कार्यकर	वि	1 કામકાજ કરનારુ—કરે એવુ 2 અસરકારક	काम करने वाला, कार्यकर प्रभावकारी, कार्यकर	capable of work, worker effective

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अर्थकर्ता	कार्यकर्ता	पु	કામ કરનારો, સચાલક	कार्यकर्ता, सचालक, काम करने वाला	worker, manager
अर्थकर्ता	कार्यकर्ता	पु	જુઓ 'અર્થકર્તા'	देखिए 'अर्थकर्ता'	see 'अर्थकर्ता'
अर्थकारी	कार्यकारी	वि	જુઓ 'અર્થકર'	देखिए 'अर्थकर'	see 'अर्थकर'
अर्थपद्धति	कार्यपद्धति	स्त्री	કાર્ય-કામ કરવાની પદ્ધતિ	कार्यपद्धति	method of work
अर्थप्रदेश	कार्यप्रदेश	पु	કાર્યક્ષેત્ર	कार्यक्षेत्र	field of work
अर्थवाहक	कार्यवाहक	वि	કારોબાર કરનાર	कार-बार चलाने वाला, कार्यवाहक	executive
		पु	કારભારી	कारबारी, कारभारी	manager
अर्थवाहकसभा	कार्यवाहकसभा	स्त्री	કાર્યવાહકોનું મડળ	कार्यकारिणी सभा, कार्यवाहक मंडल	executive body
अर्थवाही	कार्यवाही	स्त्री	1 કાર્ય ચલાવવાની રીત, 'પ્રોસીજર' 2 કાર્યક્રમ	कार्य चलाने की पद्धति, 'प्रोसिजर' कार्यक्रम, कार्यवाही	procedure minutes of business
अर्थशक्ति	कार्यशक्ति	स्त्री	કાર્ય કરવાની શક્તિ	कार्यशक्ति	ability to do things
अर्थसरणि	कार्यसरणि	स्त्री	કાર્ય કરવાની સરણી-પદ્ધતિ	कार्य करने की पद्धति	method of work
अर्थसरणी	कार्यसरणी	स्त्री	જુઓ 'અર્થસરણી'	देखिए 'अर्थसरणी'	see 'अर्थसरणी'
अर्थसाधक	कार्यसाधक	वि	કાર્ય સાધે-પાર પાડે એવું	कार्य सिद्ध करने वाला, कार्यसाधक	efficacious, capable of accomplishing something
अर्थसाधक सभ्या	कार्यसाधक सख्या	स्त्री	મડળનું કાર્ય કરવાને જરૂરી સભ્યોની આનામાં નાની સખ્યા, 'ગોરમ'	किसी सभा का काम करने के लिए (सदस्यों की) लघुतम सख्या, गणपूर्ति, 'कोरम'	quorum

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
अर्थसूचि	कार्यसूचि	स्त्री	જુઓ 'अर्थसूची'	देखिए 'अर्थसूची'	see 'अर्थसूची'
अर्थसूची	कार्यसूची	स्त्री	કામની યાદી	काम की फेहरिस्त, कार्यसूची	agenda
अर्थालय	कार्यालय	न	કામ કરવાની જગા	कार्यालय, दफतर, कार्यस्थान	office
अले	काल	स्त्री	ચાલતા દિવસથી આગળ કે પાછળનો દિવસ	कल, अगला या पिछला दिन	day preceding or succeeding today
		अ	1 ગઈ કાલે અથવા આવતી કાલે 2 હમણા, થોડા દિવસ ઉપર કે પછી (લા.)	अगले या पिछले दिन, कल (ला) अभी	yesterday or tomorrow recent, a few days before or after
अल	काल	पु	1 સમય, વખત 2 સમયનુ માપ, વેળા 3 મોત, નાશ 4 મોસમ, ઋતુ	काल, समय, वक्त समय का कोई विभाग, काल, बेला मृत्यु, काल, अत	time period or measure of time death, destruction
अलमाप	कालपण	न	કાલામાપ, કાલા થવુ તે	मौसम, काल	season
अलमापक	कालमापक	वि	સમયને માપે એવુ કાળમાપક યત્ર	बच्चों का - सा बर्ताव, बालकपन	lisping pronunciation
अलरात्रि	कालरात्रि	स्त्री	1 ઘોર અધારી રાત 2 કાળરૂપી રાત્રી, જગતના નાશની રાત્રી, બ્રહ્માની રાત 3 કાળીના જન્મની રાત્રી	काल को नापे ऐसा कालमापक यत्र	instrument for measuring time
अलरात्री	कालरात्री	स्त्री	જુઓ 'કાલરાત્રિ'	अधेरी रात, कालरात्रि प्रलय की, मौत की, ब्रह्मा की रात, कालरात्रि काली के जन्म की रात	pitch-dark night night of the end of the world, night of the birth of the Goddess Kali
				देखिए 'अलरात्रि'	see 'अलरात्रि'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. क्रो.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अलसपुं	कालववु	स क्रि	प्रवाली साधे भेणवी धूटपु	तरल पदार्थ मिलाकर घोंटना, पीसना	to mix with liquid
अलापण	कालापण	न	જુઓ 'अलापण'	देखिए 'अलापण'	see 'अलापण'
अलावाला	कालावाला	पु	કરગરવુ તે, આજીજી	गिडगिडाहट, आजिजी	entreaties
अला	काला	न	अलापण	बालकपन, लाड	lispng pronunciation
अलातरे	कालातरे	अ	1 ઘણા લાખા સમયના— યુગોના અતર પછી 2 કેટલોક કાળ વીત્યા પછી 3 કદી પણ (લા)	युगों के बाद कुछ समय के बाद, कालातर में कभी भी (ला)	after a long time after the lapse of a period of time at any time
अलु	कालु	वि न	1 બાળકની વાણી જેવું, ભાગ્યતૂટયું અને મધુરું 2 તોતડું 3 બાલિશ, અણસમજું કપાસનું જીંડવું	बालक की बोली जैसी, टूटीफूटी और मधुर तोतला बचगाना, नासमझ कपास का डोडा, दोंद देंदी	lispng, like a child's prattle stammering childish cotton-pod
अले	काले	अ	1 ગઈ કાલે અથવા આવતી કાલે 2 હમણા, થોડા દિવસ ઉપર કે પછી	कल, अगले या पिछले दिन अभी, थोड़े दिन पर, बाद में	yesterday or tomorrow shortly, before or after a few days
अलड	कावड	स्त्री	ખાધે બોજો ઉપાડવાને બનાવેલી તુલા	कॉवर, बहेंगी	bamboo lath borne on the shoulder with slings at both ends to carry pitchers

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કાવડી	कावडी	સ્ત્રી	જુઓ 'કાવડ'	देखिए 'कावड'	see 'कावड'
કાવડિયુ	कावडियु	ન	પૈસો	एक पैसा	a pice or paisa
કાવડિયો	कावडियो	પુ	કાવડ ઊંચકનારો	कॉवरिया	bearer of कावड
કાવતરાખોર	कावतराखोर	વિ	કાવતરુ કરનારુ	चालबाज, छली	crafty, intriguing
કાવતરાખાજ	कावतराबाज	વિ	જુઓ 'કાવતરાખોર'	देखिए 'कावतराखोर'	see 'कावतराखोर'
કાવતરુ	कावतरु	ન	1 ઇજા, પ્રપચ, કારસ્તાન 2 ગુપ્ત અને કપટપૂર્ણ યોજના	कारस्तानी, छल-प्रपच साजिश, कारस्तानी, षड्यंत्र	conspiracy secret plot
કાવાદાવા	कावादावा	પુ	ઇજાપ્રપચ, કપટખાજ	दॉव-पेच, छल-कपट	intrigues
કાવો	कावो	પુ	1 બુદ્ધાણાનો ઉકાળો 2 ઉકાળો, કાઢો	कहवा काढा, क्वाथ	coffee decoction, brew
કાવ્ય	काव्य	ન	1 કવિતામાં જે કલાત્મક રસનુ તત્વ હોય છે તે 2. રસાત્મક વાક્ય કે પદબદ્ધ 3 પદ્ય, કવિતા	काव्य, कविता रसात्मक वाक्य या छदोबद्ध रचना पद्य, कविता	poetic element poetical composition poem, poetry
કાવ્યકાર	काव्यकार	પુ	કવિતા કરનાર, કવિ	काव्यकार, कवि	poet
કાશ	काश	પુ સ્ત્રી	ખાસી, ઉધરસ આડખીલી	खॉसी, काश बाधा, रुकावट	cough hindrance
કાષ્ઠ	काष्ठ	ન	1 લાકડુ 2 કાઠી, બળતણ	काष्ठ, लकडी, काठ ईधन, काष्ठ	wood firewood
કાસ	कास	પુ; સ્ત્રી	જુઓ 'કાશ'	देखिए 'काश'	see 'काश'
કાસદ	कासद	પુ	સંદેશો—કાગળ લાવનાર તેજ જનાર આદમી, ખેપિયો	कासिद, पत्रवाहक, सदेश ले जानेवाला	messenger

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
असहुं	कासदु	न	असदनु अम	कासिद का काम	work of a messenger
असवास	कासवास	पु	श्वास, धम	श्वास, दमा	asthma
असण	कासळ	न	आडणीली, नडतर, पीडा	अडचन, बाधा, कोंटा	obstacle, impediment
असूद्रा	कासूद्रा	स्त्री	अेक वनस्पति	एक वनस्पति	kind of plant
असूद्रो	कासूद्रो	पु	जुओ 'असूद्रा'	देखिए 'असूद्रा'	see 'असूद्रा'
अडिली	काहिली	वि	1 आणसु, अयर 2 आणरी, माहु	काहिल, सुस्त, आलसी बीमार	lazy, shirking diseased, ill
		स्त्री	1 आणसुपण, अयरता 2 माहगी	काहिली, आलस्य बीमारी	laziness illness
अधु	काह्यु	वि	1 थिडायेलु 2 थडेलु, अयर 3 आणरी, माहु	चिढा हुआ थका हुआ, कायर बीमार	annoyed tired ill
अण	काळ	पु	1 समय, वधत 2 समयनु माप, वेण 3 मोत, नाश 4 मोसम, ऋतु 5 दुःख 6 क्रोध	काल, समय समय का कोई विभाग, बेला मृत्यु, अत मौसम, ऋतु, काल अकाल क्रोध	time measure of time death, destruction season drought anger, wrath
अणयु	काळचक्र	न	अलयु	कालचक्र, भाग्यपरिवर्तन	wheel of time
अणयोधडियु	काळचोघडियु	न	नुडसानअरुड-घातड योधडियु	घातक समय या मौत की घडी	inauspicious or unlucky hour
अणल	काळजी	स्त्री	दुःखपूर्वक सभाण, शीवट, थिता	हृदयपूर्वक देखभाल	care

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કાળજીભુ	કાઠ્ઠજીમુ	વિ	કાળ જેવી નુકસાનકારક — ઘાતક જીભવાળુ — બોલનાર	કલજિભા, વિનાશક ઢગ સે બોલને વાલા	one having a venomous or destructive tongue
કાળજુ	કાઠ્ઠજુ	ન	1 પિત્ત ઉત્પન્ન કરનારો અને શિરાઓમાનુ લોહી સાફ કરનારો એક મોટો માસલ અવયવ 2 અતર, અદરનો જીવ, મન, દિલ	કલેજા દિલ, જિગર, મન, કલેજા	the liver heart, inner life, mind, inmost feeling
કાળઝાળ	કાઠ્ઠઝાઠ્ઠ	વિ	કાળની ઝાળ જેવું	કાલકી જ્વાલા જેસા	destructive
કાલનિદ્રા	કાઠ્ઠનિદ્રા	સ્ત્રી	1 કાલનિદ્રા 2 ગાઢ નિદ્રા	કાલનિદ્રા, મૃત્યુ કી નીંદ પ્રગાઢ નિદ્રા	everlasting sleep deep sleep
કાળપ	કાઠ્ઠપ	સ્ત્રી	1 કાળાપણુ 2 કલક	કાલાપન કલક	blackness blot
કાળપુરુષ	કાઠ્ઠપુરુષ	પુ	યમરાજ	યમરાજ	Lord of Death, Yama
કાળમીઠ	કાઠ્ઠમીઠ	વિ	1 ઘણું જ કાળુ 2 નિષ્ઠુર 3 એક જાતનો ઘણો જ કાળો અને કઠણ પથ્થર	બહુત કાલા, કાલા-કલૂટા નિષ્ઠુર એક તરહ કા અતિ કાલા ઓર સહત પથ્થર	excessively black heartless kind of very hard black stone
કાળમુખુ	કાઠ્ઠમુખુ	વિ	કાળના જેવા મોંવાળુ	કાલ કે-સે મુંહ વાલા	having a death- like appearance
કાલરાત્રિ	કાઠ્ઠરાત્રિ	સ્ત્રી	જુઓ 'કાલરાત્રિ'	દેખિય 'કાલરાત્રિ'	see 'કાલરાત્રિ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अणवेण	काळवेळा	स्त्री	1 भयंकर वधत 2 संध्याकाळ	भयानक बेला साँझ का समय	hour of death evening
अणभु	काळगडु	न	अलिगडु, भूराओणु	कलिंग, पेठा, भूरा कुम्हडा	kind of vegetable
अण्णट	काळाट	पु	अण्णपणु	कालापन, कालिमा	blackness
अण्ण भण्णरियो	काळा बजारियो	पु	अणु भण्णर चलानार माणस के वेपारी	काला बाजारिया, काला बाजार चलाने वाला	black-marketeer
अण्णश	काळाश	स्त्री	1 अण्णट 2 सलेण अण्णपणु	कालापन, कालिमा थोडा कालापन	blackness blackishness
अण्णतरे	काळातरे	अ	1 धण्ण लान्ण समयना—युगोना अतर पछी 2 केटलोड अण वीत्या पछी 3 (ला) कडै पण	युगों के बाद कुछ समय के बाद, कालातर में कभी भी (ला)	after ages after some time anytime
अण्णधोण	काळाधोळा	न	अरस्तान, अण्णाल (अ व मा वपणय छे)	कारस्तानी, काली करतूतें, बदचलनी	intrigues
अण्णियार	काळियार	पु	अण्णना टोणानो मुण्णी— अणो नर	काला हिरन, कालसार	black buck, antelope
अण्णियो सरस	काळियो सरस	पु	अण्ण वनस्पति—औषधि	शिरिष, सिरिस	kind of medicinal plant
अण्णु	काळिणु	न	1 अलिगडु, तडभूय 2 भूराओणु	कलिंग, तरबूज भूरा कुम्हडा, पेठा	kind of fruit kind of vegetable
अण्णी	काळी	स्त्री	1 अण्ण रगनी स्त्री 2 अण्णी धापवाणी गण्णना पतानी अण्ण णत	काले रग की स्त्री, काली काली बूटी वाले ताश के पत्तों का एक प्रकार, काला पान	woman with dark or black skin spades(in playing cards)

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કાળીચૌદશ	काळी चौदश	સ્ત્રી	૩ કાલિદાસ આસો ૧૬ ૧૪	કાલો, કાલિકા આશ્વિન કૃષ્ણા ચતુર્દશી, નરક ચતુર્દશી	Goddess Kali fourteenth day of the dark half of the month Ashwin
કાળી ચૌદસ	काळी चौदस	સ્ત્રી	જુઓ 'કાળી ચૌદશ'	देखिए 'काली चौदश'	see 'કાળી ચૌદશ'
કાળીજીરી	काळीजीरी	સ્ત્રી	એક ઔષધિ-બીજ	काली जीरी	kind of seeds used for medicinal purposes
કાળીટીલી	काळीटीली	સ્ત્રી	કલક, લાઇન	कलक, लाइन	blot, stigma
કાળીનાગ	काळीनाग	પુ	૧ કાળો નાગ-સાપ ૨ શ્રીકૃષ્ણે નાથેલો કાલિયાનાગ	काला नाग, साँप कालिया	black serpent or cobra thousand- headed cobra tamed by Lord Krishna
કાળીપરજ	काळीपरज	સ્ત્રી	દુબલા વગેરે કાળા રંગની જાતિ	'दुबला', 'चौधरा' आदि आदिवासी लोग	dark skinned aboriginal tribes like the <i>Dublas</i> of South Gujarat
કાળીરોટી	काळीरोटी	સ્ત્રી	માલપૂઆ	मालपूआ	kind of pancake
કાળીરોઢી	काळीरोळी	સ્ત્રી	રોળીકોળી-સાજનો વખત	साँझ का समय, संध्या का झुटपुटा	evening twilight
કાળુ	काळु	વિ	૧ મેશના રંગનું ૨ નઠારું, દુષ્ટ, અઘોર, અનીતિમય ૩ વસમું, સખત, કસમું ઇ ભાવવાળું	काला कलुषित भारी, भयकर	black evil dire, extreme

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अणुधोणु	काळुधोळु	न	परापशम	खराब या बुरा काम	bad or wicked act
अणुपार्ली	काळुपाणी	न	देशानिधाल, ज-मटीप	कालापानी, आजीवन कंद की सजा	transportation for life
अणुबजार	काळुबजार	न	छानुमानु थालतु गेरशायदे नक्षपोरीनु बजार-वेथारा ने परीए	कालाबाजार, चोरबाजार	black-market
अणुभम्मर	काळुभम्मर	वि	भमरा जेवु भूल अणु	काला-कलूटा, कालाभुजग	black as the bee
अणुमेश	काळुमेश	वि	मेश जेवु अणु	मसी जैसा काला, कालाभुजग	black as soot
अणो अमरागारो	काळो कामणगारोपु		श्रीकृष्ण	श्रीकृष्ण	Lord Krishna
अणो अयधो	काळो कायदो पु		भूल अशरो जुल्मी अयधो	खूब अप्रिय और जुल्मी कायदा, काला कायदा	black act
अणोतरी	काळोतरी	स्त्री	भरणना समाचारनी चिथी	मृत्यु के समाचार की चिट्ठी	letter bearing inauspicious news (esp news of death)
अणोतरु	काळोतरु	वि	अणु	काला	black
अणोतरो	काळोतरो	पु	अणो नाग, शशीधर	काला नाग, नाग	black cobra or hooded serpent
अणोत्री	काळोत्री	स्त्री	जुथो 'अणोतरी'	देखिए अणोतरु	see 'अणोतरी'
अ	का	अ	1 जुथो 'डेम' 2 छिवा, अ तो	देखिए 'डेम' किया, या नो	see 'डेम' or, otherwise
अअथ	काकच	पु	अअथी, अेठ वनस्पति	एक वनस्पति	kind of plant
अअथ्यु	काकचियु	न	अअथनु रण, असेडु	उस वनस्पति का फल	fruit of the plant असेडु

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કાકણ	काकण	न	બગડી	कगन, चूड़ी, ककण	bangle
કાકણદોરો	काकणदोरो	पु	કાકણદોરો	मैनफल और डोरा, कगना	cotton thread made into a wristlet
કાકરી	काकरी	न, स्त्री	1 ઝીણો કાકરો 2 રેતી, પથરી 3 એ નામનો રોગ 4 કાકરી દાવની ઢૂટી	ककडी, ककरी रेती, पथरी पथरी रोग ककडी के खेल की गोटी	small bit of stone gravel disease of that name a pebble used as counter in a particular game
કાકરો	काकरो	पु	1 ઝીણો પથ્થર 2 કોઈ કઠણ પદાર્થનો નાનો ગાગડો 3 કટક, ક્ષસ, નડતર 4 શકા, વહેમ, ખટકો, મનની લાગણી 5 (આખમા થતો) ખીલ	ककड, छोटा पत्थर डला कॉटा, फॉस, अडचन शका, वहम, खटका, मन का कॉटा पलक के नीचे होनेवाली फुसी	piece of stone small piece of any hard substance obstacle misgiving, doubt granulation (in the eye)
કાકળ	काकळ	स्त्री	એક કાટાવાળી વનસ્પતિ	एक कौटेदार वनस्पति	kind of vegetation
કા કે	का के	अ	કેમ જે, કારણ કે	क्योंकि	for, because
કાગ	काग	पु, स्त्री	એક જાતનું ધાન્ય	कॉगनी, कॉगनी	kind of corn
કાગડ	कागड	पु	વાણકરનું એક ઓજાર	बुनकर का एक औजार	tool of a weaver
કાગડુ	कागडु	न	અનાજમાનો ગાગડુ દાણો, ડોળ	अनाज का न गलने वाला दाना, ठुंडी, ठुरी	hard grain of corn

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अगरादार	कागरादार	वि	अगरावाणु	कगूरेदार	with indentations
अगरी	कागरी	स्त्री	1 दाता જેવી छार-भात 2 કોર, ધાર	ददानेदार पक्ति दीवार की कँगनी, कारनिस	indentations in an ornamental border edge
अगरी	कागरी	पु	1 दातो 2 શિખર 3 કોટની કોરણ ઉપરનું એક આકાર 4 મોટા દાતાની અગરી 5 ભરત ભરવાની એક તરેહ	दाँता, ददाना शिखर कगूरा बड़े दातों वाली कारनिस गुलकारी का एक प्रकार	indentation top, pinnacle battlement border with large tooth-like projections kind of embroidery
अगलु	कागलु	वि	જુઓ 'અગુ'	देखिए 'अगु'	see 'अगु'
अगसी	कागसी	स्त्री	એક વનસ્પતિ	एक वनस्पति	kind of plant
अगारु	कागारु	न	એક ચોપગુ પ્રાણી	कगारु, कागरु	kangaroo
अगावेडा	कागावेडा	पु	અગાપણુ	अदा, हावभाव	plaintive gestures
अगु	कागु	वि	1 निर्मात्थ, शक 2 અચર, રોતડુ	रक, कायर रोनी सूरतवाला	poor, cowardly abject, wretched
अथन	काचन	न	1 सोनु 2 धન, દોલત	सोना धन-दौलत	gold wealth
अथणी	काचळी	स्त्री	1 અપડુ, કમખો 2 સાપે ઉતારી દીધેલી ચામડી-ખોળ	कचुली, चोली केचुली (साँप की)	bodice slough of a snake
अथोणु	काचोळा	न	આતરડા	आँते	intestines

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કાઠલો	काठलो	પુ	1 ગળાને બેસતો આવતો અગરખાનો શપ 2 પોપટને કંઠે શળુ વર્તળ હોય છે તે 3 વાણાનો તાર તાણામા નાખવાનુ વણકરનુ એક ઓળાર 4 ઘડા, ગાગર વગેરેના પેટાની ઉપરનો-કઠના ભાગનો ગોળ ભાગ, કઠો 5 ઘાટ, કિનારો	कठा, अगरखे की गले की काट तोते का कठा भरनी (शटल) घडे आदि का गला	cut of a coat round the neck black band round the neck of a parrot weaver's shuttle neck of a pot
કાઠો	काठी	પુ	1 કિનારો, તટ, ઘાટ 2 અત, છેડો 3 ઘડો, ગાગર, કૂવો ઇ ની છેડ ઉપરનો વર્તુલાકાર ભાગ	किनारा अत घडे आदि का ऊपर का वर्तुलाकार भाग	'ghat', bank bank, coast end, limit neck of a vessel, margin of a well
કાડિયુ	काडियु	ન	1 સ્ત્રીઓનુ કાંઠે પહેરવાનુ ઘરોણુ 2 ખમીસ ઇનો કાડા આગળનો ભાગ	पहुँची, मुतेहरा (कमीज आदि का) कफ	wristlet cuff
કાડી	काडी	સ્ત્રી	1 દીવાસળી કે તેની પેટી 2 જુઓ 'કાડુ'	दियासिलाई या इसकी पेट्टी देखिए 'काडु'	match-stick or match-box see 'काडु'
કાડુ	काडु	ન	જ્યા હાથનો પજો જોડાયેલો છે તે ભાગ	कलाई, गट्टा	wrist
કાતણ	कातण	ન	કાતવુ તે, કાતવાની ક્રિયા	कताई, कातना	spinning
કાતવુ	कातवु	સક્રિ	1 વળ દઈને તાર કાઢવો 2 પાતળુ કરવુ, ઘટાડવુ	कातना पतला बनाना, घटाना	to spin to make thin

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अ तो	का तो	अ	अशवा, अगर् तो	अथवा, या तो	or
अधे	कादो	पु	1 दुगणी 2 अए, अरओए वनस्पतिना भूणी गाठ-जड	प्याज कद, गाँठदार जड	onion root
अध	काध	स्त्री	3 लाभ, शयधे 1 ખભો 2 ખાધ, ધૂસરીનુ આટણ	लाभ, फायदा कधा, स्कध जूए की रगड से गरदन पर होनेवाला घट्ठा	gain, advantage shoulder neck (of a beast of burden), sore neck (on account of friction with yoke)
अधापत	काधाखत	न	હતા પ્રમાણે દેવુ ભરી દેવાનુ લખત	किस्तों के अनुसार कर्ज अदा करने का कबाला / दस्तावेज	agreement or document promising to pay off debt in instalments
अधियो	काधियो	पु	1 ખભા ઉપર ભાર ઉપાડનાર મજૂર 2 સાગરીત 3 બળદ 4 મુડદુ ઊંચકનાર આદમી 5 અધા કરી નાણા ધીરનાર આદમી	कधे पर बोझ ढोने वाला मजदूर पुठवाल, साथी बैल कधा देने वाला किस्त पर ब्याज-बट्टे का रोजगार करने वाला	coolie co-worker bullock one who carries a bier money-lender lending money to an agreement to its repayment in instalments
अधु	काधु	न	હતા પ્રમાણે ભરી દેવાની રકમ, હપતો	किस्त	instalment
अधेली	काधेली	स्त्री	ધૂસરી	जूआ (लकड़ी)	yoke

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કાજી	काजी	स्त्री	1 राज 2 लाछी 3 ખેળ	काजी, लपसी लेई मॉडी, मॉड	gruel paste starch
કા જે	का जे	अ	કેમ જે, કારણ કે	क्योंकि	because, for
કાટાઅશોભિયો	काटाअशोभियो	पु	એક વનસ્પતિ-ઔષધિ	कटसरैया - औषध	kind of medicinal plant
કાટાઅસાભિયો	काटाअसाभियो	पु	જુઓ 'કાટાઅશોભિયો'	देखिए 'अटाअशोभियो'	see 'अटाअशोभियो'
કાટાકોળુ	काटाकोळु	न	એક જાતનું કોળુ (બલિ તરીકે યજ્ઞમાં વધેરાય છે)	एक प्रकार का कुम्हडा (बलि के रूप में यज्ञ में चढाया जाता है)	kind of vegetable
કાટાદાર	काटादार	वि	જુસ્સાવાળુ, પારીદાર	पानीदार, जोशीला	spirited
કાટાસરિયો	काटासरियो	पु	1 એક વનસ્પતિ 2 શેળો	कटसरैया कौटाचूहा	kind of plant kind of animal
કાટાસભિયો	काटासभियो	पु	જુઓ 'કાટાસરિયો'	देखिए 'अटासरियो'	see 'अटासरियो'
કાટાઝુ	काटाळु	वि	કાટાવાળુ	कँटीला, कौटेदार	thorny
કાટિયુ	काटियु	न	1 મડદા ઉપર નાખવાનું કપડું 2 સડાસ	कफन	shroud
કાટિયો	काटियो	पु	1 સડાસ, જાજરું 2 અટસ-વેર રાખનારો મારાસ	सडास, पाखाना सडास, पाखाना कीनाकश, द्वेषी	latrine latrine revengeful man
કાટી	काटी	स्त्री	1 એક જાતની માછલી 2 નાનો પાતળો કાટો	एक प्रकार की मछली छोटा कौटा, कौटी	kind of fish small thorn
કાટુ	काटु	न	બટનનું કારણ, નાકું	बटन का काज	loop or eye for a button

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઢાટો	काटो	पु	1 કેટલીક વનસ્પતિ પર ઊગતો ઢાણ અણીદાર સીધો કે વાકો અકુર, શૂળ 2 એના જેવા આકારની ડોઈપણ વસ્તુ 3 યુરોપી ઢબે જમતા વપરાતુ ઘાતાવાળુ, ધમચા ઘાટનુ સાધન 4 તોલ કરવાનુ યત્ર, કપાણ 5 નાકે પહેરવાનુ સ્ત્રીઓનુ એક ઘરેણુ 6 પોપટના ગળામા થતો એક રોગ 7 શેમાચ 8 નસ્તર, ફાસ 9 અટસ, ડીનો 10 વહેમ, શકા 11 જુસ્સો, પાણી 12 ટેક, મમત	काटा काटे के आकार की वस्तु खाने का काटा काटेदार तराजू लौंग, नाक की कील तोते के एक कठ-रोग का नाम रोमाच फॉस वैर वहम, शका जोश टेक, दुराग्रह	thorn thing of that shape (see 1) fork scales an ornament worn on the nose by women disease affecting a parrot in the neck horripilation obstruction, snag grudge misgiving, suspicion enthusiasm, mettle oath, pertinacity
ઢાઠલી	काठली	स्त्री	1 સ્ત્રીઓના કઠનુ એક ઘરેણુ, હાસડી 2 વાણાનો તાર તાણામા નાખવાનુ વણકરનુ એક ઓળાર, નાનો ઢાઠલો	हंसली (स्त्रियोंकी) करघे की ढरकी, भरनी, 'शटल'	kind of neck-ornament of gold weaver's shuttle

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अधेवाणियो	काधेवळियो	पु	नाडेदार, धागथोडी उपरनो अमलदार	नाकेदार	toll-officer, toll-gatherer
अधेवाणियो	काधेवाळियो	पु	1 मोटो छोडरो, धरनो भार वहेनार दीडरो	बडा बेटा, घर का बोझ ढोन वाला लडका	grown up or eldest son, son sharing father's burden or responsibility
			2 साथी	साथी	colleague
अधो	काधो	पु	जुओ 'अधु'	देखिए 'अधु'	see 'अधु'
अप	काप	पु	1 अणो-चीअरो ठरेलो अधव	काला, चिकना, जमा हुआ कीचड, करेल	silt, alluvium
			2 डम्भ	'कंप'	camp
			3 अप, अपारे	कप, सिहरन	tremor
अपवु	कापवु	अक्रि	1 अपवु, धूणवु	कंपना, कौपना	to shake, to shiver
			2. भयथी धूणवु	थरथराना	to tremble due to fear
अब	काब	स्त्री	1 वासनी चीप 2 वासनो गज, आअरी	बाँस की फट्टी बाँस का गज- ऑकने का साधन	chip of bamboo instrument used in measuring length, ruler
अबणी	काबळी	स्त्री	अमणी	कबल	light blanket
अबणो	काबळो	पु	धाबणो, अमणो	बडा कबल, धुत्सा	blanket, rug
अपी	काबी	स्त्री	1 स्त्रीओना पगनु धरेणु	स्त्रियों के पाँव का एक जेवर	kind of anklet
			2 ओसना भेनो अठलो	मोट के मुँह का कठा	neck of a leather-bucket
			3 थामडानी डोल	चमडे की डोल	leather-bucket
			4 सारणगाठ धवापवानो अदीरो	अत्रवृद्धि को काबू में रखने वाला कदोरा	hernia strap

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કાશિયા	કાશિયા	ન	મજરા	મજીરે	cymbals
કાસ	કાસ	પુ	1 પાણી લઈ જવાને બનાવેલી નાની નહેર 2 પાણી વહી જવાને માટે કરેલી નીક, ગટર	છોટી નહર નાલી, ગટર	small irrigation canal gutter
કાસકી	કાસકી	સ્ત્રી	1 વાળ ઓળવાનું એક સાધન 2 એક વનસ્પતિ	કઘી एक वनस्पति	small comb kind of a plant
કાસકો	કાસકો	પુ	વાળ ઓળવાની મોટી કાસકી	કઘા	comb
કાસલુ	કાસલુ	ન	કાસાનું એક ખૂબ પહોળા મોનું વાસણ, તાસળું	કોંસે કા તસલા	broad-mouthed vessel of bell- metal
કાસવું	કાસવું	અક્રિ	1 ખાસવું 2 ખોખારવું 3 હાકવું, ફેફે કરવું	खॉसना खखारना हॉफना	to cough to utter a gurgling sound to pant, be out of breath
		સક્રિ	ઠાસવું, યગદીને ભરવું	ठूसना, दबा - दबाकर भरना	to gorge food, to stuff
કાસા	કાસા	ન	કાસીજોડ	કાસ્યતાલ, ઝાંઝા	cymbals
કાસીજોડું	કાસીજોડું	ન	કાસાની બનાવેલી મોટી ઝાઝ, કાસાનું છબછબિયું	बडा कास्यताल, भॉभ	pair of cymbals
કાસું	કાસું	ન	તાંબુ, જસત અને કલાઈથી બનતી એક મિશ્રધાતુ	कॉसा	alloy of zinc, tin and copper
કિકિયારી	કિકિયારી	સ્ત્રી	તીણી, કારમી ચીસ	किकियाना, कॅपा देने वाली चीख	shriek, snrill cry
કચૂકો	કિચૂકો	પુ	કચૂકો, આમલીનો ઠબિયો	चिआँ	tamarind seed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
डितो	कितो	पु	1 गडा शपनी श्लम- लेभाए 2 साशे लभेलो भरडो-नमूनो 3 भेतरेनो डडो-विभाज	(सरकडे की) कलम, लेखनी अच्छे अक्षरों में लिखा हुआ मसौदा कित्ता, खेत का टुकड़ा ऐजन्	reed-pen (well-written) copy division of land the same as above, ditto
डिनभाष	किनखाव	पु	1 जरीबुटाना वराटनु अडे जातनु शपड 2 डसभ	कीनखाव, कमखवाव कलावत्तु	cloth interwoven with gold and silver threads, brocade embroidery
डिनार	किनार	स्त्री	1 धारनो भाज, शेर 2 वस्त्र पर मूठवानी शेर 3 डिनारो	किनारा, कोर गोट, किनारी तट, किनारा	edge, fringe border bank, shore
डिनाभोर	किन्नाखोर	वि	श्रीनो राभे अेषु, दशीलु, डीनाभोर	कीनाकश, कीनावर	malicious, spiteful
डिनो	किन्नो	पु.	वेर, अटस, डीनो	कीना, कट्टर वैर	malice, spite
डिशायत	किफायत	स्त्री वि.	पथत शायत पस्तु, सस्तु	किफायत, वचत किफायती, सस्ता	gain, savings profitable, cheap
डियु	कियु	वि,अ	डियु ? (थ.)	कौन सा ?	which
डिशोल	किरकोल	वि अ	पर्यूरु छूटड, थोडे थोडे डरीने	फुटकल खुदरा, थोडा थोडा करके	miscellaneous in small quantities
डिश्रेण	किरकोळ	वि	गुओ 'डिश्रेण'	देखिए 'डिश्रेण'	see 'डिश्रेण'
डिशिन	किरण	न,पु	तेजनी रेभा, रश्मि	किरण, रश्मि	ray, beam
डिशपा	किपा	स्त्री	1 महेरवानी	कृपा, मेहरवानी	obligation

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 દયા	દયા	kindness
કિરપાણ	કિરપાણ	સ્ત્રી	(શીખો ધર્મચિહ્ન તરીકે રાખે છે તે) એક હથિયાર	કિરપાન, કૃપાણ	small dagger borne on his person by a Sikh
કિરમજ	કિરમજ	પુ	1 એક જાતનો કીડો 2 એમાથી નીકળતો કિરમજ-રાતો રંગ અને દવા	કિરમદાના કિરમિજ	kind of insect, cochineal red, crimson colour extracted from it
કિરમાણી અજમો	કિરમાણી અજમો	પુ	કરમાણી અજમો, એક વસાણુ	ઔષધેં ડાલકર બનાયા હુઆ એક પાક	kind of tonic
કિરવાણી	કિરવાણી	પુ	પીલુ રાગ	પીલૂ રાગ	(of music) raag Pilu
કિરાયુ	કિરાયુ	ન	ભાડુ	કિરાયા, ભાડા	rent
કિરાયાદાર	કિરાયાદાર	વિ પુ	ભાડે રહેનારુ-રાખનારુ, ભાડૂત	કિરાયેદાર કિરાયેદાર	tenant tenant
કિલકાર	કિલકાર	પુ	1 આનંદભર્યો કલકલાટ 2 આનંદની કિકિયારી	કિલકાર આનંદ કા કિકિયાના, હર્ષધ્વનિ	joyous sounds cries of joy
કિલકારી	કિલકારી	સ્ત્રી	1 આનંદની કિકિયારી 2 તીણી ચીસ કે પોકાર	કિલકારી તીક્ષ્ણ ચીઝ યા પુકાર	cries of joy shrill cry, cry for help
કિલકિલાટ	કિલકિલાટ	પુ	1 પક્ષીઓનુ કિલકિલ એમ કરવુ તે 2 હર્ષધ્વનિ	કુલકુલાના, કિલકિલા, કલરવ હર્ષધ્વનિ	(of birds) warbling sound of joy
કિલકિલાર	કિલકિલાર	પુ	જુઓ 'કિલકિલાટ'	દેખિય 'કિલકિલાટ'	see કિલકિલાટ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કિલ્લી	किल्ली	स्त्री	1 झूठी, झील 2 तिजोरी, नाणानी पेटी	कुजी, ताली तिजोरी	key safe
કિલ્લીદાર	किल्लीदार	पु	जेनी पासो झूठी रહેती હોય (કિલ્લો, તિજોરી ઇત્યાદિની) તે આદમી, કિલ્લીદાર	कुजीवाला	officer in charge of fort, safe etc
કિલ્લુ	किल्लु	न	અનાજમા પડતુ એક છવડુ, ભોટવુ	अनाज में पडने वाला एक कीड़ा, कीट	insect appearing in corn
કિલ્લો	किल्लो	पु.	કોટ, દુર્ગ	किला, दुर्ग	fort, castle
કિશોર	किशोर	वि	1 નાની ઉમરનુ, સગીર 2 ૧૧ થી ૧૫ વર્ષ સુધીની ઉમરનો છોકરો	छोटी उम्र का किशोर, 11 से 15 तक की उम्र वाला लडका	minor adolescent, boy of 11 to 15 years
કિશોર ગૂઘળ	किशोर गूगळ	पु	એક ઔષધિ	एक औषध	a medicine
કિશોરાવસ્થા	किशोरावस्था	સ્ત્રી	કિશોર વય કે સ્થિતિ	किशोरावस्था	adolescence
કિશોરી	किशोरी	સ્ત્રી	કુમારી, ૧૧ થી ૧૫ વર્ષની છોકરી	किशोरी, 11 से 15 तक की उम्र वाली लडकी	girl, girl of 11 to 15 years
કિશ્ત	किश्त	સ્ત્રી	1 શેતરજનો એક દાવ, શેહ 2 ખેતી, વાપેતર	किश्त, शह (शतरज) काश्तकारी	one of the moves in chess cultivation
કિશ્તી	किशती	સ્ત્રી	હોડી	किशती, नाव	boat
કિસમ	किसम	સ્ત્રી	જાત, પ્રકાર, રીત	किसम, प्रकार	type, variety
કિસમિસ	किसमिस	સ્ત્રી	નાના દાણાની એક જાતની સૂકી દ્રાક્ષ	किसमिस, किशमिश	raisins, dry grapes
કિસાન	किसान	पु	ખેડૂત	किसान	farmer
કિસ્ત	किस्त	સ્ત્રી	1 મહેસૂલનો હપ્તો 2 મહેસૂલ, ડીસ	लगान की किश्त, किश्त लगान	instalment of land revenue land revenue

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 ખડણી, કર 4 જુઓ 'કિસ્ત'	खिराज, कर देखिए 'किस्त'	tax, tribute see 'किस्त'
કિસ્તી	किस्ती	स्त्री	હોડી	किश्ती, नाव	boat
કિસ્મત	किस्मत	न	નસીબ	किस्मत, भाग्य	fortune, luck
કિસ્સો	किस्सो	पु	1 કહાણી, અદ્ભુત કથા-બનાવ 2 કલ્પિત વાર્તા	किस्सा, कहानी कल्पित वार्ता, किस्सा-कहानी	tale, wonderful story, event imaginary story
કિકર	किकर	पु	ચાકર	चाकर, किकर	servant
કિકરી	किकरी	स्त्री	દાસી, ચાકરડી	दासी, सेविका	maid-servant
કિગલાવુ	किगलावु	अ क्रि	1 આનંદમાં આવી જવું, ખૂબ ખુશી થવું 2 કિગલાવાનો હર્ષધ્વનિ	आनद में आना, खुब खुश होना आनदसूचक हर्षध्वनि	to be very happy joyous sound of happiness
કિમત	किमत	स्त्री	1 મૂલ્ય, બદલો, વળતર 2 કદર, બૂજ, લેખું	कीमत, बदला, मुआवजा कद्र, गिनती, महत्व	price, return appreciation, importance
કીકલાવુ	कीकलावु	अ क्रि	જુઓ 'કિગલાવુ'	देखिए 'किगलावु'	see 'किगलावु'
કીકલી	कीकली	स्त्री	નાની કીકી	छोटी बालिका	small girl
કીકલો	कीकलो	पु	નાનો કીકો	छोटा बालक	small boy
કીકી	कीकी	स्त्री	1 નાની બાળકી 2 આખની પૂતળી	छोटी बालिका (आँख की) पुतली, तारा	small girl pupil of the eye
કીચ	कीच	पु	કાદવ	कीचद, कीच	mud, slush
કીચડ	कीचड	पु	કાદવ	कीचड, कीच	mud, slush
કીજે	कीजे	अ	કરવામાં આવે, કરો (વિધ્યર્થ રૂપ) (પ)	कीजिए	may be done, please do

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કીટ	कीट	वि	1 બરાબર પાઠે-મોઢે કરેલુ	बराबर कठस्थ किया हुआ, बरजबान	that which is learnt by heart
		पु	2 પૂરું માહિતગાર 1 મેલ, કીટ 2 કચરો, કસ્તર, કીટુ	पूरा माहिर मैल, जग कचरा, कूड़ाकरकट	well-informed dirt, rust rubbish, dregs
			3 ગઠો, ગાઠ 4 કીડો, જતુ	गौठ, गट्ठा कीट, जतु	knob, knot worm, insect
કીટક	कीटक	पु	જતુ, કીડો, કીટ	कीट, कीडा	germ, worm, insect
કીટલી	कीटली	સ્ત્રી	ચાદાની	केतली, चायदानी	kettle
કીટિયુ	कीटियु	ન	લાકડાની ચીપટ	छिलपट (लकड़ी की)	splinter of wood
કીટી	कीटी	સ્ત્રી	રૂમા જે કપાસિયાની કચર કે પાદડીનો ભૂકો ઇ કસ્તર વળગી રહેલુ હોય તે	रई का कचरा	particles of dust, grass, wood etc found sticking in cotton
કીટુ	कीटु	ન	ઘીને તાપ્યા પછી નીચે જામતો કચરો	तपाये हुए घी की तलछट	dregs left after heating 'ghree'
કીડિયારુ	कीडियारु	ન	કીડીઓનુ ઘર	चीटियों का घर	ant-hole, ant-hill
કીડિયાસેર	कीडियासेर	સ્ત્રી	સેર-કઠી	गले का एक गहना, कठश्री, गलसिरी	necklace of glass beads
કીડિયુ	कीडियु	ન	ખૂબ નાનો કચનો માણકો	काँच का बहुत छोटा मनका	very small glass bead
કીડી	कीडी	સ્ત્રી	એક કીણો જીવ	चीटी	ant
કીડીમકોડી	कीडीमकोडी	સ્ત્રી	કીડી, મકોડી ઉત્યાદિ જીવજતુ	चीटी-चिटा आदि जतु	insects like ants, black-ants etc

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ક્રીડામક્રીડા	ક્રીડામક્રીડા	સ્ત્રી	જુઓ 'ક્રીડામક્રીડા'	દેખિયે 'ક્રીડામક્રીડા'	see 'ક્રીડામક્રીડા'
ક્રીડાવેગ	ક્રીડાવેગ	પુ	ક્રીડાના જોવો-ધીમો વેગ	ચીંટી કી-સી ચાલ	slow pace like that of an ant
ક્રીડો	ક્રીડો	પુ	પેટે ચાલનારો નાનો જીવડો	કીડા	worm, insect
ક્રીનાખોર	ક્રીનાખોર	વિ	વેર-ક્રિનો રાખે એવું દશીલુ, ક્રિનાખોર	ક્રીનાકશ, ક્રીનાવર	malicious, spiteful
ક્રીનો	ક્રીનો	પુ	ક્રિનો, અટસ, વેર	ક્રીના, કટ્ટર બૈર	malice, spite
ક્રીબરી	ક્રીબરી	સ્ત્રી	એક વનસ્પતિ	એક વનસ્પતિ	kind of plant
ક્રીમ	ક્રીમ	ન	એક પખી	એક પક્ષી	kind of bird
ક્રીમત	ક્રીમત	સ્ત્રી	1 મૂલ્ય, બદલો, વળતર 2 કદર, બૂજ, લેખુ	ક્રીમત, બદલા કદ્ર, ગિનતી, મહત્વ	price, return appreciation, importance
ક્રીમતી	ક્રીમતી	વિ	ભારે ક્રિમતનું	ક્રીમતી, મૂલ્યવાન	precious, costly
ક્રીમિયાગર	ક્રીમિયાગર	પુ	1 ક્રીમિયો કરી જાણનારો આદમી 2 કળાવાન-ચુક્રિતબાજ આદમી 3 ધુતારો	ક્રીમિયાગર કલાકુશલ - હુનરમદ વ્યક્તિ ધૂર્ત, ઠગ	alchemist wizard swindler
ક્રીમિયો	ક્રીમિયો	પુ	1 હલકી ધાતુને ક્રીમત બનાવવાની ગુપ્ત રસાયણવિદ્યા 2 ઇલમ, ચુક્રિત 3 મહેલાઈથી ઘણું દૂબ્ય મળે અથવા ક્રીમિયો શાય એવો ઇલમ-ધધો અથવા વસ્તુ	ક્રીમિયા, અકસીર જાદૂ, ચુક્રિત, ઇલમ અસાની સે અધિક ધન મિલે એસા ઇલમ, પેશા યા ચીજ	alchemy magic, trick business or thing which gets much money easily
ક્રીરચ	ક્રીરચ	સ્ત્રી	1 ક્રીરચ, ઘણો નાનો કકડો	ક્રીરચ, કની	very small piece

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			2 सगीन	सगीन, 'बेयोनेट'	bayonet
કીર્ત	कीरत	स्त्री	ખ્યાતિ, નામના	ख्याति, यश	fame, name
કીર્તન	कीरतन	न	1 यशोगान, गुणकीर्तन	यशोगान, गुणवर्णन	singing or narrating the glory or virtue of
			2 गायन અને સંગીત સાથેનું ઇશ્વરનું ગુણવર્ણન	गाते-बजाते हुए ईश्वर का गुणवर्णन करना, कीर्तन	celebrating the greatness of God with song and music
કીર્તનિયો	कीरतनियो	पु	કીર્તનકાર	कीर्तनिया, कीर्तनकार	one who performs 'कीर्तन'
કીર્તન	कीर्तन	स्त्री	ખ્યાતિ, નામના	ख्याति, यश	fame
કીર્તન	कीर्तन	स्त्री	1 यशोगान, गुणकीर्तन	कीर्तन, यशोगान	singing or narrating the glory
			2 ગાયન અને સંગીત સાથેનું ઇશ્વરનું ગુણવર્ણન	गाते-बजाते ईश्वर का कीर्तन	eulogizing the greatness of God with singing and music
કીલ	कील	पु	1 (ગાડાની) ખળી	(गाडी के पहिये पर की) कालिख	oily substance accumulated at the axle of a wheel
			2 મેખ, ખૂટો	मेख, खूटा, कील	wedge, peg
			3 ઢોર બાધવાનો ખીલો	खूटा (मवेशी)	stake for tying cattle
કીલવો	कीलवो	पु	કીલીદાર	कुजीवाला	custodian of the key
કીલી	कीली	स्त्री	1 કીકી	(आख की) पुतली	pupil of the eye

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 डूथी 3 तिजोरी, नाणानी पेटी	कुजी, ताली तिजौरी	key safe
कीलीदार	कीलीदार	पु	जेनी पासो डूथी रહેती छोथ (डिल्लो डे तिजोरी ए नी) ते आधमी, डिल्लोदार	कुजीवाला	one in charge of fort, safe etc
कीलो	कीलो	पु	कीलो	छोटा बालक	small boy
कीस	कीस	स्त्री	भडेसूल, सरकारभरसु	किस्त, लगान	revenue, government tax
कुकरेकूक	कुकरेकूक	न	कूकाना भोलवानो शब्द	कुकड़-कू (मुरगे की)	crowing of a cock
कुडर्म	कुकर्म	न	भोटु-भराभ डर्म	कुकर्म, बुरा काम	wicked deed
कुडर्मा	कुकर्मो	वि	कुडर्म डरनारु	कुकर्मो, कुकर्म करने वाला	wicked (person)
कुचाल	कुचाल	स्त्री	कुचाल, भराभ वर्ताणूक	कुचाल, दुराचार	bad conduct
कुजोग	कुजोग	पु	कुयोग	कुयोग, अनिष्ट, सयोग	evil, inauspicious conjunction
कुटज	कुटज	पु	अेक आड	एक पेड, कुटज	kind of tree, black helebure
कुटामण	कुटामण	न	कुटावु ते, टियाभण	बेकार धक्के खाना	going or being driven in vain
कुटारो	कुटारो	पु	1 कुटामण 2 (ला) माथाकूट, पयात	बेकार चक्कर काटना (ला) माथापच्ची, झझट	going or being driven in vain botheration
कुटावु	कुटावु	स क्रि	'कूटवु'नु प्रेरक	'कूटवु' का प्रेरणार्थक रूप	caus of 'कूटवु'
कुटावु	कुटावु	अ क्रि	1 'कूटवु' नु डर्मण	'कूटवु' का कर्मणि	passive of 'कूटवु'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 टियापु, अश्यापु	भटकना, व्यर्थ चक्कर लगाना	going or being driven in vain
			3 सूण न पडवी, कुटारो शवो	समझ में न आना	to be perplexed
कुटि	कुटि	स्त्री	झूपडी	झोंपडी, कुटी	hut
कुटिर	कुटिर	स्त्री	झूपडी	झोंपडी, कुटीर	hut
कुटी	कुटी	स्त्री	झूपडी	कुटी, झोंपडी	hut
कुटीर	कुटीर	स्त्री	झूपडी	कुटीर, झोंपडी	hut
कुटुબ	कुटुब	न	1 એક બાપનો પરિવાર-વશ 2 બૈરી, છોકરા વગેરે ધરના માણસોનો સમૂહ 3 બૈરી છોકરાનો સમૂહ	कुनबा, वश, परिवार बाल बच्चे, स्त्री आदि, कुटुब	family all the members of a family
કુટુબકબીલો	कुटुबकबीलो	पु	કુટુબ અને કબીલો	बालबच्चे, स्त्री आदि का समूह, कुटुब	wife and children
કુટુબપરિવાર	कुटुबपरिवार	पु	કુટુબ અને પરિવાર	परिवार का समूह, कुटुब-कबीला, बालबच्चे, स्त्री आदि का समूह	the whole family
કુટુબી	कुटुबी	वि	1 કુટુબનુ 2 કુટુબવાળુ	कुटुब और परिवार	wife, children, cousins and other dependents
કુટેવ	कुटेव	न,पु	કુટુબનુ માણસ	परिवार का कुनबे वाला, परिवार वाला	belonging to the family having a family
		સ્ત્રી	નઠારી ટેવ-આદત	परिवार का व्यक्ति, परिवार	member of a family
				कुटेव, बुरी आदत	bad habit, vice

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કુઠામ	कुठाम	ન	ખરાબ કે અયોગ્ય ઠામ	कुठाँव, कुठौर, बुरी जगह	bad or improper place
કુઠાર	कुठार	પુ	1 કુહાડો 2 ફરસી	कुल्हाडा, कुठार परशु	axe battle-axe
કુડતુ	कुडतु	ન	પહેરણ	कुरता	shirt
કુડલી	कुडली	સ્ત્રી	કુલડી, કુલ્લી	कुल्हड, पुरवा	small earthen pot
કુડલુ	कुडलु	ન	કુલ્લુ	कुप्पा	earthen pot
કુડાપો	कुडापो	પુ	1 કઠારો, ધામ 2 કલેશ, પરિતાપ	उमस क्लेश, कुढन	sultriness pain, misery
કુણિયાટવુ	कुणियाटवु	સ ક્રિ	કોણીએ કોણીએ મારવુ	कोहनी से पीटना	to hit with the elbow
કુતકુ	कुतकु	ન	કશર, બૂધુ, દડકો	कुतका, गतका, सोंटा	cudgel, thick stick
કુતરિયુ	कुतरियु	ન	એક ઘાસ, ફૂતરી	कुत्ता (घास), लपटौआँ	kind of grass that sticks, bur
કુતર્ક	कुतर्क	પુ	1 ખોટો તર્ક 2 ખરાબ વિચાર	कुतर्क, असगत तर्क खराब विचार	false or incorrect idea, thought wicked idea or thought
કુતુબ	कुतुब	પુ	1 ઘટીનો ખીલડો 2 ધ્રુવતારો	चक्की की कील, अखौटा ध्रुवतारा, कुतुब	upright axle of a hand-mill pole-star
કુતુબનુમા	कुतुबनुमा	ન	હોશયત્ર	कुतुबनुमा	mariner's compass
કુતુમરા	कुतुमरा	ન	એક પક્ષી	एक पक्षी	a bird
કુતૂહલ	कुतूहल	ન	1 અમુક વસ્તુની વસ્તુ જોવા -જાણવાની ઉત્કંઠા,	कुतूहल	curiosity

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કુતેલી	कुतेली	स्त्री	2 नवाँभरी वस्तु એક વનસ્પતિ, કૂતરી	कौतुक वाली चीज एक वनस्पति	wonder kind of grass that sticks
કુતી	कुती	स्त्री	કૂતરી	कुत्ती, कुतिया	she-dog, bitch
કુતો	कुतो	पु.	કૂતરો	कुत्ता	dog
કુશ્ચો	कुश्चो	पु	કાગળ ખાનારો એક જીવડો	कागज खाने वाला एक कीड़ा	insect eating paper
કુદકારો	कुदकारो	पु	કૂદકો	कुदान, छलाग	jump
કુદકુ	कुदकु	न	જુઓ 'કુતકુ'	देखिए 'कृतकु'	see 'कृतकु'
કુદરત	कुदरत	स्त्री	1 ઇશ્વરી શક્તિ, નિસર્ગ, પ્રકૃતિ 2 જાતિસ્વભાવ	प्रकृति, कुदरत जाति स्वभाव	divine power, nature original nature, disposition
કુદાવવુ	कुदाववु	सक्रि	3 જોર, તાકાત 'કૂદવુ'નું પ્રેરક	सामर्थ्य, ताकत	strength, power
કુદાવુ	कुदावु	अक्रि	'કૂદવુ'નું કર્મણિ	'कूदवु' का प्रेरक	causal of 'कूदवु'
કુધાન	कुधान	न	હલકા પ્રકારનું ધાન્ય	'कूदवु' का कर्मणि निकृष्ट अन्न, कुधान्य	passive of 'कूदवु' grain of inferior quality
કુધારો	कुधारो	पु	ખોટો-ખરાબ રિવાજ	कुरीति, खराब रिवाज	bad or evil custom
કુનેહ	कुनेह	स्त्री	1 યુક્તિ, હિકમત 2 ચતુરાઈ	हिकमत, युक्ति चतुराई	skill
કુપથ	कुपथ	पु	ખરાબ-અનીતિનો માર્ગ	कुपथ, अनीति का मार्ग, कुमार्ग	tact, ingenuity bad or immoral way
કુપથગામી	कुपथगामी	वि	કુપથે જનારુ	कुपथगामी, बुरे आचरण वाला	one going astray
કુપથ્ય	कुपथ्य	वि	પથ્ય નહિ તેવું, આરોગ્યને માફક ન આવે એવું	अस्वास्थ्यकर, कुपथ्य	not good for health

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		न	પરેજી-કરી ન પાળવી તે	बदपरहेजी, कुपथ्य	deviation from regimen prescribed by physician
કુપાત્ર	कुपात्र	वि	1 નાલાયક, અનધિકારી 2 બેઅદબ, છક્રી ગયેલુ	नालायक, अनधिकारी, कुपात्र बेअदब, बहका हुआ	unworthy, unfit wicked
		न	1 ખરાબ વાસણ 2 કુપાત્ર માણસ	खराब बरतन खराब व्यक्ति, कुपात्र	bad container unfit person
કુપિત	कुपित	वि	કોપેલુ, ક્રોધે ભરાયેલુ	कुपित, खफा	angry
કુપ્પી	कुप्पी	स्त्री	નાનો કુપ્પો, નાનુ કુલ્લુ	छोटा कुप्पा, कुप्पी	small leather (container like a) bottle
કુફર	कुफर	न	નાસ્તિકતા, અક્રમણ	नास्तिकता, कुफ्र	atheism
કુબજા	कुब्जा	स्त्री	1 કૂબડી સ્ત્રી 2 ખરાબ સ્ત્રી	कुबडी, कुब्जा, कुब्जा खराब स्त्री	ugly woman hag, wicked woman
કુબુદ્ધિ	कुबुद्धि	स्त्री	નઠારી બુદ્ધિ, લુચ્ચાઇ, કપટ	दुर्बुद्धि, कपट, कुबुद्धि	evil-mindedness, evil
કુબ્જ	कुब्ज	वि	ખૂંધુ-કૂબડુ	कुबडा, कुब्ज	hunch-backed
કુબ્જા	कुब्जा	वि, स्त्री	ખૂંધી-કૂબડી	कुबजा, कुब्जा, कुबडी	hunch-backed woman
કુભારજા	कुभारजा	स्त्री	1 નઠારી સ્ત્રી 2 ક્રિજ્યાખોર સ્ત્રી, કર્કશા 3 કૂવડ	खराब स्त्री कर्कशा स्त्री, लडाकी स्त्री फूहड स्त्री	bad woman shrew, termagant slovenly woman

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
कुमकुम	कुमकुम	न	कुंभ, कुं	कुंकुम, रोली	red turmeric
कुमति	कुमति	स्त्री	नठारी भति	दुर्भाव, कुमति	evil-mindedness, evil genius
कुमणु	कुमळु	वि	1 शोभण, मुलायम 2 सुकुमार, नाजुक 3 नरम, मृदु 4 मधुर 5 ध्याणु	क्रोमल, मुलायम सुकुमार, नाजुक मृदु मधुर, क्रोमल दयायुक्त, क्रोमल	tender, soft delicate mild sweet merciful
कुमार	कुमार	पु	1 पाच वर्षनी उभरनो बाण्ड 2 युवावस्था अथवा अेनी पछेलानी अवस्थावाणो छोउरो 3 पुत्र 4 राजपुत्र	पाँच वर्ष का लडका युवावस्था या उत्तसे पहले की अवस्था का लडका, कुमार बेटा, कुमार राजकुमार, कुमार	five-year old boy boy in his youth or adolescence son prince
कुमारभट्टर	कुमारभट्टर	न.	प्राथमिक उणवाणीनी शाळा	बालशाला	primary school
कुमारी	कुमारी	स्त्री	1 बार वर्ष सुधीनी उन्था 2 कुमारी उन्था 3 राजकुमारी 4 पुत्री	बारह वर्ष तक की कन्या, कुमारी कुँआरी कन्या राजकुमारी बेटी, लडकी, कुमारी	girl under twelve years unmarried girl, maiden princess daughter
कुमाविसदार	कुमाविसदार	पु	मछेसूल उधरावनार अमलदार, मछालेउारी, मछेसूली अमलदार	माल - महकमे का अधिकारी	officer collecting land revenue
कुमाश	कुमाश	स्त्री	1 सुवाणप, नरमाश (अपडनी)	मुलायमत, नरमी (कपडे की)	softness (of cloth), fineness

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કુરકુરિયુ	कुरकुरियु	न	2 સફાઈદાર વણાટ કુતરાનુ નાનુ બચ્ચુ, ભટોળિયુ	साफ बुनाई कुत्ते का छोटा बच्चा,पिल्ला	fine texture pup, whelp
કુરઘોડી	कुरघोडी	स्त्री	છોકરાની એક રમત	बच्चों का एक खेल	game of leap - frog
કુરતુ	कुरतु	न	કુરતુ, પહેરણ	कुरता	long shirt
કુરનસ	कुरनस	स्त्री	નમીને-ઝૂકીને સલામ કરવી તે	कोरनिश	low bow, humble salute
કુરનિસ	कुरनिस	स्त्री	જુઓ 'કુરનસ'	देखिए 'कुरनस'	see 'कुरनस'
કુરબક	कुरबक	न	એક ફૂલ ઝાડ	एक पुष्प पेड, कुरबक, कुरवक	a flowering- plant
કુરબાન	कुरबान	वि	1 બલિદાન તરીકે સમર્પેલુ 2 ન્યોછાવર, ફૂલ	बलि, कुरबान निछावर, समर्पित किया हुआ	offered as sacrifice sacrificed
કુરબાની	कुरबानी	स्त्री	કુરબાન થવુ કે કરવુ તે, બલિદાન	कुरबानी, आत्मत्याग	sacrifice
કુરવક	कुरवक	न	એક ફૂલ ઝાડ, કુરબક	कुरबक, कुरवक	a flowering- plant
કુરસીનામુ	कुरसीनामु	न	પેઢીનામુ	वशवृक्ष	genealogy, pedigree
કુરનિશ	कुरनिश	स्त्री	નમીને-ઝૂકીને કરેલી સલામ, કુરનિસ	कोरनिश	low bow
કુલ	कुल	वि	1 એકદર, બધુ મળીને શાય એટલુ 2 તમામ	कुल, सारा तमाम, पूर्ण	all taken together, total complete
		न	1 કુટુબ, વંશ 2 ખાનદાની, કુલીનતા	कुटुब, कुल कुलीनता	family, race noble lineage or birth

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 टोणु, जूथ 4 असील (वकील-नो)	समूह, दल, झुंड मुवक्किल (वकील का)	clan, group client (of a lawyer)
કુલકુલા	कुलकुला	वि	1 कुल अजत्यार भोगवतु 2 अगत, पास	कुल मुखतार निजी, खास	possessing all powers personal, special
		अ	अजत्यार समेत	अखत्यार के साथ, साधिकार	with complete powers
કુલડી	कुलडी	स्त्री	1 डसली जेवु नानु भाटीनु वासण, चडपो 2 सोनुउपु गाणवानु अेड पात्र 3 गुदानो भाग	कुल्हिया सुनारों की कुल्हिया जिस में सोना - चादी गलाते हैं गुदा का भाग, कॉच	small earthen vessel crucible the scrotum
કુલમર્યાદા	कुलमर्यादा	स्त्री	कुलनी मर्यादा-लज्जा	कुल की प्रतिष्ठा, कुलमर्यादा	honour of family
કુલવધૂ	कुलवधू	स्त्री	सारा कुटुबनी वडु-स्त्री	अच्छे घर की स्त्री, कुलवधू	daughter-in-law of a noble family
કુલહીન	कुलहीन	वि	कुल विनानु, अकुलीन	अकुलीन, कुलहीन	of ignoble, mean, birth or family
કુલગ	कुलग	न	अेड पक्षी	एक पक्षी, कुलग	a bird
કુલજન	कुलजन	न	अेड वनस्पति-औषधि	एक वनस्पति, कुलज, कुलजन	a medicinal herb
કુલાબો	कुलाबो	पु	1 लूशरनी जमीन 2. बायनो डाय	अतरीप की जमीन आस्तीन का कट	cape cut of a sleeve

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કુલી	कुली	पु	ભાર ઊંચકનારો, મજૂર	कुली	coolie, porter
કુલીન	कुलीन	वि	ઊંચા કુળનું, ખાનદાન	ऊँचे कुल का, कुलीन	of noble birth or family
કુલે	कुले	अ	જુમલે, એકઠેરે, સરવાળે	कुल-जमा, समग्रतया, सब मिलाकर	totally, on the whole
કુલેર	कुलेर	स्त्री	ઘીગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો કાચો લોટ - એક ખાદ્ય	एक खाद्य पदार्थ	a dish made of bajri flour, ghee and jaggery
કુલ્લી	कुल्ली	स्त्री	1 જુઓ 'કુલડી' 2 નાનું કુલ્લુ	देखिए 'कुलडी' कुप्पी	see 'कुलडी' small container
કુલ્લે	कुल्ले	अ	જુઓ 'કુલે'	देखिए 'कुले'	see 'कुले'
કુવાશી	कुवाशी	स्त्री	કુમારિકા	कुमारिका	unmarried girl, maiden
કુવાસ	कुवास	स्त्री	ખરાબ વાસ-ગંધ	दुर्गंध, कुबास	bad smell
કુવાસી	कुवासी	स्त्री	જુઓ 'કુવાશી'	देखिए 'कुवाशी'	see 'कुवाशी'
કુવેતર	कुवेतर	न	કૂવાવાળી જમીન	कुँ से सींची जाने वाली जमीन	land irrigated with well-water
કુવેતી	कुवेती	पु	કૂવા પરનો-કોસ ડાકનારો આદમી	चरसी, चरसिया	man attending bullocks drawing leather bucket from well
કુવ્વત	कुव्वत	न	ઊંચત	सामर्थ्य, ताकत	strength
કુશકા	कुशका	पु	ડાગર, કોદરા ઇત્યાદિના છોડા	धान, कोदों आदि के छिलके, भूसी	chaff of paddy etc
કુશલ	कुशल	वि	1 શુભ, કલ્યાણકારી 2. આરોગ્યવાન	शुभ, कल्याणकारी स्वास्थ्ययुक्त	auspicious healthy

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			3 प्रवीण, होशियार	प्रवीण, होशियार, कुशल	expert, skilful
		न	कुशलता	कुशलता	skill
कुशल	कुशल	वि	જુઓ 'કુશલ'	देखिए 'कुशल'	see 'कुशल'
कुष्ठ	कुष्ठ	पु, न	ક્રોઢ	कोढ़, कुष्ठ	leprosy
कुसग	कुसग	पु	નઠારો સગ, ખરાબ સોબત	बुरी सोहबत, कुसग	bad or evil company
कुसप	कुसप	पु.	સપ નહિ તે, અણબનાવ	फूट, अनबन	disunion, disagreement
कुसपी	कुसपी	वि.	કુસપવાળુ	फूटवाला	having disagreement, not united
कुसुपी	कुसुबी	वि	1 કસુબલ	कुसुभी, कुसुभ के रग का	of safflower colour
			2 કસુબાના ફૂલનો રગ	कुसुभ के फूल का रग	colour of safflower
			3 કસુબાનુ બીજ	कुसुभ का बीज	seed of safflower
कुसुपी	कुसुबी	पु	1 એક વનસ્પતિ 2 એના ફૂલમાથી નીકળતો રગ 3 એ રગનુ કપડુ 4 પાણીમા ઘોળેલુ અફીમ કે તે મિધે થતો મેળાવડો	एक पौधा इसके फूल से निकलने वाला रग, कुसुभा इस रग का कपडा अफीम का घोल या इस बहाने होने वाला जलसा	kind of plant colour made of its flower cloth of that colour - saffron drink of opium diluted with water and having red colour
कुस्ती	कुस्ती	स्त्री	1 અગ કસરતની એક રીત	कुरती	wrestling

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૨ બચ્ચબચ્ચા	ગુત્થમગુત્થા	punching one another
કુસેવા	કુસેવા	સ્ત્રી	ખરાબ સેવા, અસેવા	ખરાબ સેવા, કુસેવા	disservice, harm
કુહાડી	કુહાડી	સ્ત્રી	નાનો કુહાડો	કુલહાડી	small axe
કુહાડો	કુહાડો	પુ	લાકડા કાપવાનું -કાડવાનું એક હથિયાર, પરશુ	કુલહાડા	axe
કુળ	કુલ	ન	જુઓ 'કુલ'	દેખિયે 'કુલ'	see 'કુલ'
કુળદેવી	કુલદેવી	સ્ત્રી	કુળની ઇષ્ટદેવી	કુલદેવી	family-goddess
કુળધર્મ	કુલધર્મ	પુ	વશપરપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ-આચાર	વશ-પરપરાગત વિશિષ્ટ ધર્મ-આચાર, કુલધર્મ, કુલરીતિ	traditional custom pecu- liar to a family
કુળવતી	કુલવતી	વિ	કુલીન	કુલવતી, કુલીન સ્ત્રી	of noble birth
કુળહીણ	કુલહીણ	વિ	૧ કુળ વિનાનું ૨ અકુલીન	બિના કુલ કા અકુલીન	not nobly born ignoble, of low birth
કુળહીણ	કુલહીણ	વિ	જુઓ 'કુળહીણ'	દેખિયે 'કુળહીણ'	see 'કુળહીણ'
કુકુમ	કુકુમ	ન	કુમકુમ, કુકુ	કુકુમ, રોલી	red turmeric
કુજ	કુજ	સ્ત્રી	ઝાડ અથવા વેલાના પાદડાથી થયેલી ઘટા, લતામડપ	લતામડલ, કુજ	bower, arbour
કુજડી	કુજડી	સ્ત્રી	એક પક્ષી	એક પક્ષી	kind of bird
કુજડુ	કુજડુ	ન	એક પક્ષી	એક પક્ષી	kind of bird
કુજડો	કુજડો	પુ	૧ કાઠિયો ૨ માળી	કુજડા, કાઠી માલી	vegetable- monger gardener

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	ट्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
कुणर	कुजार		3 अेक पक्षी 4 कुणूस आधमी	एक पक्षी कजूस आदमी	kind of bird miserly person
कुणे	कुजो	वि	कुण जेवु, धटाधर	कुज जैसा	like an arbour
कुसल	कुडल	पु	भोटवो, यणु	कूजा, सुराही	pitcher, jug
कुसली	कुडली	न	काने पढेरवानु अेक धरेणु	कान में पहनने का बाला, कुडल	ear-ring
		स्त्री	1 नानु कुडणु 2 लाकडी, भाला वगेरेने छेडे धलाती भोणी	छोटा कुडल, मडलाकार रेखा धातु की खोली, शामी	small circle metal ring or cap attached to the end of a spear (of astro.) horoscope
कुसण	कुडळ		3 गळ वगेरेनी गणतरीनु भानावाणु थोकठु के थकरडु	जन्मकुडली	
कुसणी	कुडळी	न	णुओ 'कुसल'	देखिए 'कुसल'	see 'कुसल'
कुदन	कुदन	स्त्री	णुओ 'कुसली'	देखिए 'कुसली'	see 'कुसली'
कुदी	कुदी	न	शुधद सोनु	खालिस सोना, कुदन	pure gold
		स्त्री	1 धोयेला कपडाने टीपीने सशधधर करवानु अेक ओणर-लाकडानी भोगरी 2 धोयेला कपडाने सशधधर करवानी किय़ा 3 टीपवु-भारवु ते	कुदी करने का औजार, लकडी की मुँगरी	instrument or tool for calendering clothes
कुदीगर	कुदीगर	पु	कुदी करनाशे	पीटना, मरम्मत करना	beating
				कुदीगर	one who calenders

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કુદીપાક	कुदीपाक	पु	मार, ठोड	मार, मरम्मत	sound beating
કુદું	कुदु	न	જુઓ 'કુદો'	देखिए 'कुदो'	see 'कुदो'
કુદો	कुदो	पु.	1 દડૂકો, ધોકો 2 લાકડી કે બદુકનો જાડો છેડો	कुदा, दस्ता बदूक का दस्ता, कुदा	cudgel, thick stick stock of a musket
કુબાર	कुभार	पु	1 માટીના વાસણ ઘડનાર એક જ્ઞાતિનો મારાસ 2 (લા)અણધડ અથવા મૂર્ખ મારાસ	कुम्हार अनगढ़, मूर्ख (ला)	potter dull-witted or foolish person
કુભી	कुभी	સ્ત્રી	1 કુભી, શાભલા નીચેની પથ્થર અથવા લાકડાની બેસણી 2 મકાનનો શાભલો 3 ચાર વર્ષે ભરાતો નાનો કુભમેળો 4 નાનો કુભ-ઘડો 5 નાનું કુલ્-લુ (મશાલમા તેલ પૂરવા માટે)	खभे के नीचे का पत्थर या काठ का आधार, बैठक मकान का खभा कुभ (मेला या पर्व) छोटा मिट्टी का घड़ा छोटा कुप्पा (मशालची का)	stone or wooden base of a pillar pillar of a building minor kumbh fair held every four years small earthen jar or pitcher small leather container for oil
કુવર	कुवर	पु	1 કુવારો છોકરો 2 રાજકુમાર 3 પુત્ર-લાડકો પુત્ર	कुँवारा लडका राजकुमार पुत्र, लाडला बेटा	unmarried boy prince son, beloved son
કુવાર	कुवार	સ્ત્રી	એક વનસ્પતિ-ઔષધિ	घीकुआर, ग्वारपाठा	aloe plant
કુવારકા	कुवारका	સ્ત્રી	1 કુવારી કન્યા	कुमारिका, कुँवारी कन्या	maiden, virgin

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
कुवारपाठु	कुवारपाठु	न	2 समुद्रने मणती न छेय थेवी नदी	वह नदी जो समुद्र में न मिलती हो	(of river) not falling into the sea
कुवारी	कुवारी	वि	कुवारनो परधी जेवो शेजो	ग्वारपाठा	spear-like blade of aloe plant
कुवारु	कुवारु	वि	समुद्रने नहि मणती (नदी)	समुद्र में न मिलने वाली (नदी)	(of river) not falling into the sea
कुई	कुई	स्त्री	नहि परहेलु	कुंवारा	unmarried
कुई	कूक	न	नानो कुवो	छोटा कुआँ, कुइयो	small well
			1 (रव) कुईकुई	ऑख मिचौनी के खेल में की जानेवाली आवाज भोंपू, सीटी	crowing of the cock in a play
			2 ओजिननी सिसोटीनो अवाण	रैलगाडी	sound of whistle of a railway engine
कूकगाडी	कूकगाडी	स्त्री	आगगाडी	आधो-आध	railway train
कूकडभागे	कूकडभागे	अ	अधोअध-अराअर सरधे भागे	एक बेल-लता	kind of creeper
कूकडवेल	कूकडवेल	स्त्री	अेक वेल	उस बेल का फल	its fruit
कूकडवेलु	कूकडवेलु	न	कूकडवेलनु इण, कूकडपाडु	देखिए 'कूकडवेल'	see 'कूकडवेल'
कूकडवेलो	कूकडवेलो	पु	जुओ 'कूकडवेल'	मुर्गी, बत्तख इत्यादि	fowls, poultry
कूकडा	कूकडा	न	भरधा, भतडा वजेरे	मुर्गी	hen
कूकडी	कूकडी	स्त्री	भरधी	ऑख मिचौनी के खेल में की जाने वाली आवाज	word uttered by the players in the game of 'hide and seek'
कूकडीकूक	कूकडीकूक	अ	(रव) सताकूकडीनी रमतमा करतो अवाण		

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
कूडेकूडे	कूकडेकूक	न.	(२५) कूकडानो ओलवानो शब्द	मुरगे की आवाज, कुकड़ै-कूँ	crowing of the cock
कूडो	कूकडो	पु	भरघो	मुरा, मुरगा	cock
कूडरी	कूकरी	स्त्री	1 नानो कूडो, रभवानी डाडरी	खेलने की गोटी	round piece of stone or earthen pot used by players in certain games
			2 उणभा भारेली डुअर	हल में लगाई हुई पच्चर, खुरा	wooden wedge driven into a plough
			3 गुरजाओनु अेड एरा जेवु शस्त्र	नेपाली कटार, खुखरी	kind of knife kept by the Gurkhas
कूडरेकूड	कूकरेकूक	न	जुओ 'कूडेकूड', 'कुडरेकुड'	देखिए 'कूडेकूड', 'कुडरेकुड'	see 'कूडेकूड', 'कुडरेकुड'
कूडरो	कूकरो	पु	डैडियो	टेटुवा, घटी	Adam's apple
कूडो	कूकी	स्त्री	नानो कूडो	छोटी गोटी	small piece of stone or earthen pot used in certain games
कूडो	कूको	पु	1 डीडरीनो गोण डडो	ठीकरी, गोटी	round bit of earthen pot
			2 पशुअरनो गोण डाडरो	पत्थर का छोटा गोल टुकडा, गोटी	pebble
कूड	कूख	स्त्री	1 पेटनु पडभु	कूख, कोख	side of abdomen
			2 (ला) पेट, गर्भाशय	(ला) गर्भाशय, पेट	womb
कूड	कूच	स्त्री	1 रवाना थपु-मुशम उपाडी चाट्या जपु ते	कूच, रवानगी	departure from a place

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			2 लश्करी ठप्पनी चाल	लश्करी चाल, कूच - कदम	march
કૂચડી	कूचडी	स्त्री	नानो કૂચડો, જાડા વાળની પીંછી	मोटे बालों की कूंची, ब्रश	small brush, painter's brush
કૂચડો	कूचडो	पु	1 વાસણને અદરથી માજવાનો એક છેડ કૂચાવાળો લાકડાનો કડડો	उसकन, उवसव	small piece of stick crushed at one end to form a brush for cleansing the inside of vessels
			2 ધોળવા માટે બનાવેલો ભીંડો કે મુજના રેસાનો ઝૂડો-સાવણો	कूंची(सफेदी की)	large brush of grass etc for white-washing
			3. વણાટમા પવાયત માટે વપરાતુ સાધન	ताने का सूत साफ करने का ब्रश, कूच	tool used for sizing yarn while weaving
કૂચહ	कूचह	पु	મહોલનો, ગલી	गली, कूचा	street, lane
કૂચાપાણી	कूचापाणी	वि	કૂચા અને પાણી જોવા, એકરસ નહિ થયેલુ એવુ	एकरस न बना हुआ	not fully dissolved or mixed
		न	1 કૂચા અને પાણી	फोक और पानी	coagulum and water
			2 (લા) સત્વહીન વસ્તુઓ	(ला) निस्तार चीजें	useless things without substance
કૂજડો	कूजडो	पु	માટીના વાસણ વેચનારો	मिट्टी के बरतन बेचने वाला	one who sells earthen vessels
કૂજો	कूजो	पु	ભોટવો, થબુ	कूजा, सुराही	pitcher, jug
કૂટ	कूट	वि	1 ન સમજાય કે ન વચાય એવુ	गूढ	difficult to read or understand

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ભેદ અથવા ગૂંચવણ(अर्थ)	रहस्यभरा	intricate, difficult
			3 જૂઠું, કૂડ(अर्थ)	असत्य, कूट, कपटयुक्त	false, fraudulent
		पुं, न	1 કૂડ, ઠગાઇ, છેતરપિંડી	कपट, धोखा, छल, कूट	fraud, deceit
			2 પર્વતની ટોચ, શિખર	पहाड की चोटी	peak, top of a mountain
			3 ઢગલો	राशि, ढेर	heap
કૂટ	कूट	સ્ત્રી	1 કડાકૂટ	किचकिच, माथापच्ची	trouble, botheration
			2 ભગાર	अगड-खगड	scrap
કૂટણખાનુ	कूटणखानु	ન	વેશ્યાગૃહ	वेश्यागृह, कुटनखाना	brothel
કૂટણી	कूटणी	સ્ત્રી	અનીતિના કામમા દલાલુ કરનાર કે કૂટણખાનુ ચલાવનાર સ્ત્રી	कुटनी	procuress, bawd, one who runs a brothel
કૂટણ	कूटण	ન	1 મરણ પાછળ કૂટવુ તે	मृतक के पीछे छाती कूटना	beating the breasts in mourning
			2 તેવો પ્રસંગ	ऐसा प्रसंग	occasion for mourning
			3 ભડવાઈ	कुटनामा, कुटनाई	pimping
કૂટવુ	कूटवु	સ ક્રિ	1 મારવુ, ઠોકવુ, ટીચવુ	मारना, पीटना	to beat, to knock
			2 ખાડવુ	कूटना (धान, औषध आदि)	to pound, to crush
			3 મૂએલાની પાછળ છાતી પીટવી	मृतक के पीछे छाती कूटना	to beat breasts to mourn the dead
કૂટયુ	कूटयु	ન	માર, ઠોક	मार कुटाई, मरम्मत	beating

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
झूटी	कूटी	स्त्री	सोडटी, झूठी	गोटी, नर्द	man, piece used in certain games
झूटो	कूटो	पु	1 झ्यशयेलु-जशयेलु छोय ते, भगार, भूओ 2 मार, ठोड	चूरा, चूर्ण	something crushed or pounded
झूड	कूड	न	1 कपट, ठगाछ 2 वाधो, पथओ	मार, कुटाई	beating, thrashing
झूडकपट	कूडकपट	न	एगाइठओ, छलप्रपथ	कपट, धोखा, हरज, आपत्ति	deceit, fraud
झूडु	कूडु	वि	1 झूडवाणुं, डेपटी 2 वाडु	छल-कपट, धोखा-धडी	difficulty, offence
झूशी	कूणी	वि	1 झूडवाणुं, डेपटी 2 वाडु	कपटी, धोखेबाज	treachery
झूशी	कूणी	न	वाधोपथओ (जस झरीने देवीने डे माताने पडे ते)	टेढा, वक्र, कुटिल अपराध, खता (खास करके देवी या माता की)	treacherous crooked offence (esp that taken by the deity or goddess)
झूशी	कूणी	स्त्री	1 जभा नीथेनो छथनो पछेजोसाधो 2 अे साधानु आशीदार छाडु	बाहु और भुजा का जोड़, कुहनी	the elbow
झूशु	कूणु	वि	डुमणु	उस जोड़ की नोकदार हड्डी	pointed bone of the elbow
झूशु	कूतकु	न	डशर, भूधु, डडओ, झुतकु	कोमल, नाजुक	delicate, tender
झूशरजडियु	कूतरखडियु	न	(झूशर मारी जानारु) अेड छिस्त्र पशु	कुतका, गतका, सोंटा	thick stick, club, cudgel
झूशरी	कूतरी	स्त्री	झूशरनी माध	कुत्तों को खा जाने वाला) एक हिंसक पशु	wild animal that eats dogs
झूशरु	कूतरु	न	अेड पशु, श्वान	कुतिया, कुती	bitch, she-dog
				कुत्ता	dog

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
झूरो	कूतरो	पु	नर झूरो	कुत्ता	dog
झूथली	कूथली	स्त्री	निधा, जोटी चक्यार	कुत्सा, निदा	gossip, slander
झूडु	कूदकु	न	जुथो 'झूडु'	देखिए ' 'झूडु'	see 'झूडु'
झूडो	कूदको	पु	ठेडको, छलाग	कुदान, छलाग	jump, leap
झूडु	कूदवु	अ क्रि	1 छलाग मारवी, ठेडको मारवो 2 गण उपरपटनो भपको -अर्थ डरवो	कूदना, छलाग मारना अपने बूते से अधिक खर्च या ठाठ करना	to jump to over-spend
झूपी	कूपी	स्त्री	नानो झूपो	कुप्पी	small leather container
झूपो	कूपो	पु	1 डेलेला पेटनु अने साकडा मेनु चामडानु पात्र, कुल्लु 2 अे घाटनो डायनो शीशो	कुप्पा कुप्पे के आकार की काँच की बडी बोतल	leather container having narrow mouth glass bottle of that shape
झूपडु	कूबडु	वि	डडुपु	कुरूप, बदशकल	ugly
झूपो	कूबो	पु	1 अेड छोड 2 पक्षीअे बाधेलो भाणो 3 धुम्मटवाणु घासनु झूपडु 4 छो-डडरेटवाणी जमीन, रश्शड 5 ते टीपवानु लाडडाना डे लोडाना पञ्जनडार डयडामा लाडडी जोसी बनावेलेु साधन	एक पौधा घोंसला घास की गुबददार कुटिया पक्का फर्श, गच कोबा, मोगरा	kind of plant nest grass hut with a dome concrete floor implement for beating mud, brickbat etc into mortar
झूलो	कूलो	पु	धगडो	कूल्हा, कूला, चूतड	buttock

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કૂવાશભ	કૂવાથમ	પુ	વહાણના વચલા સટનો શાભલો	મસ્તૂલ	mast of the middle sail of a ship
કૂવો	કૂવો	પુ	1 જમીનમાથી પાણી કાઢ વા માટે ખોદેલો ખાડો 2 કૂવાશભ	કુંઆ, કુઆ મસ્તૂલ	well mast
કૂળુ	કૂલુ	વિ	કુમળુ, કૂલુ	કોમલ, નાજુક	tender
કૂચી	કૂચી	સ્ત્રી	1 ચાવી 2 ઉપાય 3 રહસ્ય જાણવાનું સાધન	કુજી, તાલી ઉપાય રહસ્ય જાનને કા સાધન	key cure, remedy clue
કૂજડી	કૂજડી	સ્ત્રી	એક પક્ષી, કુજડી	एक पक्षी	kind of bird
કૂજડુ	કૂજડુ	ન	એક પક્ષી, કુજડુ	एक पक्षी	kind of bird
કૂજડો	કૂજડો	પુ	કૂજૂસ આદમી	कजूस व्यक्ति	miser
કૂડલી	કૂડલી	સ્ત્રી	1 નાનું કૂડાળું 2 લાકડી, ભાલા વગેરેને છેકે ઘલાતી ધાતુની ખોળી 3 (જ્યો) ગ્રહ વગેરેની ગણતરીનું ખાનાવાળું ચોકઠું કે ચક્રડું	छोटा कुडल धातु की खोली, शामी जन्मकुडली	small circle metal ring or cap attached to the end of a spear or stick (of astrol) horoscope
કૂડળી	કૂડળી	સ્ત્રી	જુઓ 'કુડળી'	देखिए 'कुडणी'	see 'कुडणी'
કૂડાળું	કૂડાળું	ન	વર્તુલ, ગોલ આકૃતિ	कुँडरा, घेरा, वृत्त	circle
કૂડી	કૂડી	સ્ત્રી	1 કુડ જેવો નાનો ખાડો 2 પહોળા મોનું નાના કુડ જેવું વાસણ	कुड जैसा छोटा गढा कुड-सा बरतन, कुडी, कुँडी	small ditch like basin broad-mouthed vessel like a basin

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 नानो उवाडो 4 वीसनी सप्यानी संकेत	छोटा उबारा, कुड बीस की सख्या का सकेत, कोडी	small trough symbol for a score
કુડ	कूड	न	1 કુડ જેવુ પહોળા મોનુ નાનુમોટુ શકોરુ 2 ફૂલઝાડ વાવવાનુ એક પાત્ર 3 ફૂડાળુ	कुडा, कूडा, कुँडरा गमला घेरा, कुँडरा	broad-mouthed vessel flower-pot circle
કુડ	कूण	वि	જુઓ 'કૂળ'	देखिए 'कूण'	see 'कूण'
કુદવુ	कूदवु	सक्रि	1 કુદી કરવી 2 કુદનથી જડવુ	कुदी करना कुदन से जडना	to calender (cloth) to fix or inlay with gold
		न	ઘાસની ગણ	घास की गजी, टाल	hay-rack
કૂધવુ	कूधवु	न	ઘાસની ગણ	घास की गजी, टाल	hay-rack
કૂપળ	कूपळ	स्त्री	કુમળુ—નવુ ફૂટતુ પાદડુ	कोपल, गाभा	tender sprout
કૂપી	कूपी	स्त्री	જુઓ 'કૂપી'	देखिए 'कूपी'	see 'कूपी'
કૂપો	कूपो	पु	જુઓ 'કૂપો'	देखिए 'कूपो'	see 'कूपो'
કૂભી	कूभी	स्त्री	જુઓ 'કૂભી'	देखिए 'कूभी'	see 'कूभी'
કૂવળ	कूवळ	न	ઘઉંનુ પરાળ	गेहूँ का पयाल	stalks of wheat
કૂવાડિયો	कूवाडियो	न	એક વનસ્પતિ-છોડ	एक पौधा	oval-leafed cassia
કૂળુ	कूळु	वि	કુમળુ, કૂળ	कोमल, नाजुक	tender
કૃત	कृत	वि	કરેલુ, બનાવેલુ	किया हुआ, बनाया हुआ, कृत	made, done
		पु	કૃતયુગ	सतयुग, कृत-युग	the golden age
		न	1 કર્મફળ 2 ચારની સપ્યા	कर्मफल, कृत 4 की सख्या	fruit of action number four

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
श्रुतार्थ	कृतकार्य	वि	1 पोतानु श्रुत, पोतानी इरुण पूरी करी थूक्यु छोय अेवु 2 तेना सतोषवाणु	सफलमनोरथ, कृतकार्य सतुष्ट, कृतार्थ	one who has discharged his duty one who is satisfied with having dis- charged one's duty
श्रुतश्रुत्य	कृतकृत्य	वि	जुओ 'श्रुतार्थ'	देखिए 'श्रुतार्थ'	see 'श्रुतार्थ'
श्रुतज्ञ	कृतज्ञ	वि	करेला उपकारनी कर करेनारु, निमडडलाल	एहसानमद, कृतज्ञ	grateful
श्रुतज्ञी	कृतज्ञी	वि	जुओ 'श्रुतज्ञ'	देखिए 'श्रुतज्ञ'	see 'श्रुतज्ञ'
श्रुतनिश्चय	कृतनिश्चय	वि	निश्चय करी जेठेकु	कृतनिश्चय, जिसने पक्का इरादा किया हो	determined
श्रुतार्थ	कृतार्थ	वि	श्रुतश्रुत्य	कृतकृत्य, कृतार्थ	one who has discharged his duty and so satisfied
श्रुतार्थी	कृतार्थी	वि	जुओ 'श्रुतश्रुत्य'	देखिए 'श्रुतश्रुत्य'	see 'श्रुतश्रुत्य'
श्रुताजलि	कृताजलि	वि	छाथ जेडी अजलि करेला छोय अेवु	अजलि जोडे हुए, कृताजलि	giving tribute with folded hands
श्रुतश	कृष्ण	वि	श्याम, शणु	श्याम, काला, कृष्ण	black
श्रुतशमडल	कृष्णमडल	पु	विष्णुनो आठमो अवतार	विष्णु का आठवाँ अवतार, कृष्ण	eighth incarna- tion of Vishnu
		न	आजनी डीडीनी आणु आणुनो वर्तुलाडार शणो भाग	आँख का काला भाग, कृष्णमडल	coloured portion round the pupil of the eye

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કૃષ્ણમુખ	कृष्णमुख	वि	श्याम मुखवाળુ	काले मुँह वाला, कृष्णमुख	black-faced
કૃષ્ણલવણ	कृष्णलवण	न	એક ક્ષાર, સચળ	काला नमक, कृष्णलवण, सचल	kind of salt, natron
કૃષ્ણવલ્લી	कृष्णवल्ली	स्त्री	કાળી તુલસી	काली तुलसी	black holy basil, kind of plant considered holy
કૃષ્ણશૂગી	कृष्णशुगी	स्त्री	કાળા શીંગવાળી, તે-ભેસ	काले सींग वाली भैंस	buffalo with black horns
કૃષ્ણસાર	कृष्णसार	पु	કાળિયાર, મૃગ	कृष्णसार, कृष्णमृग, काला हिरन	black buck
કે	के	अ	અથવા, યા, વા	कि, अथवा, या	or
કેટલુ	केटलु	वि	શા માપનુ-પ્રમાણનુ?	कितना	(inter) how much, how many
કેટલુક	केटलुक	वि	અમુક માપ કે પ્રમાણનુ (અનિશ્ચિતાર્થક)	कुछ, कुछ एक	some, a few, a little
કેટલુએક	केटलुएक	वि	જુઓ 'કેટલુક'	देखिए 'केटलुक'	see 'केटलुक'
કેટલુ બધુ	केटलु बहु	वि	શોડુ કે સાધારણ નહિ, પણ અનિશ્ચિત છતાં પ્રમાણમા ઘણુ (માપ, સખ્યા કે કદ)	कितना, कितना बहुत	how very much, considerable (in size, number or quantity)
કેટલુય	केटलुय	वि	જુઓ 'કેટલુ બધુ'	देखिए 'केटलु बहु'	see 'केटलु बहु'
કેડ	केड	स्त्री	1 શરીરનો મધ્ય ભાગ, કમર 2 કેડો, પીછો, પૂઠ	कमर, कटि पीछा	waist rear, back
કેડવા	केडवा	अ	કેડ સુધી આવે એમ	कमर तक आये ऐसा, कमरभर	up to the waist

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		पु	थेक रोग, डेऽनो वा	एक रोग	kind of disease
डेडियु	केडियु	न	डेऽ सुधी आवे अेपु બદન, બડી	मिरजई	jacket
डेडी	केडी	स्त्री	साकडो पगरस्तो, पगथी	पगडडी	foot-track
डेडे	केडे	अ	पूठे, पाछण	पीठ की ओर, पीछे	behind, after
डेडो	केडो	पु	1 पगरस्तो 2 पीछो, पूठ 3 छेडो, अंत 4 (ला) सताभाशी	पगडडी, पगरस्ता पीछा सिरा, अंत (ला) सताना, परेशानी	footpath, narrow path back end giving trouble
डेड	केद	वि स्त्री	બધનયુક્ત એવી સ્થિતિ	बधनयुक्त कैद, बधन	imprisoned imprisonment
डेडभानु	केदखानु	न	જેલ, ઝાસાગાર, તુરગ	कैदखाना, कारागार	prison
डेदार	केदार	पु, न	1 ખેતર 2 હિમાલયનુ એક શિખર 3 એક રાગ	खेत हिमालय की एक चोटी, केदार एक राग, केदार	field a peak of the Himalayas (of music) a raga
डेदारो	केदारो	पु	એક રાગ	एक राग, केदार	(of music) a raga
डे दी	के दी	अ	કયે દહાડે? કયારે?	किस दिन? कब?	which day? when?
डेदी	केदी	वि पु	1 કેદમા પડેલુ 2 કેદ કરેલુ કેદ કરેલો માણસ, બદીવાન	कैद में पडा हुआ कैद किया हुआ कैदी, बदी	imprisoned imprisoned prisoner
डेनुं	केनु	वि	કોનુ?	किसका?	whose ?
डेक्ष	केफ	पु, स्त्री	નશો, ઘેન	खुमार, नशा	intoxication

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
डेक्षित	केफियत	स्त्री	आधिकाश आगण रणु करती छीक्षत	कैफियत	statement made before an officer
डेम	केम	अ	1 शा करणे? शा भाटे? 2. केवी रीते? 3 प्रश्नार्थसूचक अव्यय	किस कारण? किस लिए? कैसे? प्रश्नसूचक अव्यय, क्यों?	why ? how ? interrogative
डेम डे	केम के	अ	कारण डे	क्योंकि	because, since
डेम जे	केम जे	अ	जुथो 'डेम डे'	देखिए 'डेम डे'	see 'डेम डे'
डेर	केर	पु	मलानाश-जुलम, गण्य	कहर, जुल्म, गजब	destruction, persecution
डेरडी	केरडी	स्त्री	अेक वनस्पति	एक वनस्पति, करील	kind of plant
डेरडुं	केरडु	न	डेरडीनु इण, डेरु	करील का फल, टेंटी	its fruit
डेरडी	केरडो	पु	जुथो 'डेरडी'	देखिए 'डेरडी'	see 'डेरडी'
डेरबो	केरबो	पु	1 अेक नाच, करयो 2 अेमा गवातु गायन 3 अेक राग	एक नाच, कहरवा कहरवा नाच का गीत कहरवा राग	kind of dance musical piece set to such a dance (of music) a raga
डेरल	केरल	पु	मलबार प्रात, डेरण	मालाबार प्रदेश, केरल	the state of Kerala, a Malabar region
डेरण	केरळ	पु	जुथो 'डेरल'	देखिए 'डेरल'	see 'डेरल'
डेरी	केरी	स्त्री	आपानु इण	आम का फल, आम	mango
डेरु	केरु	न	1 डेरडीनु इण	करील का फल, टेंटी	kind of fruit

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 —नु (छठी विभक्ति-नो अर्थ बतावे छे)	-का(छठी विभक्ति के प्रत्यय का अर्थ सूचित करता है)	suffix used in possessive case
केरुल	केरुल	न	એક પક્ષી	एक पक्षी	kind of bird
केरोसीन	केरोसीन	न	ગ્યાસતેલ	केरोसिन, मिट्टी का तेल	kerosene
केल	केल	वि	1 એક (વેપારીનો સકેત) 2 કેળવેલો ચૂનો, છોનો શ્રેલ	एक (व्यापारी का सकेत) पीसा हुआ चूना, गच बनाने का चूना	one (used by merchants) prepared lime
केवडियु	केवडियु	वि.	કેવડામા રાખેલુ, તેની સુગંધવાળુ	केवडे में रखा हुआ, केवडे की खुशबू वाला	kept in the blade of agave, having the fragrance of agave
केवडु	केवडु	वि	(માપ, કદ કે વયમા) કેટલુ મોટુ?	कितना	how big, how old?
केवडुક	केवडुक	वि	આશરે કેવડુ?	अदाजन कितना, करीब कितना, लगभग कितना	approximately how big etc
केवडुथ	केवडुथ	वि	અનિશ્ચિત દષ્ટા પ્રમાણમા મોટુ	कितना ही	big enough
केवडो	केवडो	पु	1 એક ઝાડ 2 એનો લેલો	एक पेड़, केवडा केवडे का फूल	agave its flowers
केवरी	केवरी	स्त्री	એક પક્ષી	एक पक्षी	kind of bird
केवल	केवल	वि	1 शुद्ध, निर्मल 2 मात्र, इत 3 એકમાત્ર	केवल, शुद्ध सिर्फ, मात्र, केवल एकमात्र	pure only, mere alone, only one

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		अ	साव, छेड	निपट, बिलकुल	utterly, absolutely
डेवण	केवळ	वि	जुओ 'डेवळ'	देखिए 'डेवळ'	see 'डेवळ'
डेवणप्रयोगी	केवळप्रयोगी	वि	(व्या) डेवण उद्गार दर्शावतो (अव्यय)	(व्या) विस्मयादिबोधक (अव्यय)	exclamatory
डेवु	केवु	वि	क्या प्रकारनु? (प्रश्नार्थक डे उद्गारवाचक)	कैसा? किस तरह का?	of what sort or description? (interrogative or exclamatory)
डेवुक	केवुक	वि	डेवु? (प्रश्नार्थक ने कण्ड अनिश्चितार्थवाचक)	कैसा?	(in an indefinite sense) of what sort or description?
डेवुथ	केवुथ	वि	अज्ञात, अनिश्चित प्रकारनु	कैसा भी	(in an unknown sense) of what sort etc?
डेश	केश	पु	वाण	केश, बाल	hair
डेशर	केशर	न	1 अेड वनस्पति 2. तेना झूलनी वथे अगतो सुगधीदार रेसो-ततु 3 डरडोड झूलनी अडर थतो ततु	केसर, एक वनस्पति केसर के फूल का सुगंध युक्त सीका, केसर फूल के बीच का सीका या रेशा, केसर	a kind of plant saffron filament, stamen
डेशर	केसर	न	जुओ 'डेशर'	देखिए 'डेशर'	see 'डेशर'
डेशवाणी	केशवाळी	स्त्री	सिड डे धोडानी गरदन उपरना डेश	अयाल, केसर	mane of lion or horse
डेशरवारु	केसरवर्णु	वि	डेशरी	केसर के रंग का, केसरिया	saffron- coloured

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કેસરિયાં	કેસરિયા	ન	કેસરી વાઘા પહેરીને યા તો છેલ્લો કસૂબો પીને મરીશ્યા થઈને લડવુ તે	કેસરિયા બાના પહન તથા અફીમ કા આંખિરી ઘોલ પી મરણિયા બનકર લડના	going out for one last desperate fight with saffron clothes on and having taken large doses of opium
કેસરિયુ	કેસરિયુ	વિ	1 કેસરી રગનુ, પીળુ	કેસર કે રાગ કા, પીલા	saffron-coloured
		ન	2 રંગીલુ, ઉમગી, આનદી સ્ત્રીઓને પહેરવાનુ કેસરી રગનુ વસ્ત્ર	આનદી, મૌજી, રંગીલા સ્ત્રિયો કા કેસરી કપડા	gay, joyous saffron-coloured dress worn by women
કેસરી	કેસરી	વિ	કેસરના રગનુ , પીળુ	કેસરિયા, પીલા	saffron-coloured, yellow
		પુ	સિહ, કેશરી	સિહ, કેસરી	lion
કેસૂ	કેસૂ	ન	કેસરી રગના એક જાતના ફૂલ, ખાખરાના ફૂલ	ટેસૂ કે ફૂલ	flowers of butea frondosa
કેસૂડા	કેસૂડા	ન	જુઓ 'કેસૂ'	દેખિય 'કેસૂ'	see 'કેસૂ'
કેસૂડો	કેસૂડો	પુ.	ખાખરો	ટેસૂ (વૃક્ષ), પલાશ	the tree butea frondosa
કેળ	કેલ્	સ્ત્રી	જેને કેળા બેસે છે તે ઝાડ	કદલી, કેલા	plaintain-tree
કેળવણી	કેલ્વણી	સ્ત્રી	1 જુઓ 'કેળવણી' 2 વ્યવસ્થિત ઉછેર, ખિલવણી અને શિક્ષણ	દેખિય 'કેળવણી' વ્યવસ્થિત પાલન પોષણ, વિકાસ ઓર શિક્ષા	see 'કેળવણી' systematic nurture and development

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 शिक्षण, ताळीम 4 ભણતર, વિદ્યા	प्रशिक्षण पढाई, विद्या	training learning, knowledge
કેળવણીકાર	केळवणीकार	पु	કેળવણીના સિદ્ધાંતોનો- તેના શાસ્ત્રનો જાણકાર અથવા તેનો અમલ કરનાર પુરુષ	शिक्षा-शास्त्री	educationist
કેળવવું	केळववु	स क्रि	1 व्यवस्थित રીતે ખીલવવું, ઉછેરવું- સુધારવું-તાલીમ આપવી 2 (કાચ-લોટ)ગૂદીને તૈયાર કરવું 3 (કાચા-ચામડાને)પકવી નરમ ને સફાઈદાર બનાવવું 4 પલોટવું	व्यवस्थित रूप से विकास करना, पालना-पोसना, सुधारना, शिक्षण देना (साना हुआ आटा) गूधकर तैयार करना (कच्चे चमड़े को) कमाना सधाना	to educate to knead to tan to train
કેળું	केळु	न	એક ફળ	केला, एक फल	banana
કેંદ્ર	केंद्र	न	1 મધ્યબિંદુ 2 મધ્ય-મુખ્ય સ્થાન 3 ઇષ્ટ લગ્નશી ગ્રહનું પહેલું અને દશમું સ્થાન	वृत्त का मध्य बिंदु, केन्द्र मध्यवर्ती स्थान, केन्द्र जन्मकुंडली में ग्रह का पहला और दसवाँ स्थान	centre central i e key place term used in astrology
કો	को	अ वि	કોઈ(પ) 1 કોઈ(પ) 2 કોણ	कोई (प) कोई (प) कौन	any some who
કોઈ	कोई	अ	કોમે તે (જણ કે વસ્તુ માટે, અનિશ્ચિતાર્થ- વાચક)	कोई	any

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		वि	ગમે તે (જાણ કે વસ્તુ માટે, અનિશ્ચિતાર્થ-વાચક)	कोई भी	any one or any thing
કોઈએક	कोईएक	वि अ	ગમે તે એક ગમે તે એક	कोई भी एक कोई भी एक	any one any one, some-one
કોઈક	कोईक	वि,अ	જુઓ 'કોઈએક'	देखिए 'कोईએક'	see 'કોઈએક'
કોક	कोक	वि अ पु	ગમે તે એક ગમે તે એક 1 ઊલો 2 દેડકો 3 વરુ 4 ચકવાક, સારસ 5 વિષ્ણુ 6 કોકશાસ્ત્ર બનાવનાર પડિત	कोई भी एक कोई भी एक पडुक, फाख्ता मेंढक, कोक भेडिया चकवा, चक्रवाक विष्णु कोकदेव (आचार्य)	someone any one dove frog wolf saras, crane Vishnu writer of the science of love-making
		न	કોકશાસ્ત્ર	कोकशास्त्र, कामशास्त्र	science of love-making
કોકડી	कोकडी	वि	1 રૂની એક જાત 2 એની બનેલી (ખાદી)	कुकटी इससे बनने वाली (खादी)	variety of cotton cloth made from it
કોકડાવુ	कोकडावु	अ क्रि.	કોકડુ વળવુ , કોકડા જેવુ થવુ	(शरीर या चमडी का) ऐठना, झुर्री पडना	to become stiff, to stiffen
કોકડયો ધુભાર	कोकडियो कुभार	पु	એક પક્ષી	एक पक्षी, महोरवा	kind of bird, pheasant crow
કોકડી	कोकडी	स्त्री	1 નાનુ કોકડુ	कुकडी, लच्छी	small hank of thread

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 चामडी वणी-चडी जय ते, डरयली	झुरी	wrinkle
			3 सूडवेले रायाण	सुखाई हुई खिरनी	a kind of dried fruit
કોકડુ	कोकडु	न	1 શકુ આકારમા વીંટાળેલા સૂતરનો કે કોઈ ઘેરાનો દડો	बडी कुकडी, लच्छा	skein or hank of yarn
			2 ચામડીનુ કે શરીરનુ વળી-ચડી જવુ કે સકોચાવુ	झुरी पडना	wrinkling of skin
			3 (લા) પ્રૂયવાણભર્યું કામકાજ કે મામલો	(લા) पेचीदा मामला	intricate affair or problem
કોકમ	कोकम	न	કોકબ, એક ખાટુ ફળ	एक खट्टा फल	kind of sour fruit
કોકરલી	कोकरली	न	એક પક્ષી	एक पक्षी	kind of bird
કોકરવણ	कोकरवरण	वि	જરાતરા ઊનુ	कुनकुना	lukewarm, tepid
કોકરવાયું	कोकरवायु	वि	જુઓ 'કોકટવરણ'	देखिए 'कोकटवरण'	see 'कोकटवरण'
કોકરવુ	कोकरवु	सक्रि	છેતરવુ, કોસલાવવુ	ठगना, फुसलाना	to cheat, to deceive
		न	કાનનુ એક ઘરેણુ	कान का एक गहना	kind of orna- ment for the ear
કોમળિયુ	कोमळियु	न	ઝાડા અને ઊલટીનો રોગ, કોલેરા	हैजा, 'कोलेरा'	cholera
કોમળો	कोमळो	पु	મો ભરાય એટલુ પાણી-કોઈ પણ પ્રવાહી વસ્તુ	मुँहभर पानी का घूँट या कोई भी तरल पदार्थ	mouthful of water
કોચ	कोच	न	કોચાઈને થયેલુ તે, કાણ	कोचने से बना छेद, छिद्र	hole
		पु	1. સુખાસન, સોફા	कोच, सोफा	sofa

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओयरी	कोचरी	स्त्री	2 छत्रपलंग 3 सुभासनवाणी चार पैडानी गाडी स्त्री (तिरस्कारमा)	छपरखाट बगधी, क्रोच	bedstead four-wheeled carriage
ओयरु	कोचरु	वि.	1 ओचाछ जयेलु, आशावाणु, छिद्रवाणु 2 जरीपुराण, धाणु जनु	स्त्री (तुच्छ अर्थ में) छिद्रालु, छेदवाला, चुभा हुआ	(contempt) woman bored, having holes
ओयलु	कोचलु	न	ओटलु, उठल छोडु (इण छडा वगेरे उपरनु)	बहुत पुराना, जर्जरित छिलका (फल, अंडे आदि का)	very old hard cover, shell of fruit, egg etc
ओयवु	कोचवु	सक्रि	दूभवु	दिल दुखाना	to hurt the feelings of
ओयवु	कोचवु	सक्रि	1 आगु पासवु, शास्वु 2 (घरमा)जातर पासवु	कोचना, चुभाना, छेद करना सेध लगाना	to bore to break into a house for robbing
ओजागरी	कोजागरी	स्त्री	3 (ला) छिल दूभवु, सताववु माणेउठारी (पुनम)	दिल दुखाना, सताना शरत्पूर्णिमा	to hurt the feelings full-moon day of the month of Ashvin
ओट	कोट	पु	1 छिल्लानी दीवाल, रक्षाण माटे करेली भात 2 शत्रु भेदी न शडे ओवी व्यूहरचना	कोट, परकोटा शत्रु न भेदने पावे ऐसी व्यूहरचना	wall of a fort, wall for defence defence strat- egy which is difficult to penetrate

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 વડો	चहारदीवारी, आगन	courtyard
			4 કોટની અદરનો ભાગ	किले का भीतरी भाग	compound inside a fort or wall
			5 ડગલો	बडा अगरखा, कोट	coat
		સ્ત્રી	ડોક, ગળુ	गला, गरदन	neck
કોટકોટાન	कोटकोटान	વિ	કરોડો	करोड़ों	tens of millions
કોટડી	कोटडी	સ્ત્રી	ઓરડી	कोठी	small room, cell
કોટરી	कोटरी	સ્ત્રી	એક પક્ષી	एक पक्षी	kind of bird
કોટલુ	कोटलु	ન	1 કઠણ છોડુ, કોચલુ	कडा छिलका	hard cover, shell
			2 (લા) જોની અદર કંઈ સાર ન હોય તેવી ચીજ	(ला) निस्सार चीज	worthless thing
કોટલો	कोटलो	પુ	જુઓ 'કોઠલો'	देखिए 'कोठलो'	see 'कोठलो'
કોટવાલ	कोटवाल	પુ	1 કોટનો-શહેર કે ગામનો બદોબસ્ત રાખનાર અમલદાર	कोतवाल	chief police officer of a town
			2 એક અટક	एक जातिनाम	a surname
કોટવાલી	कोटवाली	પુ, સ્ત્રી	કોટવાળનું કામ	कोतवाली	work of a कोटवाल
કોટિ	कोटि	સ્ત્રી	1 કરોડ, સો લાખની સખ્યા	कोटि, करोड	ten million, crore
			2 કમાનનો છેડો	कमान का सिरा, धनुष की नोक	end of arch
			3 તકરારના પ્રશ્નની એક બાજુ-પૂર્વ પક્ષ	किसी वाद का मूर्व-पक्ष	one side of a problem or controversy

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 वर्ज, प्रअर 5 ज़ायमा ज़िचु बिट्ट, अतिमता	दर्जा, कोटि, श्रेणी आखिरी दर्जा	kind, sort highest point, zenith, climax
कोटियु	कोटियु	न	1 छोडकु, मछवो 2 मोछडडानी रमतनो अंउ धाव 3 गानवरना जणामा पधातु गोजण लाडकु	छोटी नाव, ड्रॉगो गुल्ती-डंडे का एक दाव जानवरा के गले में बाँधी जानेवाली गोल लकड़ी	small boat a trick or stroke in the game of tipcat round piece of wood tied to the neck of an animal
कोटीऱो	कोटीलो	पु	पीण्जवा भाटे पीण्जानी तातने थडअपवानु ओणर, जोटीऱो	मुठिया (धुनकी की)	dumb-bell like wooden tool of carders for striking the string of the carding-bow
कोटु	कोटु	वि न	आडु, वाडु 1 पक्षीनो भाणो 2 सामो छेतराथ ने आपाने शयधे शाय अेयो पेतरो- पाण्ण	टेढ़ा, बक्र घोसला पेतरेबाजी	crooked nest of bird trick, intrigue
कोठ	कोठ	पु न	अेउ गतनो साप अेउ इण, कोठु	एक प्रकार का साँप कपित्थ, कैथ (फल)	kind of snake wood-apple
कोठड	कोठक	न	अेउ वनस्पति	एक वनस्पति	kind of plant
कोठऱी	कोठली	स्त्री	1 नानी कोठी	कुठली, छोटी कुठिया	small earthen jar

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 नानो कोठलो	मिट्टी की छोटी मजूषा	boxlike structure of bricks or mud
कोठलो	कोठलो	पु	1 माटीनो जनावेलो पटारो (जानानी वस्तुओ मूखवानो) 2 कोठार	मिट्टी की बड़ी मजूषा (खाद्य चीजें रखने की) कोठार, भंडार	boxlike structure of bricks or mud store-room
कोठाय	कोठाय	पु	अेक गतनी रमत	एक खेल	kind of game
कोठायुद्ध	कोठायुद्ध	न	कोठामानु-यकशवामानु-अटपटा दवपेचवाणु युद्ध	चक्रव्यूह युद्ध	fight in an intricate circular battle-array
कोठार	कोठार	पु	1 अनाज भरवानो ओरडो 2 भोयरु के चार भीतो-वाणी यरेली ओथी कोठी 3 भंडार, वजार 4 जगानो	कोठार तहखाना या चार दीवारों का बनाया हुआ पक्का ऊँचा कुठला, कोठा भंडार, बखार खजाना, कोश	store cellar godown treasure
कोठी	कोठी	स्त्री	1 माटी (के धातुनो) ओथो नणो 2 वजार 3 वेपारीनी पेटी-दुकान 4 थाना 5 कोठीना आडारनु दारुजानु 6 सटपामा उतारेली कोठी	मिट्टी या धातु का गोल ऊँचा पात्र, कोठी कोठा, बखार साहूकार की दुकान, पेट थाना कुठिया के आकार की आतिशबाजी चहबच्चे में रखी हुई कोठी	barrel (earthen or metal) godown business shop outpost a barrel-shaped fire-crackery barrel sunk into the ground

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
એઠીમડી	कोठीमडी	સ્ત્રી.	એક વેલો	एक बेल-लता	kind of creeping plant
એઠીમડું	कोठीमडु	न.	એઠીમડીનું ફળ	उसका फल	its fruit
એઠીખંડી	कोठीखंडी	સ્ત્રી.	એઠીમડી	एक बेल-लता	kind of creeping plant, એઠીમડી
એઠીખડુ	कोठीखडु	न.	એઠીમડું	उसका फल	its fruit
એઠું	कोठु	न.	1 પક્ષીનો માળો 2 સામો છેતરાય ને આપણને કાયદો થાય એવો પેતરો-બાજી 3 એઠીનું ફળ	घोंसला पेंतराबाजी, चालबाजी	nest of bird trick or intrigue
એઠો	कोठी	पु.	4 ચહેરો, મોં 1 પેટ 2 શરીર, શરીરની અંદરનો એકપાડા એકરૂપ ભાગ 3 મન, અંતઃકરણ 4 ખાનુ, ઉદા. એઠો પાડીને લખવું 5 (સોગઠા ઇ બાજીનું) ઘર, ખાનું 6 મોટી એઠી, વખાર 7 મોટો ઢૂવો 8 કિલ્લાનો બુરજ	कपित्थ, कैथ (फल) चेहरा, मुँह कोठा, पेट शरीर, शरीर के अन्दर का कोई भी कोषरूप भाग मन, अतकरण खाना, कोष्ठक (चौसर, शतरज आदि का) घर, खाना बखार, गोल बड़ा कुठला बड़ा कुआँ किले का बुर्ज	wood-apple face stomach body, any cellular part of the body mind, con- science column of a table a square in a game (like chess) godown large well battlement

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			9 सुधराઈની મુખ્ય ઓફિસ, મહેસૂલ, વેરો ઇ ના નાણા ભરવાની જગા	મ્યુનિસિપલિટી का मुख्य कार्यालय, कोठी, चुगी, कचहरी	revenue office
			10. રખડતા ઢોર પૂરવાનો ડબો	कॉजी-हाउस	cage for stray cattle
			11. વ્યૂહરચના	व्यूह-रचना	strategy
			12. કોષ્ટક, આકનો પાડો	तालिका, पहाडा	table
			13 અગરખાનો ગળાની આસપાસનો ભાગ	ऑगरखे का गला, गरेबान	part of a coat around the neck
કોડ	कोड	પુ	મનોભાવ, અતરની ઊમેદ	हुलास, मनोभाव, अरमान	inclination, deep desire
કોડામણ	कोडामण	વિ	1 કોડવાળુ, કોડીલુ	हुलासपूर्ण, हुलासी, उमगवाला	eager, ardent
			2 વરણાગિયુ	सजीला, छैला	foppish
કોડિયુ	कोडियु	ન	1 માટીનુ નાનુ શકોરુ	छोटा सकोरा, कसोरा	earthen tray
			2 એ આકારનુ દીવો કરવાનુ પાત્ર	(मिट्टी का) दीया	a lamp-stand of that shape for a wick
કોડી	कोडी	સ્ત્રી	1 એક જાતનુ દરિયાઈ જીવડાનુ ઘર, શખલી	कौडी, एक छोटा शख	sea-shell
			2 એક હલકુ ચલણ	एक छोटा सिक्का, कौडी	a light type of currency
			3 વીસની સખ્યા	बीस की सज्ञा, कौडी	term signifying the number 20, score
		વિ	કુડવાળુ, પાપી	पापी, कपटी	sinner, one who indulges in intrigue

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओडीलुं	कोडीलु	वि.	ओडवाणु	उमगभरा, सजीला, हुलासी	eager, ardent, having various aspirations
ओडु	कोडु	वि.	1 ओडु, रीतभात पगरनु 2 शाभली	उजड्ड, असस्कारी	unmannerly, clumsy
ओढ	कोढ	स्त्री	1 गभारा, ढोरने पधावीनी जगा 2 अरीगर लोडोने आम करवा बेसवानी जगा पु याभडीनो अेक रोग	बहुत छोटा शख पशुशाला, बाडा, अडाड मिस्तरीखाना	small sea-shell, big cowrie manger, cattle-shed place where artisans work
ओढी	कोढी	स्त्री	कुडाडी	सफेद कोढ	a type of skin-disease, leucoderma
ओढो	कोढो	पु	1 कुडाडो 2 ओवाड, ओदाण (ला.)	कुल्हाडी कुल्हाडा अकखड, जबॉदराज, उजड्ड	axe axe stupid
ओरा	कोण	अ वि	क्यु? 1 क्यु? (प्रश्नार्थक बहुधा मारस माटे) 2 ખૂણો	कौन? कौन?	who ? who (usu for a person)
ओरामात्र	कोणमात्र	वि	जेनो डिसाप नडि अेवु	कोण, कोना	angle, corner
ओरियाटवु	कोणियाटवु	सक्रि.	ओरिअे ओरिअे मारवु	जिसकी गिनती न हो, जो कुछ भी न हो	insignificant
ओरि	कोणी	स्त्री	1 ખભા નીચેનો હાથનો (પહેલો)સાધો	कोहनी से पीटना	to strike repeatedly with the elbow
				कोहनी, कुहनी	the elbow

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 એ સાધાનુ અણીદાર હાડકું	कुहनी की नोकदार हड्डी	pointed bone at the elbow
કોણે	कोणे	अ	કોઈએ	किसने	who (instr case of)
કોતર	कोतर	न	જમીન કે પર્વતમા ઊંડો પહોળો ખાડો કે બખોલ	खोह, 'खोखली जगह	ravine
કોતરકામ	कोतरकाम	न	કોતરીને કરેલુ નકશીકામ	नक्काशी, कोरनी	carving, engraving
કોતરણી	कोतरणी	स्त्री	1 કોતરવુ તે 2 કોતરવાની ઢબ 3 કોતરકામ, નકશી 4 કોતરવાની મજૂરી 5 કોતરવાનુ ઓજાર	नक्काशी करना, खोदना खुदाई का ढग खुदाई, नक्काशी खोदने की उज्रत, खुदाई नक्काशी का औजार, टॉकी	act of carving style of carving carvings wages for carving tool for carving
કોતરણ	कोतरण	न	1 ટાકણ 2 ખરપડી 3 ખોતરવાનુ સાધન 4 ખૂદરુ, દોષ	खुदाई का औजार, टॉकी खुरपी कुतरने का आला दोष, ऐब	chisel scraper, digger instrument for picking or probing defect, fault
કોતરલેખ	कोतरलेख	पु	કોતરી કાટેલો લેખ	खुदा हुआ लेख	inscription
કોતરવુ	कोतरवु	सक्रि	આણુ આણુ ખોદવુ, ખોતરવુ, કોરવુ	नक्काशी करना	to gnaw, scratch, carve
કોથમી	कोथमी	स्त्री	જુઓ 'કોથમીર'	देखिए 'कोथमीर'	see 'कोथमीर'
કોથમીર	कोथमीर	स्त्री	ધાણાની ભાજી	धनिया की भाजी	coriander leaves

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओशणी	कोथळी	स्त्री	1 शेळी 2 अडओश 3 હજારની સખ્યા	कोथली अडकोष, फोता हजार की सख्या	small bag covering for testicles term signifying 1000
ओशणो	कोथळो	पु	शेळो	थैला, बीरा	big bag
ओदरा	कोदरा	पु	ओड धान्य	कोदरा, कोदो	kind of corn
ओदरी	कोदरी	स्त्री	ते धान्यना धारा	कोदो के फूटे हुए दाने	its grains
ओदाण	कोदाळ	वि	ओदा जेवु, णाडी बुद्धिदनु	मोटी बुद्धिवाला, कुदजेहन	stupid
ओदाणी	कोदाळी	स्त्री	ओदवानु ओड ओणार	कुदाली	implement for digging, spade
ओ दी	को दी	अ	(प) ओड (दिवस, ड्यारे, डे दी (अ))	कभी, किस दिन, कब	when, some- time
ओनडण	कोनफळ	न	रताणु, सडरड	रतालू	yam
ओनु	कोनु	अ	1 ओनु? डड व्यञ्जितनु? 2 (प) ओडनु	किसका? किसी का (प)	whose? somebody's
ओप	कोप	पु	1 ओध, रोष 2 नाशकारक आशत, गण्य	क्रोध, रोष, गुस्सा नाशकारक आपत्ति, गजब	anger, wrath calamity
ओपटी	कोपटी	स्त्री	पोपडी, डपोटी	पपडी	thin layer or crust
ओपरबरास	कोपरबरास	न	ताणु अने पीतल मणाने अनती ओड धातु	तौबे ओर पीतल के मेल से बनी एक धातु	copper-brass, an alloy of copper and brass

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओपरु	कोपरु	न	नाणियेरनी अदरनो गर, टोपरु	नारियल की गिरी, खोपरा	kernel of coconut
ओपरापाड	कोपरापाक	पु	1 ओपराणा जभाएनी बनावेली अेड भीठाड 2 (कटाक्षमा) मार	खोपडे को रेत कर बनाया हुआ एक पाक (व्यंग्य में) मार	sweetmeat prepared from coconut beating (ironically)
ओपरेल	कोपरेल	न	ओपराणु तेल	खोपरे का तेल	coconut oil
ओपवु	कोपवु	अ क्रि	ओप-गुरसो डरवो	कोपना, गुस्सा करना	to be angry
ओबर	कोबर	न	1 वे पछाड वरथेनो साडडो मार्ग 2 जीएण	घाटी, दो पहाडों के बीच का सकरा मार्ग घाटी, दर्रा, वादी	pass valley
ओबाड	कोबाड	वि न	मूर्ख, भोट, गामडियु नानु ताकु, भडारियु	मूर्ख, गँवार, बौडम छोटा ताक या ताका	foolish, rustic small cup-board or niche in wall
ओबी	कोबी	स्त्री	अेड शाडभाएण- डरमडरली	कोबी, गोभी	cabbage
ओबीण	कोबीज	स्त्री	णुओ 'ओबी'	देखिए 'ओबी'	see 'ओबी'
ओम	कोम	स्त्री	अेड ण नामशी ओणजातो लोडसमूळ (ज्ञाति, धर्म डे णतवारनो)	कोप, जाति	community race
ओमवाड	कोमवाड	पु	णुओ 'ओमीवाड'	देखिए 'ओमीवाड'	see 'ओमीवाड'
ओमल	कोमल	वि	1 डुमणु, मुलायम 2 सुकुमार, नाणुड 3 नरम, मृदु 4 मधुर 5 ध्याणु	कोमल, मुलायम सुकुमार, नाजुक मृदु, कोमल मधुर दयावान	tender, soft delicate gentle sweet kind-hearted

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કોમળ	कोमळ	वि	જુથો 'કોમલ'	देखिए 'कोमल'	see 'कोमल'
કોમી	कोमी	वि	કોમનુ, કોમ સબધી	कौमी, कौम का, जाति - सबधी	communal
કોમીવાદ	कोमीवाद	पु	કેવળ કોમના જ સાકડા હિતાહિતની દૃષ્ટિનો મત	जातिवाद	communalism
કોયડો	कोयडो	पु	1 ગૂથેલો ચાબકો, સાટકો 2 (લા) દોર, સત્તા 3 ત્રાસ, જુલમ, સખ્તાઈ 4 ઝટ ન ઊકલે શકે એવો પ્રશ્ન	चाबुक, कोडा (ला) धाक, सत्ता जुल्म, सख्ती, त्रास पहेली, समस्या, प्रश्न	scourge authority, power tyranny, persecution puzzle, riddle
કોયલ	कोयल	स्त्री	1 એક યક્ષી, કોકિલા 2 એક રમકડુ	कोकिला, कोयल एक खिलौना	cuckoo kind of toy
કોયલી	कोयली	स्त्री	1 ગળાનો એક રોગ 2 બળવુ, બળતરા થવી તે, 3 કોલસાનો ભૂકો (ખાસ કરીને બળેલા ખનિજ કોલસાનો)	गले का एक रोग जलन होना कोयले का चूरा	disease of the throat burning coal-dust
કોયલો	कोयलो	पु	1 કોલસો 2 ઠારેલો કોલસો 3 અગારો	कोयला बुझाया हुआ कोयला अगारा, अगार	coal, charcoal extinguished coal live burning coal
કોર	कोर	स्त्री	1 વસ્તુનો છેડો, કિનાર	कोर, हाशिया, किनारा	edge, border

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 त्या मुड्यानी भात डे पट्टी	किनारी, गोट	long strip attached to cloth for decoration
			3 बाजू	ओर, बाजू	side
			4 बाजू परनो उडडो, थोडोड भाग	किनारा, कोना	small portion
ओरट	कोरट	स्त्री	अदालत	कोर्ट, अदालत	court of law
ओरडु	कोरडु	वि.	1 भीनाश विनानु	कोरा, जो गीला न हो	dry
			2 गागडु	जो भीगा न हो, ठुड्डी (दाना)	hard, not capable of being cooked
ओरडो	कोरडो	पु.	जुओ 'ओयडो'	देखिए 'ओयडो'	see 'ओयडो'
ओरण	कोरण	स्त्री	1 बाजू	बाजू	side
			2 वस्तुनो छेडा परनो भाग, अनो डे सीमा	सिरे पर का हिस्सा या सीमा, कोर, छोर	end part of a thing
			3 धूणनु वावाओडु, आधी	ऑधी	dust-storm
ओरण्णी	कोरण्णी	स्त्री	1 ओरवानु ओणार	कोरने का औजार, टॉकी	instrument for carving
			2. ओरवानी रीत-कारीगरी	कोरने की रीति, कारीगरी	style or art of carving
ओरमु	कोरमु	न.	दाणनो भूडो-चूरो	दाल का चूरा, खुद्दी	coarsely ground pulse
ओरवकु	कोरवकु	वि	ओड बाजुओशी वाकु-दणतु	एक ओर टेढा-ढलता हुआ, तिरछा	slanting or sloping on one side
ओरवु	कोरवु	अ क्रि	1 वांधवु, आणु पाडवु	बेधना, छेदना	to bore, make hole

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 अदृश्यी ओतरपु, आधु जोधपु	कोरना, जरा-जरा खोदना	to carve or dig from within
ओरसशी	कोरसणी	स्त्री	ओरवानु ओणर	कोरने का आला	instrument for carving
ओर	कोरा	प	ओउ पक्षी	एक पक्षी	kind of bird
ओरडु	कोराडु	वि	ओरु, सुडु	कोरा, सूखा	dry
ओरस	कोराण	वि	जुओ 'ओरडु'	देखिए 'ओरडु'	see 'ओरडु'
ओरस	कोराणु	वि	जुओ 'ओरडु'	देखिए 'ओरडु'	see 'ओरडु'
ओर	कोरी	स्त्री	आशरे १, रुपियानी डिमतनु ओउ उथरी रुमानारु	कच्छ का 1/3 रुपए का एक सिक्का	an old silver coin of Kutch of the value of one-third of a rupee
ओरु	कोरु	वि	1 भीनु नलि ओपु, सुडु 2 लूजु 3 वापर्या विनानु तदन नपु (डापड) 4 लभ्या विनानु (पतु, अगण इत्यादि) 5 शधे लु नलि ओपु (सीधु, अनाज)	सूखा रूखा नया, कोरा (कपडा) सादा, कोरा (पत्र, कागज आदि) बिना पकाया हुआ (आटा, चावल, अनाज आदि)	dry barren, fruitless fresh, unused (cloth) blank uncooked (of food-grains)
ओरुड	कोरुक	वि	तदन ओरु	बिलकुल कोरा	completely dry
ओरुडडु	कोरुकडडु	वि	तदन नपु (परा)	बिलकुल कोरा, नया (वस्त्र)	(of dress) brand new
ओरुधाओड	कोरुधाकोड	वि	तदन ओरु	बिलकुल कोरा	quite dry
ओरुधाओर	कोरुधाकोर	वि	जुओ 'ओरुधाओड'	देखिए 'ओरुधाओड'	see 'ओरुधाओड'
ओरुओरु	कोरुकोरु	न	तदन ओरु	बिलकुल कोरा	completely dry

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કોલ	કોલ	પુ	1 વચન, કબૂલાત ખાતરી 2 યુનાની મેળવણીનો ગણ 3 શેરડીનો રસ કાઢવાનો સથો 4 શિયાળ રમકડુ	કોલ, પ્રતિજ્ઞા કબૂલિયત ચૂને મેં મિલાને કા ગારા (ઈંચ કા) કોલ્હૂ સિયાર, ગોદડ ખિલૌના	promise agreement, assurance mortar machine for extracting juice of sugar-cane fox, jackal toy
કોલટાર	કોલટાર	પુ	ખનીજ કોલસાનો ચૂવો, કામર	કોલટાર, તારકોલ	coal-tar
કોલતાર	કોલતાર	પુ	જુઓ 'કોલટાર'	દેખિય 'કોલટાર'	see 'કોલટાર'
કોલમ	કોલમ	પુ, સ્ત્રી ન	કાગરની એક જાત 1 વર્તમાનપત્ર, ગ્રંથ ઇત્યાદિના પાનાના લખાણની ઊભી ઓળ, કટાર 2 વિભાગ, ખાનુ, કોઠો	ધાન કી એક જાતિ કાલમ (અખબાર કા) વિભાગ, ખાના, કોઠા	variety of paddy column section, table
કોલસો	કોલસો	પુ	એક જાતનું બળતણ	કોયલા	coal, charcoal
કોલાહલ	કોલાહલ	પુ	શોરબકોર, ઘોઘાટ	કોલાહલ	noise, din
કોલુ	કોલુ	ન	1 શેરડી પીલવાનો સથો 2 શિયાળ ઘઉંવણ, ગોરુ	કોલ્હૂ (ઈંચ પેરને કા) સિયાર, ગોદડ ગૌર, મેહુઓ	sugar-cane press fox, jackal of the colour of wheat, white
કોલેજ	કોલેજ	સ્ત્રી	મહાવિદ્યાલય, ઉચ્ચ શિક્ષણ માટેનું વિદ્યાલય	કોલિજ	college
કોવડામણ	કોવડામણ	સ્ત્રી	કોવાડાવેલી વસ્તુ, સડો	સડાન, સડાવ	rotten thing

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी-पर्याय
श्रेवडाववुं	कोवडाववुं	स क्रि.	'श्रेवडु'नु प्रेरक	सडाना	to cause to rot
श्रेश	कोश	पु	1 श्रेवडु वस्तु सदरवा-साथववानु पात्र, ज्ञानु, आवरण अथवा धर 2 ભડાર, ખજાનો 3 શબ્દકોશ 4 મ્યાન 5 કૂવામાથી પાણી કાઢવાનુ ચામડાનુ પાત્ર, કોસ	खाना, घर, आवरण खजाना, कोश, भडार शब्दकोश म्यान चरसा, मोट	receptacle for holding things treasure dictionary sheath leather bag or bucket
		स्त्री	1 ખોદવાનુ એક ઓળાર, નરાજ 2. ડળપૂણી	सब्बल, रभा फाल, कुसी (हलकी)	crowbar ploughshare
श्रेशियो	कोशियो	पु.	1 એક પખી 2 કોસ ચલાવનાર- હાકનાર કે તે વડે પાણી કાઢનાર, કુવેતી	एक पक्षी, भुजगा पुरहा, चरसी	kind of bird man working for water - lifting with leather-bucket
श्रेशेटो	कोशेटो	पु	રેશમના કીડાનુ ધર-કોકડુ	रेशम के कीडे का घर, कोया	cocoon of silk- worm
श्रेष	कोष	पु.	જુઓ 'કોશ'	देखिए 'कोश'	see 'कोश'
श्रेषअर	कोषकार	पु	શબ્દકોશ બનાવનાર આદમી, કોશકાર	कोशकार	lexicographer
श्रेषभत्री	कोषमत्री	पु	ખજાનાનો મત્રી, ખજાનથી, કોશમત્રી	खजानची, कोषमत्री, कोषाध्यक्ष	treasurer
श्रेषागार	कोषागार	पु	ખજાનો, ભડાર, કોશાગાર	कोषागार, खजाना	treasure

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
કોષાધ્યક્ષ	કોષાધ્યક્ષ	પુ	કોષનો અધ્યક્ષ- ખજાનચી, ભંડારી, કોષાધ્યક્ષ	કોષાધ્યક્ષ, ખજાનચી	treasurer
કોષ્ટક	કોષ્ટક	ન	1 આડી અને ઊભી સમાતર લીટીઓ દોરવાથી જે થોખૂણી આકૃતિ પડે તે, કોઠો 2 તોલ, માપ, નાણા, વજોરેના હિસાબો સહેલાઈથી કરી શકાય એ માટેનો કોઠો (પરિણામનો)	કોષ્ટક સારણી (પરિમાણ કી)	table of facts and figure table of calculation
કોષ્ઠ	કોષ્ઠ	પુ	1 પેટ, કોઠો 2 પેટનો નીચલો ભાગ, મળાશય 3 કોઠાર	પેટ, કોષ્ઠ મલાશય ભંડાર, કોષ્ઠ	stomach belly store
કોસ	કોસ	પુ	1 કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો કોથળો 2 ગાઉ અથવા દોઢ માઈલનું અંતર	મોટ, ચરસા, પુર કોસ (દૂરી કી નાપ)	leather bag or bucket for drawing water from well distance of one and a half miles
કોસલી	કોસલી	સ્ત્રી	જુઓ 'કોસલુ'	દેખિય 'કોસલુ'	see 'કોસલુ'
કોસલુ	કોસલુ	ન	હળખૂણી	ફાલ (હલ કી)	ploughshare
કોહ	કોહ	પુ	1 કોહવુ તે, સડો 2 ચામડાનો એક રોગ	સડના, સડાવ ચમડી કા એક રોગ	rot disease of the skin
કોહવાણ	કોહવાણ	ન	કોહવાણો, સડો	સડાવ	rotting
કોહવાણ	કોહવાણ	ન	જુઓ 'કોહવાણ'	દેખિય 'કોહવાણ'	see 'કોહવાણ'
કોહવાણો	કોહવાણો	પુ	જુઓ 'કોહ'	દેખિય 'કોહ'	see 'કોહ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ओडवु	कोहवु	अ क्रि	सडवु	सडना	to rot
ओडसा	कोहासा	न	ओड पक्षी	एक पक्षी	kind of bird
ओडेडु	कोहेलु	वि	1 सडेडु 2 जेने ओड थयो डोथ ओवु 3 ओडवण इरे ओवु, थीडरु	सडा हुआ जिसे सडाव लगा हो ऐसा सडाव पैदा करे ऐसा	rotten in which rot has started causing rot
ओण	कोळ	पु	मोटो णडो उडर	घूस (मोटा चूहा)	large-sized rat
ओणवु	कोळवु	अ क्रि	1 जीलवु, डूलवु, पागरवु 2 डेलवु	खिलना, फूलना, पनपना फैलाना	to bloom, to blossom to spread
ओणवु	कोळवु	अ क्रि	डुर्ष डे अभिमानशी डुलवु	हर्ष या गर्व से इतराना, फूला- फूला फिरना	to swell with joy or pride
ओणियु	कोळियु	वि	डिडणमा माय ओटलु, थोडुड	थोडा-सा	that can be contained by the two arms, a little
		न	उडरियु	चूहादान	mouse-trap
ओणियो	कोळियो	पु	मोंमा ओड वार लेवाय ओटलो जोराड-ग्रास	कौर, निवाला ग्रास	mouthful, morsel
ओण	कोळी	स्त्री	ओणानो वेलो	कुम्हडे की बेल, कुम्हडा	creeper of pumpkin
ओणु	कोळु	न	शाड तशीडे वपरातु ओड डुण, डुष्माड	कुम्हडा, कद्दू (फल)	pumpkin
ओटु	कोटु	न	ओटु, पेतरो	धोखा, पैतरेबाजी	intrigue, strategy
ओटो	कोटो	पु	डुरागो	फुनगी, अँखुआ	sprout, shoot
ओतुड	कोतुक	न	1 डुतुडल,	कोतुक, कुतूहल	wonder

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 કુતૂહલ જાગત કરે એવુ ગમે તે 3 નવાઈ, અજાયબી	कुतूहल जगाने वाली चस्तु, कौतुक अचभा, कौतुक	source of wonder surprise, astonishment, wonder jest
ઐવથ	कौवच	स्त्री, न	1 એક વનસ્પતિ 2 એનો ખજૂરીવાળો ફાફો	केवॉच, कौंच खुजली पैदा करने वाली इसकी फली	kind of nettle, cowitch its pod
કૌસ	कौस	पु	કસ, લખાણમા વપરાતુ (), [], { } આવુ ચિહ્ન	कोष्ठक, 'ब्रेकेट'	bracket
ક્યામત	क्यामत	स्त्री	મરણ બાદ ખુદા આગળ ઊભા થઈને જવાબ આપવાનો દિવસ, ઈશ્વર આગળનો ઈ-સાફનો દિવસ	क्यामत	dooms day, the day of judgement
ક્યારડી	क्यारडी	स्त्री	નાનો ક્યારડો	धान का छोटा खेत, क्यारी	small bed
ક્યારડો	क्यारडो	पु	જેમા પાણી ભરાઈ રહે એવુ પાળ બાધેલુ ખેતર (ડાગર વગેરેનુ)	धान का मेंडदार खेत, धनकर	paddy field
ક્યારી	क्यारी	स्त्री	1 નાનો ક્યારો 2 પાણી પાવુ પડે તેથી જમીન 3 પાણી ભરાઈ રહે એવી જમીન 4 ખેડાણ જમીન	छोटी क्यारी, थाला सिचाई करनी पडे ऐसी जमीन पानी भरा रहें ऐसी जमीन, क्यारी, कियारी बोई-जौती जाने वाली जमीन	small bed land which needs irrigation land where water may accumulate land under cultivation

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
કચારે	क्यारे	अ	કચે વખતે?	कब?	when?
કચારેક	क्यारेक	अ	કોઈક વખતે	कभी, किसी समय	some time, at times
કચારેય	क्यारेय	अ	ગમે ત્યારે, કદી પણ	कभी भी	any time, ever
કચાસ	क्यास	पु	1 અટક, ધારણા 2 કિંમતની આકર્ણી, અદાજ	क्यास, धारणा, अनुमान कीमत की अकाई, अदाज	guess, conjecture estimate
કચા	क्या	अ	કઈ જગાએ?	कहाँ? किस स्थान पर?	where?
કચાક	क्याक	अ	કોક જગાએ	कही, किसी जगह	somewhere
કચાચ	क्याच	अ	કોઈ પણ જગાએ	कही भी, किसी भी जगह	anywhere
ક્રમ	क्रम	पु	1 એક પછી એક આવે એવી વસ્તુસકલ્પના 2 શ્રેણી, હારમાળા 3 ડગલુ, પગલુ 4 ધારો, રિવાજ 5 આક્રમણ, હુમલો 6 સંગીતમાં એક અલંકાર	क्रम, सिलसिला, तरतीब श्रेणी, पक्ति डग, कदम रिवाज, प्रथा हमला, आक्रमण संगीत में एक अलंकार	order (of things etc) series step, stage custom, tradition attack (of music) a figure
ક્રમબદ્ધ	क्रमबद्ध	वि	નિયત ક્રમવાળુ	क्रमयुक्त, क्रमबद्ध	in regular order
ક્રમભંગ	क्रमभंग	पु	ક્રમ-નિયમનો ભંગ	तरतीब का टूट जाना, क्रमभंग	breach of order
ક્રમાંક	क्रमांक	पु	અનુક્રમ પ્રમાણેનો નંબર	क्रमांक, क्रमसंख्या	number in order
ક્રમિક	क्रमिक	वि	1 એક પછી એક-ક્રમ પ્રમાણે આવે એવું 2 વંશપરંપરાગત	क्रमागत, क्रमिक कुलक्रमागत	in order from generation to generation

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
કચ	क्रय	पु	ખરીદ્યુ તે, ખરીદ	क्रय, खरीद	purchase, marketing
કાત	क्रात	वि	1 अतीत, चीतेलु 2 आक़ात	अतीत, बीता हुआ, क़ात आक़ात	past, gone overcome, crossed
કાતદર્શી	क्रातदर्शी	वि	1 अतीत, अनागत तथा सूक्ष्म पदार्थ જોઈ શકનારુ 2 વસ્તુનુ રહસ્ય જોઈ શકનારુ 3 સર્વજ્ઞ	क्रातदर्शी, भूत-भविष्य और सूक्ष्म पदार्थों को देखने वाला वस्तु का रहस्य देखने वाला सर्वज्ञ, क़ातदर्शी	able to see beyond the visible able to see the secret of things omniscient
કાતિ	क्राति	स्त्री	1 એક સ્થાનેથી બીજે સ્થાને જવુ તે, ગતિ 2 ધરમૂળથી ફેરફાર, પરિવર્તન, ઊથલપાથલ	जाना, गति भारी उलट-फेर, पूर्ण परिवर्तन, क़ाति	act of going, movement revolution, radical change
કાતિકર	क्रातिकर	वि	કાતિ-પરિવર્તન કરનારુ	क्रान्तिकारी, भारी परिवर्तन कर देनेवाला	revolutionary
કાતિકરક	क्रातिकारक	वि	જુઓ 'કાતિકર'	देखिए 'क़ातिकर'	see 'क़ातिकर'
કાતિકારી	क्रातिकारी	वि	જુઓ 'કાતિકર'	देखिए 'क़ातिकर'	see 'क़ातिकर'
કાતિવૃત્ત	क्रातिवृत्त	न	સૂર્યની ગતિથી જે ગોળાકાર રેખા ખગોળમા થતી કલ્પાય છે તે, સૂર્યમાર્ગ	क्रान्तिवृत्त, क्रान्ति- मडल, सूर्य का भ्रमण मार्ग	sun's apparent orbit, the ecliptic
ક્રિયા	क्रिया	स्त्री	1 કાર્ય, કર્મ 2 સસ્કારવિધિ, ક્રિયામાણ	क्रिया, कर्म, कार्य सस्कार विधि, क़्रिया	action, deed ritual, ceremony, rite

गुजराती शब्द	देग नागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			3 काम करवानी रीत, कृति अमल	काम करने की विधि, क्रिया	method of doing, execution
डियात्मक	क्रियात्मक	वि	1 अमली 2 प्रयोगात्मक	अमली, क्रियात्मक प्रयोगात्मक	executive experimental
डियानाम	क्रियानाम	पु	डियापदना लिंग, वचन वगेरे जेना पर आधार शब्दे छे ते पद (व्या.)	वह पद जिस पर क्रिया के लिंग वचनादि आधार रखते हैं (व्या.)	(gram) word determining the gender, number etc of a verb in a sentence, subject
डियापद	क्रियापद	न	डिया बतावनारु पद (व्या.)	क्रियावाचक शब्द, क्रिया (व्या.)	verb
डियापूरक	क्रियापूरक	वि	डियानो अर्थ पूरो करनार (पद के पदो) (व्या.)	क्रिया का अर्थ पूर्ण करने वाला (पद) (व्या.), कर्मपूर्ति	complement
डियाइल	क्रियाफल	न	डियानु-कर्मनु परिणाम	कर्म का परिणाम, क्रियाफल	fruit of action
डियाइण	क्रियाफळ	न	जुओ 'डियाइल'	देखिए 'डियाइल'	see 'डियाइल'
डियायोग	क्रियायोग	न	1 डियापद साथे-नो सबध(व्या.) 2 उपायो योजवा ते 3 देवतानु आराधन, देवमदिर बनाववा इत्यादि पुण्यकर्म 4 योगनो अब्यास शरु शरु ते माटे करवानी साधनरुप कर्म	क्रिया के साथ सबद्ध - क्रियायोग (व्या.) उपाय करना देवता का आराधन, देवमदिर बनवाना आदि पुण्यकर्म क्रियारूप योग-तप, स्वाध्याय के साधन-कर्म, क्रियायोग	relation with the verb application of remedies deeds of religious merit like building temples etc things to be done as a means for the proper study of yoga

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ક્રિયાવાચક	ક્રિયાવાચક	વિ	જેનાથી ક્રિયાનો બોધ શાય એવું	ક્રિયા કા અર્થ દેનેવાલા, ક્રિયાવાચક	suggestive of action
ક્રિયાવિશેષણ (અભ્યય)	ક્રિયાવિશેષણ (અભ્યય)	ન	ક્રિયાપદના વિશેષણ તરીકે વપરાતો શબ્દ (વ્યા)	ક્રિયાવિશેષણ (વ્યા)	(gram) adverb
ક્રિયાવિશેષણ વાક્ય	ક્રિયાવિશેષણ વાક્ય	ન	ક્રિયાવિશેષણનું કામ કરતું ઉપવાક્ય	ક્રિયાવિશેષણ વાક્ય	adverbial clause
ક્રોધ	ક્રોધ	પુ	ગુસ્સો	ક્રોધ, ગુસ્સા	anger
ક્રોધી	ક્રોધી	વિ	ક્રોધવાળું	ક્રોધી, ગુસ્સૈલ	angry
ક્રોસ	ક્રોસ	પુ	1 ચોકડી-ઘાટનો વધસ્તંભ 2. ખ્રિસ્તી ધર્મચિહ્ન	સ્ત્રી, ક્રૂસ, વધસ્તંભ ઈસાઈયો કા ધર્માચિહ્ન, ક્રૂસ	scaffold for execution Christian's religious symbol
કિવનાઈન	કિવનાઈન	ન	સિઝોના નામના ઝાડની છાલનું સત્વ, તાવની એક દવા	કુનેન, કિવનાઈન	quinine
કિવનીન	કિવનીન	ન	જુઓ 'કિવનાઈન'	દેખિય 'કિવનાઈન'	see 'કિવનાઈન'
ક્ષણ	ક્ષણ	પુ, સ્ત્રી	1 વખતનું એક માપ, સેકન્ડનો ઠાપ ભાગ 2 (લા) છેક જ જૂજ સમય	4/5 સેકન્ડ, છન, ક્ષણ (લા) બહુત થોડા સમય	measure of time, four-fifth of a second moment
ક્ષણજીવી	ક્ષણજીવી	વિ	ક્ષણ સુધી જ જીવે કે ટેક એવું	ક્ષણજીવી	momentary, short-lived
ક્ષણભગુર	ક્ષણભગુર	વિ	ક્ષણમા નાશ પામે એવું, નશ્વર	ક્ષણભગુર, ક્ષણભર મેં મિટ જાને વાલા, નશ્વર	transient, perishable
ક્ષણિક	ક્ષણિક	વિ	ક્ષણનું, ક્ષણભગુર	ક્ષણસ્થાયી, ક્ષણિક	momentary
ક્ષત	ક્ષત	વિ	1 ઈજા પામેલું, જખમી 2 ઓછું થયેલું	ઘાયલ, ક્ષત ઘટા હુઆ	wounded lessened, decreased

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ક્ષતિ	ક્ષતિ	ન સ્ત્રી	નાનો છેદ, ઘા 1 નુકસાન, હાનિ 2 ઊણપ, ખોડ 3 કલક 4 ક્ષત, ઘા	ઘાવ, ક્ષત હાનિ, ક્ષતિ ઘાટા, દોષ કલક ચોટ, ઘાવ, ક્ષતિ	small wound harm, damage fault, defect stigma wound
ક્ષત્રવટ	ક્ષત્રવટ	સ્ત્રી	જુઓ 'ક્ષત્રીવટ'	દેખિયે 'ક્ષત્રીવટ'	see 'ક્ષત્રીવટ'
ક્ષત્રાણી	ક્ષત્રાણી	સ્ત્રી	ક્ષત્રિય જાતિની સ્ત્રી, રજપૂતાણી	ક્ષત્રાણી, ક્ષત્રિયા, રાજપૂતાણી	woman of Kshatriya caste
ક્ષત્રિય	ક્ષત્રિય	વિ	જેનો ધર્મ પ્રજાનુ સરક્ષણ કરવાનો છે તે વર્ણનુ	ક્ષત્રિય વર્ણ કા	of Kshatriya caste
		પુ	તે વર્ણનો પુરુષ	ક્ષત્રિય, ક્ષત્રિય જાતિ કા પુરુષ	member of Kshatriya caste
ક્ષત્રીવટ	ક્ષત્રીવટ	સ્ત્રી	ક્ષત્રિય જાતિનુ બિરદ	ક્ષત્રિય જાતિ કા વિરુદ	title or honour of Kshatriya caste
ક્ષમ	ક્ષમ	વિ	1 સહન કરી શકે એવુ 2 સાધી શકે એવુ 3 સમર્થ, શક્તિમાન 4 યથાર્થ, યોગ્ય 5 ધીરજવાળુ	સહન કરને મેં સમર્થ, ક્ષમ સાધન મેં સમર્થ સમર્થ, શક્તિમાન યોગ્ય, યથાર્થ, ક્ષમ ધીરજવાલા	able to endure able to accomplish capable, powerful proper, fit patient
ક્ષમતા	ક્ષમતા	સ્ત્રી	1 ક્ષમા આપવી તે 2 ખમી લેવુ તે 3 સામર્થ્ય, શક્તિ 4 યોગ્યતા, લાયકાત 5 ધૈર્ય રાખવુ તે	ક્ષમા દેના સહન કરના સામર્થ્ય, ક્ષમતા યોગ્યતા, ક્ષમતા ધીરજ ધરના	forgiving endurance power, capability propriety, worth being patient
ક્ષમવુ	ક્ષમવુ	સ ક્રિ	ક્ષમા આપવુ, ખમી લેવુ	માફ કરના	to forgive

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
क्षमा	क्षमा	स्त्री	ખામોશી, દરગુજર કરવું તે, માફી	क्षमा, दरगुजर, माफी	forgiveness, pardon
क्षमापन	क्षमापन	न	क्षमा मागવી તે	माफी माँगना	asking forgiveness
क्षमावत	क्षमावत	वि	क्षमाવાળું	क्षमायुक्त, क्षमावान	of forgiving nature
क्षमावान	क्षमावान	वि	જુઓ 'ક્ષમાવત'	देखिए 'क्षमावत'	see 'क्षमावत'
क्षमाशील	क्षमाशील	वि	જુઓ 'ક્ષમાવત'	देखिए 'क्षमावत'	see 'क्षमावत'
क्षम्य	क्षम्य	वि	ક્ષમા આપી શકાય એવું, ક્ષમાપાત્ર	क्षमा करने योग्य, क्षम्य	pardonable
क्षय	क्षय	पु	1 ક્ષીણ થવું-ઘસાઈ જવું તે, ઘટાડો 2 નાશ 3 ક્ષય રોગ	क्षीण होना नाश, ह्रास, क्षय यक्ष्मा रोग, क्षय	wasting away, wearing out destruction tuberculosis
क्षयग्रंथी	क्षयग्रथि	स्त्री	ક્ષયને લીધે થયેલી ગાંઠ	क्षय रोग में होने वाली गिलटी, क्षयग्रथि	tumour of T B
क्षयतिथि	क्षयतिथि	स्त्री	જેનો લોપ થતો હોય તે તિથિ	क्षयतिथि, लुप्त तिथि, अवम तिथि	date not counted in a lunar month
क्षयरोग	क्षयरोग	पु	એક રોગ	यक्ष्मा, क्षय	tuberculosis
क्षयरोगी	क्षयरोगी	पु	ક્ષય રોગવાળો માણસ	क्षयरोगी, क्षयी	person suffering from T B
		वि	ક્ષયરોગ થયો હોય તેવું	क्षयरोग वाला, क्षयी	consumptive
क्षयी	क्षयी	वि	ક્ષયવાળું	क्षयी, क्षय रोगी	having consumption
क्षात्र	क्षात्र	वि	ક્ષત્રિયનું-ને લગતું	क्षत्रिय-संबंधी, क्षात्र	of or about a Kshatrya

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		न	1 क्षत्रियनु उर्म 2 क्षत्रियपाणु 3 क्षत्रियोनो समूह, क्षत्रिय जाति	क्षत्रिय का कर्म, क्षात्र क्षत्रियत्व, क्षात्र क्षत्रिय जाति, क्षात्र	duty of a Kshatriya Kshatriyahood Kshatriya caste or race
क्षार	क्षार	वि पु	ખારુ ખારાશવાળુ તત્વ	खारा, क्षार क्षार तत्व	salt saltish element
क्षारभूमि	क्षारभूमि	स्त्री	ખારટવાળી જમીન	क्षार भूमि, ऊसर	salt land
क्षारभूमी	क्षारभूमी	स्त्री	જુઓ 'ક્ષારભૂમિ'	देखिए 'क्षारभूमि'	see 'क्षारभूमि'
क्षितिज	क्षितिज	स्त्री	આખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય છે એ કલ્પિતરેખા, દૃષ્ટિમર્યાદા	क्षितिज, दृष्टिसीमा	horizon
क्षीर	क्षीर	न	1 દૂધ 2 પાણી 3 ખીર 4 ઝાડનુ દૂધ	दूध, क्षीर जल, क्षीर दूध-भात की एक बानगी पेड़ का दूधरूप रस, क्षीर	milk water preparation of milk and rice sap
क्षुद्र	क्षुद्र	वि	નજીવુ, તુચ્છ, પામર	तुच्छ, पामर, क्षुद्र	insignificant, mean, low
क्षुधा	क्षुधा	स्त्री	ભૂખ	भूख, क्षुधा	hunger
क्षेत्र	क्षेत्र	न	1 જમીન, ખેતર 2 સ્થાન, જગા 3 કાર્ય કે ધધાનો અવકાશ, મોકળાશ 4 શરીર, દેહ 5 જાત્રાનુ ઠેકાણુ, તીર્થ 6 સરણગણ 7 સ્ત્રી	जमीन, खेत स्थान, क्षेत्र कार्य के लिए अवकाश, क्षेत्र देह तीर्थ स्थान, क्षेत्र समरागण पत्नी, स्त्री	land, field place scope body place of pilgrimage battlefield wife

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
क्षेत्रत्रिकोणमिति	क्षेत्रत्रिकोणमिति	स्त्री	समतलत्रिकोणमिति 'ट्रिगोनामेट्री' (ग.)	'ट्रिगोनोमेट्री' (ग.) क्षेत्रत्रिकोणमिति	trigonometry
क्षेत्रपाल	क्षेत्रपाल	पु	1 जेतरेनो रभेवाण, जेडूत 2 जेतरेनु रक्षेण करनार देव 3 स्वामी, राजा 4 'फ़िल्डर' (क्रिकेट एँ समतमा)	खेत की रखवाली करनेवाला, क्षेत्रपाल खेत की रखवाली करने वाला देवता स्वामी, राजा 'फील्डर' (खेल में)	guard of a field, farmer deity guarding the field master, king (cricket) fielder
क्षेत्रपाण	क्षेत्रपाळ	पु	जुओ 'क्षेत्रपाल'	देखिए 'क्षेत्रपाल'	see 'क्षेत्रपाल'
क्षेत्रक्षल	क्षेत्रफल	न	1 क्षेत्रनो विस्तार 2 जमीननी लबाएपडोणाएनु माप, 'अेरिया' (ग.)	क्षेत्र का विस्तार जमीन की लबाई- चौडाई का गुणनफल, क्षेत्रफल, 'एरिया' (ग.)	area of a place (arith) area
क्षेत्रक्षण	क्षेत्रफळ	न	जुओ 'क्षेत्रक्षल'	देखिए 'क्षेत्रक्षल'	see 'क्षेत्रक्षल'
क्षेत्रभूमिति	क्षेत्रभूमिति	स्त्री	समतलभूमिति, 'प्लेइन ज्यामेट्री'	क्षेत्रभूमिति, 'प्लेइन ज्योमेट्री'	plain geometry
क्षेत्रमापन	क्षेत्रमापन	न	क्षेत्रने मापवु ते उे तेनी विद्या	क्षेत्र को मापना या उसकी विद्या	measuring land or science of measuring land
क्षेत्रमिति	क्षेत्रमिति	स्त्री	जुओ 'क्षेत्रमापन'	देखिए 'क्षेत्रमापन'	see 'क्षेत्रमापन'
क्षेप	क्षेप	पु	1 ड़ेडु-नाणी देवु ते 2 गाणवु-गुमाववु ते (समयनु)	फेंकना, क्षेप बिताना, गँवाना (समय)	throw, hurl waste, loss (time)
क्षेपड	क्षेपक	वि	धुसाडेडु, पाएणशी उमेरेडु	पीछे से मिलाया-बढाया हुआ, क्षेपक	interpolated, added later
		पु	1 नाजनार पुरुष 2 उमेरो, पाएणशी उमेरेली वस्तु	फेंकने वाला, क्षेपक पीछे से बढाई हुई वस्तु	one who throws thing interpolated or added later

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
क्षेपणी	क्षेपणी	स्त्री	1 छलेसु 2 माछला पकडवानी जाल 3 कुस्तीनो अेक दाव 4 अेक अस्त्र	डॉड, क्षेपणी मछली पकडने का जाल, क्षेपणी कुशती का एक दाव एक अस्त्र	oar fishing net trick in wrestling kind of weapon that is hurled
क्षेम	क्षेम	वि	1 सुखशांति आपनारु	सुख शान्ति देनेवाला, क्षेम	conferring happiness
		न	2 सुखशांतिवाणु, आपाए 1 सुखशांति	सुख शान्ति वाला, सुखी सुखशान्ति, क्षेम, कुशल श्रेय, मगल, क्षेम आरोग्य	happy, prosperous happiness, comfort well-being health
क्षेमकुशल	क्षेमकुशल	वि	सुखशांति अने आरोग्यवाणु	सुखशान्ति और आरोग्य-वाला	happy and healthy
		न	तेवी स्थिति के तेना समाचार	ऐसी स्थिति या उसके समाचार	state of happiness and health or the news of happiness and health
क्षेमकुशल	क्षेमकुशल	वि, न	जुओ 'क्षेमकुशल'	देखिए 'क्षेमकुशल'	see 'क्षेमकुशल'
क्षोभ	क्षोभ	स्त्री	1 पृथ्वी 2 अेकनी सभ्या	पृथ्वी, धरती एक की सख्या	the earth figure one
क्षोभ	क्षोभ	पु	1 मननो गभराट, व्यग्रता 2. ओसारे जावो-शरमावु ते 3 जणजणट	मन की व्याकुलता, क्षोभ लज्जित होना हलचल, खलबली, क्षोभ	agitation, shaking feeling ashamed commotion

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખ	ख	पु	1 ક્રઠસ્થાની બીજો વ્યંજન	कवर्ग का दूसरा व्यजन	fifteenth letter of the Devanagari alphabet
		न	2 સૂર્ય 1 પોલાણ, આકાશ 2 શૂન્ય, મીડુ 3 હરકોઈ નક્ષત્રથી દસમું નક્ષત્ર	सूर्य शून्य स्थान, आकाश शून्य, बिंदु लग्न से दसवाँ स्थान	the sun space, the sky zero tenth constellation
ખઈ	खई	पु	1 ક્ષયરોગ 2 ખાઈ	क्षय रोग खाई, खदक	tuberculosis moat, ditch
ખખ	खख	वि	ખખળી ગયેલું, જીર્ણ	जीर्ण	very old, worn out
ખખડબજ	खखडबज	वि	1 (ખાસ કરીને વૃદ્ધ દેખા)મજબૂત બાધાનું 2 દમામદાર, ભવ્ય	(प्राय वृद्ध फिर भी) मजबूत गठनवाला रोबदार, भव्य	strong (though old) grand, magnificent
ખખડવુ	खखडवु	अ क्रि	ખડખડ એવો અવાજ થવો, ખડખડવુ	खडकना, खडखडाना, बजना	to rattle
ખખડાટ	खखडाट	पु	(રવ) ખખડવાથી થતો અવાજ	खडखडाहट	rattling noise
ખખડાવવુ	खखडाववु	स क्रि	1 ખડખડ અવાજ કરવો 2 (લા) ધમકાવવુ 3 મારવુ (જેમ કે ઘોલ)	खडखडाना, खटखटाना धमकाना (ला) मारना (चपत)	to make a rattling sound to scold, rebuke to beat, thrash
ખખરવુ	खखरवु	अ क्रि	1 લાગવુ, બળાપો-શોક થવો, સાલવુ 2 ખૂંચવુ (આખમા)	लगना, कुटन या शोक होना, अखरना चुभना (आँख में)	to feel (loss etc), grieve to prick

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			३ ખખળવુ, ખાધાનુ હાલી ઊઠવુ, ખખ-જીર્ણ-અશક્ત થવુ	जराग्रस्त होना, अशक्त होना, जीर्ण होना	to be shaken
ખખરી	खखरी	स क्रि स्त्री	દુઃખ દેવુ 1 ગળામા ખાઝેલો કંકુ કે ખાધેલી વસ્તુનો ભાગ 2 ગાતી વખતે સૂર કપાવવો તે 3 સૂર, અવાજ 4 ધિતા, ચટપટી	दुख देना खखार गाते समय सुर को कपाना सुर, आवाज चिंता, खटका	to give pain obstruction in the throat tremor of voice while singing tune, voice worry, fretfulness
ખખરો	खखरो	पु	1 શોક, સતાપ 2 પસ્તાવો, પશ્ચાતાપ 3 શક, અદેશો	शोक, सताप पछतावा, पश्चाताप शक, अदेशा	condolence regret, remorse doubt, suspicion
ખખળતુ	खखळतु	वि	1 ખૂબ ઊનુ, ઊકળતુ 2 ખળ ખળ કરતુ વહેતુ	खौलता हुआ, अत्युष्ण, उबलता हुआ कलकल करते बहता हुआ	boiling, very hot flowing with rippling sound
ખખળવુ	खखळवु	अ क्रि	1 (રવ) ખૂબ ઊનુ થવુ, ઊકળવુ 2 વહેતા ખળખળ અવાજ કરવો 3 ખાધાનુ હાલી ઊઠવુ, ખખ-જીર્ણ-અશક્ત થવુ	खौलना, उबलना बहते हुए कलकल ध्वनि करना अजर-पजर ढीले हो जाना, जीर्ण-शीर्ण होना	to be boiled to murmur, make rippling sound to be shaken, be worn out or old
ખખ	खग	पु	1 પક્ષી 2 ગ્રહ	पक्षी, खग ग्रह	bird heavenly body, planet

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 तारो	तारा	star
			4 सूर्य	सूर्य	the sun
			5 દેવ	देवता	God, deity
			6 નવની સજ્ઞા	नौ की सख्या	nine
ખગપતિ	खगपति	पु	1 પક્ષીઓનો રાજા-ગરુડ 2 હસ	गरुड, खगपति हस	king of birds, eagle swan
ખગોલ	खगोल	पु	ગગનમડળ	खगोल, आकाशमंडल	the sky, firmament
ખગોળ	खगोळ	पु	જુઓ 'ખગોલ'	देखिए 'खगोल'	see 'खगोल'
ખચ	खच	अ	ખેચીને, સખત રીતે	कसकर, मजबूती से	tightly
ખચકાવું	खचकावु	अ क्रि	1 અચકાવુ, અટકવુ 2 પાછા પડવુ	झिझकना पीछे हटना, हिचकना	to hesitate, stop hold back
ખચકો	खचको	पु	1 સપાટી પર પડેલો ખાડો-ખાચો 2 અટકાવ, અતરાચ	खॉचा अटकाव, बाधा	depression, cavity obstruction, obstacle
ખચર	खचर	न	ખચ્ચર	खच्चर	mule
ખચરી	खचरी	स्त्री	ખચ્ચરની માદા	खच्चर की मादा	female mule
ખચરુ	खचरु	न	1 જુવાનનુ મરણ 2 નિર્માલ્ય-ખચ્ચર જેવુ ઘોડુ	जवान की मृत्यु निकम्मा या खच्चर जैसा घोडा वृद्ध, कमजोर	death of a young man worthless horse (like mule) old, weak
ખચવુ	खचवु	स क्रि	1 જડવુ, બેસાડવુ 2 ખીચોખીચ ભરવુ-લાદવુ	जडना, बैठाना खचाखच भरना, लादना	to set, inlay, fix to stuff, load heavily
ખચાખચ	खचाखच	स्त्री	(રવ)ખચ ખચ,	जल्दी जल्दी चुभाने की आवाज	the sound of ખચ ખચ

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખચાખચી	खचाखची	वि	ખીચોખીચ	खचाखच	crowded, stuffed
ખચીત	खचित	अ	ખચીત, અવશ્ય	जरूर, अवश्य	certainly, of course
ખચીત	खचीत	स्त्री	ગિરદી, ભીડ	भीड, जमघट	crowdedness
ખચીત	खचीत	वि	જડેલુ, બેસાડેલુ	जडा या बिठाया हुआ	set, inlaid
ખચીત	खचीत	अ	અવશ્ય, જરૂર	अवश्य, जरूर	certainly, positively
ખચોખચ	खचोखच	अ	1 ભચોભચ 2 ખીચોખીચ	दनादन चुभाते हुए खचाखच	piercing repeatedly tightly crowdedly
ખજા(-જી)નો	खजा(-जी)नो	पु	1 નાણુ રાખવાની જગા, ભંડાર 2 ધન, દોલત 3 હથિયાર ભરવાની ખોલ કે બાકાવાળો પટો 4 બદૂકમાનુ ગોળી ભરવાનુ ખાનુ 5 ચલમમા ગડાકુ મૂકવાનો ખાડો 6 મીઠુ પકવવાનો અગર	खजाना, खजीना धन, दौलत हथियार रखने का खोल, म्यान या छेदोवाला पट्टा बदूक में गोली भरने का दावान चिलम में तम्बाकू रखने का गड्ढा नमक जमाने का गड्ढा, आगर	treasure wealth, riches belt with loops to suspend arm etc magazine (in a rifle) wider end of a tobacco pipe salt-bed
ખજૂર	खजूर	न	એક ફળ, જે સુકાવાથી ખારેક બને છે	खजूर	date fruit
ખજૂરી	खजूरी	स्त्री	1 ખજૂરનુ ઝાડ 2 ખજરુ 3 ખજવાળ લાગે એવા નાના નાના ડાટા 4 ખજવાળ 5 એક મીઠાઈ	खजूर का (पेड़) खजूर (फल) खजोहरा (रोएँदार) काटे खुजलाहट खजूर (मिठाई)	date tree date (fruit) prickly thing causing itching itching kind of sweetmeat

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખજૂરુ	खजूरु	न	ખજૂરીની જાતનુ ઝાડ જેમાથી તાડી નીકળે છે	खजूर (जिसके रस से ताड़ी बनती है)	toddy-palm
ખજૂરો	खजूरो	पु	કાનખજૂરો	कनखजूरा	centipede
ખટ	खट	वि पु अ	છ 1 ઠગ, લબાડ આદમી 2 એક રાગ (૨૫)ખટ અવાજ કરીને	छह ठग, लबाड व्यक्ति एक राग खट की आवाज, खट	six scoundrel a raga (m) sound as of striking
ખટક	खटक	स्त्री	1 ખટકો 2 ચાનક	पश्चाताप आशका, खटका	regret, repentance suspicion, doubt
ખટકરમ	खटकरम	न	1 બ્રાહ્મણે કરવાના છ ધર્મકાર્યો (યજ્ઞ, યાજ્ઞ, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ) 2 ધર્મ સબધી નિત્યકર્મ	खटकरम धर्म-सबधी नित्यकर्म	six duties performed by a Brahmin daily religious rituals
ખટકર્મ	खटकर्म	न	જુઓ 'ખટકરમ'	देखिए 'ખટકરમ'	see 'ખટકરમ'
ખટકવુ	खटकवु	अ क्रि	1 કાકરીની પેઠે ખૂચવુ, ભોંકવુ, સાલવુ 2 અદરશી લાગવુ, પશ્ચાતાપ થવો	खटकना पश्चाताप होना	to prick, pierce, pinch to rankle, hurt
ખટકો	खटको	पु	1 ખટકવુ તે કે તેનો અવાજ યા પીડા 2 હરકત, નકતર 3 શક, અદેશો	खटका, चुभन, चुभने की आवाज, खटक अडचन, बाधा, रुकावट खटका, शुभहा, आशका	hurt, pricking impediment, obstacle doubt, suspicion

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખટખટ	खटखट	स्त्री	4 ચાનક, કાળજી 1 ખટખટ એવો અવાજ 2. હરકત, નડતર 3 પચાત, માથાકૂટ	चिन्ता, खटका खटखट की आवाज, खटखट अडचन, बाधा झमेला, खटराग, खटखट	care, alertness clicking sound obstacle botheration
ખટખટારો	खटखटारो	पु	કટાળો આવે એવી માથાઝીક, કચકચાટ	किच-किच, खटखट	wrangling, botheration
ખટગુણ	खटगुण	पु	છ ગુણ (ઉદ્યોગ, સાહસ, ધૈર્ય, બળ, બુદ્ધિ ને પરક્રમ)	छ गुण (उद्योग साहस, धैर्य, बल, बुद्धि और पराक्रम)	the six virtues (industry, adventure, patience, power, intelligence and heroism)
ખટચક્ર	खटचक्र	न	શરીરની અદરના છ ચક્રો	षटचक्र, शरीर के अदर के छ चक्र	(in Yoga) the six mystical centres or circles in the body -
ખટદર્શન	खटदर्शन	न	હિંદુ તત્વજ્ઞાનના છ શાસ્ત્રો-દર્શનો (સાખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત)	षटदर्शन, हिन्दु तत्वज्ञान के छ दर्शन, (साख्य, योग, न्याय, वैशेषिक, मीमांसा और वेदान्त)	the six systems of Indian philosophy
ખટનટ	खटनट	वि	નટખટ, પ્રપચી	नटखट, प्रपची	scheming, intriguing
ખટપટ	खटपट	स्त्री	1 યુક્તિપ્રયુક્તિથી કામ સાધી લેવાની તજ્જની, પ્રાપચિક ગોઠવણ	खटपट, युक्तिबाजी से काम करवाने की कोशिश	wire-pulling, intrigue

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 गौठवार 3 कटाकूट, पथात	योजना, व्यवस्था खटपट, झंझट	arrangement hackwork, botheration
ખટપટિયુ	खटपटियु	वि	1 ખટપટવાળુ, કડાકૂટિયુ 2 ખટપટી, કારસ્તાની	पेचीदा, टेढा उकता देनेवाला खटपटिया, चालबाज	bothersome scheming
ખટપટી	खटपटी	वि	ખટપટિયુ, કારસ્તાની	खटपटिया, चालबाज	scheming, intriguing
ખટપદ	खटपद	पु	1 છ પગવાળા પ્રાણીઓનો વર્ગ 2 ભમરો 3 મધમાખ 4 જૂ	छ पैरों वाले प्राणी का वर्ग, षटपद भ्रमर मधुमक्खी जू, ढील	class of creatures having six legs wasp bee louse
ખટમધુર	खटमधुर	वि	કઠક ખાટા અને કઠક મીઠા સ્વાદવાળુ	खटमीठा	tasting sweet and sour
ખટમધુરુ	खटमधुरु	वि	જુઓ 'ખટમધુર'	देखिए 'ખટમધુર'	see 'ખટમધુર'
ખટમલ	खटमल	पु	માકડ	खटमल	bed-bug
ખટમીઠુ	खटमीठु	वि	ખટમધુરુ	खटमीठा	sweet and sour
ખટરસ	खटरस	पु	છ સ્વાદ (ખાટો, ખારો, કડવો, તૂરો, તીખો અને ગળ્યો)	छ प्रकार के स्वाद, षडरस	six primary tastes
		वि	છ રસ-સ્વાદવાળુ, બધા રસવાળુ	छ प्रकार के स्वादों वाला, षडरस	having the six tastes
ખટરાગ	खटराग	पु	1 છ રાગ (એક મત પ્રમાણે ભૈરવ, માલકોશ, હિડોળ, શ્રીરાગ, કેદાર અને મલહાર)	छ राग, षडराग (एक मत के अनुसार भैरव, मालकोश, हिडोल, श्रीराग, केदार और मल्हार)	six principal ragas

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખટલો	खटलो	पु	2 કઞ્ઞિયો, આગબનાવ 3 સાસારિક જઞ્ઞાળ, કડાકૂટ 1 કુટુબકબીલો, પરિવાર રસાલો 2 સરસામાન, સરજામ 3 મુકદ્દમો 4 ગૂચવાણવાળુ મુશ્કેલ કામ	कजिया, अनबन झझट, बखेडा कुटुब, कबीला सरोसामान, सामग्री मुकद्दमा पेचीदा, मुश्किल काम	quarrel, disagreement worldly trouble and anxiety family paraphernalia trial complicated job
ખટવવુ	खटववु	स क्रि	1 ખટાશ થડે એમ કરવુ 2 'ખાટવુ' નુ પ્રેરક, ખટાવવુ	खट्टा बनाना फायदा पहुँचाना	to make sour, caus of 'ખાટવુ'
ખટશાસ્ત્ર	खटशास्त्र	न	જુઓ 'ખટદર્શન'	देखिए 'ખटदर्शन'	see 'ખટદર્શન'
ખટાઈ	खटाई	સ્ત્રી	1 ખાટાપણુ 2 ખાટી વસ્તુ	खट्टापन, खटाई खट्टी चीज, खटाई	sourness sour thing
ખટાખટ	खटाखट	अ	ખટાખટ એવો અવાજ કરીને	खटाखट आवाज के साथ	with sound of machines at work
ખટાટોપ	खटाटोप	સ્ત્રી	(લા) કઞ્ઞિયો, તકરાર,	(ला) कजिया, तकरार	quarrel
		पु	આડબર, (ખોટો) મોટો દેખાવ	आडबर, अनावश्यक बडा आयोजन, भारी दिखावा	showy
ખટાપટી	खटापटी	સ્ત્રી	1 ગરબડ 2 કઞ્ઞિયો, તકરાર	गडबड खटापटी, अनबन, झगडा	bustle, din quarrel
ખટારો	खटारो	पु	1 ભાર ભરવાનુ ગાડુ	माल ढोने का वाहन (बडी बैलगाडी), सगड	truck

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 तेना જેવું મોટું વાહન, ભારની 'મોટર-લોરી'	वैसा कोई अन्य वाहन, 'मोटरलारी'	motor-lorry
			3 કર્કશ અવાજ કરે એવું-ખરાબ વાહન	कर्कश आवाज करने वाला खराब वाहन	rattling vehicle
			4 ઘરવાખરો	घर-गृहस्थी की चीजें, घरबार	household
ખટાવવું	खटाववुं	स क्रि	'ખટાવું', 'ખાટવું' નું પ્રેરક	'ખટાવું', 'ખાટવું' કા પ્રેરણાર્થક સ્વ	caus of 'ખાટવું', 'ખટાવું'
ખટાવું	खटावुं	अ क्रि	1 ખટાશ થડવી, ખાટુ થવું 2 'ખાટવું' નું કર્મણિ	खटाना, खट्टा हो जाना 'ખાટવું' ક્રિયા કા કર્મણિ સ્વ	to go sour passive of 'ખાટવું'
ખટાશ	खटाश	स्त्री	1 ખાટાપણ 2 અણબનાવ	खटास, खट्टापन अनबन, बिगाड	sourness ill-feeling
ખટુબડું	खटुबडुं	पु	થોડું ખાટું	थोडा खट्टा	little sour
ખટુમડું	खटुमडुं	पु	જુઓ 'ખટુબડું'	देखिए 'खटुबडुं'	see 'ખટુબડું'
ખડ	खड	न	1 ઘાસ, કડબ 2 ખેતરમા ઊગેલું નકામું ઘાસ, નીંદામણ	खड, घास चिखुरन, खेत में होनेवाला निकम्मा घास	grass weed
ખડક	खडक	पु	1 પાણીમાનો કે જમીન ઉપરનો પથ્થરનો ટેકરો 2 ખરાબો, ધારદાર ભેખડ 3 એક પ્રકારની ચૂડી	चट्टान धारदार कगार एक तरह की चूडी	stone rock morass, precipice kind of bangle
ખડકલો	खडकलो	पु.	ખડકેલી ચીજોનો જથ્થો, ઢગલો	गट्ठा, ढेर	heap, stack
ખડકવું	खडकवुं	स क्रि	ઉપરઉપરી ગોઠવવું	एक पर एक क्रम में रखना, लादना	to-heap

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખડકી	खडकी	સ્ત્રી.	1. ઘર આગળની બાધેલી-બારણાવાળી છૂટી જગા, ડેલી 2. બે અથવા વધારે ઘર આગળની એક સામાન્ય દરવાજાવાળી ગલી કે શેરી 3. એવી જાતની-દરવાજાવાળી રચના અથવા એની ઉપરની ડેલી	પૌરી, ડ્યોટી દો યા જ્યાદા ઘરોં કે આગે કી એક હી આમ દરવાજે વાલી ગલી इस तरह के दरवाजे पर का बालाखाना	parlour corridor balcony
ખડખડ	खडखड	अ સ્ત્રી	(૨૫) ખડખડ એવો અવાજ કરીને (૭૨૫) 1. એવો અવાજ 2. ખટખટ, ડખડ, પીડા, ઉપાધિ 3. તકરાર, ખટખટ	खिलखिलाकर, खुलकर (हँसना) खिलखिलाहट खटपट, दखल, पीडा, बखेडा तकरार, षड्यंत्र	(of laughter) loudly, boisterously sound as of laughing loudly making intrigues, interference, trouble quarrel
ખડખડતુ	खडखडतु	वि न	ખડખડ અવાજ કરતુ 1. સૂકું નાળિયેર 2. ખરતરફ થવુ તે	खडखडाता हुआ बिना पानी का सूखा नारियल बरतरफ होना	making a rattling sound dry coconut being dismissed
ખડખડવુ	खडखडवु	अ. क्रि	ખડખડ એવો અવાજ થવો, ખખડવુ	खडखडाना	to rattle
ખડખડિયા	खडखडिया	न	झंझ	झोंझ	cymbals
ખડખડિયુ	खडखडियु	वि.	1. ખડખડ અવાજ કરનારુ	खडखडाता हुआ	making a rattling sound

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 सूक्ष्म नाणियेर	बिना पानी का सूखा नारियल	dry coconut
			3 (ला) भरतरक्ष थपु ते	(ला) बरतरफ होना	being dismissed
			4 એક ખાવાની વાની	एक खाद्य पदार्थ	a dish
			5 વસાય, ખોલાય એવી નાના નાના પાટિયાની બારીબારણામા મુકાતી રચના	झिलमिली	arrangement like venetian shutters
ખડગ	खडग		1 ગેડાનુ શિંગડુ	गेंडे-का सींग	horn of a rhinoceros
			2 એક પ્રકારની ચૂડી	एक तरह की चूड़ी	kind of bangle
			3 તલવાર	तलवार, खड्ग	sword
ખડચપો	खडचपो	પુ	એક જાતનો યમો	एक प्रकार का चपा	kind of flowering tree
ખડતર	खडतर	વિ	1 દુઃખ ખમી શકે એવું, ખરવાણ	कष्ट सहन कर सके ऐसा, कष्टक्षम	able to endure pain
			2 મહેનતુ	मेहनती	industrious
			3 મજબૂત બાધાનુ	मजबूत गठन का	of strong build
			4 તુચ્છ	तुच्छ	insignificant
ખડતલ	खडतल	વિ	જુઓ 'ખડતર'	देखिए 'खडतर'	see 'खडतर'
ખડતાલ	खडताल	સ્ત્રી	1 છ તાલ (સંગીત)	छ ताल (संगीत)	(music) six beats
			2. કરતાલ, કાસીજોડ	करताल, झोंझ	pair of cymbals
ખડતુ	खडतु	ન	ખડખડતુ, રળ, ખરતરફી	मौकफी, बरतरफी	dismissal
ખડતૂસ	खडतूस	ન	જુઓ 'ખડતુ'	देखिए 'खडतु'	see 'खडतु'
ખડદુ	खडदु	ન	1 ખડબુ, પ્રવાહી પદાર્થનું જામેલું ચોસલું	लोदा, आँठी	chunk of ice, soil etc
			2. ખૂદરુ, દિયરુ, દોષ	दोष, ऐब	fault, defect, something having holes

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખડધાન	खडधान	न	1 ખડયા કે વાવ્યા વિના થતુ ધાન 2 હુલકી ગાતનુ અન્ન	बिना जोते या बोये उत्पन्न होने वाला धान्य कदन्न	corn that has grown without being sown corn of inferior quality
ખડખચડુ	खडबचडु	वि	ખાડાખૈયાવાળુ, ઊંચુનીચુ	खुरदरा	rough or uneven
ખડબુ	खडबु	न	ગામી ગયેલા પ્રવાહીનુ ઓસડુ, ખડદુ	लोदा, आँठी, थक्का	chunk of solidified liquid
ખડબૂચ	खडबूच	न	એક રૂળ તરબૂચ	खरबूजा	water-melon
ખડબૂચુ	खडबूचु	न	જુઓ 'ખડબૂચ'	देखिए 'खडबूच'	see 'ખડબૂચ'
ખડભડ	खडभड	સ્ત્રી	1 (રવ) એવો અવાજ 2 ગરબડ, ધાધલ 3 ડ્રિજ્યો, બોલાબોલી 4 દખલ	खडबड (आवाज) गडबड, ऊधम कजिया, कहा-सुनी दखल	rustling sound uproar quarrel interference
ખડભડવુ	खडभडवु	अ क्रि	1 ખડભડ અવાજ થવો 2 બોલાબોલી થવી	खडबडाना कहा-सुनी होना	to make rustling sound to exchange hot words
ખડભડાટ	खडभडाट	पु	1 ખડભડ અવાજ 2 ગરબડ, ધાધલ	खडबड ऊधम, हल्ला-गुल्ला	rustling sound uproar, din
ખડમાકડી	खडमाकडी	સ્ત્રી	એક જીવડુ	एक कीट, 'ग्रासहोपर'	grasshopper
ખડમોસાળ	खडमोसाळ	न	માનુ કે બાપનુ મોસાળ	माँ या बाप का ननिहाल	family or home of father's or mother's maternal uncle
ખડવેવાઈ	खडवेवाई	पु	વેવાઈનો બાપ	समधी का बाप	father of son's or daughter's father-in-law

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખડવેવાણ	खडवेवाण	स्त्री	વેવાઈની મા	समथी की माँ	mother of son's or daughter's mother -in-law
ખડવું	खडवुं	स क्रि	1 ચોપડવું, લેપ કરવો 2 ખરડવું, ડાઘ લગાડવો 3 સડોવવું, આળ મૂકવું	लेप करना, पोतना दागवाला करना, बिगाडना, पोतना ऐब या तोहमत लगाना	to plaster to smear to stain, to stigmatize to implicate, to accuse
ખડશિખી	खडशिबी	स्त्री	એક વનસ્પતિ	एक वनस्पति	kind of plant
ખડસલ	खडसल	पु	મકાનનો પાયો	मकान की नींव	foundation of building
ખડસલિયો	खडसलियो	पु	એક વનસ્પતિ, પિત્તપાપડો	एक औषध, पित्तपापडा	kind of plant
ખડસલિયો	खडसळियो	पु	જુઓ 'ખડસલિયો'	देखिए 'ખડસલિયો'	see 'ખડસલિયો'
ખડા	खडा	સ્ત્રી	1 પાવડી, ચાખડી 2 જોડાની એડી	खडाऊँ, पादुका जूते की एड	wooden sandals heel of shoe
ખડાઉતાર	खडाउतार	વિ	જોડા ઉતારતા વેત-તરત સ્વીકારાય એવી (હુડી)	तुरत, जूते निकालते ही, स्वीकृत हो ऐसी (हुडी)	immediately acceptable (bill of exchange)
ખડાઝી	खडाऊ	સ્ત્રી	1 પાવડી, ચાખડી 2 સૂકું ઘાસ	खडाऊँ, पादुका सूखी घास	wooden sandals dry grass, hay
ખડિયાટ	खडियाट	पु	તળાવમાં ઊતરવાની, ઢાળ પડતી પણ ખસી ન પડાય એવા અણતરવાળી, ઓકળીબધ રચના	बिना सीढियों का पक्का ढालू घाट, गऊघाट	sloping but not slippery passage of getting down into and up from a pond
ખડિયુ	खडियु	न	1 સુકવાણ	सूखा, अवर्षण, अकाल	drying up of crop

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 सुझवाशी तडो पडी छोय तेवी जमीन	जिस में सूखने से दारारे पडी हुई है वैसी जमीन	soil with cracks owing to dry weather
			3 थोभासाभा डेटलाड दिवस परसाए न पडवाशी जे ताप पडे छे ते	वर्षा के दिनों में बारिश न होने से सख्त धूप पडना	hot sun during the monsoon when there is no rain
			4 चित्तो, वाघ	चीता, बाघ	cheetah, tiger
			5 ज्योटडु, गुवान भेस	जवान भैंस, ओसर	young she- buffalo
ખડિયો	खडियो	पु	1 लखवानी शाळी राखवानु पात्र	दीपक के लिए काम आने वाली	small container used as a small- lamp
			2 दीवो डरवानो नानो डवो	डिबिया, टिबरी	cloth-bag with numerous folds
			3 धरा पडवाणी ओणी, जलानी जे तरडू झूलतो नजाय अेवो ओशणी	बहुत खानों वाली थैली, कंधे के दोनों ओर लटकाया जाय ऐसा थैला	inside to be slung down one's shoulder
			4 जलतो, पाटवो	बडा बटुआ	big valet
ખડિયોખાર	खडियोखार	पु	टकराजार	एक क्षार, सुहागा	borax
ખડિયોવાઘ	खडियोवाघ	पु	चित्तो, दीपडो	चीता, तेंदुआ	cheetah, leopard
ખડી	खडी	स्त्री	1 ખડીમાટી 2 રસ્તા પર નજાય છે એવા પથ્થરના કાકરા-મરડિયા	खडिया मिट्टी खडी गिट्टी, ककड	chalk broken pieces of a stone used for road building
			3 વગર વિચાયેલી ભેશ	बिना ब्याही हुई भैंस	she-buffalo which has not conceived
ખડી ફોજ	खडी फोज	स्त्री	કચમી લશ્કર	स्थायी फौज, स्थायी सैन्य	standing army

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખડી માટી	खडी माटी	स्त्री	એક જાતની ધોળી માટી, ખડી	खडिया मिट्टी	chalk, kind of white clay
ખડી સાકર	खडी साकर	स्त्री	એક જાતની સાકર	एक प्रकार की मिसरी	sugar cubes
ખડુ	खडु	वि	1 ઊભુ 2 તત્પર	खडा, लबरूप तैयार, खडा	standing ready, prepared
ખડું	खड्डु	वि	1 અનુભવી 2 હોશિયાર, ચાલાક 3 વયોવૃદ્ધ 4 અપંગ	अनुभवी होशियार, घाघ, चालाक वयोवृद्ध अपंग, अगहीन, अपाहिज	experienced intelligent, smart old crippled
ખણ	खण	સ્ત્રી	વલૂર, ચળ, ખજવાળ	खुजलाहट, चुल	itch, itching
ખણખણ	खणखण	अ	ખણખણ અવાજ શાય એમ	खनखन आवाज के साथ	in a manner making rattling sound
ખણખણવું	खणखणवु	अ क्रि	ખણખણ અવાજ થવો	खनकना, खनखनाना	to rattle (of swords)
ખણખણાટ	खणखणाट	पु	ખણખણ અવાજ	खनकार, झकार	rattling sound
ખણખોજ	खणखोज	સ્ત્રી	1 બારીક તપાસ-શોધ 2 (લા)કોઈના દોષ શોધ્યા-કાઢ્યા કરવા તે, નિંદા કર્યાકરવી તે	बारीक जाँच-पड़ताल हरफगीरी, निंदा, नुक्ताचीनी	minute search, scrutiny slandering
ખણખોત	खणखोत	સ્ત્રી	જુઓ 'ખણખોજ'	देखिए 'ખણખોજ'	see 'ખણખોજ'
ખણખોતર	खणखोतर	સ્ત્રી	જુઓ 'ખણખોજ'	देखिए 'ખણખોજ'	see 'ખણખોજ'
ખણખોદ	खणखोद	સ્ત્રી	ખણખોતર, ખણખોજ	देखिए 'ખણખોજ'	see 'ખણખોજ'
ખણખોદિયું	खणखोदियु	वि	ખણખોદ કરવાની દેવવાળુ	निंदा अथवा नुक्ताचीनी करने की आदत वाला	slandering, malicious

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખણખોળ	खणखोळ	स्त्री-	ખણખોદ, ખણખોળ	नुक्ताचीनी	slander
ખણજ	खणज	स्त्री	ખણવાળ, વલૂર, ચળ	खुजलाहट, चुल	itch, itching sensation
ખણવું	खणवु	स-क्रि	1 ઉઝરડવુ, ખોતરવુ 2. ખોદવુ 3 વલૂરવુ, ખણવાળવું 4 ચીમટી ભરવી (ચૂટી ખણવી)	खरोचना, खनना खोदना खुजलाना चुटकी भरना	to gnaw to dig, to peck to scratch, to itch to pinch
ખણસ	खणस	स्त्री-	1 શક, અ દેશો 2. અટસ, વેરઝેર 3 ખત, હોશ 4 ઝાડા પેશાબની શકા-હાજત 5 આદત, ટેવ	शका, शुबहा कीना, लाग-डॉट तेंदेही, उत्साह पाखाने-पेशाब की हाजत आदत, टेव	doubt, suspicion enmity, malice industry, zeal inclination to urinate or defecate habit
ખત	खत	न	લેખ, લખત, દસ્તાવેજ	खत, लेखपत्र, दस्तावेज	document, bond
ખતપત્ર	खतपत्र	न-	ખત કે તેને લગતા કાગળિયા	दस्तावेज या इससे संबद्ध कागजात	document or papers relating to it
ખતપત્તર	खतपत्तर	न-	જુઓ 'ખતપત્ર'	देखिए 'खतपत्र'	see 'खतपत्र'
ખતમ	खतम	अ	ખલાસ, સમાપ્ત	खतम, खत्म, समाप्त	finished, ended
ખતરો	खतरो	पु-	1. ભય, જોખમ 2. અદેશો, સંદેહ	खतरा, भय, धोखा अदेशा, शक	danger, risk doubt, suspicion
ખતવણી	खतवणी	स्त्री-	ખતવવુ તે	खतियौनी, खतौनी	(book-keeping) posting

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખતવવું	खतववुं	स क्रि	(शेज्जेणमानी રકમ) ખાતાવાર નોંધ કરવી	खतियाना, खाते में चढाना	to enter into account-books
ખતા	खता	स्त्री	1 नुकसान, ठोकर 2 थूँड	नुकसान, ठोकर खता, चूक	loss, mistake error
ખતાબ	खताब	स्त्री	1 ભૂલ, ખામી 2 આરોપ, દોષ દેવો તે 3 શાપ, બદદુઆ	भूल, दोष आरोप, दोष लगाना, आक्षेप, दोषारोपण शाप, बददुआ	defect, mistake accusation curse
ખતા	खत्ता	स्त्री	જુઓ 'ખતા'	देखिए 'ખતા'	see 'ખતા'
ખતો	खत्तो	पु	1 કામળો, ધાબળો 2 ઠોકર 3 ધપ્પો	कबल, धुस्सा ठोकर धौल, चपत	blanket error, striking of one's foot against something slap
ખત્રી	खत्री	वि	ક્ષત્રિયની એક જાત	क्षत्रिय की एक जाति	belonging to a caste of Kshatriyas
		पु	એ -ચાતનો માણસ	उस जाति का व्यक्ति, खत्री	member of that caste
ખત્રાણી	खत्राणी	स्त्री	તેની સ્ત્રી, ખતરણ	खत्रानी, खत्री स्त्री	wife of a Kshatriya
ખદખદવું	खदखदवुं	अ क्रि	1 ખદખદ થવું 2 ખદખદ અવાજ સાથે ઠીકળવું	उबलना 'खदखद' आवाज के साथ उबलना, खदबदाना	to boil to boil with simmering sound
ખદડવું	खदडवुं	स क्रि	1 ખૂબ દોડાવવું, તગેડવું	खूब दौडाना	to make one run fast

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખણખોળ	खणखोळ	સ્ત્રી	ખણખોદ, ખણખોજ	નુક્તાચીની	slander
ખણજ	खणज	સ્ત્રી	ખજવાળ, વલૂર, ચળ	ખુજલાહટ, ચુલ	itch, itching sensation
ખણવુ	खणवु	સ ક્રિ	1 ઉઝરડવુ, ખોતરવુ 2 ખોદવુ 3 વલૂરવુ, ખજવાળવુ 4 ચીમટી ભરવી (ચૂટી ખણવી)	ખરોચના, ખનના ખોદના ખુજલાના ચુટકી ભરના	to gnaw to dig, to peck to scratch, to itch to pinch
ખણસ	खणस	સ્ત્રી	1 શકા, અ દેશો 2 અટસ, વેરઝેર 3 ખત, હોંશ 4 ઝાડા પેશાબની શકા-હાજત 5 આદત, ટેવ	શકા, શુબહા કીના, લાગ-ડોંટ તેદેહી, ઉત્સાહ પાખાને-પેશાબ કી હાજત આદત, ટેવ	doubt, suspicion enmity, malice industry, zeal inclination to urinate or defecate habit
ખત	खत	ન	લેખ, લખત, દસ્તાવેજ	ખત, લેખપત્ર, દસ્તાવેજ	document, bond
ખતપત્ર	खतपत्र	ન	ખત કે તેને લગતા કાગળિયા	દસ્તાવેજ યા ઇસસે સબદ્ધ કાગજાત	document or papers relating to it
ખતપત્ર	खतपत्र	ન	જુઓ 'ખતપત્ર'	દેખિયે 'ખતપત્ર'	see 'ખતપત્ર'
ખતમ	खतम	અ	ખલાસ, સમાપ્ત	ખતમ, ખત્મ, સમાપ્ત	finished, ended
ખતરો	खतरो	પુ	1 ભય, જોખમ 2 અદેશો, સંદેહ	ખતરા, ભય, ધોખા અદેશા, શક	danger, risk doubt, suspicion
ખતવણી	खतवणी	સ્ત્રી	ખતવવુ તે	ખતિયૌની, ખતૌની	(book-keeping) posting

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખતવવુ	खतववु	स क्रि	(शेण्भेणमानी રકમ) ખાતાવાર નોંધ કરવી	खतियाना, खाते में चढाना	to enter into account-books
ખતા	खता	स्त्री	1 નુકસાન, ઠોકર 2 ચૂક	नुकसान, ठोकर खता, चूक	loss, mistake error
ખતાબ	खताब	स्त्री	1 ભૂલ, ખામી 2 આરોપ, દોષ દેવો તે	भूल, दोष आरोप, दोष लगाना, आक्षेप, दोषारोपण	defect, mistake accusation
			3 શાપ, બદદુઆ	शाप, बददुआ	curse
ખતા	खता	स्त्री	જુઓ 'ખતા'	देखिए 'ખતા'	see 'ખતા'
ખતો	खतो	पु	1 કામળો, ધાબળો 2 ઠોકર	कबल, धुस्ता ठोकर	blanket error, striking of one's foot against something
			3 ધખો	धौल, चपल	slap
ખત્રી	खत्री	वि	ક્ષત્રિયની એક જાત	क्षत्रिय की एक जाति	belonging to a caste of Kshatriyas
		पु	એ ન્યાતનો માણસ	उस जाति का व्यक्ति, खत्री	member of that caste
ખત્રાણી	खत्राणी	स्त्री	તેની સ્ત્રી, ખતરણ	खत्रानी, खत्री स्त्री	wife of a Kshatriya
ખદખદવુ	खदखदवु	अ क्रि	1 ખદખદ થવુ 2 ખદખદ અવાજ સાથે ઊકળવુ	उबलना 'खदखद' आवाज के साथ उबलना, खदबदाना	to boil to boil with simmering sound
ખદડવુ	खदडवु	स क्रि	1 ખૂબ દોડાવવુ, તગેડવુ	खूब दौडाना	to make one run fast

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ફેરા ખવડાવવા, અથડાવવું	भटकाना, चक्कर कटवाना	to dodge, to make one come repeatedly
			3 ખૂબ મહેનત આપવી	कठोर परिश्रम कराना, कसना	to make one work very hard
ખદડુ	खदडु	वि	ઘટ પોતનુ જાડુ (કપડુ)	ठोस बुनाई का मोटा गाढा (कपडा)	coarse cloth of thick texture
ખદેડવુ	खदेडवु	स क्रि	જુઓ 'ખદેડવુ'	देखिए 'ખદેડવુ'	see 'ખદેડવુ
ખદડ	खदड	वि	જુઓ 'ખદેડુ'	देखिए 'ખદેડુ'	see 'ખદેડુ'
ખનખન	खनखन	स्त्री	1 છદ, વ્યસન 2 ખત 3 તપાસ, ખણખોદ	चसका, लत, व्यसन तँदेही, धैर्य बारीक जाँच, नुकताचीनी	addiction perseverance deep investigation, minute scrutiny
			4 શકા, હાજત (ઝાડાપેશાબની) ખણસ	पाखाने-पेशाब की हाजत	defecating or urinating feeling
ખપ	खप	पु	1 વાપર, વપરાશ 2 ઉપયોગ, અગત્ય, જરૂર 3 તંગી, ખોટ 4 માલનો ઉપાડ, ખપત	उपयोग, प्रयोग, व्यवहार जसरत, उपयोगिता, महत्व कमी, तंगी खपत, बिक्री	use need, necessity want, scarcity demand, consumption
ખપજોગુ	खपजोगु	वि	ઉપયોગ પૂરતુ, જોઈતુ	जसरत के मुताबिक, यथावश्यक	as per requirement
ખપત	खपत	स्त्री	વેચાણ, ઉપાડ	खपत बिक्री	sales, consumption

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખપતુ	खपतु	वि	1 વપરાય એવું ઉપયોગી 2 વેચાય એવું 3 વ્યવહારમાં ચાલે એવું, લેવાય ખવાય એવું	काम में आए ऐसा, उपयोगी बिक जाए ऐसा व्यवहार्य, जो खान-पान में लिया जाए	usable that which can be sold acceptable, that which can be eaten or taken
ખપનુ	खपनु	वि	ઉપયોગી	उपयोगी, कार-आमद	useful
ખપરડી	खपरडी	स्त्री	1 નાનો ખપરડો 2 ખપેડો	छोटा टट्टर टट्टी उगते पौधों को खा जाने वाला कीड़ा	small mat or curtain of bamboo chips kind of insect eating up shoots of plants
ખપરડો	खपरडो	पु	વાસની ચીપોની સાદડી-ટટ્ટી	बॉस की फट्टियों का टट्टा, टट्टर	mat or curtain made out of bamboo
ખપવુ	खपवु	अ क्रि	1 વેચાવું, ઉપાડ હોવો 2 વપરાવું, ખરચાવું, ખતમ થવું 3 લેખાવું, ગણાવું 4 વહેવારમાં ખપતું હોવું 5 જોઈવું, કામ લાગવું	खपना, बिकना खपना, खर्च होना, समाप्त होना गिनती में होना, कुछ महत्व का होना व्यवहार में चले ऐसा होना काम में आना, लगना, उपयोगी होना	to sell to be used up to be considered to be of utility to be put to good use
ખપાટ	खपाट	स्त्री	કામઠું, વાસની-લાકડાની ચીપ	खपची, कमठी, खपटी	bamboo chip
ખપાટિયુ	खपाटियु	न	1 ખપાટ, વાસની ચીપ	खपची, बॉस की खपटी	bamboo chip

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 वासनु—लाडलानु झाडियु 3 अेड वनस्पति	बॉस या लकडी का फट्टा, खपाच एक वनस्पति	bamboo or wood chip kind of plant
ખપૂસવુ	खपूसवु	अ क्रि स क्रि	ખતશી પાછળ લાગવુ —મડવુ, એકધ્યાન થવુ મારવુ, ઝૂડવુ	लगे रहना, दत्तचित्त होना, एक ध्यान होना पीटना, ठोकना	to persevere, to pursue intently, to be engrossed to beat, to thrash
ખપેડી	खपेडी	स्त्री	1 ઊગતા છોડ ખાઈ જનારુ એક જીવડુ 2 છોડુ, પોપડો 3 ગૂગુ	उगते पौधों को खा जानेवाला एक कीड़ा छिलका, पपडी नकटी, गुजी	kind of insect eating up shoots of plants crust, scale dried mucus of the nose
ખપેડો	खपेडो	पु.	1 ખપરડો, વાસની ટટ્ટી 2 પાલખમા વપરાતો વાસનો ત્રાપો	बॉस की टट्टी, टट्टर मचान के काम में आने वाला टट्टर, पाड	bamboo curtain or mat raft-like structure of bamboo used in scaffolding
ખપોટી	खपोटी	स्त्री	1 એક જાતની રેતી 2 ભિગડુ, પોપડી 3 કપોટી	एक प्रकार की रेत खुरड, पपडी पपडी (रोटी की)	kind of sand scale, crust crust
ખપોટુ	खपोटु	न	પાતળુ છોડુ, ભિગડુ	पतला छिलका, खुरड	thin scale, outer layer of a fruit or vegetable
ખપોડી	खपोडो	स्त्री	જુઓ 'ખપોટી'	देखिए 'खपोटी'	see 'खपोटी'
ખખર	खप्पर	न	1 જેમા આવેલુ બધુ નાશ પામે એવુ પાત્ર(દેવીનુ)	(देवी का) खप्पर	bowl (of a goddess) in which everything that is put is destroyed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 એરી નારિયેળીનું કે બીજું કોઈપણ બિક્ષાપાત્ર	भिक्षापात्र, खप्पर	begging bowl of poisonous coconut or any other material
ખફમી	खफगी	स्त्री	ખફાપણ, નાખુશી, ઈતરણ, રોષ	रोष, नाराजगी, खफगी	displeasure, anger
ખફા	खफा	वि	નાખુશ, ક્રોધાયમાન	रुष्ट, नाराज, खफा	angry
ખખડ	खबड	वि	જાડુ, ઘટ્ટ (દૂધ)	गाढा (दूध)	thick (milk)
ખખડદાર	खबडदार	वि	1 હોશિયાર, કાબેલ 2 સાવધ	होशियार, चालाक सावधान, खबरदार	smart, clever cautious, careful
ખખડદારી	खबडदारी	स्त्री	1 હોશિયારી, કાબેલિયત 2 સાવધાની	खबरदारी, होशियारी सावधानता, खबरदारी	smartness, cleverness caution, care
ખખડુ	खबडु	न	જાડુ પડ કે ઘર-ખખોટું	मोटी परत या स्तर, पपडी	thick crust or layer
ખખર	खबर	पु, स्त्री	1 સમાચાર, ખાતમી 2 સંદેશો, કહેણ 3 જાણ, જ્ઞાન, ભાન 4 નજર, સભાળ	खबर, समाचार सदेशा, सूचना जानकारी, पता, ज्ञान निगरानी, देखभाल	news, information message knowledge awareness care
ખખરઅતર	खबरअतर	पु, स्त्री	1 માહિતી, સમાચાર 2 તબિયતના સમાચાર	खबर, समाचार, सूचना स्वास्थ्य के बारे में पूछताछ	information, news news about health
ખખરદાર	खबरदार	वि	જુઓ 'ખખડદાર'	देखिए 'ખખડદાર'	see 'ખખડદાર'
ખખરદારી	खबरदारी	स्त्री	જુઓ 'ખખડદારી'	देखिए 'ખખડદારી'	see 'ખખડદારી'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખબરપત્રી	खबरपत्री	पु.	(છાપામાં) ખબર મોકલનાર	सवाददाता	reporter
ખબૂસવુ	खबूसवु	स क्रि	મારવુ, ઝૂડવું	मारना, पीटना	to beat, to thrash
ખબ્બડ	खब्बड	वि	જુઓ 'ખબડ'	देखिए 'ખબડ'	see 'ખબડ'
ખભળવુ	खभळवु	अ क्रि	1 (રવ.) ખળખળ અવાજ થવો 2 હાલી ઊઠવુ, તળે ઉપર થવુ 3 (લા) મનમાં અજબો થવો, ગભરાવુ	खलबलाना हलचल मचना, तले-ऊपर होना (ला) क्षुब्ध होना, घबडाना	to make a rippling sound to be shaken very much to be puzzled or restless
ખભળાટ	खभळाट	पु	જુઓ 'ખળખળાટ'	देखिए 'ખળખળાટ'	see 'ખળખળાટ'
ખભો	खभो	पु	ધડને હાથ જ્યા જોડાય છે તે અવયવ	कधा	shoulder
ખમચવુ	खमचवु	अ क्रि	ખચાવુ, અટકવુ	रकना, झिझकना, हिचकिचाना	to hesitate
ખમચાવુ	खमचावु	अ क्रि	જુઓ 'ખમચવુ'	देखिए 'ખમચવુ'	see 'ખમચવુ'
ખમણ	खमण	न	1 છીણીને ક્ષેત્રો છૂંધે 2 જુઓ 'ખમણટોકળા'	कद्दूकश पर रेतી हुई चीज देखिए 'ખમણટોકળા'	small scrapings or gratings see 'ખમણટોકળા'
ખમણટોકળા	खमणढोकळा	न	એક ખાવાની વાની, ખમણવાળા ટોકળા	दाल और चावल के दरदरे आटे की एक खाद्य चीज	a dish
ખમણવુ	खमणवु	स क्रि	છીણવુ	कद्दूकश पर रेतना	to scrape, to grate
ખમણી	खमणी	स्त्री	ખમણવાનું ઓજાર, છીણી	कद्दूकश, घियाकश	scraper
ખમતલ	खमतल	वि	ખમનારુ, સહન કરનારુ	सहनशील, जो सहन कर सके	capable of enduring

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખમતીઘર	खमतीघर	वि	1 ખમતુ 2 સઘઘર, પૈસાઘર	सहनशील, शक्तिशाली धनी, समृद्ध	able to endure rich, prosperous
ખમતુ	खमतु	वि	1 ખમી શકે એવુ 2 ગજા પ્રમાણેનું 3 સઘઘર, પૈસાઘર	सहनशील, शक्तिशाली बूते-सामर्थ्य के अनुसार समृद्ध, धनी	able to endure according to one's capacity rich, prosperous
ખમવું	खमवु	स क्रि अ क्रि	1 સહન કરવું, સાખવું 2 ક્ષમા કરવી (જૈન) શોભવું	झेलना, सहना, बरदाश्त करना क्षमा करना (जैन) धमना, ठहरना	to endure, to tolerate (Jain) to forgive to stop
ખમા	खमा	स्त्री अ	1 ક્ષમા 2 સબૂરી જુઓ 'ખમ્મા'	क्षमा सब्र, धीरज देखिए 'ખમ્મા'	forgiveness patience see 'ખમ્મા'
ખમાથ	खमाथ	પુ	એક રાગ (સંગીત)	एक राग (संगीत)	(music) a Raga
ખમાચી	खमाची	પુ	જુઓ 'ખમાથ'	देखिए 'ખમાથ'	see 'ખમાથ'
ખમાજ	खमाज	પુ	ખમાથ રાગ (સંગીત)	एक राग (संगीत)	raga 'ખમાથ'
ખમાર	खमार	પુ	દારૂ ગાળનારો	शराब चुआनेवाला	distiller of liquor
ખમીર	खमीर	ન	1 ખટાશ કે આથો ચડાવનારું તત્વ 2 ખટાશવાળું ઉભરણ 3 જોશ, તાકત	खमीर खटासयुक्त उफान जोश, ताकत	yeast, leaven fermentation force, strength
ખમીસ	खमीस	ન	એક જાતનું પહેરણ	कमीज, कमीस	kind of shirt
ખમ્મા	खम्मा	अ	'શુભકુશળ રહો - દુખ ન શાઓ' એવું બતાવતો ઉદ્ગાર	क्षेम-कुशल रहो - दुख न हो - खुदा खैर करे' यह सूचित करने वाला उद्गार	expression of wish that the person addressed be hale and hearty and be free from misery

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખ્યાલ	खयाल	पु	ખ્યાલ	खंयाल, ख्याल	thought, idea
ખરકલો	खरकलो	पु	ઢગલો	ढेर, अबार	heap
ખરખડિયુ	खरखडियु	न	જુઓ 'ખડખડિયુ'	देखिए 'ખડખડિયુ'	see 'ખડખડિયુ'
ખરખબર	खरखबर	पु, स्त्री	સમાચાર	समाचार, खबर	news
ખરખરવુ	खरखरवु	अ क्रि	જુઓ 'ખખરવુ'	देखिए 'ખખરવુ'	see 'ખખરવુ'
ખરખરાખત	खरखराजात	स्त्री	1 પરચુરણ ખર્ચ 2 ઘટ, ખાધ, નુકસાન	फुटकल खर्च घाटा, नुकसान, घट	sundry expenses loss, deficit
ખરખરી	खरखरी	स्त्री	જુઓ 'ખખરી'	देखिए 'ખખરી'	see 'ખખરી'
ખરખરો	खरखरो	पु	જુઓ 'ખખરો'	देखिए 'ખખરો'	see 'ખખરો'
ખરખલો	खरखलो	पु	ખરકલો	अबार, ढेर	heap
ખરખોશ	खरगोश	न	સસલુ	खरहा, खरगोश	hare, rabbit
ખરખોસ	खरगोस	न	જુઓ 'ખરખોશ'	देखिए 'ખરખોશ'	see 'ખરખોશ'
ખરચ	खरच	न, पु	1 વાપર 2 કિમત, લાગત 3 મોટી રકમ વાપરવાનો સારો-નરસો અવસર	खर्च, व्यय कीमत, लागत, खर्चा खूब पैसे खर्च करने का शुभाशुभ अवसर	expense price, cost occasion, good or untoward, to spend on a big scale
ખરચખૂટણ	खरचखूटण	न	1 પરચુરણ-શકલતુ ખર્ચ 2 અવસર વખતે કરવાનું ખર્ચ, વરો	फुटकल या फालतू खर्च शुभाशुभ अवसर पर होनेवाला खर्च	sundry or additional expenditure expenditure incurred on a good or bad occasion

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખરચપાણી	खरचपाणी	न	1 ખરચાપાણી, પ્રસંગ ઉજવવો તે 2 છૂટથી ધન વાપરવું તે 3 ગુજરાનનું સાધન, પરચૂરણ અર્થ	अवसर पर होनेवाला खर्च बहुतायत से धन खर्च करना, मुक्तव्यय खर्च की रकम, निर्वाह खर्च, गुजारे का साधन	expenditure to be incurred on a particular occasion spending lavishly, extravagance means of livelihood or miscellaneous expenditure
ખરચવું	खरचवुं	स क्रि	अर्थ કરવું, વાપરવું	खर्च करना, खरचना	to spend
ખરચાઉ	खरचाउ	वि	1 અર્થ કરે એવું, હાથનું છૂટું 2 મોઢું	खचीला, उडाऊ महंगा, कीमती	extravagant costly
ખરચાળ	खरचाळ	वि	જુઓ 'ખરચાઉ'	देखिए 'ખરચાઉ'	see 'ખરચાઉ'
ખરચાળું	खरचाळुं	वि	ખરચાળ	खचीला, बहुत व्यय करने वाला	expensive, costly
ખરચી	खरची	स्त्री	1 ખરચવાને માટે જોઈતી રકમ 2 ગુજરાનનું સાધન	खर्च के लिए आवश्यक राशि गुजारे का साधन	money required for spending means of livelihood
ખરચીપાણી	खरचीपाणी	स्त्री	ખરચી, ગુજરાનનું સાધન, પરચૂરણ અર્થ	फुटकल खर्च, निर्वाह खर्च	money for spending, means of livelihood
ખરચું	खरचुं	न	મળત્યાગ, ઝડે જવું તે	पाखाना जाना	defecation
ખરચો	खरचो	पु	1 અર્થ 2 ખાપો (વાળ કે છોકનો)	खर्च खँटी खुत्थी (बाल या पौधे की)	expenditure (of plant or hair) stump

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખજ	खरज	पु	૪૬જ-સા સ્વર	खडज, षड्ज (सगीत)	the fourth of the seven primary notes of music
		સ્ત્રી	1 ચામડાનો એક રોગ	खाज, खारिश (रोग)	kind of skin disease, itches
			2 ખજવાળ	खुजलाहट	itch
ખજવુ	खरजवु	न	ચામડાનો એક રોગ	चमडी का एक रोग, खाज	eczema
ખરડ	खरड	સ્ત્રી	ઘાડા રગડાનો લેપ	गाढा लेप	thick plaster
ખરડવુ	खरडवु	સ ક્રિ	1 ખરડ-લેપ કરવો	लेप करना, पोतना, लपेटना	to smear
			2 ખરાબ-મેલુ કરવુ, બગાડવુ	गदा करना, बिगाडना	to soil
			3 સડોવવુ, લખદાવવુ	किसी को किसी मामले में उसकी इच्छा के विरुद्ध शामिल करना, घसीटना	to involve, to implicate
ખરડિયુ	खरडियु	ન	સુકવાણ, દુકાળ જેવુ વર્ષ	अवर्षण, सूखा (वर्ष) अकाल जैसा (वर्ष)	drought, near famine condition
ખરડો	खरडो	પુ	1 ધૂટવાના અક્ષરોનો કાગળ	अक्षर घोटने का कागज, कापी	kind of copy book
			2 કાચુ લખાણ, મુસદ્દો	खर्चा, मसौदा	draft
			3 યાદી	सूची	list
			4 ખરડ, લેપ	गाढा लेप	thick plaster
ખરપડી	खरपडी	સ્ત્રી	ખરપવાનુ ઓળાર	खुरपी	weeder
ખરપડો	खरपडो	પુ	1 મોરી, ખરપડી	खुरपा	large weeder
			2 મોટો તવેશો	बडी खुरचनी, पलटा	iron implement for turning cakes on the baking pan

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 ચામડા ઉઝરડવાનું ઓળાર	खाल उतारने का आला	shoemaker's scraper
			4 કમઅક્કલ ગામડિયો, ગમાર માણસ	गँवार मनुष्य, जडबुद्धि	boor
ખરપણી	खरपणी	સ્ત્રી	એક વનસ્પતિ	एक वनस्पति	kind of plant
ખરપી	खरपी	સ્ત્રી	ખૂરપી, ખરપડી	खुरपी	weeder
ખરપો	खरपो	પુ	ખરપડો	खुरपा	large weeder
ખરબચડું	खरबचड़ु	વિ	ખરબચડું, ખાડાખૈયાવાળું, ઊંચુંનીચું	खुरदरा, नाहमवार, ऊबड़-खाबड़	uneven, rough
ખરવડ	खरवड	સ્ત્રી	1 ઝાડની છાલ ઉપરનો સુકાયેલો ભાગ 2 (ભાત, દૂધ ઇ મા) નીચે ઢાંચીને વળતું ખબડું, ખરેટો	पेड़ की छाल का ऊपर का सूखा हिस्सा (भात, दूध आदि में) नीचे जमने वाला पपड़ा	dry scales on the bark of a tree scrapings of cooked rice or milk (hardened element sticking in a pot)
ખરવા	खरवा	પુ	પશુઓની ખરીમા કીડા પડીને થતો એક રોગ	खुरपका, खुरा (रोग)	disease affecting the hoofs of animals
ખરવાડ	खरवाड	સ્ત્રી	ગામનું પાદર, જ્યાં ખળા કરાય છે	गाँव के पास की जमीन जहाँ खलिहान होते हैं	village common ground where farmers thrash their corn
ખરવાણ	खरवाण	વિ	દુઃખ ખમી શકે એવું, ખડતલ	सहनशील, कष्टक्षम	one who is able to endure, hardy
ખરવું	खरवुं	અ ક્રિ	1 ઉપરથી નીચે પડવું 2 સુકાઈને પડી જવું, ગરવું	झड़ना सूखकर गिर जाना, टपकना	to fall off to be dry and drop down

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			३ (ला) छारीने दूर थपु- जता रहेपु	(ला) हाकर दूर हो जाना, चला जाना	to sustain defeat and go away
ખરસણ	खरसण	न	એક વનસ્પતિ	एक वनस्पति	kind of plant
ખરસાણી	खरसाणी	स्त्री	એક વનસ્પતિ (પાન વગરની ને તેમાંથી દૂધ નીકળે છે)	खुरासानी धूहर	kind of wild plant
ખરસાડી	खरसाडी	स्त्री	જુઓ 'ખરસાણી'	देखिए 'ખરસાણી'	see 'ખરસાણી'
ખરસૂરુ	खरसूरु	वि	જરા ખારુ	थोडा सा ज्यादा नमक वाला	slightly salty
ખરસૂલુ	खरसूलु	वि	ખરસૂરુ	थोडा सा ज्यादा नमक वाला	slightly salty
ખરાખર	खराखर	अ	નક્કી, ખરેખર	सचमुच, अवश्य	certainly, surely
ખરાખરી	खराखरी	स्त्री	1 ખરાપણ, સચ્ચાઈ 2 સાબિતી 3 (લા) સકટવેળા, ખારીક વખત	खरापन, सच्चाई, सच्चापन प्रमाण, सबूत (ला) सकट का समय, अडी	veracity, truthfulness proof critical time, crisis
ખરાજાત	खराजात	स्त्री	મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતું અર્થ	मजदूरी या बिगाड के कारण माल पर होने वाला खर्च	expenditure incurred on goods on account of damage or labour charges
ખરાદ	खराद	स्त्री	લાકડુ, હાથીદાંત વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર, સઘાડો	खराद, चरख	lathe
ખરાદવું	खरादवुं	स क्रि	ખરાદીકામ કરવું	खरादना	to turn on a lathe
ખરાદી	खरादी	पु	ખરાદથી ઘાટ ઉતારનારો કારીગર	खराद का काम करने वाला, खरादी	turner

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખરાબ	खराब	वि	1 सारु नહિ તેવુ, નઠારુ 2 અનીતિમાન, ભ્રષ્ટ	खराब, बुरा दुश्चरित्र, खराब	bad immoral, base
ખરાબો	खराबो	पु	1 પાણીથી ઢાંચેલો ખડક 2 ખરાબ-ખેડવા લાયક ન હોય તેવી જમીન	पानी से ढकी हुई चट्टान खेती के अयोग्य जमीन, खराबा	rock hidden under water waste land, land that is not tillable
ખરાબોલુ	खराबोलु	वि	સાચાખોલુ	सत्यवादी, स्पष्टवक्ता	truthful
ખરાવાડ	खरावाड	वि	જુઓ 'ખરાવાડ'	देखिए 'ખરાવાડ'	see 'ખરાવાડ'
ખરાવાદી	खरावादी	वि	ખરાબોલુ, સાચાખોલુ	खराकहैया, सत्यवादी	truthful
ખરી	खरी	સ્ત્રી	કેટલાક ચોખ્ખા પ્રાણીઓને પગના આગળાને ઠેકાણે જે આખા કે ફાટવાળા નખ હોય છે તે	खुर, सुम (पशुओं का)	hoof
ખરીતો	खरीतो	पु	1 સરકારી કાગળિયાનો લખોટો-થેલો 2 ખલીતો	सरकारी कागजात का थैला, खरीता बड़ा लिफाफा, खरीता	bag of government papers big bag or envelope
ખરીદ	खरीद	સ્ત્રી	ખરીદ, ખરીદવુ તે	खरीद	purchase
ખરીદવુ	खरीदवु	स क्रि	વેચાતુ લેવુ	खरीदना	to buy
ખરીદી	खरीदी	સ્ત્રી	ખરીદવુ તે	खरीद, खरीदारी	shopping
ખરીફ	खरीफ	સ્ત્રી	ચોમાસુ પાક	खरीफ, चौमासे की फसल	monsoon crop

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખરુ	खरु	वि	1 सायु, 'ખોટુ' થી ઊભટુ, યથાર્થ, જ્યેવુ હોય તેવુ 2 શુદ્ધ, નકલી કે બનાવટી નહિ તેવુ, અસલ 3 સાચાખોલુ, ઈમાનદાર 4 શેઝીને કડક કરેલુ કે થયેલુ 5 પાકુ, ખરોબર, ઊગાપ વગરનુ 6 આશ્ચર્યના ઉદ્ગારનો ભાવ બતાવે છે 7 અહા, હા સાયુ, વારુ, અલબત્ત જ્યેવા અર્થનો ઉદ્ગાર સૂચવે છે	खरा, सच्चा विशुद्ध, सच्चा, खालिस स्पष्टभाषी, ईमानदार, सत्यवादी करारा खूब पका या तपा हुआ 'अच्छा', 'ठीक' ऐसा आश्चर्य का भाव बताता है 'अहह', 'अच्छा', 'सचमुच' इस प्रकार का अर्थ सूचित करता है	true, right, correct pure, genuine, real honest well-baked well-cooked exclamation suggestive of wonder exclamation suggestive of meanings similar to 'अह', 'हा', 'सायु', 'वारु', etc
ખરુલોદુ	खरुलोदु	न	પોલાદ	फौलाद	steel
ખરે	खरे	अ	1 સાચો, ખરેખાત 2 નક્કી	सचमुच, वाकई अवश्य, निश्चित	truly certainly
ખરેખર	खरेखर	अ	1 સાથે 2 ખચીત	यथार्थ में, सचमुच जरूर	truly verily
ખરેખાત	खरेखात	अ	જુઓ 'ખરેખર'	देखिए 'खरेखर'	see 'खरेखर'
ખરેખરુ	खरेखरु	वि	સાચેસાચુ	सच, सत्य	quite true

जुरली श्रुद	देवनागरी लिप्यतरण	व्या- को	गुजराती अर्थ	हिदी पर्याय	अग्रेजी पर्याय
अरेटु	खरेटु	न	इरेटु, तरत पिथायेली गायबेसनु दूध	पउस, पउसी (दूध)	milk of cow or buffalo which has given birth to a young one
अरेटु	खरेटु	न	गुथो 'अरेटु'	देखिए 'अरेटु'	see 'अरेटु'
अरेटो	खरेटो	पु	1 ओधराणो, रेलाओ साध	तरल पदार्थ के बहने से पडने वाला दाग, धब्बा	line or streak of liquid
			2 धअरी गथेला अन्नओ पोपडो	जले हुए अनाज का पपडा, खुरचन	layer or crust of burnt food
अरेरी	खरेरी	स्त्री	1 अअरी(रव)	खखार (आवाज)	cough or portion of food choking the throat
			2 गणामा अरअर शपु ते	खखारना	choking causing hoarse- ness of voice
अरेरो	खरेरो	पु	धोडा, अणए वगेरेनी मालिस इरवानु ओणर	खरहरा	curry-comb
अरो	खरो	पु	णेडानी अेडी	जूते की एड	heel of a shoe
अरोअर	खरोखर	अ	1 साथे 2 अथीत	सचमुच, यथार्थ में अवश्य, जरूर	truly certainly, verily
अर्थ	खर्च	न, पु	1 वापर 2 डिमत, लागत	लाय, खर्च कीमत, लागत, खर्चा	expenditure cost, price
			3 भोटी रकम वापरवानो सारो नरसो अवसर	खूब पैसे खर्च करने का शुभाशुभ अवसर	occasion for spending large amount

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખર્ચખૂટણ	ખર્ચખૂટણ	ન	1 પરચૂરણ-કાલતુ ખર્ચ 2 અવસર વખતે કરવાનું ખર્ચ, વસે	ફુટકલ ખર્ચ શુભાશુભ અવસર પર કરને કા ખર્ચ	miscellaneous expenditure expenditure to be incurred on special occasion
ખર્ચવું	ખર્ચવું	સ ક્રિ	ખર્ચ કરવું, વાપરવું	ખર્ચ કરના, ખરચના	to spend
ખર્ચાઉ	ખર્ચાઉ	વિ	1 ખર્ચ કરે એવું, છાથનું છૂટું 2 મોઢું	ખર્ચાલા, ઉડાકું મઢંગા	extravagant costly
ખર્ચાઠ	ખર્ચાઠ	વિ	જુઓ 'ખર્ચાઉ'	દેખિયે 'ખર્ચાઉ'	see 'ખર્ચાઉ'
ખર્ચાળું	ખર્ચાળું	વિ	જુઓ 'ખર્ચાઉ'	દેખિયે 'ખર્ચાઉ'	see 'ખર્ચાઉ'
ખલ	ખલ	પુ	1 ઔષધ વગેરે કચરવાનો કે ઘૂટવાનો ખાડાવાળો ઘડેલો પથરો 2 ખલ અને ખતો	ખરલ, ખલ ખલ ઓર બટ્ટા	mortar mortar and pestle
		વિ	શઠ, ધૂર્ત	શઠ, ધૂર્ત	roguish
ખલક	ખલક	સ્ત્રી	1 જગત, દુનિયા 2 માણસજાત, સસાર	દુનિયા, જગત, ખલક, સસાર લોકસમૂહ, સસાર	the world menfolk
ખલતો	ખલતો	પુ	ખાનાખાનાવાળી થેલી, મોટો વાટવો	બડા થેલા, ખરીતા	bag with many sections
ખલખતો	ખલખતો	પુ	1 ખલનો ખતો, ઉપરવટણો 2 ખલ અને ખતો	ખરલ કા મૂસલ, બટ્ટા ખલ ઓર બટ્ટા	pestle mortar and pestle
ખલલ	ખલલ	સ્ત્રી, ન	1 હરહત, અડચણ	ખલલ, અડચન	disturbance, interruption

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખલવું	खलवु	स क्रि	2 नुकसान ખળવું, ખરલ કરવું, ખલમા ઘાલીને ઘૂટવું—ખારીક કરવું	नुकसान खरल में घोटना, खलना	loss, damage to pound in a mortar
		न	1 गाडाना पाजरा ટેકવવા માટે ઘલાતો લાકડાનો ઠોથો, આકુ 2 ક્રિકેટમા શેપાતા દાકિયો, સ્ટપ	गाडी के मचान का खडा डडा क्रिकेट का स्टप, 'स्टप'	wooden-peg fixed in the side of a cart- frame (cricket) stump
ખલાવું	खलावु	अ क्रि	1 અટકી રહેવું 2 'ખલવું' નું કર્મણિ	अटका रहना, उलझे रहना 'ખલવું' का कर्मणि रूप	to remain suspended passive of 'ખલવું'
ખલાસ	खलास	वि	समाप्त, पूरु	खलास, समाप्त, खतम	finished
		पु	ખારવો	खलासी, जहाजरान	sailor
ખલાસી	खलासी	पु	ખારવો	खलासी, जहाजरान	sailor
ખલી	खली	स्त्री	1 ખિસકોલી 2 છોડરાની એક રમત 3 ખળુ 4 કઠોળની ઘણ કરવાની જગા	गिलहरी बच्चों का एक खेल खलिहान दलहन को दलकर दाल बनाने का स्थान	squirrel a game of- children place for thrashing crop pulse mill
ખલીતો	खलीतो	पु	લખોટો, પરખીકિયુ	खरीता, लिफाफा	envelope
ખલીફ	खलीफ	पु	મહમદ પેગબર પછી ઈસ્લામી ધર્મનો વડો, ધર્મરક્ષક	खलीफा, मुहम्मद पैगबर का उत्तराधिकारी	successor of Mohammed, Calif

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખત્રીક્રી	खलीफात	स्त्री	1 ખત્રીક્રી 2 ખત્રીક્રી ગાદી અથવા સત્તા	पैगबर का प्रतिनिधि होना, खिलाफत खलीफा का पद या सत्ता, खिलाफत	Califship throne or authority of Calif
ખત્રી	खलेची	स्त्री	ખાનાવાળી કોથળી, શેત્રી	खानेदार थैली, छोटा खरीता	bag with partitions
ખત્રેલ	खलेल	स्त्री, न	1 હરક્રી, અક્રી 2 નુકસાન	अडचन, खलल नुकसान, खलल	interruption, disturbance loss, damage
ખવડાવવુ	खवडाववु	स क्रि	'ખાવુ' નુ પ્રેરક	खिलाना	caus of 'ખાવુ'
ખવાડવુ	खवडावु	स क्रि	ખવડાવવુ	खिलाना	to feed
ખવાબ	खवाब	पु.	સ્વપ્ન	स्वप्न, ख्वाब	dream
ખવારવુ	खवारवु	स क्रि	ખવડાવવુ	खिलाना	to feed
ખવાવુ	खवावु	अ क्रि	1 'ખાવુ' નુ કર્મણી 2 કાટ કે સડો લાગવો, ક્ષીણ થવુ	खाया जाना, 'ખાવુ' का कर्मणि रूप जग लगना या सडना, क्षीण होना	passive of 'ખાવુ' to be rusted or rotten, be worn
ખવાસ	खवास	वि	સેવાચારીનો ધધો કરતી એક જાતનુ	खवास की जाति का	belonging to a caste which does the work of personal service
		पु	1 તે જાતનો માણસ 2 હજૂરિયો	खवास हुजूरी, खास खिदमतगार	member of such a caste page, valet

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 चीजनी भासियत, पदार्थनो धर्म	पदार्थ की विशेषता, चीज की तासीर	characteristic or property of a thing
			4 स्वभाव, भिजाज	स्वभाव, मिजाज	nature, temperament
ખવાસણ	खवासण	स्त्री	1 दासी 2 ખવાસની પત્ની, ખવાસણી	लौंडी, दासी खवासिन, खवास की स्त्री	maid-servant wife of a valet
ખવાસણી	खवासणी	स्त्री	જુઓ 'ખવાસણ'	देखिए 'ખવાસણ'	see 'ખવાસણ'
ખવાસી	खवासी	स्त्री	ખવાસણ	खवासिन, खवास की स्त्री	maid-servant
ખવીસ	खवीस	पु	1 એક જાતનું ભૂત-પ્રેત 2 રાક્ષસ	खबीस, भूत-प्रेत राक्षस	kind of ghost giant
ખશિયાણું	खशियाणु	वि	જુઓ 'ખશિયાણું'	देखिए 'ખશિયાણું'	see 'ખશિયાણું'
ખસ	खस	स्त्री	1 ચામડીનો એક રોગ 2 વીરણનો વાળો	खजली, खारिश (रोग) खस (जड), लाज	kind of skin disease, itch kind of fragrant roots of grass
ખસકવું	खसकवु	अ क्रि	જુઓ 'ખસકવું'	देखिए 'ખસકવું'	see 'ખસકવું'
ખસકો	खसको	पु	ખાચો	खॉचा	depression in a surface, obstacle
ખસખસ	खसखस	स्त्री	1 અફીમનો છોડવો 2 એ છોડવાનું બીજ	अफीम का पौधा, पोस्ता, खस पोस्ते का बीज, खसखस	poppy poppy-seed
ખસખસિયું	खसखसियु	वि	1 ખસખસના જેવું ઝીરું	बहुत छोटा, पोस्ते के दाने सा, खसखसा	fine like seeds of poppy

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ખસખસના જેવા ધોળારંગવાળું	खसखस सा सफेद	of the colour of poppy-seed
ખસમ	खसम	पु	પતિ, ધર્મી	खसम, पति, मालिक, आदमी, वर	husband, master, owner
ખસર	खसर	સ્ત્રી	નાનો ખસરઝો	छोटा खॉचा, खरोंच	small mark
ખસરઝો	खसरको	पु	1 લીટી, ખચકો 2 ઉઝરઝો, કાપો	पक्ति, लकीर, खॉचा खरोंच, काट	line, mark of a straight line scratch, cut
ખસરો	खसरो	पु	1 લીટી, આઝો 2 ઘસરઝો, કાપો	लकीर, चिह्न खरोंच, काट	line, mark scratch, cut
ખસલી	खसली	સ્ત્રી	પશુને ખાવાનું ઝીણું સૂકું ઘાસ, ખસલી	सूखी घास, खस	fodder, dry grass for cattle
ખસલુ	खसलु	ન	1 ઘાસ કે તણખલુ 2 ખસના રોગવાળું	घास या तृण खुजली के रोग वाला व्यक्ति	grass or blade of grass having the disease of itch
ખસવુ	खसवु	अ क्रि	1 સરકવું, આધા થવું 2 લપસવું 3 કસર, મત, માન્યતા, કથન ઈ થી ફરી જવું	खिसकना, सरकना रपटना, फिसलना अपने कौल, राय, मान्यता, कथन आदि में से निकल जाना, निकलना	to slide to slip to back out, to wriggle out
ખસી	खसी	સ ક્રિ	અડ-વૃષણ પર ઉપચાર કરી નિરુપયોગી કરવા તે	खसी करना, बधिया करना	to castrate
ખસેડવું	खसेडवु	સ ક્રિ	દૂર કરવું	खिसकाना, हटाना	to move, to remove

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખસ્તી	ખસ્તી	સ્ત્રી	જુઓ 'ખસ્તી'	દેખિય 'ખસ્તી'	see 'ખસ્તી'
ખળ	ખલ્લ	વિ	શઠ, ધૂર્ત	શઠ, ધૂર્ત, ખલ	roguish
ખળખળવુ	ખલ્લખલ્લવુ	અ ક્રિ	1 ખળખળ અવાજ થવો 2 ઢાલો ઊઠવુ, તળે ઊપર થવુ 3 (લા) મનમા અજ્ઞપો થવો, ગભરાવુ	ખલબલાના હલચલ મચના, હિલ ઝઠના (લા) ક્ષુબ્ધ હોના, ઘબડાના	to make a confused sound to be shaken very much to be restless or afraid
ખળખળાટ	ખલ્લખલ્લાટ	પુ	1 ક્ષોભ, ગભરાટ 2 ગરબડ, કોલાહલ	ખલબલાહટ, બેચેની, ઘબડાના, ક્ષોભ ખલબલી, કોલાહલ, ગડબડ	agitation, panic uproar, commotion
ખળવુ	ખલ્લવુ	અ ક્રિ	અચકાવુ, અટકવુ	સ્કના, અટકના	to hesitate, pause
ખળાવાડ	ખલ્લાવાડ	સ્ત્રી	ખળુ કરવાની જગા, ખરાવાડ	ખલિહાન કરને કી જગહ	place for thrashing corn
ખળાવુ	ખલ્લાવુ	અ ક્રિ	1 અટકી રહેવુ 2 'ખળવુ' નુ કર્મણિ	અટકા-સ્કા રહના 'ખળવુ'કા કર્મણિ સ્વ	to be stopped passive of 'ખળવુ'
ખળી	ખલ્લી	સ્ત્રી	1 ખળુ 2 કઠોળની દાળ કરવાની જગા	ખલિહાન દલહન સે દાલ બનાને કી જગહ	place for thrashing corn pulse-mill
ખળુ	ખલ્લુ	ન	કાસલા ગૂંદને કે ચૂડીન અનાજ કાઢવાની જગા	ખલિહાન	place for thrashing corn
ખખ	ખખ	વિ	1 ખાલી	ખખ, ખાલી, ખુલ્લ, રિક્ત, શૂન્ય	empty, vacant

गुजगती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ખોખા જેવું નકામું	खोखला, निकम्मा	useless (like an empty shell)
			3 ધનહીન	धनहीन, खाली	poor
		पु	1 ખગ, બદલો	बदला	revenge, retaliation
			2 પાયમાલી	पामाली, बर्बादी	ruin, destruction
		સ્ત્રી	1 ખત	तदेही, धैर्य	perseverance
			2 ઈચ્છા, ભૂખ	इच्छा, भूख	desire, hunger
ખખાળવું	खखाळवु	स क्रि	ઝબકોળીને ધોવું, ખખાળવું	खँगालना	to rinse
ખખારવું	खखारवु	अ क्रि	ખખારવું	खखारना	to cough
ખગાળવું	खगाळवु	स क्रि	1 પાણીમા ઝબકોળીને અને હલાવીને ધોવું, પાણી વડે ખૂબ ધોવું-સાફ કરવું	खँगालना, पानी से खूब धोना, साफ करना	to rinse or wash using lot of water
			2 પાણીના કોગળા કરી (મોં) ખૂબ સાફ કરવું	पानी की कुल्ली करके (मँह) साफ करना	to rinse or gargle in order to cleanse the mouth
ખખેરવું	खखेरवु	स क्रि	1 ખેરવી નાખવું	झाडना	to scatter away, shake off the dust
			2 ઝાટકારી કાઢવી ધમકાવવું, મારવું	फटकारना, धमकाना, पीटना	to beat, to thrash, to take (one) to task
ખખોળવું	खखोळवु	स क्रि	1 વેરણછેરણ કરી નાખવું, ચૂંથી નાખવું	खखोरना, तितर-बितर कर देना, बिगाडना	to mess up

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ખૂણેખોચરે શોધવું	कोना-कोना खोजना, ढूँढना	to rake up
			3 પાણીમા ઝબકોળીને અને હલાવીને ધોવું, પાણી વડે ખૂબ ધોવું- સાફ કરવું	पानी में हिलाकर धोना, साफ करना, पानी से खूब धोना	to rinse to wash thoroughly
			4 પાણીના કોગળા કરી (મો)ખૂબ સાફ કરવું	पानी की कुल्ली करके (मँह) साफ करना	to cleanse the mouth with water
ખગ	खग	पु	1 ખરકલો, ઢગલો 2 ઠાઠ, વેર 3 ખખ, ખદલો 4 ખત, ખાત	ढेर डाह, बैर बदला तँदेही, धैर्य	heap malice, enmity revenge, retaliation perseverance
ખખળાવવું	खगळाववुं	स क्रि	જુઓ 'ખખળાવવું'	देखिए 'ખખળાવવું'	see 'ખખળાવવું'
ખખળવું	खगळवुं	स क्रि	જુઓ 'ખખળવું'	देखिए 'ખખળવું'	see ખખળવું
ખખાવું	खखावुं	अ क्रि	ખમચાવવું, અટકવું, પાછા પડવું	झिझकना, रुकना	to hesitate, to stop, to falter
ખખર	खजर	न	કટાર જેવું, સીધું બેધારું શસ્ત્ર	खजर, कटार	dagger
ખખરી	खजरी	स्त्री	એક વાદ્ય, ઘૂંઘરીઓવાળી નાની નગારી-૬૩	खजरी, खजडी	small tambouriae
ખખવાળ	खजवाळ	स्त्री	1 ચામડીનો એક રોગ લૂખસ, ચૂટ 2 ચળ, વલૂર	खुजली, खाज (रोग) चुल, सुरसुरी, खुजलाहट	kind of skin disease, itch itch

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખડ	खड	पु	1 ભાગ, ડકડો 2 જૂથ, સમૂહ 3 પ્રકરણ 4 એક થોળી કે કાચળી શાય તેટલી મોળિયા સાથે વાલેલુ કપડુ, રેન્જો 5 ઘરનો એક ભાગ, ઓરડો 6 પૃથ્વીના પાચ મોટા ભાગમાનો એક	भाग, टुकड़ा, खड दल, समूह प्रकरण, खड चौलखड कमरा पृथ्वी के महाद्वीप में से एक खड	part, division group chapter piece of cloth with woven border enough for woman's blouse or bodice room, part of a house continent
		વિ	1 વિભાગવાળુ 2 નાનુ, ટુકુ	खडित, विभक्त छोटा, सक्षिप्त	having divisions small, short
ખડકથા	खडकथा	સ્ત્રી	નાની-ટૂંકી વાર્તા	छोटी कहानी, खडकथा	abridged or short story
ખડકાવ્ય	खडकाव्य	न	1 નાનુ કાવ્ય 2 અનેક છંદોવાળુ કાવ્ય	छोटा काव्य, खडकाव्य अनेक छंदों वाला काव्य	short poem poem in many metres
ખંડણી	खडणी	સ્ત્રી	તાબેદાર રાજ્ય ઉપરી રાજ્યને જે રકમ દર વર્ષે ભરે તે	अधीन राज्य की ओर से प्रभु राज्य को दिया जाने वाला धन, खिराज	tribute
ખડવુ	खडवु	स क्रि	1 તોડવુ, ડકડા, વિભાગ કરવા 2 માગતા પેટે અમુક ઓછુ આપી પતાવવુ 3 સામટો ભાવ ઠરાવીને સોધામા ખરીદવુ	खडित करना, तोडना कुछ कम देकर हिसाब बेबाक करना थोक के दाम तय करके सस्ते में खरीदना	to break into pieces to settle debt by paying less than what is due to buy cheaply by fixing wholesale price

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખડાવવું	खडाववु	अ क्रि	'ખડાવું', 'ખડવું' નું પ્રેરક	कुटवाना	caus of 'ખડવું', 'ખડાવું'
ખડાવું	खडावु	अ क्रि	1 'ખડાવું', 'ખડવું' નું કર્મણિ 2 નુકસાનમા આવવું 3 પીડાવું, ભીડમા હેરાન થવું	कुटना, कुटा जाना घाटे में रहना पीडित होना, भीडभाड में धक्के खाना	passive of 'ખડવું', 'ખડાવું' to suffer loss to be troubled or pushed in a crowd
ખડિયું	खडियु	वि	1 ખડણી ભરનારું, તાબેદાર 2 ખડિત	खिराज देने वाला, ताबेदार खडित	one who pays tribute broken into pieces
ખડિયેર	खडियेर	न	ભાગીતૂટી ઇમારત, પડી ગયેલા ઘરનું ખોખું	खडहर	ruin
ખડેર	खडेर	न	જુઓ 'ખડિયેર'	देखिए 'ખડિયેર'	see 'ખડિયેર'
ખત	खत	સ્ત્રી	1 ચીવટપૂર્વક લાગ્યા-મડયા રહેવાનો ગુણ 2 ચીવટ, ડાળજી	तनदिही, सावधानी के साथ काम में लगे रहने का गुण, धैर्य सावधानी, होशियारी	perseverance carefulness caution
ખતી	खती	वि	ખતવાળું	धैर्यवान	persevering
ખતીલું	खतीलु	वि	જુઓ 'ખતી'	देखिए 'ખતી'	see 'ખતી'
ખધાઈ	खधाई	સ્ત્રી	લુચ્ચાઈ, ધૂર્તતા	धूर्तता, दगाबाजी	knavery, roguery
ખધું	खधु	वि	લુચ્ચું, ધૂર્ત	धूर्त, दगाबाज	cunning, knavish
ખધોલું	खधोलु	न	ખભો, ખાધ	कधा	shoulder, (of beasts) neck
ખધોલો	खधोलो	पु	જુઓ 'ખધોલું'	देखिए 'ખધોલું'	see 'ખધોલું'

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખપાલી	खपाली	સ્ત્રી	ખેતીનું એક ઓજાર, પજેટી	पाँचा, खेती का एक आला	harrow, rake
ખભ	खभ	પુ	થાભલો, સ્તભ	खभा, खभ, स्तभ	pillar
ખાઈ	खाई	સ્ત્રી	1 ખાણ, ઊંડો ખાડો 2 કોટને ફરતી ખાડી 3 ગામનું પાણી જવા ખોદેલો કાસ	गहरा गड्ढा, खदक खाई वर्षा के पानी के निकास के लिए गाँव के पास खोदी हुई खाई	valley moat gutter
ખાઈખપૂસીને	खाईखपूसीने	અ	ખત અને એકાગ્રતાથી	तदेही से, दत्तचित्त होकर	perseveringly and attentively
ખાઈપીને	खाईपीने	અ	જુઓ 'ખાઈખપૂસીને'	देखिए 'खाईखपूसीने'	see 'खाईखपूसीने'
ખાઈખદેલુ	खाईबदेलु	વિ	પહોચેલ, પાકું, યુક્તિ- પ્રયુક્તિ પામી ગયેલું	घाघ, पक्का, पूरा चालाक, चट	shrewd, cunning, hardened
ખાઉશ્ર	खाउकी	સ્ત્રી	1 લાચ 2 ખોરાકી	रिश्त, घूस खुराकी	bribe maintenance
ખાઉધર	खाउधर	વિ	1 ખાખા કરનારું, ખાતા ધરાય નહિ એવું 2 લાચિયું	खाऊ, पेटू घूसखोर, खाऊ	gluttonous corrupt, one who is taking bribe
ખાઉધર	खाउधर	વિ	જુઓ 'ખાઉધર'	देखिए 'खाउधर'	see 'खाउधर'
ખાએશ	खाएश	સ્ત્રી	ઈચ્છા, અભિલાષા	स्वाहिश	desire, ambition
ખાક	खाक	સ્ત્રી	1 રાખ, ધૂળ 2 મારેલી ધાતુ 3 નાશ, પાચમાલી	खाक, धूल मारी हुई धातु, कुरता नाश, तबाही, बरबादी	ashes, dust metallic oxide ruin, destruction

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાકટી	खाकटो	स्त्री	કેશનો મરવો, ખાખડી	अंबिया, टिकोरा	small unripe mango
ખાકટુ	खाकटु	न	જુઓ 'ખાકટી'	देखिए 'ખાકટી'	see 'ખાકટી'
ખાકી	खाकी	वि	1 ખાખવાળુ, રાખોડી ચોળનારુ 2 રાખોડિયા રગનુ 3 ઘેરા પીળા રગનુ 4 (લા) ઐહિક	खाकवाला, भस्म मलने वाला मटियाला, खाक के रग का, खाकी गाढे पीले रग का (ला) ऐहिक	covered with ashes, one who besmears ashes ash-coloured deep yellow-coloured mundane
ખાખ	खाख	स्त्री	જુઓ 'ખાક'	देखिए 'ખાક'	see 'ખાક'
ખાખટી	खाखटी	स्त्री	એક પક્ષી	एक पक्षी	kind of bird
ખાખઠી	खाखठी	स्त्री	જુઓ 'ખાકટી'	देखिए 'ખાકટી'	see 'ખાકટી'
ખાખઠુ	खाखठु	न	ખાકટુ, મરવો	अंबिया, टिकोरा	small unripe mango
ખાખર	खाखर	पु	1 એક ઝાડ, જેના પાનના પતરાળા થાય છે 2 (ગોતા તરફે ઢોર ખાય તે) તુવેરની સૂકીપાદડી	पलाश, टेसू (पेड़) अरहर की सूखी पत्ती	kind of wild tree dry leaves of <i>arhar</i> (a pulse) used as fodder
ખાખરો	खाखरी	स्त्री	1 નાનો ખાખરો 2 રોટલી 3 તબાકુના સુકાઈ ગયેલા પાતરા, સૂકો	छोटा पलाश रोटी तबाकू की सूखी पत्तियाँ, सुरती	kind of tree small 'ખાખર bread dry tobacco leaves
ખાખરો	खाखरो	पु	1 જુઓ 'ખાખર' 2 શેકીને કડક કરેલી રોટલી	देखिए 'ખાખર' खूब सेकी हुई करारी रोटी	see 'ખાખર' roasted bread

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાખાખીવી	खाखाखीवी	वि	1 छिन्न-भिन्न 2 दुःखी, डेशन	छिन्न-भिन्न, तितर-बितर दुःखी, परेशान	scattered to pieces miserable, troubled ruin, utter destruction
ખાખી	खाखी	वि स्त्री न	1 જુઓ 'ખાંત્રી' 2 ખાલી, निर्धन ખાખી રંગનું લૂગડું	देखिए 'ખાંત્રી' खाली, निर्धन, खख खाकी (कपडा)	see 'ખાંત્રી' empty, poor deep yellow cloth
ખાખીબગાળી	खाखीबगाळी	वि	ખાલી ખિસ્સે ફક્કડ થઈને ફરનારું	खाली हाथ मस्त होकर घूमने वाला, फक्कड	foppish but without means
ખાજ	खाज	न	1 ખાદ્ય 2 ખાજુ	खाने की चीज, खाद्य खाजा (मिठाई)	eatable kind of sweet dish
ખાજલી	खाजली	स्त्री	ખૂજલી, ખજવાળ	खाज, खुजली	itch
ખાજલુ	खाजलु	स्त्री न	નાનું ખાજુ, એક ખાવાની વાની 1 ખાજુ	छोटा खाजा (मिठाई)	kind of dish
ખાજુ	खाजु	न	2 નાનું, નાનકડું ફૂડાળું એક ખાવાની વાની	खाजा (मिठाई) कुँडरा, चक्कर	kind of sweet dish small circle
ખાટ	खाट	स्त्री	હાંડોળાખાટ	खाट जैसा झूला	swinging cot
ખાટકી	खाटकी	पु	કસાઈ	कसाई, बूचड	butcher
ખાટકીખાનુ	खाटकीखानु	न	કતલખાનુ	कत्लगाह, वधस्थल, कसाईखाना	slaughter-house

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખાટકીવાડો	खाटकीवाडो	પુ	કસાઈવાડો	कसाइयों का मुहल्ला	locality of dutchers
ખાટખટુબડુ	खाटखटुबडु	વિ	ખટમધુરુ	खटमीठा	sweet-sour
ખાટખટૂબડુ	खाटखटूबडु	વિ	જુઓ 'ખાટખટુબડુ'	देखिए 'ખાટખટુબડુ'	see 'ખાટખટુબડુ'
ખાટલાવશ	खाटलावश	વિ	[સુવાવડ કે સખત માદગીથી] પશારીવશ	शय्याग्रस्त, खाट से लगा हुआ	bed-ridden (owing to sickness or child-birth)
ખાટલી	खाटली	સ્ત્રી	1 નાનો ખાટલો, માચી 2 ઠાઠડી	खटोला, खटिया अरथी	small cot bier
ખાટલો	खाटलो	પુ	1 સૂવાનો ખાટ, માચો, ચારપાઈ 2 મદવાડ 3 પ્રસૂતિ	खाट, चारपाई बीमारी प्रसूति	cot illness child-birth delivery
ખાટવુ	खाटवु	સ ક્રિ	ફાયદો મેળવવો	प्राप्ति होना, खटना, कमाना	to benefit
ખાટુ	खाटु	વિ	1 ખટાશવાળુ 2 કચવાયેલુ, નારાજ	खट्टा रजीदा, नाराज	sour hurt, disgruntled
ખાટુચડ	खाटुचड	વિ	એકદમ ખાટુ	बहुत खट्टा, खट्टा चूक	very sour
ખાટુચરડ	खाटुचरड	વિ	ખાટુચડ	खट्टा चूक	very sour
ખાટુચેડ	खाटुचेड	વિ	જુઓ 'ખાટુચડ'	देखिए ખાટુચડ	see 'ખાટુચડ'
ખાટુબડસ	खाटुबडस	વિ	જુઓ 'ખાટુચડ'	देखिए 'ખાટુચડ'	see 'ખાટુચડ'
ખાડ	खाड	સ્ત્રી	ખાઈ	खाई, खदक, गड़दा	ditch moat

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાડી	खाडी	स्त्री	1 દરિયાની ભરતી પહોંચે ત્યા સુધીનો નદીનો ભાગ 2 જમીનમા ગયેલો દરિયાનો સાકડો પ્રવાહ 3 ગટર, મોરી	ज्वार का पानी नदी में जाए वहाँ तक का नदी का हिस्सा खाडी गटर, मोरी	part of river penetrated by the sea at time of tide creek gutter, drain
ખાડાજાજરુ	खाडाजाजरु	न	ખાડા ઉપર ગોઠવાતુ ફરતુ જાજરુ	उठीआ पाखाना	movable latrine on a trench
ખાડો	खाडो	पु	1 ખાધરો, જમીનમા ખોદાણ 2 ખોટ, નુકસાન	खड्डा, गड्ढा घाटा, नुकसान	pit loss
ખાડોખડિયો	खाडोखडियो	पु	ખાડો કે ખાધરો	खड्डा, गड्ढा	pit and ditch
ખાડોખૈયો	खाडोखैयो	पु	જુઓ ખાડોખડિયો	देखिए 'ખાડોખડિયો'	see 'ખાડોખડિયો'
ખાણ	खाण	स्त्री	1 ખનીજ પદાર્થો કાઢવા માટે ખોદેલો ખાડો કે તેવા પદાર્થો ખોદતા મળી આવે તેવું સ્થળ—છૂપો ભંડાર, અખૂટ ભંડાર 2 જેમાથી બહાર ન નીકળાય તેવો ઊંડો ખાડો 3 અનાજ ભરવા માટે બનાવેલું ભોયરું, ભંડાર 4 ઉત્પત્તિસ્થાન 5 ધારવાળી વસ્તુની ધારમા પડેલો ખચકો	खान, खदान बहुत गहरा गड्ढा अनाज रखने का कोठार, भंडार उत्पत्ति स्थान धारदार चीज की धार में पड़ा हुआ गड्ढा, दौता	mine, hidden treasure very deep pit granary, cellar for storing grain place of birth dent in a sharp edge

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			6. ढोरेने ખાવાનું અનાજ કે ગોતું	सानी या उबाला हुआ दाना (मवेशी के लिए)	boiled grain oilseeds, oilcake etc for cattle
ખાણિયો	खाणियो	पु	ખાણનો મજૂર	खान का मजदूर	miner
ખાણી	खाणी	स्त्री	1. ખાણ, ઉત્પત્તિસ્થાન 2. ભંડાર	उत्पत्ति स्थान भंडार, खान	mine, place of birth store
ખાણીપીણી	खाणीपीणी	स्त्री	ખાવાપીવાનું, ખોરાકપાણી, ખાનપાન	खान-पान, खुराक-पानी	eating and drinking, food and drink
ખાણ	खाणु	न	1. જમણ, ભોજન 2. મિજબાની	खाना भोज	dinner feast, party
ખાતમુસ્ત	खातमुस्त	न	બાધકામનો પાયો નાખવાનો મગજ સમય કે તેનો વિધિ	नींव डालने का मुहूर्त या उसकी विधि	auspicious time for or rite of laying the foundation stone of a building
ખાતમુહૂર્ત	खातमुहूर्त	न	જુઓ 'ખાતમુસ્ત'	देखिए 'ખાતમુસ્ત'	see 'ખાતમુસ્ત'
ખાતમો	खातमो	पु	1. અત, છેડો 2. મોત	खातमा, अत मृत्यु, मौत	end death
ખાતર	खातर	न	1. ખેતર સુધારવા સારું તેમા નખાતા છાણ, કાપ, લીંડી વગેરે પદાર્થો, તેવો બીજો રસાયણી પદાર્થ 2. ચોરે ભીંતમા પાડેલું બાકું 3. ચોરી	खाद सेंध चोरी	manure, fertilizer opening in wall made by a thief stealing, theft

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાતરજમા	खातरजमा	स्त्री	1 थाडरी, बरदाश, सरभरा	चाकरी, सेवा	service,
ખાતરદારી	खातरदारी	अ	2 तरडदारी	खातिर-तवाजो	hospitality
ખાતરપડો	खातरपडो	स्त्री	माटे	तरफदारी, पक्षपात	partiality
ખાતરપાડુ	खातरपाडु	स्त्री	ખાતરી, સાબિતી	खातिर, लिए, वास्ते	for the sake of
ખાતરપૂજો	खातरपूजो	स्त्री	બરદાશ, થાકરી	खातिरजमा,	assurance
ખાતરબરદાશ	खातरबरदाश	पु	ખાતર પાડનાર, ચોર	इतमीनान, विश्वास	
ખાતરબરદાસ	खातरबरदास	पु	જુઓ 'ખાતરપડો'	खातिरदारी,	service,
ખાતરચિયુ	खातरचियु	पु	ખાતરમા કામ આવે એવો	चाकरी, सेवा	attendance
ખાતરી	खાતરી	पु	જુઓ 'ખાતરપડો'	સેંધ લગાને વાલા,	thief, burglar
ખાતરીપૂર્વક	खાતરીपूर्वक	पु	ખાતરમા કામ આવે એવો	સેંધિયા	
		સ્ત્રી	પૂજો, ઘાસ, ઘાણ, વાસીદુ વગેરે કચરો	દેખિયે 'ખાતરપડો'	see 'ખાતરપડો'
		સ્ત્રી	આગતા સ્વાગતા	ઘાસ-પાત, ગોબર	twigs, leaves
		સ્ત્રી	જુઓ 'ખાતરબરદાશ'	કૂડા આદિ કચરા,	etc used
		ન	દર કોથવાનુ ચોરનુ હથિયાર	ખાદ	as manure
		સ્ત્રી	1 ભરોસો, પતીજ	ખાતિરદારી, આવભગત	hospitality
		સ્ત્રી	2 નિ શક્યાણ, ચોકસાઈ	દેખિયે	see 'ખાતરબરદાશ'
		સ્ત્રી	3 સાબિતી, પ્રમાણ	'ખાતરબરદાશ'	see 'ખાતરબરદાશ'
		અ	ખાતરીથી	સેંધ લગાને કા	implement of a
				એક ઔજાર	thief for
					breaking open a
					house
					trust,
					confidence
					conviction,
					exactness
					proof
					surely, with
					certainty

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાતરીબધ	खातरीबध	अ	જુઓ 'ખાતરીપૂર્વક'	देखिए 'खातरीपूर्वक'	see 'ખાતરીપૂર્વક'
ખાતાબધી	खाताबधी	स्त्री	જમીનમહેસૂલની રૈયતવારી પદ્ધતિ	रैयतवारी	the <i>raiayatwari</i> system of land revenue
ખાતાબાકી	खाताबाकी	स्त्री	ખાતે બાકી નીકળે તે	खाते में बाकी (पावना) निकलना	credit or debit balance in an account
ખાતાવહી	खातावही	स्त्री	ખાતાવાર હિસાબ નોંધાવાનો ચોપડો—ચોપડી	खाता-बही, खतौनी	ledger
ખાતાપીતા	खातापीता	अ क्रि	નિર્વાહનું ખર્ચ ઢાટતા	निर्वाह का खर्च निकालने के बाद	after meeting the expenses for maintenance
ખાતાપોતા	खातापोता	न	હિસાબકિતાબ	हिसाब-किताब, लेन-देन	accounts, account book
ખાતુ	खातु	न	1 આસામીવાર અથવા આવકખર્ચની જાતવાર જમે-ઉધાર નો હિસાબ 2 લેણદેણીનું લખાણ	खाता, मद ऋणपत्र, तमस्सुक	account statement of credit and debit
			3 વિષય, પ્રકરણ 4 કામકાજની ક્ષણવારની અગ	विषय, प्रकरण दफतर, महकमा	subject, chapter department
ખાતુપત્ર	खातुपत्र	न	1 લેવડદેવડ 2 લેણદેણને લગતું લખાણ	लेन-देन, हिसाब-किताब ऋणपत्र, तमस्सुक	money transactions record of such transactions
ખાતુપીતું	खातुपीतुं	वि	ઠીક ઠીક ગુજરાનના સાધનવાળું	खाने-पीने से सुखी, आसूदा	having fairly good means of livelihood

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાતેદાર	खातेदार	पु	સરકારના મહેસૂલી કે કોઈના ખાનગી ચોપડે ખાતાવાળો	असामी (खसरे में या लेनदार की बही में)	account-holder
ખાધ	खाध	સ્ત્રી	1 ખોરાક, આહાર 2 ખોટ, નુકસાન 3 ખોડ, ખામણ (જેવી કે હીરામોતીમાં)	खुराक, आहार घाटा दोष, कमी	food loss, deficit flaw (e g in a diamond)
ખાધાખર્ચ	खाधाखर्च	ન	ભરણપોષણ માટે જરૂરી રકમ	खुराकी	maintenance allowance, alimony
ખાધાખર્ચ	खाधाखर्च	ન	જુઓ 'ખાધાખર્ચ'	देखिए 'खाधाखर्च'	see 'खाधाखर्च'
ખાધાખાઈ	खाधाखाई	સ્ત્રી	ખાધાખર્ચ	खुराकी	maintenance allowance, alimony
ખાધાખોરાક	खाधाखोराकी	સ્ત્રી	ખાધાખર્ચ	खुराकी, खाने का खर्च	maintenance allowance, alimony
ખાધેલ	खाधेल	વિ	ખાધેલો	खाया हुआ	eaten
ખાધેલ પીધેલ	खाधेल पीधेल	વિ	1 ખાધેપીધે સુખી 2 માતેલુ, હૃષ્ટપુષ્ટ	खाने-पीने से सुखी, आसूदा-हाल हृष्ट-पुष्ट, तगडा	well-to-do, well-off hale and hearty
ખાનગી	खानगी	વિ	1 પોતીકુ, અગત 2 જાહેર નહિ એવુ, ગુપ્ત	खानगी, निजी गुप्त	personal private, secret, confidential
ખાનદાન	खानदान	વિ	1 સારા ઘરનુ, કુળવાન 2 પ્રતિષ્ઠિત	खानदानी, कुलीन प्रतिष्ठित, आबरूदार	noble, of noble birth respectable
		ન	કુટુંબ, કુળ	खानदान, कुटुंब	family

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાનદાની	खानदानी	स्त्री	1. ખાનદાનપણ, कुलीनता 2. સજ્જનતા	कुलीनता सज्जनता	nobility of birth goodness, gentlemanliness
ખાનુ	खानु	न	1. ઘર, ઘરનો ભાગ, ખડ 2. ભડાર, નિધિ 3. પેટીપટારો કે મેજ, કબાટ વગેરેમાં વસ્તુ મૂકવા કરેલો વિભાગ 4. લખાણ માટે અલગ પડાતો વિભાગ કે કોઠો	खाना, घर का खड, कमरा भडार, निधि खाना, दराज, ड्राअर (मेज आदि की) कोष्ठक, खाना	house, part of a house store, treasure drawer or compartment of a box or a cup-board column of a table
ખાપ	खाप	स्त्री	1. દર્પણ 2. અબરખની પતરી	दर्पण, शीशा अबरक की पत्ती	mirror small piece of mica
ખાપરિયુ	खापरियु	न	1. બાળકને આપવાનું એક ઔષધ 2. આખનું એક ઔષધ	बालक की एक औषध खपरिया, आँख की एक औषध	a medicine for children a medicine for eyes, sulphate of zinc
ખાપરી	खापरी	स्त्री	લીટની પોપડી, ગૂચુ	नाक का सूखा मैल, नकटी	hard crust of mucus in the nose
ખાપરુ	खापरु	वि	ગાજ્યુ ન જાય એવું, બહુ જ પહોંચેલું, કપરુ	दबग, अनुभवो, पक्का	undeterred very clever. hard, difficult
ખાબ	खाब	पु	1. ઊંઘ 2. સ્વપ્ન	नींद स्वप्न, खवाब	sleep dream
ખાબોચિયુ	खाबोचियु	न	પાણીથી ભરેલો નાનો ખાડો	डबरा, पानी से भरा हुआ छोटा खड्डा	pool, puddle

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખામણ	खामणु	न	1 (परिधारा वगेरेमा) वासाण मूकवा सारु डरेली बेसाणी	(घड़ौची आदि में) बरतन रखने के लिए बनायी हुई जगह	small depression on which a vessel with a round bottom can be placed
ખામી	खामी	स्त्री	2 છછશે ક્યારો 3 ખામુ, કદ	थाला, आलबाल कद, आकार	shallow bed form, size
ખામુખા	खामुखा	अ	1 ખોડખાપણ, કસર, ઊણપ 2 ખોટ, ઘટ 3 ભૂલ, દોષ	खामी, न्यूनता, कसर घट, घाटा भूल, दोष	defect deficiency loss
ખાયકી	खायकी	स्त्री	1 ઇચ્છાએ કે અનિચ્છાએ, નાટ્યુટકે, અવશ્ય 2 ખાસ કરીને 3 જાણીજોઈને	अनिवार्य होने के कारण विशेष रूप से जानबूझकर	mistake, fault compulsorily, certainly
ખાર	खार	पु	1 પેદાશ, મળતર 2 કોઈનુ ખોટી રીતે પડાવવુ-મેળવવુ તે	उत्पादन, प्राप्ति किसी का अनुचित लाभ उठाना	production, gain
ખારવો	खारवो	पु	1 કાટો 2 વેર, દ્વેષ 3 ઇર્ષા, અદેખાઈ 4 ખારાશવાળો પદાર્થ, ક્ષાર	मुश्किल वैर, द्वेष इर्ष्या क्षार, क्षार वाली चीज	difficulty antagonism malice, envy salt
ખારાઈ	खाराई	स्त्री	1 ખલાસી, વહાણ ચલાવનારો 2 સચારો 3 ખારટવાળો જોળ	खवेया खपरैल छाने वाला नमकीन स्वाद वाला गुड	sailor, seaman tile-turner jaggery with salt taste
				बहुत नमक होना	saltishness

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખારાટ	खाराट	पु	સહેજસાજ ખારાટ	थोडा सा नमक होना	little saltishness
ખારાશ	खाराश	स्त्री	1 ખારાટ 2 (લા) અણબનાવ	नमकीन होना अनबन	saltishness disagreement
ખારી	खारी	स्त्री	1 ખારવાળી માટી કે જમીન 2 ખારાશવાળી એક ભાણ 3 એક વજન (દોઢ માણ)	क्षार वाली मिट्टी या जमीन क्षार वाली एक प्रकार की वनस्पति एक तोल (डेढ मन)	saltish earth or ground kind of saltish vegetable a weight (one maund and a half)
ખારીલુ	खारीलु	वि	દ્વેષીલુ, વેરઝેર	द्वेषी, ईर्ष्यालु	vindictive, rancorous
ખારુ	खारु	वि	1 મીઠા જેવા સ્વાદનુ 2 મીઠામા આથેલુ, મીઠુ ચડાવેલુ 3 ખારવાળુ, ખારીલુ	नमक जैसे स्वाद वाला नमकीन द्वेषयुक्त, जहरीला	having a saltish taste salted malicious
ખારુ અગર	खारु अगर	वि	એકદમ ખારુ	बहुत नमक वाला	very saltish
ખારુ ઊસ	खारु ऊस	वि	જુઓ 'ખારુ અગર'	देखिए खारु अगर'	see 'ખારુ અગર'
ખારુ દવ	खारु दव	वि	ખારુ અગર, ખારુ ઊસ	बहुत नमक वाला	extremely saltish
ખારેક	खारेक	स्त्री	સૂકવેલુ ખજૂર	सूखा खजूर	dried date
ખારો	खारो	पु	એક ક્ષાર, સચોરો, પાપડખાર	एक प्रकार का क्षार	carbonate of soda
ખારોપાટ	खारोपाट	पु.	1 એક રમત, અગરપાટો 2 ખારપાટ	एक प्रकार का खेल क्षारवाली जमीन	a game for children salt-producing field

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાલ	खाल	स्त्री	1 ચામડી 2 છાલ	चमडी छिलका	skin bark
ખાલડી	खालडी	स्त्री	જુઓ 'ખાલ'	देखिए 'ખાલ'	see 'ખાલ'
ખાલપો	खालपो	पु	ચામડિયો	चमार	tanner
ખાલવવું	खालववु	स क्रि	ખાલી કરવું	खाली करना	to empty, to vacate
ખાલસા	खालसा	वि	1 પોતાની કુલ માલિકીનું, આગવું 2 સરકારના વહીવટનું, સરકારી 3 શીખગુરુ ગોવિંદસિંહે પ્રર્ષતાવેલા વિધાનને અનુસરનારું	अपना, निजी, अपनी मालिकी का सरकार जिसे व्यवस्थित करती है वैसा, सरकारी, राजकीय सिक्ख गुरु गोविन्द सिंह द्वारा प्रवर्तित नियमों का अनुसरण करने वाला	of one's complete ownership under government management, of the government following the new dispensation of Guru Govind Singh
ખાલિસ	खालिस	वि	1 शुद्ध 2 कूटकपट विनानु	शुद्ध निष्कपटी	pure straight forward
ખાલી	खाली	वि	1 ઠાલુ, કશું ભર્યા વગરનું 2 निर्धन, गरीब	खाली निर्धन, खाली हाथ	empty poor, indigent, empty handed
ખાલુ	खालु	न	1 જોડાનું ઉપલુ ચામડું 2 વાણાની કોકડી ભરવાનો નેતર કે બરુનો પોલો કકડો	जूते के ऊपर का चमड़ा हाथ करघे के यत्र का एक भाग	upper part of shoe piece of hollow cane or reed covered with yarn and fixed in the shuttle and used in weaving

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 ખળાના અનાજ ઉપર ઢાકવાનુ ઘાસ	खलिहान के अनाज के ऊपर ढकने का घास	grass for covering corn on the threshing floor
ખાવટી	खावटी	स्त्री	1 શાહુઝાર કે ધણિયા માને ત્યાથી ઉછીનુ લેવાતુ અનાજ 2 જિવાઈ	साहूकार या सेठ के घर से उधार लिया हुआ अनाज वेतन, आजीविका	corn borrowed from dealer or employer wages, means of livelihood
ખાવુ	खावु	स क्रि	1 અન્ન લેવુ, જમવુ 2 વેઠવુ, ખમવુ 3 વાપરવુ, ભોગવવુ 4 લેવુ, ખર્ચ કરાવવુ ખર્ચ તરીકે કઢાવવુ 5 વગર હકે લેવુ, ચોરી છુપીથી લેવુ 6 'દમ, છીક, બગાસુ, ઉધરસ' ઇ સાથે વપરાય છે-શરીરથી તે ક્રિયા કરવી કે થવી, એ અર્થમાં 7 પકવાન 8 ખાવાની ચીજ, ભાથુ	खाना सहन करना, बरदाश्त करना भोगना, उपयोग करना लेना, खर्च करवाना, खर्च के रूप में लेना बिना हक ले लेना दम, छीक, जम्हाई, खासी इत्यादि के साथ प्रयुक्त होता है। शरीर के साथ वह क्रिया करने या होने के अर्थ में मिष्टान्न खाने की चीज, यात्रा में साथ में ली गई खाने की चीजे	to eat to bear to use, enjoy to take, to make (another person) spend to embezzle used as a verb with 'દમ, 'છીક' etc to indicate the performance of that activity sweetmeat eatable, nfin
ખાસ	खास	वि	1 પોતીકુ, અગત	खास, निजी, अपना	personal intimate

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખાસડું	ખાસડું	ન	2 વિશિષ્ટ, અસાધારણ 3 ખરું, અસલ 4 અમીરા	વિશિષ્ટ, અસાધારણ ખરા, અસલ અમીરાના, ખાસ	peculiar, salient genuine high-born
ખાસિયત	ખાસિયત	સ્ત્રી	1 જૂતા, જોડો 2 ઠપકો	જૂતા ફટકાર	foot-wear, shoe rebuke
ખાસુ	ખાસુ	વિ	1 સ્વભાવ, પ્રકૃતિ 2 વિશિષ્ટ ગુણધર્મ 3 આદત	સ્વભાવ, પ્રકૃતિ વિશિષ્ટ ગુણધર્મ આદત	nature, disposition peculiar quality habit
ખાજ	ખાજ	અ	રૂડું, મજેનું, સુદર, બરોબર યોગ્ય 1 વાહ, શાખાશ 2 સુદર બેશા બરાબર	સ્પવાન, અચ્છા, સુંદર, ઠીક, યોગ્ય વાહ, શાખાશ સુંદર, બરાબર	fine, beautiful, proper (interr) bravo! fine! beautiful!
ખાજકૂડી	ખાજકૂડી	સ્ત્રી	1 મેલા પાણીના નિકાલ માટેની નળનીક 2 ખાજવાળી થોકડી	ગદા નાલા	gutter, drain pipe
ખાજવું	ખાજવું	સ ક્રિ	અટકાવવું, રોકવું ('ખાજવું' નું પ્રેરક)	કમરે કે કોને મેં ગદે પાની કે બાહર જાને કે લિએ પત્થર કા ચતુષ્કોણ	square spot in the corner of a room with drainage, cesspool
ખાગું	ખાગું	પુ	1 જાણબેદું, જાસૂસ 2 ખાડો	ઉપર્યુક્ત ચતુષ્કોણ મેં ગદા પાની જહા જમા હોતા હૈ એસી જગહ રોકના	a small pit in a corner where dirty water is being contained to stop, to prevent (caus of 'ખાજવું')
				જાસૂસ, ગુપ્તચર ખડ્ડા	spy pit

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખામું	खागु	वि न	1 डोरवधु (रमतमा पासो डे डोडी) ટેબલનું ખાનું	कौडी के खेल में उपयोग में आने वाली पटरी मेज का दरज	round piece of tile used by girls in play compartment in a table
ખાચ	खाच	स्त्री	1 ખાચો, નાનો ખાડો-કાપ 2 સાકડ, ગૂચવણ 3 ખોટ, તોટો 4 આચકો 5 જમે-ઉધારનો તાળો નહિ મળવો તે, વધઘટ	खॉचा, सतह पर का छोटा गड्ढा, कटाव सकीर्णता, उत्पन्न घाटा, टोटा धक्का, झटका जमा-उधार का हिसाब न मिलना	crevice, slight depression, cut complication loss, deficiency jolt discrepancy in account
ખાજ	खाज	न	લગડાપણ	लगडा होना	lameness
ખાજણ	खाजण	स्त्री	જ્યા દરિયાનું પાણી આવી ભરાઈ રહેતું હોય એવી જગા, ભાઠાની જમીન	जहा समुद्र का पानी ज्वार के समय इकट्ठा होता हो वैसी जगह	land exposed to the overflow of tide
ખાડવું	खाडवु	सक्रि	1 शेतरा જુદા કરવા, કૂટવું 2 કચરવું, કૂટવું 3 કકડે કકડા, ચૂરેચૂરા કરવા, નાશ કરવો	खॉडना, कूटना कुचलना, कूटना, टुकड़े-टुकड़े करना, विनाश करना	to thresh to pound, to beat to crush
ખાડિયું	खाडियु	वि न	ખડિત થયેલું, ખોડખાપણવાળું, ભાગલા શાંગડાનું 1 ભાગલા શાંગડાવાળું ઢોર 2 ભેસ, પાડું (એકવચનમા વપરાય છે)	खडित, दोषपूर्ण, टूटे हुए सींग वाला पशु भैस, भैसा (बच्चा)	broken, crippled, of broken horns cattle with broken horn buffalo, calf

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			5 लाभाछट थछने पडवु-सूवु ते, प्रणाम लावु छट थछने पडेकु- सूतेकु	सीधा जमीन पर सोना, प्रणाम प्रणाम की भंगिमा में सोना	prostration lying prostration
ખાપણ	खापण	स्त्री	જુઓ 'ખાપ' માં 1 થી 4	देखिए 'ખાપ' में, 1 से 4	see 1 to 4 in 'ખાપ'
ખાપવુ	खापवु	स क्रि	1 सोरवु, ખાપા કાઢી નાખવા 2 થોકુ થોકુ ખોદવુ, પાવડથી (ઢગલામાંથી લઈ) આમતેમ ફેરવવુ	छँगना, खुत्थियाँ हटाना थोडा-थोडा खोदना (ढेर में से), फावडे से इधर-उधर करना	to scrape, to remove stubs to dig superficially, to remove earth from a heap and spread it out
ખાપો	खापो	पु	1 કાપ્યા પછી રહેલુ આણખોદાયેલુ જાડયુ 2 ભાંગેલી કાખળીનુ થડને વળગી રહેલુ ઠૂઠુ 3 કોઈપણ સપાટી ઉપર રહી ગયેલો કચરો, ખૂપરો 4 ખાપ, ખોડ, ખામી 5 (લા) રાખો	खुत्थी, खँटी टूटी हुई डाली का तने से लगा हुआ ठूठ किसी भी सतह पर रहा हुआ, खँटी खामी, दोष गँवार, उजड़	stub or stump blunt piece of broken branch remaining with the trunk any projecting part left on a surface defect rustic
ખાસવુ	खासवु	अ क्रि	ખાસી ખાવી	खॉसना	to cough
ખિજવાટ	खिजवाट	पु	ખિજવુ તે, ગુસ્સો, ક્રોધ	चिढ़, खीज, गुस्सा, कुढ़न	anger, wrath
ખિજમત	खिजमत	स्त्री	સેવાચાકરી, તહેનાત	खिदमत	service, attendance
ખિજમતગાર	खिजमतगार	पु	સેવક, નોકર, ચાકર	खिदमतगार, खिदमती	servant, attendant

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખિજાવવું	खिजाववु	स क्रि	'ખીજવું' નું પ્રેરક	खिजाना, चिढाना	caus of 'ખીજવું'
ખિજાવું	खिजावुं	अ क्रि	'ખીજવું' નું કર્મણિ	खीजना, चिढना, खीझना	pass of 'ખીજવું'
ખિયાનત	खियानत	સ્ત્રી.	બેઇમાની	खयानत, बेईमानी	dishonesty
ખિલકોડી	खिलकोडी	સ્ત્રી	ખિસકોલી, ખિલોડી	गिलहरी	squirrel
ખિલખિલ	खिलखिल	સ્ત્રી	1 (રવ) ખિસકોલીનો રવ 2 ખૂબ હસવાનો રવ	गिलहरी की आवाज बहुत हँसने की आवाज	sound as of a squirrel sound of loud laughter
ખિલત	खिलत	સ્ત્રી	માનનો પોશાક, સિરખાવ	खिलअत, सम्मानार्थ पोशाक	robe of honour
ખિલવર	खिलवर	સ્ત્રી	જુઓ 'ખિલવણી'	देखिए 'ખિલવણી'	see 'ખિલવણી'
ખિલવણી	खिलवणी	સ્ત્રી	ખીલવવુ તે	खिलना, विकास	cultivation, blooming
ખિલવું	खिलावुं	अ क्रि	1 ઊંચે અટકી રહેવુ, ટિંગાવુ, ભરાઈ જવુ 2 અ ક્રિ. 'ખીલવું' નું ભાવે ને કર્મણિ	टँगना, उलझना, फँस जाना	to be hung, to remain suspended, to be entangled (impersonal and passive) of (intr) 'ખીલવું'
ખિલોડી	खिलोडी	સ્ત્રી	જુઓ 'ખિલકોડી'	गिलहरी	see 'ખિલકોડી'
ખિલોણ	खिलोणु	ન	રમકડુ	खिलौना	toy
ખિલ્લત	खिल्लत	સ્ત્રી	જુઓ 'ખિલત'	खिलअत	see 'ખિલત'
ખિસકોલી	खिसकोली	સ્ત્રી	એક જનાવર, ખિલકોડી	गिलहरी	squirrel
ખિસિયાણુ	खिसियाणु	વિ	ખસિયાણુ, ઝખવાણુ	खिसियाना	abashed, crest-fallen
ખિસ્સાકાતરુ	खिस्साकातरु	વિ	ગજબાકાતરુ, ખીસુ કાપીને થોરનાર	जेबकतरा, जेबकट	pick-pocket

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાડી	खाडी	स्त्री	20 કાચા મણનું તોલ-માપ	20 कच्चे मन का तोल	a measure of 20 kacha maund
ખાડુ	खाडु	न	1 સામાન્ય કે બેધારી તલવાર 2 વરને બદલે એનું ખાડુ લઈને ગયેલી જાન 3 ખડિત, ખાણ પડેલું, ભાંગેલું	खौंड़ा दूल्हे के बदले उसका खौंड़ा साथ में लेकर जाने वाली बारात खडित, टूटा हुआ	ordinary or two-edged sword procession with a bride-groom's sword instead of the bride-groom himself at the head broken, indented
ખાત	खात	स्त्री	1 ચીવટપૂર્વક લાગ્યા-મડયા રહેવાનો ગુણ, ખત 2 ચીવટ, ધ્રુજણ 3 હોશ, ઉમંગ 4 લાલસા, તૃષ્ણા	धैर्य का गुण, दृढता से काम में लगे रहने का गुण देखभाल उत्साह, उमंग लालसा, तृष्णा	perseverance care enthusiasm greed, desire
ખાજરુ	खाजरु	न	1 ખૂણો, ખૂણે પડતું -જાહેર નહિ તેવું સ્થળ 2 કૂટણીનું ઘર, કૂટણખાનું 3 અનાજ સઘરવાની જગા, કોઠાર (સુ.) 4 માંસ (કા.)	कोना, वह स्थल जहाँ किसी की निगाह न जाए कुटनी का घर कुठली-कोठार गोश्त	corner, secluded place in a corner brothel granary flesh
ખાટુ	खाटु	वि	ખાટ, પક્કુ, પહોંચેલ	काइर्यो, चाँई	cunning, shrewd
ખાડ	खाड	स्त्री	એક ગળ્યો પદાર્થ	चीनी, शक्कर	sugar
ખાડણિયુ	खाडणियु	न	સાબેલું	मूसल	pestle

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખાડણિયો	खाडणियो	पु	અનાજ કે બીજી ચીજ ખાડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું સાધન-પાત્ર	ओखली, ऊखल	large wooden mortar for pounding corn etc
ખાડણી	खाडणी	स्त्री	ખાડવાનું પાત્ર, નાનો ખાડણિયો	छोटी ओखली	small mortar
ખાડણીપરાઈ	खाडणीपराई	स्त्री	ખાડણી ને પરાઈ	ओखली और दस्ता	mortar and pestle
ખાતીલુ	खातीलु	वि	ખાતવાળુ	मुस्तैद, धैर्यवान	perseverant
ખાઘ	खाघ	स्त्री	1 ખભો 2 પશુની ગરદન 3 ભાર વહેતા પશુની ગરદન પર પડતું આટણ	कधा पशु की गर्दन पशु की गर्दन पर पडने वाला घट्ठा	shoulder neck of cattle hardened skin on the neck of a beast of burden
ખાઘિયો	खाघियो	पु	1 ખાઘે ચડાવી લઈ જનારો, મુડદુ ઊચકનારો 2 મદદ કરનારો, સાથી 3 ખુશામતિયો	अरथी उठाने वाला, कधा देने वाला साथी, मददगार खुशामदी	one carrying (some-thing) on the shoulders, pall-bearer helper, colleague flatterer
ખાઘુ	खाघु	न	ઝાઘુ, હપતી	किश्त, भाग	instalment
ખાઘો	खाघो	पु	જુઓ 'ઝાઘવ'	देखिए 'अधव'	see 'अधव'
ખાપ	खाप	स्त्री	1 ખામી, ખોડ, એબ 2 નુકસાન 3 મુડદા ઉપર ઓઢાડવાનું કપડું, કફન 4 દવાના ઉપયોગ માટે ડોટલાવાળા અમુક બિયાખાથી ઝાટેલું તેલ	खामी, दोष, ऐब नुकसान कफन एक प्रकार का तेल जो दवा के काम आता है	defect, infirmity, slur damage shroud a type of medicinal oil

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખિસ્સાખરચ	खिस्साखरच	पु	1 सामान्य अर्थ माटे ખીસામા રાખવાનું નાણું 2 પસંદ પડતી ખાખતમા વાપરવા મળેલું— ખાસ ખરચનું નાણું	जेब में रखने के पैसे जो सामान्य खर्च के लिए हों जेबखर्च, निजी खर्च	pocket money pocket money for special purpose
ખિસ્સાખરચ	खिस्साखर्च	पु	જુઓ 'ખિસ્સાખરચ'	देखिए 'ખિસ્સાખરચ'	see 'ખિસ્સાખરચ'
ખિસ્સુ	खिस्सु	न	ગજવુ	जेब	pocket
ખીચ	खीच	वि	ગીચ, ભરચક	खचाखच, ठसाठस	thick, crowded
		स्त्री	ખીચડી	खिचडी	dish made of rice and pulse
ખીચડી	खीचडी	स्त्री	એક ખાવાની વાની	खिचडी	hotch-potch, a kind of preparation of rice and pulse
ખીચાખીચ	खीचाखीच	अ	ગીચોગીચ, ભરચક, ઠાસી ઠાસીને	खचाखच, ठसाठस	crowdedly, thickly, tightly
ખીચોખીચ	खीचोखीच	अ	જુઓ 'ખીચાખીચ'	देखिए 'ખીચાખીચ'	see 'ખીચાખીચ'
ખીજ	खीज	स्त्री	1 ચીડ, ગુસ્સો 2. ખીજવવા માટે પાડેલું નામ	खीज, चिढ़ चिढ़ाने के लिए दिया हुआ नाम	anger, annoyance name given with a purpose of annoying somebody
ખીજડો	खीजडो	पु	એક ઝાડ, સમડો	शमी (वृक्ष)	kind of tree
ખીજવવુ	खीजववु	स क्रि	ખીજે એમ કરવુ, ચીડવવુ	खिझाना, चिढ़ाना	to annoy, to make angry
ખીજવાવુ	खीजवावु	अ क्रि	'ખીજવુ' નું કર્મણિ	'ખીજવુ' का कर्मणि रूप	passive of 'ખીજવુ'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખીજવુ	खीजवु	अ क्रि	1 ગુસ્સે થવુ 2 ડાટવુ, વઢવુ	खीझना, चिढना डॉटना	to get angry to rebuke, to give a scolding
ખીણ	खीण	स्त्री	1 બે ટેકરીઓ વચ્ચે આવેલો સાકડો માર્ગ 2 પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો પ્રદેશ	घाटी, वादी, दर्रा खोह, घाटी	pass valley
ખીમો	खीमो	पु	માસનો છૂંદો	कीमा	minced meat
ખીર	खीर	वि	સારહીન, નકામુ	सारहीन, निकम्मा	meaningless, useless
		स्त्री	1 દૂધભાતની એક વાની 2 દૂધ 3 એક પક્ષી	दूध-भात की एक बानगी दूध एक पक्षी	sweet dish of milk and rice milk kind of bird
ખીરુ	खीरु	न	1 લોટ અને પાણીને અડવાળી ઢરેલો રગડો 2 ખમીર ચડાવેલો આથો 3 એક જાતની ડુમળી કાકડી 4 એક જાતનું જાડું કાપડ	(आटा और पानी का) घोल खमीरदार घोल खीरा मोटा कपडा	mixture of flour and water fermented liquid mixture kind of tender cucumber kind of coarse cloth
ખીલ	खील	पु	1 જુવાનીમા મો પર થતી ફોલ્લી 2 આખના પોપચા પર થતી લોહી-માસની ગડી 3 ઘટોનો ખીલડો	मुहासा पलक पर होनेवाली गाँठ चक्की की खूँटी, कील	pimple granulation central pin or peg round which the upper stone of a grinding-mill moves

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખીલડો	खीलडो	પુ	ઘટીના ઉઠલા પડમા વચ્ચોવચ આપેલી ખીલી, જેના પર ઉપલુ પડ ફરે છે	चक्की की खूँटी, कील, राछ	central peg or pin of a grinding mill round which the upper stone moves
ખીલમાકડા	खीलमाकडा	ન	છોકરાની એક રમત	बच्चों का एक खेल	kind of children's game
ખીલમાકડી	खीलमाकडी	સ્ત્રી	1 ઘટીના ઉપલા પડિયાની વચ્ચોવચનુ લાકડુ જે ખીલડામા પરોવાય છે	मानी (चक्की की)	piece of wood fixed in the upper part of the stone of a grinding mill which is fixed on the central pin or peg
			2 ખીલડો અને માકડી	कील और मानी (चक्की की)	tenon and mortoise
ખીલમાકડા	खीलमाकडा	ન	જુઓ 'ખીલમાકડો'	देखिए 'खीलमाकडा'	see 'ખીલમાકડો'
ખીલમાકડી	खीलमाकडी	સ્ત્રી	જુઓ 'ખીલમાકડી'	देखिए 'खीलमाकडी'	see 'ખીલમાકડી'
ખીલવવુ	खीलववु	સ ક્રિ	1 ખીલે એમ કરવુ 2 ખોલવુ, ફાટવુ સીવવુ (ઘાબળા ચોફાળના બે પાટ પેઠે)	खिलाना, विकसित करना खोलना, सीना	to cause to bloom or to blossom to open, to sew
ખીલવાવુ	खीलवावु	અ ક્રિ	'ખીલવવુ' નુ કર્મણિ	'खीलववु' का कर्मणि रूप	passive of 'ખીલવવુ'
ખીલવુ	खीलवु	અ ક્રિ	1 ફૂલવુ, ફાલવુ, વિકસવુ 2 શોભવુ, દીપવુ	खिलना फबना, सुदर लगना	to blow, to blossom to shine, to glow

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			3 ખુશીમાં આવવું, ગમ્મતે ચડવું	प्रसन्न, प्रफुल्लित होना	to be elated, to come into one's own
			4 થગવું, ઉશ્કેરાવું વીરવું	रग में आना, मस्ताना या उत्तेजित होना	to get excited
			5 બખિયા દઈને સીવવું, ફાટવું, ખીલવવું	सीना, डंडियाना	to sew, to thread
ખીલો	खीली	स्त्री	नानो ખીલો, ચૂક	कील, मेख	small nail
ખીલો	खीलो	પુ	1 ખૂટો, મેખ 2 દુકામજાના જુગારમાં પૈસાની હોડ લાગે તે લેનારો મધ્યસ્થ જુગારી	खूँटा जुए का दौंव लेने वाला मध्यस्थ जुआडी	nail booky (in gambling)
ખીશર	खीशर	પુ, સ્ત્રી	ઠડીનો દિવસ મકરસંક્રાંત, ઉત્તરાયણ	जाडे का दिवस मकर संक्रान्त	cold day transition of the sun from sagittarius to capricornus winter solstice
ખીસર	खीसर	પુ	જુઓ 'ખીશર'	देखिए 'ખીશર'	see 'ખીશર'
ખીસાકાતરુ	खीसाकातरु	વિ	જુઓ 'ખિસ્સાકાતરુ'	देखिए ખિસ્સાકાતરુ	see 'ખિસ્સાકાતરુ'
ખીસાખરચ	खीसाखरच	પુ	જુઓ 'ખિસ્સાખરચ'	देखिए 'ખિસ્સાખરચ'	see 'ખિસ્સાખરચ'
ખીસાખર્ય	खीसाखर्य	પુ	જુઓ 'ખિસ્સાખર્ય'	देखिए 'ખિસ્સાખર્ય'	see 'ખિસ્સાખર્ય'
ખીસુ	खीसु	ન	ગજ્યુ	खीसा, जेब	pocket
ખીટી	खीटी	સ્ત્રી	1 નાનો ખાટો	खूँटी, मेव	peg

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 કપડા ભરવવા ભીંતમાં જકેલુ, ટેકણ	खूँटी	peg
ખુટાડવું	खुटाडवु	સક્રિ	1 ખૂટે એમ કરવું, ઘટાડવું 2 પૂરું કરવું	घटाना, कम करना खत्म करना	to exhaust to finish
ખુડદો	खुडदो	પુ	1 મોટી સિક્કાની કિંમતના નાના સિક્કા તે, પરચૂરણ 2 કકડેકકડા, ભૂકો	खुदरा, रेजगारी रेजा, चूरा	change in small coins pieces, utter defeat or dislocation
ખુતબો	खुतबो	પુ	1 તારીફ, પ્રશસા 2 જુમાને દિવસે નમાજ વખતે પઢાતો ખાસ સ્તુતિપાઠ	तारीफ, प्रशसा खुतबा	appreciation, praise words in praise of God said in prayer by Moslems
ખુનામરકી	खुनामरकी	સ્ત્રી	ખૂનરેણ, કાપાકાપી	खूरेजी, खूनखुराबा	bloodshed, carnage
ખુનસ	खुन्नस	સ્ત્રી, ન	ખૂન કરાવે એવી ઝેરી લાગણી, વેરઝેર	खुनस	murderous hate
ખુરજી	खुरजी	સ્ત્રી	(સવારીમાં સાથેનો સરસામાન રાખવાની ઘોડેસવારની) થેલી, ઝેણો	खुरजी	rider's bag
ખુરદો	खुरदो	પુ	જુઓ 'ખુડદો'	देखिए 'ખુડદો'	see 'ખુડદો'
ખુરમું	खुरमु	ન	એક જાતની મીઠાઈ	खुरमा (मिठाई)	kind of sweetmeat
ખુરશી	खुरशी	સ્ત્રી	1 એક જાતનું આસન 2 માનનું કે પદનું યા અમલનું સ્થાન	कुरसी, कुर्सी मान या अधिकार का आसन, कुर्सी	chair position of authority

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા. કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખુરશી	खुरसी	સ્ત્રી	જુઓ 'ખુરશી'	देखिए 'ખુરશી'	see 'ખુરશી'
ખુરી	खुरी	સ્ત્રી	ખરી	खुर, सुम	hoof
ખુલાસાવાર	खुलासावार	અ	ખુલાસા સાથે	खुलासावार, खुलकर	with explanation
ખુલ્લુ	खुल्लु	વિ	1 ઉઘાડુ 2 નિખાલસ, થોખ્ખુ 3 સ્પષ્ટ 4 નાગુ, ઢાંકેલુ નહિ તેવુ 5 છૂપુ નહિ-જાહેર 6 અસભ્ય 7 આશ્ચર્યચક્ર 8 ઘેરુ નહિ-આછુ	खुला साफदिल स्पष्ट नगा, जो ढँका या छिपा हुआ न हो प्रकट, जाहिर, खुला असभ्य जो घिरा हुआ न हो, खुला जो गाढ़ा न हो, हलका	open frank clear naked, exposed public impolite not surrounded faint
ખુવાર	खुवार	વિ	1 અતિદુ ખી, હેરાન 2 પાચમાલ	खवार, अति दुखी, बहुत परेशान तबाह	very miserable or troubled ruined
ખુવારી	खुवारी	સ્ત્રી	પાચમાલી, નાશ	तबाही, बर्बादी	ruin, destruction
ખુશ	खुश	વિ	1 આનંદી, હર્ષિત, પ્રસન્ન 2 તદુરસ્ત	खुश, प्रसन्न तदुरस्त	happy, joyful healthy
ખુશકી	खुशकी	સ્ત્રી	જમીનમાર્ગ	खुशकी, स्थल-मार्ग	land route
ખુશબોદાર	खुशबोदार	વિ	સુગંધીદાર	खुशबूदार, सुगंधित	fragrant
ખુશમિજાજ	खुशमिजाज	પુ	સારો-આનંદી સ્વભાવ	आनंदी स्वभाव	joyous nature
		વિ	ખુશમિજાજ	खुशमिजाज, हंसमुख	happy, merry

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખુશમિજાજી	ખુશમિજાજી	વિ	ખુશમિજાજીવાળુ	ખુશમિજાજ	happy, merry
ખુશામત	ખુશામત	સ્ત્રી	સ્વાર્થ માટે કરેલા ઉદ બહારના વખાણ, પળશી, હાજી હા	હુશામદ	flattery
ખુશામતખોર	ખુશામતખોર	વિ	ખુશામતના ટેવવાળુ, ખુશામતિયુ	ખુશામદી	given to flattering
ખુશામતિયુ	ખુશામતિયુ	વિ	ખુશામત કરનારુ	ખુશામદી	flattering
ખુશામતિયો	ખુશામતિયો	પુ	ખુશામતિયો આદમી	હુશામદી	flatterer
ખુશામદ	ખુશામદ	સ્ત્રી	જુઓ 'ખુશામત	હુશામદ	see 'ખુશામત'
ખુશામદખોર	ખુશામદખોર	વિ	જુઓ ખુશામતખોર'	દંચિખ ખુશામતખોર'	see 'ખુશામતખોર'
ખુશાલ	ખુશાલ	વિ	1 ખુશ હાલતમા હોય એવુ સુખી 2 કુશળ, તદુરસ્ત	હુશહાલ, સુખી તદુરસ્ત	prosperous healthy
ખુશી	ખુશી	સ્ત્રી	1 આનંદમગ્નતા, હર્ષ 2 મરજી, ઇચ્છા, રુચિ	ખુશી, હર્ષ મરજી, ઇચ્છા, રુચિ	pleasure wish, desire, liking
		વિ	ખુશ, રાજી	ખુશ, રાજી	pleased
ખૂજલી	ખૂજલી	સ્ત્રી	1 યજ, વલૂર, ખજવાળ 2 ચામડીનો એક રોગ 3 જે ભાગવાથી ખજવાળવુ પડે તે, ખજૂરી	ખુજલી, ચુલ ખાજ, ખુજલી રોગ વહ चीज जिसके छू जाने से खुजलाना पडे	itch, itching a skin disease anything that causes itching
ખૂજળી	ખૂજળી	સ્ત્રી	જુઓ 'ખૂજલી'	દેચિખ 'ખૂજલી'	see ખૂજલી'
ખૂટલ	ખૂટલ	વિ	અપ્રામાણિક, ખોટાખોલુ (કા)	અપ્રામાણિક, ઝૂઠ બોલનેવાલા	dishonest, liar
ખૂટેલ	ખૂટેલ	વિ	1 ખાલી થયેલ, કગાલ, દેવાળિયુ 2 કૂટેલુ, વિશ્વાસઘાતી	દિવાલિયા, કગાલ વિશ્વાસઘાતી	exhausted, poor, bankrupt treacherous

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખૂટેલુ	खूटेलु	वि	જુઓ 'ખૂટેલ'	देखिए 'ખૂટેલ'	see 'ખૂટેલ'
ખૂણ	खूण	स्त्री	1 દિશા 2 નિશાની, ચિહ્ન	दिशा चिह्न, निशानी	direction sign, symbol
ખૂણિયુ	खुणियु	वि	ખૂણાવાળુ	कोने वाला	having angles, angular
ખૂણેખાચરે	खुणेखाचरे	अ	કોઈ ખૂણામા-ખૂણાપડતી અપરિચિત જગાએ	कोना-अंतरा में	in nook or corner, in unfamiliar place
ખૂણો	खूणो	पु	જ્યા બે દિશા કે લીટી મળતી હોય તે જગા, કોણ, ખાચો	कोना	corner, angle
ખૂણોખાચરો	खूणोखाचरो	पु	ખૂણો કે ખાચો	कोना-अंतरा	nook or corner
ખૂતવુ	खूतवु	अ क्रि	1 ખૂપવુ, કાદવમા ઊતરી જવુ, કળવુ 2 અદર જઈ ચોટી જવુ	दलदल में धँसना, गडना भीतर जाकर चिपक जाना	to get stuck or sink in mud to get stuck
ખૂદરુ	खूदरु	न	ખોતરણ, દ્વેષ ખાતર કાઢેલી ભૂલ, વાધાવચકો, છિદ્ર	खुचड, छिद्र	error or fault shown out of malice
ખૂદરુ	खूदरु	न	જુઓ 'ખૂદરુ'	देखिए 'ખૂદરુ'	see 'ખૂદરુ'
ખૂન	खून	वि	1 લોહી 2 ખૂનની-વેરની તરસ, ખૂનસ 3 જીવશી મારી નાખવુ તે, હત્યા	खून खुनस, कीना हत्या, खून	blood thirst for blood or revenge murder
ખૂનસ	खूनस	स्त्री, न	ખૂનની-વેરની તરસ, ખૂનસ	खुनस, कीना	murderous desire
ખૂમચો	खूमचो	पु	ઢળતા કાનાનો છાછરો શાળ	खोचा	tray or large shallow dish

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખૂરપી	ખૂરપી	સ્ત્રી	ખરપડી	ખુરપી	weeder
ખૂલતુ	ખૂલતુ	વિ	1. ખુલ્લુ કે પહોળું, ભીસાતુ-તગ નહિ એવું 2 ઊઘડતુ	ખુલા, ઢીલા, જો તગ યા ચુસ્ત ન હો ખુલતા હુઆ (સ્કૂલ, દફતર આદિ)	loose, not close-fitting open
ખૂલવું	ખૂલવું	અ ક્રિ	1 ખુલ્લુ થવું, ઊઘડવું 2 ખીલવું 3 દીપવું, શોભવું	ખુલના ખિલના (ફૂલ) ફબના, ખિલના (રગ)	to open to bloom to shine, to glow
ખૂખારવું	ખૂખારવું	અ ક્રિ	1 (રવ) ખૂ ખૂ અવાજ કરવો 2 (અમુક અવાજ કરી) ગળું સાફ કરવું 3 હાહાહાવું 4 પોતાની હાજરી, મરદાઈ કે બડાશ બતાવવા) ખૂખારાથી અવાજ કરવો	ઘૂં-ઘૂં આવાજ કરના ખખારના હિનહિનાના ઘોંસકર આવાજ કરના	to make coughing sound to clear the throat with a coughing sound to neigh to make coughing sound to suggest one's presence or self-importance
ખૂખારો	ખૂખારો	પુ	1 ખૂખારવું તે 2 ખૂખારવાનો અવાજ	ખખાર ઘોં-ઘોં	clearing one's throat noise made while clearing one's throat
ખૂચ	ખૂચ	સ્ત્રી	1 ખાચ, ખૂણો, ખાચો 2 ખૂચવાની અસર, ભોંક 3 લાગણી, અસર	કોના, ઘોંચ, નુકકડ ચુમન, ઘટક અસર, લગના	lane, corner effect of pricking feeling, effect

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 मनमा ખૂચવુ તે ખાર, દાઝ, વેર	द्वेष, बैर	pricking in the mind, vengeance, malice
			5 બારીક સમજ	सूक्ष्म बुद्धि, तीक्ष्ण सूझ-बूझ	subtle understanding
			6 ખોડખાપણ, વાધોવચ્છો	खुचड, खामी	defect, fault
ખૂચખાચ	खूचखाच	સ્ત્રી	જુઓ 'ખૂચ'	देखिए 'ખૂચ'	see 'ખૂચ'
ખૂચવુ	खूचवु	અ ક્રિ	1 નડવુ, ભોંકાવુ 2 મનમા ખટકવુ, દુખવુ 3 લપટાવુ, બધનમા પડવુ, ખૂપવુ	खटकना, चुभना मन में खटकना, सालना बधन में पडना, धँसना, लिपटना	to hurt, to prick to hurt or prick mentally to get entangled
ખૂચાવવુ	खूचाववु	સ ક્રિ	1 ખૂચવી લેવુ, ઝૂટી લેવુ 2 'ખૂચવુ' નુ પ્રેરક	छीन लेना, हथियाना 'ખૂચવુ' का प्रेरणार्थक रूप	to snatch away caus of 'ખૂચવુ'
ખૂટ	खूट	પુ સ્ત્રી અ	આખલો, સાઠ જમીનની હદ ખતાવતો પશ્ચર, હદનુ નિશાન બરાબર, માપસર, પૂરેપૂરુ	साँड खूँट (जमीन) ठीक नाप से, पूरा	bull stone showing boundary exactly, fully, completely
ખૂટવુ	खूटवु	સ ક્રિ	1 મૂળ સાથે ખેચી-ટૂપી કાઢવુ, નિર્મૂળ કરવુ, નિ કદન કાઢવુ 2 ચૂટવુ, ટૂપવુ	जडमूल से उखाडना खोटना, खुटकना	to exterminate, to root out to pick or pluck
ખૂટિયો	खूटियो	પુ	1 ખૂટ, સાઠ 2 બાજીગર, જાદુગર	साँड (बैल) जादुगर	bull juggler, conjurer
ખૂટી	खूटी	સ્ત્રી	1 ખાંટી 2 લાકડાની મેખ	खूँटी, मेख लकडी की मेख	nail wooden stake

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખૂતવુ	खूतवु	अ क्रि	1 ખૂપવુ, ડાદવમા ઊતરી જવુ, ડખવુ 2 અદર જઈ ચોટી જવુ	(दलदल में) धसना, गडना भीतर जाकर चिपक जाना	to get stuck in mud to stick inside
ખૂતાડવુ	खूताडवु	स क्रि	'ખૂતવુ' નુ પ્રેરક	'ખૂતવુ' का प्रेरणार्थक रूप	caus of 'ખૂતવુ'
ખૂદવુ	खूदवु	स क्रि	પગ વડે ગદડવુ, ગૂદવુ, કચરવુ	रौदना	to crush under foot
ખૂદાવવુ	खूदाववु	स क्रि	'ખૂદવુ' નુ પ્રેરક	'ખૂદવુ' का प्रेरणार्थक रूप	caus of 'ખૂદવુ'
ખૂદાવુ	खूदावु	स क्रि	'ખૂદવુ' નુ કર્મણિ	'ખૂદવુ' का कर्मणि रूप	passive of 'ખૂદવુ'
ખૂધ	खूध	સ્ત્રી	1 વાસા પર હોતો ઢેકો 2 વાસો વળી જવાથી થતો ઢેકો	कधे पर का डिल्ला, कूबड (पशु) पीठ की हड्डी के टेढ़ी होने से होने वाला कूबड (मनुष्य)	hump hunch-back
ખૂધિયુ	खूधियु	વિ	વાસે ખૂધવાળુ (માણસ)	कुबडा (मनुष्य)	(of man) hunch- backed
ખૂધુ	खूधु	વિ	જુઓ 'ખૂધિયુ'	देखिए 'खूधियु'	see 'ખૂધિયુ'
ખૂપ	खूप	પુ	પરણવા જતા વરને પહેરવાનો ફૂલનો એક શણગાર	सेहरा (दूल्हे का)	kind of flower decoration for bridegroom
ખૂપરુ	खूपरु	ન	જુઓ 'ખૂપરો', ખાપો	देखिए 'खूपरो', खुत्थी	see 'ખૂપરો', stump
ખૂપરો	खूपरो	પુ	1 (ઝાડ-છોડ કાપ્યા પછી રહેલુ) જાડિયુ, ખાપો	खुत्थी, खुत्थ	stubble

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ખીલો કે ખાપો ભરાવાથી કપડામાં પડેલી ફાટ કે ચીરો	कपड़े का चीरा	slit in cloth made by being caught by a nail or a splinter
૦			3 હજામત કરતા રહી ગયેલો ખાપા જેવો વાળ	बाल की जड़, खूँटी	stump of hair remaining after shave
ખૂપવુ	खूपवु	स क्रि	જુઓ 'ખૂધયુ'	देखिये 'ખૂધયુ'	see 'ખૂધયુ'
ખેકડો	खेकडो	પુ	ખેકડો, કરચલો	केकडा	crab
ખેડ	खेड	સ્ત્રી	1 ખેતી	खेती	cultivation of land
			2 કાટાવાળી એક વનસ્પતિ	एक कँटीली वनस्पति	kind of thorny bush
			3 ગામડું	गाँव, खेडा	village
ખેડવુ	खेडवु	સ ક્રિ	1 જમીનને હળ વડે ખોદી, ચાસીને પોથી કરવી	जोतना (जमीन)	to plough
			2 (લા) સુધારવુ, કેળવવુ	सुधारना	to improve, to cultivate
			3 (સાહસ કે વેપાર ધધો) કરવો	साहस या वणिज व्यापार करना	to embark upon (venture, trade etc)
			4 (મુસાફરી) કરવી	सफर करना	to make a journey
			5 ચલાવવુ, હાકવુ	चलाना, खेना	to drive
ખેડહક	खेडहक	પુ	ખેડવાનો હક	खेती करने का हक	right to cultivate
ખેડહકક	खेडहकक	પુ	જુઓ 'ખેડહક'	देखिए 'ખેડહક'	see ખેડહક'
ખેડાણ	खेडाण	વિ	ખેડેલું, ખેડાતું હોય એવું	जोता हुआ	cultivated
		ન	1 ખેડેલી-ખેડાતી હોય એવી જમીન	जोती हुई जमीन	cultivated land

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ખેતી	खेती	cultivation, farming
ખેડુ	खेडु	वि	3 ખેડવુ તે ખેડનારો	जोतना (जमीन) चलाने वाला, हॉकने वाला किसान	cultivation one who cultivates farmer
ખેડૂત	खेडूत	पु पु	ખેડૂત 1 ખેડવાનો ધધો કરનાર 2 તે વર્ગનો આદમી	किसान किसान	farmer, peasant, tiller farmer, peasant, tiller
ખેડુ	खेडु	न	1 ગામડુ 2 ગેડાની ઢાલ 3 ભાલો	गाँव, खेडा गैडे की ढाल भाला	village armour of rhino lance
ખેત	खेत	न	ખેતી માટેનો જમીનનો ટુકડો	खेत	piece of land for cultivation
ખેતર	खेतर	न	1 ખેત 2 ક્ષેત્ર	खेत क्षेत्र	field area
ખેતરપાદર	खेतरपादर	न	સ્થાવર મિલકત	स्थावर संपत्ति	landed property
ખેતી	खेती	स्त्री	જમીનમા અનાજ વગેરે પકવવા માટે કરવાનુ કામ	खेती	farming
ખેદાનમેદાન	खेदानमेदान	वि	તારાજ, પાયમાલ	तहस-नहस, मटियामेट	ruined, destroyed
ખેદો	खेदो	पु	કેડો, પીછો	पीछा	pursuit
ખેદો	खेदो	पु	જુઓ 'ખેદો'	पीछा	see 'ખેદો'
ખેન	खेन	न	1 ક્ષયરોગ 2 કટાળો આપે-માથુ કેડાવે એવુ મારાસ કે કામ, નકાર, પીડા 3 મુસીબત, વિપદ	क्षय रोग उबा देने वाला काम या आदमी या पीडा विपत्ति, मुसीबत	tuberculosis annoying or boring person or work trouble, difficulty

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખેપ	खेप	સ્ત્રી	1 ભાર લઈને કોઈ દૂરની જગાએ જઈ આવવું તે, આટો, ફેરો 2 લાબી મુસાફરી, સફર 3 ફેરાનું મહેનતાણું 4 ધોબીને ધોવા આપેલા લૂગડાની ગાસડી 5 વેપારની વસ્તુનું એક દેશથી બીજે દેશ આવવું તે 6 પછવાડે લાગવું તે, ખત 7 હપતો, વારો	खेप, फेरा (बोझ का) सफर, यात्रा खेप की मजदूरी धोबी का गट्ठर आयात तनदिही, धैर्य किश्त	trip long journey payment for a trip bundle of clothes given to the washerman arrival of merchandise application of mind, industry instalment turn
ખેપટ	खेपट	સ્ત્રી અ	ધૂળ, કચરો મૂઠીઓ વાળીને, ઝપાટાબધ (જેમ કે દોડવું)	धूल, कचरा सरपट (भागना)	dust, rubbish (to run)with closed fists, very fast
ખેપાની	खेपानी	વિ	1 તોફાની 2 યુક્તિબાજ	शरीर, ऊधमी युक्तिबाज	mischievous strategist
ખેપિયો	खेपियो	પુ	દૂત, કાસદ	दूत, कासिद	messenger
ખેમકુશળ	खेमकुशल	વિ ન	સુખશાંતિ અને આરોગ્યવાળું તેવા સ્થિતિ કે તેના સમાચાર	सुखशाति और आरोग्य वाला क्षेमकुशल, कुशल-प्रश्न	healthy and happy state of being healthy and happy or its news
ખેર	खेर	ન અ સ્ત્રી	એક ઝાડ ભલે, હશે, ફિકર નહિ 1 ખેરિયત	खैर, खदिर (पेड़) खैर, भले, अच्छा खैरियत, कुशल	kind of tree no matter, never mind happiness, welfare

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 धूल	धूल, खेह	dust
ખેરખાહ	खेरखाह	वि	ભલુ ખાહનાર, શુભેચ્છક	खैरखाह, हितैषी	patron, well-wisher
ખેરવવુ	खेरववु	स. क्रि	1 ખરી પકે એમ કરવુ, ગેરવવુ 2 ખસેડવુ, દૂર કરવુ, કાઢી મૂકવુ 3 પરજવવુ, માથુ ફોડાવવુ	झाडना हटाना, दूर करना परेशान करना	to shed to remove, dismiss to trouble, bother
ખેરવેલ	खेरवेल	स्त्री	એક વનસ્પતિ	एक वनस्पति	kind of plant
ખેરસલ્લા	खेरसल्ला	स्त्री	સમાધાન, સુખરૂપતા, સુલેહશાંતિ	खैरसल्ला, कुशल-क्षेम	satisfaction, peace and tranquillity
		अ	ખેર, હશે, બળ્યુ, એવો મન વાળવાનો ઉદ્ગાર	' खैर, भले या जाने दो ' ऐसा उद्गार	doesn't matter
ખેરસાર	खेरसार	पु	1 ખેરના લાકડામાથી નીકળતો પદાર્થ 2 કાથો	खैर की लकड़ी में से निकलने वाला पदार्थ कच्चा खैरसार	substance derived from the 'ખેર' tree catechu
ખેરસાલ	खेरसाल	पु	જુઓ 'ખેરસાર'	देखिए 'ખેરસાર'	see 'ખેરસાર'
ખેરચો	खेरचो	पु	રજ, ધૂળ	खेह, धूल, रज	dust
ખેરત	खेरत	स्त्री	દાન, પુણ્ય, સખાવત	खैरत, दान	alms, charity
ખેરતી	खेरती	वि.	1 ખેરત માટે કાઢેલુ, ધર્માદાનુ 2 ખેરત કરે એવુ	खैरती, धर्मार्थ, दिया हुआ जो खैरत करता हो	set aside for charitable purpose charitable
ખેરિયત	खेरियत	स्त्री	સુખરૂપ-ક્ષેમકુશળ હોવુ તે	खैरियत, खैर	welfare
ખેરી	खेरी	स्त्री	1 ખેરી, રજ	धूल, खेह	dust (of metals)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 दात उपर पाञ्जती पोपडी	दतशर्करा	tartar
ખેલદિલી	खेलदिली	स्त्री	દિલમા ખેલ કે રમતનો પ્રસન્ન ભાવ હોવો તે	दिल में खेल के प्रति प्रसन्न भाव होना	sportsmanship
ખેલવાણુ	खेलवणु	न	રમકડુ, ખિલોણુ	खिलौना	toy
ખેલવુ	खेलवु	अ क्रि	1 રમવુ, ગેલ-ગમ્મત કરવી 2 યુક્તિ કે પ્રપચથી કાર્ય કરવુ	खेलना खेल खेलना (युक्ति)	to play, frolic to act cleverly
ખેલાડી	खेलाडी	वि पु	રમતમા કામ કાઢી લે એવુ ચતુર, મુત્સદી ખેલ કરે-રમત કરે તે, નટ	खेला-खाया खिलाडी, खेलाडी, नट	clever, cunning player, acrobat
ખેલાડીપણુ	खेलाडीपणु	न	ખેલાડીના સ્વભાવવાળુ	खिलाडीपन	having the quality of a player or a diplomatic person
ખેવના	खेवना	स्त्री	કાળજી, ચાનક, સભાળ	सोच, चिन्ता, परवाह	care, alertness
ખેસ	खेस	पु	ખભે નાખવાનુ વસ્ત્ર, દુપટ્ટો	दुपट्टा, उपरना	loose cloth worn over the shoulders, scarf
ખેસવવુ	खेसववु	स क्रि	ખસેડવુ	खिसकाना, हटाना	to move, to push
ખેહ	खेह	स्त्री पु	ધૂળ, રજ ક્ષય	खेह, धूल, रज क्षय	dust, particle tuberculosis
ખેળ	खेळ	स्त्री	લાહી, આર, કાળ	मॉडी	paste, starch
ખેકડો	खेकडो	पु	કચ્છો	केकडा	crab
ખેચ	खेच	स्त्री	1 ખેચાણ, તાણ	खिचाव, तनाव	pull, spasm

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 આગ્રહ 3 તગી, તાણ	આગ્રહ તગી, કમી	importunity want, scarcity
ખેચતાણ	खेचताण	સ્ત્રી	1 ખેચાખેચ	खीचा-तानी	pulling and dragging
			2 (લા) આગ્રહ	आग्रह	importunity
ખેચવું	खेचवु	સ ક્રિ	1 પોતા તરફ આમંત્રણ, આકર્ષણ, તાણવું 2 ડસવું, તન ડરવું 3 આગ્રહ ડરવો, આગ્રહથી વળગી રહેવું 4 શોષી લેવું, ચસવું	खीचना कसना, चुस्त करना आग्रह करना	to draw attract to tighten to insist
ખેચાખેચ	खेचाखेच	સ્ત્રી	1 તાણાતાણ 2 આગ્રહ	खीचा-खीची, कशमकश आग्रह	pulling and dragging importunity
ખેચાખેચી	खेचाखेची	સ્ત્રી	જુઓ 'ખેચાખેચ'	देखिए 'खेचाखेच'	see 'ખેચાખેચ'
ખેચાણ	खेचाण	ન	ખેચ, તાણ	खिचाव, तनाव	pull
ખેચાતાણ	खेचाताण	સ્ત્રી	ખેચાખેચ	कशमकश	pulling and dragging
ખોખો	खोखो	સ્ત્રી	એક રમત, ખો	एक खेल	a game
ખોજવું	खोजवु	સ ક્રિ	ખોજ ડરવી, ખોજવું	खोजना	to search, to find
ખોટ	खोट	સ્ત્રી	1 ઘટ, ઓછાપાણ, અપૂર્ણતા 2 નુકસાન, ગેરલાભ 3 ભૂલ, ચૂક 4 નાની ભસ્તી (ઉદાનથી ઊલટા પ્રકારની)	घट, कमी, न्यूनता नुकसान, हानि भूल, चूक छोटी ज्वार (समुद्र)	deficit, shortage loss, disadvantage mistake, error low ebb
ખોટકવું	खोटकवु	અ ક્રિ	અટકવું, અચકાવું	अटकना, रुकना	to stop, to hesitate

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખોટકાવુ	खोटकावु	अ क्रि	જુઓ 'ખોટકાવુ'	देखिए 'ખોટકાવુ'	see 'ખોટકાવુ'
ખો	खो	स्त्री	1 ટેવ, આદત 2 ખાર, દ્વેષ, વેર 3 ખાઈ, ખીણ, કોતર 4 એક રમત 5 (૨૫)ખોખો રમતનો બોલ	आदत, लत द्वेष, बैर, डाह खोह, खाई एक खेल उस खेलमें प्रयुक्त शब्द	habit malice valley, ravine kind of game word spoken in that game
		पु	વશ, મૂળ	वश, मूल	ancestry, lineage
ખોઈયુ	खोइयु	न	1 ઘોડિયાની ખોઈ, ખોયુ 2 ઘોડિયુ	पालने की झोली पालना, ढोलनी	hammock of a cradle cradle
ખોઈ	खोई	स्त्री	બાળકને સુવાડવા માટે કરેલી કે બાંધેલી ઝોળી	पालने की झोली	hammock
ખોખ	खोख	न	મોટા કદનુ પણ ખાલી ખોખુ હોય તે	बड़े कद की खाली खोखली चीज	large-sized, empty wooden box
ખોખરુ	खोखरु	वि	1 જાડો ને પોલો અવાજ નીકળે એવુ 2 અડધુપડધુ ભાંગેલુ-ફૂટેલુ	जिसमें से मोटी और कर्कश आवाज निकले वैसा जो कुछ टूटा-फूटा हो	giving a hollow ring cracked
ખોટાઈ	खोटाई	स्त्री	1 જૂઠાપણ, અસત્યતા 2 હરામીપણ, આળસુપણ	झूठापन खोटाई, आलसीपन	falsehood, untruth rascality, laziness
ખોટાબોલુ	खोटाबोलु	वि	ખોટુ બોલે તેવુ, બોલીને ફરી જાય એવુ	झूठा, मुकर जाने वाला	given to lying or breaking one's promise
ખોટારો	खोटारो	पु	1 ઇટનો કકડો, પપોથો 2 અગારો, લાળો	ईट का टुकड़ा अगारा	brickbat live coal

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૩ નખરુ	નખરા	coquetry
ખોટી	ખોટી	અ	વિલબ-ટીલ થાય એમ નકામુ થોભી રહેવુ પડે— વખત બગડે એમ	વિલબ હો યા સમય બિગડે એસે રુકના પડે	waste of tim
		સ્ત્રી	વાર, વિલબ	દેર, વિલબ	delay
ખોટીપો	ખોટીપો	પુ	ખોટી થવુ તે, રોકાણ	વિલબ હોના	being delayed, waiting
ખોટુ	ખોટુ	વિ	૧ જૂઠું, અસત્ય ૨ ભૂલચૂકવાળુ ૩ ખરાબ, નઠારુ ૪ ફરી જાય એવુ, બેવફા ૫ નુકસાન, અન્યાય, ખોટુ કામ	જૂઠું, અસત્ય ખોટા, ગલત ખોટા, ખરાબ, બુરા મુકર જાનેવાલા, બેવફા બુરા કામ, નુકસાન, અન્યાય	false, untrue incorrect bad, ill unreliable loss injustice bad turn
ખોટો રૂપિયો	ખોટો રૂપિયો	પુ	બનાવટી રૂપિયો	બનાવટી રૂપયા	counterfeit rupee
ખોડ	ખોડ	સ્ત્રી	૧ ખો, આદત, કુટેવ ૨ શારીરિક ખામી ૩ ભૂલ, ખામી, કલક, લાઇન	બુરી આદત શારીરિક ખામી ભૂલ, કલક, એબ	habit, bad habit physical defect mistake, stigma
		ન	ખોડસુ	ઠૂઠ	block of wood
ખોડવુ	ખોડવુ	સ ક્રિ	૧ ઘટવુ ૨ રોપવુ, ઊભુ કરવુ ૩ તોડવુ, ભાગવુ ૪ ખોડુ કરવુ	ગાડના રોપના તોડના લેગડા કરના	to bury to plant, to raise to break up, to smash to make lame or incapacitate
ખોડસુ	ખોડસુ	ન	ખોટુ લાકડુ-હુણકુ, આડનુ જૂનુ થાડિયુ	ઠૂઠ	large block of wood
ખોડમવુ	ખોડમવુ	અ ક્રિ	લગડાવુ, ખોડુ ચાલવુ	લગડાના	to limp

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખોડગાવુ	खोडगावु	अ क्रि	જુઓ 'ખોડગવુ'	देखिए 'ખોડગવુ'	see 'ખોડગવુ'
ખોડાવુ	खोडावु	अ क्रि	જુઓ 'ખોડગવુ', 'ખોડગાવુ'	देखिए 'ખોડગવુ', 'ખોડગાવુ'	see 'ખોડગવુ', 'ખોડગાવુ'
ખોડિયુ	खोडियु	वि	ખોડવાળુ, અપગ	अपग	deformed, defective
ખોડો	खोडो	पु	1 માથાની ચામડી પર બાઝતો એક મેલ 2 માથાની ચામડીનો એક રોગ 3 સહાર, નાશ	रूसी (मैल) सिर की चमडी का एक रोग सहार, नाश	dandruff scabby, scald head destruction, extermination
ખોતરણી	खोतरणी	स्त्री	1 દાંત ખોતરવાની સળી 2 ખરપડી 3 કોતરવાનુ ઓજાર, ટાકણ 4 કોતરણી, નકશીકામ	दाँत कुरेदनी खुरपी नक्काशी करने का औजार, टॉकी नक्काशी, खुदाई	tooth-pick weeder chisel of the sculptor carving, ornamental engraving
ખોતરણ	खोतरणु	न	1 ટાકણ 2 ખરપડી 3 ખોતરવાનુ સાધન 4 ખૂદરુ, દોષ	टॉकी खुरपी कुरेदने का साधन खुचड, दोष	chisel weeder instrument for picking flaw, defect
ખોદકામ	खोदकाम	न	1 ખોદવાનુ કામ 2 કૂવા, તળાવ વગેરે ખોદવાનુ કામ 3 કોતરકામ	खुदाई नहर, तालाब आदि खोदने का काम नक्काशी	excavation digging of well, reservoir etc carving
ખોદણી	खोदणी	स्त्री	(લા.)ખણખોદ, નિદા, બદખોઈ	खुचड, निदा, बदगोई	scandal, slander
ખોદવું	खोदवु	अ क्रि.	1 ભોય ઊખાડવી, ખણવુ	खोदना	to dig

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ખોદાણ	खोदाण	न	2 કોતરવુ, નકસી પાડવી	नक्काशी करना	to scrape at, to carve
ખોદ	खोफ	पु	3 ખોદણી કરવી	खुचड निकालना, बदगोई करना	to scandalize
ખોદનાક	खोफनाक	वि	1 ખોદાવુ કે ખોદવુ તે, ખોદકામ	खुदाई	digging, excavation
ખોબલો	खोबलो	पु	2 પાણીના જોરથી ખોદાયેલી જમીન	पानी के बहाव से खुदी हुई जमीन	denudation caused by water
ખોબો	खोबो	पु	1 સર	खौफ, डर	fear
ખોચણી	खोयणी	स्त्री	2 ગુસ્સો	गुस्सा	anger, wrath
ખોચણ	खोयणु	न	ભયાનક, ડરામણ, વિકરાળ	खौफनाक, डरावना	terrible, frightful
			1 બે હાથ દખ્તા જોડવાથી બનતો પાત્રનો આકાર પોશ	अजलि, सपुट	shape which the two palms take when put alongside
			2 તેમા માય તેટલુ માપ	अजलि भर वस्तु (माप)	handful (or measure held as in 1)
			જુઓ 'ખોબલો'	देखिए 'ખોબલો'	see 'ખોબલો'
			વધાર	बघार, छौंक	oil or ghee heated with mustard seed etc as cooking sauce for curry or vegetable
			1 બળતુ લાકડુ કે સળેકડુ	लुआठा, जलता हुआ लकड़ी का टुकड़ा	burning piece of wood
			2 જામગી	जामगी	tinder or cloth smeared with gun-powder

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 (ला) थाएवु, उशेरेणी	छेडखानी, उकसाना	instigation
ખોચલ	खोचल	न	मोचीनु ओड ओणार	मोची का एक औजार	a cobbler's tool
ખોયુ	खोयु	न	धोडियानी पोछ, पोछयु	पालने की झौली	hammock of a cradle
ખોરડ	खोरडु	न	पोली, ओरडी	छोटा कमरा, झोंपडी	cabin, hut
ખોરસુ	खोरसु	न	त्रण पायानी धोडी, त्रिपाछ	तिपाई	three-legged stool
ખોરાક	खोराक	पु	1 ખાવાનો પદાર્થ 2 (લા) જેનાથી ઊંઠ વાતનો નિર્વાહ થાય તે	खुराक सामग्री, सामान	food means of livelihood
ખોરાકી	खोराकी	स्त्री	1 ખોરાક, ગુજરાનની વસ્તુ 2 તેનું ખર્ચ	खुराक, गुजारे की चीज उसका खर्च, खुराकी	food, means of livelihood its expense
ખોરાકીપોશાકી	खोराकीपोशाकी	स्त्री	1 અન્ન-વસ્ત્ર 2 તેનું ખર્ચ	अन्न-वस्त्र उसका खर्च	food and clothing its expense
ખોરિયુ	खोरियु	न	ઉબાડિયુ, ખોચણ	लुआठा, लूका, जलता हुआ लकड़ी का टुकड़ा	burning piece of wood
ખોરુ	खोरु	वि	જૂનું થવાથી બેસ્વાદ	उतरा हुआ, बेस्वाद	rancid
ખોલ	खोल	स्त्री	1 ખામી, ડરચલી, પોલાણ 2 ઊતરી ગયેલી છાલ ચામડી 3 ખોળી 4 સાપની ડાચળી	त्रुटि, सिलवट, झुर्रिया, खोखलापन उतरी हुई जीर्ण त्वचा, खोल शामी साँप की केंचुली	defect, wrinkle, hollow worn-out skin cover of metal slough (of snake)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			६ ખોળ, ગાદી, તકિયા વગેરેનું ઉપલુ પડ	गिलाफ, खोल	cover
		न	મોચીનું એક ઓળર	मोची का एक राछ	a cobbler's tool
ખોલકી	खोलकी	स्त्री	ગધેડી	गधी	she-donkey
ખોલકું	खोलकु	न	ગધેડાનું નાનું બચ્ચું	रेंगटा	young one of a donkey, foal
ખોલકો	खोलको	पु	ગધેડો	गधा, खर	he-donkey
ખોલવું	खोलवु	स क्रि	1 ઉઘાડવું 2 કાઢવું, સ્થાપન કરવું	खोलना निकालना, स्थापन करना	to open to draw out, to set up
ખોલી	खोली	स्त्री	1 ખોળી 2 ઓરડી 3 ગધેડી	शामी, टोपी कोठरी गधी	metal cover or cap room she-donkey
ખોલો	खोलो	पु	ગધેડો	गधा, खर	he-donkey
ખોલું	खोलु	न	ખીચડી વગેરેનો ઘાઝેલો પોપડો	खिचडी आदि की जली हुई पपडी	crust of sticking to the bottom of a vessel
ખોવડાવવું	खोवडाववु	स क्रि	'ખોવું' નું પ્રેરક	'ખોવું' का प्रेरणार्थक रूप	caus of 'ખોવું'
ખોવરાવવું	खोवराववु	स क्रि	જુઓ 'ખોવડાવવું'	'ખોવડાવવું' का प्रेरणार्थक रूप	see 'ખોવડાવવું'
ખોવાવું	खोवावु	अ क्रि	'ખોવું' નું કર્મણિ	'ખોવું' का कर्मणि रूप	passive of 'ખોવું'
ખોસવું	खोसवु	स क्रि	જોરથી ઘાખલ કરવું, ઘાલવું, ઘોચવું	खोंसना, गडाना, धँसाना	to push in, tuck in
ખોહ	खोह	स्त्री	ખો, કોતર, ખીણ	खोह, कदरा	ravine, valley
ખોળ	खोळ	स्त्री	1 ઊતરી ગયેલી ચામડી 2 સાપની કાચળી	उतरी हुई चमडी साँप की केंचुली	worn-out skin slough (of a snake)

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૩ ખોળી ગાદી, તકિયા વગેરેનું ઉપલુ ૫૬	શામી, ટોપી ગિલાફ, खोली	metal cover cover (of pillow etc)
ખોળ(ખો)	खोळ (खो)	પુ	તેલ કાઢી લીધા બાદ રહેતો તેલની ખીનો કૂચો	खली	dregs which remain when the oil is squeezed out, oil cake
		સ્ત્રી	તપાસ, શોધ	खोज, तलाश, शोध	inquiry, search
ખોળવું	खोळवु	સ ક્રિ	શોધવું, તપાસ કરવી, ઢૂંઢવું	खोजना, शोधना	to search, to inquire
ખોળખોળા	खोळखोळा	સ્ત્રી	શોધાશોધ, ખૂબ ઢૂંઢવું તે	खूब ढूढना	searching
ખોળાખોળ	खोळाखोळ	સ્ત્રી	જુઓ 'ખોળખોળા'	देखिए 'ખોળખોળા'	see 'ખોળખોળા'
ખોળાખોળી	खोळाखोळी	સ્ત્રી	જુઓ 'ખોળખોળા'	खूब ढूढना	see 'ખોળખોળા'
ખોળાધર	खोळाधर	પુ	જામીન	जामिन	surety
ખોળાધરી	खोळाधरी	સ્ત્રી	જામીનગીરી	जमानत, जामिनी	surety
ખોળાભરણુ	खोळाभरणु	ન	સીમત, અધરણી	गौद भरना	the ceremony performed at the time of pregnancy
ખોળિયુ	खोळियु	ન	૧ ગોદડા વગેરે ભરવાનો ઓઢો	खोल, खोली	cover or case (e g pillow- case)
			૨ શરીર, કલેવર	देह, चोला	body
ખોળી	खोळी	સ્ત્રી	વસ્તુના રક્ષણ માટે છેડા ઉપર ગોઠવેલું ઢાંધણું (જેમ કે સાકડીને)	શામી, ટોપી (કિસી ધાતુ કી)	metal cap (e g at the end of a stick)

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યાકો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ખોખો(ખો)	ખોલ્લો (ખો)	પુ	1 પલાઠી મારી બેસતા બને જાઘ ઉપરની ઘૂટણ લગી થતી આસન જેવી જગાનો ભાગ 2 એ ભાગ ઉપરના વસ્ત્રને તેમા કાઠ લેવા) ઓળી પેઠે કરાય છે તે	ગોદ કોઈ या ऑचल से बनाई हुई झोली	lap part of the <i>sari</i> which covers the part and which is tucked up to form a sort of bag
ખોખારવુ	ખોંખારવુ	અ ક્રિ	1 ખૂ ખૂ અવાજ કરવો 2 (અમુક અવાજ કરી) ગળુ સાફ કરવુ 3 હાહાહાવુ 4 પોતાની હાજરી, મરદાઈ કે બડાઈ બતાવવા) ખૂખારાશી અવાજ કરવો	खूं-खूं आवाज करना गला साफ करना हिनहिनाना गले से आवाज निकालना	to make a coughing sound to clear the throat by making gurgling sound to neigh to make a coughing sound to suggest one's presence or importance
ખોખારો	ખોંખારો	પુ	1 ખૂખારવુ તે 2 ખૂખારવાનો અવાજ	खखार खों-खों (शब्द)	coughing sound of coughing
ખોચ	ખોંચ	સ્ત્રી	1 ખાચો, ખોબણ, ખાણ 2 કસર, કમીના 3 વાઘો, અડચણ	खोंचा, कटाव, दौता कमी, कसर रुकावट, हरज	corner or angle, groove, valley want, scarcity obstacle, objection

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 भुशुकेली, गूथवण	मुश्किल, उलझन	difficulty
ખ્યાલ	खयाल	पु	1 तर्क, विचार, कल्पना, स्मरण 2 छाल, डेडो 3 अेक जगतनु गायन	खयाल, विचार, तर्क, स्मरण पीछा एक तरह का गायन	idea or concept persistence a type of song
ખિસ્ત	खिस्त	पु	ખિસ્તી ધર્મનો આદિ-પુરુષ, ઇશુ ઇસુખિસ્ત	ईसा मसीह	Jesus Christ
ખિસ્તી	खिस्ती	वि	ઇસુ સબધી, ઇસુના ધર્મનું	ईसाई	pertaining to Christ or Christianity
		पु	એ ધર્મ માનનારો માણસ	ईसाई धर्म का मानने वाला	Christian
ગ્રામીણ	ग्रामीण	वि पु	ગામડાનું —ને લગતું, 1 ગામડીયો 2 ઝૂતરો 3 કાગડો 4 ભૂડ, સૂવર	गाँव का, ग्रामीण देहाती कुत्ता कौआ सूअर	rural villager dog crow pig, hog
ગ્રાહક	ग्राहक	पु	1 ઘરાક 2 ગ્રહણ કરનાર	ग्राहक, ग्राहक ग्रहण करने वाला	customer one who receives
		वि	ગ્રહણ કરનારું, સમજનારું	धारण करने वाला, समझने वाला	who receives or understands
ગ્રીષ્મ	ग्रिष्म	पु, स्त्री	(છ ઋતુમાની) ગરમીની મોસમ (જેઠ અને આષાઢ)	ग्रिष्म	one of the six seasons, hot season, summer
ગઈ કાલ	गई काल	स्त्री	આજની પહેલાનો દિવસ	आज से पूर्व का दिवस	yesterday
		अ	જુઓ 'ગઈ કાલે'	देखिए 'गई काले'	see 'गई काले'
ગઈ કાલે	गई काले	अ	1 આજની પૂર્વેના દિવસે, કાલે	आज से पूर्व के दिन, कल	yesterday

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			૨. (લા) હમાણા જ	अभी	recently
ગઈ ગુજરી	गई गुजरी	સ્ત્રી	બની ગયેલી-ભૂતકાળની હકીકત	बीत चुकी है वैसे भूतकालीन घटना	things of the past
ગગડવુ	गगडवु	અ ક્રિ	ગડગડ અવાજ કરવો, ગાજવુ	गडगडाना, गरजना	to rumble
ગગડાટ	गगडाट	પુ અ	ગડગડ એવો અવાજ કરવો સપાટાબધ, વગર હરકતે	गडगडाहट तेजी के साथ, बेरोकटोक	thundering sound quickly, without any difficulty
ગગડાવવુ	गगडाववु	સ ક્રિ	૧ ગડગડે એમ કરવુ ૨ સપાટાબધ-અટક્યા વગર કામ ચલાવવુ (જેમ કે વાચનનુ)	गडगडाना तेज रफतार से बिना रुके काम चलाना	to cause rumbling sound to continue (some activity) without stopping
ગગણવુ	गगणवु	અ ક્રિ	૧ ગણગણ એવો અવાજ કરવો ૨ નાકમા બોલવુ ૩ પોતાની નામરજી અસ્પષ્ટ રીતે બતાવવી ૪ મનમા બબડવુ, ગગણતા કહેવુ	गुनगुनाना नकियाना अस्पष्ट शब्दों में अपनी नामरजी व्यक्त करना मन में बडबडाना	to murmur to speak in a nasal voice to demur to mumble
ગગણાટ	गगणाट	પુ	ગણગણવુ તે	गुनगुनाहट	murmur
ગગનભેદી	गगनभेदी	વિ	ગગનને ભેદે એવુ મોટું (અવાજ કે નાદ)	गगनभेदी	(sound) big enough to pierce the sky

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गगनस्पर्शी	गगनस्पर्शी	वि	आकाशाने अडे એવું, બહુ જ ઊંચું	गगनस्पर्शी, गगनचुंबी, बहुत ऊँचा	very high, touching the sky
ગગરો	गगरो	पु	धातुનો ઘડો	धातु का बना हुआ गगरा	metal water pot
ગગળવું	गगळवुं	अ क्रि	ઢીલા થઈ જવું પ્યારથી, ધમકીથી કે એવી કોઈ (લાગણીથી)	गिडगिडाना	to soften down or be choked with emotion
ગગળું	गगळुं	वि	1 ઢીલું, ઈન 2 પાકવા ઉપર આવેલું	दीन, गिडगिडाता हुआ गदराया हुआ (फल)	slack, pitiable gone tender, verging on ripeness
ગગી	गगी	સ્ત્રી	છોકરી, ઈકરી	बिटिया, मुन्नी, बेटी	girl, daughter
ગગો	गगो	पु	છોકરો, ઈકરો	बेटा, मुन्ना	boy, son
ગચ	गच	पु	1 ગચ્ચ 2 ચૂનો, કેલ	गच चूना, पीसा हुआ चूना	sound as of thrusting or piercing crushed lime
ગચ દઈને	गच दर्ईने	अ	ગચ, કચ અવાજની સાથે, ઝટ (અદર ઘૂસી કે પેસી જવું)	गच से	(to pierce or penetrate) with such a sound
ગચરકું	गचरकुं	न	ખોટો કે તીખો ઓડકાર, ઘચરકું	खट्टी या तीखी डकार	sour or bitter belching
ગચાગચ	गचागच	वि	ખીચોખીચ	ठसाठस, खचाखच	jam-packed, crowded

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગચિયુ	गचियु	ન	1 ઢેકુ, ચોસલુ (જેમ કે ઇટ, ચૂનો ઇ નુ) 2 (લા) આડ, નડતર	चक्का, ढोंका बाधा, अवरोध	lump or block obstacle
ગચ્ચ	गच्च	અ	1 ગચ 2 સજડ, તૂટે છૂટે નહિ એવુ	गच से मजबूती से	see 'ગચ' tightly, fast
ગચિયુ	गच्चियु	ન	જુઓ 'ગચિયુ'	देखिए 'गचियु'	see 'ગચિયુ'
ગચ્ચી	गच्ची	સ્ત્રી	1 માટી, ઇટો, કાકરા અને ચૂનો વગેરેનુ બાકી જવુ તે ઉદા ચૂનાગચ્ચી 2 અગાસી, ધાબુ 3 ઇબધ જમીન 4 વર્ગ	गच छत, पाटन पक्का फर्श, गच वर्ग	sticking together in a mass of earth, bricks, pebbles, mortar etc balcony, terrace concrete floor class, division
ગચ્ચુ	गच्चु	ન	ઢેકુ, ચોસલુ (જેમ કે ઇટ, ચૂનો ઇ નુ)	चक्का, ढोंका	lump or block
ગચ્છવુ	गच्छवु	અ ક્રિ	જવુ	जाना	to go
ગચ્છી	गच्छी	સ્ત્રી	જુઓ 'ગચ્છી'	देखिए 'गच्छी'	see 'ગચ્છી'
ગજ	गज	પુ	1 હાથી 2 લખાઈ ભરવાનુ ચોવીસ તસુનુ માપ 3 બારણાની ભૂગળ 4 ધાતુનો નક્કર સળિયો 5 તતુવાધ વગાડવા વપરાતુ ધનુષ્ય જેવુ સાધન	गज, हाथी गज (नाप) अरगल छड (सारंगी आदि की) कमानी, गज	elephant measure equal to 24 'tasus' bolt of a door metal bar bow for stringed musical instrument

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			6. બદૂકની નાળમા દારૂ ઠાસવા માટે વપરાતો સળિયો	(बदूक का) गज	metal rod used to ram gunpowder into the barrel of a gun
ગજપાઉ	गजपाउ	न	એક પક્ષી	एक पक्षी	black-winged stilt
ગજપુષ્પી	गजपुष्पी	સ્ત્રી	એક વેલ	गजपुष्पी बेल	a creeping plant
ગજબ	गजब	પુ	1 ક્રેર 2 મોટું દુઃખ 3 આશ્ચર્ય	गजब, जुल्म बडी विपत्ति आश्चर्य, अचभा	horror great calamity wonder
ગજરુ	गजरु	ન	1 કાંઠે કે અબોંઠે ઘાલવાનો ફૂલનો હાર 2 કાંઠે પહેરવાનું સ્ત્રીનું ઘરેણું, ગુજરી	गजरा कलाई पर पहनने का स्त्रियों का एक गहना	wreath of flowers to be worn in the hair or on the wrist bracelet
ગજરો	गजरो	પુ	જુઓ 'ગજરુ'	देखिए 'गजरु'	see 'गजरु'
ગજલ	गजल	સ્ત્રી	જુઓ 'ગઝલ'	देखिए 'गजल'	see 'गजल'
ગજવવુ	गजववु	સક્રિ	ગાજે એમ કહવુ	गुंजाना, गुजारित करना	to cause to resound
ગજવાકાતરુ	गजवाकातरु	પુ	ખીસાકાતરુ, ખીસાથોર	जेबकतरा	pick-pocket
ગજવુ	गजवु	ન	ગૂળુ, ખીસુ	जेब, खीसा	pocket
ગજવેલ	गजवेल	સ્ત્રી	1 પોલાદ, ખરુ લોઢુ 2 એક જાતના ચોખા	फौलाद, गजबेली एक प्रकार के चावल	steel, real iron a variety of rice
ગજાવવુ	गजाववु	સક્રિ	ગાજે એમ કહવુ, 'ગાજવુ' નું પ્રેરક	'गजवु' का प्रेरणार्थक रूप	to cause to resound, caus of 'गजवु'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गण्ठियु	गजियु	वि	1. अेक गण्ठना मापनु 2. गण्डा सूतरनु (बहुधा गण्ठ) कपडु	एक गज की नाप का गजी, गाढा	measuring one meter coarse cotton cloth
गण्ठियो	गजियो	पु	लोढानो सणियो, गण्ठ	लोहे की छड, गज	metal rod of a particular measure
गण्ठ	गजी	न	गण्ठियु, गण्ठियाङ्गी	गजी, गाढा	kind of silk cloth
गण्ठु	गजु	न	गुणश, शक्ति	बिसात, बृता, सामर्थ्य	capacity, power
गण्ठल	गजल	स्त्री	1. अेक इरसी रोग, रेपतो 2. अे रोगनु कथ्य	रेखता	a Persian metre
गट	गट	अ	(रव) गटगट अवाज शाय अेम	गजल	a poem in that metre
गटगट	गटगट	अ	गुओ 'गट'	'गटगट' आवाज के साथ	in a manner causing 'गट' sound
गटगटावु	गटगटावु	स क्रि	गटगट करता ऋट पी णवु	देखिए गट'	see 'गट'
गटपट	गटपट	स्त्री	धीभी-छानीमानी वात	गटगट पीना, गटगताना	to gulp down, to drink up quickly
गटरपटर	गटरपटर	अ	गमे तेम, आडुअवणु	कानाफूसी	secret talk in whisper
गटापरचा	गटापरचा	न	अेक वनस्पति	उलटा-सीधा, इधर-उधर	without rhyme or reason
गटियु	गटियु	वि	1. ठीगाणु	एक वनस्पति, गटापरचा	kind of plant
				बौना, वामन	short, dwarf

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गट्टूची	गट्टूची	स्त्री	2. पट्टु अने णडु એક વનસ્પતિ, ગળો	नाटा और मोटा गुडुच, गुडूची	short and fat kind of medicinal creeper
गट्टी	गट्टी	वि	1. ઠાંગણ 2. પટ્ટુ અને ણડુ	बौना, नाटा नाटा और मोटा	short, dwarf short and fat
गट्टु	गट्टु	वि	જુઓ 'ગટ્ટી'	देखिए 'गट्टी'	see 'गट्टी'
गठडी	गठडी	स्त्री	પોટલી	गठरी	bundle
गठियु	गठियु	वि	લુચ્ચુ, પાકુ	धूर्त, चोंई, चालाक	cunning, shrewd
गठो	गठो	पु	ગાગડો, ગથિયુ, બાઝી ગયેલો જથો	डला, ढोंका	lump, hardened mass
गड	गड	न	1. ગાઠ 2. ગૂમડુ, ગોડ 3. ગડી (કપડાની)	गॉठ, गट्ठा फोडा, गड, गॉठ चुनट, (कपडे की)	knot boil fold (of cloth)
गडगडवु	गडगडवु	अ क्रि	ગડગડ અવાજ કરવો, ગાજવુ	गरजना, गडगडाना	to thunder
गडगूमड	गडगूमड	न	1. નાના મોટા ગૂમડા 2. તે થઈને થતો ચામડાનો રોગ	फोडे-फुसी इनसे होने वाला चर्मरोग	small and big boils a skin disease
गडगूदी	गडगूदी	स्त्री	ગડગૂદાનુ ઝાડ	लसोडा, लहसुआ (पेड)	kind of a tree
गडगूदु	गडगूदु	न	ગડગૂદાનુ ફળ, મોટુ ગૂદુ	लसोडा, रेंटा (फल)	its fruit
गडगूदो	गडगूदो	पु	ગડગૂદાનુ ઝાડ	लसोडा (पेड)	kind of a tree
गडदापाटु	गडदापाटु	न	1. ગડદાને પાટુ 2. હાથપગથી મારામાર	घँसा और लात हाथापाई	fist and kick blows with fists and kicks

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गडदो	गडदो	पु.	ठोसो, धीभडो	घूँसा, मुक्का	blow with fist
गडब	गडब	स्त्री	गट, गाठ, सोणो	गाँठ, गड, सूजन	knot tumour, swelling
गडबड	गडबड	स्त्री	1 धोंधाट 2 अव्यवस्था, जोटाणो	कोलाहल गडबड	noise or din disorder, mess
गडबडवु	गडबडवु	अ क्रि	1 तणे उपर थता सरवु 2 आणोटवु 3 (ला) (वगर वाधे डे विधने) चाली डे नभी जवु, आगण वधवु	लुढकना लोटना चलना, आगे बढ़ना, निभना	to roll to wallow to go on or continue (without difficulty or obstacle)
गडमथल	गडमथल	स्त्री	महेनत, झझ, धालमेल	मेहनत, सिर मारना	exertion, effort
गडवु	गडवु	अ क्रि	1 गरवु, अदर पेसवु—जवु 2 गळडवु 3 [रव]गडगडवु	गडना, घुसना लुढकना गडगडाना	to enter, go into see 'गळडवु' to thunder
गडवेल	गडवेल	स्त्री	अेड वनस्मति	एक वनस्पति	kind of creeper
गडवो	गडवो	पु	1 धडाना जेवो गोल पडधीदर लोटो 2 गाडवो	गडुवा घियाँडा	small round water-pot kind of jar for storing ghee, oil etc
गडियो	गडियो	पु	आडनो पाडो, धडियो	पहाडा	calculation table
गडी	गडी	स्त्री	1 गाठ, आठी 2 गेड 3 गेडीनो भयडो	गाठ तह (कपडे की) गडारी, घिरनी के बीच का गड्ढा	tumour or twist fold groove in a pulley

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 દક્ષિણી ચાકર, ધાટી	दक्षिणी चौकर	man-servant (known as <i>ghati</i> coming from Kokan dist of Maharashtra state)
ગડુડાવવુ	गडुडाववु	स क्रि	'ગડૂડવુ' નુ પ્રેરક	'गडूडवु' का प्रेरणार्थक रूप	caus of 'गडूडवु'
ગડુડુડુ	गडुडुडु	अ	(૨૫) ગાબડવાના જોવો અવાજ, મેઘગર્જના	मेघगर्जना	rumbling sound, thunder
ગડૂચી	गडूची	સ્ત્રી	એક વનસ્પતિ, ગટૂચી, ગળો	गुडच, गुडुच	kind of medicinal plant
ગડૂડવુ	गडूडवु	अ क्रि	(૨૫) ગડૂડ એવો અવાજ કરવો, ગાજવુ	गरजना	to make rumbling or thundering sound
ગડેડવુ	गडेडवु	अ क्रि	જુઓ 'ગડૂડવુ'	गरजना	see 'गडूडवु'
ગડેરિયો	गडेरियो	પુ	ભરવાડ, તેમની એક અટક	गडरिया	shepherd, a surname of shepherd caste
ગડો	गडो	પુ	1 કાકરો, મોટો ગાગડો 2 તમાકુ-ગડાકુનુ મોટુ ગડિયુ 3 હાસલ, જકાત	बडा डला खमीरी तबाकू का गट्ठर जकात, चुगी	piece of stone big bundle of tobacco leaves octroi duty
ગઢ	गढ	પુ	કિલ્લો, પર્વતપરનો કોટ	गढ, किला	fort, hill-fort
ગઢવી	गढवी	પુ	1 ગઢનો રખેવાળ 2 ચારણ	गढ का रक्षक, गढपाल चारण	governor of fort bard, minstrel
ગઢવુ	गढवु	ન	ઘડવુ, માટલુ (ગોળનુ)	मटका (गुड भरने का)	pot (for jaggery)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गण	गण	पु	1 टोण, मडण 2 जात, वर्ग 3 शिव नो सेवक-समुदाय 4 छेडशास्त्रमा त्राण अक्षरनो णड	गण, समूह जाति, वर्ग शिव का सेवक-समुदाय तीन अक्षरों का खंड	association, federation race, class group of attendants to Shiva' foot of three letters in prosody obligation
गणकारवु	गणकारवु	स क्रि	5 गुण, पाड मानवु, दरदार-पत करवी, लेणामा लेवु	गुण, कीमत गिनना, गिनती में लेना	to consider, to care (for)
गणगण	गणगण	स्त्री	1 नाडमा बोलवु ते 2 अस्पष्ट नामरञ्ज पताववी ते	नाक में बोलना अस्पष्ट रूप से नाराजी जताना	speaking with nasal twang indirectly showing unwillingness
गणगणवु	गणगणवु	अ क्रि	3 षडषड 4 गणगणार (रव) 1 गणगण अेवो अवाण्ण करवो 2 नाडमाथी बोलवु	बडबडाहट गुनगुनाना गुनगुनाना	complaint murmur to murmur, hum
गणगणार	गणगणार	पु	1 गणगण अेवो अवाण्ण 2 नाडमा बोलवु ते 3 मनमा षडषार	नाक में से बोलना गुनगुनाहट नाक में बोलना मन में बडबडाना	to speak with nasal twang murmuring sound speaking with a nasal twang murmur in a complaining way

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गणतर	गणतर	वि	गणी शक्य अणु, गण्यु-गण्यु	गिनती के, इने गिने	that which can be counted, few, small number
		स्त्री	गणवु ते	गणना	counting, calculation
गणतरी	गणतरी	स्त्री	गुणो 'गणती'	देखिए 'गणती'	see 'गणती'
गणती	गणती	स्त्री	1 गणवु ते 2 गणवानी रीत 3 गणी अटेली सख्या 4 अदाज 5 मान, प्रतिष्ठा, लेणु	गिनना, गिनती गिनने की रीति गिनी हुई सख्या अदाजा मान, प्रतिष्ठा, कद्र	counting, calculating method of counting or calculating figure calculated estimate honour, prestige, respect
गणवत	गणवत	न	गणोत, साथ	देखिए 'गणोतपटो'	rent or lease of land
गणवतपटो	गणवतपटो	पु	गणोतनामु, गणोतपटो	देखिए 'गणोतपटो'	lease of land
गणवु	गणवु	स क्रि	1 सख्या अटेली 2 हिसाब के गणितनो दाखलो करवो 3 लेणामा लेवु, मानवु, आदर करवो 4 समजण के उदाहार भेजवु	गिनना, गणना करना गणित का प्रश्न या हिसाब करना, गिनना मानना, समझना समझ या समानापन प्राप्त करना	to find number by counting to do a sum to value, to regard to respect to acquire common sense

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरप	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ગણવેશ	गणवेश	पु.	આખા સમૂહનો એકસમાન પહેરવેશ, 'યુનિફોર્મ'	बरदी, 'युनिफार्म'	uniform
ગણિત	गणित	वि	1. ગણેલું 2. ગણિતવિદ્યા 3. તેની ચોપડી	गणित, गिना हुआ गणितविद्या, अकशास्त्र उसकी किताब	counted arithmetic book of arithmetic
ગણિતશ્રેણી	गणितश्रेणी	स्त्री.	'એ પા' એવી શ્રેણી છે જેના ક્રમવાર શ્રેણી પણ બે પદનો ક્રમ સરખો જ હોય (n)	गणितश्रेणी	arithmetic progression
ગણિતશ્રેણી ગણિતી	गणितश्रेणी गणित्ती	स्त्री. पु.	જુઓ 'ગણિતશ્રેણી' ગણિતશાસ્ત્રી	देखिए 'गणितश्रेणी' गणितशास्त्री, गणितज्ञ	see 'गणितश्रेणी' mathematician
ગણ	गण	वि	-થી ગુણતા આવે તેટલું	गुना	suffixed to number to show so many times
ગણોત	गणोत	स्त्री, न.	1. ગણવત, સાથ 2. ગણોતનામું	वटाई (काश्तकार) पट्टा	rent lease of land
ગણોતનામું	गणोतनामु	न.	જમીનદાર અને ખેડૂત વચ્ચેનો સાથનો કારર- દસ્તાવેજ	पट्टा	lease of land
ગણોતપટો	गणोतपटो	पु.	ગણોતનામું	पट्टा	lease of land
ગણોતપટ્ટો	गणोतपट्टो	पु.	જુઓ 'ગણોતપટો'	देखिए 'गणोतपटो'	see 'गणोतपटो'
ગણોતિયો	गणोतियो	पु.	જમીન ગણોતે રાખનાર- ખેડનાર, સાથીડો	असामी (काश्तकार)	lease-holder, tenant
ગણ્યુંગાંઠ્યું	गण्युंगाठ्यु	वि.	ગણતર, થોડુંક	थोड़ा, गिनती का, गिना-गिनाया	handful, few

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गत	गत	वि	1 गयेलु 2 भूतअणनु, पीती थूँलेलु 3 मरी गयेलु	गया हुआ भूतकाल का, बीता हुआ मृत	gone past dead
		अ	1 सुधी 2 (समासने अते) '—मा आवेलु' '—नु', '—ने' अगेनु के लगतु अे अर्थमा	तक गत	(prep) up to used at the end of a compound in the sense of lying in, of-or pertaining to
		स्त्री	1 गति 2 वाद्य वगाडवानी (ओँ रागना) स्वरोनी रचना	गति स्वरो की वाद्य में रचना, सरगम, गत	speed (music) composition of notes to be played on instrument
		स्त्री, न	हार	हार, पराजय	defeat
गति	गति	स्त्री	1 चाल 2 अडप 3 प्रवेश, प्रवेश करवानी बुद्धिशक्ति 4 समझ, मति 5 शक्ति, बल 6 स्थिति, दशा 7 मूआ पछीनी छालत 8 रस्तो, मार्ग	गति, चाल वेग, रौ प्रवेश, पैठ समझ, मति शक्ति, बल स्थिति, दशा मृत्यु के बाद की दशा, गति रास्ता, मार्ग	gait speed entering into something, ability to do so understanding power, strength state, condition condition of soul after death way
गतियु	गतियु	वि	1 सदगत, गते थयेलु 2 युक्तिशी काम अढी ले अेवु	सद्गति को प्राप्त युक्ति से काम लेने वाला, चतुर	deceased capable of taking work cleverly

गुजराती शब्द	देवनागरी लिप्यन्तरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पद, न	अंग्रेजी पर्याय
जए	गद	स्त्री, न पु.	अतथा छरवु ते 1. छडीदार, चोअदार 2. रोग, भाएगी	खेल में हारना छडीदार रोग, बीमारी	defeat (of games) staff-bearer disease. sickness
जएजडियां	गदगदिया	न	1 [रव] आनपान, नाएण डे आनएनी डेलम- छेल, जएजडिया 2. गलीपची थनी ते	रगरली गदगुदी	abundance of food, drink, money and merriment tackling
जएजडुं	गदगदु	वि.	1 पालीपोचु 2. ग्रेडी जयेलु	गुदगुदा, पिलपिला सड़ा हुआ	soft from being moist rotten
जएडवुं	गदडवु	सक्रि.	1 [पजवती] एवावपु 2 [ला] डेसन डरवुं	(पैरो से) दवाना, रौंदना परेशान करना	to trample under foot to (fig.) harass
जएध	गदव	स्त्री	अेड वनस्पति	एक वनस्पति	kind of herb
जएधडियां	गदवदिया	न	जुओ 'जएजडिया	देखिए 'जएजडिया'	see 'जएजडिया'
जएलुं	गदलु	वि.	गोलायेलु, मेलु, गंहु	मैला, गंदला, गदा	dirty
जएवुं	गदवुं	अक्रि.	1 टट्टर-ट्ट टोभा रडेवु 2. डोडवु 3. चालवु, जवुं 4. गदलुं-धुणवाजु डरवु	तनकर खडे रहना दौडना जाना, चलना गदला या मैला करना	to stand erect, firm to run to walk, go to make dusty
जए	गदा	स्त्री.	लडाधनु अेड छथियार	गदा	mace, club (weapon)
जएवपुं	गदाववु	सक्रि.	डड डे डेतीभा डोडाववु, थडववु	रेत में दौडाना, धका डालना	to cause to run in dust or sand
जडियाएरी	गदियाणी	स्त्री.	अेड वनस्पति, अंसथी	एक वनस्पति	kind of plant

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ગદિયાણો	गदियाणो	પુ	અર્ધા તોલાનુ વજન	आधे तोले की तौल	weight equal to half a tola
ગદૂક	गदूक	ન	હાડકામાનો નરમ માવો, મજ્જા	मज्जा (हड्डी)	marrow of the bone
ગદેલુ	गदेलु	ન	1 ગાદલુ 2 જાડી ગાદી	गदेल गद्दा, तोशक	mattress thickly padded seat
ગધાડુ	गधाडु	ન	એક પશુ	गधा	donkey
ગધેડુ	गधेडु	ન	જુઓ 'ગધાડુ'	गधा	see 'गधाडु'
ગદ્યાપચીશી	गध्यापचीशी	સ્ત્રી	૧૬ થી ૨૫ વર્ષ સુધીનો સમય, જ્યારે માણસમા ગદ્યાઈનુ જોર હોય છે	गधापचीसी	period between 16 and 25 years of man's life when he is dominated by thoughtlessness
ગદ્યાપચીસી	गध्यापचीसी	સ્ત્રી	જુઓ 'ગદ્યાપચીશી'	गधापचीसी	see 'गध्यापचीशी'
ગદ્યાપાટુ	गध्यापाटु	સ્ત્રી, ન	ગદ્યામસ્તી	ऊधम और शरारत	wild and foolish pranks
ગદ્યામજૂરી	गध्यामजूरी	સ્ત્રી	ગદ્યાવૈતરુ	कडी मजदूरी	drudgery
ગદ્યામસ્તી	गध्यामस्ती	સ્ત્રી	મૂર્ખાઈભર્યું, અતિશય તોફાન, લાતલાત	ऊधम और शरारत	wild and foolish pranks
ગદ્યાવૈતરુ	गध्यावैतरु	ન	1 સખત વૈતરુ 2 લાભ વગરની-નકામી મહેનત	कडी मजदूरी वृथा श्रम	hard work useless or senseless labour
ગદધી	गधधी	સ્ત્રી	ગધેડી	गधी	she-donkey
ગદધો	गधधो	પુ	1 ગધેડો 2 (લા) મૂર્ખ	गधा गँवार	donkey foolish
ગપ	गप	સ્ત્રી	1 ઊડતી વાત, અફવા	गप, अफवाह	rumour

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या को.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ગપકાવવું	गपकाववु	स क्रि	2 ખોટી વાત, ડિંગ ગપ દઈને લઈ લેવું કે ખાઈ જવું	खोटी बात, डिंग	baseless story or statement
ગપગપ	गपगप	अ	ઉપરાઉપરી, એક પછી એક, 5x 5x	गपकना	to snatch or swallow
ગપગોળો	गपगोळो	पु	ગપાટો	गपागप, एक के बाद दूसरा	one after another, in quick succession
ગપસપ	गपसप	स्त्री	ગપ્પા, આડી અવળી નવરાશની વાત	गपोडा	rumour
ગપાગપ	गपागप	अ	ગપગપ	गपसप	gossip
ગપાટો	गपाटो	पु	ગપ	गपागप	one after another, in quick succession
ગપાવું	गपावु	अ क्रि	ચુપચાપ કે છાનામાના ઘૂસવું	गप, गपोडा	rumour
ગપાષ્ટક	गपाष्टक	न	ખોટા તડાકા, ગપ	छिपे-छिपे घुसना	to enter silently or surreptitiously
ગપોડશખ	गपोडशख	पु	ગપ્પીદાસ	गप	gossip, idle talk
ગપોડું	गपोडु	न	ગપ્પું	गपोडिया, गपोड	gossip-monger
ગપોડો	गपोडो	पु	ગપ્પું	गपोडु, गप	rumour, false report
ગપોલિયું	गपोलियु	न	1 કશામાથી છુટકી જઈને ભરાઈ બેસવું તે (ખાસ કરીને નિશાળમાથી)	गपोडा	rumour, baseless statement
				नागा (शाला में से खासकर)	playing truant

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 વ્યભિચાર	વ્યભિચાર	adultery
ગપ્પી	गप्पी	વિ	ગપ્પા મારે એવું	गपोडिया, गप्पी	gossipy
ગપ્પુ	गप्पु	ન	જુઓ 'ગપ'	देखिए 'गप'	see 'गप'
ગફલત	गफलत	સ્ત્રી	1 બેદરકારી, અસાવધતા 2 ભૂલ	गफलत, असावधानता भूल, गफलत	carelessness, negligence mistake
ગફફો	गफफो	પુ	ઉતાવળમા-ગપ દઈને ભરેલો મોટો ઢોળિયો-બૂકડો	गफफा	huge morsel swallowed in haste
ગબ	गब	અ	ઝટ, ચટ	झट, चट से	quickly
ગબકાવવું	गबकाववु	સ ક્રિ	ગપ દઈને લઈ લેવું કે ખાઈ જવું	गपकना	to seize and gulp down
ગબડગડ	गबडगड	વિ	દાદારગુ, મૂર્ખ	बौडम, मूर्ख	foolish
ગબડગડું	गबडगडु	વિ	ગદુ અને અવ્યવસ્થિત	गदा और अव्यवस्थित	dirty and disorderly
ગબરુ	गबरु	વિ	1 ગાભલા જેવું, ગોરું અને માસલ 2 નિર્દોષ, ભોળું	गोरा और गदराया हुआ भोला-भाला	soft, white and fleshy innocent, simple
ગબાર	गबार	સ્ત્રી	1 ખાડો 2 બખોલ	गड्ढा खोखला	pit hollow
ગબારો	गबारो	પુ	1 નાનું બલૂન 2 હવાઈ, હવામા ઊંચે જઈ ફૂટે એવું એક જાતનું દારૂખાનું	गुब्बारा, बैलून गुब्बारा, हवाई	small balloon (fireworks) - rocket
ગબ્બી	गब्बी	સ્ત્રી	લખોટી કે મોઈદકાની સ્મતમા કરાતી નાનો ખાડો	गुच्ची	little, round pit in the ground in the game of marbles

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ગબો	गबो	पु.	મૂરખો, રાભો	मूर्ख	fool, dunce
ગબોળો	गबोळो	पु.	1 ગખાટો 2 ભવાડો	गफोड़ा, गप भद्दा, फर्जीहत	rumour fiasco
ગબ્બર	गब्बर	वि	1 સગીન 2 પૈસાદાર 3 જખરુ	सगीन, मजबूत धनी हट्टा-कट्टा	sound wealthy formidable
ગબ્બો	गब्बो	पु.	1 મોટી ગખી 2 શેરડીની ગાઠ 3 રવ. ધખો 4 મૂરખો, રાભો	बड़ी गुचची ईख की गाँठ धौल मूर्ख	large pit eye of the sugar-cane rap, blow fool, dunce
ગભરાટ	गभराट	स्त्री	ગભરામણ	घबडाहट	uneasiness, nervousness
ગભરામણ	गभरामण	स्त्री	1 અછળામણ, મૂઝામણ 2 ભય	घबडाहट, बेचैनी भय	uneasiness, confusion fright
ગભરાવુ	गभरावु	अ क्रि	1 ગૂચાવુ, મૂઝાવુ, ક્રષ્ટાવુ 2 ખીવુ	घबराना डर जाना, उलझन में पडना	to be puzzled, to be confused, to feel distressed to be afraid
ગભરુ	गभरु	वि	1 ગાભાલા જેવુ, ગોરુ અને માસલ 2 નિર્દોષ, ભોળુ	देखिए 'गभरु'	soft, white and fleshy innocent, simple
ગભાણ	गभाण	स्त्री	1 ઢોરના નીરણ માટે, આકુ લાકુ રાખી કરેલી જગા 2 ગામના પાદર પરની ગોચર જમીન, ચરો	चरनी चरागाह	manger, cattle- shed pasture land

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गભાર	गभार	पु	મદિરની અદરનો ભાગ	गर्भगार	innermost part of temple, sanctuary
ગભારો	गभारो	पु	જુઓ 'ગભાર'	देखिए 'गभार'	see 'गभार'
ગભીર	गभीर	वि	1 ઊડુ 2 ઘાડુ 3 ગભીર	गहरा गाढा गभीर	deep intense profound, serious
ગમ	गम	સ્ત્રી	1 બાજુ 2 મનનું વલણ 3 ગતિ પ્રવેશ 4 સૂઝ 5 શોક, દુઃખ 6 ગમખારી	ओर, दिशा मन का झुकाव गति, पैठ सूझ शोक, गम, दुख धैर्य, सहनशीलता	side inclination progress, ability to enter into something insight sorrow, suffering patience, tolerance
ગમતી	गमती	वि	1 વિનોદી 2 આનદી	विनोदी आनदी	humorous merry, happy
ગમવુ	गमवु	अ क्रि	1 મનને સારું લાગવું, ગોઠવું 2 પસંદ પડવું	भाना, रुचना प्रिय लगना, पसंद आना	to like, to feel happy to approve
ગમા	गमा	पु	1 શક્તિ 2 શરીરના સાધા	शक्ति शरीर की सधियों	power, ability joints of body
ગમાણ	गमाण	સ્ત્રી	ઢોરને નીચા માટે, આડું લાકડું રાખી કરેલી જગા	चरनी	manger
ગમાણિયુ	गमाणियु	न	આડું લાકડું	चरनी की आड़ी रखी हुई लकड़ी	beam forming the manger

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गमार	गमार	वि	1 आणसमज्जु, मूर्ख 2 शेचु, गामडियु	गँवार, मूर्ख उजड़	stupid, foolish uncultured, rustic
गमे ते	गमे ते	वि	1 કોઈ કે, કશુ પણ 2 રુચિ કે ઇચ્છા મુજબનુ	कोई भी, कुछ भी मनोनुकूल, इच्छित	any as desired
गमे तेम	गमे तेम	अ	1 રુચિ મુજબ, ઇચ્છા પ્રમાણે 2 કોઈ બધન કે મર્યાદા વગર, નિરકુશ, ઉચ્છ્રખલ રીતે 3 અવ્યસ્થિત રીતે	इच्छानुसार निरकुश रीति से, कैसे भी अव्यवस्थित रूप में	according to one's desire uncontrolled in a disorderly manner
गमे तेम કરીને	गमे तेम करीने	अ	કોઈપણ ઉપાયે કે રીતે	किसी भी उपाय या रीति से	any how
ગમો	गमो	पु	ગમવુ તે, રુચિ	रुचि, पसद	liking, taste
ગમ્મત	गम्मत	स्त्री	વિનોદ, મજા, આનદ	विनोद, मजा, आनद	amusement, fun
ગયુ	गयु	अ क्रि	'જવુ'નુ ભૂતકાળનુ રૂપ	गया	past tense of 'જવુ'
		वि	1 ગયેલુ, વીતેલુ, ભૂતકાળનુ 2 મરી ગયેલુ	गया हुआ, बीता हुआ, भूतकालीन मृत	past, belonging to the past dead
ગયેલુ	गयेलु	वि	'જવુ' નુ ભૂ કૃ	गया हुआ	pp of 'જવુ'
ગર	गर	पु	1 ફળ કે આડના થડની અદરનો ગર્ભ 2 મનનો ભેદ 3 કરનાર એવો અર્થ સૂચવતો પ્રત્યય	गूदा (फल का) मन का भेद, मर्म करने वाला	kernel secret of the mind suffix indicating the sense of doer

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			4 ઝેરી અધાર, ગલ	જહરીલી ષીટ	poisonous matter excreted by some animals and birds
ગરક	गरक	વિ	1 ડૂબેલુ 2 મગ્ન, લીન	गरक, डूबा हुआ मग्न, लीन, गरक	drowned, sunk engrossed in
ગરગડી	गरगडी	સ્ત્રી	1 ફરે તેવુ નાનુ પૈડુ 2 દોરાની ગરગડી, 'રીલ'	गराडी, चरखी फिरकी, 'रील'	pulley reel
ગરજ	गरज	સ્ત્રી	1 ખપ, જરૂર 2 સ્વાર્થ	गरज, जरूरत स्वार्थ	need self-interest, selfish motive
ગરજણ	गरजण	સ્ત્રી	એક પખી	एक पक्षी	a bird
ગરજમતલખી	गरजमतलबी	વિ	સ્વાર્થી	स्वार्थी	selfish
ગરજવત	गरजवत	વિ	ગરજવાળુ	गरजमद	needy
ગરજવાન	गरजवान	વિ	ગરજવત	गरजमद	needy
ગરજવુ	गरजवु	અ ક્રિ	1 ગર્જના કરવી, ગાજવુ 2 મોટેથી બરાડવુ, તડકવુ	गरजना तडकना	to roar, to thunder to bellow, to shout
ગરજ-સવાદી	गरज-सवादी	વિ	ગરજ મતલખી	स्वार्थी	selfish
ગરજાઉ	गरजाउ	વિ	ગરજવાળુ	गरजमद	needy
ગરજિયુ	गरजियु	વિ	ગરજવાન	गर्जी	needy
ગરજી	गरजी	વિ	ગરજાઉ	गर्जी	needy
ગરજીલુ	गरजीलु	વિ	ગરજમતલખી	स्वार्थी	selfish
ગરજુ	गरजु	વિ	ગરજવાળુ	गरजमद	needy
ગરજો	गरजो	પુ	1 ફાગો, અકુર	फुनगी, अकुर	shoot, sprout

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 કાટો, ઊભો ખીલો	કાંટા, खड़ी कील	thorn, vertical nail
			3 ખૂપરો	खुत्थी, खूटी	stump
			4 એક અણિયાળુ ઉશિયાર	નોકદાર શસ્ત્ર	kind of pointed weapon
અરણ	गरण	ન	એક ઝાડ	एक पेड़	a tree
અરણી	गरणी	સ્ત્રી.	1 એક ઔષધિ	एक औषध	kind of medicine
			2 સ્ત્રી-ગુરુ	स्त्री-गुरु, गुरुआनी	female teacher or preceptor
			3 ગરણીજી	जैन साध्वी	Jain nun
અરણીજી	गरणीजी	સ્ત્રી	જૈન સાધવી	जेन साध्वी	Jain nun
અરણ	गरणु	ન.	એક જાતની ધાર્મિક ક્રિયા	धार्मिक क्रिया	a religious rite
અરદન	गरदन	સ્ત્રી	ડોકી, ગળચી, બોચી	गरदन	neck
અરદા	गरदा	સ્ત્રી	ધૂળ	धूल, गर्द	dust
અરદી	गरदी	સ્ત્રી	ગિરદી, ભીડ	भीड़, मजमा	crowd, crowding
અરદો	गरदो	પુ	તમાકુના પાદડાનો ભૂકો, જરદો	जर्दा	tobacco dust
અરનાળુ	गरनाळु	ન	પાણી આવવા-જવા માટે બાધેલો સાકડો માર્ગ, નાળુ	नाला	culvert
અરમ	गरम	વિ	1 ઊનુ 2 શરીરમા ઉષ્ણતા પેદા કરે- વધારે તેવુ 3 જોસમા કે ક્રોધમા આવેલુ	गरम, उष्ण उष्णवीर्य, शरीर में गरमी उत्पन्न करने वाला जोशीला, उत्तेजित, क्रुद्ध	warm, hot producing or increasing heat in the body angry
અરમાઅરમ	गरमागरम	વિ	ગરમ ગરમ, ઊનુ ઊનુ	गरमागरम	hot and fresh

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગરમાગરમી	गरमागरमी	સ્ત્રી	1 ગરમાગરમ હોવું તે 2 ઉશ્કેરાટ, જુસ્સો, ઉત્કટતા	गरमागरमी उत्कटता, जोश, उत्तेजना	being hot excitement
ગરમાટો	गरमाटो	પુ	ગરમી, ઉષ્ણતા, તપાસો	गरमाहट, उष्णता	heat
ગરમાવો	गरमावो	પુ	ગરમાટો, ઉષ્ણતા	गरमाहट	heat
ગરમાળો	गरमाळो	પુ	એક જાતનું ઝાડ	अमलतास	laburnum
ગરમાળાનો ગોળ	गरमाळानो गोळ	પુ	તેની સર્વગમાથી નીકળતો ગોળ જેવો રેચક પદાર્થ	अमलतास का गुड	sweet pith of its pods used as purgative
ગરમી	गरमी	સ્ત્રી	1 ઉષ્ણતા, તાપ, ગરમપાણી 2 ગરમી-ચાદી કે પરમિયાનો રોગ 3 માપસર આક્ર પાડવાનું સુતારનું એક ઓજાર	गरमी, उष्णता उपदश किलकी (बढ़ई का औजार)	heat, temperature kind of venereal disease carpenter's tool for marking
ગરમું	गरमू	ન	તપેલી જેવી પડદી વિનાનું એક પાત્ર કે વાસણ	कटोरदान	bowl-shaped vessel
ગરવ	गरव	પુ	ગર્વ, અહકાર	गर्व, अहकार	pride
ગરવું	गरवू	વિ	મોટું, મહાન, ગૌરવવાળું	गौरवशाली	big, great, proud
		સ કિ	1 ખરવું, પડવું 2 ધીરે રહીને અદર પેસવું	गिरना, झडना धीरे से घुसना	to fall off, drop to enter or penetrate slowly
ગરાડ	गराड	વિ પુ	મોટું ખાડો	बड़ा गड्ढा	big, large pit
ગરાડી	गराडी	વિ	બધાણી, ભાગ, અશ્લીલ કે ગાળા વગેરેનો વ્યસની	व्यसनी, पियन्कड	addict of drug like opium etc

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गरास	गरास	पु	1 गाभनु रक्षाए करवाना બદલામા કાટી આપેલી જમીન અથવા ઊંચક રકમ 2 ગુજરાન માટે આપેલી જમીન	गाँव की रखवाली करने के बदले में दी हुई जमीन या कुछ रकम, जागीर निर्वाहार्थ दी हुई जमीन	land or money given for protection of a village land given for maintenance
गरीडु	गरीडु	न	છાણનો ગોળો	गोबर का गोला	ball of dung
गरीब	गरीब	वि	1 निर्धन, कगाल 2 બાપડુ, દુઃખી 3 નમ્ર, સાલસ, રાક	गरीब, निर्धन, कगाल बेचारा, दीनहीन नम्र, सीधा	poor, penniless helpless, miserable humble, simple, gentle
गरीबाઈ	गरीबाई	स्त्री	1 निर्धनता, कगालियत 2 નમ્રતા, સાલસાઈ	गरीबी, निर्धनता नम्रता, सरलता	poverty humbleness, gentleness
गरेडी	गरेडी	स्त्री	ગરગડી	गराडी, चरखी	pulley
गरोडो	गरोडो	पु	ટેડનો ગોર	हरिजनों का पुरोहित	priest of the untouchables
गरोणी	गरोळी	स्त्री	ઘરોળી, એક ઝેર જનાવર	छिपकली	house-lizard
गर्जपु	गर्जवु	अ-क्रि	1 गाज्जपु, गर्जना करवी 2 મોટેશી બરાડવુ, તડૂકવુ	गरजना तडकना	to thunder, to roar to bellow, to shout
गर्भद्वार	गर्भद्वार	न	મદિરનો છેક અદરનો ભાગ, ગભાર, ગર્ભાગાર	गर्भागार	innermost part of temple, sanctuary
गर्भश्रीमत	गर्भश्रीमत	वि	જન્મથી પૈસાદાર	पोतडों का अमीर, गर्भश्रीमत, जन्म से श्रीमत	born in rich family

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अर्धी	गवी	वि	गर्ववाणु, अभिमानी	घमडी, गर्वी	proud
गर्धीलु	गर्वीलु	वि	गर्वा, अभिमानी	गर्वीला	proud
गल	गल	पु	1 भाएला पडवानो आडो 2 लाथ, लालच 3 गुप्त वात, बातमी 4 गर, भावो 5 झुवामा पडेला थिण डाढवा माटेनो आडोओनो झूमणो, बिलाडी 6 गर, अेशी अधार-लाण 7 अत्तीनो भोगरो 8 पिवाए गयेली-अणी गयेली चलममानी गडाडु	कॅटिया, गलग्रह (मछली का) घूस, लालच पता, गुप्त बात गूदा, मज बिलाई, कॅटा जहरीली बीट या लार बत्ती का गुल तबाकू का जट्टा, गुल	fishing hook bribe, inducement secret information kernel drag-hook droppings, sometimes poisonous, of birds or animals snuff of wick residue of tobacco in pipe after smoking
गलडी	गलकी	स्त्री	शाडनो अेड वेलो	नेनुआ, घियातोरि (बेल)	creeping plant bearing gourd
गलडु	गलकु	न	गलडीनु इण	घिया, नेनुआ	gourd of such plant
गलगलिया	गलगलिया	न	जुओ 'गलीगली'	गुदगुदी	see 'गलीगली'
गलगली	गलगली	स्त्री	गलीगली, गलीपथी	गुदगुदी	titillation
गलगडु	गलगडु	न	गणानो अेड रोग	गले का एक रोग, गलगड	disease of the throat
गलगोटो	गलगोटो	पु	1 अेड झूलनो छेड 2 तेनु झूल	फूल का पौधा उसका फूल	marigold its flower

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગલજીભી	गलजीभी	સ્ત્રી	એક વેલો	एक बेल	a creeper
ગલદુ	गलदु	વિ	ઘરડુ, વૃદ્ધ, મોટુ	बूढा, बडा, वृद्ध	old, senior
ગલતકોઢ	गलतकोढ	પુ	લોહી કે રસ ટપક્યા કરે એવો કોઢનો રોગ	टपकने वाला कुष्ठ रोग	kind of leucoderma
ગલત્કુષ્ઠ	गलत्कुष्ठ	પુ	જુઓ 'ગલતકોઢ'	देखिए 'गलतकोढ'	see 'गलतकोढ'
ગલશૂશી	गलशूशी	સ્ત્રી	જુઓ 'ગળશૂશી'	देखिए 'गलशूशी'	see 'गलशूशी'
ગલપટો	गलपटो	પુ	જુઓ 'ગલપટો'	देखिए 'गलपटो'	see 'गलपटो'
ગલપટ્ટો	गलपट्टो	પુ	ગળે વીટવાનો પટો, ગલૂબધ	गुलूबद	scarf, muffler
ગલપાપડી	गलपापडी	સ્ત્રી	જુઓ 'ગોળપાપડી'	देखिए 'गोणपापडी'	see 'गोणपापडी'
ગલહૂતી	गलहूती	સ્ત્રી	જુઓ 'ગળશૂશી'	देखिए 'गलशूशी'	see 'गलशूशी'
ગલી	गली	સ્ત્રી	1 ગલીપચી, ગલીગલી 2 સાકડી વાટ-શેરી	गुदगुदी गली, कूचा	tickling narrow street, lane
ગલીકૂચી	गलीकूची	સ્ત્રી	ગલીઓમાનો આડાઅવળો અને સાકડો માર્ગ	गली-कूचा, गलियों में गुजरने का छोटा मार्ग	lanes and bylanes, narrow passage passing through these
ગલીકૂચી	गलीकूची	સ્ત્રી	જુઓ 'ગલીકૂચી'	देखिए 'गलीकूची'	see 'गलीकूची'
ગલીગલી	गलीगली	સ્ત્રી	ગલીપચી	गुदगुदी	tickling, titillation
ગલીચ	गलीच	વિ	ગદુ-અતિ ગદુ	गलीज	dirty, filthy
ગલીચો	गलीचो	પુ	જુઓ 'ગલીચો'	देखिए 'गलीचो'	see 'गलीचो'
ગલીપચી	गलीपची	સ્ત્રી	શરીરના અમુક ભાગમા સ્પર્શથી થતા સળવળાટની મજેદાર અસર	गुदगुदी	tickling, titillation

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गल्लूडियु	गल्लूडियु	न	भटोणियु, धारु नानु पथ्यु	पिल्ला	puppy
गल्लूभद	गल्लूबद	पु	गल्लपट्टो	गुल्लूबद (पट्टी)	scarf, muffler
गल्लूभध	गल्लूबध	पु	जुओ 'गल्लूभद'	गुल्लूबद (पट्टी)	see 'गल्लूभद'
गलेगड	गलेगड	न	अेक पक्षी	एक पक्षी	kind of bird
गलेक	गलेफ	पु	गादीतडिया वगेरेनी जोले	गलेफ, गिलाफ	pillow cover, cover for mattress etc
गलोडियु	गलोडियु	न	गोटीभडु	कलैया, कलाबाजी	somersault
गलोठु	गलोठु	न	गाल नीचेनो भोनी अदरनो भाग	गलफडा	inside of the cheek
गलोले	गलोल	स्त्री	1 गोक्षुण जेवु गलोले इकवानु अेक साधन 2 तेना वडे इकतो गलोले	गुलेल गुलेला (ढेला)	pellet-bow pellet thrown by this
गलोली	गलोली	स्त्री	नानो गलोले	छोटा गुलेला	small pellet
गलोले	गलोले	पु	गलोले वडे भारवानो गोण डकरो के पथरो	गुलेला	round stone used in pellet- bow
गल्लालेला	गल्लालेला	न	(रव) गागातलेला, जखाना, आनाडानी	टालमटूल, बहाने	excuses, pretexts, hesitation
गल्लो	गल्लो	पु	1 नाशा राभवानु ठाम-जगनो 2 परचूरुण वडरानु नाशा राभवानु पात्र	गोलक, खजाना गल्ला	safe cash-box
गवडाववु	गवडाववु	स क्रि	'गावु' नु प्रेरक	'गावु' का प्रेरणार्थक रूप	caus of 'गावु'
गवराववु	गवराववु	स क्रि	जुओ 'गवडाववु'	देखिए 'गवडाववु'	see 'गवडाववु'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गवरी	गवरी	स्त्री	गाय	गाय	cow
गवरीकद	गवरीकद	पु	એક વનસ્પતિ	एक वनस्पति	kind of plant
गवडर	गवडर	पु	ગવનર-હાકેમ	गवर्नर	governor
गवाडवुं	गवाडवुं	स क्रि	જુઓ 'ગવડાવવું'	देखिए 'गवडाववुं'	see 'गवडाववुं'
गवार	गवार	पु	1 એક વનસ્પતિ, ગુવાર 2 તેની શીંગ અને બીજ	ग्वार ग्वारफली	kind of plant, vetch its pod and seed
गवारइणी	गवारफळी	स्त्री	ગવારની શીંગ	ग्वारफली	vetch-pod
गवारशिग	गवारशिग	स्त्री	જુઓ 'ગવારइणी'	देखिए 'गवारइणी'	see 'गवारइणी'
गवावु	गवावु	अ क्रि	1 'गावु' નુ કર્મણ 2 (લા. પ્રિ. ધા. વુ, કુળેત શવુ	'गावु' का कर्मणि रूप बदनाम होना	passive of 'गावु' to be censured or disgraced
गवैथो	गवैयो	पु	ગાનારો, ગાવામા ઉસ્તાદ	गवैया, गाने में कुशल	musician, singer
गहन	गहन	वि	1 ઊડુ, ગાઢ 2 દુર્ગમ, દુર્ભેદ 3 અકળ, ગૂઢ	गहन, गाढा दुर्गम गूढ, गहन	deep, thick incomprehensible, impenetrable mysterious
गहिरगभीर	गहिरगभीर	वि	ગહન અને ગભીર ઊડાણ અને ગભીરતાવાળુ	गहन और गभीर	deep and serene
गहेकवु	गहेकवु	अ क्रि	મહેકવુ	महकना	to give good smell
गलओ	गळको	पु	1 એક વાર ચાખેલી વસ્તુનો રહી ગયેલો સ્વાદ 2 रुची, ભાવ, ચસ્કો	चसका रुचि, चाह, अरमान	taste, relish appetite, craving for a thing once tasted

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
મળમળુ	ગઠગઠુ	વિ	1 પાણીપોચુ, ઢીલુ 2 દુઃખથી કે લાગણીથી હૈયુ વા કઠ ભરાઈ જવાથી થાય એવુ	પિલપિલા, ગુલગુલા દુઃખકાતર, ગદ્ગદ	soft with moisture choked with emotion
મળચટુ	ગઠચટુ	વિ	જરા મળપણના સ્વાદવાળુ	જરા મીઠા	slightly sweet, sweetish
મળચિયુ	ગઠચિયુ	વિ	મળા સુધી આવે એટલુ	મળે તક આવે ઉતના, લબરેજ	stuffed to the throat
		ન	1 મળુ, બોચી 2 ડૂબતા માણસનુ ઉપરનીચે આવવુ તે, ડૂબકા ખાવા તે	મળા ડૂબતે મનુષ્ય કા ડૂબના ઉતરાના, ડૂબકી	neck bobbling up and down of a drowning man
મળચી	ગઠચી	સ્ત્રી	મળુ, બોચી	મળા, મરદન	neck, throat
મળજીભી	ગઠજીભી	સ્ત્રી	જુઓ 'મળજીભી', એક વનસ્પતિ	દેખિય 'મળજીભી	see 'મળજીભી kind of plant
મળણી	ગઠણી	સ્ત્રી	મળવાનુ છિદ્રાણુ સાધન	છલની	sieve, strainer
મળણુ	ગઠણુ	ન	પાણી ઇત્યાદિ મળવાનો કપડાનો કકડો	છન્ના, છનના	piece of cloth for filtering water
મળતકોઢ	ગઠતકોઢ	પુ	જુઓ 'મળતકોઢ'	દેખિય 'મળતકોઢ'	see 'મળતકોઢ'
મળતી	ગઠતી	સ્ત્રી	જેમાથી ટીપે ટીપે પાણી મળ્યા કરે એવુ વાસણ, શિવલિંગ પર લટકાવાતુ તેવુ વાસણ	મળહરી	vessel with a hole for water to drip, such vessel hung over Shiva ling
મળશૂથી	ગઠશૂથી	સ્ત્રી	તરત જન્મેલા બાળકને આપવાનુ ગોળ, ઘી તથા પાણીનુ મિશ્રણ	ઘુટ્ટી, જનમઘૂટી	mixture of molasses, ghee and water given to a new born baby

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગળધરી	गळधरी	સ્ત્રી	પિત્તપિંડારથી ગળુ બળવુ તે, અન્નનળની બળતરા	અન્નનલિકા કી જલન	burning of throat owing to bile
ગળધાઈ	गळधाई	સ્ત્રી	ગળધરી, ગળધી	દેખિયે 'ગળધરી'	burning of throat owing to bile
ગળધી	गळधी	સ્ત્રી	ગળધરી, ગળધાઈ	દેખિયે 'ગળધરી'	see 'ગળધરી'
ગળપણ	गळपण	ન	1 ગળ્યો સ્વાદ 2 ગોળ, ખાડ જેવી ગળી વસ્તુ	મિઠાસ મીઠા	sweet taste, sweetness sweet substances like molasses, sugar etc
ગળફો	गळफो	પુ	જે કફ મોંમા આવતા શૂક્રીએ છીએ તે, બળખો	ઉગાલ, ખખાર	phlegm
ગળબધ	गळबध	પુ	ગળાનુ એક ઘરેણુ, ગળુ બધ	ગુલૂબદ (જેવર)	necklace
ગળમાણુ	गळमाणु	ન	એક વાની-ગળ્યુ પેય	એક સ્વાદિષ્ટ પેય	sweet drink
ગળવુ	गळवु	સ ક્રિ	1 ગળામા ઊતરી જવુ 2 ગાળવુ, શુદ્ધ કરવુ 3 ઝમવુ 4 ઓગળવુ 5 ઢાંલુ થવુ, પાકવુ 6 અદર ઊતરી જવુ, કળવુ	નિગલના છાનના રિસના, ટપકના ગલના, પિઘલના નરમ હોના, પકના ધસના, ગડના	to swallow to filter, purify to drip, to ooze to melt to soften, to ripen to penetrate
ગળસૂણુ	गळसूणु	ન	ગળુ સૂણુ આવવુ તે	ગલસુઆ, કનફેડ	swelling of throat
ગળહૂતી	गळहूती	સ્ત્રી	જુઓ 'ગળશૂશી' ગલહૂતી	ઘુટ્ટી	see 'ગળશૂશી' 'ગલહૂતી'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અળાટૂપો	ગઢાટૂપો	પુ	ગળુ દબાવી મારી નાખવુ તે	ગલા ઘોંટના	killling by throttling
અળાફાસો	ગઢાફાસો	પુ	ગળે ફાસો ખાવો— દેવો તે	ગલફાંસી	strangling
અળાબૂડ	ગઢાબૂડ	વિ	ગળુ બૂડે એવુ, ગળાયિયુ	ગલા ડૂબે એસા (પાની આદિ)	neck-deep
અળામણ	ગઢામણ	ન	1 ગાળવાની રીત કે મહેનતાણ (સોનુ, રૂપુ ઈ)	ગલાને કી રીતિ યા ઉઝત	process of melting gold, silver etc or wages for melting
			2 ગાળતા નીકળતો કચરો	ગલાતે સમય નિકલા હુઆ કચરા	residue left after melting
અળામણી	ગઢામણી	સ્ત્રી	ગાળવાનુ મહેનતાણુ	ગલાને કી ઉઝત	wages for melting
અળાવવુ	ગઢાવવુ	સ ક્રિ	'ગળવુ', 'ગાળવુ' નુ પ્રેરક	ગલાના	caus of 'ગળવુ' and 'ગાળવુ'
અળિયુ	ગઢિયુ	વિ	1 બેઠુ ઊઠે નહિ એવુ 2 (લા) નિર્માલ્ય કે જઠ્ઠી	ગરિયાર, ઢીઠ નિકમ્મા, ફક્કી	obstinate obstinate, useless
અળિયેલ	ગઢિયેલ	વિ	ગળીના રંગનુ, નીલુ	નીલા	of the colour of indigo
અળી	ગઢી	સ્ત્રી	1 એક વનસ્પતિ	એક વનસ્પતિ, નીલ	indigo
			2 એના પાદડામાથી કઢાતો નીલો રંગ	નીલ, ઢૂલી (રા)	colour made from its plant
			3 અવાજ, સૂર, ગળુ	આવાજ, ગલા	voice, note
ગળુ	ગઢુ	ન	1 શરીરનુ એક અગ 2 અવાજ, સૂર	ગલા આવાજ, સ્વર	the throat voice

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गणो	गळो	स्त्री	એક વેલ	गुडुच, गिलोय	kind of medicinal creeper habit
गण्यु	गळ्यु	पु	ટેવ, લત	टेव, लत	sweet
गगमेना	गगमेना	स्त्री	ગોળ-સાકરના જેવા સ્વાદવાળુ મીઠું	मीठा	kind of bird, bank myna
गज	गज	पु	એક પક્ષી	एक पक्षी	heap set of things of the same kind fitting into one another
गजावर	गजावर	वि	1 ઢગલો 2 એક જાતની એકબીજામા બેસતી વસ્તુઓની ઉતરડ	गज, ढेर गड्ड	huge, very large
गज्	गजी	स्त्री	ઘાસનો ઢગલો, ઓધો	बहुत बड़ा	hay-stack
गज्शक	गजीफराक	न	શરીરે ચપટ આવી રહે એવું ગૂથેલું બદન	घास का गज, गजी	underwear
गज्शे	गजीफो	पु	રમવાના પાનાનો જથ્થો	गजी, बनियाइन	pack of cards
गजेटी	गजेटी	वि	ભાગગાજાનો વ્યસની	ताशके पत्तों की गड्डी, गड्ड	one addicted to 'bhang', opium etc
गठावपु	गठावपु	स क्रि	'गाठपु' नु प्रेरक	गॅजेडी	caus of 'गाठपु'
गठापु	गठापु	अ क्रि	1 'गाठपु' नु उर्ध्वि रुप 2 (ला) प्रधतु अटकपु (गठाएँ जपु)	'गाठपु' का प्रेरणार्थक रूप	passive of 'गाठपु' to stop developing or growing

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गठियु	गठियु	वि	1 ठग, धुतारु 2 ખીસાકાતરુ	ठग, धूर्त गँठकटा, जेबकट	roguish, deceitful pick-pocket
गठो	गठो	पु	1 કોટે પહેરવાનુ એક ગાઠેલુ ઘરેણુ, કઠો 2 દાખાને બાધેલી ગાસડી 3 આઠ ફૂટની લબાઈનુ માપ 4 ગાઠિયો	गौठी, कठा कसकर बौधी हुई गठरी, गौठ आठ फुट की एक नाप गट्ठा, गौठ	kind of necklace tightly packed bundle or bale measure of eight feet knot or root
गठोડો	गठोडो	पु	1 સ્ત્રીના પગનુ એક ઘરેણુ 2 સોનાનુ સાકળુ 3 પીપળી મૂળ, એક ઔષધિ	स्त्रियों के पैर का एक गहना सोने का साँकडा पीपरामूल, पिप्पलीमूल	anklet gold chain medicinal root
ગડેરી	गडेरी	स्त्री	છોલેલી શેરડીના કકડા	गँडेरी	pieces of peeled sugarcane
ગદકી	गदकी	स्त्री	1 વાસ મારતો કચરોપૂજો કે મળમૂત્ર 2 અસ્વચ્છતા	गदगी, मलमूत्र या कूडा-करकट अस्वच्छता, गदगी	rubbish, filth want of cleanliness
ગદુ	गदु	वि	ગદકીવાળુ, મેલુ	गदा	dirty
गध	गध	पु, स्त्री	1 સોડ, વાસ 2 દુર્ગંધ 3 સુગંધી પદાર્થ, ચંદન 4 તિલક, ચાલ્લો 5 મિશ્રચાત્તિમાન 6 અણગમો 7 સહવાસ, નિકટતા	गध, बास बदबू, दुर्गंध सुगंधित द्रव्य (चंदन) तिलक, टीका	smell bad smell scent, fragrant substance (sandalwood) red mark on the forehead vanity dislike contact, intimacy

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્ત્વ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગધાવુ	गधावु	અ ક્રિ	1 ગધ-બદબો મારવી 2 કોવાવુ	गधाना सडना	to emit out bad smell to rot, decay
ગધીલુ	गधीलु	વિ	1 વાસ મારતુ 2 (લા) અદેખુ 3 ક કાસિયુ 4 અતિશય ચીકણા સ્વભાવનુ	बदबूदार ईर्षालु झगडालू अतिशय चिकने स्वभाव का	stinking jealous quarrelsome stingy, miserly
ગભીર	गभीर	વિ	1 ઊડુ 2 અહોભાવ ને માન ઉપજાવે તેવુ, પ્રૌઢ 3 પુખ્ત, ઠરેલ, વજનદાર 4 ધીર, સહનશીલ	गहरा, गभीर प्रौढ़ सजीदा, सोचनेवाला धीर, सहनशील	deep, serious inspiring wonder and respect mature, thought- ful, influential patient, forbearing
ગમત	गमत	સ્ત્રી	ગમત, વિનોદ, મજા, આનંદ ગમ્મત	विनोद, मजा, आनंद	amusement, diversion
ગા	गा	સ્ત્રી	દૂધ દેતુ એક ચોપગુ પ્રાણી	गाय, गौ	cow
ગાઉ	गाउ	પુ	અતરનુ એક પરિમાણ (દોઢેક માઈલ)	कोस	measure of distance equal to 3 2 kms
ગાગર	गागर	સ્ત્રી	1 સાકડા મેનુ પાણી ભરવાનુ વાસણ, અમુક ઘાટનો ઘડો 2 હળનો વચ્ચેનો જાડો ભાગ	गगरी हलककुद	pot with narrow mouth for holding water thick, middle part of a plough
ગાજ	गाज	ન	રેશમ, સૂતર કે તારની એક જાળીદાર કે પાતળા પોતની બનાવટ	जालीदार बुनाई	kind of thin or net-like cloth
		પુ	બોરિયુ ઘાલવાનુ નાકુ	काज (बटन का)	eye-let in cloth for button

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		स्त्री	गर्जना	गर्जना	thundering
गाजवीज	गाजवीज	स्त्री	वाढणानी गर्जना अने वीजणी	बादलों का गर्जन और बिजली	thunder and lightning
गाजवु	गाजवु	अ क्रि	1 गरजवु, गर्जना करवी 2 गजरेर थवु, नामना थवी	गर्जना करना, गरजना प्रसिद्धि होना, नाम आसमान पर होना	to thunder, roar to be popular or famous
गाज	गाजी	वि	धर्मने माटे लडनार डे भरनार वीर	गाजी	one who fights and dies for religion (esp used of a Muslim)
गाळ	गाझ	न	जुओ 'गाळ'	देखिए 'गाळ'	see 'गाळ'
गाळी	गाझी	वि	जुओ 'गाळ'	देखिए 'गाळ'	see 'गाळ'
गाडर	गाडर	न	धेटु, भेटु	भेड	sheep
गाडरियु	गाडरियु	वि	1 गाडरने लगतु 2 (ला)गाडरनी जेभ आधणी रीते अनु सरतु, गतानुगतिड	भेड से सबधित भेडचाल चलने वाला, अधानुकरण करनेवाला	pertaining to sheep blindly following like sheep
गाडरु	गाडरु	न	जुओ 'गाडर'	भेड	see 'गाडर'
गाडली	गाडली	स्त्री	गाडली	बैलगाडी	bullock-cart
गाडलु	गाडलु	न	गाडलु	छकडा	bullock-cart
गाडवु	गाडवु	स क्रि	जाडो करीने धाटवु	गाडना	to bury, inter
गाडवो	गाडवो	पु	धडा जेवु पासण (धी-तेल भरवानु)	घियाँडा	vessel for storing ghee, oil etc
गाडाचीलो	गाडाचीलो	पु	गाडानो चीलो, गाडा-वाट, गाडानो मार्ग	गाडी का मार्ग	cart-rut track for cart

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગાડાવાટ	गाडावाट	પુ	જુઓ 'ગાડાથીલો'	देखिए 'गाडाथीलो'	see 'गाडाथीलो'
ગાડી	गाडी	સ્ત્રી	એક વાહન (રેલ-ગાડી, મોટર-ગાડી, ઘોડા-ગાડી વગેરે)	गाडी	vehicle (train, car, horse-cab etc)
ગાડીત	गाडीत	પુ	ગાડી હાકનાર	गाडीवान	driver of cart etc
ગાડીવાન	गाडीवान	પુ	જુઓ 'ગાડીત'	गाडीवान	see 'गाडीत'
ગાડુ	गाडु	ન	એક વાહન	बैलगाडी, छकडा	bullock-cart
ગાઢ	गाढ	વિ	1 ઘટ્ટ, ઘાડુ 2 અત્યંત, ઘણું (અજ્ઞાન, અધકાર) 3 ભારે, ઘોર (નિદ્રા)	गाढा, ठस अत्यत, घना, घोर	thick very much
ગાઢું	गाढुं	વિ	જુઓ 'ગાઢ'	देखिए 'गाढ'	see 'गाढ'
ગાણું	गाणुं	ન	1 ગાવુ તે 2 ગાયન, ગીત	गाना गीत, गाना	singing song
ગાતર	गातर	ન	શરીરના અવયવ, સાધા	अवयव, अग	parts or joints of the body
ગાદલુ	गादलु	ન	ખૂબ રૂથી ભરેલું ગોદડું	गद्दा, गदला	mattress (of cotton)
ગાદી	गादी	સ્ત્રી	1 બેસવાના માપનુ નાનું ગાદલું 2 શેઠ કે મોટા માણસ કે મહત ઈ નુ આસન કે પદ 3 રાજાનુ તખ્ત, સિંહાસન	गद्दी, छोटा गद्दा गद्दी सिहासन, राजगद्दी	cushion for seat seat, rank or position of a rich man, leader or religious leader throne
ગાદીતકિયો	गादीतकियो	પુ	1 ગાદી અને તકિયો	गद्दी और तकिया	soft padded seat and cushion

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 (લા) આરામ અને સુખની સ્થિતિ	મસનદ, ગાવ- તકિયા	state comfort and luxury
ગાદીપતિ	गादीपति	પુ	1 રાજા 2 ગાદીનો વારસ	રાજા गद्दी का वारिस	king heir to the throne
ગાન	गान	ન	ગાવુ તે, ગાયન, ગીત	ગાન, ગીત	singing, song
ગાનતાન	गानतान	ન	1 ગાવુ બજાવવુ તે 2 (લા) યેનબાજી	ગાના-બજાના सुख-चैन	singing and music revelry
ગાફલ	गाफल	વિ	જુઓ 'ગાફેલ'	દેખિયે 'ગાફેલ'	see 'गाफेल'
ગાફેલ	गाफेल	વિ	અસાવધ	ગાફિલ	negligent, inadvertent
ગાફેલી	गाफेली	સ્ત્રી	ગાફેલિયત, અસાવધાની	અસાવધાની	negligence
ગાભ	गाभ	પુ	ગર્ભ (પશુની માદાનો)	પશુ કા ગર્ભ, ગાભ	embryo (of beast)
ગાભણ	गाभण	ન વિ, સ્ત્રી	એક જાતનો પોથો પથ્થર, ચિરોડી ગાભણી	એક તરહ કા નરમ पत्थर गाभिन (पशु)	kind of soft stone pregnant with young (used of lower animals)
ગાભણી	गाभणी	વિ, સ્ત્રી	ગર્ભવાળી (પશુની માદા)	ગાભિન (પશુ)	pregnant with young (of beast)
ગાભરુ	गाभरु	વિ	ગાભરાયેલુ	ઘબરાયા હુઆ, हक्का-बक्का	confused, frightened
ગાભલુ	गाभलु	વિ ન	નરમ, પોચુ 1 પાંજેલા રૂનો પોલ 2 વાદળાનો જથ્થો	નરમ, પોચા धुनी हुई नरम रूई, गाला बादलों का समूह	soft ball of carded cotton mass of clouds

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गाभो	गाभो	पु	1 જેનાથી વસ્તુની અદરનુ પોલાણ પૂરવામા આવે તે 2 પાઘડીનુ બોતાનુ 3 ઘરેણાની અદરનો તાબાપિત્તળનો સળિયો 4 અદરનો ગર-ગરભ 5 રફી કમડુ-ડૂથો	गाभा तहपेच जेवर के भीतर की तौबे-पीतल की सिलाई मज, गूदा गूदड, चीथडा	thing used to fill a hole or hollow things stuffed inside a turban copper or brass wire or bar used in making up gold or silver ornaments pulp, kernel rag, crumpled piece of paper
ગામ	गाम	न	1 માણસના વસવાટનુ સ્થળ 2 વતન, રહેઠાણ	गाँव वतन, वासस्थान	village, town, place of residence birth-place, native place
ગામઠ	गामई	वि	આખા ગામનુ, —ને લગતુ	सारे गाँव का, ग्राम्य	of or pertaining to the whole village
ગામઠાણ	गामठाण	न	જેની પર ગામ વસ્યુ હોય તે જમીન કે સ્થળ	गोट-बस्ती	land on which village is situated
ગામઠી	गामठी	वि	1 ગામડાનુ, —ને લગતુ 2 ગ્રામ્ય, ગામડિયુ	गाँव का, गाँव-सबधी ग्राम्य, ग्रामीण	of or about a village rustic
ગામડિયણ	गामडियण	स्त्री	ગામડિયા સ્ત્રી	ग्रामीण स्त्री	rustic woman
ગામડિયુ	गामडियु	वि	1. ગામડાનુ, —ને લગતુ 2 [લા પ્રેવી રીતભાતનુ, રોયા જેવુ, પ્રાકૃત	गाँव का, देहाती, ग्राम्य प्राकृत, उजड़ड, असकारी	of or about a village rustic, boorish

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गामडियो	गामडियो	पु	गामडानो प्राकृत भारस	देहाती, ग्रामीण	villager, rustic
गामडु	गामडु	न	नानु गाम	छोटा गाँव, गँवई	small village
गामतरु	गामतरु	न	1. थेक गाम छोडी भीजे गाम जवु —ग्रामातर करवु ते 2 भररु	ग्रामांतर करना मृत्यु	leaving one village and settling in another death
गामसरणी	गामसरणी	स्त्री	आजा गामने जमाडवु ते, गामेरु	सारे गाँव को भोज देना	dinner given to the whole village
गामसारणी	गामसारणी	स्त्री	जुओ 'गामसरणी'	देखिए 'गामसरणी'	see 'गामसरणी'
गामात	गामात	वि	जुओ 'गामठ'	देखिए 'गामठ'	see 'गामठ'
गामेती	गामेती	पु	1 गामनो मुख्य भारस, मुज्जी 2 गामनो रजवाण	गाँव का अगुआ, मुखिया ग्रामरक्षक	village headman village guard
गामोट	गामोट	वि	1 गामनु 2 गामडियु	गाँव का ग्राम्य	of a village rustic
		पु	गामनो गोर	गाँव का पुरोहित	village priest
गामोतर	गामोतर	पु	गामनो बछारवटियो	गाँव का लुटेरा	out-law from a village
गामोतरु	गामोतरु	न	जुओ 'गामतरु'	देखिए 'गामतरु'	see 'गामतरु'
गाय	गाय	स्त्री	दूध देतु थेक चोपगु	गाय, गौ	cow
गायड	गायक	पु	गानारो, गवैयो	गायक, गवैया	singer
गायडवाडी	गायकवाडी	स्त्री	गायडवाडनु डि तेना जेवु) राज्थ डे राज्थवडीवट	गायकवाड का	state or administration similar to that of the Gaekwad
गायड	गायका	स्त्री	गानारी, गायड स्त्री	गायिका	songstress

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रजी पर्याय
गायब	गायब	वि	गेब, अलोप	गायब, अदृश्य	invisible, vanished
गायबगलु	गायबगलु	न	એક પક્ષીપ્રાયઃ ટોર પાસે રહી તેના જીવડા ખાય છે)	एक पक्षी, गायबगला	heron
ગાર	गार	સ્ત્રી	લીપવા માટે બનાવેલો દાણમાટીનો ગાર	गार	mixture of cow-dung, earth and water for daubing or coating the floor
		વિ	ઘણ ઠંડુ (ઠંડુગાર)	बहुत ठंड	very cold
ગારુડી	गारुडी	પુ	1 મદારી 2 સાપનો મત્ર જાણનાર 3 જાદુગર	मदारी गारुडी, सँपेरा जादूगर	juggler snake-charmer magician
ગારો	गारो	પુ	1 ગ્રાવ, ગ્રીચડ 2 અણતરમા વાપરવા કચેલી તૈયાર માટી 3 કેલ	कीचड गार पीसा हुआ चूना	mud, slush mud ready for use in building construction mortar ready for use in building construction
ગાલ	गाल	પુ	માણસના મોની બે બાજુનો ભાગ	गाल	cheek
ગાલિ	गालि	સ્ત્રી	ગાળ	गाली	abuse
ગાલીચો	गालीचो	પુ	ઊનનુ એક જાતનુ પાથરણ	गालीचा, कालीन	carpet
ગાલ્લી	गल्ली	સ્ત્રી	1 નાનુ ગાલ્લુ	छोटी बैलगाडी	small cart or carriage

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 એક પરિમાણ, ત્રીસ માણનુ માપ	ત્રીસ મન કી એક નાપ	a weight equal to 30 maunds
ગાલ્લુ	ગાલ્લુ	ન	ગાડુ	છકડા, ગાડી	bullock-cart
ગાવડી	ગાવડી	સ્ત્રી	ગાય	ગૈયા, ગાય	cow
ગાવડોલ	ગાવડોલ	પુ	મુખ્ય ઢૂવાસ્થાલ 'ટોપ માસ્ટ'	મુખ્ય મસ્તૂલ	top mast
ગાવદી	ગાવદી	વિ	1 ગોજુ, ગદુ 2 અણસમજુ, મૂર્ખ 3 જગલી	ગદા નાસમજ, મૂર્ખ જગલી, ઉજડ	dirty foolish uncivilized
ગાવલી	ગાવલી	સ્ત્રી	દલાલી, કમીશન	દલાલી, કમીશન	brokerage, commission
ગાવુ	ગાવુ	સ ક્રિ	1 સુરેલ અવાજ કાઢવો, સંગીતમા બોલવુ (ગીત વગેરે) 2 (લા)વખાણ કરવા 3 એકની એક વાત વારવાર કહેવી	ગાના બખાનના, ગુણ ગાના દોહરાના, બાર-બાર કહના	to sing to praise to say the same thing again and again
ગાશા	ગાશા	પુ	ઘોડાની પીઠ ઉપર નાખવાની ડબી, ઘાસિયો	અર્કગીર	piece of woollen or padded cloth placed below the saddle of a horse
ગાશિયો	ગાશિયો	પુ	જુઓ 'ગાશા'	દેખિય 'ગાશા'	see 'ગાશા'
ગાળ	ગાળ	પુ.	ગાળતા નીકળેલો કચરો	ખૂદ, નિયાર	residue left after straining
		સ્ત્રી	અપશબ્દ	ગાલી	abuse abusive term
ગાળવુ	ગાળવુ	સ ક્રિ	1 કચરો કાઢી શુદ્ધ કરવુ (ઢૂવો, પાણી ઇ)	છાનના (પાની આદિ)	to purify by removing dirt etc

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 आथ ६४ ओगाणवुं (धातु ६)	गलाना (धातु आदि)	to melt by heating
			3 शोधवु, ओछु ३२वु	सोखना, कम करना, गलाना	to make thin or lean
			4 पिताववु, पसार ३२वु	बिताना, काटना, गुजारना	to pass, waste (time), to kill time
गाणथु	गाळियु	न.	1 दोरने बाधवानु गाणावाणु दोरडु	गरोव	tether, rope with a noose
			2 (ला) धमनो षोणे, ज्वाबदारी	कार्य का भार, जिम्मेदारी	burden, responsibility
			3 गणरी	छलनी	sieve, strainer
			4 गाणता नीधनेलो उथरो	खूद, निथार	residue left after straining
गाणी	गाळी	स्त्री	1 गाण	गाली	abuse
			2 पर्वतो पथ्येनो साडको मार्ग, जीरा	घाटी, दर्रा	pass, valley
गाणो	गाळो	पु	1 सरडावी ज्वाय थेवु नाडु, शसो	अखिन, फदा	running knot-or noose
			2 अमुक समय	मियाद, अवधि, निश्चित समय	period of time
			3 मोसम	मौसम	season
			4 घरनो विभाग, ખડ	कमरा, घर का विभाग	apartment, a part of room
			5 वे स्थण के अण पथ्येनु अतर	अतर, फासला	interval, distance
			6 पडोणाछ, पनो	अर्ज, चौडाई, पनहा	breadth
			7 अमुक जग, प्रदेश	अमुक स्थान, प्रदेश	particular place or region
			8 धणारु ओरवानु धटीनु भों	चक्की का मुँह	mouth of a grinding mill to put corn in

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			9 બગડીનો વ્યાસ	चूडी का घेरा	diameter of a bangle
			10 શરીરનો બાધો	शरीर की गठन, काठी	constitution of the body
			11 મોટી ગાળી, ખીણ	दर्दा, घाटी	pass, valley
			12 ફેર, વટાવ	बट्टा, लाभ की मात्रा, 'मार्जिन'	discount, premium
			13 પેટમાં ગળાઈને જામેલો મળ	आँतों में छनकर जमा हुआ मल	waste matter accumulated in the lower abdomen
			14 સ્ત્રીને પહેરવાનું એક વસ્ત્ર (ગળણા જેવું બારીક)	स्त्रियों का एक बारीक वस्त्र	garment worn by women
ગાગડી	गागडी	સ્ત્રી	નાનો ગાગડો	डली, छोटा टुकड़ा	small bit or piece
ગાગડું	गागडु	વિ	1 ન પલબે અને ન બફાય એવું 2 પલાળવા કે બાફવા છતાં નરમ ન થાય એવો દાણો	जो भीगता नहीं और पकता नहीं ठुरी, ठुड़ी	that cannot be soaked or boiled soft such grain of corn
ગાગડો	गागडो	પુ	1 વસ્તુનો બાબી ગયેલો નક્કર કકડો-કાકરો 2 નહિ ફાટેલું કપાસનું જીડવું	डला कपास की डोडी जो फटी न हो	hard lump unopened cotton-pod
ગાગરવું	गागरवु	સ ક્રિ	બરાડવું (ઊંટનું)	बलबलाना (ऊँट का)	(of camel) to trumpet
ગાગાતલ્લા	गागातल्ला	ન	જુઓ 'ગલ્લાતલ્લા'	देखिए 'गल्लातल्ला'	see 'गल्लातल्ला'
ગાગુ	गागु	વિ	કાગુ, નમાલુ, રાક	दीन, बेशऊर, निकम्मा	worthless, effeminate

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગાજવુ	गाजवु	સક્રિ	1 છેતરવુ, ફોસલાવવુ 2 હરાવવુ	झॉसना, चकमा देना, फुसलाना हराना	to deceive, coax to defeat
ગાજા-કસુ	गाजा-कसु	વિ	ગજેરી	गँजेडी	addicted to smoking 'ganja' or hemp
ગાજાખોર	गाजाखोर	વિ	જુઓ 'ગાજા-કસુ'	गँजेडी	see 'गाजा-कसु'
ગાજાખોરિયુ	गाजाखोरियु	વિ	ગાજાખોર, ગાજા-કસુ	गँजेडी	addicted to 'ganja'
ગાજો	गाजो	પુ	1 એક છોડ અથવા તેની કળી (તેને ચલમમા પીવાથી નશો ચડે છે) 2 બાધો, કદ	गॉज, गठन, कद	Indian hemp or its flower build, size
ગાઠ	गाठ	સ્ત્રી	1 આટીવાળો બધ, ગ્રંથિ 2 ઝાડને જ્યાંથી ડાળા ફૂટે છે તે ભાગ 3 લાકડામાનો ભયરાવાળો ગઠાઈ ગયેલો ભાગ 4 મૂળનો ગઠા જેવો ભાગ (જેને વાવવાથી ફૂટાગો ફૂટે છે) 5 શરીરમા લોહીની બાઝેલી ગોળી 6 એક રોગ, પ્લેગની ગાઠ 7 અટસ, કીનો 8 સપ	गॉठ, गिरह, गुत्थी पेड़ों का जोड़, गिरह भँवरी गॉठ की शकल की जड़ गिलटी, गुत्थी प्लेग की गिलटी कीना, बैर मेल, गठौती	knot joint in a tree where it branches knot in wood tuber tumour bubo malice unity
ગાઠડી	गाठडी	સ્ત્રી	1 ગાસડી 2. ધન, સપત્તિ	गठरी धन, सपत्ति	bale, bundle wealth, property

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગાઠડો	गाठडो	પુ	મોટી ગાઠડી, ગાસડો	बड़ी गठरी	big bundle or bale
ગાઠદાર	गाठदार	વિ	ગાઠવાળુ	गॉठवाला	knotty
ગાઠનુ	गाठनु	વિ	ખાસ પોતાનુ, પદરનુ	गॉठ का, अपना, निजी, खुद का	one's own
ગાઠવુ	गाठवु	સક્રિ	1 મણકા કે એવી વેણવાળી વસ્તુને દોરામા પરોવી ગાઠવાળી એકબીજા સાથે ગૂથવુ	गॉठना	to knit together strings of beads
			2 દોરી, તાર વગેરેને એકબીજા સાથે ગાઠ વાળીને બાધવુ	गॉठ लगाना	to knot and tie together threads
			3 તાબે રહી હુકમ માનવો, બધવુ	बदना, हुकम मानना	to obey
			4 ગાઠે કરવુ, મેળવવુ	मिलना, प्राप्त करना	to secure, gain
ગાઠાળુ	गाठाळु	વિ	ગાઠવાળુ	गॉठदार	having knot
ગાઠિયુ	गाठियु	વિ	જુઓ 'ગાઠાળુ'	गॉठवाला	see 'गाठाळु'
ગાઠિયો	गाठियो	પુ	1 સૂકવેલી હળદરનો કાકરો	हलदी का गट्ठा	dried root of turmeric
			2 ચણાના લોટની એક તળેલી વાની	गॉठिआ	a dish of gram-flour
			3 મોટી ગાઠ	बड़ी गॉठ	big knot
		વિ	ગાઠ સાથે સબધવાળુ	गॉठदार	related to knot
ગાઠી	गाठी	સ્ત્રી	એક ધરેણુ	एक जेवर	kind of necklace
ગાઠે	गाठे	અ	પાસે, કબજામા	गिरह में, कब्जे में	in one's possession

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गाठो	गाठो	पु	भोटी गाठ, पेशा आगणनो भाग	बड़ी गॉठ, पोरों के जोड़ के पास का भाग	knot, joint
गाडध	गाडध	स्त्री	गाडापाण	पागलपन	madness
गाडपाण	गाडपण	स्त्री	जुओ 'गाडध'	पागलपन	see 'गाडध'
गाडाध	गाडाई	स्त्री	गाडध, गाडपाण	पागलपन	madness
गाडियु	गाडियु	वि	गाडु, गाडा जेपु	पागल, पागल-सा	foolish, mad
गाडु	गाडु	वि	1 धेलु, अणसमजु, नादान, मगजनु चसडेलु 2 गाडु अम डे वर्तन 3 बाणमा अवणी चाले डूटी चारवानु रभवु ते	पागल, नासमझ, नादान, सनकी मूर्खता का काम या आचरण (चौसर आदि में) पक जाने पर गोट को उलटी चलाना	crazy, childish, mad foolish act or behaviour (in a game) playing man that moves backward
गाडुतूर	गाडुतूर	वि	छेड गाडु	निरा पागल	utterly mad
गाडरु	गाडरु	न	1 गोडरु, गामना डोर ठीला रडेवानी भागोण पासेनी जगा 2 गामनी भागोण	रहावन सिवान	open space near village border for cattle to stand outskirts of village
गाडरे	गाडरो	पु	जुओ 'गाडरु'	देखिए 'गाडरु'	see 'गाडरु'
गाधियाटु	गाधियाटु	न	1 गाधीनो धधो, गाधीवटु 2 (ला) धधी बापतोनु थोडु थोडु ज्ञान डोपु ते, गाधीवटु गाधीवटो 3 (ला) धधेजसेण	पसारी का पेशा सभी बातों का थोडा-थोडा ज्ञान होना अस्पष्टता	grocer's trade having some knowledge of every thing confusion

श्री शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गाध्याण	गाधियाणु	न	જુઓ 'गाधीयाटु'	देखिए 'गाधीयाटु'	see 'गाधीयाटु'
गायजण	गायजण	स्त्री	વાળદની સ્ત્રી, વાળદણ, गायण	नाइन	barber's wife
गायजी	गायजी	स्त्री	વાળદણ, ગાયજણ	नाइन	barber's wife
गायजो	गायजो	पु	વાળદ	नाई	barber
गासडी	गासडी	स्त्री	અનેક વસ્તુ એકઠી બાધી ઢેલો બોળો, પોટલી	गठरी	bundle of things bound together, bale of cotton
गिदरडु	गिदरडु	न	દેટાનુ બચ્ચુ	भेड का बच्चा	lamb
गिद्वड	गिद्वड	वि.	1 સુસ્ત, ભારે (ધારણ ખાધાથી) 2 શિયાળ	सुस्त, आलसी गोदड	lethargic, heavy (owing to over eating) jackal
गिन्नावु	गिन्नावु	अ क्रि	1 (પતંગનુ)એક બાજુ નમતુ—ઢરાતુ રહેવુ 2 રિસાવુ	कन्नी खाना, कनियाना स्थना, नाराज होना	(of kite) to bend or slant on one side to be displeased
गिरदी	गिरदी	स्त्री	ભીડ	भीड	crowd, crowding
गिरदो	गिरदो	पु	નીચે ઠરેલો કે રહેલો કચરો	खूद, निथार	residue, dregs
गिरफतार	गिरफतार	वि	1 પકડાયેલુ 2 તલ્લીન	गिरफतार तल्लीन	arrested absorbed, engrossed
गिरमीट	गिरमीट	स्त्री	હિંદ બહાર સસ્થાનોમા મજૂરી માટે લઈ જવાતા મજૂરો પાસે કરાવી લેવાતુ કરારપત્ર	गिरमितियों का करारनामा	agreement made with the persons who wanted to go out of India to work in the British colonies as labourers

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		ન	છેદ પાડવાનું એક ઓળ્હર, સારડી	બરમા	drill
ગિરવી	ગિરવી	અ	જુઓ 'ગીરવી'	દેખિય 'ગીરવી'	see 'ગીરવી'
ગિરો	ગિરો	અ	ગીરવી	ગિરવી	pawned, mortgaged
		પુ	ગીરવવુ તે, દેવા પેટે આડમા કાઈ મૂકવુ તે	ગિરો, બધક, ગિરવી	mortgage
ગિલ્લી	ગિલ્લી	સ્ત્રી	1 મોઈ	ગુલ્લી, ગિલ્લી	short piece of wood used in the game of tip-cat
			2 ગડગૂમડ કે બીજા દરદને લીધે આવતો સોળો, વેળ	સૂજન, ગિલટી	swelling caused by tumour etc
ગિલ્લેમાર	ગિલ્લેમાર	ન	એક પક્ષી	એક પક્ષી	booted eagle
ગિલ્લો	ગિલ્લો	પુ	આક્ષેપ, આળ, નિંદા	આક્ષેપ, નિંદા, કલક	accusation, slander
ગીગી	ગીગી	સ્ત્રી	નાની છોકરી, કીકી	છોટી લડકી, મુન્ની, બચ્ચી	small girl
ગીગો	ગીગો	પુ	નાનો છોકરો, કીકો	છોટા લડકા, મુન્ના, બચ્ચા	small boy
ગીચ	ગીચ	વિ	પાસે પાસે સડકાઈને આવી રહેલુ	ઘના	crowded, thick
ગીત	ગીત	ન	1 ગાયન 2 અવસર પર ગાવાતુ ગાણુ	ગીત, ગાયન વિશેષ અવસર પર ગાયા જાને વાલા ગાના	song song sung on a particular occasion
ગીધ	ગીધ	ન	એક મોટું માસાહારી પક્ષી	ગીધ	vulture

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગીની	ગીની	સ્ત્રી	ગિની, સોનાનો એક બ્રિટિશ સિક્કો	ગિની, ગિન્ની	guinea, a British coin
ગીરણી	ગીરણી	સ્ત્રી	ચત્રથી ચાલતું કારખાનું, મિલ	મિલ	factory, mill
ગીરવવું	ગીરવવું	સ ક્રિ	ગીરો-ઘરેણે મૂકવું	ગિરવી રખના	to mortgage
ગીરવી	ગીરવી	અ	ગીરવેલું, ઘરેણે	ગિરવી રખા हुआ	mortgaged
ગીરો	ગીરો	અ પુ	ગીરવી ગીરવવું તે, દેવા પેટે આડમા કાઈ મૂકવું તે	ગિરવી ગિરો, બધક, ગિરવી	mortgaged mortgage, pawn
ગીસ	ગીસ	સ્ત્રી	ચોરી	ચોરી	theft, stealing
ગુચપુચ	ગુચપુચ	અ	1 ગુસપુસ, છાની રીતે, કોઈ સાબળી ન જાય એમ 2 એકમેકમા ગૂંચવાતું ગયેલું હોય તેમ, અસ્પષ્ટ (લખાણ)	ફુસફુસ, ચુપકે ચુપકે ગિચપિચ, અસ્પષ્ટ	in whisper, secretly (of writing) confused, complicated
ગુચપુચિયું	ગુચપુચિયું	સ્ત્રી	એમ કરેલી વાત	ફુસફુસ	private talk
ગુચપુચિયું	ગુચપુચિયું	વિ	અસ્પષ્ટ, ગુચપુચ હોય એવું	ગિચપિચ	confused, indistinct
ગુચપુછ	ગુચપુછ	અ	જુઓ 'ગુચપુચ'	દેખિય 'ગુચપુચ'	see 'ગુચપુચ'
ગુજરવું	ગુજરવું	અ ક્રિ	1 જવું, વહી જવું 2 વીતવું, માથે આવી પડવું 3 જતું કરવું, દરગુજર કરવું	ગુજરના બીતના, આ પડના જાને દેના, માફ કરના	to go, to carry to befall, to fall on to let go
ગુજારવું	ગુજારવું	સ ક્રિ	1 નિર્ગમન કરવું, ગાળવું 2 રજૂ કરવું, દાદ માગવી	ગુજારના, બિતાના ગુજારિશ કરના, દાદ મોંગના, ન્યાય મોંગના	to pass, to spend to pray, to seek redress of grievance

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૩ માથે નાખવું, વિતાડવું	સિર પર ડાલના, દુખ દેના	to throw (responsibility) on, to cause to suffer
ગુજારો	ગુજારો	પુ	નિર્વાહ, નિભાવ, ગુજરાન	ગુજારા, ગુજર, નિર્વાહ	maintenance
ગુટકો	ગુટકો	પુ	ઘણી ઓછી લખાઈ પહોળાઈની જાડી ચોપડી	ગુટકા (પુસ્તક)	small book
ગુટપુટ	ગુટપુટ	અ	બરોબર ઓઢી કરીને (સૂવા માટે), ગોટપોટ	झुरमुट मारकर, बराबर लपेटकर	having amply covered oneself (for sleeping)
ગુટપુટ	ગુટપુટ	અ	જુઓ 'ગુટપુટ'	देखिए 'गुटपुट'	see 'गुटपुट'
ગુટીમાર	ગુટીમાર	ન	એક પક્ષી	एक पक्षी	kind of bird
ગુણ	गुण	પુ	૧ જાતિ-સ્વભાવ, મૂળ લક્ષણ, ધર્મ ૨ સદ્ગુણ ૩ પ્રકૃતિના ત્રણ ધર્મ-સત્ત્વ, રજઃ, તમ- તે ૪ ત્રણની સખ્યા ૫ અસર, ફાયદો ૬ ઉપકાર ૭ પાણી ૮ દોરી, દોરો, દોરડું ૯ દોકડો, 'માર્ક' ૧૦ સ્વરોના બે ફેરફાર- ગુણવૃદ્ધિમાનો પ્રથમ	गुण, जाति-स्वभाव, मूल लक्षण सद्गुण प्राकृतिक तीन गुण	nature, innate quality virtue any of the three properties of nature Satvas, Rajas, Tamas three effect, benefit obligation bow-string string, rope mark kind of change in vowel
ગુણવું	गुणवु	સ ક્રિ	એક સખ્યાને બીજી સખ્યા જેટલી વાર વધારવી	गुणा करना	to multiply

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગુણાકર	ગુણાકાર	પુ	1 ગુણવુ તે 2 એથી આવતી રકમ	ગુણા, ગુણન ગુણનફલ	multiplication multiplication result
ગુણિયલ	ગુણિયલ	વિ	સદ્ગુણી	સદ્ગુણી, ગુણાદ્ય	virtuous
ગુણી	ગુણી	વિ પુ	સદ્ગુણી 1 ગુણવાન પુરુષ 2 કલાકોવિદ 3 જાતરમતર જાણનાર	સદ્ગુણી ગુણવાન પુરુષ કલાકોવિદ જાતર-મતર યા જાદૂ-ટોના કરને વાલા	virtuous virtuous man one skilled in fine arts magician
ગુનેઆર	ગુનેગાર	વિ	ગુનો કરનારુ, અપરાધી	ગુનહગાર, અપરાધી	offender, criminal, guilty
ગુનેઆરી	ગુનેગારી	સ્ત્રી	ગુનેગારપણ	ગુનહગારી, અપરાધ	guiltiness, crime
ગુનો	ગુનો	પુ	અપરાધ, વાક, તકસીર	ગુનાહ, અપરાધ, જુર્મ	offence, crime
ગુપચુપ	ગુપચુપ	અ	ચુપચાપ, ધનુમાનુ	ગુપ-ચુપ, ચુપચાપ	stealthily, quietly
ગુફા	ગુફા	સ્ત્રી	પહાડની બખોલ-ઊંડુ કોતર, ગુહા	ગુફા, કદરા	cave, deep ravine
ગુફ્તગો	ગુફતગો	સ્ત્રી	વાતચીત, મસલત, ગૂંજ	ગુફતગૂ, બાતચીત	secret conversation or consultation
ગુફ્તેગો	ગુફતેગો	સ્ત્રી	જુઓ 'ગુફ્તગો'	દેખિયે 'ગુફ્તગો'	see 'ગુફ્તગો'
ગુબારો	ગુબારો	પુ	1 નાનુ બલૂન 2 હવાઈ, હવામા ઊંચે ફૂટે એવું એક જાતનું દાણખાનું	ગુબ્બારા હવાઈ આતિશબાજી	small balloon rocket, kind of firework

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गुम	गुम	वि	जोवाथेलु	गुम, लापता	lost
गुमसूम	गुमसूम	अ	सूमसाम, गुपथुप	गुमसुम, स्तब्ध	quietly
गुमान	गुमान	न	अभिमान, अर्ध	गुमान	pride, arrogance
गुमाववु	गुमाववु	स क्रि	1 जोवु 2 धूणधारणी करवु, उडावी देवु	गँवाना नष्ट करना, उडा देना	to lose to squander away
गुमास्तागीरी	गुमास्तागीरी	स्त्री	गुमास्तानु आम, महेतागीरी	गुमाश्तागीरी	position or function of an agent, clerkship
गुमास्ती	गुमास्ती	स्त्री	अरकूनी, महेतागीरी, गुमास्तागीरी	कारकुनी, गुमाश्ते का काम, क्लर्क का काम	clerkship
गुमास्तो	गुमास्तो	पु	अरकून, महेतो	गुमाश्ता, कर्मचारी	clerk, agent
गुम्भो	गुम्भो	पु	मुक्की	घँसा, मुक्का	blow with the fist
गुरजो	गुरखो	पु	नेपाल देशनो पतनी	गोरखा	Gurkha, native of Nepal
गुरदो	गुरदो	पु	1 गुरज, लोढानो मगदण 2 मूत्रपिड, 'किडनी'	लोहे का मुद्गर गुरदा, 'किडनी'	mace, club kidney
गुरु	गुरु	वि	1 भोटु 2 भारे 3 दीर्घ	बडा, महान भारी, वजनदार दीर्घ, गुरु	big, great heavy long (of vowel in gram)
		पु	1 शिक्षक 2 पुरोहित, गोर 3 अे नामनो ग्रह, बृहस्पति	शिक्षक पुरोहित बृहस्पति (ग्रह)	teacher priest the planet Jupiter

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			4 ગુરુવાર	ગુરુવાર, ગુરુ	Thursday
ગુરુકુલ	ગુરુકુલ	ન	1 ગુરુને રહેવાનુ ઠેકાણુ, જ્યા વિદ્યાર્થીઓને રાખીને તે શિક્ષણ આપે છે 2 તે પદ્ધતિને અનુસરતી શિક્ષણ સસ્થા	ગુરુ કા વાસસ્થાન, ગુરુકુલ વિદ્યાપીઠ, ગુરુકુલ	abode of a 'guru' where students live and learn kind of residential university following this tradition
ગુરુકુળ	ગુરુકુલ	ન	જુઓ 'ગુરુકુલ'	દેખિય 'ગુરુકુલ'	see 'ગુરુકુલ'
ગુરુતા	ગુરુતા	સ્ત્રી	1 ગુરુપણ 2 મોટાઈ, ગૌરવ 3 ભારેપણ	ગુરુપન બડાઈ, ગૌરવ, ગુરુતા ભારીપન	quality of being a teacher greatness heaviness
ગુરુત્વ	ગુરુત્વ	ન	જુઓ 'ગુરુતા'	દેખિય 'ગુરુતા'	see 'ગુરુતા'
ગુરુત્વકેન્દ્ર	ગુરુત્વકેન્દ્ર	ન	બિંદુશી વજનનુ સમતોલપણ થતુ હોય તે, 'સે-ટર આંક ગ્રેવિટી'	ગુરુત્વકેન્દ્ર	centre of gravity
ગુરુત્વમધ્યબિંદુ	ગુરુત્વમધ્યબિંદુ	ન	જુઓ 'ગુરુત્વકેન્દ્ર'	દેખિય 'ગુરુત્વકેન્દ્ર'	see 'ગુરુત્વકેન્દ્ર'
ગુરુત્વરેખા	ગુરુત્વરેખા	સ્ત્રી	ગુરુત્વકેન્દ્રના આકર્ષણની લીટી યા દિશારેખા	ગુરુત્વરેખા	line or direction of gravitation
ગુરુત્વરેષા	ગુરુત્વરેષા	સ્ત્રી	જુઓ 'ગુરુત્વરેખા'	દેખિય 'ગુરુત્વરેખા'	see 'ગુરુત્વરેખા'
ગુરુત્વાકર્ષણ	ગુરુત્વાકર્ષણ	ન	ભારનુ પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચાવુ તે, 'ગ્રેવિટેશન'	ગુરુત્વાકર્ષણ	gravitation
ગુરુભાઈ	ગુરુભાઈ	પુ	ગુરુબધુ	ગુરુભાઈ	fellow student

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गुरुमंत्र	गुरुमंत्र	पु	1. गुरुअे आपेलो मंत्र 2. (ला) ढ्खूपी सलाड, शिआमारी	गुरुमंत्र गुप्त सलाह, उपदेश	mantra or sacred formula prescribed by the guru secret advice, instigation
गुरुरेखा	गुरुरेखा	स्त्री	भारेरेखा (-) आयु विरामचिह्न	विरामचिह्न (-)	punctuation mark as shown in the bracket (-)
गुल	गुल	न	1. डूल 2. गुलाबनु डूल 3. (ला) बत्ती उपरनो बनेलो भाग, भोगरो	फूल, गुल गुलाब का फूल बत्ती का गुल	flower rose snuff of lamp or candle
गुलछडी	गुलछडी	स्त्री	1. अेड डूलआड 2. तेनु डूल 3. गुलाबनो गोटे 4. अेड धरेणु	फूलों का एक पौधा उसका फूल, गुलछडी गुलाब का गुच्छा एक गहना	kind of flowering plant its flower bouquet of roses an ornament
गुलभर	गुलजार	पु वि	गुलाबनी वाडी, डूलवाडी भनोडर, सुडर	फुलवारी, गुलाबवाडी गुलजार, रम्य	rose garden, flower garden beautiful
गुलआर	गलझार	वि	जुओ 'गुलभर'	देखिए 'गुलभर'	see 'गुलभर'
गुलतान	गुलतान	वि	भशगूल, तल्लिन	मशगूल, तल्लिन	engrossed, absorbed
गुलतोरो	गुलतोरो	पु	1. गुलाबनो गोटे-गजरो	गुलाब का गुच्छा, गजरा	bouquet of roses

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 अेउ डूलआड	फूलों का एक पौधा	kind of flowering plant
गुलदस्त	गुलदस्त	पु	डूलनो गोटेन्तोरे	गुलदस्ता	bouquet of flowers
गुलनार	गुलनार	न	दडड	अनार	pomegranate
गुलअध्री	गुलबकी	पु	अेउ एए	एक छद	a metre (poet)
गुलभोर	गुलमोर	स्त्री	1 अेउ डूलआड	गुलमोहर	kind of flowering tree
			2 तेनु डूल	गुलमोहर का फूल	its flower
गुलशाम	गुलशाम	न	अेउ वनस्पति	एक वनस्पति	kind of a plant
गुलबी	गुलबी	स्त्री	अेउ वनस्पति	एक वनस्पति	kind of a plant
गुलाब	गुलाब	न	1 अेउ डूलआड	गुलाब (पौधा)	rose plant
			2 तेनु डूल	गुलाब (फूल)	rose
गुलाबजळ	गुलाबजळ	न	गुलाबनी षुशओवाणु पारणी	गुलाब, गुलाबजल	rose-water
गुलाबजबु	गुलाबजाबु	न	अेउ मीठाड	गुलाबजामुन	kind of sweetmeat
गुलाबदान	गुलाबदान	न	गुलाबजळ छाटवानी शिशेडना आडरनी आरी	गुलाबपाश, दमकला	rose-water holder with holes for sprinkling
गुलाबदानी	गुलाबदानी	स्त्री	जुओ 'गुलाबदान'	देखिए 'गुलाबदान'	see 'गुलाबदान'
गुलाबी	गुलाबी	वि	1 गुलाबना रगनु	गुलाब के रग का, गुलाबी	of rose colour, rosy
			2 मीठु, मजेदार (उध, स्वभाव)	मजेदार, हलका (नींद, जाडा)	sweet
		स्त्री	गुलाबना जेवो रतो रग	लाल रग, गुलाबी	red colour, rose colour

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગુલાબી મેના	ગુલાબી મેના	સ્ત્રી	એક પક્ષી	एक पक्षी	kind of myna
ગુલાલ	गुलाल	પુ, ન	એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂંડો	गुलाल, अबीर	slightly fragrant red powder (used on occasions of joy)
ગુલાટ	गुलाट	સ્ત્રી	1 ગોટીમડુ 2 (લા) ઊલટુ ફરી જવુ તે	कलाबाजी पलटा खाना	somersault recant
ગુલ્લુ	गुल्लु	ન	પાપડની કણકનો લૂઓ, ગૂલરુ	(पापड की) लोई	lump of kneaded flour esp prepared for making 'papad'
ગુવાર	गुवार	પુ	1 ગવાર, એક વનસ્પતિ 2 તેની શીંગ અને બીજ	ग्वार ग्वारफली, ग्वार	vetch its pod and seed
ગુવારફળી	गुवारफळी	સ્ત્રી	ગવારની સીંગ	ग्वारफली	vetch pod
ગુવારશિંગ	गुवारशिंग	સ્ત્રી	ગવારફળી, ગવારની સીંગ	ग्वारफली	vetch pod
ગુસપસ	गुसपस	સ્ત્રી	ગુથપુથ, છાની વાત, મસલત	फुसफुस, कानाफूसी	silent, whispering conversation
ગુસલ	गुसल	ન	સ્નાન	स्नान, गुस्ल	bath
ગુસલખાનુ	गुसलखानु	ન	નાહવાની ઓરડી	गुस्लखाना	bath, bath-room
ગુસ્લ	गुस्ल	ન	જુઓ 'ગુસલ'	गुस्ल, स्नान	see 'गुसल'
ગુસ્સો	गुस्सो	પુ	ક્રોધ	गुस्सा, क्रोध	anger
ગુજ	गुज	ન	1 ગણગણાટ 2 છૂપી વાત, ભેદ	गुनगुनाहट रहस्य, गुप्तबात, भेद	buzzing, humming secret information, secret

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		સ્ત્રી	1 ગુળા	ગુજા	small plant with red and black berries
			2 ગાઠ, ગૂચ, આટી	ગુત્થી, ઉલઝન	knot, tie
ગુજવુ	ગુજવુ	અક્રિ	ગણગણવુ, ગુળાર કરવો	ગૂજના	to hum, to buz
ગુળાફલ	ગુજાફલ	ન	થનોઠી	ઘુંઘચી, ગુજાફલ	fruit of ગુળા plant
ગુળાફળ	ગુજાફલ	ન	જુઓ 'ગુળાફલ'	ગુજાફલ	see 'ગુળાફલ'
ગુળાશ	ગુજાશ	સ્ત્રી	ગળુ, તાકાત	ગુજાઇશ, હૈસિયત, બૂતા, ક્ષમતા	capacity, ability
ગુઠો	ગુઠો	પુ	જમીનનુ એક માપ (એકરનો ૪૦ મો ભાગ ૧૧ x ૧૧ ચોરસ વાર)	બિસ્વા	fortieth part of acre (121 sq yds)
ગુડ	ગુડ	વિ, પુ	જુઓ 'ગુડો'	દેખિય 'ગુડો'	see 'ગુડો'
ગુડો	ગુડો	વિ	જબરદસ્તીના કામ કરનારુ, બદમાશ, દાડ	ગુડા, બદમાશ	roguish
		પુ	એવો આદમી	ગુડા (આદમી)	rogue, ruffian
ગુદ	ગુદ	પુ	1 કેટલાક ઝાડમાથી ઝરતો ચીકણો રસ	ગોંદ, નિર્યાસ	gum
			2 ચોટાડવાના કામમા આવતો તેવો બાવળનો રસ	બબૂલ કા ગોંદ	glue prepared from it
ગુદર	ગુદર	પુ	જુઓ 'ગુદ'	ગોંદ	see 'ગુદ'
ગુદરપાક	ગુદરપાક	પુ	1 ગુદર ભેળવીને બનાવેલુ વસાણુ	ગોંદ મિલાકર બનાયા ગયા , પૌષ્ટિક ખાદ્ય	kind of tonic preparation made from gum, ghee, sugar etc

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગુલાબી મેના	ગુલાબી મેના	સ્ત્રી	એક પક્ષી	एक पक्षी	kind of myna
ગુલાલ	गुलाल	પુ, ન	એક રાતા રંગનો સહેજ સુગંધીદાર ભૂકો	गुलाल, अबीर	slightly fragrant red powder (used on occasions of joy)
ગુલાટ	गुलाट	સ્ત્રી	1 ગોટીમડુ 2 (લા) ઊલટુ ફરી જવુ તે	कलाबाजी पलटा खाना	somersault recant
ગુલ્લુ	गुल्लु	ન	પાપડની કણકનો લૂઓ, ગૂલરુ	(पापड की) लोई	lump of kneaded flour esp prepared for making 'papad'
ગુવાર	गुवार	પુ	1 ગવાર, એક વનસ્પતિ 2 તેની સીંગ અને બીજ	ग्वार ग्वारफली, ग्वार	vetch its pod and seed
ગુવારફળી	गुवारफळी	સ્ત્રી	ગવારની સીંગ	ग्वारफली	vetch pod
ગુવારશિંગ	गुवारशिंग	સ્ત્રી	ગવારફળી, ગવારની સીંગ	ग्वारफली	vetch pod
ગુસપસ	गुसपुस	સ્ત્રી	ગુથપુથ, છાની વાત, મસલત	फुसफुस, कानाफूसी	silent, whispering conversation
ગુસલ	गुसल	ન	સ્નાન	स्नान, गुस्ल	bath
ગુસલખાનુ	गुसलखानु	ન	નાહવાની ઓરડી	गुस्लखाना	bath, bath-room
ગુસ્લ	गुस्ल	ન	જુઓ 'ગુસલ'	गुस्ल, स्नान	see 'गुसल'
ગુસ્સો	गुस्सो	પુ	ક્રોધ	गुस्सा, क्रोध	anger
ગુજ	गुज	ન	1 ગણગણાટ 2 છૂપી વાત, ભેદ	गुनगुनाहट रहस्य, गुप्तबात, भेद	buzzing, humming secret information, secret

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		स्त्री	1. गुण	गुजा	small plant with red and black berries
			2. गाठ, गूथ, आटी	गुथी, उलझन	knot, tie
गुण्यु	गुजवु	अ क्रि	गाणगाणवु, गुणर करवो	गूजना	to hum, to buz
गुणइल	गुजाफल	न	थनोठी	घुँघची, गुजाफल	fruit of गुण plant
गुणइण	गुजाफळ	न	गुओ 'गुणइल'	गुजाफल	see 'गुणइल'
गुणश	गुजाश	स्त्री	गणु, ताअत	गुजाइश, हैसियत, बूता, क्षमता	capacity, ability
गुठी	गुठी	पु	गमीननु अेक माप (अेकरनो ४० मो भाग ११ × ११ चोरस वार)	बिस्वा	fortieth part of acre (121 sq yds)
गुड	गुड	वि, पु	गुओ 'गुडो'	देखिए 'गुडो'	see 'गुडो'
गुडो	गुडो	वि	गुपरदस्तीना डाम करनारु, अदमाश, दस	गुडा, बदमाश	roguish
		पु	अेवो आदमी	गुडा (आदमी)	rogue, ruffian
गुद	गुद	पु	1. केटलाड आडमाथी अरतो चीअणो रस 2. चोटाडवाना डाममा आपतो तेवो आपणनो रस	गोंद, निर्यास बबूल का गोंद	gum glue prepared from it
गुदर	गुदर	पु	गुओ 'गुद'	गोंद	see 'गुद'
गुदरपाक	गुदरपाक	पु	1. गुदर भेणवीने अनावेलु वसाण	गोंद मिलाकर बनाया गया पौष्टिक खाद्य	kind of tonic preparation made from gum, ghee, sugar etc

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 એક મીઠાઈ	एक मिठाई	kind of sweetmeat
			3 (લા) માર	मार	beating
गुदरियु	गुदरियु	न	1 પલાળેલો ગુદર રાખવાનું પાત્ર 2 લકરું, કટાળો આવે તોય ન ખસે એવું —ચોટણવૃત્તિનું મારણસ	भीगा हुआ गोंद रखने का बरतन जिससे हम ऊब जाते हैं वैसा मनुष्य, चीटकु	pot to hold glue boring, bothersome person
गुदियु	गुदियु	न	गुदरनु पात्र, गुदरियु	गोंद का पात्र	pot for keeping glue
गुब्ज	गुब्ज	पु	धूमट	गुब्ज	dome
गू	गू	न	વિષ્ટા, મળ	गू, मैला	excrement, faeces
गूगण	गूगळ	पु	એક ડુગરી ઝાડનો ગુદર તે દવાના તેમ જ ધૂપ કરવાના કામમાં આવે છે	गूगल, गुगुल	kind of fragrant gum (used as incense and medicine)
गूज	गूज	સ્ત્રી	1 ગુપ્ત વાત, રહસ્ય 2 બે બાજુ અણીવાળો (પાટિયા જોડવાનો) ખીલો	गुप्त बात, रहस्य कीली	secret, private matter double-pointed nail
गूळ	गूळ	वि	गुध, गुप्त	गुह्य, गुप्त	secret, hidden
गूढ	गूढ	वि	જુઓ 'ગૂજ'	देखिए 'गूज'	see 'गूज'
		वि	1 ગુધ, છાનું 2 ન સમજાય એવું, ગહન	गूढ, गुप्त, गुह्य समझने में कठिन, गहन	secret, concealed incomprehensible

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			३ छद्रियातीत, 'मिस्टक'	इन्द्रियातीत, गूढ	beyond the senses, mystic
गूण	गूण	स्त्री	1 शेलो, ओशणो 2 छालकु 3 चार मणु भाप	थैला, बोरा गोन चार मन की नाप	sack, gunny bag pannier measure of four maunds
गूणियु	गूणियु	न	गूणमाटनो बनावेलो शेलो	पटसन का बोरा	gunny bag
गूणियो	गूणियो	पु	1 ताबानो घडो 2 शेलो, गूण 3 अमुक वजननु भाप 4 डाटभूणो (कारीगरनो)	तौबे का घडा थैला, गोनी अमुक वजन की नाप गोनिया (कारीगर का आला)	water pot made of copper big bag, gunny bag a specific measure of weight carpenter's square or right-angle
गूणशतश	गूजरातण	स्त्री	गूणशतनी श्छेवासी स्त्री	गुजराती स्त्री	woman of Gujarat
गूणशती	गूजराती	वि	गूणशतनु, —ने लगतु	गुजरात का, गुजराती	of or pertaining to Gujarat
		स्त्री	गूणशती भाषा	गुजराती (भाषा)	Gujarati language
		पु	गूणशतनो श्छेवासी	गुजरात में बसने वाला, गुजराती	native of Gujarat
गूडलु	गूडलु	न	गूडलु	(पापड की) लोई	see 'गूडलु'
गूडो	गूडो	पु	1 पगनो नणो 2 (ला)भण, शक्ति, छाण	नला (पैर का) बल, शक्ति	shin strength, power

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गूमड	गूमड	न	शरीरे ठीठतो शेल्लो- टेटा जेपो गक्षे	फोडा	boil, abscess
गूमडु	गूमडु	न	જુઓ 'ગૂમડ'	देखिए 'गूमड'	see 'गूमड'
गूमूतर	गूमूतर	न	મળમૂત્ર	गू-मूत, मलमूत्र	excreta and urine
गूलर	गूलर	न	1 गुल्लर, ठमरडो 2 ठमरडु 3 डाननु अेक धरेणु	गूलर, उदुबर गूलर (फल) कान का एक गहना	kind of fig tree fig kind of ear- ornament
गूलरु	गूलरु	न	1 पापडनो लूओ 2 જુઓ 'ગૂલર' 3 ઘોડિયે લટકાવવાનુ લાકડાનુ અેક રમકડુ	(पापड की) लोई देखिए 'गूलर' पालने का एक खिलौना	lump of kneaded flour for making 'papad' see 'गूलर' toy hung over child's cradle
गूलु	गूलु	न	अेक पक्षी	एक पक्षी	kind of bird
गूगणु	गूगणु	वि	નાકમાથી બોલતુ	नाक में से बोलने वाली	speaking with nasal twang
गूगणामण	गूगळामण	न, स्त्री	ગૂગળાવુ તે	दम घुटना	suffocation
गूगणववु	गूगळववु	स क्रि	'ગૂગળાવુ'નુ પ્રેરક	घोटना (दम)	caus of 'गूगणववु'
गूगणवु	गूगळवु	अ क्रि	હવાની ખોટ કે અટકાયતન લીધે અમૂઝાવુ, શ્વાસ રૂધાવો	घुटना, सॉस रूधना	to be suffocated, to be confused
गूगुं	गूगु	वि	1 નાકમાથી બોલતુ, ગૂગણુ 2 મૂગુ	नाक में से बोलना गूगा, मूक	speaking with nasal twang dumb

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		न	नाङना मणनो बधाए गथेलेो पोपडो	गुजी, नाक का सूखा मैल	crust of dried mucus in nose
गूगो	गूगो	पु	1 (नाङमानु)गूगु 2 अेङ जतनो णवडो	गुजी, नकटी एक प्रकार का कीडा	dried mucus in nose kind of insect
गूथ	गूच	स्त्री	1 गठाए जपु ते 2 आटीधूटी, मुशुकेली	गुत्थी उलझन, मुश्किल, पेचीदा बात	knot intricate business, difficulty
गूथवण	गूचवण	स्त्री	1 गूथाए जपु ते 2 जेभाथी उकेले अठवो मुशुकेले थए पडे अेवी परिस्थिति	उलझन असमजस, उलझन	puzzle, muddle intricate, difficult situation
गूथवणियु	गूचवणियु	वि	गूथवणवाणु	उलझन वाला	intricate, difficult
गूथवण्णी	गूचवणी	स्त्री	जुओ 'गूथवण'	देखिए 'गूथवण'	see 'गूथवण'
गूथववु	गूचववु	स क्रि	गूथवणभा नाजपु	उलझाना, फँसाना	to complicate, confuse
गूथवाडियु	गूचवाडियु	वि	गूथवाडावाणु	पेचीदा, टेढ़ा	complicated
गूथवावु	गूचवावु	अ क्रि	1 गठावु (दोरा पगेरेनु) 2 (ला)सपडावु, उकेले न सूऊवो 3 (ला)मूआवु, गभरावु	उलझना (डोरों आदि का) हल न पाना, फँसाना घबराना	to be knotted (of thread etc) to be caught or trapped to be confused, be puzzled
गूथावु	गूचावु	अ क्रि	जुओ 'गूथवावु'	देखिए 'गूथवावु'	see 'गूथवावु'
गूध्रणियाणु	गूध्रणियाळु	वि	गूध्रणीवाणु	लच्छीदार	entangled mass

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગૂમડ	ગૂમડ	ન	શરીરે ઊઠતો ફોલ્લો- ટેટા જેવો ગઠ્ઠો	ફોડા	boil, abscess
ગૂમડુ	ગૂમડુ	ન	જુઓ 'ગૂમડ'	દેખિય 'ગૂમડ'	see 'ગૂમડ'
ગૂમૂતર	ગૂમૂતર	ન	મળમૂત્ર	ગૂ-મૂત, મલમૂત્ર	excreta and urine
ગૂલર	ગૂલર	ન	1 ગુલ્લર, ઊમરડો 2 ઊમરડુ 3 કાનનુ એક ઘરેણુ	ગૂલર, ઉદુબર ગૂલર (ફલ) કાન કા એક ગહના	kind of fig tree fig kind of ear- ornament
ગૂલરુ	ગૂલરુ	ન	1 પાપડનો લૂઓ 2 જુઓ 'ગૂલર' 3 ઘોડિયે લટકાવવાનુ લાકડાનુ એક રમકડુ	(પાપડ કી) લોઈ દેખિય 'ગૂલર' પાલને કા એક ખિલૌના	lump of kneaded flour for making 'papad' see 'ગૂલર' toy hung over child's cradle
ગૂલુ	ગૂલુ	ન	એક પક્ષી	એક પક્ષી	kind of bird
ગૂગણ	ગૂગણુ	વિ	નાકમાથી બોલતુ	નાક મેં સે બોલને વાલી	speaking with nasal twang
ગૂગળામણ	ગૂગળામણ	ન, સ્ત્રી	ગૂગળાવુ તે	દમ ઘુટના	suffocation
ગૂગળાવવુ	ગૂગળાવવુ	સક્રિ	'ગૂગળાવુ'નુ પ્રેરક	ઘોંટના (દમ)	caus of 'ગૂગળાવુ'
ગૂગળાવુ	ગૂગળાવુ	અક્રિ	હવાની ખોટ કે અટકાયતન લીધે અમૂઝાવુ, શ્વાસ રુધાવો	ઘુટના, સોંસ રુધના	to be suffocated, to be confused
ગૂગુ	ગૂગુ	વિ	1 નાકમાથી બોલતુ, ગૂગણ 2 મૂગુ	નાક મેં સે બોલના ગૂગા, મૂક	speaking with nasal twang dumb

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		ન	નાકના મળનો બધાઈ ગયેલો પોપડો	ગુજી, નાક કા સૂઝા મૈલ	crust of dried mucus in nose
ગૂગો	गूगो	પુ	1. (નાકમાનુ)ગૂગુ 2. એક જાતનો જીવડો	ગુજી, નકટી एक प्रकार का कीड़ा	dried mucus in nose kind of insect
ગૂથ	गूच	સ્ત્રી	1. ગઠાઈ જયુ તે 2. આટીઘૂટી, મુશ્કેલી	ગુત્થી उलझन, मुश्किल, पेचीदा बात	knot intricate business, difficulty
ગૂથવાણ	गूचवण	સ્ત્રી	1. ગૂથાઈ જયુ તે 2. જેમાથી ઉકેલ કઢવો મુશ્કેલ થઈ પડે એવી પરિસ્થિતિ	उलझन असमजस, उलझन	puzzle, muddle intricate, difficult situation
ગૂથવાણિયુ	गूचवणियु	વિ	ગૂથવાણવાળુ	उलझन वाला	intricate, difficult
ગૂથવાણી	गूचवणी	સ્ત્રી	જુઓ 'ગૂથવાણ'	देखिए 'गूचवण'	see 'गूचवण'
ગૂથવવુ	गूचववु	સ ક્રિ	ગૂથવાણમા નાખવુ	उलझाना, फँसाना	to complicate, confuse
ગૂથવાડિયુ	गूचवाडियु	વિ	ગૂથવાડાવાળુ	पेचीदा, टेढा	complicated
ગૂથવાવુ	गूचवावु	અ ક્રિ	1. ગઠાવુ (દોરા વગેરેનુ) 2. (લા) મસડાવુ, ઉકેલ ન સૂઝવો 3. (લા) મૂઝાવુ, ગભરાવુ	उलझना (डोरों आदि का) हल न पाना, फँसाना घबराना	to be knotted (of thread etc) to be caught or trapped to be confused, be puzzled
ગૂથાવુ	गूचावु	અ ક્રિ	જુઓ 'ગૂથવાવુ'	देखिए 'गूचवावु'	see 'गूचवावु'
ગૂઠ્ઠાવાળુ	गूठ्ठियाळु	વિ	ગૂઠ્ઠાવાળુ	लच्छीदार	entangled mass

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गूछणी	गूछळी	स्त्री	दोरानी अटेरीने डरेली आटी डे गोणो	लच्छी, अटी	skein of thread
गूछणु	गूछळु	न	गोण आशरमा वणेळु डे वीटेळु छोय ते	गेडली	thread wound in a ball
गूञ्ज्यु	गूजियु	न	1 गूञ्जु 2 धुमातो देवता	जेव धूँँ वाली अग्नि	pocket smouldering fire
गूञ्जु	गूजु	न	गूञ्जु	जेव	pocket
गूञ्जु	गूजु	न	गूञ्जु	जेव	see 'गूञ्जु'
गूशर	गूथण	न	1 गूशरु ते 2 गूशरानु ग्राम 3 गूशरानी डणा	गूथना, गुफन गूथने की क्रिया गूथने की कला	knitting work of knitting art of knitting
गूशरणी	गूथणी	स्त्री	1 गूशरानु ग्राम 2 गूशरानी डणा डे आवडत 3 गूशरणी	गूथने की क्रिया गूथनेकी कला गूथनेकी उजत	knitting work art of knitting wages for knitting
गूशरु	गूथरु	स क्रि	दोरो डे सेरने आटी पाडी पाडीने साडणवु -गूथणीदार रथना डरवी	गूथना, गूथना	to weave, to knit
गूशरणी	गूथमण	न	गूथरानु मछेनताणु	गूथने की उजत	wages for knitting
गूशरणी	गूथमणी	स्त्री	गूञ्जु 'गूशरणी'	देखिए 'गूशरणी'	see 'गूशरणी'
गूशरवु	गूथरवु	स क्रि	'गूशरु' नु प्रेरड	'गूशरु' का प्रेरणार्थक रूप	caus of 'गूशरु'
गूशरु	गूथरु	अ क्रि	'गूशरु' नु डभीण	'गूशरु' का कर्मणि रूप	passive of 'गूशरु'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गूँदवु	गूदवु	सक्रि	1 पग तणे उथरवु, ખૂંદવુ 2 દાબી મસળીને નરમ કરવુ 3 મારવુ, ઠોકવુ	रौदना, पैर के नीचे कुचलना गूँधना, मसलना मारना, पीटना	to tread on, trample down to soften by kneading and pressing to beat, to thrash
गूँदापाड	गूदापाक	पु	1 મીઠાઈ 2 (લા) માર	एक मिठाई मार	kind of sweetmeat beating (fig)
गूँदी	गूदी	स्त्री	એક ઝાડ	गोंदनी (पेड), गोंदी	kind of tree
गूँदापाड	गूदीपाक	पु	જુઓ 'ગૂંદાપાક'	देखिए 'गूँदापाड'	see 'गूँदापाड'
गूँदु	गूदु	न	ગૂંદીનુ ફળ	गोंदनी का फल, गोंदनी	fruit of 'गूँदी'
गूँध	गूध	न	એક પક્ષી	एक पक्षी	kind of bird
गूँदपति	गृहपति	पु	1 ગૃહસ્થ 2 છાત્રો પર દેખરેખ રાખનાર શિક્ષક	गृहस्थ छात्रावास का अधिपति	householder, gentleman rector, hostel superintendent
गूँदप्रवेश	गृहप्रवेश	पु	1 ઘરમા વિધિપૂર્વક પ્રવેશ કરવો તે 2 બીજાના ઘરમા કે હુદમા રજા વિના પેસવુ તે, 'ટ્રેસપાસ'	गृहप्रवेश दडनीय अनधिकार प्रवेश	ceremonial entrance in a new house trespass
गूँदसचिव	गृहसचिव	पु	દેશની આતરવ્યવસ્થા સભાળનાર પ્રધાન	गृहसचिव	secretary to home ministry

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગૃહસ્થાઈ	ગૃહસ્થાઈ	સ્ત્રી	ગૃહસ્થપણુ	ગૃહસ્થી, ગાર્હસ્થ્ય	being a householder or gentleman
ગૃહસ્થી	ગૃહસ્થી	વિ	1 ગૃહસ્થને લગતુ 2 ગૃહસ્થાઈ, ગૃહસ્થાશ્રમનુ કામકાજ વગેરે	ગૃહસ્થ સે સબધિત ગૃહસ્થી	of or pertaining to a householder duties or status of a householder
ગેડ	ગેડ	સ્ત્રી	1 ગડ, ધડ, ગડી (કપડાની) 2 સળી (કાગળનો) 3 બધન 4 (લા મેળ બેસવો, સચુકિતકતા	તહ, પરત ચુનટ (કાગજ કી), સિલવટ બધન મેલ ખાના, સચુકિ- તકતા	fold, plait (of cloth) mark or line of folding (of paper) binding, bond agreement, comporting
ગેબ	ગેબ	વિ	ન દેખાય એવુ, અદૃશ્ય	ગાયબ, અદૃશ્ય, લાપતા	invisible
		ન	ગેબ હોય તે, અદૃષ્ટ	દૈવ	the unseen
ગેબી	ગેબી	વિ	ગુપ્ત, અદૃશ્ય, ગૂઢ	ગુપ્ત, ગૈબી, અદૃશ્ય, ગૂઢ	secret, invisible, mysterious
ગેબી અવાજ	ગેબી અવાજ	પુ	1 ગૂઢ અવાજ 2 આકાશવાણી	ગૂઢ આવાજ આકાશવાણી	mysterious voice voice from the sky
ગેબી ગોળો	ગેબી ગોળો	પુ	ગપ, અફવાહ	ગપ, અફવાહ	rumour
ગેબી માર	ગેબી માર	પુ	મૂઢ માર, બહારથી ચિહ્ન દેખાય નહીં તેવો માર	મૂઢ માર	beating without causing outward injury

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गेर	गेर	पु	1 गरेलो भूझे 2 निषेध, अभाव, जोटु' अेवो अर्थ दर्शावनार पूर्वग	झाडन, झडा हुआ चूरा गेर	dust fallen from wood or wall prefix used in the sense of negation
गेरआबरु	गेरआबरु	स्त्री	अपशर्ति, अदनाभी	बदनामी	disgrace, dishonour
गेरइन्साफ	गेरइन्साफ	पु	अन्याय	गैरइन्साफी, अन्याय	injustice
गेरउपयोग	गेरउपयोग	पु	दुरुपयोग	दुरुपयोग	misuse
गेरअयदे	गेरकायदे	वि अ	अयध विनानु अयध विना, अयध विरुद्ध	गैरकानूनी, अवैध गैरकानूनी	illegal unlawfully
गेरअयदेसर	गेरकायदेसर	अ	गेरअयदे, अयध प्रमाणे नहि	गैरकानूनी	illegal
गेरत	गेरत	स्त्री	मान-आबरुनु (मान, लाजशरभ	गैरत, लाज, हया, मान या इज्जत का खयाल	sense of honour
गेरअधोअस्त	गेरबदोबस्त	पु	अव्यवस्था	अव्यवस्था	disorder
गेरअरुण	गेरमरजी	स्त्री	नाराण	नाराजगी	displeasure
गेरअखेरबानी	गेरमहेरबानी	स्त्री	अवकृपा	अवकृपा	disfavour
गेरअनुअसअ	गेरमुनासब	वि	गेरवाजबी	गैरवाजिब, गैरमुनासिब	improper
गेरअनुअसअ	गेरमुनासिब	वि	जुओ 'गेरअनुअसअ'	गैरमुनासिब	see 'गेरअनुअसअ'
गेरअस्ते	गेररस्ते	अ	जोटो शते, अेअयदे	अवैध, नाजायज रीति से	along the wrong path
गेरअलाभ	गेरलाभ	पु	1 जोट, नुकसान	घाटा, नुकसान	loss, disadvantage

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ખોટો લાભ	अनुचित लाभ	illicit gain
ગેરવર્તણૂક	गेरवर्तणूक	स्त्री	ખરાબ રીતભાત-વર્તન	अयोग्य आचरण	bad conduct
ગેરવલ્લે	गेरवल्ले	अ	જ્યાથી ન જડે એવી જગાએ, ખોટી જગાએ	बैठिकाने, न मिते वसी जगह पर रखना	in the wrong place
ગેરવવુ	गेरववु	स क्रि	પાડવુ, ખખેરવુ	गिराना, झाडना	to drop to shed
ગેરવાજબી	गेरवाजबी	वि	अयोग्य, अधटित	गेरवाजिव, अयोग्य, अनुचित	improper
ગેરવો	गेरवो	पु	ઘઉંનુ ખેતરમા થતો રોગ	गेरुआ, गेरुई (रोग)	red blight, a wheat disease
ગેરવ્યવસ્થા	गेरव्यवस्था	स्त्री	ગેરવહીવટ, ગોટાળો	अव्यवस्था, अधर, घोटाला	mismanagement
ગેરસમજ	गेरसमज	स्त्री	ખોટી સમજ	गलतफहमी	misunderstanding
ગેરસમજૂત	गेरसमजूत	स्त्री	ગેરસમજ	गलतफहमी	misunderstanding
ગેરસમજૂતી	गेरसमजूती	स्त्री	જુઓ 'ગેરસમજૂત'	देखिए 'गेरसमजूत'	see 'गेरसमजूत'
ગેરહાજર	गेरहाजर	वि	હાજર નહિ તેવુ	गैरहाजिर	absent
ગેરહાજરી	गेरहाजरी	स्त्री	હાજર નહિ રહેવુ તે	गैरहाजिरी	absence
ગેરચિત	गेरचित	स्त्री	જુઓ 'ગેરત'	देखिए 'गेरत'	see 'गेरत'
ગેરુ	गेरु	पु, न	1 એક જાતની લાલ મટોડી 2 જુઓ 'ગેરવો'	गेरु	kind of red clay
ગેરુઓ	गेरुओ	पु	ગેરુનો—ભગવો રંગ	गेरु का रग, भगवा	ochre colour, saffron colour
ગેરુવો	गेरुवो	पु	જુઓ 'ગેરુઓ'	देखिए 'गेरुओ'	see 'गेरुओ'
ગેરો	गेरो	पु	ગેરેલો, ગેર	झाडन, चूरा	dust fallen from wood or wall

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગેલ	ગેલ	ન	1 લાડ 2 લાડભર્યો ખેલ, રમત	દુલાર, પ્યાર દુલારભરી ક્રીડા	fondling, caressing playing fondlingly
		સ્ત્રી	ગલી, વાટ, રસ્તો	ગલી, રાસ્તા	lane, way, street
ગેસ	ગેસ	પુ	1 વાયુરૂપી પદાર્થ 2 કોલસામાથી કઢાતો બળે એવો વાયુ	ગૈસ ગૈસ (કોયલે મેં સે)	gas coal gas
ગેદટ	ગેદટ	વિ	ચકચૂર, મસ્ત	(નશે મેં) ચૂર	enraptured, delighted
ગેડી	ગેડી	સ્ત્રી	ગેડાની માદા	માદા ગૈંડા	female rhinoceros
ગેડો	ગેડો	પુ	એક જગલી જાનવર	ગૈંડા	rhinoceros
ગોકળઆઠમ	ગોકળઆઠમ	સ્ત્રી	શ્રાવણ વદ આઠમ, કૃષ્ણાની જન્મતીથિ	જન્માષ્ટમી, કૃષ્ણાષ્ટમી	eighth day of the black half of Bhado, birthday of Shri Krishna
ગોકળગાય	ગોકળગાય	સ્ત્રી	1 ચોમાસામા થતુ એક લાલ અને સુવાળુ જીવડુ, ઇન્દ્રગોપ 2 શિંગડાવાળુ એક જીવડુ. (તેને પરમેશ્વરની ગાય પણ કહે છે)	બીરબહૂટી, ઇન્દ્રગોપ સીંગોં વાલા એક કીડા	snail kind of horned insect
ગોકળયુ	ગોકળયુ	ન	1 ગોકુળ (લાલિત્યવાચક) 2 ગોકુળનુ—ને અંગેનુ	ગોકુલ ગોકુલ કા	Gokul village near Mathura of or about Gokul

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गोडणी	गोकळी	पु	गाथोनो गोवाण, रजारी	ग्वाला, अहीर	cowherd
गोक्षरो	गोकीरो	पु	शोरभडोर, धोघाट	शोरगुल, गुल-गपाडा	uproar, noise
गोખ	गोख	पु	1 છળુ, ઝરખો 2 ગોખલો	गोखा, गवाक्ष ताक, आला	balcony niche
ગોખણ	गोखण	न	गोखवु ते	घोटा, रटाई	cramming, learning by heart
ગોખણપટ્ટી	गोखणपट्टी	स्त्री	गोખી પાડવુ તે	घोटना, रट डालना	cramming
ગોખરુ	गोखरु	पु, न	1 એક વનસ્પતિ 2 એનુ ડાટાવાળુ બીજ	एक वनस्पति, गोखरु गोखरु (बीज)	kind of plant its prickly seed
ગોખલો	गोखली	स्त्री	નાનો ગોખલો	छोटा ताक	small niche
ગોખલો	गोखलो	पु	તાકુ, ગોખ	गोखा, ताक	niche
ગોખવુ	गोखवु	स क्रि	વારવાર બોલવુ	घोटना, रटना	to cram, commit to memory by repetition
ગોખાટવુ	गोखाटवु	स क्रि	ગોખ ગોખ ડરવુ	रटते जाना	to cram repeatedly
ગોચર	गोचर	वि	ઈદ્રિયગમ્ય	गोचर, इन्द्रियग्राह	perceptible by the senses
		न	ગૌચર, ચરો	गोचर, चरागाह	pasture
ગોચરી	गोचरी	स्त्री	ભિક્ષા	भिक्षा, गोचरी	alms
ગોજુ	गोजु	वि	ગદુ	गदा	dirty
ગોઝરુ	गोझरु	वि	1 ગાયની હત્યા કરનાર, પાપી 2 જ્યાં હત્યા થઈ હોય એવું, અપવિત્ર	गाय की हत्या करने वाला, पापी जहाँ हत्या हुई हो, अपवित्र	killer of cow, sinner place of murder, unholy

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गोट	गोट	पु	1 धूटको 2 गोटो (धुमाडानो) 3 बैरा तथा छोकशने छाथे पछेरवानु अेक धरेणु 4 बीजा रगना कपडाने ओटीने भुकेली डिनार (जेम के, अनूस, स्त्रीना कभजाने)	घूट घटा (धुँए की) एक गहना गोट, मगजी	draught cloud (of smoke) bracelet for women and children border of different colours stitched to a garment
गोटपीट	गोटपीट	न	अंग्रेज के ते बोलेवु ते (डटाक्षमा)	गिटपिट	(iron) English or speaking English
गोटपोट	गोटपोट	अ	गुओ 'गुटपुट'	देखिए 'गुटपुट'	see 'गुटपुट'
गोटमोट	गोटमोट	अ	गोटपोट बराबर ओटीने (सूवा भाटे)	देखिए 'गुटपुट'	closely covering the body (for sleeping)
गोटली	गोटली	स्त्री	1 नानो गोटलो 2 गोटलानी अदरनी भीज 3 (ला)अमभाथी अपोलियु	गुठली गिरी नागा (काम में से), काम से भागना	small stone in fruit (esp mango) kernel in the stone playing truant
गोटलो	गोटलो	पु	1 इनी अदरनु ओटलावाणु, भीज 2 कठण मासपिड	गुठली मासपेशी	stone in fruit hard lump of flesh
गोटवु	गोटवु	अ क्रि	1 गोग गोग गोट वणवा	अधड की तरह गोल गोल घूमना और छा जाना	to whirl round in round mass

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 धुमावु	जलते समय धुआँ होना	to emit smoke
			3 गूथावु	जटिल होना, उलझना, गुथी में फसना	to be confused
गोटी	गोटी	स्त्री	1 गोणी 2 नानी गाठ 3 इसमें बज्या पछी रहेती धातुनी गोणी	गुटी, गोली छोटी गिलटी धातु की गोली	pill small tumour ball of metal left after silver or gold thread is burnt
गोटीमडु	गोटीमडु	न	गुलाट	कलैया, कलाबाजी	somersault
गोठीमडु	गोठीमडु	न	गोटीमडु, गुलाट	कलाबाजी	somersault
गोटीलु	गोटीलु	न	गोटीमडु, गोठीमडु, गुलाट	कलैया	somersault
गोटीलो	गोटीलो	पु	1 पींजरानी तालने थंडाववानु ओंजर 2 नकर गोणो, ढंडो 3 अठलो 4 अडानो वणेलो साटओ	बान, मुठिया पिडा, गेंद कठा (पक्षी का) कपडे का कोडा	small dumb-bell like tool for striking the string of carding-bow solid ball, ball bird's neck whip woven out of twisted cloth
गोटो	गोटो	पु	1 गोणो, पिंडो 2 डूलनो तोरो, डूलगी 3 गलगोटो 4 वाधणा जेवो गोणो (धूण, धुमाडानो)	गोला, पिडा कलगी, गुच्छा (फूलों का) एक प्रकार का फूल बगूला (धूल आदि का)	round mass or lump nosegay marigold flower cloud of smoke or dust

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			5 ફળની અદરની ગોળ ચીજ (નાળિયરનો)	गोला, गोल गिरी	round mass of kernel in fruit
			6 (લા) છબરડો, ગોટાળો	घोटाला, घपला	fiasco, bungling
ગોઠ	गोठ	સ્ત્રી	1 અદરની વાતચીત, ગુજ 2 મિજબાની 3 મશ્કરી, ટોળ 4 મિત્રતા 5 ભેટ (ખાસ કરીને હોળીના દિવસોમા ગુલાલ ઇ છાટનારને અપાતી)	गोठ, गोष्ठी वनभोजन हँसी-मजाक मैत्री भेंट, नेग	personal talk feast jesting, joking friendship gift (sp that given to one sprinkling 'gulal' during Holi)
		ન	ગામડું	गाँव	village
ગોઠડી	गोठडी	સ્ત્રી	છાની-અતરની વાતચીત (લાલિત્યવાચક)	गोठ, गोष्ठी	secret or confidential talk
ગોઠણ	गोठण	પુ સ્ત્રી	ઢાંચણ ગોઠિયાણ, સ્ત્રીમિત્ર	घुटना स्त्रीमित्र	knee female friend
ગોઠવવું	गोठववु	સ ક્રિ	1 વ્યવસ્થિત અધખેસતુ મૂઝવું કે કરવું 2 નોકરીમા કે કામધધામા રાખવું-રખાવવું	तरतीब से रखना, व्यवस्थित करना या रखना, लगाना काम धधे में लगाना	to arrange to employ, get employed
ગોઠિયાણ	गोठियाण	સ્ત્રી	સ્ત્રીમિત્ર, સખી, ગોઠણ	सखी, स्त्री-मित्र, गुड़ियाँ	female friend
ગોઠિયો	गोठियो	પુ	મિત્ર, દોસ્ત	मित्र, दोस्त	friend
ગોઠો	गोठो	પુ	1 ઢોર બાધવાનું સ્થળ 2 પક્ષીનો માળો 3 જખ, નિરાત	मवेशियो का बाडा घोंसला चैन, शान्ति	cattle-yard nest rest ease

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गोड	गोड	न	शरीर उपर थती गाठ, ढीमारु	गड, गिलटी, गॉठ	boil, tumour
		स्त्री	गोडवु ते	गोडाई (क्रिया)	digging
गोडवु	गोडवु	स क्रि	ખોદવુ	गोडना, खोदना	to dig
गोडे	गोडे	अ	1 पेठे, જેમ 2 —ની સાथे, सोधतमा	नाई, भाँति —के साथ	like, as with, in the company of
गोतर	गोतर	न	1 गोत्र, કુળ 2 કોળની શિગોના ફોતરા અને પાદડાનો ભૂકો (ઢોરનુ ખાણ)	गोत्र, कुल द्विदल के पत्तों और फलियों का चूरा	family, tribe forage for cattle consisting of the leaves and husks of the pulses
गोतरજ	गोतरज	वि	गोत्रमा જન્મેલુ	गोत्र मे जन्मा हुआ, गोत्रज	born in one's own family
		पु,स्त्री	કુલદેવતા, ગોત્રજ	कुलदेवता	guarding deity of the family
गोतवु	गोतवु	स क्रि	શોધવુ, ખોળવુ	खोजना	to search, to find
गोतागोत	गोतागोत	स्त्री	ખોળખોળ	खोज	searching
गोतु	गोतु	न	1 ઢોરને માટે બાકેલુ ખાણ	भूसा	boiled millet etc given to cattle
			2 (લા) ગમે તેમ રાધેલુ કે ટાઢુ ને સ્વાદ વગરનુ અન્ન	बदजायका अन्न	ill-cooked, cold or tasteless food
गोथ	गोथ	स्त्री	1 ઊધે માથે ફરી જવુ તે, ગુલાટ (પતગની)	गिन्नी (पतग की)	downward movement of paper kite
			2 (લા) ભુલથાપ	भूलचूक, धोखा खाना	mistake, deception

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		वि	(વિપારી સંકેત ભાષામાં) ચાર	चार	four (in the code language of merchants)
ગોશુ	गोधु	न	1 માથુ નીચે હોય તેવી શરીરની સ્થિતિ 2 ગુલાટ 3 માથુ મારવું તે	शरीर की ऐसी स्थिति जिसमें सिर नीचे हो कलैया, लुढ़कनी सिर से चोट करना (सीगों चाले प्राणी का)	position of the body with head downwards somersault butting with the head
ગોદ	गोद	स्त्री	1 ખોળો 2 વારવાર ટોક્યા કરવું તે 3 ડખલ, અતરાય	गोद बार-बार टोकना दखल, अतराय	lap chiding repeatedly interference
ગોદડી	गोदडी	स्त्री	1 નાનું ગોદડું 2 લૂગડાના કાકડા વગેરે ગોઠવીને કરાતું હલકું પાલખું ઓઢણ કે પાશરણ 3 ગાયની ડોક નીચેની લખડતી ગોદડી જેવી જાડી ચામડી	गद्दी गुदडी गलकबल	small mattress covering made of rags dewlap
ગોદવાણી	गोदवणी	स्त्री	ગોદ, ડખલ, પજવાણી	सताना	goadng, harassment
ગોદવું	गोदवु	स क्रि	ગોડવું, ખોદવું	गोडना, खोदना	to dig
ગોદાટવું	गोदाटवु	स क्रि	1 ગોદા મારવા 2 (લા) વારવાર કહ્યા કરવું, ટોકવું	घूँसा लगाना टोकना	to hit with fist, box to chide repeatedly
ગોદામ	गोदाम	स्त्री ,न	ગોદા	गोदाम, मालखाना	dock-yard, godown

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गोदावपु	गोदाववु	सक्रि	1 'गोदवु' नु प्रेरक 2 गोदी मारवो 3 (ला) टोडीने जगत सतेज डरवु	'गोदवु' का प्रेरणार्थक रूप घूसा मारना टोक-टाककर सावधान करना	caus of 'गोदवु' to give a push to bring a person to his senses by chiding
गोदी	गोदी	स्त्री	1 अदर पाणी डटाय घलाय अेवी सगवडवाणु वडाणो बाधवानु अने ओला राखवानु अदर 2 गोडाउन	गोदी, नौनिवेश गोदाम	dock-yard godown
गोदी	गोदो	पु	1 गोदावे-भूये था भेडाय अेवु ओपसेलु ते 2 मुक्को, ठोसो 3 (ला) भोट, नुडसान	गौठ, आँख मुक्का, घूसा हानि, धक्का	something that pricks blow with fist loss
गोदण	गोधण	न	गाथोनु टोणु	गोधन (समूह)	herd of cows
गोधुलगन	गोधुलगन	न	गोरज-समीसाणनु लगन	गोरज-गोधूली-सध्या के समय का विवाह	marriage celebrated at dusk
गोधूम	गोधूम	पु	घउ	गोधूम, गेहूँ	wheat
गोधु	गोधु	न	नानो अणद, वाछरडो, गोधुलियु	छोटा बैल, बछडा	small bullock, castrated calf
गोधूम	गोधूम	पु	घउ, गोधूम	गेहूँ, गोधूम	wheat
गोधो	गोधो	पु	आअलो, अस्सी नडि डरेलो अणद	सॉड (बैल)	uncastrated bull
गोप	गोप	पु	1 (पुरुषनु) शेटनु अेड धरेणु 2 गोवाणियो	गले का एक गहना गवाला, गोप	necklace worn by men cowherd

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या क्रो.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गोपवु	गोपवु	स क्रि	सताडवु, धुपाववु	गोपना, छिपाना, गुप्त रखना	to conceal, hide
गोपाल	गोपाल	पु	1 गोवाणियो 2 राजा 3 श्रृषु	गवाला, गोपाल राजा श्रीकृष्ण	cowherd king Shri Krishna
गोपालक	गोपालक	पु	जुओ 'गोपाल'	देखिए 'गोपाल', गोपालक	see 'गोपाल'
गोपाळ	गोपाळ	पु	गोपाल, गोपालक	गवाला, गोपाल	see 'गोपाल'
गोपीचदन	गोपीचदन	न	टीलु डरवामा वपरती अेक पीणी माटी	गोपीचदन	kind of yellowish earth used in making marks on the forehead
गोक्ष	गोफ	पु	1 डोटनु अेक धरेणु 2 डथनु अेक धरेणु 3 रास रमतानी साथे डथमाना रगवेरगी धेरडा गूथाता जय छे ते रमत	गले का एक गहना हाथ का एक गहना रास की डोरियों का एक खेल	an ornament for the neck bracelet kind of musical dance in which the movements of players make a plaited string out of threads held by them
गोक्षुश	गोफण	स्त्री	पथरा डेडवानु जेतरे जेवु साधन	ढेला फंकने की रस्ती	sling
गोक्षुशियो	गोफणियो	पु	1 गोक्षुशामा डेडवानो गोणो 2 (ला क्ताडु (व्यगथमा)	गुल्ला, ढेला लड्डू (व्यग्य में)	ball thrown by sling (iron) sweetball
गोबरु	गोबरु	वि न	गडु गोबर	गदा गोबर	duty cowdung

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गोबावु	गोबावु	अ क्रि	गोबो पडवो	पिचकना	to be dented
गोबो	गोबो	पु	पछडायाथो धातुनी अनेली वस्तुनी सपाटीभा पडेले भाडे	पटकने से धातु की चीजो मे पडा हुआ गड्ढा	dent
गोमडल	गोमडल	न	पृथ्वीनो गोलाकार-थड	पृथ्वी का गोलाकार चक्र	sphere of the earth
गोमडण	गोमडळ	न	जुओ 'गोमडल'	देखिए 'गोमडल'	see 'गोमडल'
गोथणी	गोयणी	स्त्री	1 गोराणी 2 सौभाग्यवती स्त्री 3 व्रत निमित्ते जमवा बोलावेली सौभाग्यवती स्त्री	पुरोहित की पत्नी सौभाग्यवती स्त्री व्रतवाली सौभाग्यवती स्त्री	wife of family- priest or teacher married woman whose husband is living such woman invited for dinner given in fulfilment of a vow
गोथरो	गोयरो	स्त्री	गोरमानु व्रत	गौरीव्रत	vow in connection with Gauri, Shiva's wife
गोर	गोर	पु	1 विचार, मनन 2 (छाणानो) भूधो, गेरो 3 टोरनो समूह 4 पुरोहित 5 पडो	गौर, विचार, मनन (उपलो का) चूरा मवेशियो का समूह, पशुओं का समूह-वृद पुरोहित पडा	contemplation dust of cow- dung cake herd of cattle priest priest attending to pilgrims at the place of pilgrimage

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		स्त्री	1 कुडडरलशुनु गुरीडुडनु डत	गुरी-डरुवती डुरत	vow of maidens to worship Gauri
			2 गुरी, डरुवती, गुरडड	गुरी, डरुवती	Gauri, Shiva's wife
गुरडडरुडड	गुरखरुडड	स्त्री	1 अड अड	वलरुडडती इडडली (डड)	kind of tree
			2 तनु इड	उसकरु डल	its fruit
गुरडडरुडड	गुरखरुडड	स्त्री	शुनु 'गुरडडरुडड'	दखलड 'गुरडडरुडड'	see 'गुरडडरुडड'
गुरडडरुडड	गुरखगुरी	डु	अड डनसुडतल	डक डनसुडतल	kind of plant
गुरडडरुडड	गुरखडुडुडी	डु	अड डनसुडतल	डक डनसुडतल	kind of plant
गुरडडरुडड	गुरखडुडी	स्त्री	अड डनसुडतल	गुरखडुडी	kind of plant
गुरडडरुडड	गुरखलडन	न	सडुडसुरनु लडन	सधुडरु सडड डरु वलवरुड	marriage celebrated at the dusk
गुरडडरुडड	गुरखी	डु	गुरन सधु-धडुडडडडशड	गुरन सधु	Jain priest or preacher
गुरडडरुडड	गुरडड	वल	गुररु, गुररुड	गुररु, गुररुडरुड	white, fair
गुरडडरुडड	गुरडडरुडड	वल	गुररु, गुररुड	गुररु, गुररुडरुड	white
गुरडडरुडड	गुरडडरुडड	वल	गुररुड, गुरडडरुडड, गुररु	गुररु	white
गुरडडरुडड	गुरडडरुडड	न	डडडडनडुडतल, गुररुनु डड	डुरुडडतुडु, डुरुडडतुडु	following of a 'gor' or his duties
गुरडडरुडड	गुरडडरुडड	न	अड डकुडु	डक डकुडु	kind of bird
गुरडडरुडड	गुरडडरुडड	स्त्री	लरुल-डुडुड डरुडु	डलडुडु, लरुल-डुडुड डलडुडु	reddish-yellow clay
गुरडडरुडड	गुरडडरुडड	स्त्री	1 गुरी, डरुवती	गुरी, डरुवती	Gauri, Parvati

देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		2 शुभारिथओनु गौरपूजननु प्रत	गौरी का व्रत	vow of maidens to worship Gauri
गोरस	न	1 दूध, दही वजेरे 2 ते राखवानु पात्र, गोरसी	दूध, दही आदि दोहनी	milk, curds etc vessel for keeping milk, curds
गोरसी	स्त्री	जुओ 'गोरसु'	दोहनी	see 'गोरसु'
गोरसु	न	दूध, दही राखवानु माटीनु वासाण, दोशी	दोहनी	pot for keeping milk, curds etc
गोरभवु	अक्रि	1 घनघोर थपु	घनघोर होना (बादलों का)	to be overcast or dark (with clouds)
		2 धुमावु 3 सूळ न पडवाशी गूथवावु	धूमिल भ्रम में पडना	to be smoky to be confused
गोरभावु	अक्रि	जुओ 'गोरभवु'	देखिए 'गोरभवु'	see 'गोरभवु'
गोराट	वि	1 जुओ 'गोरट' 2 पोची, रेटाण (जमीन)	देखिए 'गोरट' पोची, बालुई (जमीन)	see 'गोरट' soft, sandy (earth)
गोराडु	वि	पोची, रेटाण (जमीन)	पोची, बालुई (जमीन)	soft and sandy (earth)
गोराणी	स्त्री	1 गोरनी स्त्री	पुरोहितानी	wife of family- priest
		2 गुरुमत्नी के स्त्रीगुरु	गुरुआनी	wife of teacher
गोरादे	स्त्री	गोरा देडवाणी स्त्री	गौर वर्णवाली स्त्री	beautiful blonde
गोरियो	पु	वाछडो (बछुधा गोरो)	बछडा	white calf
गोरी	स्त्री	जुओ 'गोरदे'	देखिए 'गोरदे'	see 'गोरदे'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गोरुचदन	गोरुचदन	न	જુઓ 'गोरोचन'	देखिए 'गोरोचन'	see 'गोरोचन'
गोरु	गोरु	वि	સફેદ-ઊજળા રંગનું	गौर, सफेद रंग का	white, fair (of complexion)
गोरुअक्ष	गोरुगफ	वि	એકદમ ગોરુ	गौरा-चिट्ठा	very white
गोरो	गोरो	पु	ગોરી ચામડીનો પરદેશી (યુરોપ અમેરિકા વગેરે દેશોનો) માણસ	गौरा परदेशी	white man
गोरोचन	गोरोचन	न	ગાયના માથામાંથી મળતી કે તેના પિત્ત યા મૂત્રમાંથી બનાવાતી એક ઔષધિ	गोरोचन	kind of medicine made from urine or bile of a cow or found in the head
गोल	गोल	वि	1 વર્તુલના-દડાના આકારનું 2 ગોળ આકાર	गोल गोल आकार, वृत्ताकार	round like circle or ball round shape
गोलक	गोलक	पु	પૈસા નાખવાનો ગલ્લો-પેટી	गोलक, सद्रुक	cash-box
गोलमाल	गोलमाल	पु	ગરબડ ગોટો, અવ્યવસ્થા	घपला, गोलमाल	misappropriation, disorder
गोलवु	गोलवु	स क्रि	પગ વડે ખૂંધી નાખવું	पैरों से रौंदना	to crush or trample with feet
गोलापो	गोलापो	पु	ગોલાપણ, દાસત્વ	दासता, गुलामी	servitude
गोलो	गोलो	पु	1 એ નામની જાતનો માણસ 2 જનનાખાનાનો નોકર	गोला जाति का आदमी जनानखाने का नौकर	a member of the Gola caste servant in the harem

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गोळाकृति	गोळाकृति	वि स्त्री	गोळाकार गोळ आकृति	गोलाकार, गोल गोल आकृति	round round figure
गोळार्ध	गोळार्ध	पु	1 अर्ध गोळ 2 पृथ्वीनो अर्धो गोळो	आधा गोल पृथ्वी का आधा गोला	half sphere hemisphere
गोणी	गोळी	स्त्री	1 छोटा नानी गोळ वस्तु 2 दवानी गोणी, गुटिका 3 बंदूक के पिस्तोलमा भरने मारवानी (सीसानी) गोणी 4 पाणी भरवानी माटली 5 छला वलोववानु गोळ वासण 6 अडकोष	गोली दवा की बटी, गोली बंदूक की गोली मटकी मथनी अडकोष	any small round thing pill, tablet bullet, pellet water pot round vessel for churning curds testicle
गोणीबार	गोळीबार	पु	बंदूकमाथी के पिस्तोलमाथी गोणी छोडवी ते	गोलीचालन, फैर	firing (shots)
गोणो	गोळो	पु	1 छोटापाण गोळ वस्तु, पिंडो 2 गोक्षणी मारवानी पिंडो 3 तोपथी मारवानी पिंडो 4 पाणी भरवानी मोटी गोणी 5 पेटनो वायुनो अेक रोग 6 गपगोणो 7 शनसनो के वीण्णीना दीवानो पोरो	गोला गोफन से फेंकने का देला, गुल्ला (तोप का) गोला पानी भरने का मटका वायुगोला रोग गप लालटेन की चिमनी, लट्टू	any round thing, mass, lump round missile thrown with a sling cannon-ball large, round earthen pot for holding water tympanites rumour bulb of lamp

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ગોદરુ	गौदरु	ન	1 ગોદરુ, ગામના ઢોર ઊભા રહવાની ભાગોળ પાસેની જગા 2 ગામની ભાગોળ	रहावन सिवान	open space near village border for cattle to stand outskirts of village
ગોદરો	गौदरो	પુ	જુઓ 'ગોદરુ'	देखिए 'गौदरु'	see 'गौदरु'
ગોધવુ	गोधवु	સ ક્રિ	બંધ જગામા પૂરવુ, કેદ કરવુ	कैद करना	to confine, imprison
ગ્રહશાતેક	ग्रहशातेक	ન	કોઈ પણ મગળ કાર્યની શરૂઆતમા ગ્રહોની માઠી અસર નિવારવા માટે કરાતી ધાર્મિક ક્રિયા, ગૃહશાંતિ, ગૃહશાંતિક	ग्रहशान्ति की क्रिया	religious ceremony performed in order to ward off the evil influence of planets
ગ્રંથ	ग्रथ	પુ	1 પુસ્તક 2 (બત્રીસ અક્ષરનો બનેલો) અનુષ્ટુપ છંદનો શ્લોક, 3 બંધન	ग्रथ, पुस्तक अनुष्टुप छंद बधन	book a stanza of anushtup, (अनुष्टुप) metre binding
ગ્રંથપાલ	ग्रथपाल	પુ	પુસ્તકાલયમા પુસ્તકોની રક્ષા અને આપવા-લેવાની વ્યવસ્થા કરનાર	ग्रथपाल	librarian
ગ્રંથિ	ग्रथि	સ્ત્રી	1 ગાઠ 2 સાંધો	गौठ, ग्रथि जोड़, सधि	knot, boil joint
ગ્રામપચાયત	ग्रामपचायत	સ્ત્રી	ગામનો વ્યવહાર ચલાવનાર પચાયત, ગ્રામમંડળ	ग्रामपचायत	body of elected elders managing the affairs of village, 'grampanchayat'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			३ गण्डशुनु अेउ पत्तु	ताश का एक पत्ता, गुलाम	knave in the playing cards
गोल्लो	गोल्लो	पु	१ वाएरडो २ मातानो युस्त भक्त	बछडा देवी का अनन्य भक्त	calf staunch devotee of goddess Shakti
			३ गण्डशुनो गोलो-अेउ पानु	ताश का एक पत्ता, गुलाम	Jack in the playing cards
गोवाएरी	गोवाएणी	स्त्री	गोवाएण	ग्वालिन, अहीरिन	wife of cowherd
गोवाणियो	गोवाळियो	पु	गाय-ठोर थरावनारो, गोवाण	ग्वाला	cowherd
गोवाणो	गोवाळो	पु	जुओ 'गोवाणियो'	ग्वाला	see 'गोवाणियो'
गोशाए	गोशाला	स्त्री	१ गायो राभवानु मडान अशवा वाडो २ दुग्धालय, गोशाए, गोशाण	गौशाला, गायों का बाडा दुग्धालय	pen or house for cows dairy
गोशाण	गोशाळा	स्त्री	जुओ 'गोशाए', गोशाण	देखिए 'गोशाए'	see 'गोशाए'
गोस	गोस	वि न	जभारी पाजुनु (सुडान इरेववा विषे) १ सडनी नाथनु धोरडु २ मास ३ श्रेष्ठ मएवीनो पीर	दाहिनी ओर का पाल की नाथ का रस्ता गोश्त पीर, गौस	to the right (of steering, ship) rope tied to sail meat, mutton Muslim saint of the highest order
गोस्वामी	गोस्वामी	पु	१ वैश्रवानो आचार्य २ अेउ अटड	वैष्णवों का आचार्य, गोस्वामी एक अल्ल, एक जातिनाम	religious head of Vaishnavas a surname
गोहत्या	गोहत्या	स्त्री	१ गायने भारी नाभवो ते	गोहत्या	cow slaughter

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 તેનુ પાપ	ગોહત્યા કા પાપ	sin of killing a cow
ગોળ	ગોઠ	વિ પુ	ઠડાના આકારનુ 1 ગોળ આકાર 2 શેરડીના રસને ઉકાળીન બનાવાતુ એક ખાદ્ય	ગોલ વૃત્તાકાર ગુડ	spherical round shape jaggery
ગોળગોળ	ગોઠગોઠ	વિ	1 અસ્પષ્ટ, ઠડાઠ 2 નરમ, પૂર્ણ રીતે ચડી ગયેલુ 3 (લા) જ્ઞેનુ મન પીગળી ગયુ હોય-પૂર્ણ રીતે અનુકૂળ થઈ ગયુ હોય એવુ	અસ્પષ્ટ, ગોલ-મોલ નરમ, ગુલગુલા દિલગુદાજ, પૂર્ણ રૂપ સે અનુકૂલ, આર્દ્રહૃદયી	not clear, evasive soft, thoroughly cooked (fig) moved to pity
ગોળચુ	ગોઠચુ	ન	જેમા ગોળનુ પ્રમાણ વધારે હોય એવુ અથાણ	ગુડબા (અચાર)	pickle with more jaggery added than usual
ગોળધાણા	ગોઠધાણા	પુ	ગોળ સાથે ભેળવેલા ધાણા	ગુડ મિશ્રિત ધનિયા	molasses and coriander seeds
ગોળપાપડી	ગોઠપાપડી	સ્ત્રી	એક મીઠી વાની, સુખડી	એક મિઠાઈ	sweetmeat made of wheat flour, ghee and molasses
ગોળમટોળ	ગોઠમટોઠ	વિ	બરાબર ગોળ	બરાબર ગોલ	quite round plump
ગોળાઈ	ગોઠાઈ	સ્ત્રી	ગોળપણ	ગોલાઈ, ઘેરા	roundness
ગોળાકાર	ગોઠાકાર	વિ	ગોળ	ગોલ	round

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
गौडियो	गौडियो	पु	गारुडी, मधारी	गारुडी, मधारी	snake-charmer, magician
गौशाळा	गौशाळा	स्त्री	જુઓ 'ગોશાલા'	गौशाळा	see 'गौशाळा'
गौशाळा	गौशाळा	स्त्री	જુઓ 'ગોશાળા'	देखिए 'गौशाळा'	see 'गौशाळा'
ग्यासतेल	ग्यासतेल	न	घासतेल, घासलेट, બાળવાનુ એક ખનીજ પ્રવાહી	मिट्टी का तेल	kerosene
ग्रहणशील	ग्रहणशील	वि	ગ્રહણ કરવાના સ્વભાવનુ, 'રિસેપ્ટિવ'	ग्रहणशील	receptive
ग्रहवु	ग्रहवु	स क्रि	1 લેવુ, પકડવુ 2 સમજવુ	लेना, पकड़ना, ग्रहण करना समझना	to receive, hold to understand, comprehend
घઉ	घउ	पु	એક અનાજ	गेहूँ	wheat
घઉઓ	घउलो	पु	એક જાતનો સુગંધી પદાર્થ	एक तरह का सुगंधित पदार्थ	a kind of fragrant object
घઉવાર્ણુ	घउवर्णु	वि	ઘઉ જેવા રંગનુ	गेहुआँ, गदुमी	wheat-coloured
घघરણ	घघरणु	न	ઘરઘરણ, નાતરુ	करावा, विधवा का पुनर्विवाह	remarriage of widow
घચડવુ	घचडवु	स क्रि	1 (રવ) 'ઘચડ ઘચડ' શાય એમ જોરથી હીંચોળવુ 2 કચડવુ, ભીડવુ	जोर से झुलाना कुचलना, खूब दबाना	to rock in such a way as to make a creaking noise to crush
ઘચરકુ	घचरकु	न	ખાટો કે તીખો ઓડકાર, ગચરકુ	खट्टी या तीखी उकार	sour or bitter eructation
ઘચરકો	घचरको	पु	જુઓ 'ઘચરકુ'	देखिए 'घचरकु'	see 'ઘચરકુ'
ઘચૂમ	घचूम	पु	ઘચૂમલો, જૂથ	जमाव, भीड, झुड	group, crowd

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धयूमलो	घचूमलो	पु	1 જૂથ, ઝોલુ 2 ગૂંચવાડો, અવ્યવસ્થા	जमाव, भीड अव्यवस्था, अस्पष्टता, उलझन में फसने की अवस्था	group, crowd confusion
ઘટ	घट	पु	1 ઘડો 2 શરીર 3 હૃદય, મન	घडा शरीर हृदय, मन	pitcher body heart, mind
		સ્ત્રી	1 ખોટ, ખાલીપો 2 ઘટવુ તે, ઘટાડો	घाटा, खालीपन, रिक्तता कमी, घट	deficiency, loss decrease
		વિ	ઘાટુ, ઘાડુ	गाढा, घना	dense
ઘટક	घटक	વિ	વસ્તુનો એકમ	घटक, इकाई	unit
		સ્ત્રી	ઘડો	घडा	pot
		અ	પેચ ગળતા થતા અવાજની જેમ	घट-घट आवाज	sound produced while drinking liquid
ઘટતુ	घटतु	વિ	1 યોગ્ય, વાજબી 2 કમી, ખૂટતુ	उचित, योग्य घटता हुआ	proper, fit wanting, deficient
ઘટના	घटना	સ્ત્રી	1 બનાવ 2 કારીગરી 3 રચના, બનાવટ	घटना कारीगरी रचना, बनावट	event, incident workmanship composition, make
ઘટમાળ	घटमाळ	સ્ત્રી	1 રેટમા ગોઠવેલી ઘડાની હાર 2 કમ, પ્રણાલી	रहट के घडों की माला सिलसिला, परंपरा	line or row of small earthen pots set round a wheel for lifting water from a well course, routine, tradition

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઘટવુ	घटवु	અક્રિ	1 યોગ્ય હોવુ, છાજવુ 2 બધબેસતુ આવવુ, લાગુ પડવુ પિરક 'ઘટાડવુ' (જેમ કે શ્લોકનો અર્થ) 3 ઓછુ કે કમી થવુ 4 (કપડુ) યડી જવુ પિરક 'ઘટાડવુ'	યોગ્ય હોના, ફબના, શોભા દેના ઠીક બૈઠના, લાગુ હોના ઘટના, કમ હોના (કપડા) કસના, ચુસ્ત-તગ હોના	to be proper (for) to become, to fit in to abate, to decrease to shrink
ઘટા	घटा	સ્ત્રી	જમાવ, ઝુડ, સમૂહ (ઝાડ, વાદળા વગેરેનો)	ઘટા, સમૂહ, ઝુરમુટ, ઝુડ	mass of trees, clouds etc
ઘટાટોપ	घटाटोप	વિ	1 ચારે બાજુ ઢાકાઈ જાય તેવી ઘટા 2 તેવુ ઢાકણ 3 આડબર, ભપકો	ઘટાટોપ, ઘનઘટા ऐसा आच्छादन આડબર, ઠાટ-બાટ	shade spreading all around cover or canopy forming shade pomp, show
ઘટાડવુ	घटाडवु	સક્રિ	'ઘટવુ' (ઓછુ થવુ) નુ પ્રેરક	કમ કરના	to decrease, caus of 'ઘટવુ'
ઘટાડો	घटाडो	પુ	કમીપણુ, ઘટ	કમી, ઘટાવ	decrease, deficiency
ઘટાસ્ત	घटारत	વિ	યોગ્ય, ઘટતુ	ઉચિત, યોગ્ય	proper, fit
ઘટાવવુ	घटाववु	સક્રિ	બેસતુ કરવુ, લાગુ પાડવુ (શ્લોકનો અર્થ ઇ)	ઠીક બૈઠાના, લગાના	to interpret
ઘટિત	घटित	વિ	યોગ્ય, ઉચિત, બરાબર	યોગ્ય, ઉચિત, બરાબર	fit, proper
ઘટ્ટ	घट्ट	વિ	ઘાટુ, ઘાડુ	ગાઢા, ગફ (બુનાઈ)	thick, compact
ઘડતર	घडतर	ન	1 ઘડીને-ટીપીટીપીને કરેલી બનાવટ	ગઢના, બનાવટ	made by beating on the anvil

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 ઘડવુ-રચવુ કે બનાવવુ કે તેની રીત	ગઢના, રચના યા બનાના યા ઉસકી રીતિ, બનાવટ	making, shaping
			3 ઘડામણ	ગઢાઈ	wages for manufacturing
			4 કેળવાઈને તૈયાર થવુ તે, કેળવણી	શિક્ષા	education, nurture
ઘડપણ	ઘડપણ	ન	વૃદ્ધાવસ્થા	બુઢાપા	old age
ઘડભાગ	ઘડભાગ	સ્ત્રી	1 ઘડવુ અને ભાગવુ તે	ગઢના ઓર તોડના	making and unmaking
			2 લા ઠિચારોનુ ઠામડોળપણ	અસમજસ, ઢુવિધા	vascillation
ઘડવુ	ઘડવુ	સક્રિ	1 ઘાટ-આકાર આપવો	ગઢના	to shape, to give shape
			2 બનાવવુ, રચવુ, લખવુ	બનાના, રચના, લિખના	to make, to write
			3 ગોઠવવુ, સકલના કરવુ	વ્યવસ્થિત કરના, સકલન કરના	to arrange, to assemble
			4 ટીપવુ	પીટના (ઘાતુ)	to beat
			5 ખરકો તૈયાર કરવો	મસવિઢા તૈયાર કરના	to prepare (a document etc)
			6 કેળવીને તૈયાર કરવુ	શિક્ષિત કરના	to train, to educate
			7 મારવુ	મારના, પીટના	to beat, to thrash
ઘડવો	ઘડવો	પુ	ઘડાના ઘાટનો લોટો	ઘડે કે આકાર કા લોટા	water-pot of the shape of pitcher
ઘડાઈ	ઘડાઈ	સ્ત્રી	ઘડવાનુ મહેનતાણ	ગઢાઈ	wages for making
ઘડામણ	ઘડામણ	ન	ઘડાઈ	ગઢાઈ	wages for making

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઘડામણી	घडामणी	સ્ત્રી	જુઓ 'ઘડામણ'	देखिए 'घडामण'	see 'घडामण'
ઘડાયેલુ	घडायेलु	વિ	અનુભવથી પાકુ થયેલુ	कसा हुआ, मँजा हुआ	experienced, mature
ઘડિયાળ	घडियाळ	સ્ત્રી, ન	1 વખત જણાવનારું યત્ર 2 કાસાનો ગોળ સપાટ ઘટ	घडी (यत्र) झालर, घडियाल	clock, watch gong
ઘડિયાળી	घडियाळी	પુ	ઘડિયાળો વેચનાર તથા દુરસ્ત કરનાર	घडीसाज	watch-maker or repairer
ઘડિયો	घडियो	પુ	આકનો પાડો, ગડિયો	पहाडा	table of multiplication of a number
ઘડી	घडी	સ્ત્રી	1 ૨૪ મિનિટ જેટલો વખત 2 ઘડી માપવાનો વાડકો 3 (લા) ક્ષણ 4 તક, પ્રસંગ	घडी, घटी घडी नापने का कटोरा क्षण मौका, प्रसंग	duration of 24 minutes bowl to measure 'घडी' moment (fig) opportunity
ઘડીઘડી	घडीघडी	અ	ઘડીએ ઘડીએ, વારવાર, હરઘડી	घडी-घडी, बार-बार	every moment
ઘડીતાળ	घडीताळ	અ	મરવાની આશી પર	आसन्नमरण	on the point of death
ઘડીભર	घडीभर	અ	એક ઘડી સુધી, થોડી વાર	घडी भर, थोडी देर	for a moment
ઘડીસાધ	घडीसाध	અ	જુઓ 'ઘડીતાળ'	देखिए 'घडीताळ'	see 'घडीताळ'
ઘડૂલી	घडूली	સ્ત્રી	નાનો ઘડૂલો	छोटा घडा	small pitcher
ઘડૂલો	घडूलो	પુ	જુઓ 'ઘડૂલિયો'	घडा, घडोला	see 'घडूलियो'
ઘડો	घडो	પુ	ઘાતુ કે માટીનુ પાણી ભરવાનુ પાત્ર	घडा, घट	metal or earthen vessel for carrying or storing water

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धर	घण	पु	1 भोटो ભારે હથોડો 2 લાકડામા થતો એક કોડો	घन, भारी हथौडा घुन	large hammer kind of insect found in timber
धराधर	घणाघणी	स्त्री	ધરો સ્નેહ, ગાઢ સબધ	गहरी छनना, गाढा स्नेह	close friendship, intimacy
धर	घणु	वि	બહુ, ખૂબ, પુષ્કળ	बहुत, खूब	much, very much, abundant
धराधर	घणुधर	अ	બહુધા, મોટે ભાગે	अकसर, बहुत करके, बहुधा	mostly, for the most part
धन	घन	वि	1 નક્કર 2 ઘાડુ, ગીચ 3 ઘણુ, પુષ્કળ 4 (ગ) ાલબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળુ, 'ક્યૂબિક'	घन, ठोस घना, गाढा बहुत, अधिक क्यूबिक	solid thick plentiful cubic
		पु	1 (ગ) કોઈ સખ્યાને તેનાથી જ બે વાર ગુણવાથી આવતો ગુણાકાર, 'ક્યૂબ'	'क्यूब', घन	cube
			2 છ સરખી બાજુ- ઓની આકૃતિ 3 વેદપાઠનો એક પ્રકાર	छ समान बाजुओं वाली आकृति वेदपाठ का एक प्रकार	hexagon one of the systems of reciting the Vedas
		पु, न	વાદળુ	बादल, घन	cloud
धनघोर	घनघोर	वि	1 ગાઢુ (વાદળ ઇ) 2 ભયાનક (અવાજ, ચુદ્દ ઇ)	गाढा, घनघोर भयानक (आवाज आदि)	(of clouds) very dark terrible dreadful

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धनथक्कर	घनचक्कर	वि	મગજનુ ચસકેલુ	घनचक्कर	of unsteady mind
धनता	घनता	स्त्री	'अनोड' (प ५)	घनता	anode (physics)
धनत्व	घनत्व	न	જુઓ 'ધનતા'	घनत्व	see धनता
धनपात्र	घनपणु	न	ધનતા, ધનત્વ	घनापन, घनता	density
धनश्ल	घनफल	न	વસ્તુના કદનુ માપ, 'વોલ્યુમ' (ગ.)	घनफल, 'वोल्यूम'	volume
धनश्ण	घनफळ	न	જુઓ 'ધનશ્લ'	घनफल	see 'धनश्ल'
धनभाण	घनमाळ	स्त्री	વાદળાની ઊર-ઘટા	घनघटा	bank of clouds
धनभूण	घनमूळ	न	'ક્યૂબ રૂટ' (ગ.)	घनमूल, 'क्यूब रूट'	cube root
धनरव	घनरव	पु	1 વરસાદની ગર્જના 2 મોર	मेघगर्जन, घनरव मोर	thunder of clouds peacock
धनश्याम	घनश्याम	वि	મેઘ જેવુ કાળુ કૃષ્ણ	बादल जैसा काला, घनश्याम श्रीकृष्ण, घनश्याम	black or blue as the clouds Krishna (Hindu mythology)
धनसार	घनसार	पु	1 કપૂર 2 પાણી 3 પારો 4 ચંદન	कपूर, घनसार जल पारा चंदन	camphor water mercury sandalwood
धनाक्षर	घनाक्षर	पु	એક છંદ	घनाक्षरी	a kind of verse form
धनाक्षरी	घनाक्षरी	पु	જુઓ 'ધનાક્ષર'	देखिए 'धनाक्षर'	see ધનાક્ષર
धनिष्ठ	घनिष्ठ	वि	સૌથી ધન-ગાઠ	घनिष्ठ, बहुत घना, गाढा	closest, most intimate
धनीभूत	घनीभूत	वि	નક્કર કે ઘટ્ટ બનેલુ	घनीभूत, ठोस या गाढा बना हुआ	solidified, made dense, congealed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धमकवु	घमकवु	अ क्रि	धमधम अवाज शवो (धूधरा ७ नो)	घमघमाना	to make rumbling sound
धमकारो	घमकारो	पु	धमकवानो अवाज	घमाघम	sound of rumbling
धमध्रे	घमको	पु	जुओ 'धमकारो'	घमाघम, घमक	see 'धमकारो'
धमधमाववु	घमघमाववु	स क्रि	धम धम अवाज शाय तेम जोरशी मारवु	घमघमाना	to beat so as to make a rumbling sound
धमसाण	घमसाण	न	1 रमण(भमण, तोडन 2 भयकर युद्ध 3 विनाश 4 लोकोनु टोणु-भीड	तूफान, घमरौल भयकर युद्ध, घमासान विनाश जमाव, मजमा, भीड	confusion, mess fierce battle destruction crowd of people
धमड	घमड	पु	1 अडकार, गर्व 2 जोटो देजाव, डोण	घमड, गर्व आडबर, दभ	pride, arrogance false show
धमडी	घमडी	वि स्त्री	धमडवाणु अभिमान, गर्व	घमडी, अभिमानी घमड, गर्व	proud, arrogant pride, arrogance
धमेलु	घमेलु	न	तगारु, तलाडरु	लोहे का तसला	bricklayer's trough
धर	घर	न	1 रडेवानु ठेकारु, मकान 2 गूड, अेड कुटुबनु निवासस्थान 3 वस्तु राखवानु डे रडेवानु जोणु, जानु, घोडी, ठेकारु वगेरे 4 ग्रहनु जे राशिमा स्थान डोय ते 5 कुटुब 6 धरससार	घर, मकान, रहने का स्थान गृह, एक कुनबे का वासस्थान बक्सा, कोठा, खाना, दराज ग्रहविशेष का स्थान परिवार घरबार, घर-गिरस्ती	house, place of residence home case, box etc house of a planet (astro) family the whole household

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			7 ખાનદાન, કુળ	खानदान, कुल	noble family or ancestry
ઘરઆગણ	घरआगणु	न	1 ઘરનુ આગણ 2 (લા) અર્થાત પરિચિત પાસેનુ સ્થાન	घर का आगण नजदीक का परिचित स्थान	compound of a house a place with which one is very familiar
ઘરકવુ	घरकवु	सक्रि	ખીજવું	घुडकना	to tease
ઘરકાજ	घरकाज	न	ઘરનુ સાધારણ કામકાજ	गृहकार्य, घर-गिरस्ती	daily chores
ઘરકૂકડિયુ	घरकूकडियु	વિ	જુઓ ઘરકૂકડી	देखिए 'घरकूकडी'	see ઘરકૂકડી
ઘરકૂકડી	घरकूकडी	વિ	ઘરમા ને ઘરમા ભરાઈ રહેનારું	घरघुसडा	person staying indoor
ઘરખટલો	घरखटलो	પુ	1 ઘરને લગતો સરસામાન, ઘરવાખરો 2 સસારવહેવારનુ કામકાજ 3 છોકરા, સ્ત્રી વગેરે સમુદાય	घरबार, घर का माल-असबाब गहस्वी का कामकाज पत्नी, बाल-वच्चें आदि	household articles troubles and cares of a house-hold the whole family including wife, children etc
ઘરખરચ	घरखरच	પુ, ન	ઘર ચલાવવામા થતો ખરચ	घर का निर्वाह करने में होने वाला खर्च	household expenses
ઘરખર્ચ	घरखर्च	પુ, ન	જુઓ 'ઘરખરચ'	देखिए 'घरખरच'	see 'ઘરખરચ'
ઘરગતુ	घरगतु	વિ	1 જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમા જ હોય તેવું 2 વેચવા માટે નહિ કરેલું	घराऊ, घरेलू बेचने के लिए नहीं बनाया हुआ	made and consumed at home not prepared for sale

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 ખાનગી	निजी	private
ઘરમથુ	घरगथु	वि	જુઓ 'ઘરગતુ'	देखिए 'घरगतु'	see 'घरगतु'
ઘરમથુ	घरगथु	वि	ઘરગતુ, ઘરમથુ	देखिए 'घरगतु'	made and consumed at home
ઘરઘરણ	घरघरणु	न	નાતરુ, ઘઘરણ	करावा, सगाई, विधवा का पुनर्विवाह	remarriage of widow
ઘરઘરવુ	घरघरवु	अ क्रि	ઘઘરવુ, નાતરુ ડરવુ	करावा करना, अन्य के घर में बैठना	remarry (for a widow)
ઘરઘરાઉ	घरघराउ	वि	માહોમાહેનુ, ખાનગી	घर, निजी, परस्पर	mutual, private
ઘરઘાલુ	घरघालु	वि	1 ઘર આલે એવુ— પોતાના જ ઘરને નુકસાન પહોચાડનારુ 2 ખરચાળ 3 દગાબાજ	घरघालन फिजूलखर्च, उडाऊ दगाबाज	causing damage to one's own family expensive deceitful, treacherous
ઘરજમાઈ	घरजमाई	पु	સસરાને ઘેર સસાર માડી રહેનારો જમાઈ	घरजँवाई, घरजमाई	man living permanently with his wife at his father-in-law's place
ઘરડ	घरड	स्त्री	1 ચીલો 2 ચાલુ પ્રણાલી કે રૂઠિ	लीक, पगडडी परपरा, रूढि, प्रथा	rut, beaten track custom, tradition
ઘરડાપો	घरडापो	पु	1 ઘડપણ	बुढापा	old age

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 धरडाना जेवु डलापण, धोटडलापण	बूढ़ों की-सी समझ	wisdom which would suit old age
धरडियो	घरडियो	पु	1 धार श्रटवानो पथ्यर 2 गणामा ओलतो श्वास 3 धरडो-वडील माणस	धार निकालन का पत्थर, सिल्ली गले की घरघराहट, घरी वृद्ध, बुजुर्ग मनुष्य	whetstone death-rattle respectable elderly man
धरडु	घरडु	वि	1 पाश्री उम्भरे पडोयेलु भोटी वयनु 2 पुराण, जूनु 3 पाश्री गयेलु, डठल	बूढ़ा, वृद्ध पुराना पक्का, सख्त	old, elderly dilapidated, rickety ripened, hard
धरडुभभ	घरडुखख	वि	साव धरडु-भभणी गयेलु	जराग्रस्त, जराजर्जरित	very old
धरडु ठथ्यर	घरडु ठच्चर	वि	साव धरडु (तिरस्कारमा)	जराग्रस्त	quite old (in contempt)
धरडेरु	घरडेरु	वि	धरडु, वडील	बूढ़ा, बुजुर्ग	old, respectable person
धरश	घरण	न	सूर्यचंद्रनु ग्रहण	ग्रहण (सूर्य-चंद्र का)	eclipse
धरधणियाणी	घरधणियाणी	स्त्री	1 धरधणीनी पत्नी 2 धरनी मालिक, धरवाणी	घरवाली, गृहिणी घर की मालकिन, घरनी	wife of landlord mistress of the house
धरधणी	घरधणी	पु	1 धर अलावनारो मुख्य पुरुष 2 धरनो मालिक	घरवाला, गृहस्वामी घर का मालिक	chief supporter of the family master of the house
धरधधो	घरधधो	पु	धरने लगतु श्रमश्रज	गृहकार्य, घर-गिरस्ती	house-hold work

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઘરનુ	ઘરનુ	વિ	પોતીકુ, પોતાના ઘર જેવુ, ખાનગી	નિજી, ખાનગી	one's own
ઘરબોળુ	ઘરબોલુ	વિ	ઘરને બોળે-બેઆબરુ કે પાચમાલ કરે એવુ	ઘરઘાલન	ruining one's own house and family
ઘરમેળે	ઘરમેલે	અ	1 માહોમાહે સમજીને (ત્રીજા પક્ષ પાસે ગયા વિના) 2 મિત્રતાની રીતે	આપસ મેં સમજીકર	by mutual agreement
ઘરરખુ	ઘરરખુ	વિ	ઘરની સભાળ રાખે એવુ	ઘર કી સંભાલ રખને વાલા	disposed to take good care of things in the house
ઘરવાખરી	ઘરવખરી	સ્ત્રી	જુઓ 'ઘરવાખરી'	દેખિય 'ઘરવાખરી'	see 'ઘરવાખરી'
ઘરવાખુ	ઘરવખુ	વિ	ઘરની ચાહનાવાળુ, ઘરમોઢુ	ઘર કો ચાહને વાલા, ઘરઘુસડા	attached to one's house-hold
ઘરવટ	ઘરવટ	સ્ત્રી	એક ઘરના હોય તેવો ગાઢ સબધ	ઘરોબા	intimacy as if the parties concerned were of the same house-hold
		વિ	ઘર જેવો સબધ	ઘર જૈસા સબધ	intimate as if of the same family
ઘરવાખરી	ઘરવાખરી	પુ	ઘરને લગતો સરસામાન, રાચરચીલુ	ઘર કી चीज-वस्तु, ઘર-બાર	house-hold wares, furniture etc
ઘરવાળી	ઘરવાઢી	સ્ત્રી	ઘરઘણિયાણી	ઘરવાલી	mistress of the house

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
घरवाणो	घरवाळो	पु	घरधारणी	घरवाला	master of the house
घरवेदु	घरोवैदु	न	घरगथु वैदु	घरेलू वैद्यक	house-hold medicines, remedies etc
घरससार	घरससार	पु	1 गृहस्थाश्रम 2 ससारवलेवार	गृहस्थाश्रम घर-गिरस्ती का काम, घरजुगत	status of householder social give-and-take peculiar to a house-holder
घरसूत्र	घरसूत्र	न	जुओ 'घरससार'	देखिए 'घरससार'	see 'घरससार'
घराउ	घराउ	वि	घरनु, ખાનગી, અદર અદરनु	घरु, निजी, अदर का	mutual, private
घराड	घराक	पु, न	1 ખરીદનાર 2 ખૂબી પિછાનનાર	ग्राहक, खरीदार पारखी, गुणग्राही	customer appreciator
घराञ्ज	घराकी	स्त्री	1 ઘરાકપણ, વેચાણ 2 ખરીદનારાનો આવરો 3 ખપત, ઉઠાવ	बिक्री, ग्राहकी खरीदारों की आमद खपत, बिक्री	sale pressure of customers demand, sale
घराणे	घराणे	अ	जुओ 'घरेणे'	देखिए 'घरेणे'	see 'घरेणे'
घरु	घरु	न	કોઈ વસ્તુ રાખવાનુ ખોખુ- ઘર	कोठा, खाना	case, box etc
घरणी	घरणी	स्त्री	જુઓ 'ઘરણી', ગૃહિણી	गृहिणी	see 'घरणी', house-wife
घरेડ	घरेड	स्त्री	1 જુઓ 'ઘરડ' 2 ધૂવા પરના પથ્થર ઉપર દોરડાના ઘસાવાથી પડતો ખાડો	देखिए 'घरड' कुँए की लकड़ी या पत्थर पर की रस्सी की रगड से होने वाली गराडी	see 'घरड' groove formed because of the -sliding of the rope along the top of a well

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धरेडी	घरेडी	स्त्री	1 गरगडी 2 धरु धरु अेम बोलतो- मरती वधतनो श्वास, धरुडयो	घिरनी, गराडी घर्रा, घरघराहट (गले की)	pulley death-rattle in the throat (of a dying man)
धरेडो	घरेडो	पु	1 मरती वधतना श्वासशी शतो अवाण	मरणासन्न व्यक्ति की घरघराहट	death-rattle
धरेणु	घरेणु	वि	1 गीरो सभधी 2 गीरो शभेळु	गिरवी सबधी गिरवी रखा हुआ, गिरवी	pertaining to a mortgage mortgaged
धरेणियु	घरेणियु	वि	धरेणे लीधेळु डे आपेळु	गिरवी लिया या दिया हुआ	mortgaged
धरेणियात	घरेणियात	वि	जुओ 'धरेणियु'	देखिए 'धरेणियु'	see 'धरेणियु'
धरेणु	घरेणु	न	धगीनो	गहना, जेवर	ornament
धरेणुगाठु	घरेणुगाठु	न	धरेणु ने बान्णे गाठेळो अलक्षर	गहना-पाता	ornaments including those knotted and interwoven
धरेणे	घरेणे	अ	आटमा-गीरो आपेळु लीधेळु छेय तेम	गिरवी, बधक, रेहन	mortgaged
धरेघर	घरोघर	अ	धेर धेर	घर-घर	from house to house
धरोपु	घरोपु	न	धरना जेवो गाठ सभध, धरवट	घरोबा, एक घर का हो जैसा सबध	intimate relation
धरोणी	घरोळी	स्त्री	गरोणी	छिपकली	house lizard
धरुप्त	घलात	स्त्री	1 धाली डे धलाठ ज्यु ते, नुडसानी, पोड	बट्टा, टोटा, डूबी हुई या डुबाई गई रकम	losing, loss

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 वसूल न आपवु ते	पावना न देना	non-payment of dues
घलावु	घलावु	अ क्रि	घालवु'नु कर्मणि	'घालवु' का कर्मणि रूप	passive of 'घालवु'
घलोडी	घलोडी	स्त्री	अेक शाकनो वेलो, धिलोडी	कूंदरू (बेल)	kind of creeping plant, lizard
घलोडु	घलोडु	न	जुओ 'धिलोडु'	देखिए 'धिलोडु'	see 'धिलोडु'
घवावु	घवावु	अ क्रि	घायल थवु	घायल, जखमी होना	to be injured or wounded
घसघस	घसघस	अ	गाढ शीते (ठिधवु ते)	गहराई से (नींद लेना)	(of sleep) soundly, deeply
घसडबोरो	घसडबोरो	पु	लभलभ करवानी भडे-त	लिख-लिख करने का श्रम	trouble of writing frequently
घसडवु	घसडवु	स क्रि	जुओ 'घसरडवु'	देखिए 'घसरडवु'	see 'घसरडवु'
घसरओ	घसरको	पु	जथओ, डापो, आओ	निशानी की रेखा, चिह्न, आँक, खरोच	cut, mark
घसरडवु	घसरडवु	स क्रि	1 ढसरडातु जेथवु 2 ऊपाटाभध-गभे तेम लभवु के काम करवु	घसीटना घसीट लिखावट लिखना, रगड मारना	to drag along the surface to write or work carelessly and hurriedly
घसरडो	घसरडो	पु	1 घसरओ, उअरडो 2 उसरडो, वेठ	खरोच, रगड बेमन का काम, बेगार	cut, mark drudgery
घसरपसर	घसरपसर	अ	1 घसडातु पछडातु, जेम तेम 2 पराणे, वेठ लेजे	घसीटते हुए, ज्यों-त्यों करके बेगार की तरह	dragging, tumbling under duress

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धसवु	घसवु	स क्रि	1 એક વસ્તુનુ બીજી વસ્તુ પર ઘસીને જોરથી આખતેમ ખેંચવી 2 યોળવુ, મસળવુ 3 માજવુ 4 ઘસીને ધાર ચડાવવી કે ઓપ આપવો	घिसना हाथ से रगड़ना, मलना (बरतन) माजना तेज करना, चमकाना	to rub to massage to scrub to sharpen, whet, polish
धસાતુ	घसातु	वि	1 ઊતારી પાડે એવુ 2 નુકસાનકારક	कटती (कहना) नुकसानदेह, हानिकर	running down doing damage
धસારવુ	घसारवु	न	ઘસીને પીવાનુ ઓસડ	घिसकर पीने की औषध	kind of medicine rubbed on a hard surface before being taken
ધસારો	घसारो	पु	1 ઘસાવુ તે, ઘસારો 2 ઘસાવાથી પડેલી રજ 3 ઘસાવાથી લાગતી ખોટ, નુકસાન	छीज, घटाव, घिसा जाना घिसाई (रज) नुकसान, घाटा, छीज	being rubbed dust falling from rubbing loss owing to frequent use or rubbing
ધસાવવુ	घसाववु	स क्रि	'ઘસવુ' નુ પ્રેરક	'घसवु' का प्रेरणार्थक रूप	causal of 'घसवु'
ધસાવુ	घसावु	अ क्रि	1 'ઘસવુ'નુ કર્મણિ 2 ઘસારો વેઠવો, ખર્ચ કે ખોટ યા નુકસાનમા ઊતરવુ	'घसवु' क्रिया का कर्मणि रूप नुकसान उठाना, घाटे में रहना	passive of 'घसवु' to incur expense or suffer loss

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઘસિયુ	ઘસિયુ	વિ	ગાગડુ નહિ-ભૂકા જેવુ (મીઠુ)	ચૂર્ણ-સા (નમક)	(of salt) powdered, not in modules
ઘઘોલિયુ	ઘઘોલિયુ	ન	1 નકામુ, ખરાબ ઘર- ખોરડુ 2 માથે મોઢે-ગોટપોટ ઓઢવુ તે, ઘોઘો 3 લા ધૂળધાણી, વિનાશ	ઘરૌંદા ઝુરમુટ બર્બાદી, તહસ-નહસ	hovel, wretched dwelling covering oneself from head to foot with a sheet desolation, ruin
ઘટ	ઘટ	પુ	1 ધાતુની ઊંધા પ્યાલાના આકારની કે જાડી લોઢી જેવી વગાડવાની વસ્તુ, ઝાલર 2 એના પર વગાડેલો ટકોરો 3 પક્કો- ધૂર્ત, ઉસ્તાદ	ઘટા, કૌંસે કા લગરદાર ઘટા ઘટા બજને કા રવ, ડકા ચટ, ધૂર્ત, ઘાઘ	bell stroke of a bell rouge
ઘટલો	ઘટલો	પુ	ભરડવાની શાળા વિનાની ઘટી	પીસને કી બગૈર થાલે કી ચક્કી	grinding-mill without trough for flour
ઘટા	ઘટા	સ્ત્રી	ઘટ, ઘટડી	ઘટા	bell, gong
ઘટારવ	ઘટારવ	પુ	ઘટનો અવાજ-રણકો	ઘટારવ	chiming of bell
ઘટી	ઘટી	સ્ત્રી	ઘળવાનુ સાધન (હાથનુ કે યાત્રિક)	ચક્કી	grinding-mill
ઘટીચોર	ઘટીચોર	પુ	1 ચાલાક ચોર 2 ખીસાકાતરુ	ચાલાક ચોર, ઘાઝઘપ જેબકતરા	cunning thief pick-pocket
ઘટો	ઘટો	પુ	1 મોટો ઘટ	બડા ઘટા	large-sized bell or gong

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2. अेनो टकोरो	घटाशब्द, डका	chime of such a bell
			3. मोटी घटी (तुच्छशरमा)	बडी चक्की	large grinding-mill (pejorative)
धा	घा	पु	1. थोवीस शगणनो જશ્યો	दस्ता (कागज का)	quire (of paper)
			2. પ્રહાર, જખમ, ઝટકો, ચોટ	चोट	blow, stroke, wound
			3. કાપ, જખમ	घाव	cut, wound
			4. મોટા દુઃખની ઊડી અસર, આઘાત	आघात	effect of great calamity
ધાઈ	घाई	સ્ત્રી	1. ઊતાવળ, દોડાદોડી	जल्दी, जल्दबाजी, दौड़-धूप	haste, hurry
			2. ધાધલ, ધમાલ	हगामा, धौधल	mess, hubbub
			3. ભીડ, ભરાવો	भीड, मजमा	rush, crowding
ઘાઘરો	घाघरो	પુ	ચણિયો	घाघरा, लहंगा	petticoat
ઘાઘરાપાટ	घाघरापाट	પુ	ઘાઘરાનુ લૂગડુ	घाघरे का कपडा	cloth for petticoat
ઘાઘરી	घाघरी	સ્ત્રી	નાનો ઘાઘરો	छोटा घाघरा	small petticoat
ઘાટ	घाट	પુ	1. આકાર, દેખાવ	आकार, दिखावा	shape, appearance
			2. બાઘેલો આરો, ઓવારો	घाट	steps leading to the water of river or tank
			3. સ્ત્રીઓને પહેરવાનુ એક રેશમી વસ્ત્ર	स्त्रियों के पहनने का एक रेशमी वस्त्र	a kind of silken garment worn by women
			4. પહાડી રસ્તો	घाटी, पहाडी रास्ता	mountain pass
			5. સહ્યાદ્રિનો પહાડી પ્રદેશ	सह्याद्री का पहाडी प्रदेश	mountainous region of Sahyadri

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			6 प्रसंग, लाग	मौका, घात, ताक	opportunity
			7 युद्धिप्रयुद्धिथी आम डाढी लेवानी योजना, तण्णीण	भली-बुरी रीतों से काम निकाल लेने की योजना, उपाय	plot machination
			8 शीत, लक्ष्मण, शोभा	रीति, लक्षण, शोभा	manner, mark, elegance, beauty
घाटडी	घाटडी	स्त्री	1 शता रंगनु आधणीनी भातनु स्त्रीओने पड़ेरवानु रेशमी वस्त्र, यूँडी 2 गातडी	चुनरी, लाल वस्त्र गाती (गॉठ)	a kind of red silken garment for women knot at the neck of unsewn upper garment
घाटदार	घाटदार	वि	सारा घाटवाणु, रुपाणु	अच्छे आकार वाला, अच्छी सूरत वाला, रूपवान	shapely
घाटीलु	घाटीलु	वि	घाटदार, रुपाणु	सुडौल, रूपवान, सुगठित	shapely, symmetrical, beautiful
घाटु	घाटु	वि	1 घट्ट, लखडार 2 भीचोभीच 3 पुष्कण, गाढ 4 कठोर, सगीन	गाढा, लोदादार खचाखच, घना बहुत, अधिक कठोर, मजबूत, कठिन	thick congested plentiful hard, sound
घाड	घाड	वि	गुओ 'घाटु'	देखिए 'घाटु'	see 'घाटु'
घाडपु	घाडपु	न	गोण भरवानु माटलु	गुड भरने का मटका	earthen jar holding jaggery
घाडु	घाडु	वि	गुओ 'घाटु'	देखिए 'घाटु'	see 'घाटु'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या की	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
घाण	घाण	पु	1 એક ફેરે રધાય, તળાય કે કચરાય, ખડાય એટલો જથો 2 સહાર, ખરાબી 3 મોટો હથોડો, ઘણ 4 લાકડુ કોરી ખાનાર એક કોડો	घान सहार, विनाश बडा हथौडा, घन घून	quantity that can be cooked or fried or pounded at a time ruin, destruction large hammer worm eating into wood stink
ઘાણી	घाणी	સ્ત્રી	ગધ, બદબો	बदबू	
ઘાણી	घाणी	સ્ત્રી	તેલ બી પીલવાનુ યત્ર	तेलहन पेरने का यत्र, घानी	oil mill
ઘાત	घात	પુ	1 ઝટકો, ઘા 2 નાશ, ખૂન 3 'પાવર' (ગ) 4 અકાળ મૃત્યુની ઘાટી	घात, घाव, चोट नाश, खून 'पावर' अकाल मृत्यु का फॉसा	blow, stroke destruction, murder power (maths) critical time of probable untimely death
ઘાતકી	घातकी	વિ	1 ખૂની 2 ક્રૂર, નિર્દય	घातकी, खूनी, हत्यारा क्रूर, निर्दय	murderous cruel
ઘાતેલ	घातेल	ન	ઘા ઉપર ચોપડવાનુ તેલ	घाव पर लगाने का तेल	kind of oil applied to wounds
ઘાબાજરિયુ	घाबाजरियु	ન	ઘા પર કામ આવતી એક વનસ્પતિનુ ફૂલુ	एक वनस्पति की डोंडी	kind of ear of corn used for healing wounds
ઘામ	घाम	પુ	1 તાપ 2 ઉકળાટ, બકારો 3 પરસેવો	घाम उमस पसीना	heat sultriness perspiration

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धामवु	घामवु	अ क्रि	धाम थवो	धूप होना	to feel hot, to perspire
धाथो	घायो	वि, पु	1 धायल थयेलो 2 धायल थवाथी भरी गयेलो	घायल हुआ घायल होने से मरा हुआ	wounded one who has died because of wounds
धारु	घारण	न	1 धोर निद्रा 2 ओधथी धोरु ते 3 ओध लाये ओवु औपध	घोर निद्रा नीद में खरौटे लेना नीद लाने वाली दवा	deep sleep snoring soporific
धारु	घारु	न	1 रोगथी शरीरमा पडेनु नारु 2 धेटीनु पय्यु	रोग से शरीर में होने वाला छिद्र, नारु मेमना	sinus in the body caused by disease lamb
घाल	घाल	स्त्री	1 साथे जमवा वेठेलाओनी छार- ओण 2 तेमनो आणो समूह 3 नुकसान, भाघ	पगत (भोज लेने वालों की) उनका पूरा समूह घाटा, टोटा	row of people at a dinner crowd of people at a dinner loss, damage
घालजाए	घालखाद	स्त्री	जुओ 'घलात'	देखिए 'घलात'	see 'घलात'
घालजाध	घालखाध	स्त्री	जुओ 'घालजाए'	देखिए 'घालजाए'	see 'घालजाए'
घालघुसेड	घालघुसेड	स्त्री	अट्टघाल	घुसडेना और निकालना	putting in and taking out
घालघूसण	घालघूसण	न	जुओ 'घालघुसेड'	देखिए 'घालघुसेड'	see 'घालघुसेड'
घालमेल	घालमेल	स्त्री	1 अट्टघाल, गडबड सडबड 2 पयात, धमाल 3 अटपट, प्रपथ	घाल-मेल करना झंझट, पचडा प्रपच, साजिश	meddling interference intrigue

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઘાલમેલિયુ	ઘાલમેલિયુ	વિ	ઘાલમેલ કરે એવું	સાજિશી	intriguing
ઘાલવું	ઘાલવું	સ ક્રિ	1 ખોસવું, અદર મૂકવું 2 પહેરવું 3 નાણા ખાઈ જવા 4 બગાડવું, પાચમાલ કરવું	ઘાલના, ડાલના પહનના પૈસા હજમ કરના બિગાડના, પામાલ કરના	to thrust into, to pierce to put on, to wear to misappropriate to ruin, spoil
ઘાવ	ઘાવ	પુ	1 ઘા, જખમ 2 સમસ્યા	ઘાવ, જખમ સમસ્યા	wound, scar problem
ઘાવેડી	ઘાવેડી	વિ	ચતુર, ચચળ	ચતુર, ચચલ	cunning, astute
ઘાસ	ઘાસ	ન	ખડ, ચાર	ઘાસ	grass, straw
ઘાસચારો	ઘાસચારો	પુ	ઢોરનું ઘાસ ચારો વગેરે	ઘાસ-ચારા	forage
ઘાસતેલ	ઘાસતેલ	ન	ઝાસતેલ, ઘાસલેટ	મિટ્ટી કા તેલ	kerosene
ઘાસદાણો	ઘાસદાણો	પુ	ઘાસ અને દાણો(પશુ - ઓને ખવાડવાનો)	ઘાસ ઓર દાના	grass, grain etc for cattle
ઘાસપૂજો	ઘાસપૂજો	પુ	કચરોપૂજો, વાસીદું	કૂડા-કરકટ, ગોબર	dirt, sweepings
ઘાસલેટ	ઘાસલેટ	ન	ખાળવાનું એક ખનીજ પ્રવાહી, ઝાસતેલ, ઘાસતેલ	મિટ્ટી કા તેલ, કિરોસિન	kerosene
ઘાસલેટિયું	ઘાસલેટિયું	વિ	(લા) ઝલકા પ્રકારનું	ઘાસલેટી	of a low quality
ઘાસિયું	ઘાસિયું	વિ	1 જેમા ઘાસ નીપજતું હોય તેવું 2 ઘાસમાથી ઉત્પન્ન થતું 3 (લા) સત્વ વગરનું, હલકું (ધી, સોનું ઇ)	જિસમે ઘાસ હી હોતી હો ઘાસ મેં સે પૈદા હોને વાલા હલ્કા, ઘટિયા, નિસ્સત્વ	(of land) producing grass produced from grass worthless, of low quality (gold etc)

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૧. ઓઝ પક્ષી	ઞક પતી	kind of bird
ઘાસિયો	घासियो	પુ	૧ સાથરો, ઘાસનો પાથરો ૨ ઘાસ કાપનારો ૩ ઘોડાની પીઠ ઉપર નાખવાની કળી, નાસિયો	માથરા ઘાસિયારા દમિય 'નાસિયો'	bed of grass grass-mower harness
ઘાઘરડવુ	घाघरडवु	અ ક્રિ	૧ (સ્વ) ભારે ઘાટો કાઠોને— ખબ રોવુ ૨ આરડવુ (જેમ કે પાડીનુ)	કાઠે તે તૂંચ રાના કમ્પના (પદ્મ ના)	to cry or to weep loudly (of she-buffalo) to cry out (while in heat) to speak loudly
ઘાધુ	घाधु	વિ	૧ ઉતાવળુ ૨ ગભરાયેલુ	ગલા પાડફર ત્રાલના	gala padder tralna
ઘાથ	घाथ	સ્ત્રી	૧ ચીલામા પડેલો ખાડો, ખાડો ૨ ગૂંચ, મુશ્કેલી	ઉતાવલા, અધીર ઘવરાયા હુઆ મડ્ડા	tussy, hasty confused depression in cart-rut hitch obstacle
ઘાચણ	घाचण	સ્ત્રી	ઘાચી સ્ત્રી	તેલિન	Ghanchi woman
ઘાંચી	घाची	વિ	ઘાણી ચલાવી તેલ કાઢવાનો ને તે ચા દૂધ વેચવાનો ઘઘો કરતી ચાતનુ	તેલ યા દૂધ વેચને વાલા	of a caste whose members do the work of running oil- press and sell oil or milk
		પુ	તે ચાતનો માણસ	તેલી, ઘોસી	member of that caste
ઘાટી	घाटी	સ્ત્રી	૧ ઘાટા કે કઠની-પડજીભની જગા, હેડિયો	ઘાંટી, કૌઆ, ટેંટુઆ	Adam's apple

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	व्या. को.	ગુજરાતી अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			2 અવાજ, સૂર 3 ઘાટ, બે પર્વતની કે કુગરાની વચ્ચેનો સાકડો રસ્તો 4 (લા) મુશ્કેલીનો, બારીક સમય 5 હરકત, અડચણ	आवाज, सुर घाटी, दर्रा मुश्किल और नाजूक अवसर अडचन, कठिनाई	voice narrow pass between mountains critical or delicate situation obstacle, difficulty
ઘાલો	घाटो	पु	1 કઠ, સાદ 2 મોટો સાદ, બૂમ 3 ખિન્નાઈને કાઢેલો સાદ 4 મોટી ઘાટી-કુગરાળ રસ્તો	आवाज ऊँची आवाज, पुकार, हॉफ घुडकी घाटी, दर्रा	voice loud voice angry tone mountainous path
ઘિલોડ	घिलोडी	स्त्री	1 એક શાકનો વેલો, ઘિલોડી 2 એક ઝેરી જાનવર	कूंदरू (बेल) छिपकली	kind of creeper lizard
ઘિલોડુ	घिलोडु	न	ઘિલોડીનું ફળ-ઘલોડુ	कूंदरू (फल)	fruit of 'ઘિલોડી'
ઘિસોડ	घिसोडी	स्त्री	તૂરિયાનો વેલો	तोरी (बेल)	kind of vegetable creeper
ઘિસોડુ	घिसोडु	न	તૂરિયુ	तोरी, तोरई	kind of vegetable
ઘિસ્સો	घिस्सो	पु	એકદમ જોરથી પડેલો ધસરકો	घिस्सा, रगडा	cut or scratch caused by sudden strong blow
ઘી	घी	न	ઘૂત, તૂપ	देशी घी	ghee, clarified butter

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
ઘીકેળા	घीकेळा	न	1 ઘી અને કેળા 2 (લા) ભારે લાભ	घी और केले बडा लाभ, पॉचों घी में होना	ghee and banana great profit or gain (fig)
ઘીતેલુ	घीतेलु	न	પોચણીના છોકને થતુ ફળ	कँवलगट्टा	bulb at the root of lotus plant
ઘીસ	घीस	સ્ત્રી	1 રોન 2 હોળીનો વરઘોડો 3 માર, ઠોક 4 ઘિસ્સો 5 ચોરી, ગીસ	रौंद, गश्त होली का जुलूस मार, पिटाई खरोंच चोरी	patrol the Holi procession beating scratch, cut theft
ઘીસરુ	घीसरु	न	ઘૂસરુ	जुआ, जुआठा	yoke of a plough
ઘુઘરવટ	घुघरवट	સ્ત્રી	ઘાઘરાના ઘેરની નીચેની ઘૂઘરીઓવાળી ઝૂલ	घेरदार घाघरे की घुँघरुदार किनारी	border with small bells, attached to the lower circumference of petticoat
		પુ	ઝૂલ પર ઘૂઘરીઓની હાર હોય એવો ઘાઘરો	ऐसी किनारी वाला घाघरा	petticoat of this sort
ઘુઘરિયાળુ	घुघरियाळु	વિ	ઘૂઘરીઓવાળુ	घुँघरुदार	having bells
ઘુઘવાટ	घुघवाट	પુ	ઘૂઘવવુ તે	गर्जना	roar
ઘુઘવાટો	घुघवाटो	પુ.	ઘૂઘવાટ	गर्जना	see 'ઘુઘવાટ'
ઘુઘાટ	घुघाट	પુ.	જુઓ 'ઘુઘવાટ'	देखिए 'ઘુઘવાટ'	see 'ઘુઘવાટ'
ઘુઘ્યો	घुच्चो	પુ	જુઓ 'ઘુઘ્યો'	देखिए 'ઘુઘ્યો'	see 'ઘુઘ્યો'
ઘુણ	घुण	પુ	લાકડુ કોરી ખાનારો એક કીડો	घून	kind of worm eating into wood

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धुमरडी	धुमारडी	स्त्री	1 अडाअरे इरवु-नाथवु ते, इडडी 2 इरे, अक्कर 3 छीओणवु ते	धुमडी चक्कर (घूमना) झुलाना	moving or dancing in a circle giddiness, vertigo swinging
धुमावु	धुमावु	स क्रि	'धूमवु' नु प्रेरक	धुमाना	causal of 'धूमवु'
धुमावु	धुमावु	अ क्रि	'धूमवु'नु भावे	'धूमवु' का भावे रूप	passive of 'धूमवु'
धुम्भो	धुम्भो	पु	गुम्भो, धीलओ, मुक्को	घोंसा, मुक्का	blow with fist, box
धुरअवु	धुरकावु	स क्रि	'धूरकवु'नु प्रेरक	'धूरकवु' का प्रेरणार्थक रूप	causal of 'धूरकवु'
धुरडियु	धुरकियु	न	1 धूरकवानो अवाज 2. छाडियु, गुस्सानो बोल	गुराहट धमकी भरी डोंट, घुडकी	sound of growling angry word
धुरधुर	धुरधुर	अ	तेवो अवाज	'धुरधुर' आवाज	(sound as of) growling
धुरधुराट	धुरधुराट	अ	जुओ 'धुरधुर'	'धुरधुर' आवाज	see 'धुरधुर'
धुवड	धुवड	पु, न	शत्रे ज देपी शअतु अेक पक्षी	उल्लू	owl
धुसणियु	धुसणियु	वि	गमे तेम करीने धूसनारु, तेवा स्वभावनु	धुसने के स्वभाव वाला	of a pushing nature
धुसपुस	धुसपुस	अ	छानी शते, बीजा सावणी न जाय अे शते	फुस से	talk carried on in whispers
		स्त्री	माछोमाछे गुपचुप धीमी वातो उरवी ते, गुसपुस	कानाफूसी	gossip in low tone

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धुसाडवु	घुसाडवु	स क्रि	पेसाडवु, धजल करवु	घुसेडना	to thrust, to push in
धुसाववु	घुसाववु	स क्रि	'धूसवु' नु प्रेरक	'धूसवु' का प्रेरणार्थक रूप	causal of 'धूसवु'
धुसावु	घुसावु	अ क्रि	'धूसवु' नु भावे	'धूसवु' का भावे रूप	impersonal construction of 'धूसवु'
धुमट	घुमट	पु	1 દેરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબુ, ગુબજ 2 ધુમટ નીચેનો દેરાનો અદરનો ભાગ	गुबद गुबद के नीचे का मंदिर के अंदर का हिस्सा	dome portion beneath the dome of temple
ધૂદર	घूघर	स्त्री	धूधरी	घुँघरु	jingle bell
ધૂદરમાળ	घूघरमाळ	स्त्री	(બળદની કોટે બાધવાની) ધૂધરાની માળા	घटियों की माला	string of small bells (esp tied round neck of bullock)
ધૂધરી	घूघरी	स्त्री	1 ધાતુના પતરાની પોલી ખણખણતી ગોળી 2 સ્ત્રીઓના હાથનું ધુધરિયાળું એક ઘરેણું 3 એક રમકડું, નાનો ધૂધરો 4 બાફેલી જીર-બાજરી વગેરે	घुँघरु स्त्रियों के हाथ में पहनने का घुँघरुदार एक गहना एक खिलौना, छोटा झुनझुना उबाली हुई ज्वार-बाजरा आदि	little jingling bell bracelet with jingling bells worn by women on arms a toy, small rattle boiled millet or jowar
ધૂધવવુ	घूधववु	अ क्रि	1 'ધૂધૂ' એવો અવાજ કરવો 2 ગર્જવુ	'घूधू' आवाज करना गर्जना करना	to hoot (of owl) to roar (of sea)

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ધૂધવાવુ	घूधवावु	અ ક્રિ	ધૂ ધૂ અવાજ કરવો	'घूघू' આવાજ કરના	to hoot
ધૂધૂ	घूधू	અ	(રવ) રેલગાડી, સમુદ્ર વગેરેનો રવ	'घूघू' આવાજ	sound as of railway train, sea etc
ધૂડ	घूड	પુ, ન	જુઓ 'ધુવડ'	उल्लू	see 'धुवड'
ધૂણિયો	घूणियो	પુ	દેગડો	देग	vessel (made of metal) to store water
ધૂનો	घूनो	પુ	ખાઈ	खाई	creak
ધૂમ	घूम	અ	1 (તર્કમા) ગરક-લીન 2 (નશાથી) ચકચૂર-બેભાન	(તર્ક મેં) गरक, लीन (नशे में) चूर, बदमस्त	absorbed in thought intoxicated
ધૂમચી	घूमची	સ્ત્રી	ધુમરડી, ચકાકારે ફરી વળવુ તે	घुमडी	whirling round and round
ધૂમચો	घूमचो	પુ	જથ્થો, સમૂહ	समूह	collection, bulk
ધૂમટ	घूमट	પુ	1 દેરા અથવા મકાન ઉપરનુ છત્રાકાર ધાબુ, ગુબજ 2 ધુમટ નીચેનો દેરાનો અદરનો ભાગ	देखिए 'धुमट'	dome
ધૂમટો	घूमटो	પુ	ધૂધટ	घूँघट	veil
ધૂમડવુ	घूमडवु	સ ક્રિ	1 હાંચોળવુ 2 ચકર ચકર ફેરવવુ	झुलाना चक्कर खिलाना, घुमाना	to rock in a cradle to turn round and round
ધૂમરી	घूमरी	સ્ત્રી	1 વમળ, ભમરો	भँवरी, घुमरी	whirlpool

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			2 धूमडी, धुमरडी	घुमडी	turning or whirling round and round
			3 तोर डे अभिमानमा (मदनी पेठे) आपो अडणवडण शवी	तेवर बदलना	rolling the eyes in a fit of pride
धूमवु	घूमवु	अ क्रि	1 गोल इरवु 2 रभडवु 3 (ला) मोटो दरभार इरवो 4 मय्या रडेवु	चक्कर खाना, गोलाकार में घूमना बेकार घूमना बड़ा कारोबार चलाना लगा रहना, जारी रहना	to go round in a circle to wander aimlessly to run business to be engrossed in
धूमाधूम	घूमाघूम	स्त्री	उरडूर, दीडवाम	बार-बार आना-जाना, दौडा-दौडी	roaming here and there
धूमाधूमी	घमाघूमी	स्त्री	जुओ 'धूमाधूम'	देखिए 'धूमाधूम'	see 'धूमाधूम'
धूरडवु	घूरकवु	अ क्रि	1 धुरधुर इरवु 2 ज़ोरथी भसवु 3 (ला) गुस्सामा घाटो पाडवो, तडडवु	घुरघुराना, गुर्गना जोर से भूंकना घुडकना, तडकना	to growl to bark loudly to speak sharply in anger
धूरअधूरध्री	घूरकाघूरकी	स्त्री	साभसाभे धूरडवु ते	परस्पर घुडकना	growl at each other
धूलर	घूलर	न	1 गूलर, उमरडी 2 अननु धरेणु	गूलर, उदुवर कान का एक गहना	kind of fig-tree kind of ear-ornament
धूलरो	घूलरो	पु	उमरडी	उदुवर, गूलर	kind of fig-tree
धूस	घूस	पु	उ डर, श्रेण	घूस, एक तरह का बड़ा चूहा	rat
धूसण	घूसण	न	धूसवु ते, पगर उडनो प्रवेश	घुसना, अनधिकार प्रवेश	to gate-crashing

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		वि	धूसीशियु	किसी प्रकार से घुसने वाला	pushing, officious
धूसयु	धूसवु	अ क्रि	जोरशी के गमे तेम डरी पेसी ज्यु	घुसना	to enter forcibly or anyhow
धूसियु	घूसियु	न	उधरियु	चूहेदान	rat-trap
धूसियु मध	घूसियु मध	न	अेक जातनी अीएरी माजोअे अनावेले मध	एक तरह की छोटी मधुमक्खियों का शहद	honey made by bees in honey- comb
धूट	घूघट	पु	धूमटो, स्त्रीओ मो पर अपडु ढाके छे ते	घूँघट	veil (used by women to cover face)
धूटो	घूघटो	पु	जुओ 'धूट'	घूँघट	see 'धूट'
धूट	घूट	पु	1 धूटो 2 घाटो, अठ	घूँट आवाज, कठ	sip of liquid voice
		स्त्री	(जुवनु) धूटावु-गूगणावु ते	(दम) घुटना	suffocation
धूटो	घूटडो		गणा वाटे अेअी वजते उतरि शके तेटलो प्रवाळी पधार्थ	घूँट (पेय)	mouthful of liquid, liquid dose
धूटण	घूटण	न	ढीअण	घुटना	the knee
धूटशियु	घूटणियु	न	जुओ 'धूटण'	घुटना	see 'धूटण'
धूटवु	घूटवु	स क्रि	1 लसोटवु, पीसवु 2 धेरवु, रोधवु (श्वासने) 3 अभ्यासशी- पुनावर्तशी पाडु डरवु (अक्षर, राज छ)	घोटना, पीसना, रोकना या घाटना (दम को) (अक्षर) घोटना, (राग) रटना, अभ्यास करना	to grind to powder to hold one's breath to revise, by passing one's pen over the letters in a copy-book

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धूटावपु	घूटावपु	स क्रि	'धूटपु' नु प्रेरक	'धूटपु' का प्रेरणार्थक रूप	causal of 'धूटपु'
धूटापु	घूटापु	अ क्रि	'धूटपु' नु कर्मणि	'धूटपु' का कर्मणि	pass of 'धूटपु'
धूटी	घूटी	स्त्री	1 पगनी पाटली अने नणाने णेडनार साधा आगणनु छडकु 2 गणथूथी	टखना घूँटी	ankle medicinal do given to ne born child
			3 गूथवार, भरस पडाय अेवी मुश्केली	उलभन, फँसाव	complication
धेधूर	घेघूर	वि	मस्त, थक्युर	घना, छतनार (पेड), मतवाला, (नशे में) चूर	thick (tree), deeply intoxicated
धेठी	घेठी	स्त्री	धेटानी माध	भेड	ewe (sheep)
धेदु	घेटु	न	जेना शरीर उपर ान शाय छे ते प्राणी	भेड	sheep
धेटो	घेटो	पु	धेटानो नर	नर भेड, भेडा	m sheep
धेन	घेन	न	1 नशो, डेड, सुस्ती 2 मध, अभिमान	नशा, सुस्ती मद, बदहोशी, अभिमान	drowsiness, lethargy pride
धेबर	घेबर	न	अेक वानी-मडवान	घेवर	kind of sweetmeat
धेबरु	घेबरु	न	जुओ 'धेबर'	घेवर	see 'धेबर'
धेर	घेर	अ	1 धरे, धरमा, धर तरड 2 धेरव 3 समूह, टोणी	घर पर, घर में, घर की ओर घेरा, घेर समूह, टोली	in the house, at home circumference group, gang
		स्त्री	1 ओर परनो भाग	किनारी का हिस्सा	bōrder

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 धेरैथानु टोणु, ढोणु भेलवा नीडणेदी टोणु	होली खेलने वाले लडकों की टोली	the Holi procession
धेरण	घेरण	स्त्री	1 धेरी लेवु ते 2 धाशण	घेरना नशा, असर	encircling intoxication effect
धेरदार	घेरदार	वि	1 धेरवाणु 2 भूलतु, थपसीने नडि अेवु	घेरदार खुला, जो कसता न हो	having a large circumference loose
धेरना	घेरना	स क्रि	1 थारे तरड वीटणाड वणवु 2 (पशुने) पाशी पावु	घेरना चौपायों को पानी पिलाना	to surround, to encircle to give water to cattle
धेरव	घेराव	पु	1 धेर, थारे तरडनो विस्तार 2 धेरवु ते, शेकाश, अटकायत	घेरा, घेराव, चारों ओर का विस्तार घेरना, अवरोध, रोध	circumference siege
धेरवु	घेरावु	अ क्रि	1 'धेरवु' नु धर्भाश 2 सपडावु, धेरमा आपी णवु 3 धेरु थवु, व्यापवु	घिरना, घेरा जाना फँसना, घेरे में आना पलकें भारी होना, घिरना, फेलना	pass of 'धेरवु' to be encircled, to be trapped to deepen (of eyes)
धेरवो	घेरावो	पु	णुथो 'धेरव'	देखिए 'धेरव'	see 'धेरव'
धेरिया	घेरिया	न	अेड पक्षी	एक पक्षी	kind of bird
धेरु	घेरु	वि	1 गाढ, पाडु, धाशी मात्रामा रगवाणु 2 डीडु, गडन 3 थडयूर, भुभारीवाणु	गाढा, पक्का, कभी न छूटने वाला गहरा, गहन खुमारभरा, नशीली (आँखें)	deep (of colour) profound touched with pride
धेरे	घेरो	पु	1 धेरी लेवु ते	घेरा	seige

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
घोडागाडी	घोडागाडी	स्त्री	घोडा वडे जेखाती गाडी	घोडागाडी	horse-drawn carriage
घोडाचियो	घोडाचियो	पु	अेड जगतनु घास	एक तरह की घास	kind of grass
घोडापूर	घोडापूर	न	घोडानी जेम अेडधम धसी आवतु मोटु पूर	(घोडे की तरह) यकायक आने वाली बडी बाढ	big flood coming down suddenly
		अ	तेनी जेम, जेशशी	जोश से	with the force of such flood
घोडामूँ	घोडामूँ	स्त्री	अेड वनस्पति, औषधि	एक वनस्पति-औषध	a kind of medicinal plant
घोडार	घोडार	स्त्री	घोडा बाधवानी जगा, तबेलो	इस्तबल	stable
घोडावज	घोडावज	स्त्री	अेड वनस्पति-औषधि	घोडबच, घोडाबच	kind of medicinal plant
घोडासर	घोडासर	स्त्री	घोडार	इस्तबल, घुडसाल	stable
घोडियु	घोडियु	न	अेड जगतनु पारण	पालना	cradle
घोडी	घोडी	स्त्री	1 घोडानी माध 2 जेनी उपर डोँ वस्तु मुझाय अथवा गोठवाय डे टगावाय अेवी लाडडा डे धातुनी बनावट	घोडी घोडी	mare stand
			3 जेनो टेडो लड थलाय अेवी लाडडी	बैसाखी	crutch
			4 डिये थडवानी निसरणी जेवा पगथियावाणी बनावट	ऊचे चढने का सीढियों वाला नसेनी जैसा लकडी का साधन	ladder
घोडी (अणी)	घोडी	स्त्री	अझर	अफीम	opium
घोडी (लाल)	घोडी	स्त्री	धर	शराब	wine

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
घोडा (लीली)	घोड़ी	स्त्री	भाग	भौंग	bhanga, Indian hemp
घोडु	घोड़ु	न	1 घोडो अथवा घोडी 2 नानु अथवा दुर्बल घोडु, टट्टु 3 छयदण, घोडानो समूह	घोडा या घोड़ी छोटा या दुर्बल घोडा, टट्टु रिसाला	horse small weak horse, pony cavalry
घोडे	घोडे	अ	गोडे, पेडे	-के अनुसार, -की मौति	like
घोडेसवार	घोडेसवार	पु	घोडा उपर सवारी करनासे माणस के सिपाह	घुडसवार	rider
घोडेसवारी	घोडेसवारी	स्त्री	घोडेसवार थपु ते	घुडसवारी	riding
घोडे	घोडो	पु	1 सवारीनु अेक पशु, अश्व 2 नदी के दरियानु मोटु भोजु, लोट 3 घोडा आकरनी णडी नकशीदार पीटी 4 चाप-डण 5 मोटी घोडी, छेठ वस्तु भूडवा माटे बनावेले उभेडु थोडहु 6 चार पापीडीनु डपासनु डालु 7 अगूठानी पासेनी आगणी उपर पडेरवानु अेक रुपानु धरेणु	घोडा नदी या समुद्र की उत्ताल तरंग घोडा घोडा चौगोडिया	horse bore ornamental peg spring rack
घोयु	घोयु	न	ज्जम	घाव, जखम	wound
घोर	घोर	वि	1 जिछाभाणु	घोर, डरावना	frightful, terrible

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 रोड्राण, अटश्रव 3 समूह, धयूमलो	रोक समूह, झुरमुट (पेडो का)	detention multitude
धेलेध	धेलछा	स्त्री	1 धेलापण, गाडपण 2 धून	पागलपन सनक, धुन	madness craze
धेलाध	धेलाई	स्त्री	जुओ 'धेलेछा'	देखिए धेलेछा'	see 'धेलेछा'
धेलु	धेलु (घँ)	वि	1 गाडु, अकल वगरनु 2 गाडपण	पागल, बुद्धिहीन पागलपन	mad, senseless madness
धेवर	धेवर	न	जुओ 'धेवर'	धेवर	see 'धेवर'
धेघट	धेघट	वि	ॐध डे डेश्ठी धेशथेलु	नीद या नशे में बेहोश	drowsy, sleepy
		स्त्री	परसाध अधार्यो ढोय अेवी आगशनी स्थिति	बादल छाया आकाश	overcast (of sky)
धेश	धेश	स्त्री	भावानी अेक डलडी वानी-भरडकु	महेरी	porridge cooked in whey
धेस	धेस	स्त्री	जुओ 'धेश'	महेरी	see 'धेश'
धैयु	धैयु	न	भाडो, भाधरो	गड्ढा	ditch
धो	धो	स्त्री	गरोणीना आडरनु अेक डेरी प्राणी	गोह	iguana
धोगधारी	धोगधारी	स्त्री	अेक वनस्पति- औषधि	एक वनस्पति	kind of medicinal herb
धोधर	धोघर	पु	1 भारे भाथानो जगली भिलाडो 2 भाणडने भिवडाववानो डो	बडे सिर वाला जगली बिल्ला बच्चों को डराने वाला हाऊ, हौत्रा	wild cat bogey to scare children
		न	अेक पक्षी	एक पक्षी	name of a bird

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઘોઘર બિલાડો	घोघर बिलाडो	પુ	ભારે માથાનો જગલી બિલાડો	बड़े सिर वाला जगली बिल्ला	wild cat
ઘોઘરુ	घोघरू	વિ	ખોખરુ-ભારે સાધવાળુ	मोटी आवाज वाला	hoarse
ઘોઘરો(-ળો)	घोघरो (-ळो)	પુ	1 ભારે સાદ, ઘાટો 2 ગળાના જે ભાગમાંથી અવાજ નીકળે છે તે	मोटी आवाज, हॉक गले का वह हिस्सा जिसमें से आवाज निकलती है	hoarse, heavy voice throat
ઘોઘે	घोघो	વિ પુ	અભણ, મૂર્ખ માણસ 1 સાપ 2 મોમાથુ ઢકાય એમ ઓઢવુ તે, ઘઘોલિયુ	अनपढ़, मूर्ख सॉप घुघी ओढना	unlettered or foolish person serpent face completely covered with a quilt
ઘોઘોઈ	घोघोई	ન	એક પક્ષી	एक पक्षी	kind of bird
ઘોચ	घोच	સ્ત્રી	ઘોચવુ-ઘોચાવુ તે, ઘોચાયાની અસર	चुभने का असर, चुभन	prodding
ઘોચપરોણી	घोचपरोणी	સ્ત્રી	વારે વારે પરોણો ભેડવો તે	बार-बार पैना चुभाना	frequent prodding
ઘોચપરોણો	घोचपरोणो	પુ	જુઓ 'ઘોચપરોણી'	देखिए 'घोचपरोणी'	see 'घोचपरोणी'
ઘોચવુ	घोचवु	અ ક્રિ	ઘોચવુ, ભેડવુ	भोकना	to pierce, to prick
ઘોડદોડ	घोडदोड	સ્ત્રી	1 ઘોડાઓની દોડવાની હરિફાઈ 2 એને માટેનુ મેદાન અથવા રસ્તો	घुडदौड घुडदौड का मैदान या मार्ग	horse race race track
ઘોડવહેલ	घोडवहेल	સ્ત્રી	ઘોડા જોડવાની વહેલ, ઘોડાગાડી	घोडागाडी	horse-drawn carriage

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 रोकण, अटकाव 3 समूह, ध्यूमलो	रोक समूह, झुमट (पेड़ों का)	detention multitude
धेलेध	धेलछा	स्त्री	1 धेलापाण, गाडपाण 2 धून	पागलपन सनक, धुन	madness craze
धेलाध	धेलाई	स्त्री	જુઓ 'ધેલછા'	देखिए 'धेलेछा'	see 'धेलेछा'
धेलु	धेलु (घँ)	वि	1 गाडु, अक्कल पगरनु 2 गाडपाण	पागल, बुद्धिहीन पागलपन	mad, senseless madness
धेवर	धेवर	न	જુઓ 'ધેવર'	धेवर	see 'धेवर'
धेधट	धेघट	वि	ઊધ કે કેડથી ધેરથેલુ	नींद या नशे में बेहोश	drowsy, sleepy
		स्त्री	વરસાદ અધાર્યો હોય એવી આકાશની સ્થિતિ	बादल छाया आकाश	overcast (of sky)
धेश	धेश	स्त्री	ખાવાની એક હલકી વાની-ભરડકુ	महेरी	porridge cooked in whey
धेस	धेस	स्त्री	જુઓ 'ધેશ'	महेरी	see 'धेश'
धैथु	धैथु	न	ખાડો, ખાધરો	गड्ढा	ditch
धो	धो	स्त्री	ગરોળીના આકારનું એક ઝેરી પ્રાણી	गोह	iguana
धोगधारी	धोगधारी	स्त्री	એક વનસ્પતિ- ઔષધિ	एक वनस्पति	kind of medicinal herb
धोधर	धोधर	पु	1 ભારે માથાનો જગલી ખિલાડો 2 ખાળકને ખિવડાવવાનો હાઉ	बड़े सिर वाला जगली बिल्ला बच्चों को डराने वाला हाऊ, हौवा	wild cat bogey to scare children
		न	એક પક્ષી	एक पक्षी	name of a bird

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
घोडी (ભીલ્લી)	घोड़ी	स्त्री	भाग	भौंग	bhanga, Indian hemp
घोડુ	घोड़ु	न.	1 घोडो अथवा घोडी 2 नानु अथवा दुर्बल घोडु, टट्टु 3 उथएण, घोडानो समूह	घोडा या घोडी छोटा या दुर्बल घोडा, टट्टु रिसाला	horse small weak horse, pony cavalry
घोडे	घोडे	अ	गोडे, पेठे	-के अनुसार, -की भौंति	like
घोडेसवार	घोडेसवार	पु	घोडा उपर सवारी करनारे भाणस के सिपाई	घुडसवार	rider
घोडेसवारी	घोडेसवारी	स्त्री	घोडेसवार शयु ते	घुडसवारी	riding
घोडे	घोडो	पु	1 सवारीनु अेक पशु, अश्व 2 नदी के दरियानु मोटु मोणु, लोट 3 घोडा आकारनी भाडी नकशीदार भाटी 4 चाप-कण 5 मोटी घोडा, ओछ वस्तु भूडवा माटे बनावेनु उमेडु चोडु 6 चार पाभाडीनु कपासनु अलु 7 अगूठानी पासेनी आगणी उपर पडेरवानु अेक रुपानु घरेणु	घोडा नदी या समुद्र की उत्ताल तरण घोडा घोडा चौगोडिया	horse bore ornamental peg spring rack
घोयु	घोयु	न	ज्जम	घाव, जखम	wound
घोर	घोर	वि	1 बिडामणु	घोर, डरावना	frightful, terrible

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
घोडागाडी	घोडागाडी	स्त्री	घोडा वडे जेयाती गाडी	घोडागाडी	horse-drawn carriage
घोडाचिथो	घोडाचियो	पु	अेड जातनु घास	एक तरह की घास	kind of grass
घोडापूर	घोडापूर	न	घोडानी जेम अेडधम धसी आपतु मोटु पूर	(घोडे की तरह) यकायक आने वाली बडी बाढ	big flood coming down suddenly
		अ	तेनी जेम, जेशथी	जोश से	with the force of such flood
घोडाभूँ	घोडाभूँ	स्त्री	अेड वनस्पति, औषधि	एक वनस्पति-औषध	a kind of medicinal plant
घोडार	घोडार	स्त्री	घोडा बाधवानी जगा, तलेलो	इस्तबल	stable
घोडावज	घोडावज	स्त्री	अेड वनस्पति-औषधि	घोडवच, घोडावच	kind of medicinal plant
घोडासर	घोडासर	स्त्री	घोडार	इस्तबल, घुडसाल	stable
घोडियुं	घोडियुं	न	अेड जातनु पारण	पालना	cradle
घोडी	घोडी	स्त्री	1 घोडानी माध 2 जेनी उपर डेध वस्तु मुडाय अथवा गोठवाय डे टगावाय अेवी लाडडा डे धातुनी बनावट	घोडी घोडी	mare stand
			3 जेनो टेडे लध अलाय अेवी लाडडा	बैसाखी	crutch
			4 उये अडवानी निसरणी जेवा पगथियावाणी बनावट	ऊचे चढने का सीढियों वाला नसेनी जैसा लकडी का साधन	ladder
घोडी (अणी)	घोडी	स्त्री	अशीरा	अफीम	opium
घोडी (लाला)	घोडी	स्त्री	धर	शराब	wine

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
घोरभव	घोरभव	अ क्रि	गोरभावु, वाढणा यडी आपवा, घेरावु	घिरना, बादलों का उमडना, घुमडना	to be over- spread with clouds
घोरभावु	घोरभावु	अ क्रि	જુઓ 'घोरभवु'	देखिए 'घोरभवु'	see 'घोरभवु'
घोरभो	घोरभो	पु	1 गोरभावु ते, गूथवण 2 घेरे 3 वाढणा यडी आपवा	मुश्किल, आकाश में घने बादल छा जाना घेरा, घेराव बादलों का उमडना	being over-cast with clouds seige onset of clouds
घोर	घोरी	वि	ઊઘારાશી	खर्राटेबाज	given to excessive sleep
		पु	ઢોરનુ ઢોળુ	चौपायों का समूह	herd of cattle
घोलड	घोलक	स्त्री	સાવ નાનુ અધારુ ઘર, 'સ્લમ'	घरौदा	slum
घोलश्र	घोलकी	स्त्री	જુઓ 'घोलड'	छोटा घरौदा	see 'घोलड'
घोलकु	घोलकु	न	ઘોલક, ઘોલશ્ર	घरौदा	howel
घोली	घोली	स्त्री	ઘિલોડીનો વેલો	कुंदरू की बेल	name of a vegetable creeper
घोलु	घोलु	न	1 ઘિલોડુ 2 આડખીલી, ડખલ	कुंदरू (फल) दखल, अवरोध	name of a vegetable hitch, obstacle
घोस्यु	घोत्स्यु	न	ખસ્તી નહિ કરેલો એવો નાનો ખળદ	खसी नहीं किया हुआ छोटा बैल	an uncastrated bull
घोणवु	घोळवु	स क्रि	1 ફરતેથી ઢાખીને નરમ કરવુ 2 ઓગાળવુ 3 મેળવવુ	पिलपिलाना घोलना मिलाना	to soften by pressing on all sides to dissolve to mix

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 કમકમાટી ઉપજાવે એવું	सिहरन पैदा करने वाला, रोये खडे करने वाला	causing shudder
			3 ગાઢ, અત્યંત	गाढा, घन, अत्यंत	deep excessive
ઘોર	घोर	स्त्री	મડદુ ઘાટવાનો ખાડો, કબર	गोर, कब्र	grave
ઘોર	घोर	पु	1 ઘોર અવાજ કે રણકો	गूँज	bass voice or sound
			2 તબૂરા ઇ મા ખરજ સ્વરના તારનો ઘોર અવાજ કે રણકો	तबूरा आदि में षड्ज के स्वरों के तार की आवाज या गूँज	bass of musical instrument like <i>tambura</i>
			3 ઊઘમા નાક ખોલવાનો અવાજ	खर्राटा	snoring
ઘોરખોદિયો	घोरखोदियो	पु	1 ઘોર ખોદનારો	गोरकन	grave-digger
			2 ઘોર ખોદી મડદા કાઢી ખાનારુ એક પ્રાણી	गोर खोदकर मुर्दे खा जाने वाला एक प्राणी	animal that ferrets graves
			3 (લા)હીણુ કામ કરનારો	हीन कर्म करने वाला	doer of base deeds
ઘોરખોદુ	घोरखोदु	वि	ઘોર ખોદે એવુ વિનાશક	विनाशक	destructive
ઘોરખોદુ	घोरखोदु	न	એક પ્રાણી, ઘોરખોદિયો	गोर खोदकर मुर्दे को खा जाने वाला एक प्राणी	kind of animal
ઘોરણ	घोरण	न	1 ઘોરવુ-ખૂબ ઊઘવુ તે	गहरी नींद लेना, खर्राटे लेना	excessive sleep
			2 નસકોશ ખોલવા તે, એથી થતો અવાજ	खर्राटे लेना	sound of snoring
ઘોરવુ	घोरवु	अ क्रि	1 (ઊઘમા) નસકોશથી શખે કરવો	खर्राटे लेना	to snore
			2 ઘસઘસાટ ઊઘવુ	गहरी नींद सोना	to sleep fast

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. क्रो.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थडसो	चकलो	पु	1 नर थडलु, अेक पणी 2 थडलु डे थडलामा जेसतु भणर	नर चिडिया, चिडा चौक में लगने वाला बाजार	sparrow, any small bird market-square
थडणवडण	चकळवकळ	वि अ	थडित, व्याडुण आडुणव्याडुण	चकित, दग, व्याकुल, भौचक आकुल-व्याकुल, हक्का- बक्का	astonished, impatient bewildered, uneasy
थडणविडण	चकळविकळ	वि	जुओ 'थडणवडण'	देखिए 'थडणवडण'	see 'थडणवडण'
थडित	चकित	वि	छड थड गयेलु, आश्वर्य पामेलु	दग, चकित, भौचक	astonished, shocked into disbelief
थडेतरुं	चकोतर	न	मोटा लींजु जेवु अेक डुण, पपनस	चकोतरा	kind of fruit, pompelmoose
थडेतरो	चकोतरो	पु	जुओ 'थडेतरुं'	चकोतरा	see 'थडेतरुं'
थडेत्रा	चकोत्रा	न	अेक पक्षी	एक पक्षी	kind of bird
थड	चक्र	न	1 पैडु 2 धारवाणु अेक गोण उशियार 3 'विष्णु'नु अेक उशियार- सुदर्शन थड 4 डूडणु, गोणडार 5 धारु मोटु राज्य 6 समूह, समुदाय, मडण	चक्र, चाका, पहिया धारदार गोल औजार, चक्का 'विष्णु' का एक आयुध, सुदर्शन चक्र मडलाकार रेखा, वृत्त, घेरा बहुत बडा राज्य समूह, समुदाय, मडल	wheel disc with sharp edge (a weapon) Sudarshan (a weapon of God Vishnu) circle empire, vast kingdom multitude, assemblage, association

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 જોરથી ધૂમડવુ	जोर से घुमाना	to cause to swing or turn briskly
ઘોળાઘોળ	घोळाघोळ	स्त्री	1 ખૂબ ઘોળવુ તે 2 (લા) મનમા વિચાર ઘોળાયા કરવો તે, મનની અનિશ્ચિત સ્થિતિ	बहुत घोलना उधेड-बुन, मन की डोंवाडोल स्थिति	shaking about briskly brooding
ઘોળાઘોળી	घोळाघोळी	स्त्री	જુઓ 'ઘોળાઘોળ'	देखिए 'घोलाघोल'	see 'घोलाघोल'
ઘોળાવું	घोळावु	स क्रि	'ઘોળવુ' નુ કર્મણ	'घोणवु' का कर्मणि रूप	pass 'घोणवु'
ઘોળયુ	घोळयु	वि	1 ઘોળેલુ-ઘૂટેલુ 2 બળ્યુ, મૂઠું	घोला हुआ मुआ (गाली)	mixed upon damned, 'damn!'
ચક	चक	पु	1 બારણા પર નાખવાનો સળીઓનો પડદો, જાળીદાર અતરપટ 2 (સ્ત્રીઓનું) એક ઘરેણું 3 કુભારનો ચાક 4 બચકું	जालीदार परदा, चिक स्त्रियों का एक गहना, चक चाक (कुम्हार) बतीसा, काट	curtain made of bamboo chips, screen of netted cloth kind of ornament worn by women potter's wheel bite
ચકલુ	चकलु	न	1 મહોલ્લા આગળની છૂટી જગા 2 ચાર રસ્તા મળતા હોય એવું નાકું	मुहल्ले के आगे की खुली जगह, चौक चौमुहानी, चौराहा, चौक	open space in a street square
ચકલેદાર	चकलेदार	पु	ચકલાનો રખવાળ-પોલીસ	मुहल्ले का चौकीदार, पुलिस	policeman in charge of an open space in a street

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अडलो	चकलो	पु	1 नर अडलु, अेड पणी 2 अडलु डे अडलाभा जेसतु पणर	नर चिडिया, चिडा चौक में लगने वाला बाजार	sparrow, any small bird market-square
अडणवडण	चकळवकळ	वि अ	अडित, व्याडुण आडुणव्याडुण	चकित, दग, व्याकुल, भौचक आकुल-व्याकुल, हक्का- बक्का	astonished, impatient bewildered, uneasy
अडणविडण	चकळविकळ	वि	जुओ 'अडणवडण'	देखिए 'अडणवडण'	see 'अडणवडण'
अडित	चकित	वि	एड शई गयेलु, आश्वर्य पाभेलु	दग, चकित, भौचक	astonished, shocked into disbelief
अडेतरु	चकोतरु	न	मोटा लीपु जेपु अेड डुण, पपनस	चकोतरा	kind of fruit, pompelmoose
अडेतरो	चकोतरो	पु	जुओ 'अडेतरु'	चकोतरा	see 'अडेतरु'
अडेत्रा	चकोत्रा	न	अेड पक्षी	एक पक्षी	kind of bird
अड	चक्र	न	1 पैडु 2 धारवाणु अेड गोण डुशियार 3 'विष्णु'नु अेड डुशियार- सुदर्शन अड 4 डूडणु, गोणाडर 5 धारु मोटु रण्य 6 समूड, समुदाय, मडण	चक्र, चाका, पहिया धारदार गोल औजार, चक्का 'विष्णु' का एक आयुध, सुदर्शन चक्र मडलाकार रेखा, वृत्त, घेरा बहुत बडा राज्य समूह, समुदाय, मडल	wheel disc with sharp edge (a weapon) Sudarshan (a weapon of God Vishnu) circle empire, vast kingdom multitude, assemblage, association

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			7 तत्रमा वार्णवेला गुदाशी ताणवा सुधीमा आपता छ स्थानोमानु श्रेष्ठपार	योगवर्णित दह के भीतरी छ चक्र (मूलाधार, मणिपुर आदि) जो गुदा से ताल तक के भाग में स्थित हैं	any one of the six <i>tantra</i> plexuses in the body (from anus to palate)
अङ्गति	चक्रगति	स्त्री	अङ्ग जेथी गोण गति	चक्रगति	circular movement
अङ्गोल	चक्रगोल	पु	1 लेण्णमनी अेङ्ग कसरत 2 'अर्डेण', अङ्गव्यूह	लेजीम की एक कसरत कोर्डन, चक्रव्यूह	type of exercise with a bow-like implement cordon
अङ्गोण	चक्रगोळ	पु	जुओ 'अङ्गोण'	देखिए 'अङ्गोण'	see 'अङ्गोण'
अङ्गम	चक्रम	पु	अङ्क-गाडो मारस	पागल, मन का अस्थिर व्यक्ति	mad man
अङ्गवर्ती	चक्रवर्ती	वि	1 अेङ्ग अेङ्गे शब्ध करनारु, सार्वभौम 2 सार्वभौम राजा 3 अेङ्ग वनस्पति, जटामासी	एकचक्र, सार्वभौम, एकचक्र सार्वभौम सम्राट जटामासी, बालछड	wielding sovereign power sovereign such a ruler a kind of herb
अङ्गवात	चक्रवात	पु	वटोणियो	चक्रवात, बवडर	whirlwind
अङ्गवायु	चक्रवायु	पु	जुओ 'अङ्गवात'	देखिए 'अङ्गवात'	see 'अङ्गवात'
अङ्गाकार	चक्राकार	वि	1 अङ्कना आकारनु 2 संगीतमा अेङ्ग अलकार	मडलाकार, चक्र की तरह का गोलाकार (संगीत में) एक अलकार	circular, round a figure in music

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चक्षी	चक्री	वि	1 चक्रवाणु 2 सार्वभौम	चक्रयुक्त, चक्रवाला सार्वभौम	having a disc sovereign
		पु	1 सार्वभौम राजा 2 विष्णु 3 कुम्हार	सार्वभौम राजा विष्णु कुम्हार	sovereign ruler Vishnu potter
चक्षु	चक्ष	न	आज (प)	आख, चक्षु	eye
चक्षु	चक्षु	न	आज	आख, नेत्र, नयन	eye
चखाडवु	चखाडवु	स क्रि	'चाजवु' नु प्रेरक	'चाजवु' का प्रेरक रूप, चखाना	causal of 'चाजवु'
चखडोल	चगडोल	न	જુઓ 'ચકડોલ'	देखिए 'चकडोल', हिडोला	see 'चकडोल'
चगडवु	चगदवु	स क्रि	1 પગ તળે કચરવુ, જોરથી ઢાબવુ 2 'એને તે ત્યા ચગદવો છે?'— એવી ઉક્તિમાં 'વધ કરવો, ચકાવવો' એવા ભાવમાં વપરાય છે	पावो तले कुचलना, जोर से दबाना, रौदना वध करना या देवता को बलि देना	to trample, to press hard used in the sense of 'sacrifice someone'
चगदावु	चगदावु	अ क्रि	'चगडवु' नु अर्थात् रूप	'चगडवु' का कर्मणि रूप	passive of 'चगडवु'
चगदोलवु	चगदोलवु	स क्रि	ચગદવુ, રગદોળવુ	कुचलना, रौदना	to trample under feet, to roll in mud
चचणवु	चचणवु	अ क्रि	1 બળતરા થવી, લાચ બળવી 2 ચણ ચણ થઈને બળવુ	जलन होना, छरछराना, चुनचुनाना 'चर-चर' आवाज के साथ जलना, चरचराना	to feel burning pain to feel lancinating pain

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 मनमा दुःखी थपु- अणवु	मन में दुःखी होना, क्रुटना, जलना (ला)	to be unhappy
थथाशाट	चचणाट	पु	थथागवु ते, लाथ	जलन होना, जलन	burning sensation
थथरवु	चचरवु	अ क्रि	अणतरा थपी, लाथ अणवी	छरछराना, जलन होना	to feel burning or pungent pain
थथगत	चचराट	पु	थथरवु ते, अणतरा	जलन, क्रुदन	burning or sharp pain
थटड	चटक	वि	भूष रातु-आणे आळे अेवु दीपतु	बहुत गहरा (लाल), चटकदार, शोख	bright red, shining so bright as to strike the eye
		स्त्री	1 लडेजत, स्वाद 2 थटडो, डभ 3 थानड, लागशी	लज्जत, स्वाद दश (ला) डक लगन, मन की चुभन	taste flavour bite, sting fondness, feeling
थटड थानेनी	चटक चादनी	स्त्री	धशी स्वशुभवान स्त्री	बहुत स्पवती स्त्री	very beautiful woman
थटडभटड	चटकमटक	वि	1 शडडु, नअराभाज 2 परशागियो, नअराभाज देभाप डे आलवानी रीत	रसिक, नखरेबाज छैला, सजीला, नखरे, बनावसिगार की सजधज या चलने की अदा	foppish, smart foolish, foppish gait or appear- ance
थटडवु	चटकवु	स क्रि	1 थटडो भरवो 2 (ला) मनमा थटडो लागवो	डक मारना मन में चुभना	to sting to feel smart in the mind
		अ क्रि	(थानेनीनु) दीपवु, भीलवु	(चौदनी) चटकना	to shine (of moonlight)
थटडी	चटकी	स्त्री	1 तीव्र लागशी	उत्कट मनोभाव, चुभन	acute feeling

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 चूटी, चपटी 3 मोहिनी 4 ખૂલતો લાલ रंग	चुटकी मोहिनी सुहावना खुलता लाल रंग	pinch charm bright red colour
ચટકુ	चटकु	न	टीपु, छोटो	बूँद, छीटा	drop, very small quantity
ચટકો	चटको	पु	1 દશ, ડખ 2 (લા) મનની તીવ્ર લાગણી 3 સ્વાદ, લહેજત, ચસકો	दश, डक तीव्र मनोभाव, चुभन स्वाद, चसका	sting, bite strong feeling thrill, taste
ચટચટ	चटचट	अ	ઝટઝટ, સપાટામા	झटपट, तेजी से	quickly
ચટણી	चटणी	स्त्री	વાટીને બનાવાતી એક ચટકદાર વાની	चटनी	sauce, a tasty, pungent prepa- ration
ચટાકો	चटाको	पु	1 ચટકો, તીવ્ર લાગણી 2 સ્વાદ	मन की चुभन, दश स्वाद	sting, bite, strong feeling taste, flavour
ચટાચટ	चटाचट	अ	જુઓ 'ચટચટ'	झटपट, तेजी से	see 'ચટચટ'
ચટાડવું	चटाडवु	स क्रि	'ચાટવું' નુ પ્રેરક	'ચાટવું' का પ્રેરણાર્થક રૂપ	causal of 'ચાટવું'
ચટાપટા	चटापटा	पु	રંગબેરંગી આડાઅવળા પટા	रगबिरगी धारियाँ	variegated stripes
ચટાપટી	चटापटी	स्त्री	જુઓ 'ચટપટી'	देखिए 'चटपटी'	see 'ચટપટી'
ચટૂ	चटू	वि	1 ખાધાનુ લાલચુ 2 લાચિચુ	चटोरा, जिभला घूसखोर	greedy for food corrupt
ચટોચટ	चटोचट	अ	જુઓ 'ચટચટ'	झटपट, तेजी से	see 'ચટચટ'
ચટોચટ્ટ	चटोचट्ट	अ	ચટોચટ	चटाक-पटाक, तेजी से	quickly

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थડણ	चडण	न	थडावपाणो मार्ग, थडाव	चढाववाला रास्ता, चढाई	ascent, ascending path
थડती	चडती	स्त्री	1 उन्नति 2 बढ़ती, वृद्धि	उन्नति बढ़ती, वृद्धि, बढ़ोतरी	rise, advance prosperity, promotion
थડती डण	चडती कळा	स्त्री	आभादीनो वખत	बढ़ोतरी का समय	time of prosperity
थડती पडती	चडती पडती	स्त्री	थडपु अने पडपु ते, अस्तोद्य	चढती-पडती, उत्थान-पतन	rise and fall
थડती पाथरी	चडती पाथरी	स्त्री	वधारे ओचो छोदो	ज्यादा ऊँचा ओहदा	higher rank
थडतु	चडतु	वि	1 वधतु, ओचे णतु 2 थडियातु	बढ़ता, ऊँचे उठता बढिया	increasing, rising superior
थडतु व्याज	चडतु व्याज	न	थडवृद्धि व्याज	चक्रवृद्धि सूद	compound interest
थडतो दहाडो	चडतो दहाडो	पु	1 वधतो दिवस 2 ओगतो सूरज 3 आभादीनो वખत 4 (स्त्रीनी) सगर्भा स्थिति	बढ़ता हुआ दिन उगता सूर्य बढ़ोतरी का समय (स्त्री के) गर्भावस्था के दिन	fore-noon rising sun time of prosperity pregnancy
थडतो पासो	चडतो पासो	पु	थडपु ते, थडती	बढ़ती	rising, time of prosperity
थडन	चडन	न	थडती	बढ़ती	time of prosperity
थडपथडप	चडपचडप	अ	ओतावणशी, त्वराशी	चट से, त्वरा से, भटपट	quickly, speedily
थडभड	चडभड	स्त्री	थडभडपु ते	बडबडाकर बोलना, खीज, गुस्सा	noisy quarrel

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચડભડવુ	चडभडवु	अ क्रि	गुस्से थवु, ખીજવુ, લડી પડવુ, ઊંચાનીચા થવુ	गुस्सा होना, (किसी पर) बिगडना, भगडा मोल लेना, अधीर हो उठना	to be angry, to quarrel, to chafe and fume
ચડભડાટ	चडभडाट	पु	ચડભડ	गुराहट, खीज, गुस्सा	altercation, noisy quarrel
ચડસ	चडस	पु	1 એક માદક પદાર્થ 2 વ્યસન, ચસકો, લત 3 મમત	चरस व्यसन, चसका हठ, जिद्द	intoxicating preparation of <i>bhang</i> addiction, habit stubbornness, obstinacy
ચડસાચડસી	चडसाचडसी	સ્ત્રી	હરીફાઈ	होड, प्रतिद्वन्दिता	rivalry
ચડસીલુ	चडसीलु	વિ	1 લતવાળુ 2 મમતી, હઠીલુ	आदी, व्यसनी हठी	addicted stubborn
ચડાઉ	चडाउ	વિ	1 ઝટ ગુસ્સે થઈ જાય એવુ 2 જમીનને માફક આવે એવુ ગુણકારી 3 ચડવા-સવારી કરવા યોગ્ય	तुनकमिजाज,भट गुस्सा हो जाने वाला (जमीन को) अनुकूल आने वाला, गुणकारी सवारी के योग्य	easily angered, irritable suitable to the soil, beneficial fit for riding
ચડાઉતર	चडाऊतर	સ્ત્રી	ચડવુ અને ઊતરવુ તે	चढना और उतरना	to rise and to fall
ચડાઉતરી	चडाऊतरी	સ્ત્રી	જુઓ 'ચડાઉતર'	चढना और उतरना	see 'ચડાઉતર'
ચડાચડ	चडाचड	સ્ત્રી	હુસાતુસી, સરસાઈની સ્પર્ધા	स्पर्धा, चढा-चढी	rivalry
ચડણ	चडण	ન	ચડાવ, ચડાવવાળો માર્ગ	चढाव, चढाई	ascent
ચડાવ	चडाव	પુ	1 ઊંચાણ	ऊँचाई	ascent

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 चडाती ठीखाणवाणी जगा	उत्तरोत्तर, ऊँची होती जाती जगह	prominence
चडाववु	चडाववु	स क्रि	'चडवु' नु प्रेरक	'चडवु' का प्रेरणार्थक रूप	causal of 'चडवु'
चडियातु	चडियातु	वि	वधारे सरस, चडतु	बढिया	better, superior
चडी	चड्डी	स्त्री	अर्धु पाटलून, जाधियो	जाँघिया, चड्डी	half pant, shorts
चडतितर	चडऊतर	स्त्री	जुओ 'चडतितर'	देखिए 'चडतितर'	see 'चडतितर'
चडण	चडण	न	चडाववाणो मार्ग, चडाव	चढाई वाला रास्ता, चढाव	ascent
चडती	चडती	स्त्री	जुओ 'चडती'	देखिए 'चडती'	see 'चडती'
चडवु	चडवु	स क्रि	जुओ 'चडवु'	देखिए 'चडवु'	see 'चडवु'
चडाउ	चडाउ	वि	जुओ 'चडाउ'	देखिए 'चडाउ'	see 'चडाउ'
चडातितरी	चडाऊतरी	स्त्री	जुओ 'चडातितरी'	देखिए 'चडातितरी'	see 'चडातितरी'
चडाचढ	चडाचढ	स्त्री	डुसातुसी, सरसाँनी स्पर्धा	स्पर्धा, प्रतियोगिता	rivalry
चडाचढी	चडाचढी	स्त्री	जुओ 'चडाचढ'	देखिए 'चडाचढ'	see 'चडाचढ'
चढियातु	चढियातु	वि	वधारे सरस, चडतु	बढिया	superior
चण	चण	स्त्री	1 पपीओने चणवा माटे नपातु अनाज 2 ऊरचलीवाणी डपडानी सीवणी	चुगा, चुगा (लहंगे आदि) कपडे की चुन्नटदार सिलाई	corn thrown for feeding birds plaited sewing
चणचणवु	चणचणवु	अ क्रि	जुओ 'चणचणवु'	देखिए 'चणचणवु'	see 'चणचणवु'
चणचणाट	चणचणाट	पु	जुओ 'चणचणाट'	देखिए 'चणचणाट'	see 'चणचणाट'
चणवु	चणवु	स क्रि	1 दीवाल, मकान वगेरे बनाववु 2 वीणीने जावु	(दीवार, मकान आदि) बनाना, ईटें जोडना चुगना	to build, construct to pick grains (of birds)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अशाखार	चणाखार	पु	अशाना छोड उपरशी मणतो क्षार	चनाखार	acid collected from gram plants
अशादाण	चणादाळ	स्त्री	अशानी दाण	चने की दाल	pulse of gram
अशापाणी	चणापाणी	स्त्री	1 अशानो पोपटावाणो छोड 2 तेवा छोडोनी झूडी	बूट जूट	gram plant with pods bunch of such plants
अशियो	चणियो	पु	दाघरो	लहंगा, घाघरा	petticoat
अशी	चणी	स्त्री	नानो अशो, अशानी अेड ज्ञात	छोटा चना	kind of (small) gram
अशीबोर	चणीबोर	न	अशा जेवु नानु बोर	भडबेरी	kind of (small) berry
अतुर	चतुर	वि	आलाड, छोशियार	चालाक, होशियार	clever, intelligent
अतुरपाण	चतुरपण	न	आलाडी, छोशियारी, अतुराण	चालाकी, चतुराई, होशियारी	cleverness
अतुरा	चतुरा	स्त्री	अतुर स्त्री	चतुर स्त्री	clever woman
अतुराण	चतुराई	स्त्री	जुओ 'अतुरपाण'	चतुराई, होशियारी	see 'अतुरपाण'
अतुर	चतुर	वि	चार	चार	four
अतुर्थ	चतुर्थ	वि	चोथु	चौथा, चतुर्थ	fourth
अतुर्थांश	चतुर्थांश	पु	चोथो भाग	चौथा भाग, चौथाई	one-fourth part
अतुर्था	चतुर्थी	स्त्री	1 चोथ 2 चोथी विभक्ति (व्या.)	चौथी तिथि, चतुर्थी संप्रदान कारक	fourth day of lunar fortnight (grammar) dative (case)
अतुर्वर्ण	चतुर्वर्ण	पु	चार वर्ण	चारों वर्ण - ब्राह्मण, क्षत्रिय, वैश्य और शूद्र	four varnas or classes of society

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अपरा	चपण	न	1 अपरा, शओरु, अटेरु 2 भिक्षापात्र	चपनी, सकोरा भिक्षापात्र	earthen pan, dish or bowl begging bowl
अपरायु	चपणियु	न	अपरा	चपनी, सकोरा	earthen pan
अपरा	चपणु	न	अपरा, अपरायु	चपनी	earthen pan
अपतरु	चपतरु	न	डागणनी डडडी	परचा, पुरजा	slip (of paper)
अपरास	चपरास	स्त्री	सिपाहना पटानी पित्तणनी तभती	चपरास (सिपाही आदि की)	breastplate
अपल	चपल	वि	1 अथल 2 ओशियार, आलाड	चपल, चचल होशियार, चालाक	active, agile clever, smart
अपलता	चपलता	स्त्री	1 आथलय 2 आलाडी, ओशियारी	चपलता, चचलता चालाकी, होशियारी	agility cleverness
अपला	चपला	स्त्री	1 अपण स्त्री 2 वीणणी 3 लक्ष्मी 4 अेड छे	चपल स्त्री बिजली लक्ष्मी एक छेद	clever woman lightning Lakshmi kind of metre
अपसवु	चपसवु	अ क्रि	1 दाववु, ओरथी दाववु 2 अय दधने बराबर अधभेसवु	चौपना, जोर से दबाना अपनी जगह पर ठीक बैठना	to press, to press hard to be quite fit
अपण	चपळ	वि	जुओ 'अपल'	देखिए 'अपल'	see 'अपल'
अपाथप	चपाचप	अ	ऊट ऊट	भटपट	quickly
अपाट	चपाट	अ	1 साइ, अट 2 सपाट	चट, साफ सपाट, हमवार	finished flat
अपाटवु	चपाटवु	स क्रि	सपाटाबध जावु, अट डरी जवु	सपाटे से खाना, चट कर जाना	to eat quickly, devour, polish off

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थपाटी	चपाटी	स्त्री	1 चार पडवाणी शेटली 2 णडी शेटली	चार परत वाली रोटी मोटी रोटी	<i>chapati</i> , wheat-flour pancake with four layers thick <i>chapati</i>
थपाती	चपाती	स्त्री	थपाटी	चार परत वाली रोटी	<i>chapati</i> , wheat-flour pancake
थपेट	चपेट	स्त्री	1 आपोट, तमाचो 2 सडणो, डडणो (आस करीने भूतना वणगाशनी) 3 नुकसान, आहत	चपेट, तमाचा शिकजा, दबाव, काबू आफत, नुकसान	slap being possessed (esp by evil spirits) calamity
थपोथप	चपोचप	अ	ઝટઝટ, थपाथप	एकदम, चट से, भटपट	quickly
थपोतरु	चपोतरु	न	કાગળની કકડી	परचा, पुरजा	slip of paper
थप्पट	चप्पट	वि	બરોબર ચોટીને ઊંચ એવુ	चिपका हुआ, चिपटा, सटा हुआ	quite fitting, as if stuck or sticking
थप्पण	चप्पण	न	જુઓ 'થપણ'	देखिए 'थपण'	see 'थपण'
थप्पु	चप्पु	पु, न	ચાકુ, કાપવાનુ ઓળા	चाकू, छुरी	knife
थबरडी	चबरकी	स्त्री	કાગળનો નાનો કકડો	कागज का छोटा टुकड़ा, चिट	small piece of paper, chit
थबरणी	चबरखी	स्त्री	જુઓ 'થબરડી'	चिट	see 'थबरडी'
थबरड	चबराक	वि	1 थपण, ચાલાક 2 બોલવામા કુશળ, વાચાળ	चुस्त, चचल वाचाल	active, smart good at conversation, talkative
थबरडियु	चबराकियु	न	ટૂંકી થબરડ ઉક્તિ	छोटी चुस्त उक्ति	smart or clever remark
थबरडी	चबराकी	स्त्री	थबरडपण	वाचालता	clever in talking

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अतुष्कोण	चतुष्कोण	वि	1 चार ખૂણાવાળુ 2 ચાર ખૂણાવાળી આકૃતિ, 'કર્વાઈલેટરલ' (ગ.)	चार कोनों वाला, चतुष्कोण चार कोनों वाली आकृति	quadrangular quadrilateral (maths)
अतुष्टय	चतुष्टय	वि न	1 चार ભાગવાળુ 2 ચાર પ્રકારનુ ચારનો સમુદાય	चार भाग वाला चार तरह का चार का समाहार, चतुष्टय	aggregate or group of four of four kinds group of four
अतुष्पद	चतुष्पद	वि	1 ચોપગુ 2 ચોપગુ પ્રાણી	चार पैरों वाला चौपाया जानवर	four-footed (of animal) quadruped
अतुष्पाद	चतुष्पाद	वि	જુઓ 'અતુષ્પદ'	देखिए 'अतुष्पद'	see 'अतुष्पद'
अतुष्पदी	चतुष्पदी	स्त्री	ચાર પદની બનેલી કડી	चार चरणों वाला, पद, चतुष्पदी	stanza of four lines
अतु	चतु	वि	1 ઈતુ, સવળુ 2 સીધુ, પાસરુ 3 ઉઘાડુ, જાહેર	पट का उल्टा, चित सीधा, सरल खुला, जाहिर	supine, lying on back straight, upright open, public
अतु	चतु	वि	જુઓ 'અતુ'	देखिए 'अतु'	see 'अतु'
अतुपाट	चतुपाट	वि	ઈતુપાટ	पूरा चित, चारों खाने चित	supine, lying on back
अनोठी	चनोठी	स्त्री	જુઓ 'અણોઠી'	देखिए 'अणोठी'	see 'अणोठी'
अप	चप	अ	અટ લઈને, એકદમ	भट, चट से, एकदम	immediately, at once
अपकळु	चपकळु	वि न	દગાવાળુ 1 અડખલુ, આધુ 2 માટીનુ પાત્ર, નાનુ અપાણુ	दगाबाज नटखटी, शरारती छोटा मिट्टीपात्र, चपनी	treacherous over-wise, mischievous earthen pot

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
थपथप	चपचप	अ	ઝટઝટ	'चप-चप' आवाज के साथ भटपट, तेजी से	quickly
थपथपु	चपचपु	वि	थीअणु अने भीनु, गधगधु	चिकना और गीला, गुदगुदा	moist and sticky
थपटी	चपटी	स्त्री	1 अगूठो अने आगणी भीडवा ते 2 तेमा पडाय तेटलु माप 3 तेम डरीने डरातो थट थेपो अवाण 4 थे अवाण डरता लागे थेटलो समय, णर वार 5 पड, थीपटी	चुटकी उसमें पकडी जाए उतनी मात्रा, चुटकी भर चीज चुटकी बजाने से होने वाली आवाज चुटकी बजाने में लगने वाला समय, तनिक देर चुटकी (भरना, काटना आदि), चिमटी	pressing of thumb and second finger pinch, very small quantity sound caused by thumb and finger so pressed instant moment grip, pinch
थपटीचागणु	चपटीचागळु	वि	थोडुधणु	थोडा-बहुत	whatever little
थपटीमा	चपटीमा	अ	णर वारमा	क्षण मात्र में, चुटकी बजाये इतनी देर में	instantly
थपटु	चपटु	वि	बेठेलु, ध्वायेलु	चिपटा, बैठा या धँसा हुआ, चपटा	flat, pressed
थपटो	चपटो	पु.	भोटी थपटी	बडी चुटकी	bigger 'थपटी'
थपडालाण	चपडालाख	स्त्री	लगडी बनावेली थोण्णी लाण	चपडा	slug of sealing- wax

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
અપણ	चपण	ન	1 અપ્પણ, શકોરુ, બટેરુ 2 ભિક્ષાપાત્ર	ચપની, સકોરા ભિક્ષાપાત્ર	earthen pan, dish or bowl begging bowl
અપણિયુ	चपणियु	ન	અપણ	ચપની, સકોરા	earthen pan
અપણ	चपणु	ન	અપણ, અપણિયુ	ચપની	earthen pan
અપતરુ	चपतरु	ન	કાગળની કકડી	પરચા, પુરજા	slip (of paper)
અપરાસ	चपरास	સ્ત્રી	સિપાઈના પટાની પિત્તળની તખતી	ચપરાસ (સિપાઈ આદિ કી)	breastplate
અપલ	चपल	વિ	1 અચલ 2 હોશિયાર, ચાલાક	ચપલ, ચચલ હોશિયાર, ચાલાક	active, agile clever, smart
અપલતા	चपलता	સ્ત્રી	1 આચલ્ય 2 ચાલાકી, હોશિયારી	ચપલતા, ચચલતા ચાલાકી, હોશિયારી	agility cleverness
અપલા	चपला	સ્ત્રી	1 અપળ સ્ત્રી 2 વીજળી 3 લક્ષ્મી 4 એક છદ્	ચપલ સ્ત્રી બિજલી લક્ષ્મી एक छद्	clever woman lightning Lakshmi kind of metre
અપસવુ	चपसवु	અ ક્રિ	1 ઠાબવુ, જોરથી ઠાબવુ 2 અપ ઇઈને બરાબર બધબેસવુ	ચોપના, જોર સે દબાના અપની જગહ પર ઠીક બેઠના	to press, to press hard to be quite fit
અપળ	चपळ	વિ	જુઓ 'અપલ'	દેખિય 'અપલ'	see 'અપલ'
અપાચપ	चपाचप	અ	ઝટ ઝટ	ઘટપટ	quickly
અપાટ	चपाट	અ	1 સાફ, ચટ 2 સપાટ	ચટ, સાફ સપાટ, હમવાર	finished flat
અપાટવુ	चपाटवु	સ ક્રિ	સપાટાબધ ખાવુ, ચટ કરી જવુ	સપાટે સે ખાના, ચટ કર જાના	to eat quickly, devour, polish off

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थपाटी	चपाटी	स्त्री	1 चार पडवाणी शेटली 2 णडी शेटली	चार परत वाली रोटी मोटी रोटी	<i>chapati</i> , wheat- flour pancake with four layers thick <i>chapati</i>
थपाती	चपाती	स्त्री	थपाटी	चार परत वाली रोटी	<i>chapati</i> , wheat- flour pancake
थपेट	चपेट	स्त्री	1 ऊपोट, तमाचो 2 सडणो, डबणो (भास डरीने भूतना वणगणनी) 3 नुकसान, आहत	चपेट, तमाचा शिकजा, दबाव, काबू आफत, नुकसान	slap being possessed (esp by evil spirits) calamity
थपोथप	चपोचप	अ	ऊटऊट, थपाथप	एकदम, चट से, भटपट	quickly
थपोतरु	चपोतरु	न	डागणनी डडडी	परचा, पुरजा	slip of paper
थप्पट	चप्पट	वि	बशेबर थोटीने डोथ अेपु	चिपका हुआ, चिपटा, सटा हुआ	quite fitting, as if stuck or sticking
थपण	चप्पण	न	णुओ 'थपण'	देखिए 'थपण'	see 'थपण'
थपु	चप्पु	पु,न	थाडु, डपवानु ओणर	चाकू, छुरी	knife
थबरडी	चबरकी	स्त्री	डागणनी नानो डडडी	कागज का छोटा टुकडा, चिट	small piece of paper, chit
थबरणी	चबरखी	स्त्री	णुओ 'थबरडी'	चिट	see 'थबरडी'
थबरड	चबराक	वि	1 थपण, थालाड 2 भोलवामा डुशण, वाथाण	चुस्त, चचल वाचाल	active, smart good at conver- sation, talkative
थबरडियु	चबराकियु	न	टूडी थबरड उडि	छोटी चुस्त उक्ति	smart or clever remark
थबरडी	चबराकी	स्त्री	थबरडपण	वाचालता	clever in talking

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अभूतरी	चबूतरी	स्त्री	नानो अभूतरो, परबडी	छोटा चौतरा, चबूतरा	small 'अभूतरो'
अभूतरो	चबूतरो	पु	1 पोलीसशाखा, 'गेट' 2 ऊर लेवानी थोडी, नाकु 3 थोतरो 4 पजीओने माटे दाशा नाभवानी जग, परबडी	थाना, पुलिस चौकी कर वसूल करने का स्थान चौतरा, चबूतरा पक्षियों को चुगा डालने का पक्का स्थान	police-station or gate octroi or customs office or station raised square or platform raised platform or high stand on which corn is thrown for birds
अभोणु	चबोळवु	स क्रि	भराब ओलवु, गाण देवी	अपशब्द बोलना, गाली बकना	to abuse
अमड	चमक	स्त्री	1 अमडरो 2 धुगरी-ताण आवणी ते 3 ताणुणी, आश्चर्यनी थोड 4 लोडयुड	चमक, झलक (कप या ऐंठ के कारण शरीर का) तनाव, तनना ताज्जुब चुबक, लोहकान्त मणि	flash spasm, convulsion surprise, astonishment magnet
अमडपशर	चमकपथर	पु.	1 अडमड 2 लोडयुड	चकमक चुबक, लोहकान्त मणि	flint magnet
अमडपडाण	चमकपहाण	पु	जुओ 'अमडपशर'	देखिए 'अमडपशर'	see 'अमडपशर'
अमडभाण	चमकबाण	न	अमडपशर, अमडपडाण	चुबक, चकमक, लोहकान्त	flint
अमडवा	चमकवा	पु	अेड रोग	एक रोग	kind of disease
अमडवु	चमकवु	अ क्रि	1 जुओ 'अमडवु'	चमकना, झलकना	see 'अमडवु'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 थोडपु 3 पठी णपु	चौंकना चाल अच्छी न होना, गलत रास्ते पर जाना	to be startled to go astray
थमझट	चमकाट	पु	1 थमझरो, झमझरो 2 पाठनो आवेश 3 पठी णपु ते	चमक, चमकना, भलकना वातान्माद का आवेश, मिरगी बहकना, हाथ से जाना	flash, gleam fit of epilepsy depravity
थमझर	चमकार	पु	1 झमझरो 2 थमड, डमारी 3 थमथम शती अवाण	चमक, भलक कप, कॅपकॅपी 'चमचम' आवाज	flash tremor sharp squeaking sound
थमझपु	चमकावु	सक्रि	1 'थमडपु' नु प्रेरड 2 सपाटपु, मारपु	'थमडपु' का प्रेरणार्थक रूप पीटना, (धप्पड) रसीद करना	causal of 'थमडपु' to slap, bash
थमथम	चमचम	अ	[रव]थमथमे थेम	छडी की पिटाई से होने वाली आवाज	sound as of beating with cane
थमथमपु	चमचमपु	अ क्रि	1 'थमथम' थेवी अवाण शपो 2 तीव्र जलन शपी	'चमचम' आवाज होना तीव्र जलन होना	sound as of 'थमथम' to feel intense burning sensa- tion
थमथमाट	चमचमाट	पु	थमथमपु ते	तीव्र जलन होना	intense burning sensation
थमथी	चमची	स्त्री	1 नानो थमथो	छोटा चमचा, चमची	teaspoon

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 પાનસોપારી ઇ રાખવાની ખાસ કોથળી	પાન-સુપારી આદિ રખને કી ખાસ ધૈલી, બટુઆ	special bag for keeping betel leaves, areca nuts etc
ચમચો	ચમચો	પુ	રસોઈમા તથા ખાવાપીવાના કામમા આવતુ એક કડછી જેવુ સાધન	ચમ્મચ, ચમચા	spoon, ladle
ચમડી	ચમડી	સ્ત્રી	ચામડી	ચમડી	skin
ચમત્કાર	ચમત્કાર	પુ	1 આશ્ચર્ય, આશ્ચર્યકારક બનાવ-દેખાવ 2 કામત, અલૌકિક ક્રિયા	વિસ્મય, વિસ્મયકારક ઘટના, વાત યા દૃશ્ય કામાત, અદ્ભુત ક્રિયા યા વાત યા તમાશા	wonder, wonderful event or appear- ance miracle
ચમત્કારક	ચમત્કારક	વિ	ચમત્કારવાળુ	ચમત્કારી, ચમત્કારક	miraculous
ચમત્કારિક	ચમત્કારિક	વિ	જુઓ 'ચમત્કારક'	ચમત્કારી	see 'ચમત્કારક'
ચમત્કારી	ચમત્કારી	વિ	ચમત્કારક	ચમત્કારક, ચમત્કારી	miraculous, wonderful
ચમર	ચમર	સ્ત્રી	1 વાળ કે પીંછા 2 ચમરી ગાયના કે બીજા વાળની બનેલી ચમરી, ચામર	બાલ યા પર ચૈવર, ચામર, ચમર	hair or feather fly-driver made of the hair of <i>chamari</i> or other animal
ચમરખુ	ચમરખુ	ન	રેટિયાની ત્રાક જોમા રખાય છે તે (ચામડાનો કકડો)	ચમરખ	piece of leather to support the spindle of a spinning wheel

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા- કો.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચમરબધ	चमरबध	પુ	ચામડાનો પટો	चमडे का पट्टा	leather-belt, waistband
ચમરબધી	चमरबधी	વિ	1 કેડે ચમરબધવાળુ 2 શૂરવીર અને ધૈર્યવાન	(जिसने) कमर में चमडे का पट्टा बँधा हो शूरवीर, धैर्यवान	having leather-belt round waist brave, courageous
		પુ	1 ચમરબધી માણસ 2 સત્તાધીશ, રાજા જેવો માણસ	वह व्यक्ति जिसने कमरबद बँधा हो सत्ताधीश, राजा-सा आदमी	one wearing waist-band one weilding power
ચમરી	चमरी	સ્ત્રી	1 રેસાવાળી ફૂલની મજરી- મજરી 2 ફૂલની મજરીના આકારની રેશમ કે ઊનની બનાવટ 3 મચ્છર વગેરે ઊડાડવાની ઘોડાના વાળની બનાવેલી ચામર	चमरी, मजरी फूल की मजरी जैसी ऊनी या रेशमी करीगरी घोडे के बालों की बनाई हुई चँवरी, चँवर	cluster of blossoms with filaments to them article of silk or cotton imitating it fly-driver made of hair (drawn usually from mane of a horse)
ચમરી ગાય	चमरी गाय	સ્ત્રી	એક પ્રકારની પહાડી ગાય, જેના પૂછડાના વાળની ચમરી બને છે	चमरी, सुरा-गाय	kind of deer or cow whose tail is used as fly-driver
ચમાર	चमार	વિ	1 ચામડિયાની જ્ઞાતિનુ 2 તે જ્ઞાતિનો માણસ, ચામડિયો	चमार उस जाति का आदमी	tanner man of that caste
ચમારણ	चमारण	સ્ત્રી	ચમારની સ્ત્રી	चमारिन	wife of tanner, woman of the caste of 'ચમાર'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थपेली	चमेली	स्त्री	એક ફૂલવેલ, ચપેલી, ગાંધ	चमेली (लता)	a kind of flower-plant, jasmine
थम्मड	चम्मड	वि	1 थामડા જેવું, ઝટ તૂટેફટે નહિ એવું 2 (લા) ઠપણ, ડજૂસ	चिमडा, चीमड कजूस	tough like leather stingy
थम्मर	चम्मर	स्त्री, न	ચમરી ગાયના કે બીજા વાળની બનેલી ચમરી, ચામર	चँवर, चामर, चमर	fly-driver made of the hair of चमरी or other animal
थरड	चरक	न स्त्री पु	1 शेरडीनु डोले 2 छोकरीनी रमत पणीनी अधार 1 दूत, डसद 2 प्रसिद्ध वैदकशास्त्री	ईख पेरने का कोल्हू बच्चों का खेल पक्षी की बीट दूत, कासिद, चर, सदेशवाहक प्रसिद्ध आयुर्वेदाचार्य, चरक	sugar-cane press a game droppings of birds messenger name of a well-known authority in Ayurved
थरडरा	चरकण	वि	1 थरडया डरतु 2 બીકનુ માર્યું, ચરક ગાય એવું ડરકણ	चिरकने वाला भय के कारण चिरक जाने वाला, डरपोक, बुजदिल	frequently passing dung or faecal matter timid
थरडरा	चरकणु	वि न	वारवार थरडी गाय એવું (બાળક ઢોર વગેરે) વારવાર ચરકયા કરે એવો રોગ	बारबार चिरकने वाला चिरकने का रोग	frequently passing dung or faecal matter a complaint or disease

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચરકવુ	चरकवु	अ क्रि	થોડુ પ્રવાહી જેવુ અઘવુ (ખાસ કરીને પક્ષી માટે)	चिरकना (खास कर पक्षियों का)	pass small quantity of foecal matter (of birds)
ચરકુ	चरकु	वि	સહેજ તમતમુ તથા કડચુ, ખેસ્વાદ	चरपरा और थोडा कडवा, बेस्वाद	off colour in taste, slightly hot or pungent
ચરખી	चरखी	સ્ત્રી	1 નાનો ચરખો 2 પવનચક્કી	छोटा चरखा पवनचक्की	small spinning wheel wind-mill
ચરખુ	चरखु	वि	જુઓ 'ચરકુ'	देखिए 'चरकु'	see 'ચરકુ'
ચરખો	चरखो	પુ	1 ક્રાસનો લોઢવાનો સથો 2 મિલ 3 ખરાદ, સઘાડો 4 રેટિયો	रई ओटने की चरखी, ओटनी मिल खराद चरखा	gin mill lathe spinning wheel
ચરચર	चरचर	अ	1 બળવાનો અવાજ 2 ઝડપથી, જલદીથી	जलने की आवाज करते हुए, चड-चड से तेजी से, जल्द	with sound as of burning quickly, briskly
		સ્ત્રી	1 'ચરચર' એવો અવાજ 2 ધીમી બળતરા, ચચરાટ 3 ચિતા, ડિઝર	चरचराहट, 'चर-चर' आवाज छरछराहट चिता, सौच (ला)	sound as of scratching slow burning sensation worry, anxiety
ચરચરવુ	चरचरवु	अ क्रि	બળતરા બળવી, લાય બળવી	जलन होना, छरछराना	to have burning sensation
ચરચરાટ	चरचराट	પુ	ચચરવુ તે, બળતરા	छरछराहट, जलन	burning sensation
ચરચવુ	चरचवु	स क्रि	(ચદન વગેરેનો) લેપ કરવો, અર્થા કરવી	लेप करना	to apply ointment (sandal-paste etc)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચરડ	चरड	स्त्री	1 કપડુ વગેરે ફાટતા થતો અવાજ 2 જોડામાથી નીકળતો અવાજ	कपडा वगैरह फटने की आवाज जूते में से निकलने वाली आवाज	sound as of tearing cloth sound of shoes creaking
ચરડકો	चरडको	पु.	1 ચરડ થતો અવાજ 2 [લા]દિલ ચિરાચ એવી લાગણી, ઉગ્ર ચિતા, દાસકો	'चरड' आवाज चिंता, धडक	sound of cutting or tearing cutting or tearing sensation in the heart, anxiety
ચરણ	चरण	पु	1 પગ 2 તૂક, કડી (કવિતાની)	चरण, पॉव कविता का पाद, छंद का पाद, चरण, मिसरा	foot metrical line, stanza
ચરણરજ	चरणरज	स्त्री	પગની રજ-ધૂળ	चरणधूलि, चरणरज	dust of feet
ચરણસેવા	चरणसेवा	स्त्री	1 પગચાપી 2 ભક્તિનો એક પ્રકાર	पॉव दबाना, पोंचप्पी, चरणसेवा भक्ति का एक प्रकार	pressing the feet kind of devo- tion
ચરણસ્પર્શ	चरणस्पर्श	पु	પગનો સ્પર્શ	चरण छूना, चरणस्पर्श	touching the feet
ચરણામૃત	चरणामृत	न	1 ચરણોદક 2 દૂધ, દહીં, ઘી, મધ અને પાણી વગેરેનું મિશ્રણ, જેના વડે દેવમૂર્તિને સ્નાન કરાવ્યું હોય તે	चरणोदक पचामृत, चरणोदक	water in which the feet of a holy person have been washed the water, milk, curd, ghee, honey with a mixture of which the deity is bathed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચરણોદક	चरणोदक	न	દેવ, ગુરુ વગેરેના ચરણ ધોયેલુ પાણી	चरणामृत, पचामृत	the water in which the feet of venerable idol or of <i>guru</i> are bathed
ચરખણ	चरपण	न	કૃપણતા, કળ્મૂસાઈ	कृपणता	stinginess
ચરખણુ	चरपणु	वि.	કળ્મૂસ	कजूस	stingy
ચરવું	चरवु	अ क्रि	1 ચાલવું, ફરવું 2 ઘાસ, ઘાણો વગેરે ફરોને શોધી ખાવો (પશુ, પખીઓ) 3 રળવું, પેદા કરવું	चलना, फिरना (पशुओं का) चरना कमाना, पैदा करना	to walk, to roam about to graze, pick grains (of birds) to earn, to make money (usually by taking bribe)
ચરસ	चरस	पु	જુઓ 'ચડસ'	देखिए 'चडस'	see 'चडस'
ચરાઈ	चराई	स्त्री	ઢોર વગેરેને ચારવાનું મહેનતાણું	पशु आदि को चराने की मजदूरी, चराई	wages paid for grazing cattle
ચરાડ	चराउ	वि	ચરવા માટે યોગ્ય, ચરા તરીકે વપરાવાનું	चरने के लिए योग्य	fit or used for grazing
		न	ચરો	चरी, गौचर	grassland
ચરાણ	चराण	न	1 ચરો, ગોચર 2 ચરામણ	चरी, गौचर चराई, चराने की मजदूरी	grassland, pasture price paid for pasturage
* ચરચર	चराचर	वि	ચર અને અચર, ચેતન અને જડ, સ્થાવર અને જગમ	चर और अचर, चेतन और जड, स्थावर और जगम	movable and immovable, animate and inanimate
		न	આખી સૃષ્ટિ	सपूर्ण जगत	creation, the whole universe

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अरावपु	चरावपु	स क्रि	1 'अरपु' नु प्रेरक 2 (लाथ) आपवी	'अरपु' का प्रेरणार्थक रूप घूस देना	causal of 'अरपु' bribe
अराण	चराळ	वि.	1 जोछअे ते उरता ओथु उमेडु (छणपुणी छ) 2 स्पर्शनी लागणी न थाय अेपु-गूहु	जो चाहिए इससे भी ऊँचा जूठा (अग, मनुष्य)	too high for a required purpose dead, blunt
अरि	चरि	न	1 आचरण, वर्तन 2 एवनअरि	चरि, व्यवहार, आचरण जीवनचरि, जीवनी	conduct, behaviour biography
अरिअर्थ	चरिअर्थ	वि	1 कृतकृत्य, कृतार्थ 2 सङ्ग पु 1 निर्वाह 2 भावार्थ	कृतार्थ, चरिअर्थ सफल निर्वाह भावार्थ	who has done his work or accomplished his object successful maintenance import, broad meaning
अरि	चरि	न	अपट, पाण्ड, अवाधावा	कपट, पाखड (ला) चरि	deceit, fraud
अरिअर	चरिअर	पु	एवनअरि लणनार	जीवनी लिखने वाला	biographer
अरिअरिअर	चरिअरिअर	न	एवननु वार्शन, एवनअथा	जीवन कथा	biography
अरी	चरी	स्त्री	अरी, परेए	परहेज	prescribed diet
अरु	चरु	पु	1 अेक पछोणा मेानु वासण, देग 2 छेभनो अर	चौडे मुँह का एक बरतन, देग हव्यान्न	large copper vessel food cooked for sacrifice

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थरुडी	चरुडी	स्त्री	नानो थरु, देगडी	देगची, छोटा देग	small copper vessel
थरेडो	चरेडो	पु	1 थरुडो, धासडो 2 थीरो	दिल को धक्का लगाना, धडका, डर, कलेजे का फटना चीरा	spasm of fear, dread crack, slit
थरेराट	चरेराट	पु	1 (रु)थरेडो, धासडो 2 थरु अेवो अवाण	धडका, डर 'चर' ऐसी आवाज	fit of anxiety sound of tearing
थरुथरु	चरुथरु	स्त्री	जुओ 'थरुथरु'	देखिए 'थरुथरु'	see 'थरुथरु'
थरुथरी	चरुथरी	स्त्री	1 आनड, उत्सव 2 अेड छे	आनदोत्सव एक वर्णवृत्त	festivity, jubilation one type of metre
			3 नाटकमा प्रवेश पूरो थाय थारे मूडवामा आवतु गीत	नाटक के प्रवेश के अंत में गाया जाने वाला गीत	song placed at the end of a scene in a play
थरुथपत्र	चरुथपत्र	न	थरुथ के विवेचननो छापामा आवेलो पत्र-रुणुणु	समाचार-पत्र में आया हुआ चरुथ-विवेचनात्मक लेख या पत्र, सपादक के नाम पत्र	letter to the press
थरुथपत्री	चरुथपत्री	पु	थरुथपत्र रुणुणु	सपादक के नाम पत्र लिखने वाला	writer of letters to the press
थरुथपु	चरुथपु	अ क्रि	'थरुथपु' नु कर्मणि	'थरुथपु' का कर्मणि रूप	passive of 'थरुथपु'
थरुथ	चरुथ	न	थामडु, त्वथा	चमडा, त्वचा, खाल	skin, hide

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अर्धवाद्य	चर्मवाद्य	न	थामडानु वाद्य	ढोल, चर्मवाद्य	musical instrument made of leather
अर्धालय	चर्मालय	न	थामडानु करजानु, 'टेनरी'	चर्मालय, 'टेनरी'	tannery
अर्धित	चर्वित	वि	जेनु अर्धण श्रु अयेनु छे अये	जिस पर मनन या सोच-विचार अच्छी तरह हो चुकने के कारण वह निसार बन गया हो	which is chewed or masticated
अर्धितअर्धण	चर्वितचर्वण	न	अेकनी अेक वात इरी छेवी ते, पुनरुद्धि	पुनरुक्ति, चर्वितचर्वण	harping on the same theme
अल	चल	वि	1 छालतु, आलतु 2 अस्थिर, अलायमान	हिलता-डुलता, गतिमान अस्थिर, चल	moving unsteady
अलाण	चलण	न	1 आलवु ते, अमल, सत्ता 2 अलाणी नाणु 'कर-सी' 3 धारो, रिवाज	अमल, सत्ता, जोर प्रचलित सिक्का, चलन 'करन्सी', रीति-रिवाज, चलन	being current currency practice, custom
अलाणी	चलणी	वि	व्यवहारमा प्रचलित- पपरातु छीय अये	चलनसार, चलता (सिक्का)	current in practice or business
अलवुं	चलवु	अ क्रि.	आलवु, जवु	चलना, जाना	to walk, to go
अलाउ	चलाउ	वि	आली शडे- नले अये	चलाऊ, टिकाऊ	workable
अलाओ	चलाओ	पु	समथोरस उपडानो (भोटो) छडो	कपडे का समचौरस (बडा) टुकडा	large, square piece of cloth
अलाणी	चलाणी	स्त्री	1 नानु अलाणु	छोटा प्याला	small bowl

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 'भाँठ भाँठ थाणाणी' नी रमत	एक खेल	a game
चलायमान	चलायमान	वि	1 छालतु 2 इस्तु, भदलातु	गतिमान, हिलता-डुलता, विचलित, चलायमान डॉवाडोल, पलट जाने वाला, बदल जाने वाला, चलायमान	moving shaking changing
चलाववुं	चलाववु	स क्रि	'चालवु' नु प्रेरक	चलाना	causal of 'चालवु'
चलावु	चलावु	अ क्रि	चालवानी क्रिया शवी, 'चालवु' नु भावे	चलाया जाना	to be able to walk
चलित	चलित	वि	1 थणेत्तु, स्थानभ्रष्ट 2 अस्थिर 3 सञ्जीतनो अेक अंतकार	चलित, स्थानभ्रष्ट अस्थिर, डॉवाडोल सगीत में एक अलकार	moving or moved from its proper place unsteady kind of mode in music (music)
चलितकुंडली	चलितकुंडली	स्त्री	चलित ग्रह बतावनारी कुंडली (ज्यो)	चलित जन्मकुंडली	horoscope which shows the stars as in movement (astrology)
चल्ली	चल्ली	स्त्री	चल्ली	चिडिया	sparrow
चल्लु	चल्लु	न	1 चल्लानी जतनु नानु पणी, चल्लु 2 चागणु, अजलि	गौरैया की जाति का छोटा पक्षी, चिडिया चुल्लू, चार उंगलियों की अजली	sparrow, sparrow-like small bird forming hollow of the palm to receive a quantity of water etc

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चल्लो	चल्लो	पु	थडलो	नर चिडिया, चिडा	male sparrow
चलम	चलम	स्त्री	तमाडु वगेरे पीवा माटेनु माटीनु अेड पात्र	चिलम	small smoking pipe made of clay
चलववु	चलववु	स क्रि	जुओ 'चलाववु'	चलाना	see 'चलाववु'
चलविचल	चलविचल	वि	अस्थिर, ऽगमगतु	अस्थिर, डौवाडोल, चलविचल	unsteady
चवड	चवड	वि	मुश्केलीशी तूटे, इटे डे यवाय अेवु	चीमड, चीमडा	that can be broken or chewed with difficulty, leathery, tough
चवडाववु	चवडाववु	स क्रि	'चाववु नु प्रेरड	'चाववु' का प्रेरणार्थक रूप चबवाना	causal of 'चाववु'
चवडु	चवडु	वि न	चवड ढणनो अएरीदार दतो, जे लोयमा पेसे छे	चीमड (हल की) फाल, कुसी	tough ploughshare
चश्मो	चश्मो	पु	पाणीनो अशे	सोता, चश्मा, पानी का भरना	spring of water
चसड	चसक	स्त्री	चसडवाशी थतु दुध	चसक	shooting pain because of a sprain
चसडवु	चसकवु	अ क्रि	1 पडसमाशी अथवा अेडदा स्थानमाशी पसवु, छटडवु 2 नाडा थवु, मज्ज ठेडाने न रूडेवु	छटकना, खिसकना	to slip away
चसडवु	चसकवु	अ क्रि	1 पडसमाशी अथवा अेडदा स्थानमाशी पसवु, छटडवु 2 नाडा थवु, मज्ज ठेडाने न रूडेवु	दिमाग ठिकाने न रहना	to go crazy or mad
चसडवु	चसकवु	अ	चसे नडि तेम	खिसक नहीं इस तरह कसाव क साथ, मजबूती से	tightly

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या- को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
અસચસવુ	चसचसवु	અક્રિ	તગ હોવુ, જકડાવુ	તગ હોના, જકડા જાના	to fit tight
		સક્રિ	અસચસાવવુ, બરાબર ખેંચીને પીવુ	ખૂબ પીના	to tighten, to drink heavily
અસચસાટ	चसचसाट	અ	1 અસી ન જાય તેમ- તગ 2 સપાટાબધ (પીવુ) 3 તગ હોવુ તે	કસકર, મજબૂતી સે ગટ-ગટ (પીના) તગ હોના	tight hurriedly fitting tight
અસચસાવવુ	चसचसाववु	સક્રિ	1 તગ કરવુ 2 ઝપાટામા કે બરાબર પીવુ	તગ કરના ગટ-ગટ પીના	to tighten to drink hurriedly
અસમપોશી	चसमपोशी	સ્ત્રી	જુઓ 'અશ્મપોશી'	ચશ્મપોશી	see 'અશ્મપોશી'
અસમો	चसमो	પુ	જુઓ 'અશ્મો'	દેખિય 'અશ્મો'	see 'અશ્મો'
અહટાલિયુ	चहटालियु	વિ	સ્વાદીલુ	ચટોરા, સ્વાદલોલુપ	(person) with a craving for a certain taste
અહુ	चहु	વિ	ચાર	ચાર, 4	four, 4
અહુદિશ	चहुदिश	અ	ચારે દિશાએ, બધી બાજુએ	ચારોં ઓર સે, ચહોંઓર	on all sides, in all directions
અહેબચો	चहेबचो	પુ	લીલ અને વનસ્પતિથી ભરપૂર હોજ	ચહબચા	fountain or reservoir of water covered with vegetation and moss
અહેરાદાર	चहेरादार	વિ	ઘાટીલુ, સુદર	સુદર, ગઠીલા	well-shaped
અળઝટ	चळकाट	પુ	અઝઅઝટ, પ્રકાશ	ચિલક, ચમક, પ્રકાશ	shining brilliance
અળઝરો	चळकारो	પુ	પ્રકાશનો અમઝરો, ઝબઝરો	પ્રકાશ કી ચિલક, ચમક	gleam flash

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચળકી	चळकी	स्त्री	1 ચળકાટ 2 ચળકારા માસ્તી વસ્તુનું છાટારા	चमक, चिलक चमकने वाली चीज का छिडकाव	polish, glitter spraying of shining material (on cloth)
ચળવળ	चळवळ	स्त्री	1 ચટપટી, અજબો, વલોપાત 2 હિલચાલ, પ્રવૃત્તિ, આદોલન	भटपटी, उतावली हलचल, आन्दोलन	anxiety, restlessness movement, agitation
ચળવળવું	चळवळवું	अ क्रि	1 જરા હાલવું, સળવળવું 2 ઈચ્છા કરવાને ઊંચાનીચા થવું 3 મનમા ખૂંચવું	जरा हिलना, कुलबुलाना कुछ करने के लिए ऊँचा-नीचा होना मन में चुभना	to make a slight movement to be impatient to do something to prick the mind
ચળવળાટ	चळवळाट	पु	1 ચળવળવું તે 2 તલસાટ, વલવલાટ 3 ખજવાળ	हिलना-डुलना आतुरता, छटपटी खुजली	restlessness longing itch
ચળવળિયું	चळवळियું	वि	ચળવળ જગાડવાના સ્વભાવનું, ધર્માલિયું	हलचल मचाने वाला	of agitating nature
ચળવિચળ	चळविचळ	वि	જુઓ 'ચલવિચલ'	देखिए 'चलविचल'	see 'चलविचल'
ચળવું	चळवું	अ क्रि	1 ડગવું, ખસવું 2 પતિત થવું, ચ્યવવું	डिगना, हटना, खिसकना पतित होना, च्युत होना	to move away from swerve to fall (into sinful ways)
ચળાઈ	चळाई	स्त्री	ચળામણી	छानने की क्रिया	chaff or refuse
ચળાચળ	चळाचळ	वि	ચરાચર, ચળ-અચળ	चराचर, चल-अचल	moveable and immoveable
ચળામણ	चळामण	न	1 ચળામણી	छानने की मजदूरी	wages for sifting

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ચાળતા નીકળેલું ભૂસુ-કચરો	बूर, भूसा	chaff or refuse obtained by sifting
ચળામણી	चळामणी	स्त्री	ચાળવાનું મહેનતાણું	छानने की मजदूरी	wages for sifting
ચળાયમાન	चळायमान	वि	જુઓ 'ચલાયમાન'	चलायमान	see 'ચલાયમાન'
ચળાવવું	चळववું	स क्रि	'ચળવું', 'ચાળવું' નું પ્રેરક	'ચળવું', 'ચાળવું' का પ્રેરણાર્થક રૂપ	causal of 'ચળવું', 'ચાળવું'
ચળાવું	चळवું	अ क्रि	'ચાળવું' નું કર્મણિ	'ચાળવું' का कर्मणि રૂપ	passive of 'ચાળવું'
ચળિત	चळित	वि	જુઓ ચલિત'	देखिए 'ચલિત'	see 'ચલિત'
ચળું	चळું	न	હાથમા પાણી લેવા હથેળીને પાત્રાકાર કરવામા આવે છે તે	चुल्लू, आधी अजली, अचवना (खाने के बाद हाथ-मुँह धोते समय)	palmful
ચળુંપાણી	चळुपाणी	न	ચળું લેવાનું પાણી	चुल्लू करने का पानी	palmful water
ચગ	चग	पु	1 મોથી પકડીને વગાડવાનું એક વાજુ, મોરચગ 2 વગાડવાની પિત્તળની તકતી, તાવ	मुँह में पकड़ कर बजाने का एक वाद्य, मुँहचग वाद्य बजाने का पीतल का साधन	kind of musical instrument metal tongue with which the musical instru- ment (as in 1) is played upon
			3 પતંગનું પૂછડું 4 ગજીકાની રમત	कनकौवे की पूँछ ताश का एक खेल	tail of kite game of cards
		न	घट	घटा	bell
		वि	1 स्वच्छ	स्वच्छ	clean

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 મજેદાર	મજેદાર, આનન્દદાયક	pleasant
			3 તદુરસ્ત	સ્વસ્થ, તદુરસ્ત	healthy
ચગી	ચગી	વિ	1 ભાગગાળમા મસ્ત રહેનાર, વ્યસની	મગડ, મોગેડી - ગંજેડી	addict of drinks, opium etc
			2 કાછડીછૂટો	વ્યભિચારી	adulterous
ચગીભગી	ચગીભગી	વિ	જુઓ 'ચગી'	દેખિણ 'ચગી'	see 'ચગી'
ચગુ	ચગુ	વિ	નિરોગી, તદુરસ્ત	ચગા, તદુરસ્ત	healthy
ચગૂલ	ચગૂલ	ન	પક્ષીનો પજો	ચગુલ (પક્ષી)	claw of a bird
ચચલ	ચચલ	વિ	1 ડગમગતુ 2 અધીરુ 3 ક્ષણિક, ફાની	ડોંવાડોલ, અસ્થિર અધીર ક્ષણિક, ફાની	hesitating impatient transient, mortal
			4 ચકોર, ચાલાક	ચાલાક, સતર્ક	smart, clever
ચચલતા	ચચલતા	સ્ત્રી	1 ડગમગવુ તે 2 અધીરાપણુ 3 ક્ષણિકતા 4 ચાલાકી	ડગમગાના, અસ્થિરતા, ચચલતા અધીરપન ક્ષણિકતા ચાલાકી	unsteadiness impatience transitoriness cleverness
ચચલા	ચચલા	સ્ત્રી	1 ચચળ સ્ત્રી 2 લક્ષ્મી 3 વીજળી 4 એક છંદ	ચચલ સ્ત્રી ચચલા, લક્ષ્મી બિજલી એક વૃત્ત	clever woman Lakshmi lightning kind of metre
ચચળાઈ	ચચળાઈ	સ્ત્રી	ચચળતા	ચચલતા	agility, unsteadiness
ચચુ	ચચુ	સ્ત્રી	ચાચ	ચોંચ, ચચુ	beak, bill
ચચુપાત	ચચુપાત	પુ	1 ચાચ બોળવી તે	ચોંચ ડુબોના	dipping the beak into

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 (ला) प्रवेशमात्र, अल्प परिचय	अल्प परिचय, चचु प्रवेश	slight entry in (subject etc)
थयू	चचू	स्त्री	थाय	चोंच, चचु	beak
थयुपात	चचुपात	पु	जुओ 'थयुपात'	देखिए 'थयुपात'	see 'थयुपात'
थडाल	चडाल	वि	1 निर्दय, घातकी 2 पापी, नीच	निर्दय, घातकी पापी, नीच	cruel, mercile sinful, low
		पु	1 अेड जातनो अत्यज 2 भारो, जल्लाद	एक जात का अत्यज, चाडाल जल्लाद, हत्यारा	a class of untouchables assasin, murderer
			3 नीच-घातकी उर्म उरनार पुरुष	नीच कर्म करने वाला व्यक्ति, चाडाल (ला)	one who indulges in bad acts
थडाल	चडाल	वि, पु	जुओ 'थडाल'	देखिए 'थडाल'	see 'थडाल'
थडालथोडडी	चडालचोकडी	स्त्री	डाणा डम उरनाराओनी टोणी	कुकर्म करने वालों की टोली, चडालचोकडी	gang of mischief-mongers
थडालरा	चडालरा	स्त्री	1 थडाल स्त्री 2 थडालनी स्त्री	चाडाल स्त्री, चडालिनी चाडाल की स्त्री	woman of low caste wife of 'थडाल'
थडालरा	चडालणी	स्त्री	जुओ 'थडालरा'	देखिए 'थडालरा'	see 'थडालरा'
थडोल	चडोल	पु	1 अेड पक्षी 2 थडोल	चडूल (पक्षी) हिडोला	crested lark swing
थडोल	चडोल	पु	जुओ 'थडोल'	देखिए 'थडोल'	see 'थडोल'
थत	चत	पु	1 आशक 2 चिता 3 चित	आशिक चिता चित	lover worry mind
थद	चद	पु	1 थद	चद	the moon

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ચાલના તરીકે ક્રમાળે થોડવાની ટીકી	बिंदी, बिंदिया	small piece stuck on forehead as auspicious mark
		વિ	થોડુ, કેટલુક, જૂજ	कुछ, थोड़े-से, चढ़	a little, in small amount
ચદન	चदन	ન	1 સુખડનુ લાકડુ-ઝાડ 2 સુખડનો લેપ 3 ટીલુ, તિલક	चदन, सदल (पेड़, लकड़ी) चदन का लेप तिलक, टीका	sandalwood, sandaltree sandalwood paste mark of sandal paste on forehead
ચદા	चदा	સ્ત્રી	1 ચદ્ર 2 ચદની, ચાદરણ	चद्र चौदनी, छोटे छेदों में से आनेवाली रोशनी की किरन	the moon moonbeam
ચદાવુ	चदावु	અ ક્રિ	ચાદુ પડવુ, ડોહવાણ લાગવુ	छेददार घाव होना, चमड़ी सडना	to rot, to de- velop a soar
ચદી	चदी	સ્ત્રી	1 ઘોડા કે બળદને અપાતો સૂકો ઘણો 2 ખડણી 3 લાચરુશવત	घोड़े या बैल को दिया जाने वाला कोरा दाना, चदी खिराज (ला) रिश्वत	(daily allow- ance of) dry gram etc given to horses and other cattle tribute bribe
ચદો	चदो	પુ	1 ચાદો 2 ધાતુના પતરા ઉપર લાખેલુ બક્ષિસનામુ 3 ચહેરો, મુખવટો	चौद, चन्द्र ताम्रपत्र चेहरा, मुखाकृति	the moon deed of gift on metal plate face

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 ચદ્રમા જેવો ગોળ આકાર 5 ચાંદનો	चंद्र के जैसी गोल आकृति टीका, तिलक	round figure like the moon auspicious mark made on the forehead
ચદ્ર	चंद्र	पु	6 મહોર, છાપ 1 ચાંદો 2 ઉપગ્રહ (જેમ કે, શનિનો અમુક ચદ્ર છે) 3 છૂદણ, ટપકુ 4 ચાંદનો	मुहर, छाप चदामामा, चाँद, चन्द्र उपग्रह गोदना, बिंदु बिंदी	stamp, seal the moon satellite tattoo mark vermilion mark on forehead
ચદ્રક	चद्रक	पु	5 એકની સજા 1 ચાંદનો 2 મોરના પાંજાની ટીલડી 3 મહોર-છાપવાળો સિક્કો, બિલ્લો 4 ચદ્રના જેવો આકાર	एक की सजा बिंदी मोरपख पर का चद्राकार चिह्न पदक चद्र जैसा गोल चिह्न	sign of one vermilion mark on forehead coloured spot or eye on peacock's tail medal shape like that of the moon
ચદ્રકલા	चद्रकला	स्त्री	1 ચદ્રની ડળા, બિબનો સોળમો ભાગ 2 એક જાતની સાડી 3 ચદ્રનુ કિરણ 4 અબોડાનુ એક ઘરોણુ ચાંક	चद्रमडल का 16 वाँ भाग, चद्रकला एक प्रकार की साडी चद्र की किरण वेणी का एक गहना, चद्रकला	digit or one-sixteenth part of the orb of the moon kind of saree moonbeam kind of ornament to be worn in the hair-knot

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चंद्रशान्त	चंद्रकान्त	पु	એક જાતનો માણ, જેના ઉપર ચંદના ડિસ્ક પડતા તેમાંથી પાણી ઝરે છે	एक मणि जिसके विषय में प्रसिद्ध है कि चंद्रकिरण के स्पर्श से वह पसीज जाता है	moon-stone
चंद्रशान्ता	चंद्रकान्ता	स्त्री पु	1 રાત્રી 2 ચાંદની એક છંદ	रात, चंद्रकाता चौदनी एक वर्ण वृत्त	night moonlight a variety of poetic metre
चंद्रग्रहण	चंद्रग्रहण	न	ચંદ્રનું ગ્રહણ	चंद्रग्रहण	eclipse of the moon
चंद्रबिंब	चंद्रबिंब	पु	ચંદ્રનો ગોળો	चंद्रबिंब, चंद्रमंडल	orb of the moon
चंद्रमणि	चंद्रमणि	पु	જુઓ 'ચંદ્રશાન્ત'	देखिए चंद्रशान्त'	see 'चंद्रशान्त'
चंद्रमंडल	चंद्रमंडल	न	ચંદ્ર અને તેની આસપાસનું ક્રુડાણું	चंद्रबिंब, चंद्रमंडल	the moon and the circle, circular region around it
चंद्रमंडळ	चंद्रमंडळ	न	જુઓ 'ચંદ્રમંડલ'	चंद्रमंडल	see 'चंद्रमंडल'
चंद्रમા	चंद्रमा	पु	ચંદ્ર, ચાંદી	चंद्र, चाँद	the moon
चंद्रશાલા	चंद्रशाला	स्त्री	અગાશી	छत, चंद्रशाला,	terrace
ચંદ્રશાળા	चंद्रशाळा	स्त्री	જુઓ 'ચંદ્રશાલા'	चंद्रशाला, छत	see ચંદ્રશાલા'
ચંદ્રાચન	चंद्रायन	पु	એક છંદ	एक छंद	a metre
ચંદ્રાવળા	चंद्रावळा	पु	1 એક છંદ 2 એક જાતની કાવ્યરચના	एक छंद, चंद्रावर्ता	a variety of metre a variety of verse-form
ચંદ્રાવળી	चंद्रावळी	स्त्री	એક જાતનું ગીત	एक तरह का गीत	a variety of song
ચંદ્રી	चंद्री	स्त्री	ચંદ્ર	चंद्र	the moon

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थपક	चपक	पु	थपो	चपा (पेड)	kind of flowering tree, fragrant flower, 'champak'
थપકમાલા	चपकमाला	स्त्री	थेક છા	एक वर्णवृत्त, चपकमाला	a poetic metre
थપકવાર્ણ	चपकवर्णु	वि	थपानા ફૂલ જેવા રંગનું	चपा के फूल के-से रंग का	of the colour of <i>champak</i> flower
थપત	चपत	वि	ભાગતું, નાસી છૂટતું	चलता, गायब, चपत	running away, escaping
थપલ	चपल	पु, स्त्री, न	ઉપર ખોલ વગરનું એક પ્રકારનું પગરખું	चप्पल	slipper, sandal
थપાવવું	चपाववु	स क्रि	'आपवु' नु प्रेरक	'आपवु' का प्रेरणार्थक रूप	causal of 'आपवु'
थપાવું	चपावु	अ क्रि	1 'आपवु' नु કર્મણિ રૂપ 2 ગદકીમા પગ પડવો	चँपना, दबना, दबाया जाना मेले पर पाँव पडना	passive of 'आपवु' (of foot) fall into filth
થબું	चबु	पु	1 ભોટવા ઘાટનું એક વાસણ 2 કૂજો, ભોટવો	सुराहीनुमा एक बरतन कूजा, सुराही	jug flask
થબૂડિયો	चबूडियो	पु	ઊંચા ઘાટનો લોટો	ऊँचे आकार का लोटा	kind of jug
થબૂડી	चबूडी	स्त्री	નાનો થબું	छोटा लोटा	kind of small jug
થાઝર	चाऊर	न	વાવણી માટે અનાજ ઓરવાનું એક ઓળાર	बौसा, सेल	sowing implement

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चाटवो	चाटवो	पु	1 लाड्डानो डडछो 2 छलेसु	काठ की करछी, डौवा, पौना चप्पू	wooden ladle oar
चाटी	चाटी	स्त्री	लपडाड	थप्पड, तमाचा	slap
चाट्टु	चाट्टु	वि	1 छेडडाधु, थभापलु 2 चाटणियु 3 लाचियु	जरूरत से ज्यादा अक्लमद चटोरा घूसखोर	otherwise desirous of eating and licking corrupt
चाटो	चाटो	पु	चाटण, चाटण	चाटने की औषध	medicine to be licked up
चाडी	चाडी	स्त्री	छेडनी पात लीणने डडी देवी ते	एक की बात दूसरे को कह देना, चुगली	tale-bearing
चाडीभोर	चाडीखोर	वि	चाडियु, चाडी भावानी आदतवाणु	चुगलखोर	tale-bearer
चाडीचुगली	चाडीचुगली	स्त्री	चाडी, चुगली	चुगली	back-biting
चातरवु	चातरवु	स क्रि	1 चुपचाप सरकावी लेवु 2 छुपावरावु 3 भसेडवु	चुपके से सरकाकर ले लेना, उडाना छिपवाना खिसकाना, हटाना	to remove quietly to hide to remove
चातरी	चातरी	स्त्री	त्राड (रेटियानी)	तकुआ, तकला	axle of a spinning wheel
चातुरी	चातुरी	स्त्री	थतुराछ	चतुराई, चातुरी	cleverness
चातुर्मास	चातुर्मास	पु	देवपाटीशी देवडीडी छेडादशी सुधीना चार मासनो समय	चतुर्मास	four months of the rainy season

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. क्रो	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चातुर्मासु	चातुर्मासु	न	चतुर्मास, चोमासु	चतुर्मास, चोमासा	four months of the rainy season
चादर	चादर	स्त्री	ओछाड (जेम डे, ओडवानी, पशारीनी, मडदा डे डडननी)	चादर, चदर	covering (for bed, body or dead body)
चादरु	चादरु	न	चादरशी मोटु अने रगेरु पाथरु डे ओछाड	चादर से बड़ा और रंगीन बिछौना या ओढना	covering and dyed sheet often bigger than a bed-sheet
चानक्री	चानकी	स्त्री	नानो रोडलो डे भापरी	चँदिया, छोटी रोटी	small cake or <i>chapati</i>
चानकु	चानकु	न	1 ङुओ 'चानक्री' 2 नानु छोडरु	चँदिया, छोटी रोटी छोटा बच्चा	see 'चानक्री' small child
चानस	चानस	न	पतानी अेड रमत	गजीफे का एक खेल	a game of cards
चापचीप	चापचीप	स्त्री	1 टापटीप 2 चीडलाई, डोटडलापण	टीप-टाप चिकनाई, जरूरत से ज्यादा अक्ल इस्तेमाल करने की आदत	orderliness fastidiousness, overwisdom
चापचीपियु	चापचीपियु	वि	चापचीप डरवावाणु	टीप-टाप करने वाला	fastidious
चापडो	चापडो	पु	1 सण्णड राणे अेवो बध, पटो 2 अण्डना वे लूआने मेजा डरी अेड बनापेलो लूओ	किसी चीज को कसकर बाँधने का बध, पट्टी, चिप्पड गुँधे हुए आट के दो पिंडों को मिला कर बनाया जाने वाला एक पिंड, पंडा	clasp chunk of dough

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थाडिस	चाऊस	पु	લણકરના ડાઠા, નિશાન વગેરેની ટુકડોનો જમાદાર	सना क निशान-डक वाली टुकडी का मुखिया, जमादार	head of drummers in army
थाओण	चाओळ	न	જુઓ 'ચાગિં'	बौसा, सल	see 'चागिं'
थाडडो	चाकडो	पु	કુમારનો ચાક	कुम्हार का चाक	potter's wheel
थाडर	चाकर	पु	દાસ, નોકર	चाकर, नाकर	servant
थाडरडी	चाकरडी	स्त्री	ચાકરનું ગ્રામ ડરનાર સ્ત્રી	नौकरानी, चाकरनी	maid-servant
थाडरियात	चाकरियात	वि	1 ચાકરો ડુનાર 2 ચાકરિયુ	चाकरी करने वाला चाकरी से प्राप्त	one who works as servant wages of servant
थाडरियु	चाकरियु	वि	નોકર, ચાકર ચાકરી મેટે મળેલુ	नौकर, चाकर चाकरी से प्राप्त	servant what is obtained in lieu of service
थाडण	चाकळ	स्त्री	બે મોઢાનો આઘળો સાપ	दोमुँहा साँप, गौंगी	blind reptile or serpent with two mouths
थाडणण	चाकळण	स्त्री	જુઓ 'ચાકળ'	दोमुँहा, अधा साँप, गौंगी	see 'चाकण'
थाडणी	चाकळी	स्त्री	નાની ગાગર	छोटी गगर	small water-pot
थाडु	चाकु	न	1 थडु 2 गडियु 3 ખજૂરનું પાઠિયુ-ગૂણ	बडा टुकडा, टौकी धक्का खजूर का गट्टर	any large, thick slice thick roundish mass package of dates

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चाकू	चाकू	पु, न	चाकू, थप्पु	चाकू	pen-knife
चागलु	चागलु	वि	1 पवित्र छोवानो ढोंग करतु 2 मूर्ख धृता अतुर छोवानो ढोंग करतु 3 प्यार के लाड आछतु	पवित्र होने का ढोंग करने वाला पोंगा पडित लाड-प्यार का लोलुप	sanctimonious pretending to be very clever wanting love
चागणु	चागळु	वि	जुओ 'चागलु'	देखिए 'चागलु'	see 'चागलु'
चाचर	चाचर	पु	1 मडपनी अछारनो जुल्लो थोड 2 चार रस्तानु अछलु	मडप के बाहर का खुला चोक चौराहा, चौमहानी, चोक	open courtyard in front of a pavilion square where four roads meet
चाचरिया	चाचरिया	न	अछलानी देवीना गण	मुहल्ले की देवी के गण	attendants of the deity presiding over the square
चाटके	चाटको	पु	मनमा लागतो अटके	तीव्र मनोभाव, चुभन	mental twinge
चाटण	चाटण	न	1 चाटवु ते 2 चाटवानी औषधि	चाटना, चाटने की क्रिया चाटने की औषध, अवलेह	licking up medicine to be licked up
चाटणियु	चाटणियु	वि	चाटवा-आवानी लोळुपतावाणु	चटोरा, स्वादलोलुप	greedy of eating or licking
चाटण	चाटणु	न	चाटवानी औषधि	चाटने की औषध	medicine to be licked up
चाटलु	चाटलु	न	दर्पण	दर्पण, आईना	mirror
चाटलो	चाटलो	पु	रुपियो (तिरस्कारमा)	रुपया, रुपल्ली (तुच्छकार)	rupee (derog- atory)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			३ गोण नळि पण थपटा पत्ता पर वीटेलो धेर	चिपटे (गोल नहीं) पत्ते पर लपेटी हुई डोरी	string (of kite) wound round flat card
थापणियु	चापणियु	न	शमपातर	सकोरा, कसोरा	drinking cup of clay
थापलूसी	चापलूसी	स्त्री	१ ખુશામત २ थीपी थीपीने जोलपु ते, थलापलापण	चापलूसी, खुशामद, भूठी प्रशसा सजी-सँवरी बोली बोलना, चिलबिलापन	flattery speaking with over-accurate accent
थापाणी	चापाणी	न	था डे था साशेनो नास्ती	चाय-पानी	tea or tea with refreshments
थापाणीमा	चापाणीमा	अ	પરચૂરણ ખર્ચમા	चाय-पानी में, फुटकर खर्च में	miscellaneous expenses for tea and refreshments
थापु	चापु	न	અખુ, આકુ	चाकू	pen-knife, knife
थापुओ	चाबुओ	पु	१ ડોરડો २ અસરકારક-માર્મિક વચન	चाबुक, कोडा लगने वाली बात-मार्मिक वचन (ला)	scourage taunt, admonition
थापुड	चाबुक	पु	थापुड, डोरडो	चाबुक, कोडा	whip
थापुडसवार	चाबुकसवार	पु	ધોડો કેળવનારો	घोडा सधाने वाला, चाबुकसवार	jockey, horse-breaker
थाम	चाम	न	थामडी, थामडु	चमडा, चाम	skin, hide
थामजेडु	चामखेडु	न	મદારીની ઝોળી, જાદુગરની પેટી	जादूगर की पेटी	a magician's bag or wand
थामजू	चामजू	स्त्री	थामडी पर थोटती जू	चमडी पर चिपकनेवाली जू	louse sticking to skin

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ચામઠુ	ચામઠુ	વિ	1 ભૂલો જોનારુ, વાધાખોરિયુ 2 દોઢકાધુ 3 છદીલુ	દોષ દર્શન કરને વાલા, નુકતાચી, છિદ્રાન્વેષી જરૂરત સે જ્યાદા અક્લમદ મૌજી, શૌકીન	fault-finding over-wise self-willed
ચામડ	ચામડ	વિ	ચામડા જેવુ ચીકણ	ચમડે જૈસા સહત	tough like leather
ચામડિયણ	ચામડિયણ	સ્ત્રી	ચામડિયાની સ્ત્રી	ચમારિન	feminine of 'ચામડિયો'
ચામડિયો	ચામડિયો	પુ	ચામડા ઉતારવા— કેળવવાનુ કામ કરનારો કે તેની નાતનો, ચમાર	ચમાર	one who removes skin of dead bodies or tans them, skinner, tanner
ચામડી	ચામડી	સ્ત્રી	ત્વચા (શરીર પરની)	ત્વચા, ચમડી (શરીર આદિ કી)	skin
ચામડુ	ચામડુ	ન	1 ઢોરની ઉતારેલી ખાલ 2 ચામડી (તુચ્છકારમા)	ચૌપાયે કી ઉતારી હુઈ ખાલ, ચમડા ચમડી (તુચ્છકાર મે)	hide leather (derog)
ચામાચીડિયુ	ચામાચીડિયુ	ન	વાગોળની જાતનુ એક નાનુ પ્રાણી	ચમગાદડ	a kind of small bat
ચામાચેણ	ચામાચેણ	સ્ત્રી	1 છછૂદર 2 જુઓ 'ચામાચીડિયુ'	છછૂદર ચમગાદડ	blind mouse see 'ચામાચીડિયુ'
ચાર	ચાર	વિ	1 ' ૪ ' 2 થોડુધણુ, કઈક ગણનામા લેવા જેટલુ જ્ઞેમ કે, તે ચાર પૈસા ડમાયો છે)	ચાર, 4 કુછ, કઈ	four, 4 a little, some- what, considerable

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रजी पर्याय
			३ थोडु, अल्प (जेम डे, चार दिवसनु चादरगु)	थोडा, अल्प	little, short-lived
चारभूशियु	चारखूणियु	स्त्री वि	लीलु घास, चारे चार भा ॥वागु	हरी घास, चाग चोकाना, चौकोर	green grass having four corners or angles
चारभूट	चारखट	वि	१ चारे भूना २ आभी पृथ्वी	चारों कान सारी पृथ्वी	all the four directions the whole earth
चारसे	चारसै	वि	४००	चौखैट, चारआर	all, entire
चारसो	चारसो	वि	४००	चार सो	four hundred, 400
चारित्र	चारित्र	न	१ आचरण २ शील, सदाचार	चाल-चलन, आचरण शील, सदाचार	behaviour character
चारित्र्य	चारित्र्य	न	४०० 'चारित्र'	देखिए 'चारित्र'	see 'चारित्र'
चारियु	चारियु	वि	१ जेभा मात्र चार थती छोथ तेवु (जेतर)	जिसमे सिर्फ घास उगती हो ऐसा (खेत)	(of land) in which only grass grows
			२ इअ चार भानार ढोरनु (धी)	सिर्फ चारा खाने वाले मवेशियों का (धी)	(of ghee) of cattle feeding on grass only
		न	१ चार पाटी लावनार भागस २ चार पाधवानु वस्त्र	चारा काटने वाला चारा बाँधने का कपडा	man who mows grass piece of cloth in which grass is collected
चारे	चारे	अ	चारेथ, लधु	चारों, सारा	on all the four sides

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
आरेगम	चारेगम	अ	चोतरक्ष, अर्धी ओर	चारों ओर, सब ओर	all around, on all four sides
आरे वेण्ण	चारे वेळा	स्त्री	दिवसनो चोथो-छेत्तो पछोर, समीसाण	सौंभ, शाम	fourth or last part of the day
आरो	चारो	पु	1 पशुपणीनो जोराक्ष, भक्ष 2 छलाण, उभाय 3 (ला) सत्ता, अलाण	पशु-पखी की खुराक, चारा इलाज, चारा सत्ता, चलन	food for cattle or birds remedy, means authority, power
आरोणी	चारोळी	स्त्री	अेक सूको भेवो	चिरौजी	kind of dry fruit
आल	चाल	पु	रिवाण	चाल, रीतिरिवाज, प्रणाली	custom
		स्त्री	1 (ला) आलवानी पद्धति, छीकछा 2 आलवानी गति 3 झूटी वगेरे अलावपी ते के तेनो धव 4 आलअलगत, वर्तणूक 5 जुओ 'आली'	चलने का ढग, चाल गति, रफ्तार (खेल में) मोहरा चलाना या उसका ढाँव	gait speed of walking moving a piece in chess or strategy of such a move
आलअलगत	चालचलगत	स्त्री	1 वर्तणूक 2 आरित्र, शील	चलन, आचरण चारित्र्य, शील	conduct, behaviour character
आलअलाण	चालचलण	न	जुओ 'आलअलगत'	देखिए 'आली'	see 'आलअलगत'
आलअलाणियु	चालचलणियु	वि	कामअलाउ	कामचलाऊ	temporary, provisional
आलअलाउ	चालचलाउ	वि	जुओ 'आलअलाणियु'	कामचलाऊ	see 'आलअलाणियु'
आलाणगाडी	चालणगाडी	स्त्री	छेकशने आलता शीअववानी गाडी	घुडला	child's go-cart

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	શ્યા કો	ગુજરાતી અર્થ	હિન્દી પર્યાય	અંગ્રેજી પર્યાય
ચાલણચૂલો	વાલણચૂલો	પુ	સ્ત્રી-અમચલાઉ ચલા	સમચલાઉ ચૂલો	portable stove
ચાલતી	ચાલતી	સ્ત્રી	ચાલતા થયુ તે	ચલતા ચલતા	speaking easily
ચાલતુ	ચાલતુ	વિ	1 ચાલુ, ચતમાન 2 ચતમાન 3 અમ દેતુ, 'અયોગી	ચલ ચલમાન માનમાન, યતી ચલમા અમાગી, અમ દેતુ ચાલક	content continuous in motion active useful serviceable
ચાલબાજી	ચાલબાજી	સ્ત્રી	1 સ્ટી ઇ ચલાવવાની સત કે હોશિયારી 2 (લા) પ્રપચ યુક્તિ, ચાલાવે	શોશિયારી મેલ (બંદી ચલાવી શી) ચાલમાત્રી ચાલતી પ્રપચ	skill in making moves cunning move trick
ચાલવુ	ચાલવુ	અ ક્રિ	હાલુ	ચલના માનમાન હાના, ચલના હાના ચલતિના હાના પ્રમાન ચલના	to walk
ચાલુ	ચાલુ	વિ	હાલુ, ચતમાન	હાલ ચા, ચતમાન, ચલતા હા, ચાગી	of the present present
ચાવડુ	ચાવડુ	વિ	1 ચાતોડુ 2 બોલવામા ચતુર ન અનાજ વાવવા-ઓરવાનુ સાધન, ચાગીર	ચાવનો ચોલને મે ચતુર ચોલા, મેલ	talkative clever at talking sowing-drill
ચાવણિયા	ચાવણિયા	ન	1 નખરા, હાવબાવ 2 મલાવડા	નખરે મોઠે ચોલ	enticing gestures coyness
ચાવણ	ચાવણ	ન	અચુકોરુ ખાવાનુ, ચવાણ	ચવેના	something to eat
ચાવલ	ચાવલ	પુ	ચોખા	ચાવલ	rice
ચાવલા	ચાવલા	ન	જુઓ 'ચાવણિયા'	દેલિષ ચાવણિયા'	see 'ચાવણિયા'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चाववु	चाववु	सक्रि	भावा माटे दातपती उचरवु	चबाना	to chew
चावण	चावळ	पु	इंसो, वाणीशयो	बाँसा, सेल	name of an agricultural implement
चाध	चाष	पु	अेड पक्षी	चाष, नीलकठ पक्षी	a bird
चास	चास	पु	जेडवाथी पडतो लाणो आओ	हल जोतने से बनी हुई गहरी लकीर, कूँड	furrow of a plough
		स्त्री	1 जोट 2 जूओ 'चासणी'	टोटा, घाटा देखिए 'चासणी'	loss see 'चासणी'
चासणी	चासणी	स्त्री	1 उअणीने करतु जाडनु प्रवाळी	चाशनी, शीरा	syrup, sugar and water boiled (till it is thick)
			2 इसोटी	कसौटी	test
			3 नमूनो	नमूना	sample
			4 चासवानी डिया	हल जोतकर गहरी लकीरें बनाने की प्रक्रिया	turrowing
चासन	चासन	वि	जाडे-उद्याडु	जाहिर, खुले-आम, प्रकट	public, open
		अ	जाडेरशते	खुले तौर पर, जाहिर में	publicly, openly
चाड	चाह	पु	जूओ 'चाडना'	देखिए 'चाडना'	see 'चाडना'
चाडड	चाहक	वि	चाडनार, डेताण	चाहने वाला	loving
चाडन	चाहन	वि, अ	जूओ 'चासन'	देखिए 'चासन'	see 'चासन'
चाडना	चाहना	स्त्री	1 पसडगी, धुधु	इच्छा, पसद, रुचि	choice performance desire

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 प्यार, छेत	प्यार, स्नेह, चाह	love, fondness
चाहे	चाहे	अ	छच्छ भुज्ज, भरज्जभा आवे तेम	चाहे, मरजी में आये	as desired, as you wish
चाणरा	चाळण	न	जुओ 'चणामरा'	देखिए 'चणामरा'	see 'चणामरा'
चाणरी	चाळणी	स्त्री	चाणवानु पारीक छिद्रोवाणु साधन	चलनी, छलनी	sieve
चाणवु	चाळवु	स क्रि	1 अवारनवार उशलाववु-इरभएल इरवु 2 सथारवु (छापरु) 3 जुदी जुदी रीते उपयोग इरवो	उलट-फेर करना, फेरना (कभी-कभी) खपरेलों को फेरना/ठीक करना अलग-अलग तरीके से प्रयोग करना	to change or turn upside down turn tiles of a roof use in different ways
चाणा	चाळा	पु	1 मइरी भातर छोछु अनुइरए- नइल इरवी ते 2 छापभाव, नभरा, अगयेष्टा 3 अडपला, तीक्ष्ण	मजाक के लिए नकल उतारना, स्वाग नखरे, चोंचले, हाव-भाव, चेष्टा नटखटी, शरारत	mimicry gestures, coquetry pranks, mis- chief
चाणाचसअ	चाळाचसका	पु	1 नभरा, छापभाव 2 आनाडानी	नखरे, चोंचला आनाकानी, टालमटूल	blandishments hesitation
चाणी	चाळी	स्त्री	बकरी	बकरी	she-goat
चाणु	चाळु	न	बकरा	बकरा	he-goat
चाणीस	चाळीस	वि	' ४०	चालीस, 40	forty, 40
चाणो	चाळो	पु	1 चाणानु अे व 2 लक्षरा, निशानी, अेधारा	नखरा लक्षण, निशान, चिह्न	gesture etc sing of 'चाणा' omen, harbinger, indication

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थाઈ	चाई	वि स्त्री	शरमिदु नानो थाळो	शरमिदा, लज्जित छोटा टीका	abashed small red mark on forehead
थाઉ ડરવુ	चाउ करवु		પચાવી પાડવુ, અયોગ્ય રીતે લઈ લેવુ-ખાઈ જવુ	हजम कर जाना, हडपना	to misappropri- ate
थाઉ ડરી જવુ	चाउ करी जवु		જુઓ 'યાઉ ડરવુ'	हडपना, माल मारना	see 'थाઉ ડરવુ'
યાગળુ	चागळु	न	ચાર આગળાની અજલી	चुत्लू	cavity formed by bringing four fingers closer
યાચડ	चाचड	पु	એક જતુ	पिस्तू	flea
યાચવુ	चाचवु	न	ચાચવાળુ, અનાજમા પડતુ એક જીવડુ	अनाज में पडने वाला चोंचदार कीडा	insect with a beak found in corn
		वि	બહુ બોલ બોલ કરનારુ	वाचाल	talkative
યાચવો	चाचवो	पु	જમીન ખોદવાનુ હથિયાર, તીકમ	गैंती	pick-axe
યાચિયો	चाचियो	पु	દરિયાઈ લુટારો	जहाजी डाकू, जलडकैत	pirate
યાડાલ	चाडाल	वि, पु	જુઓ 'ચડાળ'	देखिए 'चडाળ'	see 'ચડાળ'
યાડાલાણ	चाडालण	स्त्री	ચડાળણ	चडालिनी	f of 'ચડાળ'
યાદરડુ	चादरडु	न	1 તારાઓનો આખો પ્રકાશ 2 ચાદની 3 ઓશા ડાશામાથી પડતુ અજવાળાનુ ચાદુ	तारो की धुंधली रोशनी चौदनी छोटे छेद से आने वाली रोशनी की किरण	dim light of stars moonlight beam of light or white spot caused by beam coming through small hole

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
આદરણી	चादरणी	वि	આદરણાવાળી	चॉदनी वाली	having moonlight star
		स्त्री	1 તારે 2 આદરણ	सितारा चॉदनी	moonlight
આદરણ	चादरणु	न	જુઓ 'આદરડું'	देखिए 'आदरडु'	see 'आदरडु'
આદરુ	चादरु	वि	1 ધોળા આદાવાળુ 2 (લા) નિરકુશ, મસ્તાની	सफेद चित्तीदार निरकुश, मस्ताना	having white spots intoxicated
આદલિયો	चादलियो	पु	આદો (પ)	चॉद, चॅदा	the moon
આદલો	चादलो	पु	આલ્લો	टीका, तिलक	money-present given on auspicious occasions
આદવુ	चादवु	वि	અડપલાખોર, અટક્યાળુ	नटखट, शरारती	mischievous
		न	અડપલુ, અટક્યાળુ	नटखटी, शरारत	mischievous
આદી	चादी	स्त्री	1 એક ધાતુ, શુદ્ધ રૂપુ 2 એક ચેપી રોગ 3 જ્યાથી ખાલ ખસી ગઈ હોય કે ઉપસી હોય એવુ આદુ, ધારુ	चॉदी (धातु) एक सक्रामक रोग, उपदश जहाँ से चमडी छिल गई हो या उभरी हो ऐसा छाला	silver syphilis scar
આદીકામ	चादीकाम	न	આદી ઉપરની નકશી	चॉदी के ऊपर की नक्काशी	engraving on silver
આદુ	चादु	न	1 જુઓ 'આદી' 2 આદાનો ડાઘ, આદુ 3 લાઇન, ડાઘ 4 છિદ્ર, દોષ	देखिए 'आदी' घाव का दाग, चकत्ता लॉछन, दाग (ला) छिद्र, दोष	see 'आदी' scar, mark stigma fault, blemish

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थाधे	चादो	पु	1 चद्र 2 तेना जेवो गोण आधर	चद्र, चॉद चद्र के जैसा गोल आकार	the moon round like the moon
थापतु	चापतु	वि	1 सभत, आकरु 2 ऊट असर करे तेपु	सखत, कडा जल्द असर करनेवाला	strict, stringent effective instantly
थापवु	चापवु	स क्रि	1 ध्वावपु 2 लग्गावपु, ध्मावपु 3 लाय आपवी 4 ठासवु	चॉपना, दबाना जलाना, भुलसाना घूस देना (ला) ठूसना	to press to burn, to set on fire to bribe to gorge, to cram (food)
थापु	चापु	ने	1 इणसनी पेशी 2 नाकनी नशमानो अेक भाग 3 माशानु अेक धरेण	कटहल का बीजकोष, कोया नाक की नथ का एक हिस्सा सिर का एक गहना	lump of pulp of jack-fruit particular part of nose-ring kind of ornament of head
थाल्लो	चाल्लो	पु	1 उभाणे उरातु गोण टपकु 2 तेनी उपर थोडवानी टपधी 3 शुभ प्रसंगे अपाती नाणानी धेट 4 बराबर नर्छा गणेल्लो धाणो	तिलक, टीका बिंदी, टिकिया मंगल अवसर पर दी जाने वाली पैसों की भेंट, बरोक, टीके का रुपया ठीक तरह नहीं गला हुआ (दाल का) दाना	auspicious red mark on the forehead the small mark to be fixed on the forehead present given in the form of money on an auspicious occasion grain of pulse which has remained uncooked

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચિકટાવવુ	चिकटाववु	स क्रि	'चीकटावु' नु प्रेरक	'चीकटावु' का प्रेरणार्थक रूप	causal of 'चीकटावु'
ચિકન	चिकन	न	ભરતકામ	कारचोबी, कशीदे का काम	embroidery
ચિકનદોજ	चिकनदोज	पु	ભરત ભરનારો	कारचोब	one who embroiders
ચિકાખાઈ	चिकाखाई	स्त्री	જુઓ શિકાકાઈ'	देखिए 'शिकाकाई', सीकाकाई	see 'शिकाकाई'
ચિકિત્સા	चिकित्सा	स्त्री	1 વૈદકનો ઉપચાર 2 ગુણદોષ પારખવાની શક્તિ 3 ટીકા, દોષદર્શન	रोग-निवारण का उपचार', औषधोपचार, इलाज गुण-दोष का अवलोकन करने की शक्ति टीका-टिप्पणी, दोषदर्शन	diagnosis or treatment power of discrimination criticism, fault-finding
ચિખલ	चिखल	पु	કાદવ	कीचड	mud, slush
ચિખ્ખલ	चिख्खल	पु	જુઓ 'ચિખલ'	कीचड	see 'ચિખલ'
ચિચૂકો	चिचूको	पु	આખલીનો ઠળિયો	चिआ, चिचा	tamarind-seed
ચિચૂકો	चिचूको	पु	જુઓ 'ચિચૂકો'	चिआ, चिचा	see 'ચિચૂકો'
ચિચોટિયુ	चिचोटियु	न	હૈડિયો	घटी, टेंदुवा	Adam's apple
ચિચોટો	चिचोटो	पु	જુઓ 'ચિચોટિયુ'	घटी, टेंदुवा	see 'ચિચોટિયુ'
ચિટનવીસ	चिटनवीस	पु	જુઓ 'ચિટનીસ'	चिटनवीस	see 'ચિટનીસ'
ચિટનીસ	चिटनीस	पु	મત્રી, અવલકારકુન	चिटनवीस	secretary, head clerk
ચિટ્ઠી	चिट्ठी	स्त्री	1 શોડા મતલબનો કાગળ કે કાપલી નાનો	चिट्ठी, खत, पुरजा	small note or chit

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ડાળોતરી	मृत्यु की खबर देने वाली चिट्ठी	letter informing of the death of a person
			3 ભલામણપત્ર	सिफारिशनामा, सिफारिशी चिट्ठी	letter of recom- mendation
ચિઠ્ઠીપાટી	चिट्ठीचपाटी	સ્ત્રી	ડાળપત્ર	चिट्ठी-पत्री	note or letter
ચિઠ્ઠીપત્રી	चिट्ठीपत्री	સ્ત્રી	જુઓ 'ચિઠ્ઠીપાટી'	चिट्ठी-पत्री	see 'ચિઠ્ઠીપાટી'
ચિડકણ	चिडकणु	વિ	ચીડિયા સ્વભાવનુ	चिडचिडा	irritable
ચિડાવુ	चिडावु	અક્રિ	ખીજવાવુ, ગુસ્સે થવુ	चिडचिडाना, चिढना	to be angry
ચિડિયલ	चिडियल	વિ	ચીડિયુ	चिडचिडा	irritable
ચિઢાણ	चिढाणु	વિ	ચીકટવાળુ અને વાસ માસ્તુ	चीकट और बदबूदार	sticky or greasy and stinking
ચિણગારી	चिणगारी	સ્ત્રી	તણખો	चिनगारी, छोटा अगारा	spark
ચિણગી	चिणगी	સ્ત્રી	જુઓ 'ચિણગારી'	चिनगारी	see 'ચિણગારી'
ચિત	चित	ન	1 જ્ઞાન, ચેતના 2 ચિત્ત 3 ચૈતન્ય, જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ	ज्ञान, चेतना चित्त चैतन्य, ज्ञानस्वरूप ब्रह्म	knowledge or consciousness mind Brahma (which is all knowledge)
ચિતચોર	चितचोर	પુ	ચિત્ત ચોરી જનાર	चित्त चुराने वाला, चित्तचोर	winsome, attractive
ચિતડુ	चितडु	ન	ચિત્ત (પ)	चित्त	(poet) mind
ચિતારો	चितारो	પુ	ચિત્રકામ કરનારો	चितेरा, चित्रकार	painter
ચિતાળ	चिताल	સ્ત્રી	ચીરેલા લાકડાનો કડકો, ચીતળ, કાચરો	चैला, फट्ठा	chip, small wedge-like piece of wood

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चित्त	चित्त	न	1 अतडरश, मन 2 लक्ष, ध्यान	अत करण, मन ध्यान (ला)	inner con- science, mind attention
चित्तशास्त्र	चित्तशास्त्र	न	मानसशास्त्र, 'साइकोलॉज'	मानसशास्त्र, मनोविज्ञान, 'साइकोलोजी'	psychology
चित्तार्थक	चित्तार्थक	वि	चित्तने आर्थे अे, मनोहर	मनोहर, चित्तार्थक	attractive beautiful
चित्र	चित्र	न	1 चीतरेलु ते, छपी 2 જે અક્ષરમા જે પ્રશ્ન થયો હોય તેજ અક્ષરોથી તે પ્રશ્નનો ઉત્તર મળે એ શબ્દની ખૂબી	चित्र, तस्वीर एक काव्यप्रकार	picture, painting kind of verse
चित्रकला	चित्रकला	स्त्री	चित्र दोरपानी डणा	चित्रकला, चित्रविद्या	art of painting
चित्रकळा	चित्रकळा	स्त्री	જુઓ 'ચિત્રકલા'	चित्रकला	see 'चित्रकला'
चित्रकाम	चित्रकाम	न	चित्रनु काम, चितारानो धधो	चित्रकर्म, चितरे का पेशा	painting
चित्रकार	चित्रकार	पु	चित्र दोरनारो	चित्रकार, चितेरा	painter
चित्रकाव्य	चित्रकाव्य	न	चित्रना आधारमा लजेली श्रवता	चित्रकाव्य	acrostic
चित्रपट	चित्रपट	पु, न	1 જેના પર ચિત્ર દોર્યું હોય તે કપડુ કે પાટિયુ 2 પડદો 3 સિનેમાની ફિલ્મ	चित्रपट (कपडा, फलक आदि) परदा सिनेमा की फिल्म	canvas or board of picture screen cinema film

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચિત્રફલક	चित्रफलक	न	ચિત્ર ઢાઢવાનુ પાટિયુ— ફલક	चित्रफलक	board for drawing a picture on
ચિત્રમજૂષા	चित्रमजूषा	स्त्री	ચિત્રોના સગ્રહની વહી, 'આલ્બમ'	'आल्बम', चित्रमजूषा	album
ચિત્રલિપિ	चित्रलिपि	स्त्री	સાકેતિક ચિત્રોની બનેલી લિપિ	साकेतिक चित्रो से बनाई गई लिपि, लिखावट	script made of ideography
ચિત્રલિપી	चित्रलिपी	स्त्री	જુઓ 'ચિત્રલિપિ'	देखिए 'चित्रलिपि'	see 'ચિત્રલિપિ
ચિત્રવત્	चित्रवत्	अ	ચિત્ર જેવુ, સ્તબ્ધ	चित्र जैसा, स्तब्ध, जडीभूत	like a picture still
ચિત્રવિચિત્ર	चित्रविचित्र	वि	1 રગબેરગી 2 વિચિત્ર, વિલક્ષણ	रगबिरगी असाधारण, विलक्षण	variegated odd, queer
ચિત્રવિદ્યા	चित्रविद्या	स्त्री	ચિત્ર દોરવાની વિદ્યા-કળા	चित्रविद्या	art of drawing or painting
ચિત્રશાલા	चित्रशाला	स्त्री	ચિત્રો ઢાઢવાનુ અથવા ઢાઢતા શીખવાનુ સ્થાન	चित्रशाला	studio
ચિત્રશાળા	चित्रशाळा	स्त्री	જુઓ 'ચિત્રશાલા'	चित्रशाला	see ચિત્રશાલા'
ચિત્રિત	चित्रित	वि	1 ચીતરેલુ 2 રગબેરગી, ચિત્રવિચિત્ર	चित्राकित, चित्र खींचा गया हो जिसका चितकबरा, रगबिरगा	painted variegated
ચિત્રો	चित्रो	पु	જુઓ 'ચીતરો'	देखिए 'चीतरो'	see ચીતરો'
ચિથરિયુ	चिथरियु	वि	જુઓ ચીથરેહાલ, ચીથરિયુ	देखिए चीथरेहाल	see ચીથરેહાલ', ragged

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चिद्रूप	चिद्रूप	वि	ज्ञानस्वरूप	ज्ञानस्वरूप	knowledge incarnate
चिनगारी	चिनगारी	स्त्री	जुओ 'चिगारी'	चिनगारी	see 'चिगारी'
चिनगी	चिनगी	स्त्री	जुओ 'चिगारी'	चिनगारी	see चिगारी
चिनाँ	चिनाई	वि	1 चीनमा बनायेलु, चीन देशनु 2 चिनाँ माटीनु बनायेलु 3 तडलाई, आर्षड पण टके नाँ अवे	चीन देश मे बना हुआ, चीनी चीनी मिट्टी का बनाया हुआ नाजुक, कम टिकाऊ	made in China of China made of China clay not durable merely attrac- tive but not lasting
		स्त्री	अँ जतनी रेशमी साडी	एक किस्म की रेशमी साडी	kind of silk-sari
चिनाँमाटी	चिनाईमाटी	स्त्री	अँ जतनी सँडे माटी जेना वासण वगेरे घाट बनावाय छे	चीनी मिट्टी	China clay
चिनाँसिग	चिनाईसिग	स्त्री	शेडेली डे भीठे पासेली भगइणी	मूंगफली, चीनी बादाम	peanuts baked or salted
चिनार	चिनार	पु	अँ जतनु आँ	एक पेड	a kind of tree
चिनिकबाला	चिनिकबाला	पु	अँ वनस्पतिना बीज- औषधि	एक औषध (बीज)	seeds of a kind of vegetation, a medicinal herb
चिबुक	चिबुक	स्त्री	डपची, दाँ	ठुड्डी, ठोडी	chin
चिबोळवु	चिबोळवु	स क्रि	आमणवु, चीमटी देवी	मरोडना, ऐँठना, चुटकी भरना	to twist to wring
चिमराज	चिमराज	न	अँ पक्षी	एक पक्षी	kind of bird
चिमेड	चिमेड	स्त्री	अँ वनस्पति-औषधि	एक औषध	kind of medicinal herb

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
धिभोडियु	धिभोडियु	न	धिभोडो	बडी किलनी, चिचडा	louse on dogs etc
धिभोड	धिभोडी	स्त्री	1 अेक जातना वेलाणा बिया 2 णुओ 'धिभोटी' 3 णुओ 'धिभोडियु'	एक तरह की बेल के बीज गर्दन बडी किलनी	seeds of a kind of creeper see 'धिभोटी' see 'धिभोडियु'
धिभोड	धिम्मड	वि	1 थामडा णेपु, शेटेतूटे नहि अेपु 2 (ला) डणूस	चीमड कजूस	sticky like leather miserly, stingy
	चिर	वि	1 लाभा (समय भाटे) 2 लाभा वणतनु लाभा वणत सुधी	लम्बा (समय के लिए) दीर्घकालीन बहुत समय तक, सदा	long (of time) of long time for a long time
	चिरकाल	पु	लाभो समय	चिरकाल, दीर्घकाल	for a long time
	चिरकाळ	पु	णुओ 'चिरकाल'	चिरकाल	see 'चिरकाल'
	चिरकालीन	वि	लाभा वणतनु-णुनु	पुराना, चिरकालीन	long-standing old
	चिरस्थायी	वि	दीर्घकाल सुधी टडी रहे अेपु	चिरस्थायी, चिरस्थ	lasting for a long time, eternal
	चिरस्मरणीय	वि	चिरकाल थाए राजवा योग्य	चिरस्मरणीय	memorable
	चिरजीव	वि	1 लाभा आवरदावाणु 2 पुत्र	बहुत दिनों तक जीने वाला, चिरायु, चिरजीवी हो (आशीर्वाद) पुत्र, बेटा	long-lived

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ચિરજીવી	चिरजीवी	वि	લાખા આવરદાવાળુ	चिरजीवी, चिरजीव	long-lived immortal
		पु	પુત્ર	बेटा, चिरजीव	son
ચિરાગ	चिराग	पु	1 દીવો, બત્તી	दिया, दीपक, चिराग	lamp, light
			2 શગ (દિવાની)	दीपक की लौ, दीपशिखा	flame of lamp
ચિરાડો	चिराडो	पु	જુઓ ચીરો	देखिए चીरो	see ચીરો
ચિરાયુ	चिरायु	वि	લાખા આવરદાવાળુ, દીર્ઘાયુ	चिरायु, चिरजीवी	long-lived
ચિરાવવુ	चिराववु	सक्रि	ચીરવુ નુ પ્રેરક	ચીરવુ કા પ્રેરણાર્થક સ્વ	causal of 'ચીરવુ'
ચિરાવુ	चिरावु	अक्रि	ચીરવુ નુ કર્મણિ	ચીરવુ કા કર્મણિ સ્વ	passive of 'ચીરવુ'
ચિરૂટ	चिरूट	पु, स्त्री	તમાકુના પાનનો જ વાળેલો મોટો ટોટો-એક પ્રકારની બીડી	चुम्ट, सिगार	cheroot
ચિરોટી	चिरोटी	સ્ત્રી	એક પકવાન	एक पकवान	a sweet dish
ચિરોડી	चिरोडी	पु	એક જાતનો પોથો પથ્થર	एक प्रकार का नर्म पत्थर	kind of soft stone
ચિગુ	चिगु	वि	1 બહુ ડરકસરિયુ, ડજૂસ 2 માંટુ	हृद से ज्यादा क्लिफायतशार, कजूस, खसीस मचला	over thrifty over miserly one who does not give his mind
ચિગૂસ	चिगूस	वि	જુઓ ચિગુ	देखिए 'चिगु'	see ચિગુ
ચિત	चित	સ્ત્રી	1 ડિકર	फिक्र, चिता	worry, anxiety

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 विचार	विचार	thought
चिंतक	चितक	वि	1 चिंतन करणारा 2 विचारक, शिस्तसूत्र	चिंतन करने वाला विचारक, दार्शनिक, फिलासफर	one who thinks thinker or philosopher
चिंतन	चितन	न	विचार, मनन	विचार, मनन, चितन	meditation thinking
चिंतनशील	चितनशील	वि	चिंतन करणारा स्वभाववाणु	चिंतनशील	contemplative
चिंतनात्मक	चितनात्मक	वि	विचार-मननशील (भरेलु)	चिंतनात्मक	thoughtful, reflective
चिंतवन	चितवन	न	चिंतन	चिंतन, सोचना-विचारना	see 'चिंतन
चिंतवणु	चितवणु	सक्रि	मनन करणु, विचारण	सोचना, चिंतन करना	to think, reflect
चिंता	चिता	स्त्री	1 शिंश 2 विचार	फिक्र, सोच, चिता विचार	Care, worry thought
चिंताकुल	चिताकुल	वि	चिंताशी आकुल थयेलु- गभशयेलु	उद्विग्न, चिताकुल	anxious
चिंताकुळ	चिताकुळ	वि	गुथो चिंताकुळ'	उद्विग्न, चिताकुल	see चिंताकुल
चिंतातुर	चितातुर	वि	चिंताशी व्याकुल	चिता से बेचैन, उद्विग्न	anxious
चीक	चीक	पु,स्त्री	वनस्पतिना शूण, डाणभा वगेरेमाशी नीकणतु चीकणु पाणी अथवा धूध	निर्यास (वनस्पति)	sap of several trees and plants
चीकट	चीकट	वि	1 चीकणु 2 तेल छ ना पासवाणु	चिकना, चीकट तेल, घी आदि लगा हुआ	sticky, oily, greasy

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चिरञ्जवी	चिरजीवी	वि	लाभा आपरदावाणु	चिरजीवी, चिरजीव	long-lived immortal
		पु	पुत्र	बेटा, चिरजीव	son
चिराग	चिराग	पु	1 दीपो, अत्ता 2 शग (दिवानी)	दिया, दीपक, चिराग दीपक की लौ, दीपशिखा	lamp light flame of lamp
चिराडो	चिराडो	पु	जुओ थोरो	देखिए थोरो'	see थोरो'
चिरायु	चिरायु	वि	लाभा आपरदावाणु, दीर्घायु	चिरायु, चिरजीवी	long-lived
चिरावपु	चिरावपु	सक्रि	थोरपु नु प्रेरक	थोरपु' का प्रेरणार्थक रूप	causal of 'थोरपु'
चिराव	चिराव	अक्रि	थोरपु' नु कर्मणि	थोरपु का कर्मणि रूप	passive of थोरपु'
चिरुट	चिरुट	पु, स्त्री	तमाकुना पाननो ज वाणेलो मोटो टोटो-अेक प्रकारनी बीडी	चुरुट, सिगार	cheroot
चिरोटी	चिरोटी	स्त्री	अेक पकवान	एक पकवान	a sweet dish
चिरोडी	चिरोडी	पु	अेक जातनो पोथो पथर	एक प्रकार का नर्म पत्थर	kind of soft stone
चिगु	चिगु	वि	1 बाहु उरकसरियु, उजूस 2 भीटु	हृद से ज्यादा क्रिफायतशार, कजूस, खसीस मचला	over thrifty over miserly one who does not give his mind
चिगूस	चिगूस	वि	जुओ चिगु'	देखिए चिगु'	see चिगु'
चित	चित	स्त्री	1 डिउर	फिक्र, चिता	worry anxiety

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 વિચાર	વિચાર	thought
ચિંતક	ચિતક	વિ	1 ચિંતન કરનાર 2 વિચારક, ફિલસૂફ	ચિંતન કરને વાલા વિચારક, ઢાર્શનિક, ફિલાસફર	one who thinks, thinker or philosopher
ચિંતન	ચિતન	ન	વિચાર, મનન	વિચાર, મનન, ચિંતન	meditation thinking
ચિંતનશીલ	ચિતનશીલ	વિ	ચિંતન કરવાના સ્વભાવવાળુ	ચિંતનશીલ	contemplative
ચિંતનાત્મક	ચિતનાત્મક	વિ	વિચાર-મનનથી ભરેલુ	ચિંતનાત્મક	thoughtful, reflective
ચિંતવન	ચિતવન	ન	ચિંતન	ચિંતન, સોચના-વિચારના	see 'ચિંતન'
ચિંતવવુ	ચિતવવુ	સ ક્રિ	મનન કરવુ, વિચારવ	સોચના, ચિંતન કરના	to think reflect
ચિંતા	ચિતા	સ્ત્રી	1 ફિકર 2 વિચાર	ફિકર, સોચ, ચિતા વિચાર	care, worry thought
ચિંતાકુલ	ચિતાકુલ	વિ	ચિંતાથી આકુળ થયેલુ- ગભરાયેલુ	અદ્વિગ્ન, ચિંતાકુલ	anxious
ચિંતાકુળ	ચિતાકુલ	વિ	જુઓ 'ચિંતાકુલ'	અદ્વિગ્ન, ચિંતાકુલ	see 'ચિંતાકુલ'
ચિંતાતુર	ચિતાતુર	વિ	ચિંતાથી વ્યાકુળ	ચિંતા સે બેચન, અદ્વિગ્ન	anxious
ચીક	ચીક	પુ,સ્ત્રી	વનસ્પતિના ફળ, ડાળખા વગેરેમાંથી નીકળતુ ચીકાગુ પાણી અથવા દૂધ	નિર્યાસ (વનસ્પતિ)	sap of several trees and plants
ચીકટ	ચીકટ	વિ	1 ચીકાગુ 2 તેલ ઇ ના પાસવાળુ	ચિકના, ચીકટ તેલ, ઘી આદિ લગા - oily, greasy હુઆ	sticky, oily, greasy

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		न,स्त्री	1. चीकश 2. चीकशवाणी वस्तु के पदार्थमा छोटु तेली तत्व, डेट	चिकनाई चिकनी चीज या ऐसे पदार्थ में रहने वाला स्निग्ध, तरल-तैली तत्व, चरबी	oiliness fat
चीकटावु	चीकटावु	अक्रि	1. चीकटवाणु थपु, तेला वगेरेथी भरडावु 2. चीकटवाणो पदार्थ जावामा आववाथी रोग के गूमडानु वीडरपु	चिकटना, चिकनाना रोग या फोडे का बढ जाना	to become greasy or oily (of boil or disease) taking a worse turn owing to intake of fa
			3. चोटावु	चिपकना	to stick
चीकटु	चीकटु	वि	चीकटवाणु	चिकटा, चीकट	sticky
चीकश	चीकण	स्त्री	अेक जातनी डाकडी	एक प्रकार की ककडी	kind of cucumber
चीकशाड	चीकणाई	स्त्री	चीकशापागु	चिकनाई, चिकनापन	stickiness
चीकशाश	चीकणाश	स्त्री	जुओ 'चीकशाड'	चिकनाई	see 'चीकशाड'
चीकशु	चीकणु	वि	1. चोटी रहे तेपु 2. चिगूस, डजूस 3. आपथीपियु, दोटडाधु	चिकना, चिपचिपा, लसदाग (ला) कम खर्च करने वाला, कजूस जरूरत से ज्यादा	sticky, greasy miserly punctilious, otherwise
चीकशु लाट	चीकणु लाट	वि	अति चीकशु	खूब चिकना	very sticky

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चीअरु वाधर	चीकणु वाधर	वि	जुओ 'चीअरु लाट'	बहुत चिकना	see 'चीअरु लाट'
चीअश	चीकाश	स्त्री	चीअशाए	चिकनाई, स्निग्धता	stickiness
चीथवाटो	चीचवाटो	पु	चीस, बुमाटो	चिल्लाहट, चिचियाना	shriek, scream
चीथवाडो	चीचवाडो	पु	जुओ 'चीथवाटो'	चिल्लाहट	see 'चीथवाटो'
चीज	चीज	स्त्री	1 वस्तु 2 सरस गायन	चीज अच्छा गीत	thing admirable musical composition
चीजवस्तु	चीजवस्तु	स्त्री	બધી चीજો, સરસામાન	सभी चीजें, सामान	goods, baggage
चीञ	चीञ	स्त्री	जुओ 'चीञ'	देखिए 'चीञ'	see 'चीञ'
चीटकु	चीटकवु	सक्रि	વળગવુ, ચોટવુ	लगना, चिपकना, चिमटना, लिपटना	to stick, cling
चीटञी	चीटकी	स्त्री	ચપટી	चुटकी	snap with thumb and (usu middle) finger
चीटु	चीटु	वि न	चीअरु, चीअटवाणु દી તાવ્યા પછી નીચે ઠરતો ડચરો-છાસ ઇત્યાદિ કીટુ	चिकना, चिकटा घृतमड, किट्ट	sticky, greasy dregs or lees of ghee after butter is purified
चीडवु	चीडवु	सक्रि	ગુસ્સે ડરવુ, ખીજવવુ	चिदाना, खिञाना	to make angry to irritate to tease
चीडवावु	चीडवावु	अक्रि	ખિજાવુ, ચિડાવુ	चिदना, खीजना	to be angered or to be vexed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थीडवु	चीडवु	अ क्रि	थिडावु, गुस्से थवु	गुस्से होना, क्रुद्ध होना, चिढ़ना	to be angry or to be annoyed
थीडियु	चीडियु	वि	1 सडेज्जा थीडाछ जतु 2 छाथियु, छागडो	चिडचिडा घुडकी, भिडकी	easily irritable scowl, peevish reply
थीणो	चीणो	पु	अेड जगतनु अनाज	एक प्रकार का मोटा अनाज, चेना	kind of corn
थीत	चीत	वि	पीठ पर पडेलु, चतु (दुस्तीमा)	चित, पट का उल्टा	stretched full length on one's back (wrestling)
		न	चित	चित	mind
थीतरवु	चीतरवु	स क्रि	1 चित्र अठवु, आलेखवु 2 जेम तेम लणी अठवु	चित्र बनाना घसीट लिखावट लिखना, घसीटना	to draw or to paint to scribble
थीतरेशी	चोतरेशी	स्त्री	सूरा डे आगगमानी अपारी	घिन, नफरत या नाराजगी से छूटने वाली कैपकैपी	shudder out of disgust
थीतरेशी	चीतरेशी	पु	1 अेड वनस्पति 2 चित्तो, वाध जेवु अटापटादार प्राणी 3 अेड जगतनो साप	एक वनस्पति चीता एक प्रकार का साँप, चीतल	kind of vegetable leopard kind of snake
थीतण	चीतळ	स्त्री	1 अेड जगतनो साप 2 लाडडानो शूअरे 3 स्त्रीथोनी अेटनु अेड धरेण	एक प्रकार का साँप, चीतल चीरी हुई लकड़ी का फट्टा, चेला स्त्रियो का गले में पहनने का एक गहना	kind of snake splinter ornament worn by women . round the neck

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			4 ચપટી પહોળી બંગડી, પાટલી	चपटी-चौड़ी चूड़ियाँ, एक गहना	broad and flat bangle
			5 એક જાતનું હરણ	हिरन का एक भेद, चीतल, चित्र-मृग	kind of deer
ચીતળી	चीतळी	स्त्री	જુઓ 'ચીતરી'	देखिए 'चीतर'	see 'चीतर'
ચીતળો	चीतळो	पु	એક જાતનો સાપ, ચીતરો	चीतल (सॉप)	kind of snake
ચીથડુ	चीथडु	न	ચીથરુ	चिथडा, चीथडा	rag, tatter
ચીથરી	चीथरी	स्त्री	ચીથરી	छोटा चिथडा, धज्जी	small rag
ચીથરુ	चीथरु	न	જુઓ 'ચીથડુ'	चिथडा, चीथडा	see 'ચીથડુ'
ચીથરેહાલ	चीथरेहाल	वि	ચીથરેહાલ	फटेहाल	ragged, reduced to tatters
ચીનનો શાહુકાર	चीननो शाहुकार	पु	ચોર, શઠ	चोर, ठग	thief, thug
ચીનાશુક	चीनाशुक	न	ચીનનું રેશમી કાપડ	चीन में बनने या चीन से आने वाला रेशमी कपडा	Chinese silk
ચીની	चीनी	वि	ચીન દેશનું- ને લગતું	चीनी, चीन देश का, चीन से सबद्ध	of or about China
		स्त्री	1 એક જાતની સફેદ માટી	चीनी मिट्टी	kind of white clay
			2 ચીન દેશની ભાષા	चीन की भाषा	Chinese language
ચીનીકામ	चीनीकाम	न	1 ચીની માટીનું કામ	चीनी मिट्टी का काम	China porcelain glassware
			2 કાચનું કામ	काँच का काम	glass work

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चीनीखानुं	चीनीखानु	न	દારૂખાનુ	आतिशवाजी	fireworks
चीनो	चीनो	पु	चीन દેશનો વતની	चीन देशवासी, चीनी	a Chinese or Chinaman
चीप	चीप	स्त्री.	1 લાબી ચપટી પટી, ચીપટ 2 પતા ચીપવાનુ ક્રમ કે તેની વારી	खपची, चिप्पी, पट्टी ताश के पत्तों की पिसाई या उसकी वारी	longish slip or slice shuffling of cards, turn of doing so
चीपट	चीपट	स्त्री	चीप, પટી	चिप्पी, खपची, पट्टी	narrow strip of thin wood
चीपटी	चीपटी	स्त्री.	ચપટી	चुटकी	pinch
चीपटो	चीपटो	पु	જરા મોટી ચપટી, ચપટો	बड़ी चुटकी, चुटका	a bigger 'चीपटी'
चीपडु	चीपडु	न.	સૂકાઈ ગયેલો આખનો મેલ, ચીપડો	कीचड (आख का), ढीङ	the rheum or mucus of the eye
चीपडो	चीपडो	पु	આખનો મેલ, પીચો	कीचड (आख का), ढीङ	mucus of the eye
चीबडी	चीबडी	स्त्री	એક પક્ષી	उल्लू की जाति का पक्षी, खूसट	kind of bird
चीबडु	चीबडु	वि	જુઓ 'ચીબુ'	देखिए 'चीबु'	see 'चीबु'
चीबरी	चीबरी	स्त्री	જુઓ 'ચીબડી'	देखिए 'चीबडी'	see 'चीबडी'
चीબું	चीबु	वि.	બેઠેલા-ચપટા નાકવાળુ	चपटी नाक वाला	flat-nosed
चीભડ	चीभडी	स्त्री.	એક વેલો	ककडी की जाति की एक बेल	kind of creeper
चीભડુ	चीभडु	न	ચીભડીના વેલાનુ ફળ	आरिया, फूट	fruit of the creeper 'चीभडी'
चीमटी	चीमटी	स्त्री	1 ચીપટી 2 ચૂટી	चुटकी चिमटी, चुटकी	pinch pinch

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चीमटो	चीमटो	पु	1 चीपटो 2 चूटो 3 चीपियो	बडी चुटकी चिमटी, चुटकी चिमटा	big pinch pinch pair of tongs or pincers
चीमणवु	चीमळवु	स क्रि	चीओणवु, आमणवु	मरोडना, उमेठना (कान)	to twist, to wring
चीमणवु	चीमळावु	अ क्रि	1 डरमावु 2 मनमा जण्या डरवु, डूरवु 3 'चीमणवु' नु डर्माणि	कुम्हलाना मन में जलना, कुढना, भुरना चीमणवु' का कर्मणि रूप	to fade, to wither to grieve, to pine passive of 'चीमणवु'
चीरवु	चीरवु	स क्रि	1 शडवु, शपवु 2 वचेशी वे भाग डरवा, सेसरु डे आरपार जाय अम डरवु 3 धराड पासेशी भूज भाव लेवो	चीरना, फाडना, पाछना, काटना बीच में से दो हिस्से करना, आरपार निकल जाए ऐसा करना (भीड को चीरना) गाहक से उचित से अधिक दाम लेना, कसना (ला)	to split, to cut to split into two, cut through to fleece a customer by over-charging
चीरियु	चीरियु	न	1 शड, चीरी 2 (प्राय डेरीनो) अथागानो डडो	फॉक (प्राय आम के) अचार का टुकडा	small piece or slice piece of mango pickle
चीरिया	चीरिया	न	डेरीनी चीरीनु अथाग	आम की फॉकों का अचार	pickle of mango slice
चीर	चील	स्त्री	1 वनस्पतिमाथी दूओतो चीडणो रस, चीड	वृक्षो आदि में से निकलने वाला रस, निर्यास	viscid ooze or sap of tree or plant

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા. કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૨ એક વનસ્પતિ	एक तरह की भाजी, बधुआ, चिल्ली	kind of plant
			૩ એક પખી, સમડી	चील (पक्षी)	kind of bird, kite
ચીલચીલ	चीलचील	ન	એક પક્ષી	एक पक्षी	kind of bird
ચીસ	चीस	સ્ત્રી	તીણી બૂમ, રાડ	चीख, चिल्लाहट	shrill cry, shriek
ચીસઝર	चीसकार	પુ	ઉપરાઉપરી ચીસો પાડવી તે	चीख, चिल्लाहट	continued screaming
ચીસરાગ	चीसराग	ન	જુઓ 'ચીસઝર'	देखिए 'चीसडर'	see 'चीसडर'
ચીસાચીસ	चीसाचीस	સ્ત્રી	જુઓ 'ચીસઝર'	देखिए 'चीसडर'	see 'चीसडर'
ચીથરી	चीथरी	સ્ત્રી	નાનુ ચીથરુ, ચીઠરડી	छोटा चीथडा, धज्जी	small rag
ચીથરુ	चीथरू	ન	ફાટી ગયેલુ કપડુ કે ટુકડો	फटा-पुराना कपडा या कपडे का टुकडा, चीथडा, गूदड	rag, tatter
ચીઠરડી	चीदरडी	સ્ત્રી	લૂગડાની લાખી પટી	चीदी, (कपडे की) धज्जी	long strip of cloth
ચીઠરી	चीदरी	સ્ત્રી	જુઓ 'ચીઠરડી'	देखिए 'चीदरडी'	see 'चीदरडी'
ચીઠવુ	चीधवु	સ ક્રિ	૧ આગળી કરીને દેખાડવુ ૨ ફરમાવવુ	उँगली के इशारे से बताना फरमाना	to point at (with a finger) to direct, to order
ચીબોળવુ	चीबोळवु	સ ક્રિ	આમળવુ, ચીમટી દેવી	ऐठना, मरोडना, उमेठना	to twist, to wring
ચુકાદો	चुकादो	પુ	ફેસલો	निपटारा, निर्णय, फैसला	judgement, verdict

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
युडावु	चुकावु	स क्रि	'यूडु' नु प्रेरक	यूडु' का प्रेरणार्थक रूप	caus of 'यूडु'
युडावु	चुकावु	अ क्रि	'यूडु' नु कर्मणि	'यूडु' का कर्मणि रूप	pass of यूडु'
युगल	चुगल	वि	युगलजोर	चुगलखोर, लुतरा	habituated to slandering
		स्त्री	पीठ पाछेले डरेली निध	चुगली	backbiting
युगलजोर	चुगलखोर	वि	युगली डर्या डरनारु	चुगलखोर, चवाई	habituated to slandering
युगली	चुगली	स्त्री	युगल	चुगली	slandering backbiting
युगलीजोर	चुगलीखोर	वि	युगलजोर	चुगलखोर	habituated to slandering
युनध	चुनदा	वि	भास पसध डरेलु, उत्तम	चुनिदा, बढिया	select, excellent
युनधु	चुनदु	वि	जुओ 'युनध'	देखिए 'युनध'	see युनध
युनारण	चुनारण	स्त्री	युनारानी स्त्री	चूना फूँकने वाले की स्त्री	wife of lime-maker
युनारी	चुनारी	स्त्री	युनारण	देखिए 'युनारण'	see युनारण'
युनारो	चुनारो	पु	1 यूनो पडवनार 2 यूनाथी धोणनार, डडियो 3 युनारानी -यातनो भारस	चूना फूँकने वाला राज चूना फूँकने वाली जाति का पुरुष	lime-maker white-washer a man of the caste of lime-makers
युप	चुप	वि अ	शात डे मूड शात डे मूड रहेवा सूयवाती निशानी डे डेगार	चुप, खामोश शान्त या मौन रहने के लिए सूचित करनेवाला सकेत	silent quiet signal for the other to keep quiet, through word or sign

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थुपझी	चुपकी	स्त्री	शांति, मौन	चुप्पी, मौन	silence
थुपझीदी	चुपकीदी	स्त्री	જુઓ 'થુપઝી'	चुप्पी, मौन	see 'थुपझी'
थुपथाप	चुपचाप	अ	કઈ પણ અવાજ કર્યા વિના, ઘાનામાના	चुपचाप	silently, without making noise
थुपाथुप	चुपाचुप	अ	જુઓ 'થુપથાપ'	देखिए 'थुपथाप'	see 'थुपथाप'
थुमावु	चुमावु	स क्रि	1 ચિમાવુ, મરજી વિરુદ્ધ શાંત થવું 2 મનમા બળવું 3 'થૂમવું' નું કર્મણિ	अपनी मर्जी के खिलाफ शान्त होना, मन मारना भीतर ही भीतर जलना, मन मसोसना 'थूमवु' का कर्मणि रूप	to be obliged to be quiet to be grieved at (internally) causal of 'थूमवु'
थुलेतरु	चुलेतरु	न	1 એક પક્ષી 2 પાટલીને જડેલી ધારિયા-ઘાટની પાળી, ચૂલિયુ	एक पक्षी छुरी, हंसिया	a kind of bird curved blade fixed in stock for cutting vegetables
थुलेतरो	चुलेतरो	पु	કેરી કાપવાનું ઓળાર, સૂડો	अमकटना, बडा सरौता	kind of instrument to cut mangoes (see 'थुलेतरो') a large nut-cracker
थुपडावु	चुवडावु	स क्रि	'थूवु' નું પ્રેરક	'थूवु' का प्रेरणार्थक रूप	caus of 'थूवु'
थुपरावु	चुवरावु	स क्रि	જુઓ 'થુપડાવુ'	'थुपडावु' का प्रेरणार्थक रूप	see 'थुपडावु'
थुवाडवु	चुवाडवु	स क्रि	જુઓ 'થુવડાવુ'	'थुपडावु' का प्रेरणार्थक रूप	see 'थुपडावु'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थुसणियु	चुसणियु	वि न	थूसवाना स्वभाववाणु वाण्डने थूसवानु रमड्डु, धावणी	चूसने की प्रकृति वाला छोटे बच्चो का चाटने का काठ का खिलौना, चट्ट	one in the habit of sucking infant's toy for sucking
थुसाडवु	चुसाडवु	स क्रि	'थूसवु' नु प्रेरड	'थूसवु' का प्रेरणार्थक रूप	caus of 'थूसवु'
थुसाववु	चुसाववु	स क्रि	जुओ 'थुसाडवु'	देखिए 'थुसाडवु'	see 'थुसाडवु'
थुसावु	चुसावु	अ क्रि	'थूसवु' नु डर्भण	'थूसवु' का कर्मणि रूप	pass of 'थूसवु'
थुस्त	चुस्त	वि	1 आग्रडी, दृढ 2 तग, सक्कस	आग्रही, दृढ तग, कसा हुआ	strict, resolute tight (fitting)
थुगल	चुगल	स्त्री	1 पणो 2 (ला) अेनी डे अेवी मण्णूत पडड, सडणो	पजा, चगुल शिकजा, पकड	paw, claw firm grip of paw or claw
थुगाल	चुगाल	स्त्री	जुओ 'थुगल'	देखिए 'थुगल'	see 'थुगल'
थुडड	चुडड	वि	1 थुडन डरनारु 2 पोतानी तरड आडर्धनारु 3 थुडड वस्तु 4 डणूस	चुडन करनेवाला अपनी ओर खींचने वाला चुडड वस्तु (उदा लोह चुडड) कजूस	one who kisses attracting toward oneself magnet miser
थुडन	चुडन	न	डथी	चुडन, बोसा	kiss
थुडवु	चुडवु	स क्रि	डथी डरवी	चूमना	to kiss
थुडणीस	चुडणीस	वि	डड, थुडणीस	चौवालीस, 44	forty-four, 44
थुडोतेर	चुडोतेर	वि	डड	चौहत्तर, 74	seventy-four, 74
थुडुआडोर	चुडुआडोर	पु	अेड पक्षी	एक पक्षी	kind of bird
थुडुओ	चुडुओ	पु	डुडर	चूहा	rat

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
ચૂક	चूक	स्त्री	ભૂલ, ડસૂર	चूक, भूल, कसूर, दोष	mistake, fault
ચૂકતું	चूकतु	वि	ચૂકવી દીધેલું	चुकता, बेबाक, वापस लौटाया हुआ	paid up
ચૂકતે	चूकते	अ	ચૂકતું હોય એમ	चुकता, अदा	fully re-paid
ચૂકવવું	चूकववु	स क्रि	1 ભૂલાવવું, યુકાવવું 2 પતાવવું (કર્જિયો, દેવું)	भुला देना, भुलाना चुकता करना, निपटाना (ऋण, तकरार)	to dodge, to evade to settle, to pay off (quarrel, debt)
ચૂકવાવું	चुकवावु	अ क्रि	'ચૂકવવું' નું કર્મણિ રૂપ	'ચૂકવવું' का कर्मणि रूप	pass of 'ચૂકવવું'
ચૂકવું	चूकवु	अ क्रि	1 ચૂક-ભૂલ કે ગણત કરવી, ભૂલવું, ડસર રાખવી 2 ચૂકતે થવું, પતાવું (જેમ કે, કર્જિયો, દેવું)	चूकना, गलती करना, भूलना अदा होना, निबटना, चुकना (ऋण, कजिया आदि)	to make mistake to err, to forget to be settled, to be paid (quarrel, debt)
		स क्रि	1 ખોવું (જેમ કે વખત, ગાડી, તક, આણી, નિશાના ઇ ચૂકવું) 2 બીજા ક્રિયાપદની સહાયતા આપતા તે ક્રિયા કરી પરવારવું એવો અર્થ પતાવે છે (જેમ કે, મારી ચૂક્યો, લખી ચૂક્યો ઇ)	खोना, गंवाना, चूकना (अवसर, निशाना, गाडी आदि) (दूसरी क्रिया के साथ) निपट जाना, फरागत होना	to miss, to lose (train, time) used as an auxiliary verb in the sense of 'have done' 'finished'
ચૂકો	चूको	स्त्री	એક જાતની ભાજી	एक प्रकार की भाजी, सब्जी	kind of vegetable

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ચૂગવું	ચૂગવું	સ ક્રિ	(પક્ષીનું) આપ વડે ખાવું	(પક્ષી કા) ચુગના	to pick up or eat with beak (of birds)
ચૂટકી	ચૂટકી	સ્ત્રી	ચપટી	ચુટકી, ચિમટી	pinch
ચૂટકો	ચૂટકો	પુ	૧ ટકુ પાગ અસરકારક ભાષણ ૨ ટચકો, જાદુ ૩ લહેજો છાટો	સક્ષિપ્ત કિતુ અસર વાલા ભાષણ જાદુ, ચુટકુલા બિન્દુ, છીટા	brief but effective speech joke trick of magic drop
ચૂડગર	ચૂડગર	પુ	ચૂડી વહેરનાર-ઝારનાર મણિયાર	મનિયાર	bangle-maker
ચૂડલો	ચૂડલો	પુ	જુઓ ચૂડો	દેખિયે ચૂડો	see 'ચૂડો
ચૂડી	ચૂડી	સ્ત્રી	૧ નાનો ચૂડો ૨ ગ્રામોફોનની જૂની ચૂડા-ટબની રેકર્ડ	ચૂડી, છોટા ચૂડા ગ્રામોફોન કા રેકર્ડ	small bangle gramophone record of cylindrical shape of early days
ચૂડીકરમ	ચૂડીકરમ	ન	પતિનું મરણ થતા સ્ત્રીના હાથની ચૂડીઓ ભાગવી તે	ચૂડિયો તોડ દેના યા ઠડી કરના	breaking of bangles of a woman on husband's death
ચૂડીગર	ચૂડીગર	પુ	જુઓ ચૂડગર	દેખિયે ચૂડગર'	see ચૂડગર
ચૂનવું	ચૂનવું	સ ક્રિ	૧ વીણવું, ચૂટવું ૨ પસંદ કરવું	ચૂનના, બીનના પસંદ કરના, છોટના	to pick to glean to select
ચૂનાગચ્છી	ચૂનાગચ્છી	સ્ત્રી	ચૂનાના કેલની જમાવટ, ચૂનાનું મજબૂત આપતર કે તેની બનાવેલી અગાશી-ધાબું	છત, ચૂને ક્રી પક્કી છત, ચૂને ક્રી મજબૂત જોડાઈ	strong setting with lime and mortar such terrace

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ચુનાગચ્છી	चनागच्छी	સ્ત્રી	જુઓ 'ચુનાગચ્છી'	ढग्विए 'चुनागच्छी'	see 'चुनागच्छी'
ચુની	चनी	સ્ત્રી	1 હીરાકાળી 2 ચુનીવાળી નાકની નાની જડ	चुन्नी, हीरे की कनी नाक की चुन्नी वाली लाग	small diamond kind of orna- ment for nose
ચુનુ	चनु	ન	1 ચુન, ખોરાક 2 ચુનો 3 કઠોળ (મરડતા પડેલો) ઝીંગો ભૂંડો	चुनी, चुकी-भूसी चुना चनी (द्विदल)	food lime husks and fragments of pulse etc given as food to cattle
ચુનો	चुनो	પુ	મકાનાદિ આગવામાં વપરાતો પશુચર, મરડ વગેરેનો ભૂંડો	चुना	lime
ચુપકી	चूपकी	સ્ત્રી	જુઓ 'ચુપકી'	चुप्पी, मौन	See 'चुपकी'
ચુપચાપ	चूपचाप	અ	જુઓ 'ચુપચાપ'	चुपचाप	see 'चुपचाप'
ચુપાચુપ	चुपाचुप	અ	જુઓ 'ચુપાચુપ'	चुपचाप	see 'चुपाचुप'
ચૂર	चूर	પુ	ભૂંડો, ચૂરો	चूरा, चूर	powder small fragments
ચૂરાગ	चुराग	ન	1 ભૂંડો, ચૂરો 2 ઔષધિનો ભૂંડો	चूरन, बकनी चूर्ण (औषध)	powder medicinal powder
ચૂરમુ	चूरमु	ન	ભોજનની એક વાની-છટ્ટો લાડુ	चूरमा (पकवान)	kind of sweetmeat
ચૂરી	चूरी	સ્ત્રી	ચૂર, ઝીંગો ચૂરો	चूरा, चूर	small bits
ચૂરો	चूरो	પુ	ભૂંડો	चूरा, चूर्ण	powder

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थूल	चूल	स्त्री	रसोई माटे जोडेले मोठे थूलो, तमाग	रसोई के लिए खोदकर बनाया हुआ बड़ा चूल्हा, भट्ठी	large furnace for cooking
थूलाशगडी	चूलाशगडी	स्त्री	थूलानी पाण गरज सारे अेवी शगडी	चूल्हे का भी काम देने वाली अगीठी	portable earthen furnace
थूलाशघडी	चूलाशघडी	स्त्री	जुओ 'थूलाशगडी'	देखिए 'थूलाशगडी'	see 'थूलाशगडी'
थूलासगडी	चूलासगडी	स्त्री	जुओ 'थूलाशगडी'	देखिए 'थूलाशगडी'	see 'थूलाशगडी'
थूलासघडी	चूलासघडी	स्त्री	जुओ 'थूलाशगडी'	देखिए 'थूलाशगडी'	see 'थूलाशगडी'
थूलियुं	चूलियु	न	शाड सभारवानो नानो सूडो, थुलेतरु	हंसिया, छुरी	kind of instrument for cutting vegetables
थूली	चूली	स्त्री	नानो थूलो डे थूल	छोटा चूल्हा	small fire-place
थूलो	चूलो	पु	शधवा वगेरे माटे जणतण गोठववा करती जगा डे गोठवण	चूल्हा	large fire-place
थूवु	चूवु	अ क्रि	टपडवु, गणवु (छिद्रमाथी)	चूना, टपकना (छिद्र में से)	to leak, to drip
थूस	चूस	स्त्री	थूसी जावु ते, शोषण	चूसना, शोषण	sucking, exploit
थूसण	चूसण	न	थूस	चूसना, शोषण	sucking, exploitation
		वि	थूसनारु	शोषण करने वाला	one who is given to sucking
थूसवु	चूसवु	स क्रि	1 मो वडे रस जेथवो 2 नि सत्त्व डरवु	चूसना, सोखना रस, सार, निचोड लेना (ला)	to suck, to dry to exploit

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थू	चू	न	[२५] उदरનો अवाજ	चूहे की आवाज	squeaking of mouse
थूड	चूक	स्त्री	1. पेटની आडडी 2. नानी जीली, रेખ	पेट की ऐंठन, मरोड छोटी कील, तार की खूँटी	colic. gripping pain (in stomach) small nail
थूअणु	चूकावु	अ क्रि	1. [पेटमा] थूड आवणी 2. [ला] मनमा गुप्त वाधो छेवो- ना गमवु	(पेट में) ऐंठन पैदा होना नहीं भाना, मन में पसद न होना, ऐतराज होना	to have grips to grudge to dislike
थूअडु	चूखडु	वि	अधीणी आओवाणु, मड दृष्टिनु	चूंधा	short-sighted
थूअणु	चूचळु	वि	जुओ 'थूअडु'	चूंधा	see 'थूअडु'
थूआ	चूचा	न	1. थू डे आ-जरा पार न भोलेवु ते, सामे जवाब न आपवो ते 2. आनाडानी	ची-चपड न करना, चूँ न करना आनाकानी, ऐतराज	not uttering even a single word declining, hesitation
थूआ	चूची	स्त्री	1. स्तनની ડાંટડી 2. स्तन	चूची स्तन	nipple breast
थूथु	चूचु	न वि	उदरनु थूथु [२५] थूअणु	चूहे की आवाज चूंधा	squeaking short-sighted
थूथू	चूचू	(रव)	उदरનો अवाજ	चूहे की आवाज	squeaking
थूट	चूट	स्त्री	ખજવાળ, વલૂર	खुजली, चुलकन	itch
थूटणी	चूटणी	स्त्री	1. थूटवु ते, पसदगी 2. प्रतिनिधिने थूटवो ते, 'छलेक्षण'	चुनना, पसद चुनाव, 'इलेक्शन'	picking election

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चूटली	चूटली	स्त्री	चूटी	चुटकी	pinch
चूटलो	चूटलो	पु	भोटा चूटी	बडी चुटकी, चुटका	biggest pinch
चूटवु	चूटवु	स क्रि	1 तोडवु, ट्मवु 2 पसद करवु	चुटकी से तोडना, चुनना चुनना, पसद करना, छाँटना	to pick to pluck to select to elect
चूटावु	चूटावु	स क्रि	'चूटवु नु प्रेरु	'चूटवु का प्रेरणार्थक रूप	caus of 'चूटवु'
चूटावु	चूटावु	अ क्रि	चूटवु नु उर्भाणि	'चूटवु का कर्मणि	pass of 'चूटवु'
चूटी	चूटी	स्त्री	चीमटी	चुटकी	pinch
चूथ	चूथ	स्त्री	चूथारे-पीडा	अगतोड पीडा, वेदना	pain in stomach
चूथवु	चूथवु	स क्रि	आभतेम अस्तव्यस्त इरीने थोणी नाभवु, इडेवु, उम डे व्यवस्था छ जगाडी नाभवु	अस्त-व्यस्त करना	to turn upside down, to ran- sack
चूथाचूथ	चूथाचूथ	स्त्री	इरी इरीने चूथवु ते	बारबार अस्त-व्यस्त करना	repeated ransacking
चूडडियाणी	चूडडियाळी	वि स्त्री	चूडडीवाणी	चुनरीवाली	having designs painted on
चूडडी	चूडडी	स्त्री	अेड जगतनु भातीगर रेशमी वस्त्र	चुनरी, चूदरी	silken garment or sari with design on it
चूधणु	चूधळु	वि	जुओ 'चूधडु'	चूंधा	see चूधडु
चूवाणीस	चूवाळीस	वि	चुमालीस, ' ४४ '	चौवालीस, 44	forty-four 44
चूवोतेर	चूवोतेर	वि	' चुमोतेर, '७४ '	चौहत्तर, 74	seventy-four 74
चेड	चेक	पु	1 अेड जगतनु थोडडी भातनु डापड	एक प्रकार का कपडा	check (kind of fabric)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
			2 બેકમાથી નાગા ઉપાડવાની ચિઠ્ઠી	चेक (बेक)	cheque
ચેકવુ	चेकवु	स क्रि	જુઓ 'ચેરવુ'	देखिए 'चेरवु'	see 'चेरवु'
ચેકચેક	चेकचेका	स्त्री	ચેરચેર	काटपीट (अक्षर)	scratches and erasures
ચેકચેક	चेकाचेक	स्त्री	જુઓ 'ચેકચેક'	काटपीट (लिखावट)	see 'ચેકચેક'
ચેકો	चेको	पु	1 છેકો	काटपीट	stroke, line, cross showing cancellation
			2 ચેકવાથી પડેલો લીટો કે ડાઘો	काटने-पीटने से होने वाली लकीर या दाग	blot or line caused by crossing or erasure
ચેટક	चेटक	पु न	દાસ, સેવક 1 ભૂત, વળગાગ	दास, सेवक भूत, भूत-प्रेत की छाया	servant sorcery, witchcraft
			2 ચાનક	जागृति	awakening
ચેટકી	चेटकी	पु	જાદુગર	जादूगर	magician
ચેડા	चेडा	न	1 ગાડા	पागल के से हावभाव या चेष्टाएँ	foolish pranks
			2 અડપલા, ચાદવા	नटखटी, छेडछाड	teasing, pranks
ચેણ	चेण	न	છછૂદર	छछूंदर	mole, musk-rat
ચેત	चेत	स्त्री	1 ચેતના, જ્ઞાન	चेतना, ज्ञान	awareness, knowledge
			2 હોશ, સૂઘ ચિત્ત	होश, सज्ञा चित्त, मन, चेत	consciousness mind
ચેતન	चेतन	वि न	ચેતનાવાળુ, સજીવ 1 ચૈતન્ય, જીવનશક્તિ	सचित्, सजीव चैतन्य, जीवनशक्ति, प्राण	living, sentient life

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चेतवणी	चेतवणी	स्त्री	2 હોશ, સૂઘ चेतवणु ते, अगाउथी आपेली ખબર, सावथेती	होश, सुध चेतावनी, चितावनी	consciousness warning
चेतवणु	चेतवणु	स क्रि	'चेतवणु' नु प्रेरक	'चेतवणु' का प्रेरणार्थक रूप	caus of 'चेतवणु'
चेतवु	चेतवु	अ क्रि	1 સળગવુ, લાગવુ 2 આગ લાગવી 3 ઇશારતમા સમજી જવુ 4 સાવધાન થવુ, અગાઉથી જાણી જવુ	सुलगना, लगना आग लगना इशारे से समझ जाना चौकन्ना होना, चेतना, सावधान होना, जाग्रत होना	to burn to kindle to catch fire to take hint to beware, before-warned
चेतावणु	चेतावणु	स क्रि	જુઓ 'चेतवणु'	देखिए 'चेतवणु'	see 'चेतवणु'
चेन	चेन	न	1 સુખ, આરામ 2 ગમ્મત, મોજમજા 3 ચિહ્ન, લક્ષણ	चेन, सुख, आराम, कल आनद, मजा चिह्न, लक्षण	comfort, ease rest merriment sign symptom
चेनथाणो	चेनचाळो	पु	નામનિશાન, ચિહ્ન	चिह्न, निशानी	name or mark
चेनभाण	चेनबाजी	स्त्री	સુખચેન, મોજમજા	अमन-चैन, सुख-चैन	merry-making
चेप	चेप	पु	1 પરુ, રસી 2 બીજાના રોગ કે સબધની અસર 3 દબાણ 4 તત, દુરાગ્રહ, ચીકણાશ	मवाद, पीब दूसरे के रोग या सबध का असर, छूत दबाव दुराग्रह, जिद, हठ	pus infection pressure obstinacy stickiness

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थेपवु	चेपवु	स क्रि	1 धाववु, निथोववु 2 जोसवु, रोपवु 3 थेपशी असर डरवी	दबाना, निचोडना खोसना, रोपना छूत का असर होना	to press, to squeeze to thrust, to plant to infect
थेपी	चेपी	वि	1 थेप लगाडे थेपु 2 थीडरु, दुशुग्राडी 3 डणूस	छूतहा, छुतैला, सक्रामक चिकना, दुराग्रही कजूस	contagious, infectious sticky, obstinate stingy
थेशु	चेरवु	स क्रि	1 छेडवु 2 जोतरशी डरवी	छेकना, काटना (लिखावट) खुचड या दोष निकालना	to cross, to erase to slander, to criticize
थेलथी	चेलकी	स्त्री	छोडी (वहालमा)	बेटी, लडकी	(endearingly) girl
थेलडु	चेलकु	न	छोडरु	छोकरा, बच्चू	(contempt) child
थेलओ	चेलकी	पु	छोडशे	बेटा, पुत्र	son
थेलो	चेलो	पु	शिष्य	चेला, शिष्य	disciple
थेली	चेली	स्त्री	शिष्या	चेली, शिष्या	female disciple
थेवडो	चेवडो	पु	अड थवाणु	चिउडा, चिडवा, एक चबेना	preparation of fried rice, split gram etc
थेववु	चेववु	स क्रि	शेडवु, गरम डरवु (बजता डु डे भीलशी)	सेकना	to make warm (with heated wax, water etc)
थेष्टड	चेष्टक	वि	थेष्टा डरनारु, तोडानी	नटखट, शरारती,	mischievous, one given to playing pranks

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
येष्टा	चेष्टा	स्त्री	1 જુઓ યાળા' 2 ઠક્કી, મજાકરી	देखिए 'याणा' ठट्ठा, मजाक, मसखरी	see 'याणा' joking banter fun
येष्टाખોર	चेष्टाखोर	वि	येष्टક, ટીખળી, તોફાની	शरारती	see येष्टક
येष्टાળી	चेष्टाळी	स्त्री	ઠેકડી, મજાકરી	ठट्ठा, मजाक	joking fun banter
येહ	चेह	स्त्री	મડદાની ચિતા	चिता	funeral pyre
येચુ	चेंचु	न अ	આનાકાની ખાનગી રીતે	आनाकानी गुप्त रीति से	hesitation secretly pri- vately
येचेपેચે	चेंचेपेंचें	अ स्त्री, न	ખાનગી રીતે, માહોમાહે 1 આનાકાની 2 બડબડાટ	गुप्त तरीके से आनाकानी अस्पष्ट शब्दों में विरोध प्रकट करना	privately hesitation grumbling
येડુ	चेंडु	पु	રમવાનો દડો	गेंद	ball
येપે	चेंपें	न	1 આનાકાની 2 ખાનગીપણે	आनाकानी गुप्त रीति से	hesitation privately
ચૈતન્ય	चैतन्य	न	1 ચેતના, ચેતનપણ 2 સમજ, જ્ઞાન 3 આત્મા 4 પરમાત્મા 5 બળ, પરાક્રમ (સ) પ્રસિદ્ધ બગાળી વૈષ્ણવ સત	चेतना, चेतन- मयता, ज्ञान समझ, ज्ञान, होश आत्मा परमात्मा बल, पराक्रम प्रसिद्ध बगाली सत (चैतन्य)	life, conscious- ness understanding knowledge spirit the Supreme Spirit or Being strength valour well-known saint of Bangal
ચૈત્ર	चैत्र	पु	વિક્રમ સવતનો છઠ્ઠો માસ	चैत्र मास, चैत	sixth month of Vikram year

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चैत्री	चैत्री	वि	चैत्रनु, चैत्रशी १३ थतु	चैत का, चैत से शुरू होनेवाला, चैती	of or beginning with Chaitra
		स्त्री	चैत्रनी पूनम	चैती, चैत की पूर्णिमा	full moon day of the month of Chaitra
चोडडी	चोकडी	स्त्री	1 X आपी आकृति	X ऐसा चिह्न	cross as shown in the bracket (x)
			2 ओरडामा (सामान्य रीते तेना पुशामा) पाणी टोणवा करवामा आपतु जाणवाणु कडियाकाम	कमरे में बना हुआ मेंडदार चौका जिसमें मोरी रहती है, चौका	square spot in corner of room for accumulating and clearing waste water
			3 चारनी टोणी (उदा चडाणचोडडी)	चार आदमियों की टोली, मडली, चौकडी	group of four (usually of wicked men)
			4 चार युगनो समुदाय	चार युगों का समूह	period of four ages in Hindu mythology
चोड्डु	चोकडु	न	1 डाननु अेक धरेणु	कान का एक गहना	an ornament worn in the ear
			2 गाडा उपर माल भरवा भूडवामा आपतु लाकडानु पाणरु	गाडी में माल भरने के लिए बनाया हुआ चौकठा	a wooden cage
			3 घोडाना मोभा रडेतो लगामनो लोडानो भाग	घोडे की लगाम का मुँह में रहने वाला हिस्सा	iron bit of a bridle
			4 चोडडी X (तुच्छकारमा)	X ऐसा चिह्न	sign of (x) (contempt)
चोडवु	चोकवु	अ क्रि	भडडवु, थमडवु	चौकना, चौक जाना	to be stratled
		स क्रि	भापवु	नापना	to measure

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थोडस	चोकस	वि	1 थोडस, नक्री, जरेजरे (वस्तु) 2 सावधान 3 जातरीदार (भागस)	ठीक, निश्चित (वस्तु) सावधान चौकस (मनुष्य), भरोसेदार, विश्वासपात्र	exact, precise circumspect dependable (person)
		अ	नक्री, अवश्य	अवश्य, निश्चित	certain, sure
थोडियात	चोकियात	पु	थोड्री डरनार, रजवाण	चौकीदार, रखवाला	watchman, guard
थोड्री	चोकी	स्त्री	1 रजवाणने रडेवानु स्थान 'गेट' 2 रजवाणी 3 तपास, सभाण 4 जडत लेवानु नाडु	चौकी रखवाली, चौकीदारी खोज, निगरानी टोल-नाका, चुगीघर	gate guard, watch investigation, care toll-gate
थोड्रीदार	चोकीदार	पु	थोडियात, रजवाण	चौकीदार	watch-man
थोड्रीदारी	चोकीदारी	स्त्री	रजवाणी	चौकीदारी, रखवाली	duty of watchman
थोड्रीपडेसे	चोकीपहेरो	पु	थोड्री अने पडेसे, सजत जपतो	पहरा, कडी निगरानी, सख्त पहरा	careful watching
थोड्रीवाणो	चोकीवाळो	पु	थोडियात	चौकीदार	guard, watchman
थोडो	चोको	पु	1 चार जूणावाणी जगा 2 रसोई डरवा आजीट डरेली डे मरनारने सुवाडवा लीपी तैयार डरेली जगा	चौकोर स्थान, चौका रसोई बनाने के लिए या मरणासन्न व्यक्ति के लिए गोबर से लिपी हुई	square such place cleaned and reserved for cooking or a

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
				जगह, चौका	place daubed with cowdung for laying dying man
			३ चारनी सजावाणु गण्डुनु पतु	चौआ, चौका (ताश का)	four (in cards)
चोक्कस	चोक्कस	वि, अ	જુઓ 'ચોક્કસ'	देखिए 'चोक्कस'	see 'चोक्कस'
चोक्को	चोक्को	पु	જુઓ 'ચોક્કો'	देखिए 'चोक्को'	see 'चोक्को'
चोખ	चोख	वि स्त्री	ચોખ્ખુ १ ચોખ્ખાઈ २ (લા) નિકાલ	साफ सफाई फैंसला, निबटारा	pure clean cleanliness settlement
ચોખડિયાત	चोखडियात	वि	વટાળ વિનાનુ	भ्रष्टताविहीन	pure
ચોખડિયુ	चोखडियु	वि	१ ચોખલિયાત २ શુદ્ધિ કે નીતિનો અતિ આગ્રહ રાખનાર	शुद्ध शुद्धि या नीति का अति आग्रही	pure puritan
ચોખવટ	चोखवट	स्त्री	१ ચોખ્ખાઈ, પવિત્રતા २ સ્પષ્ટતા ३ (લા) નિકાલ, ખુલાસો	पवित्रता, शुद्धि स्पष्टता, सफाई फैंसला, स्पष्टता	cleanliness, purity clarity clarification, explanation
ચોખડ	चोखड	वि पु	જુઓ 'ચોખડુ' १ ચોખડી આકૃતિ २ ચારે ખડ (પૃથ્વીના)	देखिए 'चोखडु' चौकोर आकृति (पृथ्वी के) चारो महाद्वीप	see 'चोखडु' square figure all the four continents
ચોખડું	चोखडु	वि	१ ચારખૂણિયુ २ ચોરસ ३ ચાર ખડવાળુ	चौकोर, चौकोना चौरस चौखड	quadrangular square having four continents
ચોખા	चोखा	पु	(ડાગર ભરડીને કઢાતુ) એક જાતનુ અનાજ	चावल, तड़ुल	rice

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थोખાળવું	चोखाळवु	स क्रि	1 साधु કરવું 2 થોખખું—ખૂલ્લું —સ્પષ્ટ કરવું	साफ करना स्पष्ट-करना	to cleanse to express clearly
थોખું	चोखु	वि	જુઓ 'થોખખું'	देखिए 'थोखखु'	see 'थोखखु'
થોખુચટ	चोखुचट	वि	ખિલકુલ થોખખું	बिल्कुल साफ	quite clean
થોખૂણ	चोखूण	वि	ચાર ખૂણાવાળું	चतुष्कोण, चौकोना	square
થોખૂણિયું	चोखूणियु	वि	જુઓ 'થોખૂણ'	देखिए 'थोखूण'	see 'थोखूण'
થોખૂટ	चोखूट	वि	1 ચારે દિશાની મર્યાદામાં આવતું —તમામ 2 ચારે ખૂણાઓમાં —ચારે બાજુ	तमाम, चौखूट चारों ओर, चौखूट	coming within the four regions all around, on all four sides
થોખો	चोखो	पु	થોખાનો ઠાણો	चावल का दाना	grain of rice
થોખખાઈ	चोखखाई	स्त्री	1 સ્વચ્છતા, શુદ્ધતા 2 પ્રમાણિતતા, નિખાલસતા	स्वच्छता, शुद्धता, सफाई सच्चाई	cleanliness nonesty
થોખખું	चोखखु	वि	1 સ્વચ્છ 2 ભેળ વગરનું 3 સાચું, પ્રમાણિત 4 ખુલ્લું, સ્પષ્ટ	स्वच्छ, साफ बिना मिलावट का, शुद्ध, चोखा, ख़ालिस सच्चा, खरा, प्रामाणिक स्पष्ट, साफ, खुला	clean, clear unadulterated, pure truthful, honest frank, open, unambiguous
થોખખુચટ	चोखखुचट	वि	થોખખુચટ, ખિલકુલ થોખખું	बिल्कुल साफ	quite clean or clear
થોગડો	चोगडो	पु	ચારનો આકારો '૪'	चार का अंक, 4	figure of four 4
થોગણ	चोगणु	वि	ચાર ગણ	चौगुना, चार गुना	four times
થોગમ	चोगम	अ	ચારે દિશામાં, ચોમેર	चौगिर्द, चारों ओर	in all the four directions

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थोगरदम	चोगरदम	अ	જુઓ 'थोगम'	देखिए 'थोगम'	see 'थोगम'
थोगान	चोगान	न	ખુલ્લી જગા, મેદાન	मैदान, चौगान	open space
थोगो	चोगो	पु	ઝબ્બો	चोगा, अगरखा	large coat
थोधडियु	चोधडियु	न	1 ચાર ઘડી જેટલો વખત 2 મુરત	चार घडी जितना समय मुहूर्त, साइत	period of time equal to four <i>ghadis</i> auspicious moment or time*
थोट	चोट	स्त्री	1 આઘાત, પ્રહાર, મુઠિત 2 દાવ, લાગ 3 એક જાતનું જાદુ-મારણ, મૂઠ 4 નિશાન (તીર, ગોળીનું)	आघात, चोट दाव, घात, मौका मारण, मूठ निशाना	blow, stroke twist, trick kind of black magic target
थोटडु	चोटडु	वि	થોટી રહે-ખસે નહિ એવું	चिपकने वाला, चमचिच्चड	sticky
थोटडू	चोटडूक	वि	જુઓ 'થોટડુ'	देखिए 'थोटडु'	see 'थोटडु'
थोटण	चोटण	वि	જુઓ 'થોટડુ'	देखिए 'थोटडु'	see 'थोटडु'
थोटલી	चोटली	स्त्री	1 શિખા 2 નાળિયેરના ઉપરના રેસા	चोटी, शिखा नारियल के रेशे	tuft of hair, pigtail fibres covering a coconut
थोटलो	चोटलो	पु	વેણી, અખોડો	स्त्रियो की चोटी, वेणी, जूडा	plaited or knotted hair of women
थोटवु	चोटवु	स क्रि	1 ચીકાશને લીધે વળગવું 2 આગ્રહપૂર્વક વળગવું, અડી જમાવવો	चिकनाई के कारण जुडना, चिपकना, (-से) लग जाना चिमटना, आग्रहपूर्वक पकडे	to stick, to adhere to be with or pursue some-

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
-	-	-	-	रहना, अड्डा जमाना (ला)	body obstinately with a purpose or motive (contemptuously)
-	-	अ क्रि	बेसवु (तिरस्कारमा)	बैठना (तिरस्कृत रूप में)	sit on (at somebody's place causing boredom)
थोटावु	चोटाडवु	स क्रि	'थोटवु' नु प्रेरक रूप	चिपकाना	caus of 'थोटवु'
थोटी	चोटी	पु स्त्री	थोट-निशान-ताडनार थोटली	निशानेबाज चोटी, शिखा	marksman tuft or lock of hair on the head
थोट्टु	चोट्टु	वि	1 थोरुं उरवानी टेववाणु 2 लुथ्यु	चोरी करने का आदी, चोट्टा युक्तिबाज	thievish, given to stealing cunning
थोड	चोड	स्त्री	वस्तुओनो जथो	चीजो का जत्था, ढेर चौडा	heap or pile broad
थोडवु	चोडवु	स क्रि	1 थोटावु 2 जडवु, बेसावु 3 लगावु, ठोडवु 4 बरोबर लागे तेवो सथोट आउरो पोल उडेवो	चिपकाना जडना, बिठाना लगाना, जमाना, मारना (धौल) ठीक, कठोर, लगती बात कहना	to stick to fix to apply to say hard or bitter word
थोडाववु	चोडाववु	स क्रि	'थोटवु' नु प्रेरक	'थोटवु' का प्रेरणार्थक रूप	caus of 'थोटवु'
थोडु	चोडु	वि	1 पडोणु 2 चार पडवाणु, थोवडु	चौडा चौहरा	broad having four layers, four-fold

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
चोडो	चोडो	पुं	એક ઉપર એક વસ્તુનો ખરડો	गड़्डी	pile
चोतश्च	चोतरफ	अ	चारो आंगु	चारो तरफ	all around on all four sides
चोतशे	चोतरा	वि-	1. मोटो ओटलो, चभूतरा	बड़ा चबूतरा, चौतरा	big raised floor or platform. village-hall
			2. मोलीसथोडी, चावडी	थाना, चौकी	police-station
चोतारु	चोतारु	त्रि	चार तारवाणुं	दोसूती, चार तारो वाला	having four threads
चोथ	चोथ	स्त्री-	1. पणवाडियानी चोथी तिथि	चौथ, प्रत्येक पक्ष की चौथी तिथि	fourth day of lunar fortnight
			2. १६ चोथे इयानु अडे व्रत	कृष्ण पक्ष की चौथ के दिन करने का व्रत	rite performed on the fourth day of dark (lunar) fortnight
		न	3. गुरुओ 'चोथाड' इल्लाना पणियारानो नानो भाग	देखिए 'चोथाड' कडे के तिर का छांटा हिस्ता	see 'चोथाड' small part of socket of anklet
चोथियु	चोथियु	त्रि	चोथे दिवसे आवतु	चौथे दिन पर पडने वाला	recurring on fourth day
		न-	चोथो भाग	चौथा भाग	fourth portion
चोथियो	चोथियो	पुं	चोथे दण्डे आवतो ताव	चौथिया (बुखार)	fever recurring on fourth day
चोथियो ताव	चोथियो ताव	पुं	गुरुओ 'चोथियो'	चौथिया (बुखार)	see 'चोथियो'
चोदश	चोदश	अ	चारो दिशाओमा, चोतश्च	चतुर्दिक, चौगिद, चौखूट	all around. in all four directions
चोदश	चोदश	अ-	गुरुओ 'चोदश'	चतुर्दिक, चौखूट	see 'चोदश'
चोधार	चोधार	त्रि	चोधारुं	चार धारोवाला	see 'चोधारुं'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		अ	पुष्प	बहुत	plentiful
चोधारु	चोधारु	वि न	चार धारवाणु आर धारवाणु अेक उशियार	चार धारवाला चार धारवाला एक हथियार	four-edged weapon having four edges
चोपग	चोपग	वि न	चार पगवाणु जानवर, पशु	चार पैरो वाला पशु, चौपाया	having four legs animal
चोपगु	चोपगु	वि, न	जुओ 'चोपग'	देखिए 'चोपग'	see 'चोपग'
चोपचीनी	चोपचीनी	स्त्री	अेक औपधि	चोबचीनी	a medicine
चोपट	चोपट	स्त्री	1. सोगटानी रमत 2. ते रमवानु डपडु डे पाटियु	चौसर, चौपड चौसर की बिसात, चौसर	kind of game board of cloth on which it is played
चोपड	चोपड	न वि	(चोपडवानु) घी आर पडवाणु	घी चार परतवाला	ghee having four layers
चोपडी	चोपडी	स्त्री	पुस्तक	पुस्तक, किताब	book
चोपडीचुबक	चोपडीचुबक	वि	चोपडीओमा मशगूल रहेनार	पोथा पढने में लीन रहने वाला	book-worm
चोपडु	चोपडु	वि	1. आर पडवाणु 2. चीडु	चौहरा चिकना	having four layers greasy sticky
		न	1. आर पडवाणी शेटली 2. चोपडी (तिरस्कारमा)	चपाती, चार तहो वाली रोटी किताब, पोथा	kind of <i>chapatti</i> or cake with four layers book
चोपडो	चोपडो	पु	हिसाब लखवानी वली	बही (हिसाब)	ledger
चोपन	चोपन	वि	' ५४ '	चौवन, 54	fifty-four 54

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थोपवु	चोपवु	सक्रि	1 ખોસવુ, રોપવુ 2 ટીપવુ 3 મારવુ, ઠોકવુ	रोपना (पौधा), ख़ासना टीपना मारना, मरम्मत करना, पीटना	to thrust to copy to thrash, to beat
थोपाઈ	चोपाई	स्त्री	1 એક છદ 2 ચારપાઈ, ખાટલો	चौपाई चारपाई	kind of metre bed-stead
थोपाટ	चोपाट	स्त्री	1 સોગટાની રમત 2 તે રમવાનુ કપડુ કે પાટિયુ 3 સરખી સુધારેલી જમીન, યોગાન 4 પરસાળ જેવો બેઠકનો ભાગ, ચોપાડ	चौसर, चौपड चौसर की बिसात समतल भूमि, मैदान दालान के अदर का कमरा	see 'थोपाट' see 'थोपाट' level ground see 'थोपाड'
थोपाડ	चोपाड	स्त्री	પરસાળ	दालान के अदर का कमरा	sort of verandah for sitting
थोपानियु	चोपानियु	न	1 બેપાથ પાનાનુ પતકડુ, 'પેમ્ફલેટ' 2 નાનકડુ જાહેરનામુ 3 વર્તમાનપત્ર	चार-पाँच पृष्ठों की लघु पुस्तक, पुस्तिका, रिसाला, चौपतिया, 'पेम्फलेट' विज्ञापन, घोषणा (छोटा) समाचारपत्र	pamphlet short proclama- tion or declara- tion newspaper
थोपाया	चोपाया	पु	એક છદ	एक छद	kind of metre
थोपायो	चोपायो	पु	ખાટલો, ચારપાઈ	चारपाई	cot or bed-stead
थोपास	चोपास	अ	ચારે બાજુ	चौगिर्द	all around, on all sides

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थोड्ण	चोफाळ	पु	जडा मोटी पिछोडी	मोटी और लम्बी चद्दर	large, thick covering sheet
थोडेर	चोफेर	अ	थारे जाजू	चौगिर्द, चौखूट	all around, on all sides
थोडेर	चोफेरी	अ	जुओ 'थोडेर'	देखिए 'थोडेर'	see 'थोडेर'
थोपथीनी	चोबचीनी	स्त्री	थोपथीनी	चोबचीनी	see 'थापथीनी'
थोपो	चोबो	पु	1 भथुरा तरइनो ब्राह्मण	चोबा, चौबे	member of sect of brahmins living round Mathura
			2 टोल वगाडवानो ढडूओ	चोब (नगाडा)	drum-stick
थोपीलु	चोभीलु	वि	भोटु	खिसिया, लज्जित	crest-fallen
थोमग	चोमग	अ	थोपास, थोमेर	चौगिर्द	all around, on all sides
थोमासु	चोमासु	वि	थोमासामा थतु	चौमासे मे होनेवाला, चौमासिया	of or pertaining to monsoon
थोमासु	चोमासु	न	वरसादना थार भडिना, वर्षात्रतु	बरसात के चार महीने, चौमासा	monsoon
थोमुण	चोमुख	वि	थारे भो, पारणा डे जाजूवाणु	चौमुखा	having four mouths, doors or sides
थोर	चोर	पु	थोरी डरनार भासस, गुडो	चोर	thief, rogue
थोरभड	चोरखड	पु	(डभाट, पेटी छ नु) छूपु जानु	चोरखाना	secret drawer
थोरभानु	चोरखानु	न	जुओ 'थोरभड'	चोरखाना	see 'थोरभड'
थोरथपार	चोरचखार	पु	थोर वगेरे, थोर-पोर	चोर-चकार	belonging to clan of robbers

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ચોરટુ	ચોરટુ	વિ	ચોટ્ટુ	ચોટ્ટા	thievish
ચોરણી	ચોરણી	સ્ત્રી	લેઘી, સુથાણી	સુથની	pyjamas
ચોરણો	ચોરણો	પુ	1 સાથળ આગળ ખૂલતો હોય એવો લેઘો 2 મોટી ચોરણી	સુથના બડા પાજામા	pyjamas sort of breeches
ચોરદાનત	ચોરદાનત	સ્ત્રી	1 ચોર જેવી ઝીણી છૂપી નજર 2 (લા) ખોટી દાનત, અપ્રમાણિકતા	ચૌર જેસી તીક્ષ્ણ દૃષ્ટિ બદનીયત, બેઈમાની	sharp eye like that of a thief evil or bad intention
ચોરનજર	ચોરનજર	સ્ત્રી	જુઓ 'ચોરદાનત'	દેખિય 'ચોરદાનત'	see 'ચોરદાનત'
ચોરબજાર	ચોરબજાર	પુ, સ્ત્રી ન	જ્યા ચોરીનો માલ વેચાતો હોય તેવું બજાર	ચોરબાજાર	market where stolen goods are sold
ચોરબત્તી	ચોરબત્તી	સ્ત્રી	ચોરફાનસ	ચોરબત્તી	see 'ચોરફાનસ'
ચોરબારી	ચોરબારી	સ્ત્રી	છૂપી બારી	ચોરખિડકી	secret gate or outlet
ચોરવાટ	ચોરવાટ	સ્ત્રી	છૂપો રસ્તો	ચોરગલી, ચોરરસ્તા	secret path
ચોરસ	ચોરસ	પુ	ચારે સરખા બાજુ ને સરખા ખૂણાવાળી ચતુષ્કોણ આકૃતિ	સમકોણ, ચતુર્ભુજ આકૃતિ	square
		વિ	તેવા આકારનું, 'સ્કવેર'	એસે આકાર કા, ચૌરસ, 'સ્કવાયર'	anything of that shape
ચોરસો	ચોરસો	પુ	1 જાડા કાપડનો ચોરસ કાપડો 2 વિશેષ પહોળી એક પિછોડી	મોટે કપડે કા ચૌરસ ટુકડા ચૌડી ચાદર, ચાદર	broad sheet of thick cloth broad rug
ચોરાણ	ચોરાણ	વિ	' ૯૪ '	ચૌરાનવે, 94	ninety-four, 94
ચોરાણ	ચોરાણ	વિ	જુઓ 'ચોરાણ'	ચૌરાનવે	see 'ચોરાણ'

गुजराती शब्द	देवनागरी लिप्यन्तरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थोराशी	चोराशी	वि स्त्री	' ૮૪ ' બ્રાહ્મણોની થોરાશી-બધી નાતોનું જમાણ	चौरासी, 84 ब्राह्मणों की चौरासी- सभी जातियों का समूह भोज	eighty-four 84 dinner given to all the 84 castes of Brahmins
थोरासी	चोरासी	वि, स्त्री	જુઓ 'થોરાશી	देखिए 'थोराशी'	see 'थोराशी'
थोरी	चोरी	स्त्री	1 માધ્યરુ, વરકન્યા પરણવા બેસે છે તે મડપ	लग्नमंडप, चौरी	small square pandal with an altar where the bride and bridegroom are married
			2 થોરવુ અથવા થોરાવુ તે	चोरी	stealing, theft
थोरीछूपी	चोरीछूपी	स्त्री	થોરી કે ગુપ્તતા	चोरी या छिपाव	secrecy
थोरीફેરો	चोरीफेरो	પુ	થોરીમા વરકન્યાને ફેરવાતા ફેર	भोंवर, फेरा	going specific number of times around marriage altar
થોરે	ચોરો	પુ	1 ગામમા સૌને બેસવાની જગ્યા 2 પોલીસથાણ, 'ગેટ' 3 મોટો ઓટલો	चौपाल पुलिस चौकी, थाना बड़ा चबूतरा, चारा	public place in village police-station large platform
થોલમોગરો	चोलमोगरो	પુ	એક વનસ્પતિ	एक वनस्पति	kind of vegetation
થોવટ	चोवट	પુ, ન	1 ચકલુ, બજાર, ખુલ્લી જગ્યા	चौमहानी, बाजार, खुली जगह	market market-place open space in market-place

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 पथनो निर्णय-चुदाई	सप्रदाय का निर्णय/फैसला	decision or judgement given by four or more respect- able persons
		अ	1 ङुओ 'ओवाट' 2 पथात, (लाणी दोट- साणी), ओणाचोण	देखिए 'ओवाट' मीन-मेख से	see 'ओवाट' over-much scrutiny
ओवाट्यु	चोवटियु	वि	दोटाद्यु	जन्त से ज्यादा अक्लमद	over-wise
		न	पथनो चुदाई	पचो का फैसला	decision of jur or committee of elders
ओवाटयो	चांवटियो	पु	थोरे बेसनारो, आगेवान पुरुष, पथ	पच, अगुआ, चौपाल पर बैठने वाला	arbitrator
ओवडु	चोवडु	वि	1 चार पडवाणु 2 चारगणु	चौपरता, चौतहा चौगुना	having four layers four times, four-fold
ओवाट	चांवाट	अ	थोतरडु, पधी जाणुओ	चौतरफ	all around, on all four sides
ओवाटे	चोवाटे	अ	ङुओ 'ओवाट'	देखिए 'ओवाट'	see 'ओवाट'
ओवास	चोवाड	वि	थारे जाणुओ वाडवाणु	चारो ओर बाड वाला	having fence on all sides
		पु, न	तेपु धेतरे	ऐसा खेत	a field of that kind
ओवीस	चोवीस	वि	' २४ '	चौबीस, 24	twenty-four, 24
ओपवु	चोपवु	न	थूसवु	चूसना	to suck
ओसठ	चोसठ	वि	' ६४ '	चौसठ, 64	sixty-four, 64

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
थोसर	चोसर	वि	थार सेरवाणु, थोसेरु	चौलडा, चौसर	having four strands
		न	1 थार धोरीवाणो गणथपो 2 थार सेरनु भरत-गूथार	चौलडा हार चोकडी	necklace with four strings embroidery with four threads
थोसलु	चोसलु	न	गथियु	जमा हुआ टुकडा, चक्का	thick, square slice of sweet-meat
थोणवु	चोळवु	स क्रि	1 धसवु-भसणवु 2 थूथवु, वारवार उथलाववु	मलना, मसलना कुचलना, बारबार उलट-पुलट करना, बिगाडना (ला)	to rub, to smear to rumple, to handle frequently, to spoil
थोणथोण	चोळचोळा	स्त्री	थोणाथोण	गीजना-मलना	rubbing roughly and frequently
थोणा	चोळा	पु	थेड उठोण	एक दलहन, बोडा, लोबिया, चौरा	kind of pulses
थोणाथ	चोळाई	स्त्री	थोणानी सींग	बोडे की फली	kind of vegetable
थोणाथली	चोळाफळी	स्त्री	गुथो 'थोणाथ'	बोडे की फली	see थोणाथ
थोणाथोण	चोळाचोळ	स्त्री	वारवार थोणवु-थूथवु ते	गीजना-मलना	see 'थोणथोण'
थोणाथोणी	चोळाचोळी	स्त्री	गुथो 'थोणथोण'	बारबार मलना-गीजना	see 'थोणथोण'
थोणी	चोळी	स्त्री	1 स्त्रीओनो टूथी पाथनो उथणो 2 थोणासींग	चोली बोडे की फली	bodice a kind of beans
थोणीथड	चोळीखड	पु	थोणीनु लुगडु	चोली का कपडा	blouse-piece

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ચોડવુ	ચોકવુ	અક્રિ	ભડકવુ, ચમકવુ	ચોકના, મડકના	to be startled
ચોટવુ	ચોટવુ	સક્રિ	વળગવુ	ચિપકના, ચિમટના	to stick, to cling
ચોટાડવુ	ચોટાડવુ	સક્રિ	ચોટાડવુ	ચિપકાના	to stick
ચૌદ	ચૌદ	વિ	' ૧૪ '	ચૌદહ, 14	fourteen, 14
ચૌદમુ	ચૌદમુ	વિ	ક્રમમા ૧૩ પછી આવે એવુ	ચૌદહવૉ	fourteenth
		ન	માણસના મરણને ચૌદમે દિવસે કરાતો જમાણવાર	મૃત્યુ કે બાદ ચૌદહવે દિન કા મોજ	public dinner given on the 14th day of mourning
ચૌદમુરત્ન	ચૌદમુરત્ન	ન	1 અમૃત 2 (લા) માર, દડ	અમૃત માર, દડ	nectar punishment
ચૌદ રત્ન	ચૌદ રત્ન	ન	સમુદ્રમથનમાથી નીકળેલા ચૌદ રત્ન—લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધન્વતરી, ચંદ્રમા, કામ- દુધા, ઐશવત, રભા, સાતમુખી ઘોડો, ઝેર, સારંગ ધનુષ, પાચજન્મ શાખ અને અમૃત	ચૌદહ રત્ન	so called fourteen jewels obtained at the churning of the ocean by Gods, according to Hindu mythol- ogy
ચૌદશ	ચૌદશ	સ્ત્રી	પખવાડિયાની ચૌદમી તિથિ	ચૌદસ, ચૌદહવૉ તિથિ	fourteenth day of lunar fort- night
ચૌદસ	ચૌદસ	સ્ત્રી	જુઓ 'ચૌદશ'	દેખિય 'ચૌદશ'	see 'ચૌદશ'
ચૌદશિયો	ચૌદશિયો	પુ	વિદનસતોષી માણસ	વિદનસતોષી	man gloating on others' troubles
છ	છ	વિ	' ૬ '	છ, 6	six, 6

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
છ આગળિયુ	छ आगळियु	वि	(હાથે કે પગે) છ આગળીવાળુ	छ उँगलीवाला	having six fingers
છક	छक	अ	દિગ્મૂઢ, ચક્રિત	चकित, विस्मित	surprised, stunned
		पु	છક, તોર	रुआब, मिजाज, अहकार, अभिमान	insolence
છકડુ	छकडु	न	છનો જથ્થો	छकडी, छ का समूह	aggregate of six, collection of six
છકડો	छकडो	पु न	ગાડુ, ખટારો છનો જથ્થો	छकडा, गाडी छ का समूह	bullock cart see 'છકડુ'
છકવુ	छकवु	अ क्रि	બહેણે જવુ, વહી જવુ	छकना, बहकना, हाथ से जाना, अकुश में न रहना	to be insolent
છક્કડ	छक्कड	स्त्री	તમાચો, શપ્પડ	तमाचा	slap
છક્કો	छक्को	पु	છ ચિહ્નવાળુ ગણકાનુ પતુ	छक्का (ताश)	six in playing cards
છખૂણ	छखूण	वि	છ ખૂણા કે બાજુવાળુ (ષટકોણ)	षट्कोण	having six angles, hexagonal
છખૂણિયુ	छखूणियु	वि	જુઓ 'છખૂણ'	षट्कोण	see 'છખૂણ'
છગડગ	छगडग	वि	સગડગ, અસ્થિર, ઢચુપચુ	अस्थिर, डायॉडोल	wobbly, uncertain
છગડો	छगडो	पु	છનો આકડો	छ का अँक	figure of six
છચોક	छचोक	अ	છકેછોક, ખુલ્લી રીતે, જાહેરમા	खुले आम, प्रकट	openly, publicly
છછરુ	छछरु	वि	ઊંડ નહિ તેવુ	छिछला, उथला	shallow
છછૂદર	छछूदर	न	1 ઊદરના જેવુ એક પ્રાણી	छछूदर	mole, blind mouse

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 એક જાતનું દારૂખાનું	एक आतिशबाजी	kind of firework
છળાવટી	छजावटी	સ્ત્રી	છળા ઉપરનું નાનું છાપરું, વાછટિયું	छज्जा	small roof over balcony
છળુ	छजु	ન	ઝરૂખો	छज्जा	balcony
છટ	छट	અ	ધુત્કારસૂચક ઉદ્ગાર, છીટ	धत्	expression of contempt
છટકું	छटकु	ન	દાવપેચ, જાળ	छटका, जाल	trap
છટા	छटा	સ્ત્રી	1 શોભા, ક્રાંતિ 2 રીત, ખૂબી	छटा, शान, शोभा रीत, खूबी, दग	lustre, beauty way of doing, style
છટાંક	छटाक	ન	નવટાંક	छटॉक	sixteenth part of seer (weights)
છઠ	छठ	સ્ત્રી	પખવાડિયાની છઠી તિથિ	छठ	sixth day of lunar fortnight
છઠ્ઠી	छठ्ठी	સ્ત્રી	બાળકના જન્મ પછીનો છઠ્ઠો દિવસ	छठी	sixth day after child's birth
છડવું	छडवु	સક્રિ	1 ખાડીને છોડા જાડા કરવા 2 (લા) મારવું, ઠોકવું	छडना पीटना, मारना	to husk, to pound to beat, to thrash
છડામણ	छडामण	ન	છડતા નીકળેલો ભૂકો, કુશકી	कुटाई, छँटाई	husking and pounding
છડીવાન	छडीवान	વિ	જુઓ 'છડીદાર'	छड़ीदार	see 'छडीदार'
છડું	छडु	વિ	1 એકલું, સાથ વિનાનું 2 (લા) કુવારું 3 છોડરાઈયા વિનાનું	छडा, अकेला केवारा बिना बाल-बच्चों का	alone unmarried childless

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
छडेचोड	छडेचोक	अ	ખુલ્લી રીતે, જાહેરમાં	खुलेआम, सरे बाजार, आम तौर से	openly
छडेછડુ	छडेछडु	वि	સાવ છડુ	छडा	quite alone
છણકારો	छणकारो	पु	1 જુઓ 'ઝણકાર' 2 છણકો, તોર	झकार तिरस्कार, गुस्सा, मिजाज	see 'ઝણકાર' rude behaviour
છણકો	छणको	पु	1 ગરમ તેલમાં પાણીનો છાટો પડવાથી થતો અવાજ 2 ગુસ્સાનો બોલ, ગુસ્સો 3 તુચ્છકાર, તરછોડ	छनाका गुराहट, गुस्सा तिरस्कार, फटकार	hissing sound as of drop of water falling into boiling oil angry word scorn, curtness
છણવુ	छणवु	स क्रि	1 બારીક કપડાથી ચાળવુ કે ગાળવુ 2 બારીક તપાસ કરવી 3 ખણવુ, નખથી વલૂરવુ 4 (લા) દબાઈ ગયેલી વાતને ફરી ઊખેળવી-છેડવી	महीन कपडे से छानना या चालना छानबीन करना नाखून से खुजलाना गडे मुर्दे उखाडना, छेडना	to sift or strain with fine cloth to examine minutely to scratch to rake up a matter
છણણી	छणणी	स्त्री	છણવુ તે	छानना	sifting
છણાવટ	छणावट	स्त्री	જુઓ 'છણણી'	देखिए 'छणणी'	see 'છણણી'
છત	छत	स्त्री	1 હોવાપણ, હસ્તી 2 પુષ્કળપણ, ભસ્તી	हस्ती, होने का भाव बहुलता, अधिकता, बाढ	existence abundance

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૩ ઓરડા કે મકાનના છાપરાનો અદરનો ભાગ-સીલિંગ, ચદરવો, વિતાન	છત, સીલિંગ	ceiling canopy
			૪ ધાબુ, અગાશી	છત, ધાવા	terrace, roof
છતા	છતા	અ	તોપણ	ફિર મી	in spite
છતાય	છતાય	અ	છતા પણ	ફિર મી, તબ મી	despite although
છતુ	છતુ	વિ	૧ જીવતુ, વિદ્યમાન ૨ ચતુ, સવળુ	વિદ્યમાન, જિદા ચિત, પટ કા ઉલટા	living with back to the floor
			૩ સીધુ, પાસરુ ૪ ઉઘાડુ, જાહેર	સરલ, સીધા જાહિર, ખુલા	straight open, public
છતુપાટ	છતુપાટ	વિ	ચતુ, ચતુપાટ	ચિત	stretched full length with back to the floor, supine
છતે	છતે	અ	એક નકામો વપરાતો શબ્દપ્રયોગ	રહતે હુર, હોતે હુર	despite, inspite of (sometimes used redundantly)
છતર	છતર	ન	જુઓ 'છત્ર'	દેખિય 'છત્ર'	see 'છત્ર'
છતાપાટ	છતાપાટ	વિ	જુઓ 'છતુપાટ'	દેખિય 'છતુપાટ'	see 'છતુપાટ'
છત્રપતિ	છત્રપતિ	પુ	રાજા, શહેનશાહ	રાજા, શહનશાહ	king, emperor
છત્રી	છત્રી	સ્ત્રી	૧ તાપ તથા વરસાદથી બચવા માથે ઓઢવાનુ એક સાધન ૨ ગાડી, પલગ વગેરે પર હોતી છત-ઢાંચણ	છાતા, છત્રી છતરી (ગાડી, પલગ)	umbrella cover, hood of carriage etc

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या. को.	ગુજરાતી अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
છત્રીશ	छत्रीश	વિ	' ૩૬ '	छतीस, 36	thirty-six, 36
છત્રીસ	छत्रीस	વિ	જુઓ 'છત્રીશ'	देखिए 'छत्रीश'	see 'छत्रीश'
છનાછની	छनाछनी	સ્ત્રી	(લા) પૈસાની રેલછેલ	रुपये-पैसों की बाढ	abundance of money
છન્નુ	छन्नु	વિ	' ૯૬ '	छानबे, छियानबे, 96	ninety-six, 96
છન્નુ	छन्नु	વિ	જુઓ 'છન્નુ'	छानबे, छियानबे	see 'छन्नु'
છપચ	छपच	પુ	છપ્પો	छप्पा	kind of metre
છપર	छपर	ન	છાપરુ	छप्पर	roof
છપવુ	छपवु	અ ક્રિ	છુપાવુ, સતાવુ	छिपना, छुपना	to hide
છપાઈ	छपाई	સ્ત્રી	1 છાપવાનુ મહેનતાણ 2 છાપ, છાપણ	छापने की मजदूरी, छपाई छाप, छपाई (काम)	wage or price of printing printing
છપામણ	छपामण	સ્ત્રી	જુઓ 'છપાઈ'	देखिए 'छपाई'	see 'छपाई'
છપામણી	छपामणी	સ્ત્રી	જુઓ 'છપાઈ'	देखिए 'छपाई'	see 'छपाई'
છપાવવુ	छपाववु	સ ક્રિ	'છપવુ', 'છાપવુ' નુ પ્રેરક	छपाना, छपवाना	caus of 'छपवु', 'छापवु'
છપાવુ	छपावु	અ ક્રિ	1 'છાપવુ' નુ કર્મણી 2 છપાવાની ક્રિયા થવી, 'છપવુ' નુ ભાવે	छपना छपना	pass of 'छपवु' process of getting printed
છપ્પન	छप्पन	વિ	1 ' ૫૬ ' 2 ઘણ, અનેક, બહુ, બધુ	छप्पन, 56 बहुत, अनेक	fifty-six many, plentiful
છપ્પચ	छप्पच	પુ	જુઓ 'છપ્પો'	छप्पच, छप्पा	see 'छप्पो'
છપ્પર	छप्पर	ન	જુઓ 'છપર'	देखिए 'छपर'	see 'छपर'
છપ્પો	छप्पो	પુ	છ ૫૬નો એક છંદ	छप्पच	a kind of stanza of six lines

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છબરડો	छबरडो	પુ	ગોટાળો, અવ્યવસ્થા, કામ કે કૃત્તને નામે મીંડુ	घोटाला, अव्यवस्था	bungling, disorder, fiasco
છબલીકા	छबलीका	ન	કાસા, છબછબિયા	झाल-झालर, झॉस	cymbals
છમકલુ	छमकलु	ન	અટકચાળુ, ચાદવુ	नटखटी, छेडखानी	mischief, prank
છમકાટ	छमकाट	પુ	છમકવુ તે	छनकाना	noun of 'छमकवु'
છમકાર	छमकार	પુ	જુઓ 'છમકાટ'	छनकाना	see 'छमकट'
છમકારવુ	छमकारवु	સક્રિ	છમ અવાજ કરવો (ઊની, ગરમ વસ્તુ પાણીમા બોળવા ઇ થી)	छनकाना	caus of 'छमकवु'
છમછરી	छमछरी	સ્ત્રી	1 વાર્ષિક મરણતિથિ, સવત્સરી 2 પજુસણનો છેલ્લો દિવસ	सवत्सरी पर्युषण का आखिरी दिन	death anniversary last day of <i>Paryushan</i> (Jain festival)
છમાસિક	छमासिक	વિ	છ મહિને થતુ (ખાસ કરીને પરીક્ષા માટે)	छमाही	six monthly
છર	छर	પુ	1 મદ, તોર 2 મસ્તી, તાન 3 અસ્ત્રો	मद, अहकार, अभिमान मस्ती, धुन उस्तरा, छुरा	insolence whim razor
છરવંગુ	छरवगु	વિ	છરવાળુ, મદમસ્ત, અભિમાની	अभिमानी	proud, whimsical
છરવિગુ	छरविगु	વિ	જુઓ 'છરવંગુ'	अभिमानी	see 'छरवगु'
છરી	छरी	સ્ત્રી	ખાળી, કાતુ	छुरी	knife
છરો	छरो	પુ	1 મોટી છરી 2 સીધો જમ્બૈયો	बड़ी छुरी, छुरा खजर	large knife dagger

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા. કો.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			૩ બદૂકના બારમા ઊંડે એવા ખીલા, કાકરા ઈ	छर्चा (बदूक)	charge of gun
છલબલ	छलबल	ન	છળકપટ, પ્રપચ	प्रपच, छलबल	deception, trickery
છલાછલ	छलाछल	અ	છલકાય તેમ-છેક સુધી (ભરેલુ)	लबालब (भरा हुआ)	filled to the brim
છલૂડી	छलूडी	સ્ત્રી	નાનુ છાલિયુ, નાની વાડકી	कटोरी	small, broad cup
છલોછલ	छलोछल	અ	જુઓ 'છલાછલ'	लबालब (भरा हुआ)	see 'છલાછલ'
છવાવુ	छवावु	અ ક્રિ	ફેલાવુ	छाना, फैलना, पसरना	to spread
છવીશ	छवीश	વિ	૨૬, છવીસ	छब्बीस, 26	twenty-six, 26
છવીસ	छवीस	વિ	જુઓ 'છવીશ'	छब्बीस, 26	see 'છવીશ'
છસે	छसे	પુ	'૬૦૦' છસો	छ सौ	six hundred, 600
છસો	छसो	પુ	'૬૦૦' છસે	छ सौ	six hundred, 600
છળ	छल	પુ, ન	છલ	छल, कपट	deceit
છળકપટ	छलकपट	ન	દગોફટકો, પ્રપચ	छल, कपट	deception, fraud
છળના	छलना	સ્ત્રી	છલના, છળ કરવુ તે	छलना, ठगना	to deceive, to cheat
છળભેદ	छलभेद	પુ	છળપ્રપચ, દગોફટકો, છળકપટ	छलप्रपच	deception, treachery
છળવુ	छलवु	સ ક્રિ	છેતરવુ, ઠગવુ	छलना, ठगना	to deceive, to cheat
		અ ક્રિ	ખીકથી ચમકવુ, હાલકવુ	चौकना, भय से चौकना	to be frightened

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છછેડવું	છછેડવું	સ- ક્રિ	ચીડવવું, સળી કરવી	છેડના, ચિદાના	to tease, to vex, to provoke
છટકાવ	છટકાવ	પુ	છાટવું તે	છિડકાવ	sprinkling, spraying
છટકોર	છટકોર	પુ	છટકોરવું તે	છિડકાવ	spraying, sprinkling
છટકોરવું	છટકોરવું	સ ક્રિ	છટકાવ કરવો, છાટવું	છિડકના	to spray, to sprinke
છટાવ	છટાવ	પુ	જુઓ 'છટકાવ'	છિડકાવ	see 'છટકાવ'
છટાવવું	છટાવવું	સ ક્રિ	'છાટવું' નું પ્રેરક	છિડકવાના	caus of 'છાટવું'
છદ	છદ	પુ	1 અક્ષર કે માત્રાના મેળ-નિયમથી બનેલી કવિતા, વૃત્ત 2 લત, વ્યસન	વૃત્ત (અક્ષર યા માત્રા), છદ લત, વ્યસન	metre hobby, addiction
છદબદ્ધ	છદબદ્ધ	વિ	પદ્યરૂપે ગોઠવેલું— બનાવેલું	છદોબદ્ધ	in verse form
છદભંગ	છદભંગ	પુ	છદ-વૃત્તનો ભંગ	છદોભંગ	break in metre
છદીલું	છદીલું	વિ	જુઓ 'છદી'	મૌજી, વ્યસની	see 'છદી'
છદોબદ્ધ	છદોબદ્ધ	વિ	જુઓ 'છદબદ્ધ'	છદોબદ્ધ	see 'છદબદ્ધ'
છદોભંગ	છદોભંગ	પુ	જુઓ 'છદભંગ'	છદોભંગ	see 'છદભંગ'
છાકટ	છાકટ	વિ	છાકટું	મતવાલા, પ્રમત્ત	arrogant, intoxicated
છાકટાઈ	છાકટાઈ	સ્ત્રી	દારૂ પીને છાકટા બનવું તે, બહેંચી જવું તે	શરાબ પીકર બહક જાના, મદહોશ હોના	drunken behaviour
છાકટાપણું	છાકટાપણું	ન	જુઓ 'છાકટાઈ'	દેખિય 'છાકટાઈ'	see 'છાકટાઈ'
છાકટું	છાકટું	વિ	દારૂ પીને ભાન ભૂલેલું	મતવાલા, પ્રમત્ત	drunken
છાકટો	છાકટો	પુ	દારૂકિયો	શરાબી	drunkard

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છાકોટો	छाकोटो	પુ	ભારે છાકભર્યો છણકો-તિરસ્કામ, છાંછિયુ	झिडकी, भर्त्सना, फटकार	scornful gesture or word
છાજ	छाज	ન	1 છાપરામા ઘાસ, પાટિયા કે વાસ વગેરેનું ડરાતુ આથ્છાદન કે તે વસ્તુઓ 2 અભરાઈ	छाज, छाजन परछत्ती, टॉड	thatching material shelf
છાજલી	छाजली	સ્ત્રી	1 છળા ઉપરની નાની અગાસી 2 નાનું છળુ 3 અભરાઈ	छज्जे पर की छत छोटा छज्जा परछत्ती, टॉड	small terrace over a balcony small balcony shelf
છાજવું	छाजवु	સ ક્રિ	1 છાજથી ઢાકવું, છાવું 2 છવાઈ રહેવું 3 લાયક હોવું 4 સારું દેખાવું, શોભવું	छाजन से ढँकना, छाना, छा जाना लायक होना शोभा देना	to thatch to be overspread to be fit, to suit to look comely
છાણ	छाण	ન	ગાય ભેસનો મળ, ગોબર	गोबर	dung of cow or buffalo
છાણવું	छाणवु	સ ક્રિ	1 બારીક રીતે ચાળવું 2 છણવું	बारीक छानना छानना	to sift, strain to scrutinize
છાણ	छाणु	ન	બાળવા માટે છાણને શાપીને સૂકવેલું ચકરડું	उपला, गोहरा	cake of dung
છાતીકડું	छातीकडु	વિ	બહાદુર, પ્રાણવાન	बहादुर	brave, gallant
છાતીચલું	छातीचलु	વિ	હિમ્મતવાન	हिम्मतवान	brave
છાતીપૂર	छातीपूर	વિ	છાતી સુધી આવે એટલું ચકરડું	छाती तक पहुँचे इतना	chest-high
છાતીશર	छातीशर	અ	છાતી શરી નાચ એમ, ખૂબ લાગણીથી	हृदयपूर्वक	heartful

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
छातीभेर	छातीभेर	अ	1 छिमतशी 2 छाती भरल आवे-दम चडे तेम	हिम्मत से दम भर जाय इस तरह	bravely that which makes one pant
छात्रवृत्ति	छात्रवृत्ति	स्त्री	छात्रने तेना अर्थ पेटे भणती (नाशानी) मडे	वजीफा, छात्रों को पढाई के खर्च के लिए मिलने वाले पैसे	scholarship
छानु	छानु	वि	1 गुप्त 2 मूगु	गुप्त, छिपा हुआ शान्त, मौन	secret, confidential dumb
छानुछपतु	छानुछपतु	वि	छुपु, छेछे ज़ाणे नछि तेपु, गुप्त	छिपा हुआ, गुप्त	secret, concealed
छानुछपनु	छानुछपनु	वि	जुओ 'छानुछपतु'	देखिए 'छानुछपतु'	see 'छानुछपतु'
छानुमानु	छानुमानु	अ	1 छानुछपतु 2 गुपचुप	छिपे-छिपे चुपचाप	see 'छानुछपतु' secretly
छाप	छाप	स्त्री	1 ओड वस्तु बीछ पर दबाववाशी तेनी आकृति अछि थाय ते 2 आकृति पाडवानो सिक्को 3 मन पर थयेली असर -बधायेलो अभिप्राय	एक चीज को दूसरी चीज पर दबाने से अकित उस की आकृति मोहर चित्त पर पडा हुआ प्रभाव, बना हुआ अभिप्राय	impression seal impression in the mind, formation of opinion
छापखानु	छापखानु	न	छपाइ थतु छेय ते स्थान, मुद्रणालय	छापखाना, 'प्रेस'	printery, printing press
छापगर	छापगर	पु	छीपो	छीपी	cloth-printer, dyer

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છાપરુ	छापरु	ન	1 મકાન પર કરેલુ ઢાંકણ 2 છાજ 3 ઝૂપડુ	छप्पर छाजन झोंपडा	roof thatch hut
છાપરી	छापरी	સ્ત્રી	1 નાનુ છાપરુ 2 (લા.) ઝૂપડી	छोटा झोंपडा-छप्पर झोंपडी	small cover or roof small hut
છાપવુ	छापवु	સ ક્રિ	બીબા વડે છાપ-આકૃતિ પાડવી	छापना	to print
છાપુ	छापु	ન	1 વર્તમાનપત્ર 2 બીબુ	समाचारपत्र ठप्पा	newspaper mould
છાપો	छापो	પુ	1 ઓચિંતો હુમલો 2 છાપ વડે કરેલુ ચિહ્ન 3 લાગો, વેશે	छापा, धावा छापा, चिह्न कर, लगान	sudden attack impression made with stamp duty, levy
છાબ	छाब	સ્ત્રી	છાબડી, વાસની છાછરી ટોપલી	डलिया, छबडा	basket
છાબડી	छाबडी	સ્ત્રી	જુઓ 'છાબ'	छोटा छबडा	see છાબ'
છાબડુ	छाबडु	ન	જુઓ 'છાબ'	देखिए 'छाब'	see છાબ'
છાયા	छाया	સ્ત્રી	1 પડછાયો 2 આશરો 3 અસર	छाया, परछाई, छाँह आश्रय असर, प्रभाव	shadow shelter impression impact
છાયાચિત્ર	छायाचित्र	ન	કેવળ છાયા-ઓબાડમે આલેખાયેલુ ચિત્ર	छायाचित्र	silhouette
છાયાયત્ર	छायायत्र	ન	છાયા ઉપરથી વખત જાણવાનુ યત્ર, 'સન-ડાયલ'	छायायत्र	sun dial
છાયો	छायो	પુ	છાયો, પડછાયો, ઓબો	छाया, परछाई	shadow

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
छार	छार	पु, स्त्री	1 छटनो भुंओ 2 झुग 3 राख	इटों का चूर्ण पुई राख	brick powder fungus ash
छारो	छारो	पु	थेड आदिवासी जाति	एक आदिमवासी जाति	an aboriginal tribe in Guja
छारी	छारी	स्त्री	छारा' नु स्त्रीलिंग	'छारा' का स्त्रीलिंग	famine of 'छारा'
छाल	छाल	पु स्त्री	1 ज्याले 2 डेडो, पीछे (आडनी) त्वचा	ख्याल पीछा (छोडना) (पेड की) छाल	notion, idea trail, pursuit skin (of tree)
छालक	छालक	स्त्री	पार्लीनी छोण	छलक	splash of water
छाला	छाला	न	1 शेतरी, छोडा 2 थामडी परना भिगडा	छिलके खुरड, छाले	husks, chaff scales on skin
छालियु	छालियु	न	पछोणा मेनी वाडकी, छालु	चौड़े मुँह की कटोरी, छाली	broad-mouthed cup
छाली	छाली	स्त्री	नानु छालु, वाडकी	छाली, कटोरी	small broad-mouthed cup
छावणी	छावणी	स्त्री	लश्करी पडाव डे मथड	पडाव, छावनी (लश्करी)	camp, esp military encampment
छावु	छावु	स क्रि	1 टाडपु 2 छाव पडे टाडपु	छाना, ढकना छाज से ढकना	to cover to cover with thatch
छाश	छाश	स्त्री	छाँ मथी डरातु प्रवाडी	छाछ, मट्ठा	thick butter-milk
छाशी	छाशी	वि	' ૮૬ ', છયાશી	छियासी, 86	eighty-six, 86

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છાસ	छास	સ્ત્રી	જુઓ 'છાશ'	छाछ, मट्ठा	see 'छाश'
છાસઠ	छासठ	વિ	' ૬૬ '	छियासठ, 66	sixty-six, 66
છાણી	छाणी	સ્ત્રી	બકરી	बकरी	she-goat
છાળો	छाळो	પુ	બકરો	बकरा	goat
છાછવું	छाछवु	વિ	ઉછાછવું, ઉદ્દત	उद्धत	thoughtless, rude
		ન	છાછિયું, છાછો	झिडकी	rude word or gesture
છાછળું	छाछळु	વિ	1. છોકરવાદ 2. આછકલું	लडकपन छिछोरा	childishness shallow, showy
છાછિયું	छाछियु	ન	શેષ કે તિરસ્કારયુક્ત છાછો કે ઘુરકિયું	झिडकी, भर्त्सना	rude word or gesture
છાટવું	छाटवु	સ ક્રિ	1. વિખેરાઈને પડે એમ નાખવું 2. (લા.) ગપ-બડાઈ હાકવી 3. લાથ આપવી 4. ઉપર ઉપરથી કાપવું	छिटकना, छिडकना, बिखेरना गप या बडाई हॉकना घूस देना ऊपर-ऊपर से काटना, छॉटना	to sprinkle to boast to give bribe to prune
છાટા	छाटा	પુ	થોડો છાટા જેવો વરસાદ, છાટી	छीटे, फुहार	drizzle
છાટું	छाटु	વિ	ગપી, છાટું	गपोडा	boastful
છાટો	छाटो	પુ	1. બુદ, ટીપુ 2. (લા.) ડાઘ, ડલક 3. થોડુંક, ચપટીક	छीटा, बूद दाग, कलक थोडा सा, तनिक	drop stir, stigma a little
છાટોપાણી	छाटोपाणी	ન	(લા.) ઘર	शराब	drinks, esp liquor
છાડવું	छाडवु	સ ક્રિ	1. તજવું	त्यागना, छोडना	to leave

adultery	ସ୍ତ୍ରୀହତ୍ୟା	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
adulterous	ସ୍ତ୍ରୀହତ୍ୟା, ସ୍ତ୍ରୀହତ୍ୟା	ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
adulteress	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
adulterous	ଠାକୁରାଣୀ କାନ୍ଦୁ ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
having holes with holes,	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
finder holes, fault-					
one who picks	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
finding faults,					
picking holes,	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
see, see	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
see, see	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
see, see	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
see, see	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
food in plate					
to leave uneaten	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
cow-dung					
of earthen					
ware with mixture	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
to dabble thick	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
see, see	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଠାକୁରାଣୀ, ମୁହୂର୍ତ୍ତ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
purged by					
discovered	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
abandoned	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
the plate	(ଠାକୁରାଣୀ)	ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
to leave food in	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
to divorce	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ ଓ ଠାକୁରାଣୀ	ଫୁଲ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ

ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ	ଠାକୁରାଣୀ
----------	----------	----------	----------	----------

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છિનાળુ	छिनाळु	ન	જુઓ 'છિનાળી'	વ્યભિચાર	see 'છિનાળી'
છિખાવવું	छिखाववु	સ ક્રિ	'છીપવું' નું પ્રેરક	'છીપવું' કા પ્રેરણાર્થક રૂપ	caus of 'છીપવું'
છિપાવું	छिपावु	અ ક્રિ	'છીપવું'નું કર્મણિ	'છીપવું' કા કર્મણિ	pass of 'છીપવું'
છિપોલી	छिपोली	સ્ત્રી	જુઓ 'છીપ'	દેખિય 'છીપ'	see 'છીપ'
છીછરું	छीछरु	વિ	શોડ ઊડાઈવાળું	છિછલા, ઉથલા	shallow
છીણવું	छीणवु	સ ક્રિ	1 ગાળવું 2 છીણી ઉપર ઘસવું, છૂદી પાડવો 3 મોળવું, સમારવું (શાક)	છાનના કદ્દુકસ પર ઘિસના, કસના છીલના, કાટના (સબ્જી)	to sit, to strain to scrape to cut (esp vegetables)
છીણી	छीणी	સ્ત્રી	1 છીણવાનું સાધન 2 લાકડા શડવામા વપરાતી લોઢાની ફાચર 3 ધાતુ કાપવાનું લોઢાનું વાંધારું	કદ્દુકશ, ઘિયાકસ રુખાની ટાંકી, છૈની	scraper iron wedge used in splitting wood iron chisel for cutting metal
છીદરું	छीदरु	વિ	જુઓ 'છીછરું'	છિછલા	see 'છીછરું'
છીનવવું	छीनववु	સ ક્રિ	1 ઝૂટવી લેવું 2 છેતરી લેવું	છીનના ઠગના	to snatch, to grab to cheat, to swindle
છીનવાવું	छीनवावु	અ ક્રિ	'છીનવવું' નું કર્મણિ	છીના જાના, છિનના	pass of 'છીનવવું'
છીપ	छीप	સ્ત્રી	એક જાતની માછલીનું ઝોટલું-ઘર, સીપ	સીપ	shell
છીપવું	छीपवु	અ ક્રિ	1 શમવું, શાત થવું (તરસનું) 2 સતાવું, લપાવું	બુઝના, મિટના (પ્યાસ) લુકના, છિપના	to quench (esp of thirst) to hide, to lurk

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છીપો	છીપો	પુ	કપડા છાપનારો, છાપગર	છીપી	dyer, cloth-printer
છીબુ	છીબુ	ન	તપેલીનું ઢાંકણ, તાસક	તશતરી	flat saucer
છીંક	છીંક	સ્ત્રી	છીંક કરીને જોરથી શ્વાસ બહાર ફેંકવો તે	છીંક	sneeze
છીંકણી	છીંકણી	સ્ત્રી	સૂઘવા માટે ઘૂટીને તૈયાર કરેલી તમાકુ	સુંઘની, નસવાર	sunff
છીંકવું	છીંકવું	અ ક્રિ	છીંક ખાવી	છીંકના	to sneeze
છીંટ	છીંટ	સ્ત્રી	એક જાતનું રંગિત, ભાતીગર કપડું	છીંટ	kind of dappled cloth
છીંડું	છીંડું	ન	1 વાડમાં રાખેલું બાકું- માર્ગ 2 (લા) દોષ 3 બહાનું	બાડ મેં સંકરા રાસ્તા એબ, દોષ બહાના	small opening in hedge fault excuse
છૂટકારો	છૂટકારો	પુ	મુક્તિ, છૂટકો, અત	છૂટકારા, નજાત રિહાઈ	deliverance, respite
છૂટાવું	છૂટાવું	અ ક્રિ	છૂટવાની ક્રિયા થવી, 'છૂટવું' નું ભાવે	છૂટ જાના	process of getting deliverance or respite
છૂટી	છૂટી	સ્ત્રી	1 છૂટી, રજા 2 નવરાશ	છૂટી ફુરસત	holiday, leave leisure
છૂટું	છૂટું	વિ	જુઓ 'છૂટ'	દેખિય 'છૂટ'	see 'છૂટ'
છુપાડવું	છુપાડવું	સ ક્રિ	સતાડવું, ગુપ્ત રાખવું	છિપાના, છુપાના, ઢોંપના (મુંહ)	to hide, to conceal
છુપાવવું	છુપાવવું	સ ક્રિ	જુઓ 'છુપાડવું'	દેખિય 'છુપાડવું'	see 'છુપાડવું'
છુપાવું	છુપાવું	અ ક્રિ	સતાવું, છુપવું	છિપના, છુપના	to hide

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
છૂ	छू	न	સરકી જવું-જતા રહેવું તે	छू होना, चलते बनना	to slip, to escape
છૂટ	छूट	स्त्री	1 મોડળાશ 2 રજા, પરવાનગી 3 છોડી દીધેલી-જતી કરેલી રકમ 4 છૂટાપાણી, સ્વતંત્રતા 5 તગી કે સખતાઈ, સકોચ યા મનાઈનો અભાવ	कुशादगी, अवकाश रजा, अनुमति ऋण की माफी, छूट स्वतंत्रता रिआयत, कड़ाई का अभाव	spaciousness, roominess leave, permission concession freedom liberality
છૂટક	छूटक	वि अ	છૂટુ છૂટુ જથાબધ નહિ તેમ	अलग-अलग, भिन्न-भिन्न खुदरा, फुटकर	scattered retail
છૂટકો	छूटको	पु	છૂટકારો, મુક્તિ	मुक्ति, छुटकारा	deliverance
છૂટવું	छूटवु	अ क्रि	1 બંધનમાંથી છૂટા થવું 2 (એકાએક કે જોરથી) બહાર નીકળવું 3 પાસેથી જવું કે નીકળવું 4 (જવાને માટે) છૂટ કે રજા મળવી 5 વધુવું, ઊંડવું 6 કોઈ ભાવ કે લાગણી એકદમ પ્રગટવી	छूटना, बंधन दूर होना बाहर निकलना पास से निकलना इजाजत मिलना, छूटना खुलना (गौठ) प्रकट होना (भाव)	to be free from bondage to go off, to explode (of perspiration smell etc) to come out to be permitted to go to be let off to arise (esp emotion) sentiment
છૂટાછેડા	छूटाछेडा	पु	ફારગતિ, લગ્નના બંધનમાંથી છૂટકારો	तलाक	divorce

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છૂટી	છૂટી	સ્ત્રી	જુઓ 'છુટ્ટી'	દેખિય 'છુટ્ટી'	see 'છુટ્ટી'
છૂટ	છૂટ	વિ	1 બંધન વિનાનુ 2 (નોકરી કે કામ યા કોઈ રોકાણમાથી) ફરેગ, નવરુ, બરતરફ થયેલુ યા કરાયેલુ 3 અલગ, જુદુ, કોઈ સાથે ભેગુ સઘાયેલુ કે જોઠવાયેલુ યા મુકાયેલુ નાહ એવુ 4 ભભરુ 5 મોકળુ, વચમા અતર હોય તેવુ	છુટ્ટા, खुला फारिग, बेकार, बरतरफ, मुक्त अलग, भिन्न भुरभुरा कुशादा, खुला, बीच में अतर हो वैसा	free, unencumbered dismissed, sacked (from a job etc) separate dry large-hearted, liberal
		न	परचूरण (नाशानु)	रेजगारी, खुदरा, छुट्टा	change (of currency)
છૂતઅછૂત	छूतअछूत	સ્ત્રી	અમુકને અડાય, અમુકને ન અડાય એવી અસ્મૃશ્યતાની માન્યતા	छूतछात, छुआछूत	notion of untouchability
છૂપવુ	छूपवु	अ क्रि	સતાવુ, છુપાવુ	छिपना, छुपना	to hide, to conceal oneself
છૂપાછૂપ	छूपाछूप	अ	છુપી રીતે	गुप्त रीत से, छिपकर	secretly
છૂપુ	छूपु	વિ	ગુપ્ત, છાનુ	गुप्त, खुफिया	secret; con- cealed
છૂમતર	छूमतर	न	જાદુ, જતરમતરનો પ્રયોગ	जादू, छूमतर	magic

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
છૂંચ	छूँछ	न	રૂંછા, વણતા કે બીજે કારણે રહી ગયેલા તારના છેડા	रेशे, फुचडे	stray ends of yarn
છૂંછુ	छूँछु	न	ડાચુ, મોં (તિરસ્કારમા)	मुँह (तिरस्कार में)	face (contemptuous)
છૂંછી	छूँछी	स्त्री	છૂંછવુ તે	गोदना	tattoo
છૂંછણ	छूँछण	न	શરીર પર છૂંછને પાડેલુ ટપકુ-ચાટુ કે આકૃતિ	गोदना	tattoo
છૂંછવુ	छूँछवु	स क्रि	1 સોચ કે અણીવાળા હથિયાર વડે ટોચવુ 2 બારીક કચરવુ, છૂંછા જેવુ બનાવવુ	गोदना बारीक कूटना, कुचलना	to pierce with a needle or a sharp instrument to crush into bits
છૂંછાવવુ	छूँछाववु	स क्रि	'છૂંછવુ' નુ પ્રેરક	गुदाना, गुदवाना	caus of 'छूँछवु'
છૂંછવુ	छूँछवु	अ क्रि	'છૂંછવુ' નુ કર્મણિ	कूटा जाना, कुचल जाना	pass of 'छूँछवु'
છૂંછે	छूँछे	पु	1 છૂંછા છૂંછને બનાવેલો ભોથો 2 છીણેલી કેરીનું અથાણ	लोदा, पिडा (कूटा हुआ) कसकर बनाया हुआ आम का आचार	mesh, crush pickle of crushed mango
છેક	छेक	अ	તદન, સાવ	निपट, बिल्कुल, निरा	utterly
		पु	અત, હદ (પ)	अत	end, limit
છેટી	छेटी	स्त्री	નાની પોતડી	छोटी धोती, कछनी	short dhoti
છેટુ	छेटु	वि	વેગળુ, દૂર	दूर	distant, far off

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		ન	1 બે જગા વચ્ચેનું અંતર 2 અશક્યતા (પ્રાયઃ બ વ મા)	દૂરી, ફાસલા અશક્યતા	distance between two points impossibility (esp in plural)
છેટે	છેટે	અ	દૂર, આધે	દૂર, ફાસલે પર	distant
છેડતી	છેડતી	સ્ત્રી	અડપલુ, અટક્યાળુ	છેડખાની, નટખટી	harassment
છેડવું	છેડવું	સ ક્રિ	1 અટક્યાળું કરવું, ખીજવું 2 ટકોરવું, જરા હળવો સ્પર્શ કરવો,	ખિજાના, નટખટી ટકોરના, છેડના	to harass, tease to knock gently
છેડાગાઠણ	છેડાગાઠણ	ન	વરકન્યાના છેડા ગાઠવાનું વસ્ત્ર	ગઠબધન, ગઠજોડા	garment used in marriage ceremony
છેડાગાઠણ	છેડાગાઠણ	ન	જુઓ 'છેડાગાઠણ'	ગઠબધન	see 'છેડાગાઠણ'
છેડાછેડ	છેડાછેડ	સ્ત્રી	વારવાર છેડવું તે, સતામણી	છેડખાની, સતાના, છેડના	harassment
છેડાબધન	છેડાબધન	ન	જુઓ 'છેડાબાધણ'	ગઠબધન	see 'છેડાબાધણ'
છેડાબાધણ	છેડાબાધણ	ન	વરકન્યાના છેડા ગાઠવાનું વસ્ત્ર, છેડાગાઠણ	ગઠજોડ	garment used in marriage ceremony
છેડાબાધણ	છેડાબાધણ	ન	જુઓ 'છેડાબાધણ'	ગઠબધન	see 'છેડાબાધણ'
છેડાવું	છેડાવું	અ ક્રિ	ખીજવાવું	ચિઢના, ખીજના	to be teased
છેડો	છેડો	પુ	1 અંતનો ભાગ, અંત 2 હદ, સીમા 3 પાલવ 4 (લા.) આશરો, મદદ	છોર, સિરા, અંત હદ, સીમા દામન આશ્રય, મદદ	end limit border help, refuge

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છેતરપિડી	छेतरपिडी	સ્ત્રી	છેતરખણી, ઠગાઈ	ઠગાઈ, ઝાંસાપટ્ટી, ધોખેબાજી	cheating
છેતરવું	छेतरवुं	સ ક્રિ	ઠગવું, છળવું	ઠગના, છલના, ચકમા દેના	to cheat, to swindle
છેતરખણ	छेतरखण	ન	છેતરવાખણું	ઠગા જાને કા ભાવ, ધોખા	liability of being cheated
છેતરખણી	छेतरखणी	સ્ત્રી	જુઓ 'છેતરખણ'	ધોખા	see 'છેતરખણ'
છેતરખણું	छेतरखणुं	વિ	છેતરી લે એવું	ઠગે એસા	having capacity to cheat
છેતાળીસ	छेतालीस	વિ	' ૪૬ ', છેતાળીસ	છિયાલીસ, 46	forty-six, 46
છેદ	छेद	પુ	1 કાપો, ચીરો 2 છિદ્ર 3 છેદનારી-ભાગનારી સખ્યા (અપૂર્ણાંકમાં લીટી નીચે લખવામાં આવે છે તે) 4 નાશ	છેદ, ચીરા, શિગાફ, કાટ છિદ્ર, સૂરાઈ ભાજક સહ્યા, હર	slit, cut hole, pore denominator of fraction (math)
છેદવું	छेदवुं	સ ક્રિ	1 કાપવું 2 છિદ્ર-કારણ પાડવું 3 નિકદન કાઢવું 4 છેદવુંપે થઈને ભાગવું (ગ)	કાટના, છેદના સૂરાઈ કરના, છેદના નષ્ટ કરના અશ કો હર સે ભાગ દેના	to cut, to slit to drive a hole to destroy to divide as denominator
છેર	छेर	સ્ત્રી	જુઓ 'છેરટો', ખેર	ધૂલ, ઝાડન	see 'છેરટો'
છેરવું	छेरवुं	અ ક્રિ	પાતળું અઘવું	પોંકના	to pass liquid stools
છેરટો	छेरटो	પુ	1 છેરખણ, પાતળો ઝાડો 2 ધૂળ કચરો	પતલા દસ્ત ધૂલ, ઝાડન	liquid stools dust, rubbish

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
એશમણ	છેરામણ	ન, સ્ત્રી	પાતળો ઝાડો	પતલા દસ્ત, પોંકના	liquid stools
એલ	છેલ	પુ	વરણાગિયો માણસ	છૈલા, શરીર કી સજાવટ કરને વાલા વ્યક્તિ	fop, dandy
એલછબીલુ	છેલછબીલુ	વિ	મોહક અને રૂપાળુ	છબીલા, મોહક ઔર સ્પવાન	charming and attractive
એલછટાકિયુ	છેલછટાકિયુ	વિ	એલખટાઉ	છૈલા, છૈલ-છબીલા	foppish
એલએલુ	છેલછેલુ	વિ	એલલામા છેલુ, સૌથી છેલુ, એલવેલુ	સબ સે આખિરી	latest
એલખટાઉ	છેલખટાઉ	પુ	વરણાગિયો-લહેરી જવાન	છૈલા, છૈલ-છબીલા	foppish youth
એલવહેલુ	છેલવહેલુ	વિ	જુઓ 'એલએલુ'	સબ સે અતિમ	see 'એલએલુ'
એલવેલુ	છેલવેલુ	વિ	જુઓ 'એલએલુ'	સબ સે આખિરી	see 'એલએલુ'
એલ્લી ઘડી	છેલ્લી ઘડી	સ્ત્રી	1 મરણની તૈયારીનો સમય 2. આખરનો સમય	મૃત્યુ કે ક્ષણ આખિરી વક્ત	last moments (esp as a person lies dying) moment of termination
એલુ	છેલુ	વિ	એવટુ	આખિરી, અતિમ	last
એલ્લે સરવાળે	છેલ્લે સરવાળે	અ	એવટે	આખિર	at last, in sum
એવટ	છેવટ	સ્ત્રી, ન અ	અત, છેડો અતે, છેડે	અત, સિરા અત મેં, આખિર	end lastly, finally
એવટે	છેવટે	અ	અતે, છેડે	અત મેં, આખિર	at last
એતાળીસ	છેતાલીસ	વિ	' ૪૬ ', એતાળીસ	છિયાલીસ, 46	forty-six, 46
એયાછોકરાં	છૈયાછોકરા	ન	છોકરાછૈયા, બાળકો, સતાન કે પરિવાર	બાલ-બચ્ચે	members of the family esp. children

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છેયુ	छैयु	ન	છોકરુ	बच्चा, बालक	child
છેયુછોકરુ	छैयुछोकरु	ન	સત્તાન, બાળક	सतान, बालक	child
છો	छो	સ્ત્રી	ચૂનાનો કેલ	कमाया हुआ चूना, गच	mortar, plaster of mortar
છોકરમત	छोकरमत	વિ સ્ત્રી	બાળક જેવી અલ્પ બુદ્ધિનુ કે ઉઠીલુ બાળક જેવી ઉઠ	बालक जैसी अल्प मति वाला या हठी बालक जैसी हठ	childish, obsti- nate obstinacy like that of a child
છોકરવાદ	छोकरवाद	વિ સ્ત્રી	થોડી અક્કલનુ, ઉછાછળુ, અવિવેકી તેવુ વર્તન	नासमझ, अविवेकी छोकरापन, नासमझी	childish, disre- spectful childish behav- iour
છોકરી	छोकरी	સ્ત્રી	1 સ્ત્રી જાતિનુ છોકરુ 2 કન્યા, દીકરી 3 (વ્યગ્રમા) નામર્દ	लडकी कन्या, बेटी (व्यग्न में) नामर्द	young girl daughter coward (ironic)
છોકરુ	छोकरु	ન	1 સત્તાન, બાળક 2 નાનો છોકરો કે છોકરી	बालक, सतान बच्चा या बच्ची	child young boy or girl
છોકરો	छोकरो	પુ	1 નરજાતિનુ છોકરુ 2 દીકરો	लडका बेटा, पुत्र	a boy a son
છોગુ	छोगु	ન	1 કલગીની જેમ ખોસેલો ઊડતો કે ઝૂલતો ફેટા- શાળિયાનો છેડો 2 પાઘડીમા ખોસેલો ફૂલનો તોરો	तुरी	crest, tassel in a cap or a turban
છોટુ	छोटु	વિ ન	નાનુ છોડિયુ	छोटा छिलका, चिप्पड	small, young splinter
છોડ	छोड	પુ ન	રોપો, છોડવો 1 સુકાઈને થયેલુ છોડુ	पौधा चिप्पड (सूखा), सूखा हुआ छिलका	plant dried up piece of bark. chip

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૨ સુકાઈ ગયેલો ગર્ભ	સૂકા હુઆ ગર્ભ	embryo arrested in growth
છોડવવુ	છોડવવુ	સ ક્રિ	બધનમાથી છુટુ કરાવવુ	છુડાના	to cause to be released
છોડવુ	છોડવુ	સ ક્રિ	૧ છૂટે એમ કરવુ ૨ તજવુ, ત્યાગ કરવો	છોડના ત્યાગના	to release, to set free to give up, to part with
છોડવો	છોડવો	પુ	છોડ, રોપો	પૌધા	plant sapling
છોડાવવુ	છોડાવવુ	સ ક્રિ	જુઓ 'છોડવવુ'	છુડાના	see 'છોડવવુ'
છોડિયુ	છોડિયુ	ન	૧ છાલ કે તેનો કકડો ૨ લાકડાનો પાતળો કકડો (મૂકરી)	છાલ યા ઉસકા ટુકડા છિલપટ, ચિપ્પડ	bark chip
છોડી	છોડી	સ્ત્રી	છોકરી	લડકી	girl, daughter (vulg)
છોડુ	છોડુ	ન	૧ જુઓ 'છોડિયુ' ૨ જુઓ 'છોતરુ'	દેખિઈ છોડિયુ દેખિઈ 'છોતરુ'	see 'છોડિયુ' see 'છોતરુ'
છોતરુ	છોતરુ	ન	છોડુ, ફોતરુ, પડ	છિલકા	bark, skin
છોતેર	છોતેર	વિ	' ૭૬ ', છોતેર	છિહત્તર, 76	seventy-six, 76
છોતેર	છોતેર	વિ	જુઓ 'છોતેર'	છિહત્તર	see 'છોતેર'
છો ને	છો ને	અ	ભલે ને	ભલે હી	let it be (as adv)
છોબધ	છોબધ	વિ	છોવાળુ	ફર્શ યા પલસ્તર વાલા	plastered
છોભાવુ	છોભાવુ	અ ક્રિ	છોભુ-ખસિયાણુ પડવુ	ખિસિયાના	to be non- plussed, to be dismayed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
छोभीलु	छोभीलु	वि	ખસિયાણુ, ઝખવાણુ, શરમિદુ	खिसियाना, लज्जित, झेंपा हुआ	non-plussed, dismayed
छोभु	छोभु	वि	જુઓ 'છોભીલુ'	देखिए 'छोभीलु'	see 'छोभीलु'
छोर	छोर	पु	છર, અસ્ત્રો	उस्तुरा, छुरा	razor
छोरी	छोरी	स्त्री	છોકરી, છોડી	लडकी	girl, daughter
छोरु	छोरु	न	છોકરુ	बच्चा, बालक, छोरा	child
छोरु	छोरु	न	જુઓ 'છોરુ'	छोरा, बालक	see 'छोरु'
छोरो	छोरो	पु	છોકરો	लडका	boy
छोल	छोल	पु, स्त्री	(લાકડાને) છોલવાથી પડતા છોલા, (ફળ, શાક ઇને) છોલતા પડે તે	छीलन, छिलके	skin of vegetable
छोलवु	छोलवु	स क्रि	1 ઉપર ઉપરથી ઊખેડવુ 2 (ફળની) છોલ કાઢવી 3 (લાકડુ) ઘડવુ 4 (વ્યગમા) અણઆવડતથી કે ખરાબ સાધનથી ઉજામત કરવી 5 સખત ઠપકો આપવો, ઝાટકવુ, છોડા ઠારવા	छीलना, खुरचना (फल का) छिलका उतारना खरादना, छीलना (लकड़ी) खूँटी लेना	to scrape, flay to peel (fruit) to cut away with adze to shave (ironic)
छोलाटवु	छोलाटवु	स क्रि	1 ખૂબ છોલ છોલ કરવુ 2 (લા) સખત ઠપકો આપવો	फटकारना, डौटना	to rebuke
				बहुत छीलना	to keep on scraping
				सखत फटकारना, डौटना	to give a strong rebuke

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
છોલાવુ	છોલાવુ	અ ક્રિ	'છોલાવુ' નુ કર્મણિ	છિલના	pass of છોલાવુ
છોલા	છોલા	ન	જુઓ 'છોડુ', છાલા	છિલકે	see 'છોડુ'
છોહ	છોહ	પુ.	1 જુઓ 'છેહ' 2 વિયોગ	દગા વિયોગ	see 'છેહ' separation
છોળ	છોઢ	સ્ત્રી	1 તરંગ, મોજુ 2 છલકાવુ તે, છાલક 3 (લા) પુષ્કળપણ	તરંગ, લહર છલક, છલકના બહુલતા, ઇફરાત, ભરમાર	wave splash abundance
છોતેર	છોતેર	વિ	'૭૬', છોતેર	છિહતર, 76	seventy six, 76
છયાશી	છયાશી	વિ	'૮૬', જુઓ છાસી'	છિયાસી, 86	eighty six, 86
છયાસી	છયાસી	વિ	જુઓ 'છયાશી'	છિયાસી	see 'છયાશી'
જ	જ	અ	વાક્યના પદ પાછળ આવતા તેને અંગે મહત્વ, અન-ચતા, નિશ્ચય, ખાતરી વગેરે બતાવે છે	જ	(indicates) surely, positively, etc
જઈફ	જઈફ	વિ	1 વૃદ્ધ 2 અશક્ત	વૃદ્ધ દુર્બલ	old feeble
જઈફી	જઈફી	સ્ત્રી	1 ઘડપણ 2 અશક્તિ	બુઢાપા દુર્બલતા	old age feebleness
જક	જક	સ્ત્રી	1 જીદ, હઠ 2 રકઝક, પચાત	જિદ, હઠ ઝકઝક, હુજ્જત	obstinacy wrangling
જકડ	જકડ	સ્ત્રી	જકડવુ તે, પકડ, સકળો	જકડ, પકડ	grip
જકડવુ	જકડવુ	સ ક્રિ	ખેચીને - ચસકે નહિ એમ સખત બાધવુ - પકડવુ	જકડના	to tighten, hold in grip
જકાત	જકાત	સ્ત્રી	નાકાવેરો, ઠાણ	ચુગી, આપાત કર	duty, customs duty

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જાકાતદાર	जकातदार	पु	જાકાત લેનારો અમલદાર, નાકાદાર	चुगी अधिकारी	a custom officer
જાકાતી	जकाती	वि	1 જાકાતનું —ને લગતું 2 જાકાતને પાત્ર	चुगी से संबंधित चुगी के योग्य	regarding customs duty liable to such duty
જાકિયુ	जकियु	वि	જાકકી, હઠીલુ	हठी, जिद्दी	obstinate
જાકકી	जककी	वि	જાકક ડરનારુ, જાકકિયુ	झककी, हठी, जिद्दी	obstinate
		न	એક પક્ષી	एक पक्षी	kind of bird
જખ	जख	स्त्री	માછલુ, પસતાવો	मछली पछतावा	fish repentance
જખ મારવી	जख मारवी	अ क्रि	પસતાવુ, વાકા રહીને ઠેકાણે આવવુ	पछताना	to pay for one's own deeds, to repent
જખમ	जखम	पु	ઘા	जखम, जख्म, घाव	wound
જખમી	जखमी	वि	જખમ થયો હોય એવુ, ઘાયલ	जखमी, जखमी, घायल	wounded
જખીરો	जखीरो	पु	જથો, સમૂહ	ढेर, जखीरा, समूह	bulk, collection
જગકર્તા	जगकर्ता	पु	જગતનો ડરનાર-ઇશ્વર	जगत्कर्ता, परमेश्वर	the creator of the world God
જગકર્તા	जगकर्ता	पु	જુઓ 'જગકર્તા'	देखिए 'जगकर्ता'	see જગકર્તા
જગજાહેર	जगजाहेर	वि	જગમા બધે જાણીતું	जगजाहिर, सर्वविदित	open, public
જગત	जगत	न	1 સૃષ્ટિ, વિશ્વ 2 દુનિયા, પૃથ્વી	सृष्टि, विश्व, जगत् दुनिया, जगत्, पृथ्वी	creation the universe world

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			३ (ला) लोडो, लोडमत	लोग, लोकमत	public at large, public opinion
जगतप्रसिद्ध	जगतप्रसिद्ध	वि	जुओ 'जगजालेर'	देखिए 'जगजालेर'	see 'जगजालेर'
जगती	जगती	स्त्री	१ जुओ 'जगत' २ अेड छे	देखिए 'जगत' एक छेद, जगती	see 'जगत' a kind of metre
जगत्पति	जगत्पति	पु	जगतनो स्वामी-परमेश्वर	जगत्पति, परमेश्वर	Lord of the universe, God
जगत्प्रसिद्ध	जगत्प्रसिद्ध	वि	जुओ 'जगजालेर'	देखिए 'जगजालेर'	see 'जगजालेर'
जगधु	जगधु	न	छेडरु	बच्चा	urchin, child
जगन	जगन	पु	१ जुओ 'यज्ञ' २ (ला) अति मुश्केल के मोटु काम	देखिए 'यज्ञ' मुश्किल या बड़ा काम	see 'यज्ञ' a difficult enterprise
जगप्रसिद्ध	जगप्रसिद्ध	वि	जुओ 'जगजालेर'	जगजाहिर, जगतप्रसिद्ध	see 'जगजालेर'
जगबत्रीशी	जगबत्रीशी	स्त्री	लोडवायड	अफवाह, किवदती	rumour
जगा	जगा	स्त्री	१ स्थण, ठेकार २ ખાલી જગા ३ નોકરી	स्थल, ठिकाना, जगह खाली जगह नौकरी	place, spot open space employment, job
जगाडवु	जगाडवु	स क्रि	'जगवु' नु प्रेरड	जगाना	caus of 'जगवु'
जगावु	जगावु	अ क्रि	'जगवु' नु उर्मीए	'जगवु' का कर्मणि रूप	pass of 'जगवु'
जगो	जगो	स्त्री	जुओ 'जगा'	देखिए 'जगा'	see 'जगा'
जगोजग	जगोजग	अ	ठेर ठेर, બધી જગાએ, સર્વત્ર	जगह-जगह, सर्वत्र	at all places, everywhere
जग्या	जग्या	स्त्री	जुओ 'जगा'	देखिए 'जगा'	see 'जगा'
जगन्य	जगन्य	वि	१ હલકુ, કનિષ્ઠ	नीच, ओछा	mean low

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 અતિમ, છેલ્લુ	અતિમ, सबसे पीछे का	extreme last
		પુ	શૂદ્ર	શૂદ્ર	a <i>shudra</i> (or of a low caste)
જજ	જજ	પુ	ન્યાયાધીશ	જજ, न्यायाधीश	judge
જજમાન	જજમાન	પુ	1 યજ્ઞ કરનાર	યજ્ઞ કરને વાલા	performer of a sacrifice
			2 ગોર કે બ્રાહ્મણને દક્ષિણા આપીને ધાર્મિકક્રિયા કરાવનાર	દક્ષિણા દેકર ધાર્મિક ક્રત્વ કરને વાલા, જજમાન	performer of a ritual by paying the priest
			3 આશ્રય આપનાર, દાતા	આશ્રય દેને વાલા, દાતા	one who offers patronage
જજમાનવૃત્તિ	જજમાનવૃત્તિ	સ્ત્રી	યજ્ઞમાનના દાનદક્ષિણા વડે આજીવિકા કરવી તે	જજમાનવૃત્તિ, જજમાની	one who earns one's living as a priest
જજમાની	જજમાની	સ્ત્રી	જજમાનવૃત્તિ	જજમાની	see 'જજમાનવૃત્તિ'
જજિયાવેરો	જજિયાવેરો	પુ	મુસલમાની શબ્દમાં મોટી ઊમરના (હૈકિયાવાળા) પરધર્મીઓ પાસેથી લેવાતો માથાવેરો	જજિયા	a tax levied during Muslim rule
જજિયો	જજિયો	પુ	જુઓ 'જજિયાવેરો	જજિયા	see 'જજિયાવેરો'
જટા	જટા	સ્ત્રી	1 બાવાઓ માથે રાખે છે તે કે તેવું કેશનું ઝુક	જટા	a knot of hair on top of the head worn by sadhus
			2 અવ્યવસ્થિત લાંબા વાળ	અવ્યવસ્થિત લંબે બાલ, જટા	matted hair
જટાજૂટ	જટાજૂટ	પુ	જટાનો ભારો	જટાજૂટ	abundant growth of hair (see જટા)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જટાધર	जटाधर	वि पु.	भाशे જટા હોય એવું 1 જોગી, તપસ્વી 2 શિવ	जिसके सिर पर जटा हो, जटाधारी जोगी, तपस्वी शिव	one who wears & 'જટા' ascetic Lord Shiva
જટાધારી	जटाधारी	वि, पु	જુઓ 'જટાધર'	देखिए 'जटाधर'	see 'जटाधर'
જટામાસી	जटामासी	स्त्री	એક વનસ્પતિ-ઔષધિ	एक वनस्पति- औषध	kind of medicinal herb
જટિયુ	जटियु	न	વાળની છૂટી કે ગૂંચવાયેલી લટ	जटा, झोंटा	tangled braid or hair
જટિલ	जटिल	वि पु	1 જટાવાળુ 2 ગૂંચવાયેલું, અટપટું તપસ્વી	जटाधारी उलझा हुआ, पेचीदा, जटिल तपस्वी	see 'जटाधर' tangled, complicated ascetic
જટિલતા	जटिलता	स्त्री	અટપટાપણ	पेचीदगी, जटिलता	complication
જડ	जड	वि स्त्री	1 જીવ વિનાનું 2 (લા) લાગણી, બુદ્ધિ કે સ્ફૂર્તિ વિનાનું 1 મુખ્ય મૂળિયું 2 ખીલી, મેખ 3 સ્ત્રીઓના નાકનું એક ઘરેણું	अचेतन, जड निर्बुद्धि, गतिरहित, जड जड, मूल कील, मेख स्त्रियों का नाक का एक गहना, लौंग, भोगली	non-sentient dull, callous, slack main root nail, rivet ornament worn by women nose-ring
જડજ	जडज	पु	ન્યાયાધીશ, જજ	न्यायाधीश, जज	judge
જડતર	जडतर	वि न	જડાવ કામનું, —ને લગતું જડવું તે, જડવાની રીત, જડાવકામ	जडाऊ पच्चीकारी, जडाई	pertaining to the art of setting joining, setting inlaying
જડતા	जडता	स्त्री	1 નિર્જીવપણું 2 લાગણીહીનતા	अचेतनता, जडता भावहीनता	non-sentience dullness, callousness

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જડત્વ	जडत्व	न	જુઓ 'જડતા'	जडता, जडत्व	see 'જડતા'
જડબુદ્ધિ	जडबुद्धि	वि	મદ બુદ્ધિનુ	मद बुद्धि वाला	slow-witted
જડબુ	जडबु	न	1 દાતવાળો મોના નીચેનો ભાગ 2 તે ભાગનુ છાડકુ, 'જા બોન'	जबडा उस की हड्डी	jaw jaw-bone
જડબેસલાક	जडबेसलाक	अ	સજજડ, મક્કમ	दढ	firmly rightly
જડબેસલાખ	जडबेसलाख	अ	જુઓ 'જડબેસલાક'	देखिए 'જડબેસલાક'	see 'જડબેસલાક'
જડભરત	जडभरत	वि	આગસમજુ, મૂર્ખ	नासमझ, मूर्ख	slow-witted foolish
		पु	એ નામનો એક યોગી	उस नाम का एक योगी	name of a character in Hindu mytho- logy
જડમૂળ	जडमूल	न	મુખ્ય મૂળિયુ	प्रधान मूल	main root
જડમૂળિયુ	जडमूलियु	न	જુઓ 'જડમૂળ'	देखिए 'જડમૂળ'	see 'જડમૂળ'
જડરૂપ	जडरूप	वि	જડ જેવુ, મૂર્ખ, ઠોઠ	जड जेसा, मूर्ख, बुद्ध	dull foolish
જડવાદ	जडवाद	पु	જગતનુ મૂળ જડ પદાર્થ છે, ચેતન નહિ એવો વાદ, 'મટિરિયાલિઝમ'	जडवाद, जगत का मूल जड तत्व है चेतन नहीं उस का प्रचार करने वाला दर्शन	materialism (philosophical term)
જડવાદી	जडवादी	वि	1 જડવાદનુ, -ને લગતુ 2 જડવાદમા માનનાર	जडवाद से सम्बद्ध, जडवाद का जडवाद में मानने वाला	pertaining to materialism see જડવાદ one who be- lieves in materi- alism (see 'જડવાદ')

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જાણ	जण	पु, न	पुरुष, व्यक्ति, आदमी	जन, व्यक्ति	person, individual
જાણવવું	जणववु	स क्रि	1 'जाणवु' नु प्रेरक 2 ખતાવવુ, દેખાડવુ	'जाणवु' का प्रेरणार्थक रूप बताना दिखाना	caus of 'जाणवु' to show, to exhibit
જાણવું	जणवु	स क्रि	(अर्थाने) જન્મ આપવો	जनना, जन्म देना	to give birth to a child
જાણસ	जणस	स्त्री, न	1 वस्तु, चीज 2 माल, सोदा 3 सिलक 4 धरेणु 5 अफीम	चीज माल, सोदा रोकड-बाकी गहना, जेवर अफीम	thing, article goods, merchandise asset ornament opium
જાણસભાવ	जणसभाव	स्त्री, न	દરદાગીનો, કીમતી સરસામાન	मूल्यवान सामान	ornaments etc valuables
જાણાવવું	जणाववु	स क्रि	જુઓ 'જાણવવું'	देखिए 'जाणववु'	see 'जाणववु'
જાણાવું	जणावु	अ क्रि	1 'જાણવુ', 'જાણવુ' નુ કર્મણ 2 દેખાવુ 3 બહાર પડવુ	'जाणवु', 'जाणवु' का कर्मणि रूप दिखाई देना बाहर आना	pass of 'जाणवु', 'जाणवु' to be seen or known to be made public
જાણી	जणी	स्त्री	સ્ત્રી-વ્યક્તિ	स्त्री-व्यक्ति	a woman
જાણુ	जणु	न	મનુષ્ય-વ્યક્તિ	मनुष्य-व्यक्ति, जन	individual, person
જાતન	जतन	न	સભાળ, સાચવણી	जतन, हिफाजत	preservation, care
જાતના	जतना	स्त्री	જુઓ 'જાતન'	जतन	see 'जातन'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જતરડુ	जतरडु	न	1 सोनाइपाना तार ખેચવાનુ એક સાધન 2 (લા) સકળો, ચુગલ	जता शिकजा, चुगल	a tool used by gold-smiths grip, hold
જતરડો	जतरडो	पु	જુઓ 'જતરડુ'	देखिए 'જતરડુ'	see 'જતરડુ'
જથા	जथा	अ	જેવી રીતે	यथा, जिस तरह, जैसे	like, as
જથાબધ	जथाबध	अ	છૂટક નહિ પણ એકસામટુ	थोक, फुटकर का उल्टा	whole-sale
જથાર્થ	जथार्थ	वि	યોગ્ય	योग्य	proper
જથો	जथो	पु	જૂથ, સમૂહ, સમુદાય	जत्था, जूथ, दल, समूह, समुदाय	bulk, quantity, collection
જદપિ	जदपि	अ	જો કે	यद्यपि	although, even if
જદા	जदा	अ	જે વખતે	जिस समय, यदा	when
જન	जन	पु	1 માણસ (એ વ મા સામાન્ય રીતે સમાસમાં) 2 જનતા, લોકોનો સમુદાય	जन, मनुष्य जनता, लोगों का समुदाय	person, man people, public, the world
જનક	जनक	वि पु	ઉત્પન્ન કરનાર, પેદા કરનાર (પ્રાય સમાસ ને અંતે) 1 બાપ 2 સીતાજીના પિતા	जन्म देने वाला, जनक पिता सीताजी के पिता का नाम	creator father name of Sita's father (Hindu mythology)
જનતા	जनता	स्त्री	બધા લોકોનો સમૂહ, આખો મનુષ્ય સમાજ	जनता, लोक	people or the world at large, a multitude of persons

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જનન	जनन	ન	ઉત્પન્ન કરવું તે, ઉત્પત્તિ, જન્મ	जनन, उत्पत्ति	birth
જનની	जननी	સ્ત્રી	જન્મ આપનારી-માતા	जननी, माता	one who gives birth, mother
જનપદ	जनपद	પુ, ન	દેશ	देश, जनपद	a country
જનભાષા	जनभाषा	સ્ત્રી	લોકભાષા	लोकभाषा	language of the common man (people)
જન્મ	जनम	પુ	1 જન્મ, અવતરવું તે 2 જન્મારો, જિંદગી	जनम, जन्म जिदगी, जीवनकाल	birth life-time
જન્મકુડળી	जनमकुडळी	સ્ત્રી	જન્મ વખતના ગ્રહસંયોગનો બરાબર કાળ લઈને બનાવેલું બાર રાશિવાળું ચક્ર, જન્માક્ષર	जन्मकुडली	horoscope
જન્મકેદ	जनमकेद	સ્ત્રી	જિંદગી સુધીની કેદ	उमरकैद, आजन्म कारावास	life-sentence
જન્મકેદી	जनमकेदी	વિ, પુ	જન્મકેદ થઈ હોય એવું (કેદી)	उमरकैदी, आजीवन बदी	prisoner for life
જન્મગાઠ	जनमगाठ	સ્ત્રી	વરસગાઠ, જન્મતિથિ	बरसगाँठ, सालगिरह	birth-date
જન્મટીપ	जनमटीप	સ્ત્રી	જન્મકેદ	उमरकैद	see 'જન્મકેદ'
જન્મભોમકા	जनमभोमका	સ્ત્રી	જન્મભૂમિ	जन्मभूमि	mother-land
જન્મવું	जनमवुं	અ ક્રિ	જન્મવું, પેદા થવું	जन्म लेना, जनमना	to be born
જન્મારો	जनमारो	પુ	જન્મથી મરણ લગીનો કાળ, આખી જિંદગી, ભવ	पूरी जिदगी	for life-time whole of life

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જનમોજનમ	जनमोजनम	अ	દરેક જન્મે, જનમોજનમ	हर एक जन्म में	in each birth
જનમોતરી	जनमोतरी	स्त्री	જન્મ પછી ઉતરોત્તર બનારા બનાવ ને લાભલાન જગાવતી જન્મકુડળી ઉપરથી જોધીએ બનાવેલી પત્રિકા	जन्मपत्री	horoscope
જનમોત્રી	जनमोत्री	स्त्री	જુઓ 'જનમોતરી	जन्मपत्री	see 'જનમોતરી'
જનશ્રુતિ	जनश्रुति	स्त्री	અફવા	अफवाह, जनश्रुति	rumour
જનસમાજ	जनसमाज	पु	જનતા, જનસમૂહ	जनता, जनसमाज	see 'જનતા'
જનસમુદાય	जनसमुदाय	पु	લોકોનો સમૂહ	जनसमूह, जनसमुदाय	multitude or assembly of men
જનસમૂહ	जनसमूह	पु	જુઓ 'જનસમુદાય'	जनसमूह	see 'જનસમુદાય'
જનહિત	जनहित	न	લોકોનો હિત	लोकहित	welfare of the people
જનહિતકારી	जनहितकारी	वि	જનહિત કરનારુ	लोकहितकारी	that which is for the welfare of men
જના	जना	स्त्री	વ્યભિચાર, દિનાળુ	व्यभिचार, जिना, जना	adultery
જનાકારી	जनाकारी	स्त्री	જુઓ 'જના'	देखिए 'जना'	see 'જના'
જનાજો	जनाजो	पु	1 મુસલમાનોમા મડદુ દાટવા લઈ જવાની ખાટલી 2 એની પાછળ જનારુ સરથસ	अरथी, जनाजा जनाजे के पीछे जाने वाला जुलूस	bier funeral procession
જનાનખાનુ	जनानखानु	न	અત.પુર, રાગવાસ	जनानखाना, अत पुर	harem

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જનાનો	जनानो	પુ	ઓઝલમા રહેનારો સ્ત્રી-સમુદાય કે તેનું જનાનખાનું	जनाना, अतपुर मे रहने वाला नारी समुदाय या अतपुर	women in a harem, zanana
જનાબ	जनाब	વિ.	મહેરબાન, ડ્રપાળુ (સબોદન કે શ્રી પેઠે નામ પૂર્વે આદર તરીકે)	जनाब, श्रीमान	'sir' (as a mode of address)
જનાબેઆલી	जनाबेआली	વિ	મોટા મહેરબાન, પરમ ડ્રપાળુ	जनाबेआली	person honoured by God
જનાવર	जनावर	ન	જુઓ 'જાનવર', પશુ	देखिए 'जानवर', पशु	see 'जानवर', पशु
જનેતા	जनेता	સ્ત્રી	જન્મ આપનારી-મા	जननी, माता	mother
જનોઈ	जनोंई	સ્ત્રી, ન	ઉપવીત, યજ્ઞોપવીત	जनेऊ, यज्ञोपवीत	sacred thread
જનોપયોગી	जनोपयोगी	વિ	લોકોપયોગી	लोकोपयोगी, जनोपयोगी	for the welfare of men
જન્નત	जन्नत	ન	સ્વર્ગ, (જન્નત)	जन्नत, स्वर्ग	paradise
જન્મ	जन्म	પુ	1 જન્મવુ-પેદા થવું તે 2 જન્મમારો	जन्म जिदगी, जीवन	birth life
જન્મકુડલી	जन्मकुडली	સ્ત્રી	જુઓ 'જન્મકુડલી'	जन्मकुडली	see 'जन्मकुडली'
જન્મકેદ	जन्मकेद	સ્ત્રી	જુઓ 'જન્મકેદ'	उमरकेद	see 'जन्मकेद'
જન્મકેદી	जन्मकेदी	વિ, પુ	જુઓ 'જન્મકેદી'	उमरकेदी	see 'जन्मकेदी'
જન્મગાઠ	जन्मगाठ	સ્ત્રી	જુઓ 'જન્મગાઠ'	बरसगाँठ, जन्मतिथि	see 'जन्मगाठ'
જન્મચરિત્ર	जन्मचरित्र	ન	જીવનચરિત્ર	जीवनचरित्र	biography
જન્મટીપ	जन्मटीप	સ્ત્રી	જુઓ 'જન્મટીપ'	उमरकेद	see 'जन्मटीप'
જન્મતિથિ	जन्मतिथि	સ્ત્રી	જન્મનો દિવસ, જન્મગાઠ	जन्मतिथि, बरसगाँठ	birth-date
જન્મદિવસ	जन्मदिवस	પુ	જુઓ 'જન્મતિથિ'	जन्मदिवस, जन्मदिन	see 'जन्मतिथि'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જન્મનક્ષત્ર	जन्मनक्षत्र	न	જે નક્ષત્રમાં જન્મ હોય તે	जन्मनक्षत्र	a natal star
જન્મપત્રિકા	जन्मपत्रिका	स्त्री	જન્મોત્તરી	जन्मपत्रिका, जायचा	horoscope
જન્મપત્રી	जन्मपत्री	स्त्री	જુઓ 'જન્મપત્રિકા'	देखिए 'जन्मपत्रिका'	see 'जन्मपत्रिका'
જન્મભૂમિ	जन्मभूमि	स्त्री	જ્યા જન્મ થયો હોય તે સ્થાન કે દેશ, માતૃભૂમિ	जन्मभूमि, जन्मस्थान	mother-land, birth-place
જન્મવુ	जन्मवु	अ क्रि	જુઓ 'જન્મવુ'	जनमना, जन्म लेना	see 'जन्मवु'
જન્મસિદ્ધ	जन्मसिद्ध	वि	જન્મથી જ પ્રાપ્ત થયેલુ - મળેલુ	पैदाइशी, जन्मसिद्ध	granted at birth
જન્માક્ષર	जन्माक्षर	पु	જુઓ 'જન્મકુડળી'	जन्मकुडली	see 'जन्मकुडली'
જન્મારો	जन्मारो	पु	જુઓ 'જન્મારો'	जिदगी, जीवन	see 'जन्मारो'
જન્મોજન્મ	जन्मोजन्म	अ	જુઓ 'જન્મોજન્મ'	हर एक जन्म में	see 'जन्मोजन्म'
જન્મોત્રી	जन्मोत्री	स्त्री	જુઓ 'જન્મોત્રી'	जन्मपत्रिका, जायचा	see 'जन्मोत्री'
જપ	जप	पु	નામ, મંત્ર ઇત્યાદિનુ રટન	जप	repeating prayers, <i>mantra</i> etc
જપત	जपत	वि	1 જપ્ત, ગુનાસર દસરૂપે સરકારે કબજે કરેલુ 2 માગતા પેટે કબજે લીધેલુ	जब्त जब्तशुदा, कब्जे लिया हुआ	confiscated attached, seized in lieu of debt
જપતી	जपती	स्त्री	1 જપ્તી, ગુનાના દસરૂપે સરકારે કે માગતા પેટે કોઈએ લીધેલો કબજો	गुनाह के दड के रूप में कब्जा लेना	seizure

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 ટાચ	कुर्की	attachment
જપવુ	जपवु	સ ક્રિ	જપ કરવો, રટવુ	जपना, रटना	to repeat, to mutter
જબરજસ્ત	जबरजस्त	વિ	જોરાવર, જબરુ	जबरदस्त, बलवान	mighty
જબરજસ્તી	जबरजस्ती	સ્ત્રી	બળાત્કાર, જુલમ	जबरदस्तो, जुल्म, ज्यादती	violence, force
જબરું	जबरु	વિ	1 જબર, જોરાવર, બળવાન 2 (લા) મુશ્કેલ	बलवान, ताकतवर, शक्तिशाली मुश्किल	strong, powerful difficult
જબાન	जबान	સ્ત્રી	1 જીભ 2 બોલી, ભાષા	जीभ, जबान बोली, भाषा	tongue language
જખર	जखर	વિ	જુઓ 'જખરુ'	देखिए 'जखरु'	see 'जखरु'
જમ	जम	પુ	જુઓ 'યમ'	जम, यम	see 'यम'
જમડો	जमडो	પુ	જમ, જમદૂત	यम, यमदूत	Lord of death, Yama
જમણ	जमण	ન	1 જમવુ તે, ભોજન 2 નાતવારો	भोजन, खाना जाति-भोज	meal, dinner caste- dinner
જમણવાર	जमणवार	પુ, સ્ત્રી	1 નાતવારો 2 એનો દિવસ	जाति-भोज, जेवनार उसकी तिथि	see 'जमण' day of caste-dinner
જમણ	जमणु	વિ	પૂર્વાભિમુખ થતા દક્ષિણ તરફનું	दाहिना	right
જમદડ	जमदड	પુ	યમદડ	यमदड	same as 'यमदड'
જમદૂત	जमदूत	પુ	યમદૂત	यमदूत	same as 'यमदूत'
જમપુરી	जमपुरी	સ્ત્રી	જમરાજાનું નગર	यमपुरी, यमलोक	city of the Lord of- Death
જમરૂખ	जमरूख	ન	જામરૂખ	अमरूद	kind of fruit, guava

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જમરૂખડી	जमरूखडी	સ્ત્રી	જમરૂખનુ ઝાડ	अमरूद का पेड	tree of 'જમરૂખ'
જમવુ	जमवु	સ ક્રિ	1 ભોજન કરવુ, ખાવુ 2 (લા.) લાભવુ, ખાટવુ (વ્યગમા)	खाना, भोजन करना लाभ होना, खटना, कमाना	to eat, to take one's meal to stand to benefit
જમા	जमा	વિ	1 એકઠુ થયેલુ, એકઠુ 2 જમા બાજુનુ	इकट्ठा हुआ, जमा जमा खाते का	accumulated, collected on the credit side
		સ્ત્રી	1 આવક, ઉપજ, વસૂલ 2 સરવાળો, જુમલો	आमदनी, जमा, प्राप्ति जोड	income sum, total
જમાઈ	जमाई	પુ	દીકરીનો વર	जवाई, दामाद	son-in-law
જમાઉધાર	जमाउधार	ન	જમા અને ઉધાર, આવક-જાવકનો હિસાબ	जमा और खर्च, जमा-खर्च	credit and debit
જમાખરચ	जमाखरच	પુ, ન	ઉપજ અને ખર્ચ	आय और खर्च, जमा-खर्च	income and expenditure
જમાખર્ચ	जमाखर्च	પુ, ન	જુઓ 'જમાખરચ'	देखिए 'जमाखर्च'	see 'જમાખરચ'
જમાડવુ	जमाडवु	સ ક્રિ	'જમવુ'નુ પ્રેરક રૂપ	भोजन कराना	caus of 'જમવુ'
જમાત	जमात	સ્ત્રી	1 (એક નાતના કે પથના લોકોનો) સમુદાય, સમૂહ 2 બાવાઓનો સમૂહ	जमात, समूह नगे साधुओं का समूह, जमात	community congregation (esp of sadhus)
જમાદાર	जमादार	પુ	1 સિપાઈઓની નાની ટુકડીનો ઉપરી 2 (લા.) ઉપરીપાણુ કે પ્રભાવ દાખવે એવુ માણસ (કટાક્ષમા)	जमादार प्रभावशाली व्यक्ति	head of a small body of sepoy leader or superior (ironic)

गुजराती शब्द	द्वन्नागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જામાદારી	जमादारी	स्त्री	જામાદારનું કામ-પદ	जमादारी	post or work of a 'जमादार'
જામાન	जमान	पु.	જુઓ 'જામીન'	जमानत, जमानतदार	see 'जामीन'
જામાનખત	जमानखत	न	જુઓ 'જામીનખત'	जमानतनामा	see 'जामीनखत'
જામાનાજૂનુ	जमानाजूनु	वि	જામાનાઓથી ચાલતુ આવેલુ, પ્રાચીન	प्राचीन, बहुत पुराना	very old, ancient
જામાનાનુ ખાધેલુ	जमानानु खाधेलु	वि	પહોચેલ, અનુભવી, પાકુ	जमाना देखा हुआ, अनुभवी	seasoned, mature
જામાની	जमानी	स्त्री	જુઓ 'જામીનગરી'	जमानत	see 'जामीनगरी'
જામાનો	जमानो	पु.	1 યુગ, લાંબો સમય 2 દેશકાળની, આચારવિચારની અમુક સ્થિતિ કે તેનો સમય	जमाना, बहुत समय, युग देशकाल या आचरण की परिस्थिति और उस का समय	period, long time an age
જામાનોંધ	जमानोंध	स्त्री	ખરીદનો માલ નોંધવાનો ચોપડો	खरीद का माल नोट करने की बही	record of things which have been purchased
જામાપાસુ	जमापासु	न	ચોપડામા (ડાબુ) પાસુ જ્યાં જમા રકમ લખાય છે	बही में जमा का हिस्सा	credit side of an account
જામાબદી	जमाबदी	स्त्री	જમીન માપી જાત વગેરે તપાસી કરીને તેનું સરકારી ભરત આકારવું તે, 'લેન્ડ રેવન્યુ-સેટલમેન્ટ'	जमाबदी, बंदोबस्त	land-revenue settlement
જામાબધી	जमाबधी	स्त्री	જુઓ 'જામાબદી'	जमाबदी, बंदोबस्त	see 'जमाबदी'
જામાબાજુ	जमाबाजु	स्त्री	જુઓ 'જામાપાસુ'	देखिए 'जमापासु'	see 'जमापासु'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જમાબાજૂ	जमाबाजू	સ્ત્રી	જુઓ 'જમાપાસુ'	देखिए 'जमापासु'	see 'जमापासु'
જમાવવુ	जमाववु	સ ક્રિ	'જમાવુ' નુ પ્રેરક રૂપ	जमाना	caus of 'जमावु'
જમાવસૂલ	जमावसूल	સ્ત્રી, ન	મહેસૂલની ઊપજ	लगान	revenue of a state
જમાવણી	जमावही	સ્ત્રી	જમાનેધ	देखिए 'जमानेध'	record of credit
જમીન	जमीन	સ્ત્રી	1 ભોય 2 ખેતર તરીકે વપરાય તેવી જમીન 3 ઘા રુઝાવાથી આવતી નવી ચામડી	जमीन, भूमि खेती की जमीन, खेत खुरद	land, ground tillable land new skin
જમીનદાર	जमीनदार	વિ પુ	જમીનની માલિકીવાળો જમીનનો માલિક	जमीन की मालिकी रखनेवाला जमीन का मालिक, जमींदार	land-owner man of the landed gentry, zamīdan
જમીનની	जमीनदारी	વિ સ્ત્રી	જમીનદારનું, - ને લગતું જમીનદારપણું	जमीनदार का, जमींदार संबंधित जमींदारपना	pertaining to, of a 'जमीनदार' status of a 'जमीनदार'
જમીનદોસ્ત	जमीनदोस्त	વિ	(ભાગીતોડી) જમીનસરસુ કચેલું, પાયમાલ	नष्ट, तहसनहस	completely destroyed, razed to the ground
જમે	जमे	વિ	જુઓ 'જમા'	देखिए 'जमा'	see 'जमा'
જમૈયો	जमैयो	પુ	કટાર જેવું એક હથિયાર	खुखरी	dagger
જય	जय	પુ, સ્ત્રી	જીત, ક્ષેત્ર	जय, फतह	victory, success
જયઘોષણ	जयघोषणा	સ્ત્રી	જુઓ 'જયઘોષ'	जयध्वनि, जयघोष	see 'जयघोष'
જયજય	जयजय	પુ	જયજયકાર	जयजयकार, जयध्वनि	shout of triumph

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
		अ	જે જે (કોઈને સામા મળતા કે છૂટા પડતા બોલાતો શબ્દ)	जयजय	mode of greeting
જયજયકાર	जयजयकार	पु	જીતની ખુશાલીનો પોકાર	जयप्राप्ति की पुकार, जयजयकार	see 'જયજય'
જયજયવતી	जयजयवती	સ્ત્રી	એક રાગિણી, જેજેવતી	जयजयवती	a mode or raga in music
જયશ્રી	जयश्री	पु, स्त्री	1 વિજયની દેવી 2 એક રાગિણી	विजय की देवी, जयश्री एक रागिणी	goddess of triumph mode or raga in music
જયતી	जयती	સ્ત્રી	1 મહાન વ્યક્તિનો જન્મદિવસ 2 વિજયનો વાવટો	महान व्यक्ति की बरसगाँठ का उत्सव, जयती विजय पताका, जयती	birth anniversary of a great man flag of victory
જયી	जयी	वि	જય મેળવનાર, વિજયી	जयी	victorious
જર	जर	સ્ત્રી	1 ઓર, મેલી 2 જખો	ऑवल, जरायु जोंक	placenta leech
		वि	જીર્ણ, જર્જર	जीर्ण, जर्जरित	old, decrepit
		पु	1 પૈસો, નાણુ, સોનુ 2 કસબ (સોના-રૂપાના તાર) કે કસબનુ વણતર	जर, धन, सोना जरतार	wealth, gold brocade
જરકસ	जरकस	पु	સોનારૂપાનો તાર, કસબ	कलाबत्तू, सोना या चादी का तार	gold or silver thread
જરકસી	जरकसी	वि	કસબી, કસબના ભરતવાળુ	जरकश, कलाबतूनी	worked with gold or silver thread
જરખ	जरख	न	ઝરખ, એક જગલી પ્રાણી, ઘોરખોદિયો, તરસ	लकडबग्घा	kind of animal, hyena

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જરજોખમ	जरजोखम	न	पैसा वगैरे ज़ोखमनी वस्तुओ	पैसा आदि जोखिम वाली चीजें	valuables
જરઠ	जरठ	वि	1 वृद्ध, धरु 2 कठोर	बूढ़ा कठिन	old, wizened hard, stiff
જરદ	जरद	वि	पीणु, आणुपीणु	जर्द, हल्का पीला	yellow, faded
જરદાલુ	जरदालु	न	अेक सूझे मेवो, आलू	जरदालू, खूबानी	plum
જરદાલુ	जरदालु	न	जुओ 'जरदालु'	जरदालू	see 'जरदालु'
જરદી	जरदी	स्त्री	पीणो पदार्थ	जरदी	yellow substance
જરદો	जरदो	प	तमाकुनो लुओ	जरदा	tobacco for chewing
જરદોજ	जरदोज	पु	कसय भरनारो	जरदोज, जरकश	worker in gold thread
જરદોજી	जरदोजी	स्त्री	कसय भरवानु कम-विद्या, कसय भरतकाम	जरदोजी	art of embroidery
જરવુ	जरवु	अ क्रि	1 છર્ણ થવુ, ઘસાઈ જવુ 2 પચવુ, હજમ થવુ 3 પાખુ કે છૂટુ થવુ	जीर्ण होना, जर्जरित होना, घिसना हजम होना अलग या झिलमिला होना	to be worn to be digested to be scattered or torn apart
જરા	जरा	स्त्री अ	1 वृद्धावस्था 2 सापनी कायणी लगार, थोडु	वृद्धावस्था, जरा साँप की केंचुली जरा, थोडा	old age snake's skin slight, a little
જરાક	जराक	वि, अ	थोडु, लगार	जरा-सा, थोडा-सा	slight, a little
જરાયત	जरायत	वि	वसना पानीशी थतु (पेती के पाक माटे)	वर्षा के पानी से होने वाला खरीफ (फसल)	watered only by the rain (of soil)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
जरियान	जरियान	वि	जरीनु, डसणी	जरी का, कलाबतूनी	of brocade
		न	सोनाडुपाना धरेण	सोना-चौदी के गहने	gold and silver ornaments
जरी	जरी	स्त्री	डसण, डसणी माल	जरी, कलाबतू, जरी का माल	embroidery, brocade
		वि	डसण साथे पड़ेनु, डसणी	जरकश, जरबफ्त	worked with gold or silver thread
		वि, अ	थोडु, लगार	थोडा, जरा	slight, a little
जरीक	जरीक	वि, अ	सडेण, थोडुड	थोडा सा	slight, a little
जरीकाम	जरीकाम	न	डसणी भरतकाम	जरी का काम, कसीदा	silver thread
जरीपुराण	जरीपुराण	वि	जूनू, झटीतूटी गयेनु, धागु जूनू	विशेष पुराना, टूटा-फूटा	very old and worn out
जरुणो	जरुखो	पु	जुओ 'जरुणो'	देखिए 'जरुणो'	see 'जरुणो'
जरुत	जरुत	स्त्री अ	जुओ 'जरुत' अवश्य, नक़ी, अलभत	जरुत, आवश्यकता अवश्य, जरुत, बेशक	see 'जरुत' certainly, of course
जरुत	जरुत	स्त्री	अगत्य, आपश्यता, गरुण, डारुत	जरुत, आवश्यकता, गरज	necessity, want, acute need
जरुशियात	जरुरियात	स्त्री	जुओ 'जरुत'	जरुत	see 'जरुत'
जरुरी	जरुरी	वि	जरुनु, अगत्यनु	जरुरी, आवश्यक	necessary
जरुणर	जरुजर	अ	जरुपाण छोड्या वगर, बधु ज, रणेरुण	सारा, पूरा	every bit, completely
जरुणर	जरुजर	वि	एण शड गयेनु	जरुजर, जरुजरित	worn out
जरुणरुत	जरुजरित	वि	जुओ 'जरुणर'	जरुजरित	see 'जरुणर'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જલદ	जलद	वि	ઊગ્ર, આકરુ, તેજ	तेज, सख्त, कडा	strong, sharp
જલદી	जलदी	स्त्री	ઊતાવળ, ત્વરા	जल्दी, त्वरा, उतावली	hurry
		अ	ઊતાવળથી, ઝટ, સત્વર	झटपट, शीघ्र, जल्द	quickly
જલસો	जलसो	पु	1 આનંદ યા ઉત્સવનો મેળાવડો 2 સંગીતનો મેળાવડો	जलसा संगीत का जलसा	festive occasion musical concert
જલેબી	जलेबी	स्त्री	એક મીઠાઈ	जलेबी	a sweet dish
જલ્લાદ	जल्लाद	पु	1 ગરદન મારનાર, શિરચ્છેદ કરનાર 2 કસાઈ	जल्लाद, वधिक, हत्यारा कसाई	executioner butcher
જવખાર	जवखार	पु	જવનો ખાર-ક્ષાર	जवाखार	carbonate of potash
જવનિકા	जवनिका	स्त्री	પડદો, ચક્ર	पर्दा, चिक, यवनिका	curtain, partition
જવની	जवनी	स्त्री	જુઓ 'જવનિકા'	देखिए 'जवनी'	see 'जवनिका'
જવરઅવર	जवरअवर	स्त्री	વારવાર જવુ આવવુ તે, અવરજવર	आवन-जावन, बारबार आना-जाना	going and coming
જવલ્લુ	जवल्लु	वि	કોઈક જ, વિરલુ	कोई ही, विरला	rare
જવલ્લે	जवल्ले	अ	કવચિત્, ભાગ્યે	क्वचित्, शायद	rarely
જવવુ	जववु	अ क्रि	1 (ફળ માટે) બેસવુ, ફળ થવુ, ઉત્પન્ન થવુ 2 (ફળ કે કશામા) જીવ પડવા	लगना, फलना, उत्पन्न होना कीडा पडना (फलादि मे)	to be full grown, ripe to be worm eaten
જવાન	जवान	वि	જુઓ 'જુવાન'	देखिए 'जुवान'	see 'जुवान'
જવાની	जवानी	स्त्री	જુવાની	देखिए 'जुवानी'	see 'जुवानी'
જવાબ	जवाब	पु	ઉત્તર	जवाब, उत्तर	answer

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જવાબી	जवाबी	વિ	1 જેનો જવાબ માગેલો હોય એવું 2 જેના જવાબનું ખર્ચ ભરેલું હોય એવું	जवाबी जवाबी (खतादि)	that which has asked for a reply the reply for which has been paid for in advance
જવારણ	जवारण	ન	મેળવણ	जामन	dash of curd or lime put in milk to curdle it
જવારવું	जवारवु	સ ક્રિ	આખરવું	जमाना (दूध)	to curdle (milk)
જવારા	जवारा	પુ	જવ વગેરેના નાના-તાજા ઊગેલા અકુરો	जवारा, जरई	tender plants of corn grown as an auspicious sign
જવાવું	जवावु	અ ક્રિ	જવાની ક્રિયા થવી, 'જવું'નું ભાવે	जाना	act of going
જવાસો	जवासो	પુ	એક વનસ્પતિ	जवास, जवासा	kind of vegeta- tion
જવાહિર	जवाहिर	ન	હીરામાણેક વગેરે ઝવેરાત	जवाहिर, जौहर	diamonds, pearls and other precious stones
જવામર્દ	जवामर्द	પુ	બહાદુર, વીર	बहादुर, वीर	brave, hero
જવામર્દી	जवामर्दी	સ્ત્રી	જવામર્દપણ, વીરતા	बहादुरी, वीरता	gallantry, bravery
જવું	जवु	અ ક્રિ	1 ગતિ કરવી, ખસવું 2 પાસેથી ખસવું, ઓછું થવું 3 ઘટવું, નુકસાન થવું, નાશ પામવું 4 વીતવું, પસાર થવું	जाना, खिसकना कम होना, हाथ से निकल जाना घटना, नुकसान या नाश होना बीतना, पसार होना	to go, to move to reduce, de- crease to suffer loss, to diminish to pass

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જશ	जश	पु	शक्ति	यश, कीर्ति	reputation
જસ	जस	पु	शुभो 'जश'	यश, कीर्ति	see 'जश'
જહનનમ	जहन्नम	न	नरक, दीर्घ	जहन्नम, नरक, जहन्नम	hell
જહાજ	जहाज	न	मोटु वहाज	जहाज, जलयान	large ship or vessel
જહાજી	जहाजी	पु	जहाज चलावनासे	जहाजी, जहाजरान	helmsman of ship
		वि	जहाजनु, -ने लगतु	जहाज का, जहाजी	pertaining to a ship
જહાન	जहान	स्त्री	जहा, दुनिया, आलम	जहाँ, दुनिया, जहान, आलम	world
જહાનમ	जहानम	न	नरक	जहन्नम, नरक	hell
જહાલ	जहाल	वि	उद्दाम, आडगु	उद्दाम	extremist, hawkish
જહા	जहा	स्त्री	दुनिया, जहान	जहाँ, दुनिया	see 'जहान'
જહાપના	जहापना	वि, पु	जगतनु रक्षासे करना (बादशाह)	जहाँपनाह	emperor, badshah
જહાપનાહ	जहापनाह	वि, पु	शुभो 'जहापना'	जहाँपनाह	see 'जहापना'
જહી	जहीं	अ	ज्या, जे ठेकारे	जहाँ, जिस जगह	where, at which place
જહેજ	जहेज	न	कन्यादान करवु ते	कन्यादान करना	ceremony of giving one's daughter in marriage
જહેમત	जहेमत	स्त्री	महेमत, श्रम	श्रम, मेहनत, परिश्रम	hard work
જળ	जळ	न	पाणी	जल, पानी	water

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જળકમળ	जळकमळ	ન	જલકમલ, કમલ	जलकमल	lotus
જળકૂકડી	जळकूकडी	સ્ત્રી	એક જળચર પક્ષી	एक जल पक्षी	kind of water fowl
જળક્રીડા	जळक्रीडा	સ્ત્રી	પાણીમાં ખેલવું તે	जलक्रीडा	play in water
જળઘોડો	जळघोडो	પુ	એક પ્રાણી, 'હિપ્પોપોટેમસ'	'हिपोपोटेमस'	hippopotamus
જળજળવું	जळजळवु	અ ક્રિ	બળવું, બળતરા થવી	जलना, जलन होना	to have a burning sensation
જળજળુ	जळजळु	વિ	આસુથી ભરાયેલું (નોંચના)	डबडबाया हुआ (आँख)	to be filled with tears (of eyes)
જળપ્રપાત	जळप्रपात	પુ	પાણીનો ધોધ	जलप्रपात	water-fall
જળપ્રલય	जळप्रलय	પુ	ભારે વરસાદ કે પૂરથી નાશ થવો તે	जलप्रलय	deluge, inundation
જળપ્રવાસ	जळप्रवास	પુ	જળ ઉપર-વહાણમાં કરેલી મુસાફરી	जहाजी यात्रा	voyage
જળબબાકાર	जळबबाकार	વિ	જલબબાકાર, જલમય	जलमय	huge flood
જળબિલાડી	जळबिलाडी	સ્ત્રી	એક જળચર પ્રાણી	जलबिडाल, ऊदबिलाव	an otter
જળમય	जळमय	વિ	બધે પાણી પાણી થઈ ગયું હોય એવું	जलमय	to be flooded
જળમાર્ગ	जळमार्ग	પુ	1 જળ ઉપર-વહાણમાં બેસીને જવાનો રસ્તો 2 નહેર, વહેળો	जलमार्ग नहर, स्रोत	water course canal
જળચત્ર	जळयत्र	ન	1 જળના જોરથી ચાલતું ચત્ર 2 ફુવારો 3 ચેટ	जलयत्र फुहारा रहट	water engine fountain or spout water-mill

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જળયાત્રા	जळयात्रा	स्त्री	1 જળપ્રવાસ 2 એક તહેવાર, જ્યારે ઠાકોરજીને જલવિહાર કરાવવામાં આવે છે	जलयात्रा एक वैष्णव उत्सव, जलयात्रा	voyage a Hindu festival
જળયાન	जळयान	न	જળ પર જવાનું વાહન, વહાણ, મછવો	जलयान, जहाज	ship, boat
જળવાવવું	जळवाववु	स क्रि	'જળવવું' નું પ્રેરક	'જળવવું' का प्रेरणार्थक रूप	caus of 'જળવવું'
જળવાવું	जळवावु	अ क्रि	'જળવવું' નું કર્મણિ	'જળવવું' का कर्मणि रूप	pass of 'જળવવું'
જળવું	जळवु	अ क्रि	બળવું, સળગવું	जलना, सुलगना	to burn, to catch fire
જળશાયી	जळशायी	वि	પાણીમાં શયન કરનાર-ડૂબી જનાર	जलशायी, पानी में डूबने वाला	lying in water (for a drowned man)
જળસમાધિ	जळसमाधि	स्त्री	પાણીમાં કરેલો પ્રાણત્યાગ	जलसमाधि (प्राणत्याग)	suicide or death willingly accepted by drowning oneself
જળસમાધિ	जळसमाधि	स्त्री	જુઓ 'જળસમાધિ'	जलसमाधि	suicide or death willingly accepted by drowning oneself
જળદર	जळदर	न	એક ઉદરરોગ	जलोदर	a kind of disease affecting the abdomen, dropsy

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या को.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જળધર	जळधर	न	જુઓ 'જળધર'	जलोदर	see 'जलधर'
જળાઉ	जळाउ	वि	બાળવાના ડામનુ (લાકડુ)	जलाने की लकड़ी	wood used for fuel
જળાગાર	जळागार	न	પાણીનો ઢોજ, ટાંકી	जलागार	reservoir, tank
જળાપો	जळापो	पु	બળાપો, ઢઢાપો	जलापा, डाह की जलन	burning, grouse
જળાશય	जळाशय	न	કૂવો, તળાવ વગેરે પાણીનુ સ્થાળ	जलाशय	reservoir
જળો	जळो	स्त्री	પાણીમા રહેતો એક જીવડો	जोंक	leech
જળોદર	जळोदर	न	જુઓ 'જલોદર'	जलोदर	see 'जलधर'
જગમ	जगम	वि	એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવુ	जगम	moveable (of property)
જગલ	जगल	न	વન	जगल, वन	forest, wood
જગલિયત	जगलियत	स्त्री	જગલીપણ	जगलीपना	barbarism
જગલી	जगली	वि	1 જગલનુ, રાની 2 ખેડયા વિના ઊગેલુ 3 (લા) સુધારો, સસ્કાર કે વિવેક વિનાનુ	जगली, वन्य बिना जोत का, जगली असभ्य, उजड़्ड, जगली	pertaining to a forest of the nature of a wild growth wild, uncultured
જગાલ	जगाल	पु	તાબાનો ડાટ	ताँबे का कसाव, हरा जग	green rust
જગાલી	जगाली	वि	જગાલનુ, —ને લગતુ	जगारी, जगाली	of or regarding green rust
જગી	जगी	वि	1 જગ-લડાઈને લગતુ 2 (લા) મોટુ, જખરુ	जगी (युद्ध) विशालकाय, बड़े डील-डौल का, जगी	relating to war large, very big

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या- को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જગોડી	जगोडी	સ્ત્રી	નાનો 'જગોડો'	छाटी किलनी	small 'જગોડો'
જગોડો	जगोडो	પુ	જુઓ 'જિગોડો'	किलनी	see જિગોડો
જગાર	जजार	સ્ત્રી	એક જાતની નાની તોપ, જખૂરો	जजाल (तोप)	small piece of cannon
જગાલ	जजाल	સ્ત્રી	જુઓ જગાર	जजाल (ताप)	see જગાર'
જગાળ	जजाल	સ્ત્રી	ઉપાધિ, ખટખટ	झझट, जजाल, झमला	botheration
જગાળી	जजाली	વિ	જગાળવાળુ	जजाली, जजालिया, झझट करने वाला	one who has lot of botheration or entangle- ments
જજીર	जजीर	સ્ત્રી	1 સાકળ 2 બેડી 3 ઘડિયાળની કમાન 4 આઝર	जजीर, नृखला जजीर घड़ी की क्रमान्नी आँझर	chain snackles spring of a watch anklet
જત	जत	પુ	જુઓ 'જતુ'	देखिए 'जतु'	see જતુ'
જતર	जतर	પુ, ન	1 તાંત્રિક આકૃતિ 2 તેવી આકૃતિ કે અક્ષરવાળો ડાગળ કે પતરું, તાવીજ 3 જાદુ	जतर, तान्त्रिक आकृति तावीज जादू, जतर-मतर	a figure in occult science, tantra paper or plate of that shape a talisman magic
જતરડુ	जतरडु	ન	જુઓ 'જતરડુ'	देखिए 'जतरडु'	see જતરડુ'
જતરમતર	जतरमतर	પુ, ન	જતર અને મતર	जतर-मतर	charm, spell
જતુ	जतु	પુ, ન	નાનુ જીવડુ	जतु, छोटा कीडा	insect
જત્રી	जत्री	પુ	1 જત્ર વગાડનાર	वीणावादक, जत्री	one hwo plays on જત્ર (a stringed instrument)

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 જાદુગર, ખેલાડી 1 સૂચિ, અનુક્રમણિકા, સાકળિયુ	જાદુગર સૂચિ	magician index, table of contents
		સ્ત્રી	2 જાતરવાનુ તાવીજ 3 તૈયાર ગણતરીનો કોઠો, કોષ્ટક	તાવીજ કોષ્ટક, કોઠા	talisman tabular presen- tation
જપ	જપ	પુ.	શાંતિ, નિરાત	ચૈન, શાન્તિ	quiet, rest
જપવુ	જપવુ	અ ક્રિ	1 નિરાત વાળવી, શાંત પડવુ 2 જરા ઊઘવુ-આખ મળવી 3 તોફાન, ધમાચકડી છ માથા શેકવુ, તે બધ કરી શાંત થવુ	ચૈન હોના, શાન્ત હોના થોડી નીંદ લેના, ઊઘના શરાત બદ કરના	to rest, to be quiet to have a nap to keep away from mischief etc for a while
જબૂર	જબૂર	ન.	ખીલા ખેચી કાઢવાનુ ઓજાર-એક જાતની પકડ	જબૂર, જબૂરા	kind of instrument to extract nails
જબૂરિયો	જબૂરિયો	પુ	નાનો છોકરો	છોટા લડકા	young boy
જબૂરો	જબૂરો	પુ	1 એક નાની તોપ 2 બાલગરનો મદદનીશ છોકરો	છોટી તોપ ઝમૂરા	small piece of cannon a young boy as an assistant to a juggler
જાઆવ	જાઆવ	સ્ત્રી	જવુ ને આવવુ તે, આવજા	જાના-આના, આવન જાવન	frequent com- ing and going
જાઈ	જાઈ	વિ, સ્ત્રી	1 જાણી, જાણેલી 2 પુત્રી 3 એક ફૂલની વેલ (માલતી કે તેન ફૂલ)	જન્મ દી હુઈ પુત્રી, જાઈ જાઈ, ચમેલી	bom daughter kind of flower- ing creeper
જાકાર	જાકાર	પુ.	'જાઓ' એવો ઉદ્દગાર, અસત્કાર	અસત્કાર, આવ- ભાગત ન હોના	non-reception asking a person to quit

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
જાકારો	जाकारो	पु	જુઓ 'જાકાર'	'देखिए 'जकार'	see 'जकार'
જાકીટ	जाकीट	न	એક પ્રકારનું પહેરવાનું વસ્ત્ર, વાસકોટ	जाकित, फतूही, वास्कट	jacket
જાગતું	जागतु	वि	1 ઊઘતું નહિ તેવું, જાગ્રત 2 સાવધાન	जागता हुआ, जाग्रत सावधान	awake alert, watchful
જાગરણ	जागरण	न	1 જાગવું તે, ઊજાગરો 2 જાગૃતિ	जागरण, रतजगा जागृति	keeping awake awakening
જાગરૂક	जागस्क	वि	1 જાગતું 2 સાવધ	जागता हुआ, जागस्क सावधान, सतर्क	wakeful, wide awake alert, vigilant, watchful
જાગવું	जागवु	अ क्रि	1 ઊઘમાથી ઊઠવું, જાગ્રત થવું 2 પ્રમાદમાં ન પડવું, જાગ્રત રહેવું 3 જાગતા હોવું 4 ફરી ઊખડવું, તાજું થવું 5 અજ્ઞાનમાંથી નીકળવું, જ્ઞાન પામવું	जागना, जगना जाग्रत रहना, सजग होना जागता हुआ होना उभरना, ताजा होना ज्ञान पाना	to wake up to keep alert to keep awake to rise again, revive to come out of ignorance
જાગીર	जागीर	स्त्री	સરકાર તરફથી બક્ષિસ તરીકે મળેલી જમીન કે ગામ	जागीर	estate or land
જાગીરદાર	जागीरदार	वि पु	જાગીર ધરાવનારું જાગીરનો ધણી	जागीरदार, जागीर वाला, रईस जागीर का मालिक	estate-holder, land-holder one who owns an estate
જાગીરદારી	जागीरदारी	स्त्री	જાગીરદારપણું	जागीरदारी, रईसी	status of an estate-holder

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઝાગીરી	जागीरी	વિ	ઝાગીરને લગતુ	जागीर से सबद्ध	regarding an estate
		સ્ત્રી	ઝાગીરદારી	जागीरदारी रईसी	see 'ઝાગીરદારી'
ઝાચક	जाचक	પુ	માગણ	याचक, माँगने वाला	beggar
ઝાચના	जाचना	સ્ત્રી	1 વિનતી, પ્રાર્થના 2 માગણી, ભીખ	प्रार्थना, विनती माँग, भीख, याचना	request, prayer begging
ઝાચવુ	जाचवु	સ ક્રિ	યાચના કરવી	याचना करना	to beg, to request
ઝાજમ	जाजम	સ્ત્રી	પહોળુ, ઝાડુ એક પાથરાણુ	जाजम, जाजिम, बिसात, मोटी दरी	large carpet
ઝાજમ્માન	जाजरमान	વિ	1 ઝાજવલ્યમાન 2 તરત પારખુ દેખાડે એવુ 3 ડરડા મિઝાજનુ, રુઆબદાર, તેજીલુ	जाज्वल्यमान, तेजोमडित तुरत परचा दिखाने वाला रुआबदार, तेज	bright quick at proving itself hot-tempered
ઝાજરુ	जाजरु	પુ, ન	સડાસ, પાચખાનુ	पाखाना	latrine
ઝાજવલ્યમાન	जाज्वल्यमान	વિ	પ્રકાશથી ઝગઝગતુ, દેદીપ્યમાન	जाज्वल्यमान, तेजोमडित	splendid, bright
ઝાડ	जाड	સ્ત્રી	ઝાડાપણુ	मोटापन, स्थूलता	thickness
ઝાડપણ	जाडपण	ન	જુઓ 'ઝાડ'	देखिए 'ઝાડ'	see 'ઝાડ'
ઝાડાઈ	जाडाई	સ્ત્રી	જુઓ 'ઝાડ'	स्थूलता, मोटापन	see 'ઝાડ'
ઝાડાશ	जाडाश	સ્ત્રી	જુઓ 'ઝાડ'	देखिए 'ઝાડ'	see 'ઝાડ'
ઝાડિયુ	जाडियु	વિ	ઝાડુ (જરા ડટાક્ષમા)	मोटा	fat swollen (ironic)
ઝાડુ	जाडु	વિ	1 દળદાર 2 ચરબીથી ભરેલુ 3 ઘાટુ	मोटा, दलदार चरबीयुक्त, मेदस्वी घना, ठोस, दबीज, गाढा	bulky plump thick

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			4 તીણ નહિ એવું 5 ખોખરું, ભારે 6 (ના) મદ બુદ્ધિવાળું 7 અશિષ્ટ, ગામડિયું 8 ઓછી ઝીણવટવાળું	મોથરા, કુદ ભારી, કર્કાશ જડ, મદબુદ્ધિ ગૌંવાર, અશિષ્ટ જિસમેં ગહરાઈ ન હો, મોટા	blunt heavy slow-witted callow, boorish one having no depth, crude
જાડુપાતળું	જાડુપાતલું	વિ	જાડુ કે પાતળું ગમે તેવું, જેવું હોય તેવું કે તેટલું	મોટા યા મહીન, જૈસા મી હો	whether thick or thin, what- ever it might be
જાડુ બખખડ	જાડુ બલખડ	વિ	જાડુ, ઘટ્ટ (દૂધ માટે)	ગાઢા	thick, rich (for milk)
જાડુ બમ	જાડુ બમ	વિ	ખૂબ જાડુ	બહુત મોટા	very bulky
જાડુ ભમ	જાડુ ભમ	વિ	જુઓ 'જાડુ બમ'	બહુત મોટા	see 'જાડુ બમ'
જાડુ રેડ	જાડુ રેડ	વિ	રગડા જેવું જાડુ-ઘટ	ગાઢા	thick (esp of liquid)
જાડુ રોડ	જાડુ રોડ	વિ	જુઓ 'જાડુ રેડ'	ગાઢા	see 'જાડુ રેડ'
જાણ	જાણ	વિ	1 જાણનાર 2 ઓળખાણવાળું, પરિચિત	જાનકાર પરિચિત, પહચાન વાલા	one who knows known
		સ્ત્રી	1 જાણવું તે, જ્ઞાન, માહિતી 2 ઓળખાણ	જાનના, જ્ઞાન, સૂચના પહચાન	knowledge, information acquaintance, familiarity
જાણકાર	જાણકાર	વિ, પુ	જાણકાર	જાનકાર	one who knows, expert
જાણપિછાણ	જાણપિછાણ	સ્ત્રી	ઓળખાણપિછાન	જાન-પહચાન	acquaintance
જાણભેદુ	જાણભેદુ	વિ	વાતનો ભેદ જાણનારું, અદરની વાત જાણતું	મેદિયા	one who knows the secrets of a matter

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જાણવું	જાણવું	સ ક્રિ	1 ખબર, માહિતી, સમજ, જ્ઞાન, આવડ કે પરિચય વગેરે હોવું કે પામવું 2 માનવું, ડલવું	જાનના, પહચાનના	to know
જાણીજોઈ	જાણીજોઈ	અ	જાણતા છતાં, ઇરાદાથી	જાન-બૂઝકર	knowingly, deliberately
જાણીજોઈને	જાણીજોઈને	અ	જુઓ 'જાણી જોઈ'	જાન-બૂઝકર	see 'જાણીજોઈ'
જાણીતું	જાણીતું	વિ	1 ઓળખીતું 2 અનુભવી 3 પ્રસિદ્ધ	પરિચિત, જાન-પહચાન વાલા અનુભવી નામી, પ્રસિદ્ધ, રહ્યાત	familiar experienced well-known
જાણીબૂજી	જાણીબૂજી	અ	જુઓ 'જાણીજોઈ'	જાન-બૂઝકર	see 'જાણીજોઈ'
જાણીબૂજીને	જાણીબૂજીને	અ	જુઓ 'જાણીજોઈ'	જાન-બૂઝકર	see 'જાણીજોઈ'
જાણે	જાણે	અ	1 'એવું જ હોય ને' એવી ઉત્પ્રેક્ષા બતાવતો શબ્દ 2 'માનો કે' એવો ભાવ બતાવતો શબ્દ	ગોયા, જૈસે માનો, જાનો	as if supposing
જાણે કે	જાણે કે	અ	જુઓ 'જાણે'	દેખિય 'જાણે'	see 'જાણે'
જાણેઅજાણે	જાણેઅજાણે	અ	જાણતા કે અજાણતા, વગર ઇરાદે	જાને-અનજાને	knowingly or unknowingly
જાણ્યેઅજાણ્યે	જાણ્યેઅજાણ્યે	અ	જુઓ 'જાણેઅજાણે'	જાને-અનજાને	see 'જાણેઅજાણે'
જાત	જાત	વિ	જન્મેલું, ઉત્પન્ન થયેલું	જન્મા હુઆ, ઉત્પન્ન હુઆ	born, arisen
		સ્ત્રી	1 જાતિ, વર્ગ 2 ખાનદાન, કુલ	જાત, જાતિ, વર્ગ ખાનદાન, વશ, કુલ, જાત	race, class family, parentage

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 नात, ज्ञाति	विरादगे, गोत्र, जाति	caste
			4 पस, देह	दह, जान	self, body
			5 (दा) मूण स्वभाव	मूल गुण	one's basic nature
जातअनुभव	जातअनुभव	पु	पोतानो જ અનુભવ	खुद का, अपना ही अनुभव, निजी अनुभव	first-hand experience
जातउमाई	जातकमाई	स्त्री	पोते, जाते डरेली उमाणी	खुद की कमाई, अपनी कमाई	one's own earnings
जातनु	जातनु	वि	जाते, जातिथी	जाति का	by or of one's own, self
जातभाई	जातभाई	पु	जातिभाई	जातिवधु	person of the same religion or caste
जातमहेनत	जातमहेनत	स्त्री	1 जाते डरेली महेनत, स्वाश्रय 2 शरीरश्रम	स्वा-य, अपने आप किया हुआ श्रम शरीरश्रम	work done by oneself, self-help physical labour
जातरधु	जातरधु	वि	जात साथपनारु, स्वाथी	स्वार्थी, खुदगर्ज	self-centred
जातपत	जातपत	वि	उिया धानदान डे ओलाएनु	कुलीन, अच्छी नस्ल का	of high breed
जातवान	जातवान	वि	जुओ 'जातपत'	देखिए 'जातपत'	see 'जातपत'
जातस्वभाव	जातस्वभाव	पु	जातिस्वभाव, दुणनो - बापदादानो स्वभाव	जातिस्वभाव	natural or innate disposition
जाति	जाति	स्त्री	1 दुण, वार्ग डे नात तथा थोनिना भेडसूयड वर्ग, समुदाय 2 (व्या) लिगभेडसूयड वर्ग	जाति, समुदाय जाति, लिंग (व्या)	race, family lineage gender (in grammar)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
जातिભાઈ	जातिभाई	पु	એક જ જાતિ કે જાતિનો હોઈ ભાઈ	जाति-जन	see 'जातिभाई'
जातीय	जातीय	वि	1. जातिनु - ने लगतु 2. स्त्री-पुरुष संबधने लगतु, 'सेकश्युअल'	जाति का, जातीय यौन	pertaining to a class, generic sexual
जातीલુ	जातीलु	वि	पोतानी जातिनु, स्वजातीय	स्वजातीय	of one's own caste
जाते	जाते	अ	1. पोते, पडे 2. जातिशी, जाति प्रमाणे	खुद, आप जाति से, जाति के अनुसार	by one's self in terms of one's caste
जात्यभिमान	जात्यभिमान	न	पोतानी जातिनु अभिमान	अपनी जाति का अभिमान	pride in one's caste
जात्रा	जात्रा	स्त्री	1. तीर्थोनी मुसाद्रीअे जवु ते 2. देव के मछापुरुषने निमित्ते थतो मोटो समारोह के मेणो 3. बगाल, आसाम तथा ओरिसानु लोकनाट्य	तीर्थयात्रा, यात्रा बड़ा समारोह या मेला बगाल, असम और उड़ीसा का लोकनाट्य	pilgrimage festival in honour of a deity or a celebrity folk drama of Bengal, Assam & Orissa
जात्राणु	जात्राळु	पु, वि	जात्रा करवा जनार	यात्री	pilgrim
जाथु	जाथु	अ	हमेश रळे-याट्या करे अेम	लगातार चला करे ऐसे, सतत	constantly, permanently
जाथुड	जाथूक	अ	जुओ 'जाथु'	देखिए 'जाथु'	see 'जाथु'
यादव	यादव	पु	1. यादव, यदुनो वशज 2. कृष्ण	यादव कृष्ण, यादव	same as यादव, of Yadu clan Krishna

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જાદવાસ્થળી	જાદવાસ્થલી	સ્ત્રી	1 જાદવોની અદર-અદર થયેલી લડાઈ 2 એક વર્ગના માણસોની માહોમાહેની લડાઈ (લા)	યાદવોં કી આપસી લડાઈ	internecine strife among Yadavas internecine or civil strife
જાદુ	જાદુ	પુ, ન	મત્રત્ર કે હાથચાલાકીનુ કામ	જાદૂ	magic, sleight of hand
જાદુઈ	જાદુઈ	વિ	જાદુશી થયેલુ, અમત્કારી, વિલક્ષણ	જાદૂ કા, ચમત્કારી	magical, miraculous
જાદુખોર	જાદુખોર	પુ	જાદુ જાણનાર, જાદુગર	જાદૂગર	magician
જાદુખોરો	જાદુખોરો	પુ	જુઓ 'જાદુખોર'	જાદૂગર	see 'જાદુખોર'
જાદુગર	જાદુગર	પુ	જાદુનુ કામ કરનાર	જાદૂગર	magician
જાદુગરી	જાદુગરી	સ્ત્રી	1 જાદુની વિદ્યા 2 જાદુનુ કામ	જાદૂ કી વિદ્યા જાદૂ કા કામ	science of magic trick of magic
જાદુમત્ર	જાદુમત્ર	પુ	જાદુનો મત્ર	જાદૂ કા મત્ર	magical formula
જાદે	જાદે	વિ	જ્યાદા, વધારે	જ્યાદા, બહુત	more
જાન	જાન	સ્ત્રી	લગ્નમા વર સાથે જનારાઓનો સમૂહ	બરાત, જનેત	marriage party
		ન	નુકસાન, હાનિ	નુકસાન, હાનિ	damage, loss
		પુ	1 જીવ, પ્રાણ 2 (લા) પ્રાણપ્રિય માણસ	જાન, પ્રાણ, જીવ પ્રાણપ્યારા વ્યક્તિ, જાન	life, vitality very dear person
			3 દમ, શક્તિ	દમ, જાન, શક્તિ	strength, vigour
જાનપિછાણ	જાનપિછાણ	સ્ત્રી	જુઓ 'જાણપિછાણ'	જાન-પહચાન	see 'જાણપિછાણ'
જાનફિશાની	જાનફિશાની	સ્ત્રી	પ્રાર્ણપણ	પ્રાણાર્પણ	laying down one's life

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જાનવર	જાનવર	ન	જાનવર, પશુ	જાનવર, પશુ	animal, beast
જાની	જાની	વિ	1 જાન સમુ પ્રિય 2 જીવલેણ	પ્રાણપ્રિય જાનલેવા, જાની	as dear as one's own life fatal
જાનીવાસો	જાનીવાસો	પુ	જાનનો ઉતારો	જનવાસા	lodging place for a bride- groom's party
જાનેવરી	જાનેવરી	પુ.	જુઓ 'જાન્યુઆરી'	જાનવરી	January
જાનેયો	જાનેયો	પુ	જાનમા જનાર પુરુષ	બરાતી	male member of a bride- groom's party
જાન્યુઆરી	જાન્યુઆરી	પુ	ખ્રિસ્તી પહેલો મહિનો	જાનવરી	January
જાપતો	જાપતો	પુ	પાકો બદોબસ્ત, જાપતો, કાબૂ, તકેદારી	વ્યવસ્થા, પક્કા ઇતજામ, કડી નિગરાની	bandobast, strict watch
જાપતો	જાપતો	પુ	જુઓ 'જાપતો'	દેખિય 'જાપતો'	see 'જાપતો'
જાફત	જાફત	સ્ત્રી	મિજબાની, ઉજાણી	દાવત	feast, party
જાફરા	જાફરા	ન	લાબા કેશ (અવ્યવસ્થિત)	લંબે બાલ (અવ્યવસ્થિત), બિહારે હુય બાલ	long hair (esp when disorderly)
જાફરિયા	જાફરિયા	ન	જુઓ 'જાફરા'	દેખિય 'જાફરા'	see 'જાફરા'
જાફરુ	જાફરુ	વિ	જાફરાવાળુ	જાબરા (પશુ)	having long hair, shaggy
જામગરી	જામગરી	સ્ત્રી	બદ્દ કે તોપના ઘરને સળગાવવા માટેની કાકડી-પત્તી	ફલીતા	end of a squib where fire is applied, match of a gun
જામફળ	જામફળ	ન	એક ફળ-જમરૂખ	અમરુદ	kind of fruit guava

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ગાવડ	जावक	वि स्त्री	બહાર જતુ કે મોકલાતુ 1 બહાર મોકલેલુ તે 2. ખર્ચ, ઉધારેલી રકમ	बाहर जाता हुआ या भिजवाता हुआ निर्यात खर्च, व्यय	that which is to be despatched despatched or sent out expenditure, amount debited
ગાવરુ	जावरु	वि	1 જાણ, ઘસાઈ ગયેલુ 2 ક્ષણભંગુર 3 નાજુક	जीर्ण, जर्जरित क्षणभंगुर नाजुक	old and worn out transient delicate
ગાવતરી	जावतरी	स्त्री	જુઓ 'ગાયપત્રી'	जावित्री	see 'गायपत्री'
ગાવત્રી	जावत्री	स्त्री	જુઓ 'ગાયપત્રી'	जावित्री	see 'गायपत्री'
ગાવુ	जावु	अ क्रि स क्रि	1 જવુ 2 જન્મવુ જન્મ દેવો, જણવુ	जाना जनमना जन्म देना, जनना	to go to be born to give birth
ગાસાચિઠ્ઠી	जासाचिठ्ठी	स्त्री	ગાસાનુ કારણ દર્શાવતી ચિઠ્ઠી	धमकी भरी गुप्त चिट्ठी	threatening note
ગાસૂસ	जासूस	पु	1 શત્રુની છૂપી રત્તિ ખાતમી જાણી લાવનાર 2 કાસદ	जासूस, चर, गुप्तचर कासिद, सन्देशवाहक	spy messenger
ગાસૂસી	जासूसी	स्त्री	છૂપી ખાતમી લાવવાનુ કામ	जासूस का काम, जासूसी, गुप्तचर का काम	espionage
ગાસો	जासो	पु	1 અગત વેર વાળવા લોકો પર કરતી જબરદસ્તી 2 તેને માટે અપાતી છૂપી ધમકી	जबरदस्ती गुप्त धमकी	blackmail threatening to blackmail

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જાસ્તી	जास्ती	वि स्त्री	જાસ્ત જુલમ, જબરદસ્તી	जितना चाहिए उससे ज्यादा जुल्म, जबरदस्ती	more than desired tyranny, coercion
જાહેર	जाहेर	वि	1 ગુપ્ત નહિ એવું, લોકોને જાણીતું 2 સાર્વજનિક	जाहिर, प्रकट, खुला आम, सार्वजनिक	open public
જાહેરખબર	जाहेरखबर	स्त्री	1 સૌ કોઈની જાણ માટેની ખબર 2 તેને માટે લખાણવાળા વગેરેનું લેવાતું સાધન	विज्ञापन, इशतहार विज्ञापन लेने का साधन	advertisement means of advertisement
જાહેરનામું	जाहेरनामु	न	જાહેરખબર, ઢઢેરો	घोषणापत्र, सार्वजनिक सूचना	proclamation
જાહેરસભા	जाहेरसभा	स्त्री	જાહેર જગ્યાએ અને સૌને માટે થતી સભા	सार्वजनिक सभा, आम जलसा	public meeting or an assembly
જાહેરસેવા	जाहेरसेवा	स्त्री	લોકસેવા	लोकसेवा	public service
જાહેરતા	जाहेरत	स्त्री	1 જાહેર કરવાની ક્રિયા, પ્રસિદ્ધ 2 જાહેરખબર છડેચોક, ચાહન	प्रसिद्धि विज्ञापन खुले आम, जाहिर में	publicity advertisement publicly
જાહો	जाहो	पु	જુઓ 'જાસો'	देखिए 'जसो'	see 'जसो'
જાહોજલાલી	जाहोजलाली	स्त्री	દબદબો, આબાદી, વૈભવ	वैभव, दबदबा, जाह व जलाल, सपन्नता	splendour
જાળ	जाळ	स्त्री	1 જુઓ 'જાલ' 2 ભમરડો ફેરવવાની દોરી	जाल लट्टू की रस्ती	see 'जाल' string to whip a top
જાળવણી	जाळवणी	स्त्री	જાળવવું તે, સભાળ, સાચવણી	हिफाजत, देखभाल	care, preservation

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જામફળી	जामफळी	स्त्री	1 જામફળનું ઝાડ 2 તેની વાડી	अमरुद का पेड़ अमरुद का बाग	tree that yields guava place where these trees grow in plenty
જામવું	जामवु	अ क्रि	1 એકઠું થવું, છૂટા-છૂટા તત્વોનું એકત્ર થવું 2 ઘન થવું, ઠરવું, બાઝવું, બધાવું 3 સ્થિર કે દૃઢ થવું 4 બરોબર ચાલવું, પૂરું રગમા આવવું, મથવું, પુરબહાર થવું	जमना, इकठ्ठा होना गाढ़ा होना, बैठना स्थिर, दृढ़ होना रग में आना, चल निकलना, जमना, मचना	to collect to congeal to be firmly established to get into swing
જામિન	जामिन	पु	બીજાની જોખમદારી પોતા પર લઈ તે વિષે કબૂલાત આપનારો	जमानत देने वाला	security, surety
જામિની	जामिनी	स्त्री	જામની, રાત્રિ	रात	night
જામીન	जामिन	पु	જુઓ 'જામિન'	देखिए 'जामिन'	see 'जामिन'
જામીનખત	जामिनखत	न	જામીન તરીકેનો લેખી કરાર	जमानतनामा	deed for surety
જામીનગીરી	जामिनगीरी	स्त्री	જામીન થવું તે, ખાતરી આપવી તે	जमानत	security, guarantee
જામીની	जामिनी	स्त्री	જુઓ 'જામીનગીરી'	देखिए 'जामिनगीरी'	see 'जामिनगीरी'
જામો	जामो	पु	મોટા ઘેરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અગરખો	जामा	long robe or vest
જાચફળ	जायफल	न	એક ફળ-તેજાનો	जायफल	kind of fruit, nutmeg
જાચું	जायु	वि	જન્મેલું	जनमा हुआ, जात	born

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या-को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જાથો	जायो	पु- वि, पु	पुत्र જાણેલો, જન્મેલો	पुत्र जनमा हुआ, जना हुआ, जात	son born
જાર	जार	स्त्री- पु-	એક અનાજ, જુવાર પરસ્ત્રી સાથે પ્રીતિ કરનાર, યાર	ज्वार (अनाज) जार, यार	same as જુવાર paramour, lover
જારકર્મ	जारकर्म	न	व्यभिचार	व्यभिचार	adultery
જારણ	जारण	न	1 માણસ રોગી થઈ જાય તેવો મત્ર-મયોગ 2 વશીકરણ	रोगी बनाने वाला मंत्र-प्रयोग वशीकरण	evil charm sorcery
જારણ	जारणु	न	જુઓ 'જારણ'	देखिए 'जारण'	see 'जारण'
જારબાજરી	जारबाजरी-	स्त्री	(લા.) ભરણપોષણ	गुजारा, भरणपोषण	maintenance
જારી	जारी	अ	1 ચાલુ 2. જુઓ 'જારકર્મ'	जारी, चालू व्यभिचार	continuing adultery
જાલ	जाल	स्त्री	1 માછલા, પખી વગેરે પકડવાની જાળી 2 ઘણી વસ્તુઓ ગૂંચવાઈને થયેલું જાળું 3 ફાદો, ફરેબ	जाल बहुत-चीजों का मिश्रण होने से बनी हुई जाल फदा, फरेब	net to catch fish etc a web in which many things have got entangled noose
જાલમ	जालम	वि	જુઓ 'જાલિમ'	देखिए 'जारम'	see 'जारम'
જાલિમ	जालिम	वि	જુલમી, નિર્દય	जालिम, क्रूर	tyrannical
જાલી	जाली	वि	કપટી, બનાવટી, જૂઠું	जाली, कपटी, भूठा	deceitful lying
જાવ	जाव	स्त्री	જવાની ક્રિયા	जाने की क्रिया	going
જાવઆવ	जावआव	स्त्री	જાઆવ	आवा-जाही	frequent coming and going

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
જાવક	जावक	वि स्त्री	બહાર જતુ કે મોકલાતુ 1. બહાર મોકલેલુ તે 2. ખર્ચ, ઉધારેલી રકમ	बाहर जाता हुआ या भिजवाता हुआ निर्यात खर्च, व्यय	that which is to be despatched despatched or sent out expenditure, amount debited
જાવરુ	जावरु	वि	1. જાણ, ઘસાઈ ગયેલુ 2. ક્ષણભંગુર 3. નાજુક	जीर्ण, जर्जरित क्षणभंगुर नाजुक	old and worn out transient delicate
જાવતરી	जावतरी	स्त्री	જુઓ 'જાયપત્રી'	जावित्री	see 'जयपत्री'
જાવત્રી	जावत्री	स्त्री	જુઓ 'જાયપત્રી'	जावित्री	see 'जयपत्री'
જાવુ	जावु	अ क्रि स क्रि	1. જવુ 2. જન્મવુ જન્મ દેવો, જણવુ	जाना जनमना जन्म देना, जनना	to go to be born to give birth
જાસાચિઠ્ઠી	जासाचिठ्ठी	स्त्री	જાસાનુ કાશર દર્શાવતી ચિઠ્ઠી	धमकी भरी गुप्त चिट्ठी	threatening note
જાસૂસ	जासूस	पु	1. શત્રુની છૂપી રતિ બાતમી જાણી લાવનાર 2. કાસદ	जासूस, चर, गुप्तचर कासिद, सन्देशवाहक	spy messenger
જાસૂસી	जासूसी	स्त्री	છૂપી બાતમી લાવવાનું કામ	जासूस का काम, जासूसी, गुप्तचर का काम	espionage
જાસો	जासो	पु	1. અગત વેર વાળવા લોકો પર કરતી જબરદસ્તી 2. તેને માટે અપાતી છૂપી ધમકી	जबरदस्ती गुप्त धमकी	blackmail threatening to blackmail

का	जय		
वि	जस्त	जितना चाहिए	more than
स्त्री	जुलम, जबरदस्ती	उससे ज्यादा जुल्म, जबरदस्ती	desired tyranny, coercion
वि	1 गुप्त नहीं थे, लोकने जाणीतु 2 सार्वजनिक	जाहिर, प्रकट, खुला आम, सार्वजनिक	open public
स्त्री	1 सौ ओछनी जाण माटेनी जबर 2 तेने माटे लज्जासुखपाण वगेरेनु लेवातु साधन	विज्ञापन, इशतहार विज्ञापन लेने का साधन	advertisement means of advertisement
न	जालेरजबर, द्देशे	घोषणापत्र, सार्वजनिक सूचना	proclamation
स्त्री	जालेर जगाथे अने सौने माटे थती सभा	सार्वजनिक सभा, आम जलसा	public meeting or an assembly
स्त्री	लोकसेवा	लोकसेवा	public service
स्त्री	1 जालेर करवानी किया, प्रसिद्ध 2 जालेरजबर	प्रसिद्धि विज्ञापन	publicity advertisement
अ	छडेथोक, थालन	खुले आम, जाहिर में	publicly
पु	जुओ 'जसो'	देखिए 'जसो'	see 'जसो'
स्त्री	दबदबा, आभादी, वैभव	वैभव, दबदबा, जाह व जलाल, सपन्नता	splendour
स्त्री	1 जुओ 'जाल' 2 लमरडो इशवानी दोरी	जाल लट्टू की रस्सी	see 'जाल' string to whip a top
स्त्री	जानवपु ते, सभाण, साथवणी	हिफाजत, देखभाल	care, preservation

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	व्या. को	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જાળવવું	जाळववु	स क्रि	સભાળવું, સાચવવું	सभालना, देखभाल करना, सहजना, हिफाजत करना	to preserve, to keep safe
જાળાવાળા	जाळावाळा	वि	1 અગ દેખાય એવા આછા વણાટવાળું 2 જરી ગયેલું	छिदरा तार-तार, जीर्ण	thin to the point of being transparent worn out
જાળાઝાખરા	जाळाझाखरा	न	જાળા અને ઝાખરા	झाड-झाडाड	thicket
જાળિયું	जाळियु	न	મકાનના અજવાળા માટે મૂકેલું બાકું	जाली, रोशनदान	wicket or a small window
જાળી	जाळी	स्त्री	1 વચમા કાણા રહે એવી ગૂંચાણી કે તેવી બનાવટની વસ્તુ 2 તેવી ગૂંચાણીવાળા વાળાશી કે સળિયાશી ભરેલું બારી-બારણાનું કમાડ કે ભીંતનું જાળિયું	जाली, छेददार चीज जगला	net-work net-work fixed in a door or window
જાળીદાર	जाळीदार	वि	જાળીવાળું	जाली वाला	(thing) with a net
જાળું	जाळु	न	1 એકબીજા સાથે ગૂંચવાઈ કે ગૂંચાઈને બનેલું કોકડું, ધુગું 2 કરોળિયાનું બાવું 3 જાળ, ફાસલો	जाला मकड़ी का जाला जाल, फदा	net cobweb noose, net to catch a bird etc
જાગડ	जागड	वि	જોવા દેખાડવા મૂલ્ય આપ્યા કે સોદો કર્યા સિવાય લીધેલું	जाकड	taken for approval
જાગલો	जागलो	पु	1 ગોરો, ટોપીવાળો (કાઈક તુચ્છકારમા) 2 જગલી	गोरा लोक जगली	white-man (contemptuous) wild

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઝાંઘ	જાઘ	સ્ત્રી	સાથળ, જઘા	ઝાંઘ, જઘા, રાન	thigh
ઝાંઘિયો	જાઘિયો	પુ	ઝાંઘ ઢકાય એવડો તગિયો-ચડી	ઝાંઘિયા, નિકર, ઘુટન્ના	kind of short breeches
ઝાંબુ	જાબુ	ન.	ઝાંબુડાનુ ફળ	જામુન	kind of fruit
ઝાંબુડિયુ	જાબુડિયુ	વિ	ઝાંબુના રંગનુ	જામુની	scarlet
ઝાંબુડું	જાબુડું	વિ.	1 ઝાંબુના રંગનુ 2 ઝાંબુ	જામુની જામુન	of the colour of 'ઝાંબુ' a kind of fruit
જિતાડવું	જિતાડવુ	સ ક્રિ	'જીતવું' નુ કર્મણિ	જિતાના, જિતવાના	pass of 'જીતવું'
જિતાવવુ	જિતાવવુ	સ ક્રિ	જુઓ 'જિતાડવું'	જિતાના	see 'જિતાડવું'
જિતાવુ	જિતાવુ	અ ક્રિ	'જીતવું' નુ પ્રેરક	જીતા જાના	caus of 'જીતવું'
જિદ	જિદ્દ	સ્ત્રી	જિદ, હઠ	જિદ, હઠ	obstinacy
જિદ્દી	જિદ્દી	વિ.	જિદ્દી	જિદ્દી, હઠી	obstinate
જિન્નત	જિન્નત	ન	જુઓ 'જિન્નત'	દેખિણ 'જિન્નત', સ્વર્ગ	see 'જિન્નત'
જિન્નતનશીન	જિન્નતનશીન	વિ	જુઓ 'જિન્નતનશીન'	દેખિણ 'જિન્નતનશીન'	see 'જિન્નતનશીન'
જિલ્લો	જિલ્લો	પુ	1 વિભાગ 2 કલેક્ટરની હકૂમત નીચે મુકાતો દેશનો ભાગ	વિભાગ, હલકા જિલા	region district
જિવાઈ	જિવાઈ	સ્ત્રી	જીવનનિર્વાહ પેટે બાધી આપેલી રકમ કે જમીન-ગરાસ	જીવિકા કા સાધન, ગુજારા	maintenance, in the form of money, land etc
જિવાડવુ	જિવાડવુ	સ ક્રિ	જીવતુ કરવુ, મરતુ બચાવવુ	જિલાના, જિદા કરના	to bring to life
જિવારી	જિવારી	સ્ત્રી	તબલુ	તબલા	particular kind of drum

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જિવારો	जिवारो	પુ	જ-મારો	जिदगी	life
જિવાવુ	जिवावु	અ ક્રિ	'જીવવુ' નુ ભાવે	जिया जाना	to keep alive
જિવાળી	जिवाळी	સ્ત્રી	1 તબલના ચામડા ઉપરનુ કાળુ વર્તુલ 2 તબૂરાના ઝારા પર તારને લગાડાતા દોરા	स्याही (तबला) जवारी (तबूरा)	the black mark on a तबला thread used in a tambura
જિસમ	जिसम	ન	શરીર	जिस्म, शरीर	body
જિસસ	जिसस	પુ	ઈશુ ખ્રિસ્ત	ईसा मसीह	Jesus
જિસસ કાઈસ્ટ	जिसस काइस्ट	પુ	જુઓ 'જિસસ'	ईसा मसीह	see 'जिसस'
જિહોવા	जिहोवा	પુ	ઈશ્વરનુ ચલૂદી નામ	यहोवा	Jahowah (Jew God)
જિગોડી	जिगोडी	સ્ત્રી	નાનો જિગોડો	छोटी किलनी, चिचडी	small louse
જિગોડો	जिगोडो	પુ	ફૂંટરા, ગાય, ભેસ ઈ પશુઓના કાન વગેરે પર બાઝતો જીવ, જગોડો	बडी किलनी, चिचडा	big louse
જિંદગાની	जिदगानी	સ્ત્રી	જ-મારો, જિંદગી	जिदगी, जीवन	life-time
જિંદગીભર	जिदगीभर	અ	આખી જિંદગી સુધી	जीवन तक, जीवनभर	for whole life
જીજી	जीजी	સ્ત્રી	1 બા 2 મોટી મા, દાદી	माँ दादी	mother grand-mother
જીજો	जीजो	પુ	1 દાદો 2 બનેવી	दादा बहनोई	grand-father brother-in-law
જીતવુ	जीतवु	સ ક્રિ	ફેતેલ મેળવવી	जीतना	to win a victory
જીતેલુ	जीतेलु	ન	એક ફળ અને તેમાનુ બીજ	एक फल और उसका बीज	kind of fruit and its seed

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
જીદ	जीद	स्त्री	જુઓ 'જિદ'	देखिए 'जिद'	see 'जिद'
જીન	जीन	पु	1 એક જાતનું ભૂત 2 ધોડાનું પલાણ	जिन्न जीन, पलान, चारजामा	kind of ghost saddle
		न	એક જાતનું જાડું મિલનું કપડું	एक प्रकार का कपडा	jean (a kind of cloth)
જીનગર	जीनगर	पु	જીન બનાવનાર	जीनसाज	one who manufactures jean
જીનપોશ	जीनपोश	न	જીન ઉપર નાખવાનું કપડું	जीनपोश	cloth put over a saddle
જીનો	जीनो	पु	દાદરબારી, અલગ કાઢેલી સીડી	जीना, सीढी	staircase, flight of stairs
જીભડી	जीभडी	स्त्री	જીભ (તુચ્છકાર)	जीभ	tongue (contemptuous)
જીભને ટેરવે	जीभने टेरेवे	अ	મોઢે, પાઠે, યાદ	मुँह पर, कठस्थ, याद	on the tip of the tongue
જીભલડી	जीभलडी	स्त्री	(કોમળ લલિતભાવ) જીભ	जीभ	tongue (endearingly)
જીભાજોડી	जीभाजोडी	स्त्री	બોલાબોલી, તકરાર	हुज्जत, कहा-सुनी	angry exchanges
જીરણ	जीरण	वि	જુઓ 'જીર્ણ'	जीर्ण, जर्जरित	see 'जिर्ण'
જીરવવું	जीरववुं	स क्रि	1 પચવવું, હજમ કરવું 2 સાખવું, વેઠવું	पचाना, हजम करना सहन करना, झेलना	to digest to put up with, to tolerate
જીરવાવું	जीरवावुं	अ क्रि	'જીરવવું' નું કર્મણિ	'जिरववुं' का कर्मणि रूप	see 'जिरववुं'
જીરું	जीरुं	न	એક મસાલો	जीरा	cumin seed

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જીર્ણ	जीर्ण	વિ	છેક જૂનુ, ઘસાઈ કે ખવાઈ ગયેલુ	जीर्ण	old, worn-out
જીવ	जीव	પુ	1 શરીરનુ ચેતનતત્વ, પ્રાણ 2 પ્રાણી 3 મન, દિલ 4 દમ, સાર 5 કાળજી, લક્ષ્ય	जीव, प्राण, चेतन- तत्व प्राणी, जीव मन, दिल, जी जान, दम, माल लक्ष्य	life animate being mind, heart good substance concern, care
જીવઉકાળો	जीवउकाळो	પુ	બળાપો-કલેશ	जलन, क्लेश	fretting, mental tension
જીવજત	जीवजत	પુ, ન	જીવડુ	कीडा - मकोडा	insect
જીવજતુ	जीवजतु	પુ	જુઓ 'જીવજત'	कीडा - मकोडा	see 'જીવજત'
જીવડુ	जीवडु	ન	કદમા નાનુ જતુ	छोटा कीडा, जतु	insect
જીવડો	जीवडो	પુ	1 જીવ, આત્મા 2 કીડો	जीव, आत्मा कीडा	life, soul insect
જીવત	जीवत	ન	જીવિત, જીવતર	जीवन, जिदगी	life, life-time
જીવતર	जीवतर	ન	જન્મારો, જિંદગી	जीवन, जिदगी	life-span, life
જીવતુ	जीवतु	વિ	જીવવાળુ, જીવનશક્તિવાળુ, સજીવ	जीता, जिदा, सजीव	alive, vital
જીવતુજાગતુ	जीवतुजागतु	વિ	જીવતુ ને પૂરુ સાવધ, જીવત ને પ્રાણવાન	जीवित और जागृत, पूर्ण सावधान	alive and quick
જીવતોડ	जीवतोड	વિ	અતિશય મહેનત કરાવે એવુ (કામ)	जीतोड (काम)	very hard
જીવનચરિત	जीवनचरित	ન	જિંદગીનુ વૃત્તાત	जीवनी	biography
જીવનચરિત્ર	जीवनचरित्र	ન	જુઓ 'જીવનચરિત'	देखिए 'जीवनचरित'	see 'જીવનચરિત'
જીવનદોરી	जीवनदोरी	સ્ત્રી	1 જીવનરૂપી દોરી, આયુષ્ય	आयुष्य को सीमा	life-span, thread of life

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 (લા) જીવનનો મુખ્ય આધાર	जीवन का मुख्य आधार	main support in life
જીવનબુટ્ટી	जीवनबुट्टी	સ્ત્રી	સજીવન કરી દે એવી બુટ્ટી, સજીવની	जीवनबूटी	miraculous cure which gives life
જીવનમૂળી	जीवनमूली	સ્ત્રી	જીવનનું મૂળ, જીવનાધાર	जीवन का आधार/सहारा	chief support of life
જીવનસખી	जीवनसखी	સ્ત્રી	સહધર્મચારિણી, પત્ની	पत्नी, जीवनसखी	wife, life partner
જીવલેણ	जीवलेण	વિ	મૃત્યુ નિપજાવે એવું	प्राणघातक, जीवनहर	fatal, mortal
જીવલોક	जीवलोक	પુ	મૃત્યુલોક	मृत्युलोक	abode of the mortals
જીવવિદ્યા	जीवविद्या	સ્ત્રી	જીવોના ભૌતિક જીવનનું શાસ્ત્ર, 'બાયોલોજી'	जीवविज्ञान	biology
જીવવું	जीववुं	અ ક્રિ	1 જીવનક્રિયાઓ કરવાની શક્તિ હાવી, પ્રાણ ધરવા, શ્વાસ ચાલવો 2 જીવતું હોવું કે રહેવું, હયાત હોવું કે રહેવું 3 જીવન ગુજારવું	जीना, साँस चलना	to live
જીવશાસ્ત્ર	जीवशास्त्र	ન	જુઓ 'જીવવિદ્યા'	जीवविज्ञान	see 'જીવવિદ્યા'
જીવસટોસટ	जीवसटोसट	અ	જીવને જોખમે	जान की बाजी लगाकर	at the risk of life
જીવાત	जीवात	સ્ત્રી	જીવડા કે ડીડાનો સમૂહ	कीड़ों का समूह	insects
જીવાદોરી	जीवादोरी	સ્ત્રી	જુઓ 'જીવનદોરી'	देखिए 'जीवनदोरी'	see 'જીવનદોરી'
જીવિતકાલ	जीवितकाल	પુ	જિંદગીનો સમય, આયુષ્ય	आयुष्य, जीवितकाल	life-span

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेज़ी पर्याय
જીવિતકાલ	जीवितकाल	पु	જીવિતકાલ 'જીવિતકાલ'	आयुष्य, जीवितकाल	see 'જીવિતકાલ'
જીડવું	जीडवुं	न	1 છોડનો કોટલાવાળો બીજકોષ 2 (લા.) જોડકુ	डोंडा, डेंदी, डोडी युग्म	bag of seeds (part of a plant) twin
જીથરા	जीथरा	न	માથાના અવ્યવસ્થિત અને છૂટા વાળ	सिर के अस्तव्यस्त और बिखरे हुए बाल, झोंट	shaggy hair
જુઆરુ	जुआरु	न	સયુક્ત કુટુંબમાંથી છૂટા પડી નવો માડેલો ગૃહસસાર, જુજીવારો, જુગલબારુ	विभक्त परिवार (सयुक्त परिवार से अलग होकर)	setting up one's house after having separated from a joint family
જુઆળ	जुआळ	पु	ભરતી, ઝાર	भाटा का उलटा, ज्वार	tide
જુગટિયો	जुगटियो	पु	જુગારી	जुआडी, जुआरी	gambler
જુગલ	जुगल	न	જોડુ	जोडा, युगल	couple
જુગાર	जुगार	पु	જૂગટુ, ઘૂત	जुआ, जूआ, घूत	gambling
જુગારખાનુ	जुगारखानु	न	જુગાર રમવાનુ સ્થળ-ઘર	जुआखाना	gamblers' den
જુગારિયો	जुगारियो	पु	જુગારી	जुआडी	gambler
જુગારી	जुगारी	वि	જુગાર રમવાની લતવાળુ	जुआ खेलने का आदी	one who is given to gam- bling
જુઠું	जुठुं	वि	1 અસત્ય, જૂઠું 2 કૃત્રિમ, બનાવટી 3. રહી ગયેલુ-જડ	असत्य, झूठा कृत्रिम, जाली बेकार, जड, सज्ञाहीन (अग)	false artificial paralysed, numb

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જુદુ	जुदु	વિ	1 છૂટું, અલગ, વેગળું 2 અનોખું, અસાધારણ	जुदा, दूर, अलग अनोखा	separate unique, distinc- tive
જુદ્દ	जुद्ध	ન	લડાઈ	लडाई, युद्ध	battle
જુનવાણી	जुनवाणी	વિ	1 જૂનું 2 જૂના વિચારનું, 'ઓર્થોડોક્સ'	पुराना पुराने विचार वाला, सनातनी	old fashioned, conservative orthodox
જુનાડ	जुनाड	વિ	જૂનવાણી	प्राचीनमतवादी	old fashioned
જુબાન	जुबान	સ્ત્રી	1 જીભ 2 બોલી, ભાષા	जीभ, जबान बोली, भाषा	tongue speech, lan- guage
જુબાની	जुबानी	સ્ત્રી	બોલીને જણાવેલી હકીકત, સાક્ષી	गवाही	statement, witness
જુમલો	जुमलो	પુ	એકઠેર આકડો, સરવાળો	जोड	score, total
જુમ્મેદાર	जुम्मेदार	વિ	જોખમદાર, જવાબદાર	जिम्मेदार, उत्तरदायी	responsible
જુમ્મેદારી	जुम्मेदारी	સ્ત્રી	જોખમદારી, જવાબદારી, જુમ્મો	उत्तरदायित्व, जिम्मेदारी	responsibility
જુલફુ	जुलफु	ન	વાળની લટ-ગૂંચળું	जुल्फ	lock of hair
જુલમ	जुलम	પુ	1 જબરદસ્તી, બળાત્કાર 2 અત્યાચાર, અન્યાય 3 ક્રોધ વાતમા અતિશયતા કરવી કે ખૂબ કરી નાખવું એવો ભાવ બતાવે છે	जुल्म, जबरदस्ती अत्याचार, अन्याय अतिशयता	violence outrage, injustice indicative of excess
જુલમગાર	जुलमगार	વિ	જુલમી	जुल्मी	tyrannical

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા. કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જુલમી	जुलमी	વિ	1 જુલમ કરનારુ, જુલમગાર 2 જેમા જુલમ હોય તેવુ, જુલમભરેલુ	जुल्मी, अत्याचारी	tyrannical
જુલાઈ	जुलाई	પુ	ખિસ્તી સનનો સાતમો મહિનો	जुलाई	July
જુવતી	जुवती	સ્ત્રી	જવાન સ્ત્રી યુવતી	युवती	young woman
જુવાન	जुवान	વિ	યુવાવસ્થામા આવેલુ, યુવાન	जवान, युवा	youthful
		પુ	તેવો પુરુષ, યુવાન	जवान पुरुष	young man
જુવાનજોદ	जुवानजोध	વિ	1 ભરજુવાન 2 મજબૂત, કઠોવર	पूर्ण यौवनशाली मजबूत, तगडा	in full youth strong in build
જુવાનિયુ	जुवानियु	વિ	જુવાન	जवान	young
જુવાનિયો	जुवानियो	પુ	જુવાન	जवान	young man
જુવાની	जुवानी	સ્ત્રી	યુવાવસ્થા, યુવાની	युवावस्था, यौवन, जवानी	youth
જુવાર	जुवार	સ્ત્રી	એક અનાજ, જાર	ज्वार, जुआर (अन्न)	kind of food grains, <i>juwar</i>
જુવારુ	जुवारु	ન	જુઓ 'જુઆરુ'	देखिए 'जुआरु'	see 'जुआरु'
જુવાળ	जुवाळ	પુ	ભરતી, આર	भाटा का 'उल्टा, ज्वार	tide
જૂ	जू	સ્ત્રી	માથામા કે ચામડી પર પડતુ એક જતુ	जूँ	louse
જૂઈ	जूई	સ્ત્રી	એક ફૂલવેલ	जूही, जुही (बेल)	a flowering creeper
જૂગટુ	जूगटु	ન	દૂત, જુગાર	जुआ, दूत	gambling
જૂજ	जूज	વિ	બહુ થોડુ, જરા	बहुत थोडा, जरा	a little, a few
જૂજજાજ	जूजजाज	વિ	ઘણુ થોડુ, જરાતરા	थोडा सा	very little

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જૂજવુ	जूजवु	વિ	જુદુ, નોખુ	અલગ, જુદા	distinctive, separate
જૂઠ	जूठ	ન	જૂઠાણ	झूठ, असत्य	lie, falsehood
જૂઠાણ	जूठाणु	ન	જૂઠી વાત, અસત્ય વાત	झूठी बात	lie, falsehood
જૂઠાબોલુ	जूठाबोलु	વિ	જૂઠુ બોલવાની ટેવવાળુ	झूठा, असत्यभाषी	given to lying
જૂઠુ	जूठु	વિ	1 અસત્ય, જુઠું 2 કૃત્રિમ, બનાવટી 3 રહી ગયેલુ-જડ (અગ) 4 અજીઠુ, એઠુ	झूठा, असत्य कृत्रिम, जाली बेकार (अग) जूठा	lying, false artificial paralysed, numb left-over (esp food)
જૂતિયુ	जूतियु	ન	જૂતી, ખાસડુ, પગરખુ	जूता	shoe, foot-wear
જૂતી	जूती	સ્ત્રી	જૂતિયુ, ખાસડુ, પગરખુ	जूता	shoe, foot-wear
જૂતુ	जूतु	ન	જુઓ 'જૂતિયુ'	जूता	see 'जूतियु'
જૂથ	जूथ	ન	ટોળુ, સમૂહ	समूह, जूथ	group
જૂન	जून	પુ	ખ્રિસ્તી સનનો છઠ્ઠી મહિનો	जून	June
જૂનુ	जूनु	વિ	1 પુરાણ, પ્રાચાન, અગાઉનુ 2 જર્જરિત, છાણું 3 ઘણો વખત થયેલુ, ઘણો વખત વાપરેલુ 4 રીઢુ, નામીયુ, અનુભવી	पुराना, प्रचीन जीर्ण बहुत बार जिसका उपयोग किया हो वैसा सधा हुआ, अनुभवी, घाघ	old, ancient worn-out put to use over a long period seasoned, tried
જૂનો જોગી	जूनो जोगी	વિ	જૂનેશી ડસાઈને તૈયાર થયેલ વ્યક્તિ	पुराना घाघ	old timer, veteran
જૂપો	जूपो	પુ	ઢોરના શરીર પર ચોટતુ એક જીવડુ	किलनी	louse, insect sticking on a beast
જે	जे	સ, વિ	તે (સાથે સબધમા વપરાય છે)	जो	that, which

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
		અ	કે (વાક્યના બે વિભાગને જોડતું અપેક્ષાપૂરક અવ્યય)	જો, કિ	conjunctive
		પુ, સ્ત્રી	ફતહ	જય, ફતહ	utterance of triumph
જેઓ	જેઓ	અ	'જે' નું બહુવચન	જો	plural of 'જે'
જે ગમ	જે ગમ	અ	જે તરફ	જિસ ઓર	the direction in which
જેગોપાલ	જેગોપાલ	પુ	'જ્યગોપાળ' (નમસ્કાર કરવાનો એક વૈષ્ણવ ઉદ્ગાર)	'જયગોપાલ', નમસ્કાર કા એક વૈષ્ણવ ઉદ્ગાર	a mode of greeting (among Vaish- navas)
જેગોપાળ	જેગોપાળ	પુ	જુઓ 'જેગોપાલ'	દેખિયે 'જેગોપાલ'	see 'જેગોપાલ'
જે જે	જે જે	અ	દરેક, હરકોઈ જે	પ્રત્યેક, જો જો, હરકોઈ જો	each, every
જેટલું	જેટલું	વિ	'તેટલું' ના સબધમા વપરાય (કે, સખ્યા, વજન ઇ નું માપ સૂચવે છે)	જિતના	(with) 'તેટલું', indicative of size, quantitative, number etc)
જેટલે	જેટલે	અ	1 'તેટલે' સાથે સબધમા જેટલે અતરે, હે કે મર્યાદા ઇ મા 2 જે વખતે, જ્યારે (પ)	જિસ માત્રા મે, જિતના	(with 'તેટલે') indicative of distance etc
જેઠાણી	જેઠાણી	સ્ત્રી	જેઠની વહુ	જેઠાની	sister-in-law, brother-in-law's wife
જેઠીમધ	જેઠીમધ	ન	એક વનસ્પતિ, ઔષધિ	જેઠીમધુ, મુલેઠી	kind of medicinal herb

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જેણી	जेणी	अ	'जे' नु स्त्री रूप ('तेणी'ना सलधमा जूना पधमा કે मुप्यत्वे पारसी ओमा)	'जे' का स्त्रीवाचक	fem of 'जे'
		वि, स्त्री	जे	जो	same as 'जे'
જેણે	जेणे	अ	'जे' नु तृतीयानु रूप	जिसने	instrumental of 'जे'
જેતून	जेतून	न	એક તેલી બી, 'ઓલિવ'	जैतून, 'ओलिव'	live
જે તે	जे ते	स, वि	1 ગમે તે, કોઈ પણ 2 ફાલતુ, સામાન્ય	कोई भी, जो भी सामान्य	anyone extra, surplus
જેબ	जेब	पु, स्त्री	1 ખીસુ 2 શોભા, સુદરતા	जेब शोभा, सुन्दरता	pocket beauty, charm
જેમ	जेम	अ	જે રીતે	जैसे	way in which
જેમ કે	जेम के	अ	દાખલા તરીકે	जैसे कि, मसलन्	for instance
જેમ તેમ	जेम तेम	अ	ગમે તેમ, હરકોઈ રીતે, મુશ્કેલીથી	ज्यों-त्यों किसी तरह, मुश्किल से	some how or the other
જેમનું	जेमनु	अ वि	જેઓનું 1 જે પ્રમાણેનું, જે રીતનું, જેવું 2 જે બાજુ કે તરફનું	जिनका जिस तरह का, जैसा जिस ओर का	whose of which sort, in which way in which direction, on which side
જેર	जेर	अ	વશ, તાબે, પરાજિત	पराजित, बस में	defeated
જેલ	जेल	स्त्री	1 કેદખાનું 2 જેલની સજા, કેદ	जेल, कैदखाना कैद की सजा, कैद	prison, jail imprisonment
જેવડું	जेवडु	वि	અમુક કદ કે માપનું	जितना (कद, नाप)	of a certain size
જેવું	जेवु	वि	('તેવું સાથે સલધમા') અમુક જાત, રીત કે ગુણ-લક્ષણનું	जैसा	(with તેવું) indicative of a certain type, style or quality

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યત્તરણ	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જેવુ તેવુ	જેવુ તેવુ	વિ	1 સાધારણ 2 ગમે તેવુ	સાધારણ, જૈસા-તૈસા કૈસા મી	ordinary of any sort
જેવે	જેવે	અ	જે વખતે, જ્યારે	જબ	at the time
જેહ	જેહ	અ	જે (પ)	જો	same as 'જે'
જો	જો	અ	(સશય કે શસ્ત બતાવે છે 'તો' સાથે વપરાય છે)	યદિ, અગર, જો	if
જોઈએ	જોઈએ	અ ક્રિ	'જોઈવુ' નુ વર્તમાન કાળનુ રૂપ	ચાહિએ	present tense form of 'જોઈવુ'
જોઈએ એમ	જોઈએ એમ	અ	ખપ કે જરૂર મુજબ	ચાહિએ इस तरह	according to need or require- ment
જોઈએ તેટલુ	જોઈએ તેટલુ	વિ	માગો તેટલુ, જરૂર હોય તેટલુ	ચાહિએ उतना	as much as you like
જોઈએ ત્યારે	જોઈએ ત્યારે	અ	ખપ પડે તે વખતે	ચાહિએ तब	whenever necessary
જોઈએ ત્યા	જોઈએ ત્યા	અ	ગમે ત્યા, જ્યા કહો ત્યા-જ્યા જરૂર હોય ત્યા	ચાહિએ वहाँ	wherever nec- essary
જોઈતુ	જોઈતુ	વિ	જોઈએ તેટલુ, જરૂરી	ચાહિએ उतना, जरूरी	as much as required
જોઈતુ કસ્તુ	જોઈતુ કરતુ	વિ	જરૂરી, ખપનુ	जरूरी	whatever is necessary
જોઈતુ કસ્તુ	જોઈતુ કારવતુ	વિ	જુઓ 'જોઈતુ કસ્તુ'	जरूरी	see 'જોઈતુ કસ્તુ'
જો કે	જો કે	અ	1 અગર જો 'છતા' અથવા 'પણ' સાથે સબધમા વપરાય છે	यद्यपि, अगरचे	although

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 'બલકે' થી ઊલટો ભાવ બતાવવા વપરાય છે	फिर भी	on the contrary, on the other hand
જોખ	जोख	पु स्त्री न	સુખ, આનંદ જુઓ 'જોડ' 1 જોખવાનું ડાટલું 2 જોખવાની રીત, તોલ 3 ત્રાજુ	सुख, आनंद जोक जोखने का बाट तौल, जोख तराजू	happiness, joy see 'જોડ' a weight method of weighing scales (for weighing)
જોખમકારક	जोखमकारक	वि	જોખમવાળું, જોખમ-પહોચાડે એવું	जोखिमी	risky
જોખમકારી	जोखमकारी	वि	જુઓ 'જોખમકારક'	जोखिमी	see 'જોખમકારક'
જોખમદાર	जोखमदार	वि	જવાબદારીવાળું	जिम्मेदार	responsible
જોખમદારી	जोखमदारी	स्त्री	જવાબ દેવાનું જોખમ અથવા ફરજ, જુમ્મે-દારી, જવાબદારી	जिम्मेदारी	responsibility, accountability
જોખમાવું	जोखमावु	अ क्रि	જોખમમા આવવું, જોખમ કે નુકસાન થવું	नुकसान पहुँचना	to incur, to risk
જોખવું	जोखवु	स क्रि.	1 તોળવું, વજન કરવું 2 (લા) મનમા તોળીને વિચારી લેવું	जोखना, तौलना मन में अच्छी तरह विचार कर लेना	to weigh to mentally weigh the consequences
જોગ	जोग	वि अ न	જોગ, લાયક, ઇજાત 1 બાબત, ફળ, કામ 2 માટેનું, - ના તરફનું 3 પ્રતિ, તરફનું યોગ	योग्य, लायक फल, काम -की ओर का, जोग, -की तरफ का -के प्रति योग -	proper, fitting matter, result for for to coincidence

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા- કો-	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જોગમાયા	જોગમાયા	સ્ત્રી	1 સૃષ્ટિને ઉત્પન્ન કરનારી ઇશ્વરની મોટી શક્તિ, જગતના કારણરૂપ ઇશ્વરની માયા 2 દુર્ગા	યોગમાયા દુર્ગા	God's impulse which creates the universe Goddess Durga
જોગવટો	જોગવટો	પુ	જોગીપણ, સન્યાસ	સન્યાસ	renunciation, assuming the status of a sanyasi
જોગવાઈ	જોગવાઈ	સ્ત્રી	ગોઠવણ, બંધોબસ્ત	વ્યવસ્થા, પ્રબંધ, ઇતજામ	provision
જોગાનજોગ	જોગાનજોગ	અ	જોગ આવી મળવાથી, બનવાકાળ હોવાથી, સજોગવશાત્	યોગાનુયોગ, દૈવયોગ સે	by coincidence
જોગુ	જોગુ	વિ	લાયક, જોગ, ઇજાતુ	દેખિણ 'જોગ'	see 'જોગ'
જોટડી	જોટડી	સ્ત્રી	ઝોટડી, જવાન- પહેલવેતરી ભેસ	જવાન મેંસ, ઔસર	young and sturdy buffalo
જોટડુ	જોટડુ	ન	જુઓ 'જોટડુ'	જવાન મેંસ, ઔસર	see 'જોટડુ'
જોટુ	જોટુ	ન	જુઓ 'જોટડુ'	જવાન મેંસ	see 'જોટડુ'
જોટો	જોટો	પુ	1 બે સરખી વસ્તુની જોડ 2 એક વસ્તુને બધી રીતે મળતી આવતી બીજી વસ્તુ	જોડા જોડી	twin pair (esp when exact)
જોડ	જોડ	સ્ત્રી	1 બે સરખી વસ્તુઓની જોડી 2 હરીફાઈ કે સરખામણીમા બરાબર ઊતરે તેવી બીજી વસ્તુ	જોડ, જોડા જોડ (પ્રતિયોગિતા)	pair equal, peer

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			3 तबूरांना चार तारमाना वयला वे तार	तबूरा के बीच के दो तार	two middle strings of a musical instrument
			4 संगति, सोपत, जोडाण	सगत, सयोजन	companionship, company
जोडण	जोडकण	न	1 गमे तेम जोडी अढेलु गीत के कविता 2 जोडी अढेली वात	तुकबदी मनगदत बात	impromptu piece of verse a cooked up story
जोडु	जोडकु	न	1 अेकजीणनी साथे वणगेली वस्तुओ 2 जोडे अवतरेला वे बाण्ड (व व मा)	युग्म जुडवॉ	a pair twin
जोडणी	जोडणी	स्त्री	1 जोडकाम 2 शब्द लખवा अक्षरने जोडवानी शीत 'स्पेलिंग'	जोडने की क्रिया वर्तनी	joining spelling
जोडवु	जोडवु	स क्रि	1 जुडी वस्तुओनो सवध करवो— साधवी, भेगु करवु, वणगाडवु 2 छूटा भागो के घटकेने भेगा करी अेक आणी रथना करवी 3 लग्गाडवु, जोतवु 4 वाहनने के ओणरने वण्ड, घोडो जोतीने तैयार करवु 5 जोट के नुकसान भरी आपवु, ખૂટતુ પૂરુ करी आपवु, ભરખાઈ करवी	जोडना, सीना, चिपकाना, मिलाना तरतीब से बैठाना, बैठाना काम पर लगाना जोतना (बैल), वाहन या सवारी तैयार करना भरना, नुकसान या घाटे की पूर्ति करना या भरना	to join, to connect to unite (into a whole) to put together to yoke together to pay up

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			6 એકસાથે બાંધને લગાડવું, સાધવું	સીના, જોડના	to append, attach
			7 રચવું, ઘડવું	રચના કરના, ઘડના	to write, create
		ન	8 એકઠું કરવું જોડું, જોડકું	ઇકઠા કરના જોડા, જુડવો	to collect twin, pair
જોડાક્ષર	જોડાક્ષર	પુ	બે અથવા વધારે જોડવાથી બનેલો એક સચુક્ર અક્ષર	યુક્તાક્ષર	conjunct consonant
જોડાજોડ	જોડાજોડ	અ	પાસપાસે, અડોઅડ	પાસ-પાસ, સટકર	close, adjacent
જોડાણ	જોડાણ	ન	1 સાધો, સધાન 2 એકઠું કરવું, ભેગું કરી દેવું 3 એકઠા થવું, જોડાય તે	જોડ, સધાન ઇકઠા કરના ઇકઠા હોના, જુડના	joint merger combination collection
જોડીદાર	જોડીદાર	પુ	1 સાથી 2 બરાબરિયો	સાથી જોડીદાર	help-mate comrade match
જોડો	જોડો	પુ	1 પગરખુ 2 બે સરખી વસ્તુઓની જોડ	જૂતા દેખિય 'જોડો', જોડા	foot-wear, shoe see 'જોડો'
જોત	જોત	સ્ત્રી	1 તેજ, પ્રકાશ 2 દીવાની શિખા	જ્યોતિ, પ્રકાશ દીયે કી લૌ, ટેમ	light flame
જોતજોતા	જોતજોતા	અ	ક્ષણમા, પલકવારમા	દેખતે હી દેખતે, ક્ષણ મેં, દેખતે-દેખતે	in an instant
જોતજોતામા	જોતજોતામા	અ	જુઓ 'જોતજોતા'	દેખિય 'જોતજોતા'	see 'જોતજોતા'
જોતર	જોતર	ન	ધૂસરીની સાથે બળદને જોડવાનો પટો	જાતો	yoke-strap
જોતરવું	જોતરવું	સ ક્રિ	જોતર વડે પશુને ધૂસરી સાથે જોડવું	જોતના	to yoke

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા. કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
જોબન	जोबन	ન	જુવાની	जवानी, यौवन	youth
જોબનવતુ	जोबनवतु	વિ	જોબનવાળુ	यौवनशाली	youthful
જોબનિયુ	जोबनियु	ન	જોબન (લાલિત્યવાચક)	यौवन	youth (literary sense)
જોમ	जोम	ન	જુસ્સો, બળ, શક્તિ	बल, शक्ति	strength, vigour
જોરજબરાઈ	जोरजबराई	સ્ત્રી	જબરદસ્તી, જુલમ	जबरदस्ती, जुल्म	force, pressure, tyranny
જોરજબરી	जोरजबरी	સ્ત્રી	જુઓ 'જોરજબરાઈ'	जबरदस्ती, जुल्म	violence, tyranny
જોરજુલમ	जोरजुल्म	પુ	બળાત્કાર, જુલમ	बलात्कार, जुल्म	force, oppression
જોરુ	जारु	સ્ત્રી	બૈરી, વહુ	जोरु, पत्नी	wife
જોવડાવવું	जोवडाववु	સક્રિ	'જોવું' નું પ્રેરક	'जोवु' का परणार्थक रूप, दिखाना	caus of 'जोवु'
જોવાવું	जोवावु	અક્રિ	'જોવું' નું કર્મણિ	देखा जाना	pass of 'जोवु'
જોવું	जोवु	સક્રિ	1 દેખવું, આખ વડે જાણવું 2 (લા.) તપાસવું, વિચારવું, ધ્યાન આપવું 3 વાચવું, અભ્યાસ કરવો 4 અખતરો કરવો, પ્રયોગ કરવો (બીજા ક્રિયામદો સાથે સહાયકારક)	देखना सोचना, ध्यान देना, जाँचना पढना, अभ्यास करना प्रयोग करना	to see to examine, to think to study, read to try out (when used as an auxiliary)
જોશીલુ	जोशीलु	વિ	જોશવાળુ, જોસદાર	जोशीला, जोरदार	forceful
જોષ	जोष	પુ	જુઓ 'જોશ'	जोश	see 'जोश'
જોષી	जोषी	પુ	જુઓ 'જોશી'	जोशी	see 'जोशी'

अंग्रेजी पदान्	हिंदी पदान्	व्या. कौ. अर्थ	देवनागरी लिखतारा	व्या. कौ. अर्थ	अंग्रेजी पदान्	हिंदी पदान्
गणतन्त्र	जोहोका	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका
गणतन्त्र, sole authority	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, harsh rule	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, as per order	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, autocracy, tyranny	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, autocratic caste	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, one having knowledge, knowing	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, where at which place	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, more from the time when	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, of the time of (or when) so long as	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, when	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, sometime or other at any time	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज
गणतन्त्र, where, at which place	जोहोका, राज	राज्य	राज्य	राज्य	राज्य	जोहोका, राज

ગુજરાતી શબ્દ	देवनागरी लिप्यंतरण	व्या- को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
જ્યા ત્યા	ज्या त्या	अ	1 જાણીતણી, દરેક જગાએ 2 મુશ્કેલીથી 3 કોઈ પણ રીતે	जहाँ-तहाँ, हर जगह	everywhere, at all places with difficulty anyhow
જવાલા	ज्वाला	स्त्री	અગ્નિની શિખા	आग की लपट, ज्वाला	flame
જવાલામુખ	ज्वालामुख	न	જવાલામુખી પર્વતનું મોં	ज्वालामुखी पर्वत का मुख	mouth of a volcano
જવાલામુખી	ज्वालामुखी	पु	જેના મુખમાથી જવાલા નીકળે છે એવો - બળતો પહાડ	ज्वालामुखी	volcano
ઝકઝોલવું	झकझोलवु	स क्रि	રેલછેલ કરવી	आनद की रेलपेल करना	to have abun- dance of joy
ઝકઝોળ	झकझोळ	वि स्त्री	મશગૂલ રેલછેલ (આનદની)	लीन रेलपेल (आनद की)	engrossed abundance (of joy)
ઝકઝોળવું	झकझोळवु	स क्रि	જુઓ 'ઝકઝોલવું'	देखिए 'झकझोळवु'	see 'झकझोळवु'
ઝગઝગ	झगझग	अ	ખૂબ તેજ મારતું હોય તેમ	झलझल	brightly
ઝગઝગવું	झगझगवु	अ क्रि	ઝગઝગ થવું	जगमगाना, झलझलाना	to shine brightly
ઝગઝગાટ	झगझगाट	पु	ઝગઝગ થતો પ્રકાશ	जगमगाहट, चमक	glitter, brilliance
ઝગવું	झगवु	अ क्रि	ઝગમગ થવું	जगमगाना, झलकना	to glitter
ઝગાર	झगार	पु	ઝગઝગાટ	जगमगाहट	glitter, brilliance
ઝગારો	झगारो	पु	જુઓ 'ઝગાર'	झलक	see 'झगार'
ઝઘડવું	झघडवु	अ क्रि	લડવું, ટટો કરવો, સામે બોલાબોલી કરવી	झगडना, लडना	to quarrel, to fight

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝઘડાખોર	झघडाखोर	वि	ટટાખોર, ઝઘડવાના સ્વભાવનુ	झगडालू	quarrelsome
ઝઘડો	झघडो	पु.	લડાઈ, ટટો	झगडा, टटा, लडाई	quarrel, squabble
ઝઝાટ	झझणाट	पु	1 મોટો ઝણકારો 2 ઝમઝમાટ, બળતરા 3 ધમધમાટ	झनझनाहट, झनकार जलन, झुनझुनी झन्नाहट	loud jingling burning sensation sound as of shaking
ઝઝણી	झझणी	સ્ત્રી.	1 ખાલી 2 ક્રોધ કે રીસની લાગણી, ઝઝ	झुनझुनी, झनझनी क्रोध या रीस का आवेश	numbness anger, rage
ઝઝૂમવુ	झझूमवु	अ क्रि	1 ઉપર લથી પડવુ, બહાર કે ઉપરથી ઝૂંચવુ 2 ટમટમી રહેવુ, જોર કર્યા કરવુ	ऊपर लटकना, बाहर या ऊपर से-लटकना, टँगना, झूमना (बादल) टूट पडने को तैयार होना, दबाव डालना (ला)	to project and hang out, to overhang, to lean outwards to be imminent, to keep on giving a fight
ઝટ	झट	अ.	તરત, તાબડતોબ	झट, तुरत	immediately
ઝટકામણી	झटकामणी	न	1 ઝાટકવાની ક્રિયા 2. ઝાટકવાથી પડતો કચરો, ઝાટકણ 3 ઝટકામણી	फटकना फटकन फटकने की मजदूरी	act of winnowing waste thrown off as a result of winnowing money charged for winnowing
ઝટકામણી	झटकामणी	સ્ત્રી	ઝાટકવાનુ મહેનતાણુ	फटकने की मजदूरी	money charged for winnowing
ઝટપટ	झटपट	अ	ઝટઝટ	झट-झट	quickly

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝટોઝટ	झटोझट	अ	ઝટઝટ	झट-झट	quickly
ઝડકામણ	झडकामण	न	જુઓ 'ઝટકામણ'	देखिए 'ઝટકામણ'	see 'ઝટકામણ'
ઝડકામણી	झडकामणी	स्त्री	જુઓ 'ઝટકામણી'	फटकने की मजदूरी	see 'ઝટકામણી'
ઝડતી	झडती	स्त्री	1 ટાચ, જપતી 2 પોલીસની તપાસ 3 બારીક તપાસ	जाच, बरामद करना पुलिस की तलाशी तलाशी	search police search thorough search
ઝડપ	झडप	स्त्री	1 ત્વરા, વેગ 2 ઝડપવાની ક્રિયા 3 ઝાપટ, અડફટ	ત્વરા, વેગ झपटने की क्रिया भडप, टक्कर	speed, velocity swoop (of a bird of prey) brush, graze
ઝડપબધ	झडपबध	अ	ઝડપથી, સપાટાબધ	झपाटे से, तेजी से	quickly, speedily
ઝડપભેર	झडपभेर	अ	જુઓ 'ઝડપબધ'	झपाटे से	see 'ઝડપબધ'
ઝડપવુ	झडपवु	स क्रि	એકદમ પકડવુ, ઓચિતુ ઝૂટવુ-લઈ લેવુ	झडपना, झपटना	to seize, to snatch away
ઝડપી	झडपी	वि	ઝડપવાળુ	वेगवान, तेज	speedy, quick
ઝડાઝડી	झडाझडी	स्त्री	ટપાટપી, તકરાર	तकरार	quarrel, wrangling
ઝડી	झडी	स्त्री	1 એકસપાટે-જોસભેર વરસવુ તે 2 રમઝટ, ઝપાટો	झडी सपाटा, झडी	continuous shower of rain quick succession of anything
ઝણઝણ	झणकार	पु	ઝણઝણ અવાજ	झकार, झनकार	resonance
ઝણઝણે	झणकारो	पु	જુઓ 'ઝણઝણ'	झकार	see 'ઝણઝણ'
ઝણઝે	झणको	पु	જુઓ 'ઝણઝણ'	झनकार	see 'ઝણઝણ'
ઝસઝસાવુ	झणझणवु	अ क्रि	1 ઝાઝણી-ખાલીના જેવી અસર થવી, તમતમવુ	झुनझुनी होना	to have the feeling of numbness

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 अक्षरपु	झनझनाना, झुनझुनाना	to make jingling sound
अक्षर	झणझणाट	पु	1 अक्षरानी असर, अमअमाट 2 अक्षररो	झुनझुनी का असर झनकार	effect of tingling jingling sound
अक्षरशाली	झणझणाटी	स्त्री	अक्षरशाल, अक्षरी जेवी तीव्र असर	झुनझुनी का असर	effect of tingling
अक्षरी	झझणी	स्त्री	1 अक्षरी, ખાલી 2 रीस	झुनझुनी क्रोध	numbness, tingling anger
अनून	झनून	स्त्री, न	गाडो गुस्सो	जुनून, जोश-जुनून	fanatical fervour
अनूनी	झनूनी	वि	अनूनवाणु	जुनूनी, जनूनी	having fanatical fervour
अप	झप	अ	अट	झट	quickly
अपअप	झपझप	अ	अट अट	झटझट	quickly
अपट	झपट	स्त्री	1 अपाटो, ઉતાવળ 2 अपपी लेवु ते, अप 3 भूतप्रेत ઈની અડક્ટ 4 અડક્ટ	झपाटा, सपाटा झपट्टा प्रेतबाधा टक्कर	quickness, haste seizing, snatch- ing possession by evil spirit etc collision
अपटपु	झपटपु	स क्रि	1 अपट-उतावण કરવી 2 अपपु, अटपु 3 मतपु	उतावली/जल्दी करना झपटना, झडपना मंत्रित करना	to hurry, to make haste to snatch, to pounce upon to charm, to enchant
अपटापु	झपटापु	अ क्रि	1 अपटमा आवपु, વચ્ચે આવી જવુ	टकराना	to come in the way, to collide

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. क्रो.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 (ला) 1 भरवु, इसावु	फँसना, उलझना	to be caught or to be entangled in
अपवु	झपवु	अ क्रि	सजनु-शात रडेवु	शान्त रहना	to keep quiet, to keep away from mischief
अमाअम	झपाझप	स्त्री	1 मारामारी, टटो 2 अपाअपी, अतल	मारामार, टटा, झडपा-झडपी मार-काट, कतल	squabble, skirmish slaughter
अपाअपी	झपाझपी	स्त्री	जुओ 'अमाअम'	देखिए 'अपाअम'	see 'अपाअम'
अपाटवु	झपाटवु	स क्रि	1 अपाटो इरवो 2 मारवु, अपाटामा लेवु 3 अट अट, थापीने पावु	जोर मारना, रपटना (चलना) मारना, चपेटना जल्दी जल्दी खाना, ठूसना	to speed up to beat up to gobble, eat hurriedly
अपाटो	झपाटो	पु	1 अडप, वेग 2 जोरमा इरेलो प्रहार, सपाटो 3 अडइट	वेग, झपाटा, फर्राटा झटका टक्कर	quickness, speed hard blow collision
अपेट	झपेट	स्त्री	जुओ 'अपट'	देखिए 'अपट'	see 'अपट'
अपेटवु	झपेटवु	स क्रि	जुओ 'अपटवु'	देखिए 'अपटवु'	see 'अपटवु'
अपेटो	झपेटो	पु	जुओ 'अपाटो'	देखिए 'अपाटो'	see 'अपाटो'
अपोअम	झपोझप	अ	अपाटशी, अपअम	तेजी से, झटझट	quickly, swiftly
अभडवु	झबकवु	अ क्रि	1 थमडवु, थोडवु 2 अभडवु	चमकना, चौंकना झिलमिलाना	to be startled to twinkle
अभडरो	झबकारो	पु	प्रकाश-नो अभूओ	प्रकाश का झिलमिलाना	flash of light
अभओणवु	झबकोळवु	स क्रि	पाशीमा जोणवु -अभोणवु	बीरना, डुबीना चुभोरना (पानी में)	to dip, to soak in water

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઝબલુ	झबलु	ન	નાના છોકરાનું પહેરણ	झगा, झंगुला	frock (of a child)
ઝબાકો	झबाको	પુ	ઝબકારો	कौंध, प्रकाश	flash of light
ઝબૂક	झबूक	અ સ્ત્રી	રહી રહીને ચમકે તેમ ઝબૂકો	झिलमिलाते हुए कौंध (बिजली)	twinklingly flash
ઝબૂકવું	झबूकवुं	અ ક્રિ	ઝબૂક ઝબૂક પ્રકાશવું	झिलमिलाना	to twinkle, to flash
ઝબૂકો	झबूको	પુ	ઝબકારો	कौंध (बिजली)	flash
ઝબે	झबे	સ્ત્રી	વધેરવું-ભોગ આપવો તે, કતલ	बलिदान, हत्या	offering as sacrifice, killing, slaughter
ઝબો	झबो	પુ	લાખો અને ખૂલતો ડગલો	लबा और ढीला-ढाला कोट, चोगा, चोला	loose, long jacket
ઝબોઝબ	झबोझब	અ	ઝબોઝબ	झट-झट	quickly, swiftly
ઝબોળવું	झबोळवुं	સ ક્રિ	જુઓ 'ઝબોળવું'	देखिए 'झबोळवुं'	see 'ઝબોળવું'
ઝબો	झबो	પુ	1 જુઓ 'ઝબો' 2 પતાની એક રમત	देखिए 'झबो' पत्तों का एक खेल	see 'ઝબો' kind of game of playing cards
ઝબલુ	झबलु	ન	જુઓ 'ઝબલુ'	देखिए 'झबलु'	see 'ઝબલુ'
ઝબા	झभा	પુ	જુઓ 'ઝબો'	चोगा, चोला	see 'ઝબો'
ઝબબો	झभभो	પુ	જુઓ 'ઝબો'	चोला	see 'ઝબો'
ઝમકદાર	झमकदार	વિ	ઝમકવાળું	चमकदार, भमकदार	lustrous, having jingling sound
ઝમકવું	झमकवुं	અ ક્રિ	ઝમકાર-મધુર રણકાર શવો	झमकना	to jingle sweetly
ઝમકાર	झमकार	પુ	(રવ) રણકો. ઠણકો	'झमक' आवाज	jingle, twang

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝમકારો	झमकारो	पु	જુઓ 'ઝમકાર'	देखिए 'झमकार'	see 'ઝમકાર'
ઝમક્રો	झमक्रो	पु	જુઓ 'ઝમકાર'	देखिए 'झमकार'	see 'ઝમકાર'
ઝમઝમ	झमझम	अ	1 રણકે તેમ	झम-झम, छम-छम	with a jingling sound
			2 ઝીણુ ઝીણુ બળે તેમ	धीमी-धीमी जलन हो ऐसे	with a burning sensation
		पु	કાબા પાસેનો પવિત્ર કૂવો	काबे का कुँआ, 'जमजम'	holy well near the <i>Caaba</i>
ઝમઝમાટ	झमझमाट	पु	ઝમઝમવુ તે	झमझमाना	loud jingling, sensation caused by eating something hot
ઝમવુ	झमवु	अ क्रि	પ્રવાહીનુ જરા જરા થઈને બહાર ઝરવુ	द्रव का बूँद-बूँद होकर नन्हें-नन्हें छेदों से बाहर निकलना, रिसना	to ooze, to drip
ઝરખ	झरख	न	જરખ, એક જગલી પ્રાણી, ધોરખોદિયો, તરસ	लकडबग्घा	striped hyena
ઝરડવુ	झरडवु	स क्रि	(રવ)ઝરડ એવા અવાજ સાથે કાડવુ (કમડુ)	कपडा चीरना	to tear cloth with peculiar sound of tearing
ઝરડુ	झरडु	न	ઝાખરુ, કાટાવાળુ ડાળુ	कॉटेदार झाड, झखाड	thorny bush or branch
ઝરણ	झरण	न	જમીન કે પહાડમાથી ઝરતો પાણીનો વહેણો	झरना, स्रोत	spring
ઝરણી	झरणी	स्त्री	નાનુ ઝરણ	छोटा झरना	small spring
ઝરણુ	झरणु	न	જુઓ 'ઝરણ'	झरना, स्रोत	see 'ઝરણ'

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝરમર	झरमर	न	1 स्त्रीनी डोटनु એક સોનાનુ ઘરેણુ 2 સ્ત્રીઓના પગનુ એક ઘરેણુ 3 એક જાતનુ ઝીણુ કપડુ	स्त्रियों का गले का एक गहना स्त्रियों का पॉव का एक गहना एक बारीक कपडा	a variety of necklace a kind of anklet a kind of fine fabric
		સ્ત્રી	વરસાદની ફરફર	बारिश की फुहार, बूदाबूदी	drizzle
		અ	ઝીણે ઝીણે છાટે (વરસવુ)	रिमझिम	drizzle (vb)
ઝરમર ઝરમર	झरमर झरमर	અ	ઝરમર	रिमझिम	in a drizzle
ઝરવુ	झरवु	અ ક્રિ	(પ્રવાહીનુ) ધીમે ધીમે બહાર નીકળવુ, સવવુ	झरना	to ooze
ઝરુખો	झरुखो	પુ	બારી બહાર કાઢેલુ ઝઝૂમતુ બાધકામ, છજુ, જરુખો	झरोखा	balcony
ઝરેણી	झरेणी	સ્ત્રી	જુઓ 'ઝઝરણી', ખાલી	देखिए 'ઝઝરણી' झुनझुनी	see 'ઝઝરણી', numbness
ઝલક	झलक	સ્ત્રી	ઓપ, ચળકાટ	झलक, चमक	glitter, polish
ઝલકદાર	झलकदार	વિ	ચળકતુ	चमकदार	glittering, polished
ઝલકવુ	झलकवु	અ ક્રિ	1 તેજ મારવુ, ચળકવુ 2 (લા) પોત પ્રકાશવુ	चमकना, झलकना अपनी असली प्रकृति दिखाना (ला)	to shine brightly to prove oneself
ઝલાવુ	झलावु	અ ક્રિ	1 'ઝાલાવુ' નુ કર્મણી 2 અક્કડ થઈ જવુ, ઉલનચલન બંધ થવુ, રહી જવુ	पकडा जाना अकड जाना, काठ होना	passive of 'ઝાલાવુ' to be stiff, to be unable to move

गुजराती शब्द	देवनागरी- लिप्यंतरण	व्या- को-	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अवेर	झवेर	न	1 જવાહિર 2 (લા) પાણી, દમ	जवाहिर, जौहर पानी, शक्ति	jewellery (fig) mettle, spirit
अवेरात	झवेरात	न	1 હીરા, માણેક, મોતી 2 જડાવ દાગીના 3 બળ, સત્વ, દમ	जवाहिरात, रत्न, हीरा, मोती जडाऊ जेवर बल, खूबी, जौहर	gems, precious stones ornaments studded with jewels spirit, mettle
अवेरी	झवेरी	पु	अवेरात-नो वेपारी	जौहरी	jeweller
अण्ड	झळक	स्त्री	ચળકાટ	झलक, चमक	brightness, glitter
अण्डवु	झळकवु	स क्रि	તેજ મારવુ, પ્રકાશવુ, ચળકવુ	झलकना, चमकना	to shine, to glitter
अण्डारो	झळकारो	पु	તેજનો ચળકારો	प्रकाश की झलक	flash of light
अण्ड्री	झळकी	स्त्री	1 અણક, ભભક 2 કોઈ પણ અસર સહેજસાજ જણાવી તે	झलक, चमक झलक	splendour slight effect
अण्ण	झळझळ	अ	તેજથી અણકતુ હોય તેમ	झलझल	brightly
अण्णवु	झळझळवु	अ क्रि	1 અણ્ણ થવુ 2 (લા) આજી નાખવુ	झलझल होना चकित कर देना	to shine brightly (fig) to dazzle
अण्णાટ	झळझळाट	पु	અણ્ણાટ	झलझलाहट, जगमगाहट	glitter, splen- dour
		अ	अण्ण थए रहे तेम	झलझल	glitteringly
अण्णियु	झळझळियु	न	1 આખમા અમતુ પાણી-આસુ 2 અણ્ણુ	ऑसू धुधला प्रकाश, झूटपुटा	tear twilight

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अटडवु	झाटकवु	स क्रि	1 सूपडा वडे ॐपणवु - सोवु 2 ज़ोरशी ढभेरवु, अडपटवु 3 (ला) ढभूळ ठपडो आपवो	सूप से साफ करना, फटकना झटकारना, झाडना फटकारना, उलटी-सीधी सुनाना (ला)	to winnow to dust off to rebuke strongly
अटडो	झाटको	पु	1 ज़ोरशी ॐगामी डरेलो डप-धा 2 आथडो, ज़ोरबध ढेथ 3 (ला) धानी माडुड थतु दुःख	झटका, झटके से - घाव जोर से खींचना, धक्का - घाव के जैसी पीडा	sudden, full stroke jerk, sudden pull (fig) sudden pain like that of a wound
अड	झाड	न	1 वृक्ष 2. धारुणानानी अेड थीण	पेड एक आतिशबाजी, झाड	tree a kind of fireworks
अडपान	झाडपान	न	वनस्पति मात्र	पौधे-पत्ते	vegetation
अडपालो	झाडपालो	न	जुओ 'अडपान'	देखिए 'अडपान'	see 'अडपान'
अडवु	झाडवु	न स क्रि	नानु अड 1 अडुथी वाणवु, डथरो थडवो 2. अटडवु, ढभेरवु 3 ॐजरी नाधव	छोटा पेड झाडना, बहारना फटकना झाड-फूंक करना	small tree to sweep to thrash, to shake up to exorcize evil spirit by casting a spell
अडपार	झाडपार	स्त्री	नुध	फटकारना, डँटना गुदा	(fig) to rebuke anus
अड	झाडी	स्त्री	1 अड, वेला, धास ड नो भरवो	झाडी	thicket, wild growth of vegetation

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા- કો.	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			2 જગલ	जगल	forest
ઝડુ	झाड़ु	ન	1 મોટો સાવરણો (જેવો કે ભગી વાપરે છે) 2 સાવરણી 3. ઝાટકણી, ઠપકો, અપમાન, અનાદર	बड़ी झाड़ू बुहारी झाड़-फटकार, अपमान, अनादर, भर्त्सना, डाट	large broom broom severe criti- cism, repri- mand, insult, disrespect
ઝડુવાળી	झाड़ुवाळी	સ્ત્રી	ઝડુ લઈ (રસ્તો) વાળનાર કામદાર સ્ત્રી, ભગિયારા	झाड़ूवाली, भगिन, मेहतरानी	woman em- ployed for sweeping road etc , female sweeper
ઝડુવાળો	झाड़ुवाळी	પુ	ઝડુ લઈ (રસ્તો) વાળનાર કામદાર, ભગી	झाड़ूवाला, भगी, मेहतर	sweeper
ઝાડો	झाड़ो	પુ	1 વિષ્ટા 2 દસ્ત 3 બારીક તપાસ 4 ઝાડવુ- ઊજણી નાખવી	झाड़ा, मैला, गू दस्त, जुलाब गहरी जाच, तलाशी झाड़-फूक करना	excreta, stools motion close investiga- tion, search exorcising evil spirit by casting spell
ઝાડોપેશાબ	झाड़ोपेशाब	પુ	શૌચ, મળની ઉત્સર્ગક્રિયા	शौच, मलौत्सर्ग	passing urine and stools
ઝાનમ	झानम	ન	નરક, જહાનમ, જહન્નમ, દોજખ	जहन्नम, नर्क	hell
ઝાપટ	झापट	સ્ત્રી	1 ઝડકટ 2 ભૂતપિશાચની ઝપટ	टक्कर प्रेतबाधा, झपेटा	by-blow, brush, graze being possessed by an evil spirit

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝળહળ	झळहळ	अ	જુઓ 'ઝળમળ'	झलझल	see 'ઝળમળ'
ઝળહળવુ	झळहळवु	अ क्रि	જુઓ 'ઝળમળવુ'	झिलमिलाना	see 'ઝળમળવુ'
ઝળહળાટ	झळहळाट	पु	જુઓ 'ઝળમળાટ'	झलझलाहट, चमक	see 'ઝળમળાટ'
ઝળળ	झळळ	अ	તેજથી ઝળકતુ હોય તેમ	चमके ऐसे	brightly, glitteringly
ઝળાઝળા	झळाझळा	अ	ઝળઝળાટ	तेज का अबार, झलाझल, चमक के साथ	brightly, glitteringly
ઝળેળો	झळेळो	पु	ચામડી બળવાથી ઊઠેલો ફોલો, ઝરેળો	फफोला	blister caused by burn
ઝખવાણ	झखवाणु	वि	ભોઠુ, ખાશિયાણ	खिसियाना, झेंपू	ashamed, abashed
ઝખવાવુ	झखवावु	अ क्रि	1 ઝખુ પડવુ 2ભોઠુ પડવુ	धुंधला पडना खिसियाना	to be pale or dim to be abashed
ઝખવુ	झखवु	स क्रि	ઝખના ડરવી	लालसा करना	to long, to desire
ઝઝટ	झझट	स्त्री	ઝઘડો, પચાત, નકામી પીડા	झझट, पचडा, बखेडा	quarrel, trouble, bother
ઝઝ	झझा	स्त्री	પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ	झझा, तेज हवा की आवाज या अँधड के साथ होने वाली वर्षा की आवाज	whistling sound of wind or of wind and rain
ઝઝવાત	झझावात	पु	વરસાદ ને વટોળિયાનુ તોફાન	ऑंधी, अंधड	stormy wind and rain
ઝડી	झडी	स्त्री	નાનો ઝડો	झडी	small flag or banner
ઝડો	झडो	पु	1 ઝડો, દવજ	झडा, निशान, पताका	flag

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 अजुषे 3 पक्ष के तेनी आगेवानी के दोरवणी	आदोलन (ला) कोई पक्ष या उसकी अगुआई	campaign faction or its leadership or its guidance
अपलाववु	झपलाववु	अ क्रि	थाछेभे करीने छूई पडवु —साहस करवु	जीवट से किसी काम में कूद पडना, साहस करना	to take a plunge, to venture
अपावपुं	झपाववु	अ क्रि	जुओ 'अपलाववु'	देखिए 'अपलाववु'	see 'अपलाववु'
अकअमाक	झाकझमाक	पु	अक, ममके	झलक, चमक	splendour, lustre
अकअमाण	झाकझमाळ	वि	उज्ज्वल, अगअगतु, देदीप्यमान	झकाझक, झलाबोर	bright, splendid
अकमअेण	झाकमझोळ	वि	स्वच्छ अने सुस्पष्ट	स्वच्छ और सुस्पष्ट	clear and distinct
		पु	महालवु ते, आनद	आनद	merry-making, enjoyment
अकण	झाकळ	न	ओस, तुषार	शबनम, ओस, तुषार	dew
अअु	झाझु	वि	पुञ्जण	ज्यादा, अतिशय	large in bulk, much
अअेरु	झाझेरु	वि	अअु (लातित्यवाचक)	ज्यादा	(fig) much, plenty
अटअणी	झाटकणी	स्त्री	1 अटअवु-सूपडा वडे सोवु ते 2 अटअवानु मलेनताअु 3 सभत ठपके	सूप आदि से साफ करना, फटकना फटकने का दाम या मजदूरी फटकार, झिडकी, डाट	winnowing wages for winnowing scolding, reprimand

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝાટકવું	झाटकवु	स क्रि	1 સૂપડા વડે ઊપણવું - સોવું 2 જોરથી ખખેરવું, ઝાપટવું 3 (લા)ખૂબ ઠપકો આપવો	सूप से साफ करना, फटकना झटकारना, झाड़ना फटकारना, उलटी-सीधी सुनाना (ला)	to winnow to dust off to rebuke strongly
ઝાટકો	झाटको	पु	1 જોરથી ઊગામી કચેલો કાપ-ઘા 2 આચકો, જોરબધ ખેચ 3 (લા)ધાની માફક થતું દુઃખ	झटका, झटके से - घाव जोर से खींचना, धक्का - घाव के जैसी पीडा	sudden, full stroke jerk, sudden pull (fig) sudden pain like that of a wound
ઝાડ	झाड	न	1 વૃક્ષ 2 દારૂખાનાની એક શીજ	पेड एक आतिशबाजी, झाड	tree a kind of fireworks
ઝાડપાન	झाडपान	न	વનસ્પતિ માત્ર	पौधे-पत्ते	vegetation
ઝાડપાલો	झाडपालो	न	જુઓ 'ઝાડપાન'	देखिए 'आडपान'	see 'आडपान'
ઝાડવું	झाडवु	न स क्रि	નાનું ઝાડ 1 ઝાડુથી વાળવું, કચરો કાઢવો 2 ઝાટકવું, ખખેરવું 3 ઊજારી નાખવી 4 (લા) ઠપકો આપવો	छोटा पेड झाड़ना, बुहारना फटकना झाड-फूँक करना फटकारना, डौटना	small tree to sweep to thrash, to shake up to exorcize evil spirit by casting a spell (fig) to rebuke
ઝાડાવાટ	झाडावाट	स्त्री	ગુદા	गुदा	anus
ઝાડી	झाडी	स्त्री	1 ઝાડ, વેલા, ઘાસ ઇ નો ભરાવો	झाडी	thicket, wild growth of vegetation

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યंतरण	વ્યા- કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
			૨ જગલ	जगल	forest
ઝાડુ	झाडु	ન	૧ મોટો સાવરણો (જેવો કે ભગી વાપરે છે) ૨ સાવરણી ૩ ઝાટકણી, ઠપકો, અપમાન, અનાદર	बडी झाडू बुहारी झाड-फटकार, अपमान, अनादर, भर्त्सना, डाट	large broom broom severe criti- cism, reprimand, insult, disrespect
ઝાડુવાળી	झाडुवाळी	સ્ત્રી	ઝાડુ લઈ (રસ્તો) વાળનાર કામદાર સ્ત્રી, ભગિયણ	झाडूवाली, भगिन, मेहतरानी	woman em- ployed for sweeping road etc , female sweeper
ઝાડુવાળો	झाडुवाळो	પુ	ઝાડુ લઈ (રસ્તો) વાળનાર કામદાર, ભગી	झाडूवाला, भगी, मेहतर	sweeper
ઝાડો	झाडो	પુ	૧ વિષ્ટા ૨ દસ્ત ૩ બારીક તપાસ ૪ ઝાડવુ- ઊજણી નાખવી	झाडा, मैला, गू दस्त, जुलाब गहरी जाच, तलाशी झाड-फूक करना	excreta, stools motion close investiga- tion, search exorcising evil spirit by casting spell
ઝાડોપેશાબ	झाडोपेशाब	પુ	શૌચ, મળની ઉત્સર્ગક્રિયા	शौच, मलौत्सर्ग	passing urine and stools
ઝાનમ	झानम	ન	નરક, જહાનમ, જહન્નમ, દોજખ	जहन्नम, नर्क	hell
ઝાપટ	झापट	સ્ત્રી	૧ અડક્ટ ૨ ભૂતપિશાચની ઝાપટ	टक्कर प्रेतबाधा, झपेटा	by-blow, brush, graze being possessed by an evil spirit

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्याको.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अपटु	झापटु	न	शोडा समय माटे परसाधनु अेकधम तूटी पडवु ते	जोरो की वर्षा, झडी	shower
अपोट	झापोट	स्त्री	जुओ 'अपट'	देखिए 'अपट'	see 'अपट'
अमर	झामर	पु	माथा अने आपनो अेक रोग	सिर और आँखों का एक रोग	glaucoma
अमरी	झामरी	स्त्री	उथेजीमा डे पगने तणिये थतो शेल्-लो	हाथ या तलवे का छाला, फोडा	boil on palm or sole of foot
अमरो	झामरो	पु.	1 जुओ 'अमरी' 2 यामडीनो अेक रोग 3 अडु पाडेली-दाडेली छटनो डडडो शरीरे धसवा-मेल धसीने डडवा वपरातो	देखिए 'अमरी' चमडी का एक रोग झाँवों	see 'अमरी' kind of skin disease piece of over- baked brick (for scrubbing skin)
अर	झार	पु	भरती	ज्वार, भाटा का उलटा	tide
अरश	झारण	न	रेण (धातुना वासण साधवानु)	धातु की जोडाई, झाल, झालना	soldering
अरवु	झारवु	स क्रि	1 ङिना पाणीनी धार वडे शेडवु 2 धीमे धीमे सिथन डरवु 3 अरश वडे धातुना वासणने साधवु, आणवु 4 डाणा डपी नाणवा, छाटवु	गरम पानी की धार से सेंकना आहिस्ता सीचना झालना (धातु) डालियों छोटना	to foment by pouring hot water to sprinkle slowly to solder to prune
अरी	झारी	स्त्री	1 नाणयावाणी टोयली	झारी, टोंटीदार लुटिया, करई	a small pitcher with a spout

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			2 पेणामाथी तणेची पस्तु डाटवानु तपेशा जेवु आणावाणु ओणर	पूरियो आदि उतारने का छेददार पलटा, छोटा झरना	a small ladle with holes as in a sieve
अरी	झारो	पु *	1 भोटी अरी (जुओ अरी) 2 (भागमा डे जमीन पर) पाणी छाटवानु नाणयावाणु वासण 3 तपूराना तार नीचे द्योडी उपर मूधवामा आवतो दीरो, जिवाणी 4 तपूरानो पित्तणनो तार, अरज-स्वरनो तार	झरना, झर (पूरियो छनने का) पानी छिडकने का नलदार बरतन, हजारा, फुहारा तबूरे के तुबे पर तारों को बँधा जाने वाला डोरा, जवारी षड्ज के स्वर का पीतल का तबूरे का तार	big ladle (see 'अरी') pitcher for watering (a garden etc) thread used in the niche for a wire in the <i>tambura</i> (musical term) brass wire of a <i>tambura</i> , wire for <i>kharaj</i> sound (musical term)
आलड	झालक	स्त्री	छोण	छलक	splash of water
आलण	झालण	न	1 आरण, रेण 2 तेनाथी करेकु धातुनु साधण 3 भोळ, पाटडी	झाल (धातु) धातु की जोडाई शहतीर	soldering metallic cement for soldering roof-beam
आलर	झालर	पु स्त्री	अेड डडोण -वाल 1 अूल, डोर 2 भोगरीथी वगाडवानी घडियाण	एक दलहन, सेम के दाने झालर, झूल झालर, घटा	kind of pulse, bean fringe, border gong
आलरी	झालरी	स्त्री	वगाडवानी नानी आलर	छोटी झालर, घडियाल	small gong

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝાલવું	झालवु	स क्रि	1 હાથમા લેવું, પકડવું, ગ્રહવું 2 કેદ કરવું, પકડી રાખવું, બંધનમા લેવું 3 જડવત રહી જાય એમ કરવું (જેમ કે, વાએ ઝાલથી કેડ ઝાલી છે)	हाथ में लेना, पकड़ना, ग्रहण करना, धरना कैद करना, धामना, बंधन में लेना अकड़ना (किसी अंग का)	to hold, to catch to arrest, to take into custody to afflict (with stiffness etc)
ઝાવા	झावा	न	ડૂબતા માણસના તરફડિયા, વલખા	डूबते आदमी की छटपटाहट	last minute frantic efforts of a drowning man to save himself
ઝવું	झावु	न	બચકુ	बतीसा	bite
ઝળ	झाळ	स्त्री	1 જવાલા, તેની આથ 2 ક્રોધનો આવેશ	ज्वाला या उसकी आँच क्रोध का आवेश, झल्लाहट (ला)	flame, its blaze spurt of anger
ઝળણ	झाळण	न	જુઓ 'ઝાલણ'	देखिए 'झाळण'	see 'झाळण'
ઝળવું	झाळवु	स क्रि	રેણ વડે સાધવું	झालना, जोड़ना (धातु)	to solder
ઝઈ	झाई	स्त्री	ઝાખી	झाँकी	glimpse
ઝખ	झाख	स्त्री	1 ઝાખાપણ 2 બટ્ટો, લાઇન	मदता, धुधलापन बट्टा, लाइन	faintness, dimness slur, blot
ઝખપ	झाखप	स्त्री	જુઓ 'ઝાખ'	देखिए 'झाख'	see 'झाख'
ઝખરુ	झाखरु	न	કાટાવાળું ડાળખું	झखाड, झाँखर	thorny branch
ઝખાશ	झाखाश	स्त्री	ઝાખાપણ	धुंधलापन	dimness

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
अખી	झाखी	स्त्री	1. अखी ज्याल डे दर्शन 2. धानुमानु जेवु ते 3. भावपूर्वक दर्शन	झॉकी देखना, झॉकना भावपूर्वक दर्शन	glimpse, faint idea seeing hidngly looking at with admiration
अખુ	झाखु	वि	1. अस्पष्ट, आधु 2. ओछा प्रकाशवाणु, निस्तेज	अस्पष्ट, हलका धुंधला, निस्तेज	indistinct dim, fading
અઝ	झाझ	स्त्री	1. छमलीक, असीजोड 2. गुस्सो, रीस	झॉझ गुस्सा, झल्लाहट	cymbals rage, anger
અઝર	झाझर	न	1. स्त्रीओनु पगनु अेक धरेण, नूपुर 2. (ला) बेडी, ज्जर	झॉझर बेडी, जजीर	anklet fettters, chain
અઝરી	झाझरी	स्त्री	1. पाण्डु अअर 2. धूधरी पाधेली लाकडी 3. नानु अरग	बालक की झॉझर धुंधर बाँधी हुई लकडी छोटा झरना	anklet for child staff with jingling bells small stream
અઝવા	झाझवा	न	1. मृगजल 2. तेजशी डे आसुशी आजने पडती आभय	मृगजल, मृगतृष्णा धुध	mirage dimness of eye owing to glare or tears
અપલી	झापली	स्त्री	नानो अपो (प्रायः वाड डे जेतरनो)	छोटा फाटक, झॉप	wicket gate (in a hedge)
અપો	झापो	पु	1. (शेरी, वाडा वगेरेनो) दरवाजे 2. गामनी भागोज	फाटक गाँव का सिवान	gate, wicket outskirts of a town or village
અચ	झाय	स्त्री	1. प्रतिबिंब, पडछायो 2. आलक, तेज	प्रतिबिंब, परछाईं झलक, तेज	reflection, shadow glimpse, brill ance

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝિપાવવુ	झिपाववु	स क्रि	'अपिपु' नु प्रेरक	'अपिपु' का प्रेरणार्थक रूप	caus of 'अपिपु'
ઝિપાવુ	झिपावु	अ क्रि	'अपिपु' नु कर्मिणि	पकडा जाना	passive of 'अपिपु'
ઝિલાવવુ	झिलाववु	स क्रि	'अलिपु' नु प्रेरक	'अलिपु' का प्रेरणार्थक रूप	caus of 'अलिपु'
ઝિલાવુ	झिलावु	अ क्रि	'अलिपु' नु कर्मिणि	पकडा जाना, हाथ में लिया जाना	passive of 'अलिपु'
ઝીક	झीक	स्त्री	1 કસબી તારનુ ભરત 2 ઝીક, ઝીકવુ તે -પછાડ	सलमे-सितारे का काम टक्कर, मुकाबला	embroidery work in gold and silver act of dashing
ઝીકવુ	झीकवु	स क्रि	1 જોરથી ફેકવુ -પછાડવુ 2 પાડી નાખવુ, હરાવવુ	जोर से फेंकना, उठा कर फेंकना पटकना, हराना	to throw or to dash with force to throw, to defeat
ઝીણવટ	झीणवट	स्त्री	1 બારીકી 2 ચતુરાઈ, ડહાપણ	सूक्ष्मता चतुराई, सयानापन	minuteness, subtlety cleverness, wisdom
ઝીણ	झीणु	वि	1 બારીક, નાનુ (જેમ કે, ઝીણ ડાણ) 2 તીણ, અણીદાર (ઝીણી અણી દ્વારા ઇ) 3 પાતળુ, બારીક (ઝીણ કપડુ) 4 નાજુક, ઝીણવટ ને સભાળની જરૂરવાળુ (જેમ કે, ઝીણ કામ, ઝીણી વાત)	झीना, बारीक, छोटा (उदा छेद आदि) पैना, तीक्ष्ण (उदा नोक आदि) पतला, महीन (उदा कपडा आदि) नाजुक, गहरा, सूक्ष्म (उदा काम, कशीदे का काम आदि)	small (e g hole etc) sharp (e g edge etc) thin, fine (e g fabric etc) delicate (e g work etc)

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
			5 (अवाज्जमा) धीमु ने पातणु, भए, धीमु (जेभ डे, आरु आरु ओलेवु)	महीन, धीमा, तीक्ष्ण (उदा आवाज आदि)	low (e g voice etc)
			6 आरुपटलेर वर्तनार -शम करनार (भारस)	गहराई से काम करने वाला (मनुष्य)	(person) given to subtlety
			7 अलु करुसरियु, कुसु जेवु	बहुत क्लिफायती, कजूस जैसा	stingy
अशोताव	झीणोताव	पु	धीमो पारु थालु आख्या करतो ताव	जीर्णज्वर	slow chronic fever
अपवु	झीपवु	स क्रि	जुओ 'अलेवु'	देखिए 'अलेवु'	see 'अलेवु'
अलेवु	झीलवु	स क्रि	1 पकडी लेवु, अपवु 2 अेक गणनु ओलेवु डे गावु ओज्जथे उपाडी लेवु 3 नाडवु, जलझडा करवी रचना	पकड लेना, झेलना एक का बोलना या गाना दूसरे से दुहराना नहाना, जलक्रीडा करना	to catch pick up a refrain to bathe, to sport in water
अलु	झीलु	न	लटखता सूपडा बाधीने नीथेशी उपर (जेतरमा) पारु चडाववानी अेक रचना	बेंडी	device for lifting water to higher level
अडवु	झीकवु	स क्रि	1 जेरेशी डेडवु, पणडवु 2 पाडी नाजवु, डराववु	देखिए 'अडवु' पटकना, हराना	to dash, to throw forcefully to throw, to defeat
अडाववु	झीकाववु	स क्रि	'अडवु' नु प्रेरक	'अडवु' का प्रेरणार्थक रूप	caus of 'अडवु'
अडावु	झीकावु	अ क्रि	'अडवु' नु उर्भाण	'अडवु' का कर्मणि रूप	passive of 'अडवु'

अंग्रेजी पद	हिंदी पद	अर्थ	क.	उदाहरण	वैयर्थ्य	उदाहरण
bothersome person or thing	निर्युक्त पीडा देने वाला व्यक्ति या वस्तु	निर्युक्त पीडा देने वाला व्यक्ति या वस्तु	न	निर्युक्त पीडा देने वाला व्यक्ति या वस्तु	उदाहरण	उदाहरण
thorny branch to attach (some)	देर लगी शाखा	देर लगी शाखा	स	देर लगी शाखा	उदाहरण	उदाहरण
dishvelled hair on head	झिंझी	झिंझी	न	झिंझी	उदाहरण	उदाहरण
to cause to bend	झिकाना, नवाना	झिकाना, नवाना	स	झिकाना, नवाना	उदाहरण	उदाहरण
to take a plunge	झुकना, झुकना	झुकना, झुकना	स	झुकना, झुकना	उदाहरण	उदाहरण
act of bowing, impersonation	झुकना, झुकना	झुकना, झुकना	अ	झुकना, झुकना	उदाहरण	उदाहरण
wasting away (of) body, weeping	झुकना, झुकना	झुकना, झुकना	स	झुकना, झुकना	उदाहरण	उदाहरण
separation, cause of sorrow	झुकना, झुकना	झुकना, झुकना	स	झुकना, झुकना	उदाहरण	उदाहरण
hanging, kind of pendant	झुकना, झुकना	झुकना, झुकना	स	झुकना, झुकना	उदाहरण	उदाहरण
swinging	झुकना, झुकना	झुकना, झुकना	स	झुकना, झुकना	उदाहरण	उदाहरण
impersonation	झुकना, झुकना	झुकना, झुकना	अ	झुकना, झुकना	उदाहरण	उदाहरण
cause of sorrow	झुकना, झुकना	झुकना, झुकना	स	झुकना, झुकना	उदाहरण	उदाहरण
separation, cause of sorrow	झुकना, झुकना	झुकना, झुकना	स	झुकना, झुकना	उदाहरण	उदाहरण
wasting away (of) body, weeping	झुकना, झुकना	झुकना, झुकना	स	झुकना, झुकना	उदाहरण	उदाहरण
act of bowing, impersonation	झुकना, झुकना	झुकना, झुकना	अ	झुकना, झुकना	उदाहरण	उदाहरण
bothersome person or thing	निर्युक्त पीडा देने वाला व्यक्ति या वस्तु	निर्युक्त पीडा देने वाला व्यक्ति या वस्तु	न	निर्युक्त पीडा देने वाला व्यक्ति या वस्तु	उदाहरण	उदाहरण

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या. को.	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝુડ	झुड	न	જૂથ, ટોળુ	झुड, समूह, टोला	group, crowd
ઝુડો	झुडो	पु	જુઓ 'ઝડો'	देखिए 'ઝડો'	see 'ઝડો'
ઝુડાધારી	झुडाधारी	वि	જુઓ 'ઝડાધારી'	झडाधारी	see 'ઝડાધારી'
ઝુબેશ	झुबेश	स्त्री	જોશપૂર્વકની ચળવળ, ઊલ્લાસ	जोरों का आन्दोलन, जोर-शोर से प्रचार	campaign, agitation
ઝૂકવુ	झुकवु	अ क्रि	નમવુ, લચી પડવુ, લટકવુ	झुकना, नमित होना, लटकना	to bend, to bow, to bend low
ઝૂડવુ	झूडवु	स क्रि	1 ધોકો કે ખૂધા વડે ઠોકવુ 2 ઝાપટવુ, ખખેરવુ	पीटना, ठोकना झकझोरना, झटकारना	to beat with a club to strike, to thrash
ઝૂડિયુ	झूडियु	न	જેનાથી ઝુડાય એવુ સોટુ-બૂધુ	सोंटा, लट्ठ	big club for thrashing
ઝૂડી	झूडी	स्त्री	નાનો ઝૂડો, જૂડી	देखिए 'જૂડી'	see 'જૂડી'
ઝૂડો	झूडो	पु	ઘણી યાજ્ઞોનો સાથે બાધેલો જથ્થો, જૂડો	बहुत सी चीजों का एक साथ बाँधा हुआ जुट, पूला, गट्ठर	bunch
ઝૂમખૂ	झूमखू	न	જુઓ 'ઝૂમખઝૂમખુ'	देखिए 'ઝૂમખઝૂમખુ'	see 'ઝૂમખઝૂમખુ'
ઝૂમખો	झूमखो	पु	જુઓ 'ઝૂમખઝૂમખુ'	देखिए 'ઝૂમખઝૂમખુ'	see 'ઝૂમખઝૂમખુ'
ઝૂમણી	झूमणी	स्त्री	એક જાતનો હાર (એમા વચમા પાઈના આકારનુ ચક્રુ હોય છે)	झुमका, झूमर	kind of neck-lace
ઝૂમણ	झूमणु	न	એક જાતનુ ઘરેણુ	झुमका (जेवर)	kind of ornament

गुजराती शब्द	देवनागरी लिप्यंतरण	व्या को	गुजराती अर्थ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝૂમવું	झूमवु	अ क्रि	1 જુઓ 'ઝૂમવું' 2 લટકવું, ટિગાવું 3 આતુરતાથી ટાપી રહેવું	देखिए 'ઝૂમવું' टँगना, लटकना तरसना	see 'ઝૂમવું' to hang to be suspended to be eager for
ઝૂરવું	झूरवु	अ क्रि	1 —ને માટે તલસવું —કલપાત કરવું 2 કલપાતથી ક્ષીણ થવું	- के लिए तरसना, कल्पना कल्पने से दुर्बल- क्षीण होना, झूरना, झुरना	to pine, long to be reduced through pining
ઝૂલણા	झूलणा	पु	એક છંદ	एक वृत्त	kind of metre
ઝૂલણું	झूलणु	न	1 ઝૂલવું તે, હાંચકો 2 પારણું 3 હાલરડું	झूला पालना, हिडोला लोरी	swing cradle lullaby
ઝૂલતું	झूलतु	वि	ઝોલા ખાતું, લટકતું	झूलता हुआ	swinging, hanging
ઝૂલવું	झूलवु	अ क्रि	1 હાંડોળે કે પારણે હાંચવું 2 લટકવું	झूलना, पेग लेना लटकना	to be rocked in cradle to hang
ઝૂલો	झूलो	पु	1 જેમા ઝૂલી શકાય તે હાંચકો 2 (લા) નુકસાન, ખાધ	झूला, हिडोला नुकसान, घाटा, हानि	swing loss, deficit
ઝૂટ	झूट	स्त्री	ઝૂટવી લેવું તે	भपटना	robbing, seizing
ઝૂટવવું	झूटववु	स क्रि	'ઝૂટવું' નું પ્રેરક	हथियाना, झपटना	caus of 'ઝૂટવું'
ઝૂટવું	झूटवु	स क्रि	ઝડપ મારી ખૂંચવી —પડાવી લેવું	छीन लेना, झपटना	to snatch away
ઝૂટઝૂટા	झूटझूटा	स्त्री	સામસામે ઝૂટ ચલાવવી તે	छीना - झपटी	snatching one another's things
ઝૂટાઝૂટ	झूटाझूट	स्त्री	જુઓ 'ઝૂટઝૂટા'	देखिए 'ઝૂટઝૂટા'	see 'ઝૂટઝૂટા'

ગુજરાતી શબ્દ	દેવનાગરી લિપ્યંતરણ	વ્યા કો	ગુજરાતી અર્થ	હિંદી પર્યાય	અંગ્રેજી પર્યાય
ઝૂટાવવું	ઝૂટાવવું	સ ક્રિ	'ઝૂટવું' નું પ્રેરક	હથિયાના, ઝપટના	caus of 'ઝૂટવું'
ઝૂટાવું	ઝૂટાવું	અ ક્રિ	'ઝૂટવું' નું કર્મણી	છીના જાના, ઝપટા જાના	to be snatched
ઝૂપડી	ઝૂપડી	સ્ત્રી	ઘાસ, સાઠી, છાજ વગેરેથી બનાવેલું છાપરું -ઘર	ઝોંપડી	hut
ઝૂપડું	ઝૂપડું	ન	ઘાસ, સાઠી, છાજ વગેરેથી બનાવેલું છાપરું -ઘર	ઝોંપડી	hut
ઝૂસરી	ઝૂસરી	સ્ત્રી	ધૂસરી, ધુરા	જુઆ (ગાડી આદિ કા)	yoke
ઝૂસરું	ઝૂસરું	ન	ધુરા, ધૂસરું	જુઆ (ગાડી આદિ કા)	yoke
ઝેર	ઝેર	ન	1 વિષ 2 ઈર્ષ્યા 3 વેર	જહર, વિષ ઈર્ષ્યા બૈર	poison jealousy, envy vengeance
ઝેરકચૂરો	ઝેરકચૂરો	પુ	એક કડવું બી-ઓષધિ	કુચલા	kind of bitter medicinal seed
ઝેરકચૂલો	ઝેરકચૂલો	પુ	જુઓ 'ઝેરકચૂરો'	દેખિય 'ઝેરકચૂરો'	see 'ઝેરકચૂરો'
ઝેરકચોલું	ઝેરકચોલું	ન	જુઓ 'ઝેરકચૂરો'	દેખિય 'ઝેરકચૂરો'	see 'ઝેરકચૂરો'
ઝેરકોચલું	ઝેરકોચલું	ન	જુઓ 'ઝેરકચૂરો'	'દેખિય 'ઝેરકચૂરો'	see 'ઝેરકચૂરો'
ઝેરી	ઝેરી	વિ	1 ઝેર-વિષવાળું 2 અદેખું, અટસ રાખે એવું	જહરીલા, વિષાકત ઈર્ષ્યાલું	poisonous jealous, envi- ous, spiteful
ઝેરીલું	ઝેરીલું	વિ	જુઓ 'ઝેરી'	દેખિય 'ઝેરી'	see 'ઝેરી'
ઝોક	ઝોક	પુ, સ્ત્રી	વાક, વલણ, ઝૂકવાપણું	ઝુકાવ, ઝુકને કા ભાવ	curve, bend, inclination
ઝોકું	ઝોકું	ન	ઊઘ કે ઘેનનું ડોલું	ઝપકી, પીનક, ઝઘ	dozing nod

ગુજરાતી શબ્દ	દેવનાગરી लिप्यंतरण	વ્યા. કો.	ગુજરાતી અર્થ	हिंदी पर्याय	अंग्रेजी पर्याय
ઝોટ	झोट	સ્ત્રી	જુવાન બેસ	जवान भैस, ओसर	young she- buffalo
ઝોટડુ	झोटडु	ન	જુઓ 'ઝોટ'	देखिए 'ओट'	see 'ओट'
ઝોટુ	झोटु	ન	જુઓ 'ઝોટ'	देखिए 'ओट'	see 'ओट'
ઝોડ	झोड	ન	ઝૂડ, વળગણ	भूत, प्रेत	possession (by evil spirit), evil spirit
ઝોબાવુ	झोबावु	અ ક્રિ	જોબો આવવો, મરણઘાટીમા સપડાવુ	देखिए 'जोबावु'	see 'जोबावु'
ઝોબો	झोबो	પુ	જોબો, મરણઘાટી, તમ્મર, છવ ડાંડો ઊતરી જવો-બેભાન થઈ જવુ	देखिए 'जोबो'	see 'जोबो'
ઝોલ	झोल	સ્ત્રી	ઢીલાશને લીધે તારનુ વચ્ચેથી ઝૂલી જવુ તે	झोल	sinking, sag
ઝોલુ	झोलु	ન	1 ઝૂડ, ટોળુ 2 ઝોકુ, ડોકુ	झुड, टोली झपकी	mob, crowd, herd nod, doze
ઝોલો	झोलो	પુ	1 ઝૂલો, ઢિડોળો 2 હેલો, હાંચકાનો એક ઝોક 3 ઝોલ	झूला, हिडोला पेंग झोल	swing one form of swing sinking, sag
ઝોળ	झोळ	સ્ત્રી	ઝાળ, જ્વાલા	ज्वाला, शोला, आग की लपट	flame
		ન	ઝોડ, વળગણ	भूत, प्रेत	evil spirit
ઝોળી	झोली		1. કપડાના ચાર છેડા પરથી પકડીને ઝૂલતુ પત્રાકાર કરાય છે તે, ઉદા શાકની, સાધુની ઝોળી	झोली (साधु की)	bag, wallet

